

પૂજયપાદ શાસતરમાટ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસ્કૃતીથરણ  
સદગુરભ્યો નમઃ

પંડિત શ્રીરાવિજયળકૃત

# પૃથ્વીચંદ્ર અને ગુરુસાગર અથવા

એકવીશ ભવનો સ્નેહ સંબંધ

---

લેખક:

મણુલાલ ન્યાયચંદ્ર શાહ.

પ્રકાશક:

મહેતા નાગરદાસ પ્રાગળભાઈ

ડ. ડાશાવાડાની પોળ-અમદાવાદ.

વીર સંવત ૨૪૬૭ આવૃત્તિ પહેલી-૧૦૦૦ વિકલ્પ સંવત ૧૯૬૭

---

મુદ્રક: હીરાલાલ દેવચંદ્ર શાહ, શારદા મુદ્રણુલય, પાનકોર નાકા  
ગુરુમામરણ સામે, અમદાવાદ.

---

અન્ય સ્વામિત્વના તમામ હક્ક પ્રકાશકને સ્વાධીન છે.

ત્રણ રૂપિયા

## અનુક્રમણીકા

પરિચેદ નંબર	ભવનંધર	વિષય
પરિચેદ ૧ દો	ભવ પહેલો. શાખરાજ અને કલાવતી રાણી.	
,,	ભવ બીજો. દેવ ભવમાં - સૌધર્માકલ્પે દેવદેવી.	
પરિચેદ ૨ જો	ભવ ત્રીજો. કભલસેન રાજ અને ગુણુસેના રાણી.	
,,	ભવ ચોથો. પાંચમો. દેવદોકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૩ જો	ભવ પાંચમો. દેવસિંહ રાજ અને કનક સુંદરીરાણી.	
,,	ભવ ૬ હું. મહા શુક દેવદોકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૪ થો	ભવ સાતમો. દેવરથ રાજ અને રતનાવલીરાણી.	
,,	ભવ આંદોમો. આનત દેવદોકે મિત્ર થયા.	
પરિચેદ ૫ મો	ભવ નવમો. પૂર્ણાંદ્રસાજ અને પુણ્ય સુંદરી રાણી	
,,	ભવ દશમો. આરણ દેવદોકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૬ મો	ભવ અગીયારમો. શરૂસેન રાજ અને મુક્તાવલીરાણી.	
,,	ભવ બારમો. પ્રથમ ગ્રૈવેયકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૭ મો	ભવ તેરમો. પદ્મોત્તર રાજ અને હરિવેગ વિદ્વાધરેંદ્ર થયા.	
,,	ભવ ચૌદમો. ભંધ્યમ ગ્રૈવેયકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૮ મો	ભવ પંદ્રમો. ગિરિસુંદર રાજ અને રતનસાર યુવરાજ ભાઈ થયા.	
,,	ભવ સોણમો. નવમા ગ્રૈવેયકે મિત્ર દેવ થયા.	
પરિચેદ ૯ મો	ભવ સતતરમો. કનકસુંદર રાજ અને જયસુંદર યુવરાજ ભાઈ થયા.	
,,	ભવ અઠારમો. વિજય વિમાને દેવ થયા.	
પરિચેદ ૧૦ મો	ભવ ઓંગણીસમો. કુસુમાયુધરાજ અને કુસુમકેંઠ પિતાપુત્ર થયા.	
,,	ભવ વીસમો. સર્વીર્થ સિદ્ધ મહાવિમાનમાં દેવથયા.	
પરિચેદ ૧૧ મો	ભવ એકનીશમો. પૃથ્વીયંદ્ર રાજ અને ગુણુસાગર શ્રેષ્ઠ થયા.	

## આભાર દશોન

### શ્રી રૂપવિજયલુ ગણિવર

પંચમ ગણુધર સુધર્માસ્તવામી પછી ચરમ કેવલી જાણુસ્તવામી તેમની પાટે આવ્યા. કેટલાય ખુગ પ્રધાન અને સૂરીધરોએ એ પાઠને શોભાવી. અહુકેમે પટ મી પાટ શ્રીહૃત્વિજયસૂરીધરલુ થયા. તેમની પછી વિજયસેન સૂરીધરલુ થયા, તેમની પાટ વિજયહેવસ્તુરિલુ થયા. તેમની પછી દુ મી પાટ શ્રી વિજયસિંહસ્તુરિલુ થયા. કહેવાય છે કે તેમને બાવન શિષ્યો હતા તેમાંથી સતર શિષ્યો તો ભારતીનું વરહાન પામેલા એવા વાદ વિવાહમાં નિપૂષ્ટ હતા.

એ અધાય શિષ્યોમાં શ્રીમાન સત્યવિજયલુ આદ અને મુખ્ય હતા. ઓછ વર્ષની ઉંમરમાં એમની દીક્ષા વિજયસિંહસ્તુરિના હસ્તે થઈ હતી. અવાંતરનો ક્ષયોપશમ સારો હોવાથી લાણી ગણી વિક્રાનોને પણ માત્રવા ચોઅ થયા.

એ સમયે યતિએનો શિથિલાચાર વૃદ્ધિ પામતો હોવાથી ગુરુભ્યાજ્ઞા મેળવી એમણે (સત્ય વિજયલુએ) કહ્યા ઉક્ખાર કર્યો. શ્રી વિજયપ્રભુસ્તુરિએ સંવત ૧૭૨૮ માં સોજતમાં એમને પંન્યાસ પદ આપ્યું. છુટુ અહુમની તપસ્યા કરનારા એ મહામુનિએ ખુખ્ય સહન કરીને પણ શુદ્ધ માર્ગ પ્રવર્તાવ્યો.

સંવત ૧૭૫૬ ના પોષ સુદી ૧૨ ના રૈબે પંન્યાસલુ કાલ ધર્મ પામ્યા ને એમની પાટ શ્રીમાન કર્મશ્વરવિજયલુ

थयા, તેઓ પાઠણવાડાના રહીશ હતા. તેમણે પણ ચૌદ  
વર્ષની વયે સંવત ૧૭૨૩ માં દીક્ષા લીધેલી ને તે પછી  
સં. ૧૭૭૫ માં સ્વર્ગ ગયા. તેમની પાટે ક્ષમાવિજયળ થયા  
તેમની પછી લુનવિજયળ, તેમની પછી ઉત્તમવિજયળ ને  
તેમની પછી શ્રીમાન પદ્મવિજયળ થયા.

પંડિતશ્રી પદ્મવિજયળ અમદાવાદના રહીશ હતા.  
સં. ૧૭૯૨ માં જન્મ ધારણ કરી સં. ૧૮૦૫ માં દીક્ષા  
લીધી. સં. ૧૮૧૦ માં વિજયધર્મસૂરિલાએ રાખનપુરમાં  
તેમને પંડિતપદ આપેલું હતું. તે ૧૮૬૨ માં સ્વર્ગ ગયા.

એમના શિષ્ય શ્રીમાન ઇયવિજયળ ગર્ણિવર થયા.  
એમના લુધન સંખ્યાંથી ખાસ હકીકત જાણવામાં નથી  
હતાં તેઓ વિકાનોને માનવા ચોણ્ય, કિયાપાત્ર, તપસ્વી  
તેમજ જૈન શાસનના આભૂષણિય હતા. એમની અનેક  
કૃતિઓ—પૂજાઓ વગેરે જોવાય છે તેઓશ્રી આ પૃથ્વી-  
ચંદ્ર ગુણસાગર કાવ્યના રચયિતા છે. પૂર્વાચાર્ય રચેલું  
તેનો ઉદ્ઘાર કરી આધુનિક અલ્પભુદ્ધિવાળા લુંબોને ઇય-  
શાળી થાય તેવું સરળ ગાથ તેમજ પદ્મલાધામાં અનાવી  
સંવત ૧૮૮૨ ની સાલમાં તેમણે અમદાવાદમાં—રાજનગરમાં  
પૂર્ણ કર્યું.

તપગચ્છથી પાટ પરંપરાએ શ્રી વિજયળનેંડ્રસૂરિલાની  
પાટે નવીન—ખાળ સૂર્ય જેવા વિજય હિનેંડ્રસૂરિલાના સમ-  
યમાં સંવત ૧૮૮૨ ના શ્રાવણ સુહી પંચમીના દિવસે તેમણે  
રાજનગરમાં આ અંથની પૂર્ણતા કરી—સંપૂર્ણ કર્યો ન  
સં. ૧૯૦૫માં પોતે ( શ્રી ઇયવિજયળ ) સ્વર્ગ ગયા.

દેખક

અક્ષય તૃતીયા ૧૯૬૭	માણુલાલ નાલચંદ શાહ
દહેગામ.	

## નિવેદન

જૈન સાહિત્યનું સર્જન એવા પ્રકારનું હોવું જોઈએ કે જૈના મનનપૂર્વક વાંચનથી વાંચનાર ઉપર એ વસ્તુ-તત્ત્વની છાયા પડે, તેમજ વાંચનારે એક વખત વાંચવું શરૂ કર્યું કે એના રસની જમાવટમાં આકર્ષણિલા એને પૂર્ણ કરવાની તલ્લિનતા રહે. સાહિત્યની વસ્તુમાં અનેક પ્રકારની ભાવનાઓ હોય છે. તેમાંય વસ્તુતાઃ જૈન સાહિત્યની ભાવના તો એવા પ્રકારની જ હોય છે કે તેથી વાંચકનું ધર્મ ભાવના અવશ્ય પોષાય છે. એ સાહિત્યની અસરથી વાંચકનું મન અનેક પ્રકારના પદ્ધતા લે છે એના ઝૂદ્ધયના આંદોલનોમાં તે અનેક તોડ્ઝાન જગાવે છે.

આજના જડવાહના જમાનામાં ચુવકોની ભાવના સંસારના અનેક આકર્ષણીયામાં લોલાઈ સંકુચિત થઈ જાય છે એ બાદ્ય આકર્ષણીયામાં જ જીવનનું સર્વસ્વ માની તાંથી આગળ વધતાં એના કદમ અદ્દી જાય છે. પછી તો આ ભાવના રંગરાગમાં મુંઝાધ પરલબના હિત માટે કંઈક કરવાની ભાવના મૃતપ્રાય થઈ જાય છે. કારણુંકે આ ભવ મીઠા તો પરલબ કોણે દીઠા !

આજના ચુવકોની આવી સંકુચિત ભાવનામાં તોડ્ઝાન જગાવવા માટે આવા જૈન સાહિત્યની પ્રસિદ્ધિની ખુલ્લ ખુલ્લ અત્યારે જરૂર છે, એમ અમે માનીએ છીએ, આજના ચુગમાં સાહિત્ય તો અનેક પ્રગટ થાય છે ને એવા સાહિત્યને ઉત્તેજનારાઓનીય આજે કંધ ખામી નથી. જૈન સાહિત્યના નામ હેઠળ પણ આજે એવાં સાહિત્ય પ્રગટ

થાય છે કે જે પ્રગટ રીતે જૈન સિદ્ધાંતને કલાંક સમાન છે. આજનાં સાહિત્ય સર્જન જે જૈનસિદ્ધાંતને માન્ય ન હોય તો એવા સાહિત્યની રચના પાણળ અલેને આજનો જ્ઞાન પૂર્ણ પાથરે પણ એ કંઈ સાહિત્ય સેવા ન કરેલાય. આજના અપ્રાભાષિક સાહિત્ય સમાજને જાણે આત્મતત્ત્વ ભૂલાવી જડવાદમાં જ સુઅવી દીઘેલ હોય અને એમની એ સંકુચિત જડભાવનાને જ ઉત્તેજતો હોય એવાં સાહિત્યને જૈન સિદ્ધાંત કહ્યા અપનાવી શકે નાઃ.

જૈનસિદ્ધાંત આજના એજ સાહિત્યને અપનાવી શકે કે જે સાહિત્ય આજના ચુંચકની ભતોલુભિમાં એની જડ ભાવના સામે તોકાન જગાવે, જુગજુગ પર્યાતકી જમેદી એની એ સાંસારીક ભાવનાને હુચમચાવી નથીન વિચારશેણી જગાવે ને આજ પર્યાતનો એનો સાંસારકસુ પરિવર્તનપણાને પામે, વસ્તુતત્ત્વની એણાખાણ કરાવે, સાચો રાહ ઘતાવી એની ભૂલાનું ભાન કરાવે, ધર્મની દિશા સુઝડે.

આધુનિક પંડિત શ્રીરઘવિજ્ય મહારાજે રચેલું આ કથાનક જે કે ખુખ્ય પ્રાચીન છે, કંઈ જુગનાજુગ પહેલાંતું આ કથાનક નથી છતાંય આજના જુગને અતુકૂળ થાય તેવી રીતે પંડિતશ્રીએ આદેખેલું છે જે ખચિત પત્થરે સમાન કલેજનાળાને પણ હુચમચાવનાર્દ છે ગમે તેવા છિંસક કે પાણીના હૃદયમાં પણ એક વખત લો જડર અરે-રાદી જગાવનાર્દ છે.

શાખરાળ અને કલાવતીરાણીના લખથી આ ચરિત્ર કર્તાને શારીર કર્યું છે તે પછી ઉત્તરોત્તર એકલીશાસ લવમાં ખૂલ્ખીન્દ્ર અને ગુણસાગરને ગુહસ્થપણામાં જ કેવલજ્ઞાત

ઉમ્મત થાય છે. ત્યાં લગ્ની ભાવોભલ એમનું ચારિનારાધન એમના મનના ઉચ્ચ વિચારો ખાબનાઓ ક્રમે કરી ડેવી શુદ્ધ થતી જાય છે, સંસારમાં રહ્યા છ્ટાં મણું એમની મળેલદશા ડેવી નિલેંપણે વર્તે છે કે કેથી રોજ્યસુખ જોગયતાં જ્ઞાનમાં પણ એમાં આસક્તિ થતી નથી અહેકે સમય આખતાં તૃણની માર્ગક તેને તળ હે છે ને એકવી-શામા લવમાં તો એમની ભાવના છેલ્લી પરાકાષ્ઠાએ પહેંંચી જાય છે કે જેનાથી તેમને કૈવલ્યદશા પ્રગટે છે.

આ ચરિત્રની અંદર વૈરાઘ્યથી ભરેલી રેસથી પરિ-પૂર્ણતાવાળી અનેક અવાંતર કથાઓ આવે છે કે ધાંચ-નારે નરી એકાંતે હિત કરનારી જ હોય છે દુંકમાં આ નવીન સાહિત્ય જરૂર આજના જમાનામાં ખુલ્લજ ઉપ-યોગી થધ પડશે. વિકભયરિત જ્યારે અખાંડિત રસધારાને જળવી રાખે છે ત્યારે આ પુરુષના હૃદયમાં વૈરાઘ્યભાવ-નાને જન્માવે છે. મુક્તિનો સાચો રાહ થતાવે છે.

પાંડિતશ્રી ઇપવિજયજીએ આ અંથ રચીને આજના સમાજ ઉપર ખુલ્લ ખુલ્લ ઉપકાર કરેલો છે આવો અણુ-મોલ અંથ પ્રગટ કરી પ્રકાશન કરવાનું મહોભારત કામ કંઈ જેવું તેવું નથી. તેથી જ પ્રકાશક શ્રીનાગરહાસસાહિતી આ સાહિત્ય સેવાનાં મૂલ્ય તો અણુમોલ છે.

સિદ્ધાન્તની દિલ્લી રચાયેલું આ કથાનક જો કૈન સમાજ અપનાવે તો જ લેખક અને પ્રકાશકનો પ્રયાસ સ્તુત્ય ગણ્યાય. પ્રકાશકની સાહિત્ય સેવાને ઉતોજન મળે, ને આવાં કંઈ નવીન સાહિત્ય પણ પ્રગટ થધ શકે!

પાંડિતજી ઇપવિજયજી ગણ્યિવરના આ ચરિત્રનું માત્ર અમે તો તેમની ભાવના સાચવી રાખી ભાવાંતર કર્યું

છે. નવલકથાના સ્વરૂપમાં વાંચુકનો રસ જળવાઈ રહે તેવી રીતે આણેખવા પ્રયત્ન કર્યો છે, ભતિકલ્પના કે કાલ્પનિક વસ્તુની મેળવણી કરી અમે અમારું ડાખાપણું ચલાવ્યું નથી. પુરુતક મોડું થવાના ભયથી અમે વિશેષ વર્ષન કર્યું નથી. તો જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માડુક દોષ બેવાની દથિ ન રાખે એજ વિનંતિ.

સંવત ૧૯૬૭	}	દૈખક
અક્ષય તૃતીયા		શાહ મણીલાલ ન્યાલચંદ

દર્ઢેગામ



ॐ ह्रीः श्रीं पार्थिनाथाय नमः

## પૂર્વીચંદ્ર અને ગુણસાગર

યાને

## એકવીશ ભવનો સ્નેહસંબંધ

પરિચ્છેદ ૧ લો.

શાખ અને કલાવતી.

સच્ચિદાનંદસંપૂર્ણ, સર્વજ્ઞ વિશ્વપાવકં ।  
સંખેશરપુરોત્તમં, પાર્થિનાથં નમામ્યહમ् ॥૧॥

ભાવાર્થ—સંપૂર્ણ દર્શન જ્ઞાન અને આત્મ આનંદથી અરેલા, સર્વજ્ઞ, વિશ્વને પાવન કરનારા, અને શ્રીસંભેદ્યર પુરના ભૂપણુર્પ પુરિસાહાની એવા શ્રી પાર્થિનાથને નમસ્કાર કરેં છું.

“જય ! જય ! મહારાજ શાખરાજનો જય થાએઓ,  
શાખપુર નરેશ્વર આપ મહારાજ વિજય પામો, આપનું  
રાજ અવિચળ તપો, સુખ, સૌભાગ્ય અને રાજકુદ્રિયે  
આપ વૃદ્ધિ પામો, ખળ, બુદ્ધિ, કળા, કૌશલ્ય હિનું

પ્રતિદન આપનાં વિસ્તાર પામેના. ”પ્રતિહારી રાજસભામાં શાંખરાજની બિદ્ધાવલી બોલતો પોતાનું મસ્તક નમાવી શાંખરાજની આજાની રાહ જોતો ઉલો રહ્યો.

”કેમ શું અરજ કરવાની છે ?” રાજએ કારપાલને પૂછ્યું.

”મહારાજ ! ગજશ્રેષ્ઠનો કુમાર હતું આપના દર્શાન કરવાને આવેલા છે. આપની શી આજા છે ?” પ્રતિહારીએ અરજ ગુજરી.

”આવવા હે.” રાજએ આજા આપી.

દક્ષિણાર્ધ ભરતના મધ્યઅંમાં શ્રીમંગલ નામે દેશને વિષે શાંખપુર નગર આવેલું છે. એ શાંખપુર નગરના ચુવરાજ શાંખકુમારનો રાજ્યાલિષેક થયા પણી વચ્ચમાં કેટલોક સમય પસાર થઈ ગયો, ગુણવાન, કાંતિમાન, બળવાન અને ખુદ્ધિમાન શાંખરાજને ચુવાનીનો મદ છતાં અહુંકાર નથી. બળવાન છતાં જે હુજુનો થકી સજજનોનું રક્ષણ કરવામાં પોતાના બળનો ઉપયોગ કરે છે, નવીન ચૌધન અને નવીન અસ્થુદ્ધયવાળો છતાં જે પરસમાણીઓથી પરાસ્થુખ છે એવો શાંખરાજ એ હું દ્વારા સભા ભરીને એડો છે તેની આગળ પ્રતિહારી રાજની આભાનિં ગુણગાન કરતો હાથ જોડી સ્તવના કરે છે ત્યાંથી આ વાર્તા આગળ વધે છે.

પ્રતિહારીના આદેશ પામી હરખાતે હૈયે ને ઉલ્લરાતે હૃદ્યે હતશેડ રાજની સભામાં પ્રવેશ કરતો શાંખરાજની સન્મુખ અસુલ્ય લેટથું સુકી એ હાથ જોડી ઉલો રહ્યો. નાના હતશેડના હૃદ્યમાં આજે હરખ સમાતો નહોંતો. એની આંખો અમૃતના જણે મેહ વરસાવતી હોય, પોતાના અંગઠાતા રાજનું હિત કરવાની જ જેનામાં તમજા રહેલી

હોય, એક નિષાથી જેના હૃદયમાં રંગ ભરાયો હોય, એવા રાજ્યભક્ત આ નાના શોઠના હૃદયમાં અત્યારે કરી વિચારશેણિ રમી રહી હશે એ તો જ્ઞાની જણે.

“મહારાજ શાંખ નરેશ્વર ! આપ કુશળ તો છો ને ? આપની અમર કીર્તિ દેશપરદેશમાં પણ મેં સાંભળી છે. આપનાં યશોગાન પરદેશમાં પણ કોણું નથી ગાતું ? આપનું રાજ તેજ અમર તપો, અવિચણ રહો.” હતે કુશળતા પૂછી.

“આહો ! દાટકુમાર ! આજે અહુ દ્વિસે કાંઈ !” આજે ઘણે દ્વિસે રાજસભામાં આવેલા દાટશોઠને જોઈ નવાધ પામેલો શાંખરાજ ઘોલ્યો.

“હો ! મહારાજ ! ઘણે દ્વિસે તો ખરો ! કારણું હું પરદેશ ગયો હતો ત્યાંથી હણ તો ગઈ કાલે જ આપના નગરમાં આવ્યો, આજે આપની સેવામાં હાજર થયો.”

“પરદેશ ગયો હતો, શા માટે પરદેશ ગયો હતો, શું પિતાથી રિસાધને પરદેશ ગયો હતો કે થીજા કોઈ કારણું પરદેશ ગયો હતો ?”

રાજેન્દ્ર ! પરદેશ ગયો હતો તે પિતાથી રિસાધને નહીં પણ ધન કમાવા માટે ગયો હતો.” દાટશોઠ રાજના મનતું સમાધાન કર્યું. પણ દાટની વાણી સાંભળી શાંખરાજ આશ્વર્ય પામ્યા. એમતું મન દાટની વાણી સાંભળવા છતાં હામાડાલ થયું.

“વન કમાવા ? તારે ધેર શું ધનની આમી હતી તે તારે ધન કમાવા પરદેશ જવાની જરૂર પડી ? કે ધનલોલી તારા પિતાના આદેશથી તારે ધન માટે પરદેશ જવાની જરૂર પડી ?” રાજની વાત સાંભળી દાટશોઠ રાજતું મન મનાવા માંડયું.

“જોકે ધન કમાવા પરદેશ જવું એ વ્યવહારિક કરજ છે છતાંય લાગ્યવશાત્ કદાચ ધરમાં પુષ્કળ ધન હોય તો શું? વળી પરદેશ જવામાં તો અનેક કાયદા છે મહારાજ !”

“તમે વાણીયા-વણીક મહાજન ઘોલવામાં બંધાયો તો નહિજ! હુશે જવાને એ વાત. તારા પિતા ગજશ્રેષ્ઠ વગેરે તારે કુદુંખ મજામાં તો છે ને ?”

“ભાષુ ! આપના પસારે બધુ કુદુંખ સુખ શાંતિમાં છે. આપના રાજ્યમાં અમને અશાંતિ ક્યાંથી હોય !”

“નગરના વ્યવહારી જનોમાં ગજશ્રેષ્ઠ મોદા શાહુકાર અને રાજ્યમાન્ય છે, ભાષુ ! સામા માણસનું મન જોઈ અને અનુકૂળ પ્રતિકૂળ વાત કરવામાં ગજશ્રેષ્ઠ બૂહુસ્પતિ સરખા છે. સારા નગરમાં એ પ્રતિષ્ઠિત છે, હતશ્રેષ્ઠ પણ અમના જ પુત્રને ?” સુમતિ મંત્રીએ રાજને ઉદેશીને કહ્યું.

“તમારે કથન બરાબર છે મંત્રીશર ! શૂરવીરતા જેમ ક્ષત્રીય કુળમાં પરંપરાએ ચાલી આવે છે તેવી રીતે વાઇપુટતા વણીક કુળમાં, તેઓ બધુ દીર્ઘ દશ હોય છે. ધનાધ્યમાં અંગેસર છતાં હતશ્રેષ્ઠ ધન કમાવા પરદેશ જાય છે અને પુષ્કળ ધન કમાવી લાવે છે, કેમ ખર? કુષેરભાડારીની સ્પર્ધા કરવી છે શું ?”

“અરે ! કુષેરભાડારીની સ્પર્ધા કરે એવા છતાંય આપાઢી મેઘના જેવા તેઓ ગંભિર પણ છે અમના ભાડારો ભરપૂર છતાં એમના પેણું પાણીય હાલતું નથી. ધન જરૂરવાની તકાત તેમની અજબ છે, મહારાજ !” સુમતિ મંત્રીએ કહ્યું.

“હેવ ! પિતાની લક્ષ્મી હોવા છતાં ખુદ્ધિમાન પુત્ર પરદેશગમન કરી વ્યાપાર વડે પોતાનું ભાગ્ય અજમાવે

છે. પરદેશગમન કરવાથી અનેક પ્રકારની ભાષાઓ સમજાય છે. અનેક માણુસોનો સમાગમ થાય છે. ચતુરાઈ આવે છે. નવીન કળાઓનો અળ્યાસ થાય છે. માતાપિતાની છાયામાં રહી પિતાની લક્ષ્મીનો લોગ કરનારા તેમજ લક્ષ્મી ઉપાજન કરવાની વિધાને નહીં જાણુનારા કુળદીખેડો કુવાના દેહકાની માર્ક સારાસારને કંઈ જાણતા નથી.”

“ત્યારે તો તું પણ હવે તારા પિતા જેવો હેંશીયાર થયોને ? દેશાવરથી કયારે આવ્યો ? કંઈ ધન કમાવી લાવ્યો કે ખાલી આવ્યો ?”

“હેવ ! આપના પુણ્યપસાયથી હજુ ગંધીકાલે જ આવ્યો છું. મારા ભાગ્ય અનુસારે ધન પણ લાવ્યો છું”.

“કુમાર ! તું પણ પરદેશ જઈને હેંશીયાર તો થયો છે. દેશાવરમાં તેં ક્યાં ક્યાં મુસાફરી કરી. ? તને શું શું અનુભવ થયો ? કંઈક નવીન આશ્ર્ય જેણું હોય તો કહો.”

“નરેન્દ્ર ! અનેક ડરીયાણુની પોઢીયો. ભરીને સાર્થની સાથે ઘણ્ણાં ગામ, નગર અને શહેરોને જેતો ને વ્યાપાર કરતો હું હેવશાલપુર નગરે ગયો. ત્યાં કાયમ રહીને વ્યાપાર કરવા લાગ્યો, પુષ્કળ ધન મેળવી ગંધીકાલે જ હજુ આવ્યો છું.” દાટકુમારે પોતાની મુસાફરીને લગતી હકીકત રાજને કહી સંભળાવી. અને વસ્ત્રના અંતર્ફર્યમાં છુપાવેલું એક ચિત્રપટ બહાર કાઢી રાજના હાથમાં આપ્યું. રાજની નજર ચિત્રપટ જોતાં જ એક ધ્યાન થઈ ગય.

“આહ ! આ કઈ હેવીનું ચિત્ર હુલો ? શું પાતાલ કન્યા કે હેવાંગના ? શું વિધાધર કન્યા કે નાગકન્યા ? શું અનાં નેત્ર ! શું એનું વહન ! શી એની સુંદરતા ! શું મીઠકતા ! અગોપાંગ પણ અદ્ભુત જ !” આ મનોહર ચિત્રમાં રહેલી બાળાના સૌંદર્યને અતૃપ્ત નથેને નિહાળતો

રાજ મનમાં અનેક પ્રકારના વિચાર કરતો ઓદ્યો।” દાત ! આ કંઈ હેવીની છણી છે ? કોઈ ચાલાક-ચતુર ચિત્રકારે આને આલેખી છે ખર્દ ?”

“હેવ ! આ કંઈ હેવીની છણી નથી પણ મનુષ્ય છે ?” દાતનો જવાબ સાંલળી રાજ તાજુથ થયો.

“શું આ મનુષ્ય કન્યા છે ? મનુષ્યમાં તે આવું અથાગ રૂપ સંલવી શકે ? હેવ કે વિધાધરેમાં જ એ સંલવી શકે.”

“હેવ કે વિધાધર તો શું પણ મનુષ્યોમાંથી એ રૂપ-રૂપ સંલવી શકે”.

“એમ ! તો કહે આ ભાગા કોણ છે ?”

“આ ભાગા મારી લગિની છે”.

“તારી લગિની ? વણિક કન્યા ?”

“ના, રાજકન્યા.”

“રાજકન્યા ? તો પછી આ ભાગા તારી લગિની શી રીતે છોધ શકે ? શાખરાજએ એ લેદ ભાષુવા માટે દાતકુમારને પ્રશ્ન કર્યો. રાજ આ ભરતાર્થના અધ્યાત્મમાં આવેલા શાખપુરનગરનો શાખરાજ હતો, પિતાનું રોજ્ય મલે હજુ અધિક સેમય થયો નથી. એવો નવીન યૌવનવાળો, મેદા લાગ્યવાળો ને સૌલાઘ્યનો નિધાન શાખરાજન્યાયથી પ્રબળનું પાલન કરતો હતો. શઠ અને હુજીનોને શિક્ષા કરી સક્રાન્તોનું સંભાન્ત કરતો હતો. પ્રેભાપાલક અને ન્યાયપરાયણ હોવાથી લોકોની લક્ષ્ણ રાજ ઉપર ખૂબ હતી.

શાખરાજના પ્રશ્નના ઉત્તરમાં દાતકુમાર ઓદ્યો.

“હેવ ! આ રાજભાગા મારી ધર્મલભિની શી રીતે તે આપ સાંલળો. પિતાની આજા મેળવીને ધન કમાવતું તેમજ દેશાધન કરવા હું એક મેદા સાર્થની સાચે.

નિકળ્યો. એક એક નવીન શહેરને જોતાં અમે દેવશાલા દેશની લગભગ પહોંચ્યો ગયા. થાઉસ્વાર થયેલો હું અમારા સાર્થની આગળ ચાલતો ને માર્ગનું શોધતું કરતો હતો. એક સમયે સાર્થની આગળ ચાલતા મેં દૂરથી એક થાઉસ્વારને જમીન ઉપર પડેલો જોયો, કંઈક સાંઅમથી હું તેની પાસે આવ્યો. તો એક નવજવાન સ્વરૂપવાન અસ્વાર માર્ગમાં મૃત્યુને લેટવાને તૈયારી કરતો મુચ્છિત સિથિતિમાં પડેલો જોયો, એનો અથ નાણકમાં ભરણ પામેલો પડેલો હતો, તરતજ અથ ઉપરથી ઉત્તરી હું એ નવજવાન પાસે ગયો કંઈક વ્યારા. જેવું જણ્ણાતાં મેં જલસિયન કર્યું, થીજુ સારવાર કરી. મારી શુદ્ધપાથી નવચેતન પામેલો એ જવાન જ્ઞાનમાં આવ્યો—સાવધ થયો, સાવધાન થધ એઠા થયો, મેં એ સું પુરૂષને પૂછ્યું હે. સુંદર ! તમે કોણ છો ? આવા કષ્ટને તમે શી રીતે પામ્યા ?”

“હે પરોપકારી ! હું દેવશાલાયુર નગરથી ચ્યા અથ ઉપર આડદ થધતે નિકળ્યો હતો, પણ વિપરીત શિક્ષા પામેલો અથ મને લધને દૂર નિકળી જોયો. આખરે હું અને અથ બન્ને શ્રમિત થધ ગયા. પરિણામે ચા અથ પડીને મરી ગયો હું મરવાની તૈયારીમાં હતો પણ હે આત ! તે મને નવજવન આપી તારો ધર્મ અભિવ્યા.”

“અમે પણ દેવશાલાયુર તરફ જાઈએ છીએ, તેથી તમારો ને અમારો માર્ગ એક હોવાબી આપણે સાથે જાધશું મિત્ર ! તમે મોટા ભાગ્યવાળા જણ્ણાએ છો. જરા ખાનપાંન કરીને સ્વર્ણ થાઓ પછી આપણે આગળ વધીયે.”

સાર્થ પણ પછવાટેથી આવી પહોંચ્યો. મેં તરતજ શિતલજલનું પાન કરાવી મોહક વગરેથી લોજન કરાવી એ મિત્રને સ્વર્ણ કર્યો. મુખાસનમાં બેસાડી અમે બન્ને

વાતો કરતા આગળ ચાલ્યા. વાખ, વર અને સિહની ગર્જનાઓથી લયંકર એ જંગલ અમે પસાર કર્યે બીજા હિવસે વનમાં અમે અનેક હાથી, ઘાડા, રથથી પરવરેલા કાટી સુલટો હલમદી રહેલા જોયા. “‘શુ’ આ તે અમને હુંઠવા આવેલા છે કે અમારી સાથે ચુંદ કરવા ?” અમારા સુલટો પણ તૈયાર થયા.

તે દરમિયાન એ સુલટોમાંનો એક ઘાઉસવાર મારા ઘાડા પાસે આવી મને કહેવા લાગ્યો, “લય પામણો નહીં, પણ અશ્વથી હરાયેલા એક ઘાઉસવારને તમે જોયો ?” મારી સાથે વાત કરતા એ ઘાઉસવારની નજર સુખાસનમાં બેઠેલા એ સુંદર નવજવાન તરફ પડી. તરતજ આનંદમાં આવી જઈ “જયસેનકુમારનો જય થાયો !” એ ઘાષણા દૂર રહેલા અનેક સુલટોએ જીલી લીધી. ને અનેક સુલટો અમારી તરફ ધર્સી આવ્યા. તેઓ જયસેન કુમારને [સુખાસનમાં બેઠેલા પુરુષને] નમ્યા. પછવાઉથી વિજયરાજ પણ આવ્યા. જયસેનકુમાર સુખાસનથી ઉત્તરી પિતાને નમ્યો. સુલટોએ પણ ગર્જના કરી. “વિજયરાજના પુત્ર જયસેનકુમાર ઘણું જોવો.”

આ અનાવથી હું તો તાજુખ થઈ ગયો મારી તાજુખી દરમિયાન જયસેનકુમારે પોતાની આપવીતી કંકમાં કહી સંભળાવી મારી તરફ અંગુલી નિર્દેશ કરી રાજને કર્યું. “પિતાજ ! અશ્વ ઉપરથી જમીન ઉપર પડેલા અને મૂર્ખિંદ્રા થયેલા મને આ પરોપકારીએ સારવાર કરી અચાવ્યો”

જયસેન કુમારની વાખી સાંસણી વિજયરાજ મારી પાસે આવી મને આલિંગી બોલ્યા. “કુમાર ! તું પણ મારે જયસેન કુમાર જોવો છો. તારો ઉપકાર કાંધ જોવો તેવો છો ?” મારી હકીકત જાણી રાજ અને રાજકુમાર જયસેન

મને લઈને પોતાના પરિવાર સાથે નગરમાં ચાલ્યા ગયા. અમારો સાર્થ પણ સુલોટાની સાથે દેવશાલપુર નગરે આવ્યો. મારે અને જયસેન કુમારને ત્યારથી ગાડ. મિત્રતા થઈ. અરે અમે એક લાઈ જેવા થઈ ગયા. હું રાજમહેલમાં રહેતો ને જયસેન કુમારની સાથે આતો, ચીતો, ને સુખમાં મારો સમય પસાર કરતો હતો. જયસેન કુમારને એક નાની બેન હતી. તે સકલકળાને જણુનારી, અને સ્વરૂપવતી હતી. એ બાળાનું નામ કલાવતી. હું ! જેને આપ આ છથીમાં જુઓ છો ! જે મારી ધર્મની બેન છો. યૌવન વચ્ચે પામેલી આ બાળાને જોઈ રાજ રાણીને ચિંતા થઈ, એના સંબંધ માટે અનેક ઠેકણે રાજાએ તપાસ કરી પણ ક્યાંય એનું મન માન્યું નહીં.

રાજકુમારીની ચિંતાએ ચિંતાતુર થયેલા રાજાએ મને કહ્યું:

“હત ! આ તારી છેનનો વિવાહ તું જ કર. એને માટે યોગ્ય સ્થાન તું જ શોધી કાઢ.”

“આપનું વચ્ચે મને પ્રમાણ છે.” વિજયરાજાનું વચ્ચે મેં અંગીકાર કર્યું. કલાવતીના સ્વરૂપનું આ ચિત્રપદ્મ મેં તૈયાર કર્યું. જેવું તે બાળાનું સ્વરૂપ છે તેવું તો મેં મારી મતિમંહત્વાથી આદેખાયું નથી. એ ચિત્રપદ્મ તૈયાર કરી રાજરાણીને ઘધી વાત સમજવી હું ત્યાંથી રવાને થયો, તે ગઈ કાલે આવી પહોંચ્યો ને આજે આપની સેવામાં હાજર થયો. “હતકુમારે એ ચિત્રપદ્મને લગતી પોતાની હકીકત કંકમાં કહી પતાવી.

હતની આ વાત સાંસાળી રાજ આશ્ર્ય પામતો ને વારવાર ચિત્રપદ્મને જોતાં બોલ્યો. “વાહ ! મતુષ્ય કન્યા

છતાં શું એનું અદ્ભુત સ્વરૂપ ! જાણે સાક્ષાત હેવી !  
હમણાં બોલશે કે શું !”

“હેવ ! આપ કેવા પુરુષોત્તમને પામીને જરૂર એ  
હેવી થાયો. આપની વાણી સત્ય થાયો.”

“એ બધું રીતે બને ? દાટકુમાર ! આ બાળા  
મને રીતે મલે ?” શાખરાજાએ અધિરા થઈને પૂછ્યું.

“હેવ ! શા માટે ન મલે ? આપને જ ચોણ્ય આ  
કન્યા છે. પોતાના ગુણવાન અને પરાક્રમી સ્વામીને છાડી  
આ કન્યા રેતન ભીજને તે કોણું આપે ? આપજ એને  
ચોણ્ય છા હેવ !” દાટાની વાણી સાંલળી રાજને સંતોષ થયો.

દાટાની વાણીનો પરમાર્થ સમજનારા શાખરાજાના  
પ્રધાનો એક એકથી અધિક હતા. “મહારાજ ! કૃપાનાથ !  
આ દાટકુમાર તો અમારા કરતાંય અધિક છે, અમે તો  
અહીંયાં રહ્યા રહ્યા સ્વામીનું કાર્ય કરીએ છીએ ત્યારે આ  
દાટકુમાર તો પરહેશમાં જઈને સ્વામીનું કાર્ય કરે છે.”  
મતિસાગર મંત્રીએ રાજને કહ્યું.

“જે ભીજનું અહિત કરીને પોતાનો સ્વાર્થ સાધે  
છે તે તો અધ્યમ કહેવાય છે. તેમજ જે પોતાનું અને  
પારકું બજેનું હિત સાધે છે તે મધ્યમ પુરુષ કહેવાય છે,  
પણ ઉત્તમ જન તો તે જ કહેવાય કે જે પોતાના સ્વાર્થને  
લોગ આપીને અન્ય જનનું લખું કરે છે. આ દાટકુમાર  
પણ એવા પરોપકારી અને ઉત્તમ જન છે કે જેમણે મહા-  
રાજનું કાર્ય સહેલાધીથી સિદ્ધ કર્યે.” સુમતિ મંત્રી બોલ્યો.

“જગતમાં એ : સામાન્ય બાધત છે કે નીચે પુરુષો  
વિધીનો લય કદ્યો લેધને કાર્યનો આરંભ કરતા નથી.  
અધ્યમ પુરુષો કાર્યનો આરંભ તો કરે પણ વચ્ચમાં અનેક  
વિસ્તો આડે આવતાં કાર્યને પહતું ખુકી હે છે, ત્યારે દાટ.

જોવા ઉતમ પુરુષો તો એક કાર્ય હાથમાં લીધું કે તેને પાર પાડે જ સિદ્ધિ. વચ્ચેમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં તેની ફરકાર કરતા નથી, ને સુશીખતોનો સામનો કરીને પણ કાર્યને પાર પાડે છે.” સુષુદ્ધિ મંત્રી બોલ્યો, રાજમંત્રીઓ પોતાના અનેક મધુર વચ્ચેનોથી રાજના ઉત્સાહને વધારતા હતા. તેમજ હતને હાથ ધરેલું કાર્ય પાર પાડવા ઉતેજન આપતા હતા. રાજમંત્રીઓની વાણી સાંલળી હતકુમાર બોલ્યો, “વાહ ! એ તો રાજને આ છથી જોવા સારું જ માત્ર આપી છે એમાંતો આપ બધા ‘આપ બલા તો પકડ ગલા’ એ વાત વાળું કેમ કરે છો ? આગળ શું કરવું એ તો મહુરરાજ-દેવને યોગ્ય લાગે તેમ કરે.” હતકુમારે પણ વિનોદમાં ઘાપસી પૂરી.

આજના વાર્તાલાપમાં જતા એવા સમયની પણ ખખર ન પડવાથી પ્રતિહારીએ રાજદરાયારનો સમય નિવેદન કરવાથી રાજને સલા વિસર્જન કરી.

એ ચિત્રપટના દ્યાનમાં અને આ બાળ કલાવતીના સૌદ્ધયમાં મોહમુખ થયેલો. રાજ સલા વિસર્જન કર્યો પણ શું કરે ! વિરહાનલના સંતાપથી તપેલા રાજને ક્યાંય ચેન પડ્યું નહીં, કોઈ વિષયમાં મન લાગ્યું નહીં. શાખરાજએ સ્નોન કર્યું, સેવા-પૂજા કરી, બોજન કર્યું, પણ એનું ચિત્ર હતું કલાવતીના સૌદ્ધયમાં ! એની પેદી દિવ્ય મનોહર છથીમાં.

એ કલાનિધિ કલાવતીના વિચાર કરતો શાખરાજ બોજનના કાર્યથી પરવારી પલંગ ઉપર પડ્યો, પણ મનોહર રમણીના મોહણાણુથી વિદ્ધ થયેલા રાજને નિર્દાયણ રીતે આવે. એક વિચાર પુરો ન થાય ત્યાં એને આવે. “હા ! હા ! પ્રિયા ! પ્રિયા ! કલાવતી ! તને પ્રાર્થે

કરવા મારે શું કરવું ? અને જો વિધિએ મને પાંખો આપી હોત તો ઉડીને જટ તારાં દર્શાન કરત, અથવા તો કોઈ એવી યમતારિક વિધા મારી પાસે હોત તો તને પ્રાપ્ત કરવામાં એ વિધા સહ્યાય કરત. પ્રિયા ! તું દૂર છતાં મારા હૃદયને બાળે છ. મારે જો તારા જેવી પ્રિયા નથી તો જગતમાં આવું સાઓન્ય છતાં કંઈ નથી. તે જ પુરુષને ધન્ય છે કે જે આ પ્રિયાનો પતિ થશે.

પ્રિયા ન એવી નિરભી અરે મેં,  
પ્રિયા ન એવી રીજવી અરે મેં;  
પ્રિયા ન એવી ઉર લીધી રે મેં,  
વસંત કેલી ન ઝીધી અરે મેં.

## પરિચ્છેદ ૨ જો



### કલાવતી

તીર લગો ગોળી લગો, લગો ઘરછીકે ધાવ,  
નયનાં કીસીકો મત લગો, લુસકા નહિ ઉપાય;

દાકુમારે કલાવતીનું ચિત્રપટ રાજાને બતાવ્યા પછી  
એ હિવસનાં બહાણાં વહી ગયાં. એ બજેય હિવસો શાંખ-  
રાજના ચિંતાતુરપણે ગયા, ખાન, પાન કે વિકાનોની  
ગાઢિમાં પણ શાંખરાજને ચેન પડતું નહિ, મંત્રીઓ અનેક  
પ્રકારની કથા વાર્તા કરતા, રાજના હિલને રિઝવવાના  
અનેક પ્રયત્ન કરતા છતાં રાજ એ ચિત્રપટની બાલાને  
ભૂલી શકતો નહિ. એ દૃઢ હૃદયને હારવા અનેક શીતોપ-

ચાર થતા હતા, એ હૃદયનો ગમ ભૂલવવા માટે, મનને બીજુ દિશામાં વાળવા માટે અનેક પ્રયત્ન થતા હતા, છતાં રાજના હૃદયની સમૃતિને તે ખાણ ઉપયારો ભૂલાવી શકતા નહિ, રાજ મોટો નિઃખાસ મૂકતો, ખાલાના દર્શન માટે આડુલ વ્યાડુલ થઈ જતો, પણ એમાં બીજે ઉપાય પણ શું? ઉતાવળે કંઈ આંખા પાડી શકે? ધીરજનાં ઝળ જ મીડાં હોઈ શકે.

પ્રાતઃકાળે રાજ રાજસભામાં એડા હતો, મંત્રીઓ અનેક પ્રકારની વિનોદ વાણીથી રાજને પ્રસંગ કરી રહ્યા હતા, તે હરભિયાન રાજના ચરપુરુષોમાંનો એક પુરુષ રાજસભામાં ધસી આવી રાજને નમસ્કાર કરી બોલ્યો. “કૃપાનાથ! ગજથ થધ ગયો, કોઈક રાજ પોતાના સકળ સૈન્ય સહિત આપણી હૃદમાં પ્રવેશ કરી આપણા નગર તરફ ધસી આવે છે, શસ્ત્રાલ્યથી સંનિષ્ઠ તેના અનેક ઘાઉસ્વારો આપણી રૈયતને રંજાડતા ન જાણે કે તેઓ શું કરવા માગે છે? હવે આપને જે ચોણ લાગે તે કરો.” એ ચરપુરુષ અત્યાંત અભિત થયેલો હતો, શાસોશ્વાસ પણ તે સુશકેદીએ લઈ શકતો હતો, અનેક ઘાઉસ્વારોને દૂરથી પોતાની હૃદમાં પ્રવેશ કરતા અને પોતાના નગર તરફ ધસી આવતા જોઈ અભયથ થતો તે શંખરાજને અખર આપવા વેગથી ધસી આવેલો હતો તેણે પરાણે પરાણે રાજને એ સમાચાર કહી સંભળાવ્યા હતા.

ચરપુરુષની વાત સાંલળી રાજ અને મંત્રીઓ અજાયથ થઈ ગયા, આપણે કોઈની સાથે વેર વિરોધ નથી છતાં અચાનક આ શું? કોણ હુશમન અત્યારે મરવાને તૈયાર થયો છે? સુતેલા સિંહને જગાડી તેનું માન મર્દન કરવાને કોણ તૈયાર થયો છે?

શાખરાજએ ચરપુરિષને વિદ્યાય કરી તુરત જ રણભેદી વગડાવી રાજસલા વિસર્જન કરી રાજ પણ હુંમનની ખખર લેવાને શસ્ત્રથી સજ્જ થવા શસ્ત્રાગારમાં વાલ્યો ગયો, રણભેદી-લાનાના નાથી આખુંય સાંખપુર નગર ખળલણી ગયું, વાખુને વેગે વાત સારાય નગરમાં પ્રસરી ગઈ, નગરની અહાર કેમ્પમાં લશકર પણ તૈયાર થઈ ગયું નાના મોટા અધિકારીઓ, લશકરી નાયકો શસ્ત્રાસ્ત્રી સંભવ થઈ રાજમહાલય આગળ રાજના હુકમની રાહ જોતા પરસ્પર વાતો કરવા લાગ્યા, સારાય નગરમાં લડાધનું વાતાવરણ જોઇ નગરમાં નરનારીઓ આકુળ વ્યાકુળ થઈ ગયાં, અરે ! અકાળે આ શું ઉત્પાત ?

સાંચામ ઘેલવામાં પ્રીતિવાળો રાજ શસ્ત્રાસ્ત્રી સાંનિબદ્ધ થઇને આવી પહેંચતાં આધિકારીઓએ સલામી આપી, રાજએ આવતા શાનુ તરફ કુચ કરવાની ને માર્ગમાંજ તેની ખખર લેવાની સેનાપતિને આજા આપી, અકાળે ઉલ્કાપાત જોઇને હાકુમાર પણ ત્યાં સહસ્રા આવી પહેંચી રાજને નમ્યો, “કૃપાનાથ ! આ અકાળે શું તોકાન ? હેવ ! આ ખધો શું ખળલણાદ ?”

“અરે હતા ! તુંતે નગરમાં રહે છે કે જગલમાં ? શાનુનું દણ આપણી નગરીને ભાંગવા આપણી હૃદમાં પેહું છે ને તુંતો કંઈ જાણતો નથી, અમારા સામંતો, સેનાપતિઓ, સુલાદો હુંવે તેની ખરાખર ખખર લેશે, રૈબતને રંગડવાનું રેણ તેને વ્યાજ સાથે આપશે.”

શાખરાજની વાત સાંલળી હાકુમાર ખડખડાદ હસી પડ્યો,

“હેવ ! જરા ધીરજ ધરો, એવો તે કોણ એ માથાનો છે કે નાહા સુતેલા સિંહને જગાડે ? એ સેન્ય આપણા

શરૂનું નથી પણ મિત્રનું છે. એ લડવા નથી આવતું પણ !”

“પણ શું ? શરૂ નથી તો કોણ છે ? તેં કેમ જાણું કે એ સૈન્ય મિત્રનું છે, બોલ ! અટ બોલ !”

અધીર અને લડવાને આવુર થયેલા રાજને શાંત કરતો હતું બોલ્યો.” મહારાજ ! જેમની સામે આપ અને આપના સુખોએ રણે ચઢ્યા છો તે સૈન્ય તો મહારાજ કુમાર જયસેનનું છે. જે ચિત્રપટ મેં આપને આપેણું હતું, જે ચિત્રપટની કન્યાને મેળવવા આપ આતુર થયા છો એ મારી ધર્મભગ્નિનીના સાઈ જયસેન પદ્ધાર્યા છે.”

હતાકુમારની વાત સાંસલી રાજના મનમાં અકસ્માત પરિવર્તન થઈ ગયું. રણનો ઉત્સાહ એકદમ મંદ પડી ગયો”. શું તું ખર કહે છે ?”

“હેવ ! અસત્ય બોલી આપને ઠગવાનું મારું તે ગળું ? પરાક્રમી અને તેજસ્વી એવા જયસેન કુમારને સ્વયંબર માટે વિજયરાજે કન્યાની સાથે આપના નગર તરફ મોકદ્યા છે માટે એમનું સ્વાગત કરો.”

“એ અધું તું કેમ જાણે ?” શાંખરાજને પૂછ્યું. હું ન જાણું તો બીજે કોણ જાણે હેવ ! અમારી એ મંત્રણું હતી. મારી પછી એ દિવસમાં તેમને નિકળવાનું હતું. અમારી પણવાઉજ એ જયસેન કુમાર આવવાના હતા, એમનો મોકલેલો હૃત મારી પાસે આગળથી આવી ગયો છે બાયુ !”

વાહ ! હત ! તેં પણ ખૂબ કરી છો ! મને તેં એ સંબંધી વાતેય ન કરી ? એમ કેમ ?” સિમત કુરકાવતાં રાજ બોલ્યા ને કુચનો હુકમ અટકાવી દીધો.

હેવ ! એવાત તે સમયે કરવા જેવી ન હતી. કો કે અમારી મંત્રણું ચોક્કસ હતી છતાં પણ વાત કર્યા પ્રષ્ટી

કહાય હું ઓએ પડી જાઓ. માટે સંપૂર્ણ નક્કી થયા સિવાય એ વાત આપની આગળ કેમ થાય ? દાઢુભારે મુલાસો કર્યો.

“ તુંથ જથરો તારે ! નકારો એ હિવસ મને તપાઠ્યો .” શંખરાજએ પોતાનાં વસ્તાલશુઅને સુવર્ણની જીબ દાઢુભારને લેટ આપી. “તેં કષણમાં ડેવો રંગ પદાવી દીધો, શું તું શું કરી દીધું નહીં અનવા જોગ તેં અનાવી દીધું ” રાજએ કહ્યું.

“ હે ! વિધિ બળવાન છે. હું તો એક નિમિત્ત માત્ર છું આપના ભાગ્યે જ એ જોર કર્યું છે મેં તો ઝડપ જીબ ચલાવીને જ માર્દ કામ કર્યું છે.” દાની નાભલરી વાણીથી રાજ સંતોષ પામ્યો.

“ મહારાજ ! દાઢુભાર ઘણા ગંભીર છે એમના હૃદયનો પાર અલા પણ શી રીતે પામી શકે ? એ મહાનુભાવ ઓલ ઓલીને સારું લગાડવા કરતાં એતો કાર્ય સિદ્ધ કરવાવાળા છે. સ્વામીની આગળ મધુર મધુર ભાષ્ણ કરી સ્વામીને રાજ રાખવા કરતાં સ્વામીના પરોક્ષ ગુણોતું અનુવાહન કરનારા સેવકોજ ઉત્તમ સેવકો છે. , , અતિસાગર મંત્રી વચ્ચમાં ઓલ્યો.

“ અને દા પણ ઓલવામાં તો કૃપણ જણાય છે પણ કાર્ય સાધવામાં એકરા છે. મહારાજ ? મને લાગે છે કે આપના ગુણો સંભળાવીને કન્યાને આપની તરફ રાગિણિ અનાવી હશે. તેથી જ વિજયરાજે જયસેન કુમાર સાથે કન્યાને આપની તરફ સ્વયંબર માટે મોકદી હશે, દાઢુભારે પણ આગળ આવી ને ચિત્રપટ અતાવા પૂર્વક જેમ આપને અતુરાગી કર્યા તેવી રીતેજ તો ?” સુમતિ મંત્રી દાઢુભાર તરફ જોતો ને હાસ્ય કરતો ઓલ્યો. “આ-

પણ આ અદ્ભુત કાર્યે કરનારની આપે અરાખર અખર લેવી કેમ ખરને હતુકમાર ? ”

“તમે મંત્રીએ પણ ખડુ જથરા ! અહસ્પતિ સરખા તમે જે પરોક્ષ વાત અને છે તે જોએલાની માઝુક પ્રત્યક્ષ કહી સંભળાવો છો, નહિ હેઠ્યા કે સંભળ્યા છતાં આપે યથાર્થ વાત કહી સંભળાવી. એ જેવી તેવી વાત છે કંઈ ? ” હતુકમાર મંત્રીની બુદ્ધિનાં વખાણુ કરતો હોયો. અથા એક બીજાના ગુણને જોનારા હતા.

“અરાખર હત ઘણા ગંભિર ભનવાળો છે. તેમ જ મંત્રી ! તમે પણ સુરાચાર્ય જેવા બુદ્ધિમાન છો, માટે તમે હવે ચુદ્ધ નિવારીને જયસેનકુમારના સ્વાગત માટે જે ઉચિત હોય તે કરો ”.

મંત્રીએને જયસેનકુમારનું સ્વાગત કરવા તેમજ તેમના સુલદો વગેરેની વ્યવસ્થા કરવાનું ફરમાવી રાજ રાજમહેલમાં ગયા. રાજના હર્ષનો પાર ન હતો, આજનો હિવસ એને મન અપૂર્વ હતો. અથે હિવસ થયાં પ્રિયા કલાવતીને મેળવવા માટે રાજ અનેક ઉપાય ચિંતવતો પણ તેને કંઈ સુઝતું નહિ. આજે અણધાર્યો બનાવ બનવાથી રાજને તો અવર્ણનીય હર્ષ હતો, ઉદ્ઘાસ હતો. દૂર રહેલી પ્રિય વસ્તુ આજે ચાલી ચલાવી કદમ આગળ લુકી પડતી હતી. આખ્યની તે અલિહારી કંઈ !

ઇછ વસ્તુની પ્રાપ્તિ માટે માનવી આકાશ પાતાણ એક કરી નાખે છે, અનેક ધમપળાડા કરવા છતાંય લાખ-હીન માનવીને ઉપરથી જુતાં પડે છે. મહેનત અરથાદ જય છે ને હાથનાં કર્યાં હૈયે વાગે છે, છતાં ઇછ વસ્તુનું ફર્શન પણ થતું નથી. તપ્ત અને તાજો ડુલ થતાંય અલિહાપિત વસ્તુની પ્રાપ્તિ દૂર જ રહે છે. કવચિત લાખવાનો

પણ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે કેના થવાનો વખત આવે છે, કારણ કે પુણ્યની એમાં જરૂર ખામી રહેલી હોય છે. અનેથાંચિની વસ્તુને આકર્ષિતામાં ને ડોઈ પણ સામર્થ્ય કરીબનું હોય તો એક પુણ્ય જ.

એ પુણ્ય તો ધર્મ કરવાથી થધ શકે, સાંધુ અને આવક ધર્મ આચરનારા ભાવ્ય આત્માચોના ભાગમાં તે શું ખામી હોય! ભાવથી આરાધિત કરેલો ધર્મ પ્રાણીને શું નથી આપતો? સુક્તિની વરમાળને પહેસચનાર એ કર્મનાં આતો પ્રાસંગિક કેળ છે. કારણ કે જે આપણે કરેલું છે તે જરૂર જગ્યે ત્યારે પણ આપણને જ મલવાનું છે. પ્રાણીઓ સુખ મેળવવા માટે, જગતના આકર્ષક પદાર્થી મેળવવા માટે જેઠલો પ્રયત્ન કરે છે તેથી અધીયા પ્રયત્ન કર્મને આરાધવા માટે કરતા હોય તો તેમનાં વિષમ કાર્યો પણ સહેલાઈ અને સરળતાથી સિદ્ધ કેમ ન થધ શકે?

રાજાની આજ્ઞા પ્રમાણે રાજમંત્રીઓ હાડુમારને સાચે લાઠને ભંગલ વાહિનો સાથે અનેક અસ્વારોને હાથીઓથી શાલતા જયકુમારના સન્માનાર્થે તેની સામે વચ્ચા. જયસેનકુમાર અને મંત્રીઓ ભાર્ગમાં ભજ્યા, લેઠયા, કુશળ-વર્તમાન પૂછ્યા. હાડુમારે જયસેનકુમારને સર્વે હડીકર કેણી ભંભળાવ્યી. ભંગલવાહિનોના ભંદુરા રવેનું ખાન કરેલ સર્વે શાખપુર નગરીના ઉધાવમાં આવી પહોંચ્યા. નગરીની અહાર રાજબાટિકાથાં જયસેન અને કલાવતીને ઉતારો આયી મંત્રીઓએ તેમની સરલસ કરી સુલાયે તેમની અન્ય અધિકારીઓને આસપાસ ઉલારવાની સરાવડ કરી, અનેક તંખુંએ ઉલા કરી દીક્ષા, અનેક જાનાં મોદાં મજાકોએ અત્યરે વધૃત થધ ગયાં. માનજીઓના કેલાંડકાશી નાંદર આનું હુલમહદી રહ્યું. તેમના આપણાં, સરાગ માટે જે

ભ્રમસ્થા થઈ ગઈ. મહેમાનોના આનંદ-વિજોદ માટે અનેક પ્રકારથી નાટક રચના, ગાન, તાન થયાં. એ આનંદમાં એમના દિવસ ક્ષણગારમાં પસાર થઈ ગયો. તેથું યે પુત્ર ફરેહું હોય ત્યારે આવા મહેમાનો આવે, એતી ભ્રમસ્થામાં શું કાંઈ ખામી આવે?

શાખના જેવી ઉજવળ કાંતિવાળી શાખપુર નગરીને પ્રણ શાખગારવામાં શી ખામી રહે. ચોક, ચૌડ, ઘણર અને હડાનોની લાઇન લાઇન ધ્વજ પતાકાઓથી સુશોલિત થઈ ગઈ. રાજ્યદરખાર તેમજ રાજમાર્ગ ધ્વજ પતાક તોરણ જેવી થીલ અનેક કારિગરીથી અસક્ષાર અનાવવામાં જ્યાબ્યા, મંત્રીએ રાજસેવકો પાસે એક દિવસમાં સારાય શાખપુર નગરને મનોહર સ્વર્ગ નગરી-અલકાપુરી જેવી અનાવી હીધી. ભાગ્યવાન પુરુષોનાં કાર્ય માત્ર વચ્ચત દ્વારાએ જ સિદ્ધ થાય છે.

થીજે દિવસે મહોમહોત્સવ પૂર્વક રાજમંત્રીએ જય-સેન કુમારને હાથી ઉપર બેસાડી નગરમાં તેડી લાવ્યા. મનોહર વાદિનોના નાદ ગુંલ રહ્યા છે. સૌભાગ્યવંતીએ અધૃતાં મંગલમય ગીત ગાઈ રહી છે, અનેક નાગરિક જન્મે જયસેનકુમારને જેવાને રાજમાર્ગ ફીડીએનાની સાફેક ડિલ-રાઈ રહ્યા છે. નગરની એવી અનેક નગરતો જ્યાબ્યતાવે નિહાળતો જયસેનકુમાર રાજસભામાં આપદ્યો. સિહાસ્કુ આરદ થયેલા કામહેવ જેવી કાંતિવાળા શાખરાજને તમી સાથ આગળ લેટણું મૂકી જયસેનકુમાર બે હાથ જેડી રાજને નમ્યો. શાખરાજ સિહાસનથી નીચે ઉત્તરી જલસેન-કુમારને લેટ્યા, બન્ને પરસ્પર મહિયા, રાજાએ પોતાપત્ર સિહાસન ઉપર જયસેન કુમારને પોતાની સાથે ચેમચ્છુદ. કુમારની સાથે આવેલા એમના મંત્રીએ, સુલાદ્ય વગેરેને

યોગ્ય સ્થાનકે બેસાડ્યા. નગરીની અદ્ભૂત શોભાને જોતા રાજસલામાં આવેલા હતા. રાજસલાની હિંય રચનાને જોઈ મહેમાનો પણ છક્ક થઈ ગયા છતા મંત્રીઓની કુરા-ળતાની તારીઝ કરવા લાગ્યા. સંકાર વિધિ પૂર્ણ થયા પછી જયસેનકુમારનો મંત્રી ઉલો થઈ હાથ જોડી બોલ્યો. “કૃપા-નાથ ! આપની ઉજ્વલ કીર્તિ સાંલળીને દૂર રહ્યા છતાં પણ અમારા સ્વામી આપની ઉપર પ્રસન્ન થયા છે. દૂર રહેલા છતા આપની તરફ તે એકનિષ્ઠ સત્યસ્નેહ ધરાવે છે. જેથી પોતાને પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી રાજકન્યા અમારી સાથે મોકલી છે. હે દેવ ! મનોહર હિવસ જોવરાવી આપ એની સાથે પાણિઅહેણ કરો ને અમને ક્રેણમાંથી સુક્તા કરો.” જયસેનકુમારના મંત્રીની વાણી રાજાને અતુ-કૂળ હતી. વરે એઠાં ગંગા આવતી હતી, વગર પ્રયાસે કદ્વપુરુષ રીળીલૂત થતું હતું. અનાયાસે સ્ત્રીરલ પોતાને પ્રાત્મ થતું હતું. રાજાના હર્ષમાં હવે શું ખામી રહે ?

“દૂર રહેલા અને ગુણ રહિત એવા મારા ઉપર વિજ-યરાજની આટલી બધી કૃપા છે એ એમની સહૃંનતા છે. મારા મોદ્ય લાગ્યે જ જયસેન જેવા મહેરથાનો માર્દ આંગણ પાવન કરી રહ્યા છે, તેથી જ મને લાગે છે કે માર્દ ભાગ્ય હણું જાગત છે. વિજયરાજ જેવા વડેરાએ મારી પાસે જે માગણી કરી છે તે માગણીને નકારનાર હું તે કોણ ભાત્ર ! મારા જેવા તુચ્છ માણસો વડીલોની એવી વાણીને કોધ પણ અવગણી શકે નહિ, મંત્રીણ ! ઇલને દેનારો કદ્વપુરુષી જેવી વાણીનો અનાદર કોણ કરી શકે ?” રાજાએ પોતાની લધુતા પ્રગટ કરતાં મંત્રીની વિનંતિ આન્ય કરી.

“બંધ્યો ! મહારાજાના સંખ્યાબમાં તમે મને કહેતા હતી

પણ એથી ય વિશેષ આજે મને ખાતરી થઈ. રાજ છતાં શું એમની બોલવાની અતુરાધ, સરળપણું, વિનય, નઅતા; ઉદ્ધતાધનું તો નામ નહિ. અમૃત સરખી મધુરી વાણી, એ અદૌરીકિક છે". જયસેનકુમાર હતને ઉદેશીને બોલ્યો. રાજનો રીતલાત તેમજ નઅતા જોઈ જયસેન પ્રસન્ન થયો. હતો.

"મહાપુરુષનો સ્વભાવ જ એવો છે' વૃક્ષો જેમ અધિક ઝ્લતાં નીચે નમે છે, અનેક નદીનાળાંના અથાગ જળનો સંગમ થવા છતાં સાગર ઝ્લકાતો નથી. તેમ મોટા પુરુષો પોતાની મોટાઈ કૃયારે પણ છોડતા નથી. રાજકુમાર!" જયસેનકુમારનો મંત્રી કૃમારને-પોતાના સ્વામીને ઉદેશીને બોલ્યો.

જયસેનકુમાર પણ પ્રસન્નતાથી મસ્તક ધુણાવતો શાંખ-રાજ તરફ નજર કરતો બોલ્યો." દેવ ! આજે તમને જેવાથી મારાં નેત્રો સફ્લ થયાં, અમૃતથી પણ અધિક વાણી સાંભળવા વડે મારા કર્ણો સફળ થયા, ને શાંખપુરી અને આ રાજમહેલમાં આવવાથી મારી કાયા સફ્લ થઈ. રાજન ! તમને વિશેષ તે શું કહું ??"

"અને દેવશાલપુરના રાજકુળમાં વિશાળ રાજકુંભ છતાં રાજભાગાં કલાવતી પણ મહારાજના શુણ્ણામાં જ અતુરાગિણી અનેલી છે." જયસેનકુમારનો મંત્રી બોલ્યો.

"એ બધોય મહારાજના અદ્ભુત લાભનો જ પ્રતાપ છે." હતકુમારે પાદપૂર્તિ કરી. વાણી વિલાસમાં ડેંલોક સુભય પસાર થયો.

રાજન્યોત્તિષ્ઠાનાને બોલાવી લખનો શુલ દિવસ નકી કરી. સ્વાગત કરવા પૂર્વક જયસેનકુમારને એમને ઉતારે રવાના કર્યા. રાજસલા પણ વિસર્જન કરી. તે

પછીના એક દિવસે મોયા મહોત્સવપૂર્વક શાખરાજ અને રાંગધાળા કલાવતીનાં ધામધુમથી લમ્બ થઈ ગયાં, કન્યા-દાનમાં જ્યસેનકુમારે વિજયરાજે જે જે વસ્તુઓ હુાથી, ઘાડા, રથ, વસ્ત્રાલરણ, જરૂર અવેરાત, દાસ, દાસીઓ કરેંટે આપેલી હતી તે કરતાંય વંશારે આપી દીધું, શાખરાજના આગ્રહથી કેટલોક સમય રોકાઠ રાજની આજા મેળવી જ્યસેનકુમાર પોતાના પરિવાર સહિત પોતાના નગર હેવશાલપુર તરફ ચાલ્યો ગયો, પુન્યવંત મનુષ્યાને જગતમાં શું શું નથી મળતું? જે વસ્તુઓ હુરે છે, કુંભે કરીને મેળવી શકાય તેવી છે, પ્રયત્ન કરવા છતાં પણ અસાધ્ય છે, તેવી હુંસાધ્ય વસ્તુઓ પણ પુન્ય હોય તો તરતમાં જ મહી શકે છે. એ જાણ્યા પછી એવો ડોષ મ્રમાદી હોય કે પુન્ય કરવામાં પાણી પાની કરે? પુન્યમ્રકૃતિ બાંધવા મણિનાં જે જે કરણો હોય તેની જરૂર આરાધના કરેનું કર્મના ગમે તે અંગનું આરાધન કરો પુન્યના લંડાર કરો.

### પરિચ્છેદ ૩ જે.



### સૌંદર્યનાં મનુ

ધર્માદ્રનમનન્તં સ્યાત્, સર્વકામશ્ચ ધર્મતઃ ।

લભ્યતે ધર્મતો મોક્ષઃ, તેનોત્તો ધર્મ ઉત્તમઃ ॥

**ધાર્યાર્થ**—જાનતમાં ધર્મ કરવાથી અગત્યિસ ધનની પ્રાપ્તિ થાય છે, મનની સર્વ અલિતોપાણો અને લોણ ઊપલોગની વસ્તુઓ પણ ધર્મ થકી જ પ્રાપ્ત થાય છે,

ઉતામમાં ઉતામ મોક્ષજીન્ય સુખ પણ ધર્મના પ્રલાભથી મળી શકે છે તો આ ક્ષણીક સુખો મળે એમાં તે શું ? માટે જ જગતમાં ધર્મને ઉતામ કહેલેલું છે.

“સૌદર્યનાં જાડુય જગતમાં અદ્ભુત તો અરો !”.

રાજરાણી-પદ્મરાણી કલાવતી એક દીવસે ભવ્યાલ સમગ્રે સ્નાન કરી આગ્ર એક વસ્તુ લેર પોતાના નાગ પાણ સમા કેશકલાપને આમતેમ નચાવતી આરિસા ભુવનમાં પોતાના હિંય સૌદર્યને નિરખતી બોલી. ક્રેનાં અંગોપાંગો મનો-હર કારીલાં તેમજ નવીન યોવનના આવેશાખી અદ્ભુત હતાં. પહેલીજ નજરે પ્રલોભન કરેનારોં પોતાનાં ખુલ્લાં અંગો પોતેજ જેતી મનમાં વિચારી રહી હતી, “વાહ ! વિદ્ધિએ શું અદ્ભુત હ્ય સરેજણું છે ! આ હ્યમાં ભયંકરે સિહેને કશ કરેનાર પુરુષ હિવાનો અને છે - પાગલ અને છે, અનેક જાડુ કરતાં જગતમાં હ્ય સૌદર્યનાં જાડુ અદ્ભુત છે, એ સૌદર્યને મોદી વભરણધીએ. પણ મસ્તક નમાવે છે તે કંધી તદ્દન ગેરવ્યાજથી તો નથી. જે સ્ત્રીઓમાં આતું આકર્ષક સૌદર્ય નહોલ તો તે કઢી સમર્થ પુરુષો પર પોતાનો પ્રલાભ પાડી શકતા નહીં. આ મોહીની પણ જગતમાં કંઈ ક્રેવી તેવી નથી. આહ ! હ્ય એતો અદ્ભુત ” મનમાં સૌદર્યનાં વખાણ કરતી ખાલા કલાવતી અત્યારે આરિસા ભુવનમાં એકાંતમાં પોતાના કેશકલાપ સમારતી, વિચારમાં ને આરિસામાં પોતાના સૌદર્યને જેતી એકાગ્ર હતી. અચાનક એના મનમાં વિચાર સ્કુરોં ને અતું ચંદ્ર-વહન જરીક ઇરેક્યું, વહન ઉપર આતું સિમત પથરાણું, અને કદાચ અત્યારે એ આવે તો ? ” સહેજ આસ્તેથી એ શણ્ણો એ મનોહર ચંદ્રવહનમાંથી સરકી ગયા. એ નવાન જવાન શરીરના રોમચાય વિકસનર થયાં, હૃદયમાં અનેક

લાવો ઉત્પન્ન થયા ને ચાલ્યા ગયા, હૈયામાં અકુથ્ય ઉલ્લાસ થયો, યૌવનનો થથરાઠ થનથની રહ્યો, સૌંદર્ય ક્ષાટ ક્ષાટ થવા લાગ્યું, એ સ્નાનથી શુદ્ધ થયેલી નવોઢ કલાવતીના વહન ઉપર ખ્રીતિના લાવો જાગૃત થયા કે શું ?

એ આરિસામાં પોતાના વહનને અનિમેષ નથને જેતી કલાવતીએ તરતજ એક પ્રતિબિંબ-વહન જોખું અને ચમકી, “અરે આતો એ...હેં શું ? કયાં જઈ ? સંતાદ જઉં ? કલાવતી ગલબરાઈ ગાઈ, પોતાના કેશકલાપને આમ તેમ નયાવતી હરખુંની માર્ક કુદાકુદું કરતી કરતી એક ખુણામાં સંતાદ ગાઈ-ભરાઈ ગાઈ.

આવનાર પુરુષ ભીજે તે કોણ હોય, ? એતો રાત-હિવસ એના રૂપનું પાન કરનાર શાખરાજ પોતે જ હતો. પ્રિયાના દર્શાનનો અધિરો રાજ પ્રિયાનું દર્શાન કરવા-રીજવવા અત્યારે ક્વેળાએ પણ હાજર થયો હતો. પ્રેમી આશકને પ્રિયાના ધ્યાન સિવાય ભીજું રૂંધ્યાન હોઈ શકે ? એના હૃદયમાં તો પ્રિયાનું જ સ્થાન હોઈ શકે.

શાખરાજ પ્રિયાના સૌંદર્યને નિરખતો મંહમંહ ડગલાં ભરતો ભનમાં અકુથ્ય રમણીય મુંઝવણુને અનુભવતો એ સંતાયેલી પ્રિયાના સન્મુખ હાજર થયો. દિશિથી એ સર્વાંગ સુંદર અગ્નાપાંગના સૌંદર્ય-લાલિત્યનું પાન કરવા લાગ્યો, “વાહ ! સંતાઈ જતાં તો સારુ આવડે છે હો !” રાજ હસ્યે.

નવોઢ કલાવતી શરમની મારી નીચ્યથી ઉંચે મસ્તક પણ શી રીતે કરી શકે ? લાઙજ એ તો નવોઢ નારીઓનું ડિતમભ્રમાં ઉત્તમ ભૂપણ કહેવાય. શરમથી પૃથ્વી માર્ગ આપે તો જણે પેસી જઉ. શું કર ? એ ગલદ નારીને અત્યારે હિંમત આપે તેથું કોણ હતું ? પૃથ્વી પણ માર્ગ આપવાને અત્યારે નવરી નહોતી. મોત પણ અત્યારે તો મંહમંહ

હસી રહ્યું હતું - એની મરુકરી કરતું હતું. ગરીબ ઘિયારી બાલા !

“સંતાધ જવું હોય તો મારા હૃદયમાં સંતાધ જાને ? જરી ઉચ્ચ તો જો ? મારી સામે તો જો ? પૃથ્વી કાંધ માર્ગ આપવાને અત્યારે નવરી નથી કલા !” એ યૌવન અમૃતનું દિશિથી પાન કરતા રાજનાં નેત્રો હસી રહ્યાં-નૃત્ય કરવા લાગ્યાં. એ રૂપના જદુથી શાખરાજનું મસ્તક તાલા-ચમાન થવા લાગ્યું.

એ શરમનો આવેગ પૂર્ણ થતાં હવે કાંધક હિંમત ધારણ કરી બાલા-નવોદાનારી કલાવતી પોલી. “જીની આનંગીમાં આમ એકદમ પ્રવેશ કરવો એ સારા માણસનું લક્ષણ ન કહેવાય. ચોરની માદ્ક ગુપ્ત્યુપ દાખલ થતું એ તે ક્યાંની રીત ?”

“હુનિયામાં આવી ચોરી કોણ નથી કરતું ? મોઢ લાગ્ય હોય ત્યારે જ આવી ચોરી કરવાની તક મલે છે બાલા !”.

“શું ચોરવા આવ્યા છો ? આ મહાલયમાંથી ગમે તે વસ્તુ ઉપાડી ચાલતા થાએઓ. આદલી બધી કિમતો વસ્તુએ પડી છે તેમાં તમને કંઈ ગમે છે ?” એ શાખદાનો ઉચ્ચાર કરતી કલા હસી. એના મનમાં-હૃદયમાં શુંય થતું હશે એ તો એ પાતે જ જાણો.

“મને તો આ વસ્તુ ગમે છે કલા ?” રાજએ અંગુલી નિર્દેશ કરી કંદું ને આસ્તેથી પોતાના સુકોમળ હાથે એનું મસ્તક ઉચ્ચું કરી પોતાની સામે સ્થિર કર્યું. “મને શું ગમે છે તે તું સમજુને કલા ?” અને એક બીજાને દિશિથી દિવાનાં કરતાં હસ્યાં.

“ના.” કલાએ મસ્તક ધૂણાંયું.

“એ...મ ? હજુ પણ તને સમજ પડતી નથી દે સમજાવું ?” આસ્તેથી તેના વહન પાસે પોતાનું વહન લઈ જઈ એક.....

“અરે આ...શુ? ચોરીને ઉપરથી સરળેરી!” ખાલા કલાવતી જરા હૂર અણી ગાંધિ-શરમાંદ જાંદ.

“અરે એમાં આરલો બધો રોષ ? તમારી રજાથી હું ગમે તે ચીજ લઉ તોય કાંઈ વાંધો ? વાહ ! આ તો અજાય વાંધો !”

શાંખરાજ કલાવતીના પાસે ગયો અને મંદમંદ અધરે ને સ્કુરાવતો યોધ્યો. “રોષ ન કરશો કલા-દેવી !”

અને પતિ ખાની ભજાન હતાં. અદ્ભૂત વ્યક્તિત્વ ફરાયનારાં હતાં. એક બીજાની શક્તિ પોતપોતના પ્રમાણમાં ખુબ હતી, એતો જ્યારે કસોટીએ કસવાનો સમય આવશે ત્યારે અધરે. શાંખરાજ અહાદૂર, વીરેનો વીર ને સમયનો જાણુ હતો. ત્યારે કલાવતી સતીઓમાં પણ એછ હતી. એના પ્રથમ સતીત્વ અપગણ સળતું વ્યક્તિત્વ રહ્ય ગોણુ થઈ જતું. એ સતીત્વ સિવાય કલાવતીમાં જીસિ ઉચ્ચિત એજિન પણ અનેક જુણો હતા. તેમજ ઉત્તરોત્તર આલીકાલમાં પણ અને ઉજ્જીવને પ્રામુખ કસનારે ઉચ્ચ આરમાંદો હતા. પણ અત્યારે શું ? અત્યારે તે કેવો સમય લેયો જ દ્વારા, કેવો કર્માદ્ય સેવી જ પ્રદૂષિ. કેવા સંયોગો તેવો જ વર્તાવ કે બીજું કંબુ ?

એમને અપાધિન ધ્યેના માનવેની આંકડ શાંખરાજ પણ અજૂન નખરે મિથા કલાવતીને કિણાણતો ને મંદમંદ પોતના અધરે રમાડતો યોધ્યો. “હુલા ! ખરેખરે આજુને કો જાણ સ્કેલને હું કરા થઈ જશો શું. જાણ કૌન્દર્યનાં પતંગની માડુક મુંઆંદ રહ્યો શું. વ્યાજસરે તો હૈથું પણ હાથ નથી પ્રિયે !”

“તે હૈથું ડેકાણે રાખો; કોઈ ચોરી જરૂર તો ?” કલાજરાક હુસ્તી. એના નયનમાં અત્યારે અંભૂત જાહું એ જાહુમાં જોશે ધળવાન માનવી પણ અત્યારે તો સ્થિર થઈ ગયો હતો.

હવે ચોરાવામાં ખાડીએ શું રહ્યું છે ?, તારા ભાઈ દ્વારા જ્યારથી તારું ચિત્રપટ ઘતાવ્યું ત્યારથી જ હૈથું તો હું દાવમાં હારી એઠો જું. હવે શું થાય ?”

“એ દ્વારા બહુ ખરાખ કામ કર્યું છે, ચિત્રપટ ઘતાવી તમને હેરાન કર્યા છે એવાને તો શિક્ષા જ કર્યી જોઈએ, કેમ ખરું ને ?”

“સ્થા, શિક્ષા તો જરૂર કર્યી જોઈએ, પણ દાને નહિ”.

“ત્યારે કોણે ?”

“મારા કુદ્દયના ચોરનાંસે !”

“એ.....મ ! ત્યારે તો ઇસાયા !”

“એમાં શક શું ? ચોરને શિક્ષા થધી જ જોઈએ ?”

“તેમારો ન્યાય તો વિચિત્ર પ્રકારનો કહેવાય ?”

“ન એ શિક્ષા પણ અત્યારે જ કરી હોય તો ?”

“તેથી જ રાજક્ષણામાંથી અત્યારે આવ્યા હશો ?”

“હા, ખરાખ છે.”

“ત્યારે તો પૂરો ફેલાવા હવે તો !”

“અપારના ! શાખમુરમાં આધ્યા સે દિવસથી.”

“ના ! અત્યારે તો મને જવાદો”.

મૃગદીની માદુક છઢી જતી ખાલ્સાનીવના કલાવતીને સાખરોએ એકદમ પોતાના ખને હાથ મજબૂત પકડી લીધી. પોતાના ખને હાથોમાં એને રમાટો હિંડાયા ઉપર એણે. પોતાની પાસે એસાડી એના થાળ પોતાની અંગલીવંતી હોળણા લાગ્યો. પોતાને હાથ એને આલૂખા

અને વસ્ત્રો પહેરાવવા લાગ્યો, વારે વારે એના સુંદર શરીર  
પર પોતાના હાથનો સ્પર્શ કરતાં રાજ તમિજ પામતો  
નહીં, કલાના સુઅને માટે રાજ શું ન કરતો? પ્રિયાનું  
કાર્ય પોતે જતેજ કરતો, પ્રિયાની સાથેજ આતો, પીતો  
અને વાર્તાલાપમાં તો સમય પણ જણાતો નહિ. સમય  
ઉપર સમય જવા છતાં પ્રિયાથી દૂર થવાનું એને પાલવતું  
નહિ. પ્રિયાના વદનને જોતો ત્યારેજ રાજનું હૈથું ડરતું  
હતું; એવાં બાદુઈ આકર્ષણ એમ સહેલાધીથી કોઈનાંય દૂર  
થયાં છે કે?

પ્રિયાની સાથે વિવિધ પ્રકારે સુખને લોગવતો રાજ  
રાજકાર્યમાં પણ મંદ ઉત્સાહવાળો થયો. મંત્રીઓને રાજ-  
કાર્ય ભળાવી દીધું; બીજે કોઈપણ ઠકાણે જરૂર આવવું ચ  
રાજએ છાડી દીધું; એવી અનેક ઉપાધિઓને છાડી રાજ  
કલાવતી સાથેજ સમય વિતાડતો હતો. ખાન, પાન, ગાન-  
તાન, સ્નાન એ સર્વે કંઈકલાવતી સાથે હોય તોજ એમાં  
આનંદ જણાતો હતો. કલા સિવાય સર્વ કંઈ રાજને નિરસ  
-નિર્માલ્ય હતું; જ્યાં અને ત્યાં રાજને કલાવતીજ હેખાતી  
હતી. સુધ્રમ સ્વરંપે એની દિવ્ય પ્રતિમા એની નજર સમક્ષ  
તરવરતી હતી. કલાવતીના પ્રેમમાં મરાગુલ થયેલા શંખ-  
રાજને અત્યારે પ્રજાની કે રાજ્યની કંઈએ પડી નહોંતી.  
રાજ્યમાં નવાજુની શી બને છે તેની પણ રાજને પરવા  
નહોંતી. એવું અનેર સ્નેહથંધન રાજને બંધાયેલું છે કે  
એક ક્ષણ પણ કલાવતીને ન જુઓ તો એને કંઈકંઈ મનમાં  
થઈ જતું હતું. વિશેષ શું? અત્યારે તો કલાવતી એ  
એકજ મહાન હતી. એની સાથેનાં લોગવાતાં સુઝો એજ  
એને મન સર્વસ્વ હતું. એના મધુર શબ્દોનું શ્વરણ એ  
રાજને મન ઉચ્ચયમાં ઉચ્ચય સંગીત હતું. અહોનિશ એને

જોઈને જ રાજ પોતાની દિશિનું કલ મેળવતો હતો, કલાવતીને મેળવીને જગતમાં પોતાને શું નથી મલ્યું ? મનુષ્યના સુખની પરાકાણાએ પહોંચેલા એ માનવીને મનમાં થતું કે આવું સુખ કોઈને હશે વાર ? કલા જેવી રૂપ અને ગુણસંપન્ન નારીએ જગતમાં હશે કે ?

અનુપમ લોગોને લોગવતી કલાવતીની નગરીની નારીએ પણ ધર્યા કરવા લાગી. કેટલીક સમજુ રમણીએ એના સૌભાગ્યની પ્રશંસા કરવા લાગી. કેટલીક પોતાને કલા જેવું સૌભાગ્ય, લોગવૈલવ, ઔર્ધ્વ મલે એ ખાતર ધર્મ કરવા તત્પર બની. સારાય નગરમાં એના ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. પંચવિષયજન્ય સુખને લોગવતનારાં આ રાજ રાષ્ટ્રીના ભાગ્યમાં તે શી ખામી હોય !

પ્રતિહિવસ વિવિધ સુખો લોગવતાં તેમનો કેટલોક કાળ ચાલ્યો ગયો જેની એ હંપતિને ખર્ચર પણ પડી નહીં. સુખ અને દુઃખ એ વસ્તુઓની એક બીજાથી ઉલ્લિં રીતે છે. દુઃખમાં અદ્ય સમય પણ દીર્ઘકાલ જેવો લાગે છે ત્યારે સુખમાં દીર્ઘકાળ પણ અદ્ય થઈ જાય છે; સુખમાં જેમ દેવતાએને પોતાના જતા એવા કાળની ખર્ચર પડતી નથી તેવી જ રીતે ચારેકોરથી સુખમાં પડેલા માનવીએ પણ દેવતાની માર્ગક જતા એવા કાળને જાણુતા પણ નથી.

મનુષ્યને દુર્લભ એવા લોગોને લોગવતાં કલાવતીએ એક સુંદર ભાગ્યવાન ગર્ભને ધારણ કર્યો, એની પ્રતીતિ તરીકે સુખે શાયનાગારમાં પોઢેલી કલાવતીને એક સુંદર સ્વરૂપ આવ્યું. સ્વરૂપમાં કલાવતીએ રાત્રીના ચરમ પ્રહરે ક્ષીરાદ્વિ જલથી ભરેલો સુવષ્ણુ કલશ જોયો. એ મનોહર કળશના ગળામાં પુષ્પમાળાએ ગુંધેલી હતી. સુંદર ચિત્ર વિચિત્ર કમળથી એ કળશનું સુખ ઠંકાયેલું હતું. એવા એ

કળાને જોતાં પ્રભાતના મંગલમય વાહિત્રના જાહોએ તેને જાગત કરી. “આહ ! કેવું મનોહર સ્વરૂપ !”

હર્ષના આવેશવાળી કલાવતીએ શાખરાજને એ સ્વરૂપ નિવેદન કર્યું. “પ્રાણેશ ! એ મનોહર સ્વરૂપનું ક્રોણ શું ?”

“પ્રિય ! રાજ્યધૂરાને ધારણું કરવામાં સમર્થ એવો પરાક્રમી પુત્ર થશે ! તમારા મનોરથ સર્જણ થશે.”

“આપણું વચન સત્ય થાઓ.” કલાવતીએ રાજનું વચન અંગીકાર કર્યું. મનમાં અતિહળ્ય પામી.

ગર્ભને નિર્બાહ કરતાં કલાવતી શાસની રીતિ પ્રમાણે ગર્ભને પોપવા લાગી. ગર્ભને પોપણ મલે તેવું કોજન કરતી, ઔષધ પણ પીતી હતી. ગર્ભના રક્ષણું માટે પોતાને હાથે જરીયુટીએ આવંધવા લાગી. છષ્ટ હેવતાની આરાધના કરવા લાગી. ગર્ભના રક્ષણ માટે અનેક ઉપાય કરતી સમય નિર્ગમન કરવા લાગી. એવી રીતે નવ માઝ વ્યતીત થયા ત્યારે પ્રથમ પ્રસુતિ પિતૃશુદે થવી જોઈએ એ રીતિ હોવાથી વિજયરાજે રાજસેવકોને મોકલેલા, તે સેવકો શાખપુરુભમાં હતાના મફાને આવી ગયા. રાજસભામાં બીજે દ્વિષસે જવાનો નિર્ણય થવાથી તે દ્વિષસે તેમણે પરિશ્રમ ઉત્તારવા વિશ્રાંતિ દીધી. પણ કલાવતીને ખખર પડતાં તરત જ હતાને મફાને હોડી આવી. કુદંબના સમાચાર પૂર્ણી સાધને મોકલેલું લેખણું લાઇ રાજમહેલમાં પાછી દર્શી.

## પરિચ્છેદ ૪ થૈ।

રંગમાં રંગ.

“કયા કરે ચાહને વાલોંડા ભરોંસા કોઈ,  
જગતમેં કીસીકા હોતા નહી કોઈ.

નિશા સમયે નિશાનાથનો આખમાં ઝગઝગાઈ હોવા  
છતાં રાજમહેલમાં અનેક દીપશિખાઓ અંધકારને ભગાડી  
રહી હતી, અનેક પંચરંગી દીપહોથી રાજમહેલની અપૂર્વ  
શોભા જણુાતી હતી, મોદા મોદા રાજમાર્ગી તેમજ અનેક  
નાના મોદા રાખપુરના રસ્તા દીપકેના તેજથી દીવસુ  
નું જ ભાન કરાવતા હતા. અનેક ધનાદ્યોના ગ્રાસાદ્યો  
તેમજ મોદા મોદા રાજ્યાધિકારીઓના મહાલયો ખણ દીપ  
કેની જ્યોતથી ઝગઝગી રહ્યા હતા તેમની સમૃદ્ધિને  
સૂચવતી ધનાદ્યો-પંચરંગી પતાકાએ હવામાં નૃત્ય કરી  
રહી હતી.

રાજમહેલના એક મનોહર અને વિશાળ ખંડમાં  
પદરાણી કલાવતી પોતાની સખીએ સાથે અત્યારે આપેદુ  
પ્રમોદમાં વખત ખ્સાર કરતી અનેક પ્રકારની વાર્તા કરી  
રહી હતી. આવતી કાલે અગર તો એક એ હિવસુદું  
કલાવતીને પિતૃ શૃષ્ટે જવાતું હોવાથી તેનું મન ઝંધુ  
આનંદમાં હતું માતાપિતા તેમજ લાઇને મળવાના સંસ  
અની આતુરતાથી રાહ બેઠું હતું. અત્યારે તે હંઘુને  
આકૃતની જરાક જેવડી જાંખીય ક્યાંય જણુાતી ન હોઈ  
સ્વપ્નામાંય અપાઙ્ગવની જાંખી ક્યાંથી છોય!

“સખી! જો આ આજુથાંધ કેવા મનોહર છે તુ

મારા પ્રાણુથી પણ અધિક પ્રિય આ આભૂષણને મોકલનારને હું ક્યારે જોઈશ ? ” કલાવતી આદીઅવળી વાતથી પરવારી પોતાના ઘન્ને નાજુક હાથ પર ધારણ કરેલાં ખાજુબંધને વારંવાર જોતી હર્ષ પામતી બોલી. એના હૈયામાં હર્ષની અવધી ન હતી. આંખો હર્ષથી હસી રહી હતી. માતાપિતાને મલવાના ઉત્સાહમાં એનાં રેમરાય વિકસ્પર થયાં હતાં. આજે એતું મન આનંદના મહીસાગરમાં ડાલવામાન થર્ડ રહ્યું હતું.

“અહેન ! હવે અધિરાં થાઓ નહિ. થોડાજ દિવસમાં તમે તમારા પ્રિયજનોનાં દર્શન કરશો, ઝુશી થશો, પ્રિયજનો મેલાપ પણ ભાગ્ય વગર કાંઈ ઓછાજ થાય છે ? તમો તો મોટાં ભાગ્યવાળાં છો, નશીખદાર છો.” સખીએ કલાવતીનું મન પ્રસન્ન થાય તેવી રીતે કોમલ ભાપામાં જણાવ્યું ને એ સખીના વચનથી કલાવતી પણ રાજ થાડ ગઈ. અત્યારે એના ઉત્સાહ પણ અખંડિત ન સંપૂર્ણ હતો. આનંદના આવેશથી એના મનરૂપ આકાશમાં અનેક નાની મોટી હર્ષની વાદળી આવતી ને વેરાધ-વિભરાધ જતી. કારણું સંપૂર્ણરીતે સુખી અને સમૃદ્ધ માણુસોની સૃષ્ટિ હુંમેશાં ગરીબો કરતાં નિરાળીજ હોય છે.

“હા ! સખી તારી વાત સત્ય છે. આ ખાજુબંધ જોવાથી જણે પ્રત્યક્ષ એ પોતેજ મારી સામે ઉલો હોથ એમ જાણી હું ઝુશી થાડિ છું. મારી ઉપર કેદો અધો એના સ્નેહ છે ? જગતમાં આવો સ્નેહ ક્યાંય હશો કે ? ” હર્ષવિરામાં અત્યારે કલાવતી શું બોલી રહી છે તેનું પણ લાન નહોતું ! તેમાંય મોટા માણુસોના પ્રસંગે હુંમેશાં અનેરાજ હોય છે. સ્વતંત્ર અને ષેપરવા માણુસોને માલવામાં કે ચાલવામાં ડાઢની પરવાહ નથી હોતી. કેઠની

દાક્ષિણ્યતામાં તેમને ગલરાવાતું કે વિચાર કરવાતું પણ હોતું નથી.

“તમારી વાત સત્ય છે ભુણ, જગતમાં સ્નેહ એ તો મોયામાં મોડું અદ્ભુત વર્ણિકરણ છે. કેમ મોરદીના મધુરા નાદને વશ થયેલો. સાપ મૃત્યુનીય પરવા નહીં કરતાં સ્થાંભીત થઈ જાય છે તેવીજ રીતે આપ પણ સ્નેહના વશથી અત્યારે કેવાં ડામાડાલ થઈ રહ્યાં છો? દૂર છતાં પણ સ્નેહનું આકર્ષણ અનેરજ હોય છે, ચંદ્રનાં દૂરથીય દર્શન કરીને કુમુહની શું નથી ખીદી ઉઠીતી?”

નિર્દ્દીપણે કલાવતી અને સખીની થતી વાતચિત આકસ્માત આવી ચુલા રાખાએ ગુપ્તપણે ઉલા રહીને સાંસારી અને મહુસાગરના તોષાનમાં નાવડીની કેમ રાખાનું મન ચગડાલે ચઠું, કલાવતીના હાથ પર રહેલા બાળુખં પ્રને બોઇ રાખાએ વિચાર કર્યો. ઓહો! આ બાળુખં કોણે મોકલ્યા હોશે, કોની ઉપરના સ્નેહની આ વાત કરે છે? આના હૈયામાં આદલો ખધો સ્નેહ કોના તરેક ઉલરાધ જાય છે? વાહ! શું આંદું સ્ત્રીનું હુદય? હું જ્યારે એના માટે મરી મથું હું ત્યારે આ તો કોઇ બીજા ઉપરજ એવારી જાય છે? વાહ! દુનિયા વાહ! વિધાતા! શું સ્ત્રીની અભિનય-કળા છે! એલવાના જુદા ને ચાવવાનાય જુદા! આ તે સ્ત્રી કે રાક્ષસી? દેવી કે દ્વાનવી? કે નારી પોતાના વિશ્વાસુ પતિને છેતરી જારી વિનારી રમે એનો પાર અલા પણ શી રીતે પામી શકે? ” શાખરાજના શાંકાશીલ થયેલા મનમાં અનેક કાળી વાદળી આવીને પસાર થઈ ગઈ, ક્ષણું પહેલાંની પ્રાણવલલસા પ્રિયા કલાવતી માટે એનું સારાંક મન અનેક પ્રકારે બહેમવાળું થવા લાગ્યું. માનવીના ચંપળ માને વિચારેના વિનિમય કરતાં શું વાર લાગે? શાંક-

રાજના મનમાં વહેમનું વમળ એવી રીતે બુંચળું વળી ગયું કે એ શાંકાની તપાસ કે ચોકસાઈ કરવા જેએલું ધૈર્ય પણ તે ધરી શક્યો નહિ. વહેમના જાળામાં જુદી વકળ થતાં જ રાજએ એકદમ કલાનિપુણ કલાવતીનો ઝેંસલો કરી નાંખવાનો વિચાર કર્યો. “હા ધિક! આ હૃષ્ટા નારીનો વિશ્વાસ કરી એના મિથ્યા મોહમાં હું ઇસાયો, એના પ્રિય તમને જે હું અત્યારે જોઉં તો હમણાંજ એને ઉલ્લો ચીરી નાખું અથવા તો આ અધમ નારીને તો સ્વર્ગમાં મોકલી હું, આ પાપિણી તો મારી શાંખ જેવી શુદ્ધ એને ઉજવળ શાંખપુરીને લજવશો. હવે એક હિવસ પણ એ મારા મહેલમાં રહી શકશે નહિ, એના કર્મને ચોઅય એને અવરય શિક્ષા થવીજ જોઈએ” આકુળબ્યાકુળ થયેલા રાજોને અત્યારે કોણ સારી સલાહ આપે? રાજ તેજ, સત્તા, ચૈમદ્યુર્ય એને યૌવનના મહથી છકી ગયેલું મન શાંત કરવાને કે ધીરજ ખમવાને શક્તિમાન નહોંતું, અત્યારે તો તડ એને ઝડ સિવાય કોઈ રસ્તોજ નહોંતો. સાહસિક કાર્ય કર્યા પછી પાછળથી એનાં માડાં ઝલ લાલે લોગવનાં પડે પણ અત્યારે તો બસ એમજ.

હૃદયમાં કંઈક નિશ્ચય કરી શાંખરાજ બુપચુપ પાછા ઇચ્છો. પોતાના એકાંત શયનબુહમાં આવી આરામ ઝુલા ઉપર પડ્યો. મનને શાંત પાડવા એનેક પ્રયત્ન કર્યા પણ કેચી રીતે એ ઉદ્ઘત મન શાંતિ પામણું નહિ. મનને ભૂલવા એનેક હીપમાળાના રંગ એરંગી પ્રકાશ તરફ નજર દેરવી તેમાં મનને પરોચું પણ મનમાં જે બ્યાકુળતા છલમલી રહી હતી તેમાં જ તે ઉછાળા માર્યા કરતું હતું. પલંગ ઉપર પોઢી નિદ્રાધિન થવાનો વિચાર કર્યો, પલંગમાં શાંખરાજ આમતેમ આળોઠવા લાગ્યો. છતાં નિદ્રાય

અત્યારે તો વેરણ બની ગઈ હતી. પ્રાતઃકાળ સુધી ધીરજ ખરવા કેટલી સહેનશીલતા પણ મનથતાવી શક્યું નહીં. મનની વ્યાદુળતાથી રાજ આખરે કંઈક નિશ્ચય કરી છિયો. દિવાનખાનામાં આવી મધ્યરાતના જાંખા પડતા દિયું કેને સતેજ કર્યાં. એક લાંખી ઝુરશી-બેઠકપર રાજ કંઈક વિચાર કરતો બેઠો. ત્યાં રહેલો પહેરગીરને હાક મારી. આવી માજુમ રાતે પહેરગીર મનમાં અનેક ગડ લાંગ કરતો શંખરાજ સામે કુર્નિશ બજવી ઉલો રહ્યો.

“જ ભણને બોલાવી લાવ”. રાજનો હુકમ સાંભળી પહેરગીર સલામ ભરી ચાલ્યો ગયો. રાજનું મન પાછું તોક્ષાનમાં ઓલાં ખાવા લાગ્યું. “અરે શું એ હૃદાને મારી નાંખાવું ? કે એને જંગલમાં હિંસક જાનવરોના ખોરાક માટે છાડી દઉ ? શું કરું ? આ મહાન પાપ હવે શંખપુરમાં તો નજ જોઇએ !” એ વિચારમાં એકચિતવાળા રાજને ભણ સામે હૃથ જોડીને ઉલો રહ્યાની પણ ખરર પડી નહિં, રાજની નજર જ્યારે ભણ ઉપર પડી ત્યારે વિચારમાંથી એકભૂમિ સાવધ થઈને બોલ્યો. “જો ! પ્રાતઃકાળે સૂર્યોદિય થતાં પદ્મરાણી કલાવતીને રથમાં બેસાડી ભયંકર જંગલમાં લઈ જઈ છાડી મૂક, જો એમાં જરા પણ ગરૂલત થશે તો તને હુક્યું સહિત મરાવી નાભીશ”. ભણને એ પ્રમાણે હુકમ ઝરમાવી શંખરાજ ત્યાંથી પોતાના શયનગૃહ તરફ ચાલ્યો ગયો.

રાજબાણી સાંભળી ભણ મનમાં અનેક વિચાર કરતો જ્યાંથી પોતાના બેર ગયો. રાત્રી હજુ વિશેષ હોવાથી એણે ચારવા માંડયું. પ્રાતઃકાળ થતાં વહેલો વહેલો નિત્યકર્મથી ખરવારી રથ તૈયાર કરી પદ્મરાણી કલાવતીના મહેલ આગળ આડા કર્યા. એ હૃથ જોડી મસ્તક નમાવતો ભણ પદ્મરાણીને ઝાંખેવા લાગ્યો. “માતાજી ! મહારાજ ઉપરનમાં પવાર્ય

છે, આજ આખે હિંસ ત્યાં આનંદમાં ગાળવાનો હોવાથી મને આપને તેડવા માટે મોકલ્યો છે. રથ તૈયાર છે આપ રથમાં ભીરાને એટલી જ વાર છે.” ભક્તની વાણી સાંભળી કલાવતી મનમાં ઝુશી થઇ, એણે સારાં વસ્તુ પહેરી બહાર જવા માટે તૈયારી કરી. “વાહ ! મહારાજની મારી ઉપર શું અખંડ પ્રીતિ છે ? રાજ મારી વગર જરાય રહી શકતા નથી કેથી ઉધાનમાં પણ મને તેડાવી છે. પતિનો આવો અપૂર્વ ગ્રેમ ગેળવવા માટે જગતમાં હું મોટી લાઘ્યશાળી હું.” કલાવતી મનમાં અનેક પ્રકારના વિચાર કરી મહેલના પગથીયાં ઉત્તરી આસ્તેથી રથમાં એડી. પદ્ધરાણીને રથમાં એસાડી લદે રથને હું કાર્યો. શાંખપુરના ફરવાન છાડી રથ જંગલને માર્ગ ચાલ્યો. પાણીદાર અથ્યો ભક્તના અભિ-પ્રાયને જાણતા જંગલને માર્ગ ધર્યા જતા હતા. શાંખ-પુરના બાણી ઉધાનો છાડી રથ જંગલમાર્ગ જતો જોઈ કલાવતી આલી થઇ ગઈ, તેનું જમણું નેત્ર ફરકવા લાગ્યું, અને મનમાં ગલરામણ થવા લાગ્યી.

“અરે ! તું મને કયાં લધ જય છે ? મહારાજ ક્યાં રહેલા છે ??”

“હવી ! હજુ બણે હૂર આપણે જવાનું છે. અરેરે ! એટલામાં મહારાજ તો બણે હૂર નિકળી ગયા જો !” લહે પાણીએ અશ્વોની લગામ મૂડી દીધી, અથ્યો હવામાં ઉડતા હોય તેમ શીખગતિએ રથ ચાલવા લાગ્યો.

જમણું નેત્ર ફરકવાથી કલાવતીને હૈયામાં પ્રાસકો પડ્યો. “શું સહ આ બધું સાચું બોલે છે ! મહારાજ કોઈ હિંસ આઠલા બધા હૂર જંગલ તરફ જતા નથી મે આજે ગયા એ તો અભયં !” કંઈ સમજતું ન હોવાથી મન અફળાતું શરીર બધું એચેન અની ગણું એ મનોહરે

ચંદ્રવહન પણ ભલાન થઈ ગયું; લાલીના અનેક વિચારો કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારેની પરંપરા મનમાં ગડભથ્થલ કરવા લાગી.

મધ્યાહ્ન થયો છતાંય હલુ મહારાજનો મુકામ જણાતો ન હતો. ધીરે ધીરે સૂર્ય પણ પચ્છિમ હિશા તરફ સિધાની જતો હતો. છતાંય ક્યાંય ડેકાણું નહોઠું. શાખપુરથી બણે દૂર નિકળી જવા છતાં પણ હલુ લયંકર જંગલ આવેલું ન હોયાથી રથને લદ્દ પુરપાય દોડાવે જતો. બીજુ તરફ સૂર્ય પણ નારાજ થઈને પોતાનો પ્રકાશ સંબરી લેવાની તૈયારી કરી રહ્યો હતો. જાણે આ અકાર્યથી નારાજ થયો કે શું?

કલાવતી હવે કૈર્ય ધરી શકી નહીં. અતિ સહનશીલ ખોવા છતાં પણ હવે તો હિમત હારી ગઈ, આ પુરવ મને ઝાં લધ જશે? સાંજ પડવાની તૈયારી ફાતી, છતાંય હલુ જંગલને માર્ગ અધ્યોને દોડાવે જતો જોઈ અફળાઈને બોલી “અરે દુષ્ટ! તું મને છતરે છે કે શું? આ તો લયંકર જંગલ આવતું જાય છે. મહારાજ તે આહી ક્યાંથી હોય? નથી તો ઉધાન કે નથી જેનોનો કોલાહલ કે અધ્યોના હણુહણુાટ” બોલ! આ ઘૂસું શું છે? સાચું કહે? ગુસ્સાથી લાલચોળ કલાવતી અની ગઈ.

બદ હવે અરજંગલમાં આવી પહોંચ્યો હતો. કલાવતી રાજરાણીને કોશાયમાન જોઈ પોતે પણ થથરી રહ્યો હતો. જેને માટે અત્યાર સુધી કરા પણ અપવાહ સાંલળવામાં આવ્યો નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તો હું નિર્દોષ: માર્ગ જધશ, એમ વિચારી અધ્યોને થોલાવી રહે ઉપરથી ઉત્તરી પણ્યો. “સાતાણ! મહાદેવી! ક્ષમા ક્ષો. હું નિરપરાધી છું. રાજનો હુકમ આ પાણી પેટેલે

ખાતર નામરજી છતાંય ઘણવવો પડે છે. શું કરું !” ભટ્ટની વાત સાંલળી કલાવતી ચમકી ગઈ. એનો જુસસો નરમ પણો. સારથી ઉપરથી એનો કોથ ઓસરી ગયો. ભટ્ટની આલુલુ બોધ એને દ્વાયા આવી.

“રાજાએ તને શું એવો હુકમ કર્યો હતો કે મને જંગલમાં છાડી હેવી ?”

“હા માતાજી ! મહારાજ શાખપુરપતિનો એ હુકમ છે કે તમને જંગલમાં તજી હેવાં, હેવી ભારો એ અપરાધ ક્ષમા કરો. ”

“કારણું ?” કલાવતીએ અજાયા થતાં પૂછ્યું.

“કારણું તો હુંય નથી જાણુતો !”

“ઓહ ! શું વિધાતા આજે વેરણું થઈ ?” કલાવતી ઘિણાછને રથમાંથી ઉતરી પડી. ચારે તરફ બાર જંગલ હજું; હિવસ અસ્ત થયો હતો. અંધકારનાં આગમન શરૂ થવાની તૈયારીમાં હતા. કલાવતીને અત્યારે મનમાં અકથ્ય વેહના થતી હતી. કલાવતીની વેહના બોધ લાદ પોછ્યો.

“હા ! વિગ ધિરા વિધિ તને ધિકાર થાયો. નહિ કરવા ચોણ્ય એવું અકાર્ય તો ભારી પાસે કરાવ્યું, હે હેવી ! હું પાપી હું. નિર્દ્યાનિર્માણેલું મારું નામ આજે મેં સાર્થક કર્યું. આ સતી નારોને જંગલમાં છાડી હું પાપી અધમ હવે નગર તરફ જાઉ હું. હેવી ! ભારા પાપ તમે ક્ષમનો. લિંસક પ્રાણીએથી લરચક આ બાર જંગલમાં અત્યારે તો તમારો ધર્મ, તમારું શીલ તમારું સ્ક્ષાણ કરશો. કરશો. ધર્મ આવા સંકટના સમયમાં જ તમને સહાય કરશો. સારથી ગદ્ગાદ કંઠે પોતાની નિંદા કરતો ને રહતો. કલાવતીની જંગલમાં હેવને ભરેરસે છાડી નગર તરફ ચાલ્યો. શાશ્વત રથથી ઉતરી એક વૃક્ષ તળે, બેઠેલી એકાડી

કલાવતી હૃદયમાં એકાઈ અસુંઅણ થવાથી મૂર્ચિત થઇ ગઈ.

વનની મધુરીને મંદમંદ પવનની લહેરોથી થાડી વારે કલાવતી જગત થઈને ધીમેથી બેડી થઇ તો તેની નજીર એક રાક્ષસી જેવી, હાથમાં કર્તિકા લધને ઉલેલી ભયંકર ચંડાલણી ઉપર પડી. રાજને મોકલેલી એ ચંડાલણીની ભયંકર ડાકણું જેવી આકૃતિ જેઠનેજ રાણી ભયથી થીલ ગઈ.

“કેમ હે છ શું? તારા હિવસો હવે ભરાઇ ગયા છે એ સમજ તું?”

“તું કોણ છે? અને કેમ આવી છે?”, જેમ તેમ કરી પરાણે હિંમત લાવી કલાવતી બોલી.

“હું કેમ આવી છું તે જે તને અતાવું, આ કર્તિકાથી આજુખંધવાળા તારા આ ઘનને હાથ છેદવા આવી છું સમજ કે પાખિણી?” ભયંકર અદૃહાસ્ય કરતી એ મનુષ્ય રાક્ષસી બોલી.

“મારા હાથ છેદવામાં તને શું લાસ?” કલાવતી નિશ્ચાસ નાખતી બોલી.

“લાસ! રાજણનો હુકમ અજાવું એલાલ. જાણતી નથી રાજ તારી ઉપર ઝ્યો છે તે?” ને તરત જ અધીર એવી ચંડાલણીએ આલૂષણ યુક્ત કલાવતીના ઘજે હાથ છેદી નાખ્યા ને અદૃહાસ્ય કરતી રાજણને એ હાથા અર્પણ કરવા નગર તરફ ગાલી ગઈ.

માનવી ન જણે કે, અમાર શું થવાનું છે,

ન જણું જાનકી નાથે સવારે શું થવાનું છે.

૫

### શીખ પ્રકાશ

અવળી ગતિ છે હૈવની, રખે પતિલે કોય,  
આરંભ્યા ચુંઝી રહે, અવર અચિત્યા હોય.

“હા માતા ! હા પિતા ! હા ભાઈ ! તમે ક્યાં છો ?  
અરે સૂર્ય પણ જેનું વહન જોવાને સમર્થ ન હોતો તે  
અત્યારે વનવગડામાં હિંસક પશુના ખોરાક માટે જીવી  
રહી છે. હા ! હેવ ! તમે વિકાર થાયો ! અરે ! આ મારાં  
ક્યાં પાએ ઉદ્ધ્ય આવ્યાં ? હા ! પ્રિયતમ ! તમે આ વગર  
વિચાર્ય શું કર્યું ? મને નિરપરાધીને આમ જંગલમાં પશુના  
ખોરાક માટે છોડી દીખી એ શું તમે સારું કર્યું ! અરે જરીકે  
તો તપાસ કરવી હતી ?. લગાર તો વિચાર કરવો હતો ?,  
મારી નિર્દેખતા જ્યારે સામીત થશે ત્યારે તમને કેદ્દોા  
પદ્ધતાપ થશે”. એકલી અદુલી પડેલી રાજરાષી કલા-  
વળીના હાથ એ ચંગલખી એ છેઢી નાખ્યા પછી તે દુઃખની  
મારી બેસાન થધ ગધ. વિધાતાએ એ રીતે ભવાંતસું  
કરેલ ભરપાઈ કર્યું છતાં એનું સર્વ નારાકરવાને તે તૈયાર  
નહોતો; મૃત્યુ પણ એનું લુચિતબ્ય હરવામાં. અત્યારે તો  
આળસું બની ગયું હતું. નેથી પૃથ્વીમાતાના ખોળે પડેલી  
કલાવતી વનના મંદમંડ વાસુથી કરીને પાછી લાનમાં  
આવી, ને વિલાપ કરવા લાગી. વનમાં ભયલીત મૃગ-  
દીની માઝેક ચારે તરફ પોતાની વિશાળ અને તેજવાળી  
આંખો ફેરવતી હતી. આકાશમાં ઉદ્ધ્ય પામેલાં તારલા-  
ઓનાં જીથ ચંદ્રના પ્રકાશમાં હુંબી જવાથી આછાં નજરે  
પડતાં હતાં, કવચિત વનચર લુયોની ભયંકર ગર્જનાએ.

કર્ષણા પડદાને ધમધમાવી હતી. આવા લયંકર જગં  
લમાં એના ધર્મ સિવાય એનું રક્ષણ કોણ કરે તેમ હતું?

“અરે માલ્યસને માયે આકૃત આવી પડે છે ત્યારે  
ચાહેનાસ અધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ  
પાતાને જ લોગબવાં પડે છે. પરલવે કંઈ પણ એવી અધમ  
કરણી કરી હશે કેતું આ કળ મલ્યું. પ્રાણથી અધિક વજાલા  
પતિએ પણ વેરીની અરજ સારી. અરે આ મારી આલૂપણ-  
ચુક્લ મનોહર ધારુ લતા અત્યારે તો ખાડિત થઈ ગાધ. અન્ને  
હાથ મારા કુંડા થઈ ગયા. હવે શું કરે? આ દુઃખ કોને  
કહું? ઇનું અને વિલાપ કરતી હુંમની મારી કલાવતી  
હવે માત્ર મૃત્યુની જ રાહ જેતી જળ વગરની માજ-  
લીની જેમ હુંમથી તસેકડવા લાગી. હસ્તની વેહનાએ  
એને આકૃતાન્યાકૃતા કરી હતી. પણ શું કરે? વિધિની  
અજભ કરામતમાં માનવીની બુદ્ધિ કંયાં સુધી ચાલી શકે?

પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપણ  
થઈ ગઈ હતી, તેથી આવા આકૃતના પ્રસંગે એને બીજી  
પ્રસ્તુતાન્ય વેહના પણ ઉત્પન્ન થઈ, “હા! હૈવ ! તું પણ  
અરાબર તારો અફલો લઈ લે. હર્જનની માકુક હેઠલું હૈવ,  
પણ એક દુઃખ જ્યાં મૂર્ખ થતું નથી. જ્યાં બીજુ તૈયાર  
કરે છે. હોથ ! તસે પણ સમય છે. જમતમાં સમયની  
અલિહારી છે,” પ્રસ્તુતની વેહનાથી કલાવતી તાંધી ઘસ-  
ડતી બસદાતી આગળ ચાલી. નશીદમાં જ બુધવાર કરતી  
પદ્ધંડ અને પ્રચંડ કાયાવાળી ર્યામ સર્વપા સિંહ નદીના  
કિનારો નશીક આવી, જ્યાં નાનાં નાનાં આડવાઓનાં  
જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આંતર પ્રે-  
શમાં આવતાં ત્યાં પણ કલાવતીને કેરલીએ વેહના થઈ, એ  
કષ્ણે સહન કર્યાં વગર કંઈ ઝુટકો નહોતો. કારણ કે એની

સારસંભાળ કરનાર કોઈ એની પાસે નહોતું. પાણીની માગણી કરતાં દુધનું પાન કરનારને અત્યારે ખુશ અખરે પૂછનાર પણ કોઈ નહોતું. સેંકડા દાસ દાસીએ પર હુકમ કરનારી અત્યારે તો જંગલમાં મૃત્યુના ખોળામાં હતી, હૈવની દ્વારા ઉપર જીવતી હતી. રોજ અમૃતના જેવું લોજન કરનારને અત્યારે તો નાળવા અન્નના પણ ઝરાંઝાં હતા, કુદરત જ્યારે ઇડે છે ત્યારે ગમે તેવા માનવીને પણ એ ખાના ખરાખ કરી નાખે છે પણ તેને કોણ જીતી શકે છે ?

કેટલોક સમય એ વેહના ચાલ્યા જ કરી. જણે હુમણાં જ મૃત્યુ આવશે કે શું એવી કારભી પીડા સહન કરતાં કલાવતીએ એક સુંદર ભાલકને જન્મ આપ્યો. ચંદ્રના પ્રકાશમાં ચંદ્રના જેવું મનોહર બાળકનું વહનકમળ બોધ માતા જરા હર્ષ પાભી. વળી એના સુખ ઉપર વિષાધની છાયા ઇરી ગઈ. “અરે ! અરે ! જંગલમાં જન્મનાર આ બાળકનું લાય કેવું હોશે ! એની સારવાર કરવા માટે મારે હાથ પણ નથી. કોઈ દાસીય નથી. વધામણી આપનાર પણ અત્યારે કોઈ નથી. હા ! આ બાળકનો વર્ધાપન મહોલ્સથ પણ કોણું કરે !”.

આ સુંદર ભાલકના જન્મ પછી કલાવતીની ચિંતામાં વળી વધારે થયો. જો કે બાળકના જન્મનો હર્ષ હોવા હતાં અત્યારની વર્તમાન પરિસ્થિતિએ એને મુંઝવી નાખી. તેમાંથી પોતાને હાથ નહીં હોવાથી એ સુશકેદીમાં વધારે થયો. પોતે એકદી હતી ત્યારે તો જીવનની એને કંઈ પરવા નહોતી. આ લયંકર જંગલમાં મૃત્યુ લલેને અત્યારે આવીને ભેટે, મૃત્યુ સાથે ભેટવા એ તૈયાર હતી. કેમકે ધર્મજિનોને મૃત્યુનો લય જરાય હોતો નથી. એને જ્ઞાનીએ તો ! એમની તો પ્રાતે શ્રી કરીએ ? એતો જીવન મૃત્યુમાં

સમદિષ્ટવાળા થઈ જાય છે. જગતમાં જ્ઞાનીઓના જીવનની તો અલિહારી છે.

ખાળકનો જન્મ થયા પછી કલાવતીના જીવનમાં પરિવર્તન થયું. ખાળકના મોહે એના જીવનમાં ભમતલાવ જાણુત થયો. પોતાના અને ખાળકના જીવન માટે એને ચિંતા થવા લાગી. “અરે ! આવા ભયંકર જંગલમાં અમારું શું થશે ? અરે પુત્ર ! તું લદે આવયો ! દીર્ઘ આચુષ્યવાળો થા ! મોટા ભાષ્યવાળો થા !” વારંવાર એ ખાળપુત્રના સુંદર વહનને નિરખતી પોતાનું વાત્સલ્ય અતાવતી હતી. પણ વિધિએ કલાવતીના એથોા આનંદ પણ છુંદ્વી લીધો.

એ ચચ્ચળ ખાળક માતાની ગોદમાં પડેલો ને કુદકા મારતો રહતો હતો એ દરમિયાન વીજળીના કડાકા લડાકા થાય અને મેઘની બોર ગર્જનાથી જંગલમાં રહેલા એકાડી માનવીનું હૈથું જેમ એકદમ ભયઅસ્ત થાય તેમ ખાળક ભયઅસ્ત થઈ માતાની ગોદમાંથી નીચે પડી ગગડતો સિંહુના જળ પ્રદેશ તરફ ચાલ્યો. ગયો અને કલાવતી બેખાડળી અની ગઈ, પોતાને હથ પણ નહોંતા કે એ ખાળકને ઝડપાડી લે ! અરે આતો રલ આપીને નહી માતા એને પોતાના ઉદ્રમાં સમાવી લેશે કે શું ? “હા ! હા ! ધિં ! ધિં ! વિધિ આ શું કરવા એડી ? અરે દુષ્પ વિધિ ! આઠદી બધી પુઢ્યી પડી છે, અનેક પાપીમાં પાપી માનવો જગતમાં વિધમાન છે છતાં તું મારે કેંડ કેમ પહણું ! અને એક ગરીબ રંક અખળાની ખાંચા ! તું તો મરતાને મારે છે. અહાદુર પુરુષો તો જગતમાં કાંઈ મરતાને પાડુય મારતા નથી. શરણે આવેલાને બચાવી લે છે. ને તું તો અરેખર નિયત છે. તારી નકદાઈની તે કાંઈ હદ છે ? નવગજના

નમસ્કાર તને !” બાળકની પણવાડે જ ધસડાતો આગળ ધસી. પોતાને હાથ નહીં હોવાથી નહીના તીર પ્રદેશ પાસે આવેલા બાળકને પોતાના એ ચરણો વચ્ચે રાખી રોકી લીધો પણ હવે લેવો શી રીતે ? ન હવે જે તે ચરણો-માંથી બાળક ખસી જય તો સિંહિનાં ઉડાં જળ સિવાય ભીજુ સ્થાન નહોઠું; શું કરે ! કેની મહદ માગે ?.

“હે નહીં માતા ! હે સિંહુ દેવી ! તમે પ્રયં શક્તિ-શાળી છો. હું તમારા ચરણોમાં ન મું છું. હીન, અનાથ અને દુઃખિના એવી ભારા ઉપર તમે હ્યા કરો. ભારા બાળ-કુનુ રક્ષણ કરો !” રૂહન ઉરતી કલાવતીની અરજ સાંભળવાની નહીં દેવીને પણ અત્યારે ક્યાં નવરાશ હતી ? આફું આવે છે ત્યારે ચારેકોરથી બમાલ કરતી આવે છે. દુઃખમાં ભાગ પડાવવાને કોણ આવે છે ? સુખમાંજ સૌકોઈ ભાગ પડાવે છે એવો જગતનો નિયમ છે. દુઃખમાં અત્યારે એ સતીની કસ્સાઠી અરાધર હેવ કરી રહ્યું હતું. સુવર્ણને અમિમાં શું તપાવું નથી પડતું ? ચંદ્ર અને સૂર્ય જેવા સર્મર્થ શક્તિશાળીને પણ રાહુથી કુચિત અસાવું પડે છે ત્યારે આ તો એક દુઃખી અવળા, તેમાંથી હાથ વિનાની.

“અરે જગતમાં જો શીલ જ્યવંતું હોય, શાસન-દ્વો પણ જો શીલને માનતા હોય, શીલ તરફ તેમનો લક્ષ્ણિલાવ હોય, એ જગતમાં પવિત્ર અને અલોકિક ગણુંતું શિથલ જો મેં પવિત્ર-શુદ્ધપણે પાણું હોય, અને મારું શિથલ કલાંક રહિત હોય તો હે દેવી ! હે નહીં માતા ! આ ભારા બાળકના રક્ષણનો ઉપાય કરો !” આફું કરતી એ સતીના તરફાટ અને શીલના પ્રભાવથી સિંહુ દેવીનું સિંહાસન કંપાયમાન શકું; સંભ્રમથી દેવી એક દમ તરકાજ સતી કલાવતી આગળ હાલ્યું થઈ. એના

કપાયેલા હાથને બદલે નવીન બાહુલતા પણ આભૂષણ-  
ચુક્કા પ્રગટ થઈ. સત્તી કલાવતી પોતાની બાહુલતા અને  
દ્વીને નિહાળી જુશી થતાં દ્વીની સુતિ કરી.” હે દ્વી !  
તમે જય પામો ! હે નિર્દેષ અને પવિત્ર માતા ! તમારું  
કલ્યાણ થાએના. મારા જેવી દીન, દુઃખી અને અનાથ  
અખળાયોનું તુંજ રક્ષણ કરનારી છા, જીવિત આપ-  
નારી છા.”

“સત્તી ! દુઃખમાં ધીરજ રાખજે. અવાંતરનું તારું  
મહાન પાપકર્મ હવે નામશોષ થઈ ગયું છે. સૌ સારું થશે.  
હજુ તારે આ પુત્ર સહિત વણ્ણા કાલ રાજસમૃદ્ધ લોગ-  
વવાની છે. હિંમત રાખજે” દ્વી તરતજ અદશ્ય થઈ ગઈ.

પોતાના અન્ને કોમલ હાથોવડે બાળકને તેડી લઈ કલા-  
વતી નહીના કંઈથી દૂર એક વૃક્ષ નીચે આવીને એડી. મનમાં  
અનેક વિચારે થતા હતા. વિચારેને અગે સંતાપ હતો,  
વ્યાકુળતાય હતી. “અરે ! પૂર્વે જે મેં શ્રમણીધર્મ સ્વી-  
કાર્ય હોત તો મારે આ આપદા ક્યાંથી આવત ? જેમનાં  
મનોમંહિર કામ પિશાચની વ્યાકુળતા રહિત છે, જેઓ શીલ-  
ધર્મથી સુશોલિત છે તેમજ જીનેથી રના આગમોનો અભ્યાસ  
કરવામાંજ જે પોતાનો કાલ નિર્ગમન કરે છે એવા શ્રમણ  
શ્રમણી વર્ગને મારેના નમસ્કાર થાએના.” પોતાના પાપની  
નિંદા કરતી કલાવતી ડસ્કાં ભરતી વનના પ્રાણીઓનેય  
રેખાવવા લાગી. કલ્યાંત ભરેલી એ ગોજારી રાત્રી પણ પૂર્ણ  
થઈ ગઈ. પ્રાતઃકાળનો સૂર્યોદિય થયો, પ્રભાતનાં પણ્ણી  
પોતપોતાની ભાષામાં કિલિકિલાઈ કરતાં મધુરા ગાનનો  
અસરંભ કરતાં હોવાથી વનપ્રકેશ પણ રમણીય લાગવા  
માંઓ. એ કુદ્દરતની લીલા જેવામાં કલાવતી પોતાનું

હંખ જરા વિસરી ગધ જણે કે રાત્રીની સાથે એનું હુંખ  
પણ પૂર્ણ થયું કે શું !

પ્રાતઃકાળે સૂર્યોદિય થતાં સિંહ નદીના જળમાં સ્નાન  
કરવાને આવતા એક તાપસની નજર ભાગ્યયોગે આ વન-  
દેવી કલાવતી ઉપર પડી, “અરે ! આ શું ! આ તે કોઈ  
વનદેવી કે વિધાધરી ! પોતાના બાળકને લધને કીડા કરવા  
આવતારી આ નાગાંગના કે નૃપાંગના ! આ કોણું હશે ?  
કોઈ દિવસ નહિ ને આજે આ દર્શય જોવાથી અકિત થયે-  
લો તે ધીરેધીરે કલાવતી પાસે આવયો, વિચિત્ર વેશવાળા  
આ પુરુષને જોઈ કલાવતીનું મન શાંકાશીલ થયું, છતાં  
દેવ ઉપર ભરેંસો રાખીને લાવીનો વિચાર કરતી સાવધ  
થઈ ગઈ.

“ખેણ ! આ લયંકર જંગલમાં તમે શું ભૂલાં પડ્યાં  
છો ? કે અકસ્માત આવી ચઢ્યાં છો ? ગભરાશો નહિ  
ધીરજથી કહો .” એ તાપસપુરુષની મધુર વાણી સાંભળી  
કલાવતીને હિંમત આવી.

“ભાઈ ! હું એક હુંખ અને હુર્ભાગના યોગે જંગ-  
લમાં આવેલી અનાથ સ્વી છું, જનશૂન્ય આ જંગલમાં  
તમે કાંઠીંથી ?”

અહીં નજીકમાં અમારો તાપસોનો આશ્રમ છે ત્યાં  
અમારા કુલગુરુ તમારું સ્વાગત કરશે, એમના ધર્મોપ-  
દેશથી તમારું હુંખ હૂર થશે, માટે ચાલો. તમને ગુરુજી  
સારો માર્ગ હેખાડશે.”

તાપસનાં વચન સાંભળી કલાવતી પોતાના બાળ-  
કને લઈ તાપસની સાથે ચાલી. તપોવનમાં આવેલી  
કલાવતીએ કુલગુરુને નમી પ્રણામ કર્યા તેમની આગળ  
હુાથ જોડી પેઢી. કુલગુરુએ કુશલવાર્તા પૂછી, “વત્સ ! આ  
લયંકર અરણ્યમાં એડાડી કાંઠીંથી ?”

કુલગુરુના જવાબમાં કલાવતી પોતાનું દુઃખ સાંભરી આવવાથી રહી પડી. કલાવતીના રદ્દનથી કુલગુરુએ અને વિશેષ ન પૂછતાં આધ્યાત્મન આપ્યું.

“વત્સ ! સંસારમાં સુખ દુઃખ એ તો પાપ અને પુણ્યદ્વારા વૃક્ષનાં ઇણ છે. પોતે જે કંઈ પાપ અગર પુણ્ય કરેલાં હોય છે તેનાં ઇણ કાલાંતરે જીવને લોગવવાં પડે છે. પોતાની કરેલી ઘુરાઈ અગર ભલાઈનાં ઇલ લોગવતાં હું કે શોક શું કરવો ? તાર્દ સંપૂર્ણ લક્ષ્યાખુલ્લાસ શરીર, ગંલીર વાળી તેમજ વિશાળ નેત્રો જોતા તું કોઈ કુલીન અને મોયા ભાગ્યવાળી છું. તાર્દ કલ્યાણ થશે માટે જરી ધીરજ ધારણ કરી સુખેથી થાડો સમય અમારા આશ-મમાં રહી તારા આ ભાગ્યવંત બાળકનું પાલન કરું અમારા તાપસીઓના સસુદ્ધાયમાં તને ઢીક પડશે, તો તાપસીઓના સસુદ્ધાયમાં રહી યથાશક્તિ ધર્મને આચર કે જેથી તાર્દ ભવિષ્યમાં સાર્દ થશે.” કુલગુરુની વાળી સાંભળી કલાવતીને સારા ભવિષ્યની આશા થવાથી એણે ગુરુની વાળી અંગીકાર કરી. તપસ્વીનીઓની મધ્યમાં રહી છતી કલાવતી બાળકનું પાલન કરતી પોતાનો કાલ વ્યતીત કરવા લાગી.

૬

પત્રાત્તાપ.

સહસાવિદધીત ન ક્રિયા-

મવિવેકઃ પરમાપદાં પદમ् ।

વૃણુતે હિ વિમૃશ્યકારિણ-

ગુણલુબ્ધાઃ સ્વયમેવ સંપદઃ ॥

ભાવાર્થ-વિચાર કર્યા વગર કોઈ પણ કાર્ય કરવું નહિ. એકદમ કોઈપણ કાર્ય કરી નાખવાથી પાછળથી મોટી આડતને કરેનારં થાય છે. લાંબો વિચાર કરીને કાર્ય કરવાથી એમાં વિજય મલે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

પ્રાતઃકાળે શાખરાજ મનમાં અનેક વિચાર કરતો સિંહાસન ઉપર બેઠેલો હતો. અભ્ય આકૃતિવાળો છતાં અત્યારે એના મનોમંહિરમાં વિચારની અનેક આછી વાદળી પસાર થઈ રહી હતી. પોતાના કાર્યના પરિણામની તે ઉત્સુકતાથી રાહ જેઠ રહ્યો હતો, પોતે જાણે મેટો ઈન્સાર કરી રહ્યો હોય, દુષ્ટ કામ કરનારે તેને યોગ્ય શિક્ષા કરી નયો સંતોષ અનુભાવી રહ્યો હોય તેમ શાંત ચિત્તે જાણે કોઈના આગમનની રાહ જેતો હોય એવા રાજના વહન ઉપર ઉદ્ઘાસીનતાની જરા જલાનિ હતી. એ દરમિયાન પેલી ચંડાલણી મહારાજની આજ્ઞા મેલવીને ત્યાં હાજર થઈ.

ચંડાલણીએ મહારાજને નમસ્કાર કરી બાળુખંધવાળા એ કોમળા નાભુક લતા સમા બજે હાથ શાખરાજની સમક્ષ રણુ કર્યા. પોતાની નજર સમક્ષ રણુ થયેલી એ નાભુક બાહુલતાને રાજ નિહાળી રહ્યો-એક ધ્યાને જેઠ રહ્યો. એક હિસસ આ બાહુલતા એ નાભુક દેહલતાને કેવી શાલાવી રહી હતી? મારા હાથવડે આ બાહુને હું રમાડતો હતો. આચલી રાજ્ય સમૃદ્ધિ છતાં વિપુલ સત્તા અને સાદ્ધારી છતાં આશકનાં આભૂષણ પહેરવાનું મન થયું, મને તો રહી રહીનેજ અત્યારે ભાન થયું. સ્વીએમની કુટિલતાનો પાર અન્ધા પણ ખરે પ્રામી શકતા નથી ત્યાં મારા જેવાનું શું ગળું?"

મહારાજ શાખરુપતિને વિચારથ૾ં પડેલો જાણી તેમજ એમના વહન ઉપર અનેક લિંગલિંગ પ્રકારની

વિચાર વાદળીએ પસાર થતી જાણી ચંડાલણી તો અયની મારી ત્યાંથી છ પાંચ ગણી ગઈ. રખેને રાજ કોપાયમાન થઈને પોતાનું સર્વ નાશ કરી ન નાણે ! મોદ્ય લેકેનો વિશ્વાસ શો ?”

એક ધ્યાન જોતાં અચાનક રાજની નજર ખાળુંથિએ ઉપર રહેલા ‘જયસેન’ એ અક્ષર તરફ ગઈ. જયસેન એ અક્ષર જોઈને-આતરી કરીને રાજ ચોંક્યો. અકસ્માત જાણે વિજળીનો આંચકો લાગ્યો કે શું ?

વરસાદના, વિજળીના, વાખુના અને ધરતીકંપના અકસ્માતો જ્યારે અને છે ત્યારે આ ધરતી ઉપર આશ્ર્ય-જનક ફેરદાર થાય છે. પરંતુ એક સતીઓમાં શિરોમણિ નારીને કલાંકિત ઘનાવી લયંકર શિક્ષા કરી દેવાની લુલા સમજાય છે, ત્યારે તો એ માનવીની બુદ્ધિનાં દેવાળાં હૃદાઈ આવે છે. ધરતિહાસનો પ્રવાહ પણ ત્યારે તો અદલાઈ જાય છે અને તેથી ગર્ભવતી સતી સાધ્વી સીતાળને વનવગડામાં એકાડી રખડતી મૂકનાર રામના કૃત્યને આજે પણ કોઈ વખાણું નથી.

“જયસેન તો કલાના ભાઇનું નામ ! શું કલાવતીના પિયરથી કોઈ આવણું છે કે ?” મનમાં વિચારી રાજએ ગજશેષિને ત્યાં પહેરળીર મોકલીને ગજશેઠને પોલાંબ્યા. રાજના હૃદ્યમાં તે દરમિયાન અનેક ઉલ્કાપાતો મચી રહ્યા. ધરતીકંપની માઝે એનું મજબૂત શરીર કંપાય-માન થવા લાગ્યું, રાજ આકૃણંબ્યાકુળ થઈ ગયા. “અરે જરા પણ તપાસ કર્યા વગર એકદમ મેં આ શું હોણી જગાવી ?”

ગજશેઠ મહારાજની સમક્ષ તરતજ હાજર થયા. એને જોતાંજ રાજ થાથરાતો યોદ્યો. “યોલ ? યોલ ?

દેવશાલપુરથી કોઈ આવ્યું છે ?”

“હા, મહારાજ ! હેવીને તેડવા સારુ રાજએ પોતાના સેવકોને મોકલ્યા છે. તે મારે ઘેર રહેલા છે પણ અવસર નહીં ભલવાથી હજુ આપના દર્શને આવ્યા નથી. ગજ-શોઠની વાત સાંભળી રાજના હૈયામાં દ્રાસકો પડ્યો. એ રાજસેવકોને તરતજ પોતાની પાસે પ્રોલાભ્યા. દેવશાલપુરના રાજસેવકો રાજ આગળ હાથ જોડી ઉલા રહ્યા. “મહારાજ ! આપનો જય થાઓ.”

“રાજએ હેવીમાટે કંધ મોકલાબ્યું છે વારુ ?” રાજએ રાજસેવકોને પૂછું શરૂ કર્યું.

“હા, રાજન ! આપને માટે તેમજ હેવી માટે અમૂલ્ય વસ્તો, આલૂખુણો વગેરે કેટલીક કિમતી વસ્તુએ મોકલી છે.”

“એ અધી કયાં છે ? અહીં હાજર કરો.”

“નરેથર ! કેટલાંક હેવીનાં વસ્ત્રાભરણ તો અમે પરમ દિવસે આવ્યા ત્યારે સાંજના હેવી માતાપિતાના કુશલ સમાચાર જાણવાને શોઠને ઘેર આવેલાં હતાં તે લઇ ગયાં છે. એમને પહેરવા માટે જયસેન કુમારે કીમતી હીરા માણેક જડેલા બાળુખંધ કરાવેલા હતા તે પણ હેવી લેતાં ગયાં છે.”

“એ બાળુખંધ તમે એળાખી શકો છો ?”

“કેમ નહિયું ? મહારાજ ! જયસેન મહારાજે ધણા સ્નેહથી પોતાની જ્હેન માટે હીરા, મણિ વગેરે રનોથી જડાવેલા એ બાળુખંધ બહુજ કીમતી છે.”

રાજસેવકોની વાણી સાંભળી રાજએ જયસેનના નામવાળા તે બાળુખંધ સેવકોને ખતાબ્યા. સુવર્ણના શ્રૂણમાં રહેલા તે બાળુખંધને જોઈ સેવકો બોલી ઉભ્યા.

“હા, મહારાજ ! આપ જુઓ, ઉપર જ્યસેન કુમારતું નામ છે તે.”

રાજની આંખે અંધારાં આવ્યાં, પોતાના અકાર્યથી જરૂર ક્રેચો બની ગયેલો રાજ મૂર્ચિત થઈ ગયો, સિંહાસનથી જમીન ઉપર પડી ગયો, ઘેલાન બની ગયો, રાજમહેલમાં હાહાકાર થઈ રહ્યો, રાજસેવકો દોડાદોડ કરી રહ્યા, રાજરાણીઓ, મંત્રીઓ વગેરે બધા પ્રાસાદમાં લેગા થઈ ગયા, અનેક શીત ઉપચાર કરીને મંત્રીઓ રાજને સાવધાન કર્યા.

સાવધ થયેલો રાજ બધા તરફ નજર કરતો ભનમાં અકથ્ય અતુલ વેહનાને અતુલબવતો હોય તેમ વિલાપ કરવા લાગ્યો, “અરે ! શા માટે મને સાવધ કરો ? અરે ! અરે ! કેવો હું હું ! કેવો હું અજ્ઞાની ? કેવો હું સુર્ખ ! કેવો હું ઉતાવળીયો ? કેવો હું નિર્દ્યમાં શિરોમણિ ! અરે ! અધમ અવા મેં આ શું અકાર્ય કરું ! હું હું મને કેવો લૂલાવ્યો ?” વિલાપ કરતો રાજ કરી ઘેલાન થઈ ગયો, “હું મને નિરાંતે મરવા હો.”

મંત્રીઓએ રાજને કરીને સાવધ કર્યો, “સ્વામી ! આ શું ? શું હકીકત છે એ તો કહો ? અકાર્ય આજે આપને આ શું થાય છે ? આઠદી બધી વ્યાકુળતા શી ?” રાજએ યુસુ રીતે કરાવેલી કલાવતીની હુર્દશા મંત્રીઓની ડેર્ઝ પણ જાણતું ન હોવાથી રાજના આ વલોપાતનું કારણ બીજાઓ શી રીતે સમજ શકે ?

“મંત્રીવર ! શું કહું ? મારું શાંખ નામ આજે સાર્થક થયું, આજ સુધી હું નામે શાંખ હતો હવે તો અર્થથી પણ મારું કાર્ય જ્યારે તમે સાંભળશો ત્યારે મારી ઉપર શુંકશો, અચીત લોકો પણ મારા નામનો પૂરેપૂરો દુર્ભ-

થોગ કરશે, કહેશે કે તું તો શાંખ જેવો છે. લપોડશાંખ છે. બુદ્ધિ વગરનો છે, વિચાર વગરનો ને ઉતાવળીયો છે, મહા ઝૂખ્યા શાંખભારથી છે.”

“પણ મહારાજ ! આપે એવું શું અકાર્ય કર્યું છે કે આપને આથલો બધો પશ્ચાત્તાપ થાય છે.” રાજના ઘોલવામાં કંઈ સમજ નહીં પડવાથી મંત્રીએ પૂછ્યું.

રાજને કહ્યું. “માં અકાર્ય તમારે જોવું છે ?” એમ કહ્યી રાજને થીજા સુવર્ણના થાળ ઉપર ટાંકેલા ઢવાલ ઉપાડી હૂર ફેંકી દીધો. બધાએ શું જોયું ? મનોહર નાઞુક કોણી સુધી કપાયેલા બતે હાથ !

“અરે ! આ શું ? બધાના સુખમાંથી અરેરાટી વજુટી ગાઈ. “આ કોના હાથ ? દેવીને તો કુશાલ છે ને મહારાજ !” મંત્રીએ પૂછ્યું.

એ દેવીનાજ હાથ ! એ પાપીએ-દુરાત્માએ આસજ્ઞ-પ્રસૂતા અને દ્વાપ રહિત એવી દેવીને મિથ્યા કલંકની શાંકાએ મરાવી નાભી. અરેરે ! મેં બહુજ લુંડં કામ કર્યું ! ચંડાલથી પણ હીણું કામ કર્યું. અકાર્ય કરી હવે કયાં જાઉં ? શું કરું ! હા ! દુષ્ટ વિદ્ધિ ! પાપિષ્ઠ ? તેં મારી પાસે આવું અકાર્ય કરાવી કયા ભવનું આ વેર વાખ્યું ? એક નિર્દ્દિષ્ટ મહાસતીનું મારે હાથે કરપીણ ખુન કરાવ્યું. હા ! હા ! હતાશ ! “રાજ વિલાપ કરવા લાગ્યો, કરેલા અકૃત્યનો થઈ શકે તેથલો પશ્ચાત્તાપ કરવા લાગ્યો.

શાંખરાજ વિગતા હૃદયે હાથની સુઢીએ વીજતો ને પોંચાને કરડતો ગુસ્સાથી એ સુશોલિત દિવાનખાનામાં આમતેખ આંદ્યા મારવા લાગ્યો” હા ! એક રાજ થઈ મારે હાથે કેવું અધોાર કામ થયું ; હાથ ! હૈવ ! હૈવ !

“પશ્ચાતાપથી ધરે છે, હૃદય આ મારં,  
નરા ઐરના અંગારે, ધરે હૃદય આ મારં;  
મરાવી પ્રિયાને, લોહીથી રંધું અંગ મારં,  
કપાવી નાજુકલતાને, કર્ષુ મેં કર્મ આ કાળું.”

રાજના આ અકાર્યથી બધા આલા થઈ ગયા. એક અભીજના મેં જેવા લાગ્યા, વાત નગરમાં પાણીમાં તેલ થીંદું નેમ પ્રસરી ગઈ. રાણી વર્ગ પણ વિલાપ કરતા લાગ્યો, અથે હાહાકાર થઈ ગયો. ક્ષણું પહેલાનો આનંદ સુકાઈ ગયો. ચારેકાર શોક સંતાપ ટળાઈ રહ્યો. મંત્રીએ,  
ગજશોક અને સેવકો પણ એક અભીજના મેં તડાસતા શું  
ઓલનું તેના નિયારમાં પડી ગયા. બીજુતરદે રાજના પશ્ચા-  
તાપનો પાર નહોંતો. “મહારાજ ? હવે શું થાય? શાંત  
થાએ. શાંત થાએ.”

પોતાની જતને તિરસ્કારની નજરે જેતો રાજ પશ્ચા-  
તાપની આગમાં જલી રહ્યો હતો. હજરો વીંઠીના  
ડંખોની વેદના અતુલવી રહ્યો હતો, સીલાર ઉપર સીલાર  
કરી રહ્યો હતો. હા ! હા !

“લોહીના ડાઢા, હજુ સુકાયા નથી”

પાપનાં કામો અરે! વિસરાયાં નથી;

રોતી કકળતી પ્રિયાને, કંગાલ કીધી રખડતી,  
મહેલાતમાં વસનારને, કીધી ઘરોધર લઘકતી.”

પશ્ચાતાપ રૂપી કીડો રાજનું હૃદય કોતરી રહ્યો હતો,  
પોતાના અકાર્યથી એક આંખે શ્રાવણ ને બીજી આંખે  
ભાડરવો વહેવડાવતો રાજ ચોંધાર અંસુડાં પાડી રહ્યો  
હતો. અરે બગડેલી બાળ હવે શી રીતે સુધરી શકે?  
કુણી કુમળી ભિલેલી કોમળ લતાને મેં પાપીએ બાળી  
ભર્મ કરી નાખી. મારાં એ નવપ્રસૂત બાળકનું શું થયું

હશે ! અરે એ મારી પ્રિયાનું મોં મને ડેણ ઘતાવે ! એનું મનોહર હસમુખુ વહન હું ક્યારે નિહાળીશ ! એ અક્ષત અંગાપાંગવાલી પ્રિયા મને ડેઈ ઘતાવે ? એ નિર્દ્દિષ્ટ પ્રિયાને સંતાપી-દુઃખી કરી હું હજી જવું છું ? અરે હૃદ્ય ! તું ઝાટી જા, ઝાટી જા, ભુંડ કામ કરતાં લેશ પણ વિચાર નહિ કરનાર હે નિંદુર ! નિર્દ્દિષ્ટ ! હવે તને જવતાં લાજ નથી આવતી ? પ્રિયાને મરાવી નાખી હવે દુનિયાને શું મોં ઘતાવવા તું જીવે છે ? . વિષુસીળ, કુટીજા, ”

“હુસાવી જો સત્તી નારી, જીવ્યા તો શું મુખ્યા તો શું ?

નિર્દ્દિષ્ટ પ્રણાને સંતાપી, જીવ્યા તો શું મુખ્યા તો શું ?

કરી જારી વ્યલિચારી, જીવ્યા તો શું મુખ્યા તો શું ?

રીખાવી જો લલી નારી, જીવ્યા તો શું મુખ્યા તો શું ?

“મારે હવે તો આ મહાન પાપનું પ્રાયશ્ક્રિત કરવું જોઈએ, નિર્દ્દિષ્ટ અને પવિત્ર પ્રિયાને મરાવી નાખી ક્યા સુખને માટે મારે જીવવું જોઈએ ? મંત્રીધર ! નગરની અહાર તમે કાષ એકત્ર કરી ચહે તૈયાર કરાવો, જેમાં આ મારા પાપી ઢેહને જલાવો ? ખસ ! એજ નિશ્ચય મંત્રીધર ! જેમ અને તેમ ચેહ તાકીદ તૈયાર કરાવો.”

ક્ષત ઉપર ક્ષારની જેમ કાષભક્ષણની વાત સારાય નગરમાં પ્રસરી ગઈ. બધીય નગરી હલમલી ગઈ. રાણીએ કરુંશુ રહન કરેવા લાગી. મંત્રીએ અનેક રીતે રાજને સમાનવવા લાગ્યા. મોદ્ય મોદ્ય રાજપુરેષા, નગરના મહાજનનો રાજને વિનવવા લાગ્યા. રાજ મહેલ આગળ અનેક માનવીનાં જુથ ઉલ્લરાવવા લાગ્યાં, શોકસાગરમાં ડુષ્પેલા બધાય રહી રહ્યા હતા, નગરની નારીએ પણ વિલાપ કરતી, ચોધાર આંસુડાં પાડી રહી હતી. એ બધાંકર દિવસે માતા-ઓએ પોતાનાં ખાળકોને પણ ધવડાવવાં છોડી દીધાં.

રાજને લુચતો રાખવા માટે અનેક પ્રયત્નો થવા લાગ્યા. અનેક લોકો અરજ કરવા લાગ્યા. “અરે નરેશ્વર ! તમે એક તો મહાન અકાર્ય કર્યું, હવે વળી બીજું એથીય મહાન અકાર્ય કરી શા માટે દાઢેલા ઉપર અંગારો નાખવાની છંઘા કરો છો ? સંસારમાં લીડ પ્રાણીઓના આપ આધારે છો, આપ જ જ્યારે ધીરતા છાડી દેશો ત્યારે અમારા અધારની શી ગતિ ? આલદુક પણ ધરને બાળીને અજવાળું કરતો નથી. આપ જરૂર તો વિચાર કરો ? “દુઃખ માટે ધમારત ફોણ તોડી પાડે ?”.

મંત્રીઓની અનેક પ્રકારની આજીજી છતાં શાખરાજ અથુ ઉપર સ્વાર થઈને નગરની બહાર બળી ભરવાને ચાલ્યો. એ બળતા લુગરમાં કોઇની આજીજી ઠંડુ જળ રેઠી શકી નહીં. ધગધગતા હૃદયવાળો રાજ પોતાના નિશ્ચયમાં અડગ હતો. તેના પશ્ચાત્તાપથી ધગધગતા હૈયાનો આવેશ રોકવાને કોઈ સમર્થ થયું નહીં. રાજ અભિ ભક્ષણ કરવાને નંદનવનમાં આવ્યો જાણી અનેક જનો ઝદન કરવા લાગ્યા, નગરની ખાનહાન અને ઉચ્ચકુદુંથની નારીઓ છાતી કુદ્દી ઝદન કરવા લાગી, રાજની પાછળા મંત્રી વર્ગ, મહાજન તેમજ રાજ્યાધિકારી પુરુષો આવી પહોંચ્યા રાજના નિશ્ચયને કોઇ રીતે ફેરવવો જોઈએ પણ કંઈ રીતે ?

કોઇની શીખામણ કે વિનાંતિનો અસર રાજને થઈ નહીં અને રાજએ જ્યારે ચેહમાં બળી ભરવાની તૈયારી કરવા માંડી ત્યારે બીજો કોઈ ઉપાય નહીં ચાલવાથી ગજ શેડે રહે રહે વિનાંતિ કરી. “સ્વામી ! અહીં નાલુકમાં જીનેશ્વર અગવાનનો પ્રાસાદ છે તો આપ પ્રથમ વીતરાગ અગવાનની પુણ્ય વગેરેથી પૂજા કરી દ્યો”

પરલખનું ભાતુ સાથે આવતુ જાણી રાજને તે શૈઠનું વચ્ચન માન્ય કર્યું, ઇડે ભાવે સ્નાન કરી પુણ્યાહિકથી જુને થેરની મહાન લક્ષ્મિ કરી. તે પછી નાલુકમાં રહેલા અમિત સેજ નામના જાણી મુનીથર પાસે ગજશેડ રાજને લઈ ગયો, રાજને ગુરુને વંદન કર્યું, જાણી ગુરુએ રાજની મુશ્કેદી જાણી ઉપદેશ આપ્યો.

“જીન્મ, જરા અને મૃત્યુથી ભરપુર આ સંસાર-સાગર દોગ, શોક, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. તેમાં હેવતા, નારકી, મનુષ્ય અને તિર્યાંચ એ ચારે અતિમાં જીમણું કરતા પ્રાણીઓએ અનંત હુંઘ લોગવે છે. કોષ, માન, માયા અને લોલદ્વી આરે સર્વોચ્ચી ડસાયેલા પ્રાણીઓએ સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર કિલકિલાદ કરી રહ્યા છે. કોષ એ વ્યાતમાનો અધોગતિ લઈ જનારો લયંકર હુંગુણું છે. કોષને વશ થયેલા પ્રાણીઓએ હે રાજન ! તાર્દી માફક કર્યા અનર્થને નથી કરતા ? કોષાવીન પુરુષો આલોક અને પરલોકમાં હુંઘને જ લજનારા થાય છે. એ લયંકર કોષ સર્વથી ડસાયલો પદ્મરાજ કંઈ એણા અનર્થને પામ્યો નથી.”

“એ પદ્મરાજ કોણ ? અને શી રીતે અનર્થને પામ્યો ?” રાજ શાંખ ભૂપતિએ ગુરુમહારાજને પૂછ્યું.

કાષલક્ષણ માટે તૈયાર થયેલા રાજને ગજશેડ એક રીતે વિલંઘ કરાવવા માટે વચ્ચમાં જીનપૂજન અને ગુરુ વંદન એ એ મહાન પ્રસંગો ઉલા કર્યા. એ અજ્ઞે પ્રસંગો ચૂકુના ધગધગતા હૈયાને આધ્યાસનદૃપ હોવાથી રાજ એ પદ્મલૂપસંગો ઉજવી લેવા તૈયાર થયો, જીનપૂજન કરી ગુરુવંદુનો લાલ લીધો, ગુરુ વંદનનો લાલ લેતાં પરલખના સારા શાખ્યાદ્યે ઉપદેશ સાંલળવાની તક મળી.

અને તેમાંથી પાછી સાંભળવાની લજાસા જાગૃત થધ.  
પાપનો ઉદ્ય છતાં હું ખમાં પણ મહાન પુરુષાનું પુરુષ ચુમા-  
પણ કોઈ અજથ રીતે કામ કરે છે.

રાજાની આતુરતા જાણી હુર મહારાજે કહ્યું, “રાજન!  
એ પદ્મરાજાનું કથાનક પણ તારે સાંભળવા જેવું છે. તારા  
નિમિત્તે કરીને આ ખધી પર્વદાને પણ એ કથાનક સાંભ-  
ળવાથી લાલ થશે”.

૭

“પદ્મરાજ”

કોહો પીં પણ સેહ, માણો વિળયનાસણો ।

માયા મિત્તાળિ નાસેહ, લોહો સાંબિણાસણો ॥૬॥

ભાવાર્થ—જગતમાં કોથ પ્રીતિનો નાશ કરે છે, માન  
વિનયનો નાશ કરે છે, માયા ભિત્તાનો નાશ કરે છે, ત્યારે  
દોાલ સર્વનાશ કરે છે.

પૂર્વે પદ્મપુર નગરમાં લક્ષ્મીને પ્રિય, ન્યાયપરાયણ  
પરનામે રાજ હતો. એક દિવસે રાજવાહિકાએ ઝરવા  
જતા રાજએ વરુણશોઠની અદ્ભૂત લાવજ્યવતી અને  
સાખીએ સાથે કીડા કરતી કન્યાને જોઈ. અંતઃપુરમાં અનેક  
રાણીએ હોવા છતાં પદ્મરાજ એ કન્યાના સૌંદર્ય ઉપર  
દ્વિનાનો થઈ ગયો—માગણી કરી પરણી ગયો.

પરણીને રાજકાર્યના વ્યવસાયને અગે કહે કે કન્યાના  
હુલ્લાંયે કહે. રાજ કન્યાને ભૂલી ગયો. અનેક વધેનાં  
નહાણાં વહી ગયા પછી રાજએ ઝરી એ માર્ગ જતાં એ  
કન્યા— પ્રૌઢ ચુવતીને જોઈ. સુંદર વસ્તુ અને આભૂષણ

રહિત માત્ર સાદા પોષાકમાં હોવા છતાં પણ આકર્ષણ થવાથી રાજએ મંત્રીને પૂછ્યું “આ યુવતી કોણ છે ?”.

“પૂર્વે આપે પરણીને તલુ દીધેલી વરણશોઠની કન્યા અને આપની ધર્મપત્ની છે.”

મંત્રીની વાત સાંભળી રાજને પદ્ધતાપ થયો. “અરે ! આવી કુલીન સ્વાને પરણીને મેં તલુ દીધી તે સારું કર્યું નહિએ.”

રાજએ એ સ્થીને પોતાના અંતઃપુરમાં તેડાવી. રાજકાર્યથી પરવારી નિશા સમયે રાજ વહેલા વહેલા નવી પત્નીના મહેલે ગયો, નવીન નવોદા પત્નીને જોતાં રાજએ કહ્યું. “પ્રિયે ! પરણીને મેં તને તલુ દીધી એ મારો અપરાધ માટે કરને”. રાજની લોગણી જાણી રાણી બોલી. “મહારાજ ! એમાં આપનો શું હાથ ? મારો પરલખનાં પાપ, કે જેથી મને આપના દર્શનનો લાલ મળ્યો નહિએ”. પોતાના હાથને જોતારી રાણીને જાણી રાજ મનમાં ઝુશી થયો.

એ નવોદા નારીએ પરણ્યા પછીની પહેલી રાત્રી આજે જ રાજ સાથે સુખમાં વ્યતીત કરી. રાજએ શરમને મુકાવી એટલે રતિકલામાં પ્રવિષ્ટ એ નારીએ શરમને તલુ કામકલાની અનેક કુશળતાએ ઘતાવી-પ્રગટ કરી. રાજને ઝુખ રાણું કર્યો. પાપને લીધે જગતમાં કોઈ વખતે ગુણપણ હાથને માટે થાય છે એ નિયમને અતુસરીને કામકણામાં આ નારીની અપૂર્વ અતુરાધ જાણી રાજના મનમાં સહેજ શાંકા થઈ આવી. “લોગ વિલાસ લોગવ્યા વગરે ભલા આ સી આવું કૌશલ્ય શી રીતે જાણી શકે ? નક્કી આ નારી જરી વિજારી રમનારી છે”. શાંકાને વશ થયેલા રાજએ તરત જ મારી નાંખવાનો વિચાર કર્યો.

પણ જ્ઞી અવધ્યા હોવાથી એને જંગલમાં રખડતી ઝુકી દેવી જેથી તે આપોઆપ મૃત્યુને પામી જશે. રાજએને શું ? વિચાર થયો કે તરત જ એને અમલ.

મંત્રીને એલાવી રાજએ તરત જ પોતાની હડીડત કહીને એ રાણીને હિસ્ક પ્રાણીએને શિકાર થયા જંગલમાં છાડી દેવાનો હુકમ કર્યો. સમયને જાણુનારા મંત્રીએ અત્યારે રાજને કંઈ પણ શિખામણ ન આપતાં તેમની વાત કબુલ કરી દીધી. નવી રાણીને જંગલમાં છાડવાને ઝડાને લઈ ગયો ને પોતાના મહેલના લોંઘરામાં ગુમ્ફપણે છુપાવી દીધી. એ રડતી નારીને ધીરજ આપી. બુદ્ધિનિધાન મંત્રી રાજ પાસે આવ્યો પોતાના મનનો ભાર હવે હલકો થયો. હોવાથી રાજ ખુશભીજજમાં મંત્રીએ અને સભાસદો સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો, મંત્રીએ પણ અવિચારી રાજતું શાલ્ય હૂર થાય તેવી એક રમુજ ભરી કથા કહેવા વિચાર કર્યો.

“મહારાજ ! આપણા નગરમાં એક આશ્રમકારી બનાવ અન્યો છે તે આપના જાણવામાં આવ્યો કે ?” મંત્રીએ શરૂઆત કરી.

“કહી સંભળવો તો વાર્દ, રી નવાઈની એ વાત છે ?” રાજ સહિત અન્ય સભાસદો પણ મંત્રીની વાર્તા સંભળવાને અધીરા થયા.

“આપણા નગરમાં ધન્ય નામે એક બ્રેષ્ટી હતો. તેને શ્રીમતી નામની ભાર્યાથી ચાર પુત્રો થયા. ધન, ધનદ, ધર્મ અને સોમ. એ ચારે પુત્રોને પરણાવી શોઠ પોતાના ધંધામાં પારંગત કર્યા. એક દિવસ ધન્ય શોઠ ભીમાર થયા, એ ભીમારીએ લયંકર રૂપ ધારણ કર્યું, શોઠનો ભરણુકાદ સમીપે આવ્યો, ત્યારે સગાંસંખંધી વગેરે બધાં લેગાં થયાં,

તેમના આગહથી શેડે પુત્રોને શિખામણ દીધી." તમે ચારે ભાઈ સંચીને રહેલો, નાના મોયાની મર્યાદા સાચવીને રહેશો તો કલેશનો સંભવ નહીં રહે છતાંય જો જુદા થાઓ તો આ ખંડની ચારે દિશાએ (ખુણે) ચાર કળશા હાટેલા છે તે તમારે અનુકૂળે લઇ લેવા." તે પછી ધન્યરોઠ મૂલ્ય પામી ગયા, તેમની ઉત્તર કિયા કરી કેલોક સમય તેઓ સંચીને રહ્યા પણ ખીચ્યાની ખરપણે તેમને જુદા કર્યા.

ચારે ખુણેથી તેમણે કલશ કાઢી લીધા. ધનના કળશમાંથી ધૂળ નિકળી. ધનના કળશમાંથી હાડકાં નીકળ્યાં, ધર્મના કળશમાંથી શાહી નિકળી ત્યારે સોમના કળશમાંથી સુવર્ણ મહોરે નિકળી. સોમ તો રાજ રાજ થઈ ગયો. પણ પેલા ત્રણે ઝાખવાણા ફીકા પડી ગયા. આ અપૂર્વ ધનાવથી સગાં સંખાંથી પણ લેગાં થઈ ગયાં, એક ખીજા વાદવિવાદ કરવા લાગ્યા. પણ સોમ પોતાનામાંથી લાગ આપવા રાજ નહોતો જેથી સગાં સંખાંથી પણ તેમના વિવાહનો નિવેડો લાવી શક્યા નહીં. બધા વિચાર કરવા લાગ્યા" એના પિતા જાંદી છતાં આ ત્રણે મોયા ભાઈ આને કેવો ગેરધનસાંક કર્યો?"

ત્રણે મોયા ભાઈઓ પણ પિતાને ઓળાંભો હેવા લાગ્યા. "આરે! આપણા પિતાએ નાના ભાઈને ખંડું આપી આપણું મારી નાખ્યા."

ત્યારે નાના ભાઈએ કાંઈ ન આપું, એમનો ધનસાંક કોઈએ ન કર્યો?" રાજએ વચ્ચમાં મંત્રીને પૂछ્યું:

જ માસ સુધી તેઓ રાજકોચેરીમાં ધનસાંક કરાવા આવ્યા છતાં ન્યાય નહીં મલવાથી નિરાશ થઈને ચારે ભાઈ પરદેશ ગયા. માર્ગમાં કોઈ એક ગામમાં તેઓ જઈ ચક્યા. ગામના ચોરે-ચકલે ઘેઠેલા વૃદ્ધ પણુંપાલે તેમને

બેયા. પશુપાલ ગામનો પદેલ અને પંડિત હતો તેણે આ ચારેને પરદેશી જાણી પૂછ્યું.” કયાંથી આવો છો ક્યાં જાઓ છો ?”

પશુપાલની વાણી સાંભળી ચારે ખાંધવો તેની પાસે આવ્યા, નમીને પોતાની હકીકત વુદ્ધ પશુપાલને તેમણે કહી સાંભળાવી. તેમની હકીકત સાંભળી પશુપાલ બોલ્યો. “પુત્રો ! તમારા પિતા વિક્રાન અને ડાદ્યા છે તેમણે તમારા ચારેનું હૃત કરેલું છે એમ લાગે છે.”

“શી રીતે ? હે પૂજ્ય ! તો અમને સમજવો ? અમારો વિવાહ નિવારો.” એ સુસાફરીથી કંચણેલા ચારે ખાંધવો બોલ્યા.

“પુત્રો ! તમારા પિતા વિચક્ષણ હોલાથી મને લાગે છે કે જે પુત્રને જે યોગ્ય હતુ તેજ તેને આપેલું છે. મોયાના કળશમાં કૂળ નિકળવાથી એ પુત્રને જમીન જાયગા એતી-વાડી ખંડું આપી દીધું છે. ધીજના કળશમાં હાડકાં નિકળ્યાં તેની મતલબ એકે તેને ગાય, લેંસ, બળદ, બોડા વગેરે આપેલું છે એમ સમજવું. ત્રીજને શાહી આપવાથી દુકાનનો વ્યવસાય, ખાતાં, પતરાં, દસ્તાવેજો, રાજ-સેવા વગેરે જેનો નિભાવ લખવા ઉપરેજ ચાલે છે તે ખંડું અને સોંપી દીધું, અને ચોથો જે ભાલક અને નાનો છે તેને કોઈપણ વ્યવસાયની અજ્ઞતાને લીધે ઘરની સુવર્ણ ભહોરો એટલે રોકડ રેકમ આપી છે. આ સત્ય ધનસાફ છે, છતાં એમાં હુદે જેને અધિકું યા એાણું ભાગે આવતું હોય તેમણે પોતપોતાના ભાગમાં આવતી વસ્તુએની કીમત ગણી સરવાળો કરવો એટલે તરતજ ખખર પડી જશે. છતાં ચપળ લક્ષ્મીના માટે તમે ડાદ્યા થઈને અંદરઅંદર જબડશો નહિં.”

પશુપાલની વાણી સાંસળી ચારે મનમાં રાજુ થયા. ચારે સમન્યા કે પિતાએ ધન્સાડ ખરાખર કર્યો છે. ચારેના ભાગમાં લગભગ ઢાલત પણ સરખીજ આવે છે જેથી મનમાં રાજુ થઈ પશુપાલના પગમાં પડ્યા. પોતાનો વિવાહ લાગવાથી એનો ખડુ ખડુ આલાર માન્યો તેમજ મોટા નણે લાઈએને નાના ભાઇને જે વિડાઘના કરી હતી તેની ક્ષમા માણી. અથ્વા હળીમળી એક થઈ પશુપાલની રાજ લઈ પોતાને વેર આવ્યા. ખુશી થયા છતા ચારે બંધુએ એએ વર્ધાપન મહોત્સવ કર્યો.

મંત્રીની ચા વાર્તા સાંસળી સર્વે સર્વોએ આનંદથી મસ્તક ધૂણાવવા માંદયાં, રાજ પણ પશુપાલની ધન્સાડ કરવાની ચાલાકીથી ચક્કિત થયો “તે પશુપાલે બધું શી દીતે જાણ્યું હશે? છતાંય કલાવન પશુપાલે પોતાની હેંશીયારીથી ચારેનો વિવાહ લાગી ન્યાય કરી દીધો તેમ પ્રિયા પણ શાસ્ત્રજ્ઞ હોવાથી કામશાસ્ની નિપુણતાને દીધે કામકલાથી મને રંણુત કરે તો એ સંભવિત છે, નાહંક એના ઉપર શાંકા લાવી મેં એને જગંગલમાં હિંસક જાનવરનો શિકાર બનાવી દીધી.” રાજ પણ પશ્ચાત્તાપની આગમાં જલી રહ્યો, મંત્રીએ રાજનો હૃદય પદ્દો પારખ્યો, શોક સાગરમાં ભર્મ થયેલો રાજ મરવા માટે તૈયાર થઈ ગયા. “હે મંત્રી! મેં મહા પાપકર્મ કર્યું છે કામશાસ્ને જાણુનારી નિર્દ્દેખ અને પવિત્ર સ્ત્રીરત્નને મેં મરાવી નાખી, પિતાના વેર સુખમાં રહેલી એ શુદ્ધ પ્રિયાને મેં હુંઘના મહીસાગરમાં ધકેલી દીધી. હા! હા! મારાં પાપ! અમાપ છે માટે હવે પ્રાણેને ધારવા હું સમર્થ નથી, અમિની ચેહે ખડકાવ જેમાં બળીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ.” રાજને ખરેખરો પશ્ચાત્તાપ થતો જાણી, તકવર્તીને

મંત્રીએ રાજને આનગીમાં કહ્યું “સ્વામિન! આપ ધીરજ થરો! આપની પ્રિયા હજુ હૃત્યાત છે, આપ પશ્ચાત્તાપ ન કરો.”

રાજની આજ્ઞાથી મંત્રીએ નીશાને સમયે ચુપ્ત સ્થાને રક્ષણ કરેલી રાજપત્નીને રાજ સમક્ષ રજુ કરી, એ પ્રિયાને સાક્ષાત જોઈ રાજ મંત્રીને લેટી પડ્યો “વયસ્ય! હું મારો ખરો મિત્ર છે! મારી પ્રિયાનું રક્ષણ કરી તે આજે મને નવળુંન આપ્યું. માર્દ લુંબન અચાચ્યું.” મંત્રીનો સત્કાર, સંમાન કરી રાજએ તેને ન્યાલ કરી દીધો ન એ પ્રિયામાં વિશેષ અનુરક્ત થયો. અને રાજ સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.”

“એ પદ્મરાજની માર્ક તું પણ સ્થિનો ત્યાગ કરી હુવે મૃત્યુ સાથે લેખવાને તૈયાર થયો છે કેમ અદ્દને? પણ ધર્મજીજનોએ બીજાના નાશની જેમ પોતાનો નાશ ન કરવો. જગતમાં આત્મધાત-આપધાત સમાન મહાન પાપ બીજુ કોઈ નથી, માણે આત્મધાતજ જો કરવો છે તો પછી એના કરતાં સર્વ દુઃખને નાશ કરનાર અને સુગમ એવો આર્હત ધર્મ કેમ ન આચરવો?”

જ્ઞાની ભુનિ અમિતતેજનો ઉપહેશ સાંભળવા છતાંય રાજના મનનો વિચાર કાંઈ બદલાયો નહિ. “લગવાન! દુઃખ દાવાનલથી બળેલા મારા જેવાની વાતજ શી કરવી? આપ મને ધર્મરૂપી શાખાલ આપો! જેથી ભવાંતરમાં મારા આત્માની શુલ્ગ ગતિ થાય.”

રાજન! મોહને આધિન થયેલો તું હજુ મૃત્યુને છચ્છે છે શુ? પદ્મરાજની માર્ક લુંબતો નર અદ્રા પામશો, એતો વિચાર? જરા તો ધીરજ ધર? ”

સ્વામિન! ધીરજ તે શીરીતે રહે? એં પાપીએ મરાવી

નાખેલી પ્રિયા કંઈ પાડી મને મસે તેમ છે ? રાહના ભાવ તો રાતે વહી ગયા ! ચેં પાચીએ હાથ આવેલું ચિંતામણિરલા સમુદ્રમાં ફેંકી દીધું. હવે શું થાય ?

રાજનો પશ્ચાત્તાપ જોઈ ગુરુ બોલ્યા. “રાજન ! હું ખથી હું ખુંઝાઈ ગયો છે પણ ધીરજ ધરવાથી ખબુંય સારું થશે. ધર્મના પ્રલાઘથી તારું સારું થશે, કારણકે નિરાશામાં અમરે આશા છુપાઈ છે. તે માટે કપિલનું આખ્યાન સાંલળા. એક લુલ કરી તેના ઉપર થીજુ લુલ કરનાર કપિલની માર્ક તું અનર્થની કરનાર નથી.”

૮

### કપિલ આખ્યાન

સુયણાણ નિદ્રણતં, કુણા કુલ બાલિયાણવિહવતં ।

ઇચ્છ્યણનિષ્ફલતં, ધિરત્થુ બુદ્ધિ પયાવહણો ॥૧॥

ભાવાર્થ—“પાંડિત અને ગુણવાન પુરુષોને નિર્બન અનાભ્યા, કુલવાન પુત્રીઓને વિધવાપણ અને શૈરીને ઇલ વગરની કરનાર પ્રજાપતિ( અશ્વા )ની ખુદ્ધિને ધિક્કાર થાએા.”

પૂર્વકાલને વિષે ગંગા નદીને કીનારે રહેલા કોઈક સંનિવેશમાં ખટ કર્મભાં તત્પર અને દીવસમાં નણવારે સ્નાન કરેનારો કપિલ નામે આખ્યાણ રહેતો હતો. શૌચ કિયા-માં તત્પર એવો તે આખ્યાણ અપવિત્ર થવાના ડરથી બેરથી અહૃત પણ કવચિતજ નિકળતો હતો, કોઈ માણસ જરા અડી જાય તો સ્નાન કરતો, કૃતરાં, બીલાડાંનો જરા સ્પર્શ થાય તોય નાહી નાખતો, ગાય સેંસ કૃતરાં બીલાડાં આહી અનવરના કરેલાં ખુત્ર કે વિષા ઓળંગવી પડુ કે એમાં

ભૂલે ચુકે પગ પડી જાય તો ય નાહી નાખતો. દિવસ લરમાં તે જણે કેટલીય વાર નાહી નાખતો હશે, એવા તે શૌચમાં ચુસ્ત કપિલના મનમાં શૌચ સંખ્યા અનેક વિચારે આવતા હતા.

“ગાય, જેંસ કુતરાં બીલાડાં આહિ અનેક પશુઓએ રાતદિવસ વિષા અને સુત્ર કરેલાં એવા અપવિત્ર માર્ગમાં ચાલનાર આશ્વષુનો શૌચધર્મ શ્રી રીતે રહે? તેમજ જે ભૂમિ ઉપર સારાય વર્ષ દૂરમિયાન અનેક પશુઓએ વિષા અને સુત્ર કરેલાં હોય, તે ભૂમિની એ અપવિત્રતા વર્ષા-કાલે વરસાદથી ઘોવાઈને બધી નહી કે તલાવમાં તણાઈ જાય છે એ નહી કે તલાવમાં સ્નાન કરેનારો આશ્વષુ શ્રી રીતે પવિત્ર થાય? સત્ય વાત તો એ છે કે શૌચધર્મ પાળનારનો શૌચધર્મ વસ્તીમાં રહેવાથી સચ્ચવાતો નથી. મનુષ્ય અને પશુથી રહિત સમુદ્રની મધ્યમાં કોઈ દીપ હોય તો ત્યાં રહેવાથી શૌચધર્મ બરાબર પાળી શકાય”.

અનેક વિચારેથી અને પોતાનો શૌચધર્મ બરાબર નહી પળવાથી હુભાતો તે કપિલ દુઃખે દુઃખે કાલ વ્યતીત કરતો હતો. એકદા કોઈ નાવિકના સુખથી એણે સાંભળું કે “સમુદ્રની મધ્યમાં શોરડીના વાદ્યી લરપુર અલય નામે દીપ છે. મનુષ્ય અને પશુથી રહિત એ દીપમાં શૌચધર્મ બરાબર પાળી શકાય”. ખલાસીની આ પ્રકારની વાણી સાંભળી કપિલે અલયદીપ જવાની તૈયારી કરી.

સગાં સંખ્યા અને સ્નેહીજનોએ અનેક રીતે સમાજવા છતાં કોઈનું વચ્ચે નહી સ્વીકારતાં સર્વના સ્નેહનો ત્યાગ કરીને કપિલ વહીષુમાં એસી અલયદીપ ચાલ્યો; નાવિકે પણ અલયદીપમાં કપિલને સુકી દીધો, જનશૂન્ય અલયદીપમાં એકાડી કપિલ વાવડીઓના પાણીથી

રોજ વ્રણવાર સ્નાન કરતો ને ઈક્ષુનું લક્ષ્મણ કરી સંધ્યા કરતો હતો. કેલાક દિવસ જતાં રોજ ઈક્ષુનું લક્ષ્મણ કરવાથી પોતાના દાંતથી ઈક્ષુ-શેરડીને છાલવા જતાં એના અન્ને હોઠ ફાટી જવા લાગ્યા. જેથી અચાનક કપિલના મનમાં વિચાર સુધ્યો. “આ સુષ્ટિને રચનાર પ્રજાપતિ-અળા ખુદ્ધિ વગરનો તો અરો જ. દરેક નાના મોદ્ય વૃદ્ધોને કૃળ સરળ્યાં તેમ શેરડીને ઇલ અનાબ્યાં હોત તો કેવું સાહેં? જોકે આપણા હેશમાં તો શેરડીને ઇલ આવતાં નથી પણ અહીંથીં આ દીપના ભલિમાથી કદાચ કૃળ આવતાં હો અરાં! એમ વિચારતો કપિલ ચારે કાર અમણ કરતો શેરડીનાં ઇલ શોધવા લાગ્યો.

પૂર્વે વહુણના ભાંગવાથી તાં આવી ચાલા કોઈક વહુણની સૂર્યની ગરમીથી સુકાઈ ગયેલી વિષને જોખ તે કપીલ શેરડીના ઇલની અંતિથી ચાખવા લાગ્યો, એ-સ્વાદ છતાં તે આંગો અંધ કરી પરાણે પરાણે ખાઈ ગયો. અને પછીતો તે સુકાઈ ગયેલી પોતાની વિષ પણ સેરદીના ઇલની અમણાએ ખાઈ જવા લાગ્યો. શૌચમાં પવિત્રતા માનનારો અશુદ્ધિની ગતામાં ગણડી પડ્યો. એને લાન પણ ન રહ્યું કે પોતે શું કરી રહ્યો હતો. અદ્ધાની ભૂલો શોધનારાને લાગ્યું કે પોતે વ્યાજણી કરી રહ્યો છે.

એક દિવસે પેલો વહુણ અચાનક કપિલને લેટી ગયો, મનુષ્યના સહુવાસથી દૂર રહેલાને ઘણા દિવસે આ દીપમાં મનુષ્યને જોવાથી સ્નેહ થયો. અરે ભાઈ! તમે શરીરનો નિલાખ શી રીતે કરો છો? કપિલે પૂછ્યું “સુખી તો છાને? મજા છે ને?”

“શેરડીનું લક્ષ્મણ કરીને” પેલા વહુણી કે ઉત્તર આપ્યો.

“શેરડીનાં ઇલ તમે આતા નથી?”

“એનાં ઇલ વળી કેવાં હોય !” વણીક આશ્ર્ય પામ્યો.

“કેમ તમે જોયાં નથી. ચાલો ખતાવું ?”.

“ખતાવો જો ?” આશ્ર્ય પામેલો. વણીક આલણની મૂડું ચાલ્યો.

ખતાનાં માનેલાં ઇલ કપિલે ખતાવવાથી વણીક કપિલની ખોટી અમણાથી ખડુ હુંઘી થયો. “અરેરે ! આ બિચારો કપિલ અજાનથી વિષાને ઇલ માની એડો છે”.

“આ ઇલ તમે ચાખ્યાં છે વાર ?” વણીકે આતુરતાથી પૂછ્યું.

“હા ! વણીએ વાર !” અલિમાનથી સંતોષપૂર્વક કપિલે જવાબ આપ્યો.

“એ સ્નાહમાં કેવાં લાગે છે ?” વણીક તેની મૂર્ખતા જર જરી હસ્યો.

“પહેલ વહેલાં તો ખરાબ લાગેલાં પણ હવે ધીરે ધીરે ઢીક માડેક આવતાં જય છે હો ?” કપિલ આલણની મૂર્ખતા ઉપર વણીક હસ્યો.

“કેરલા હિવસથી આ ઇલ આઓ છો ?”

“લગલગ એક માસ થયો !” કપિલ અલિમાન-પૂર્વક પોદ્યો.

કપિલની વાણી સાંભળી વણીક પોદ્યો. “કપિલ ! તું ભીત બુલી ગયો છે. એક એવા ખાપને માર્ગ તું ચીડી ગયો છે તે તું સમજશે નહિ. તારો શૌચ ધર્મ સાચવવા જતાં તું અશુચિનું લક્ષણ કરવાની હુદે પહોંચી ગયો છે તું પાછું રક્ષણ કરવા જતાં લાકીથી મસ્તક ઝોડી રહ્યો છે. જરા ભાત અશુચિથી જય પામેલો તું અશુચિથી ભચવાને અહિં આવ્યો. પણ અહીંટો તેં અશુચિનું લક્ષણ

કરવામાં પાછું ફરીનેય જોખું નથી. જે ભયથી તું નાડો હતો તે ભય તો તારી આગળ જ આની ગયો તે તું જાણી પણ શક્યો નહિ. શરીરને ફલ નથી હોતાં એતો સર્વ સાધારણ આખત છે. બાળક પણ જાણી શકે એવી વાતની તે અશ્વા કરીને વિષાનું લક્ષણ કરી તારા આત્માને અપવિત્ર કર્યો.”

“તમારી વાત ખરાયર નથી. મનુષ્ય રહિત દીપમાં વિષા કયાંથી?”

“તું અને હું અને તો છીએ ને? આપણે વિષા પણ કરીયે છીએ કે નહિ તેનો તો જરી વિચાર કર!”

“તે તો કઠીણું છે ને આ વિષા તો ઢીલી પોચી હોય છે”

“ઘણા હિવસ થવાથી તેમજ સૂર્યની ગરમીથી તે સુકાધને કઠીણું થઈ જાય”.

વણીકની વાણીથી તત્ત્વને સમજેલો કપિલ મિથ્યા-આલિમાનને છોડી માથું કુદ્ધવા લાગ્યો. વિલાપ કરતો પ્રતાના કૃત્યની નિંદા કરવા લાગ્યો. “મને વિકાર થાયો! મેં આ શું કર્યું? અરે! હુદ્દેવ! તેં મારી ઉપર શું જુલમ કર્યો? આવી કુરે મરકરી કરી મારી ભૂરી દશા કરી શું તું રાણ થયો? હા! હા! વિદ્ધાતા! તેં કયા લવનું વેર વાહણું? ત્રણવાર સ્નાન કરી સંદ્યા કરેનારા મારા જેવા સર્વોત્તમ નરશ્રેષ્ઠ આદ્ધણની તેં આ હાલત કરી! સગાં સંખ્યાધીના સ્નેહને છોડીને શૌચ ધર્મ સાચવવા આવા એકાંત સ્થળમાં આવ્યો તોએ હુણ વિધિએ અહીયાં મારી પાસે અશુચિનું લક્ષણ કરાવી મને નાપાક અનોધ્યો હા! હા!

ધિગ્નાતિ કપિલને વિલાપ કરતો જાણી વણીક પોચ્યો, “મિત્ર? હવે જે થયું તે થયું. તેં તારા હાથે ભૂલ કરીને પછી તું ફૈલને હોથ કેમ આપે છે? જાણી યુલુ, ધરાદાપૂર્વક

પોતે અપરાધ કરીને પછી નિરપરાધી હૈવ ઉપર કોષ કરવો એ તે ક્યાંનો ન્યાય ? કપિલ ! જગતમાં પણ એવો માનવી સ્વભાવ જ છે કે કોઈ પણ કાર્ય સારું થયું હોય તો તેનો જશ પોતે લઈ લે છે અને જો અગડી જાય કે એમાંથી કાંઈ ઉત્પાત થાય તો તેના દોપનો દોપદો મનુષ્ય હૈવ ઉપર નાખે છે. એ તે કાંઈ ન્યાય ?”

“હા ! હા ! પણ આ મારું કૃત્ય તો અક્ષમ્ય છે. ક્યાં જાઉ ? શું કરું ? શૌચધર્મથી પવિત્ર એવા મારી આ દશા ! તેવી ખૂરી દશા ?” કપિલ પશ્વાત્તાપ કરવા લાગ્યો.

પણ એ તારા શૌચ ધર્મને તું હુલ્ય માને છે ? બાબ્દ શૌચથી જો પવિત્ર થવાતું હોય-પાપ રહિત થવાતું હોય તો નહીં કે તલાવમાં માછલાં કે ફેડકાં વણુંય નહોય છે. તારા વિચારસુજય તો એ સિદ્ધાં મોક્ષમાં પહોંચવાં જોઈએ કેમ અરે ? કૃતરાં બિલાડાંય નહીંમાં ઘણીવાર સ્નાન કરે છે. એ સ્નાન માત્રથી શરીરની અંદર રહેલું ને આત્માને વળગેલું પાપ જતું નથી. પાપને કાઢવા માટે તો મનની શૌચતા (શુદ્ધતા) વચ્ચનની શૌચતા (સત્યવચ્ચન)ને કાયાની શૌચતા (અદ્વાર્ય) જોઈએ. બાબ્દ સ્નાન તો અહંકાર તેમજ રાગાદિકને વધારનાંડ છે કપિલ !”

“અરે ! અરે ! તમારી વાત હું સમજાય છે. બાબ્દ શૌચમાં જેમ જેમ વધારે ચુસ્ત થતો ગયો તેમ તેમ હું અશુદ્ધિની લારે આધમાં ઉથલી પડયો હું મારું શું થશે ? હું પવિત્ર પણ શી રીતે થધ શકીશા.” ધિગ જાતિ કપિલની આંખો હું વરાખર ઉંઘડી ગઇ હતી. બધુંય રંધાયા પછી હું હું ઉહાપણ આવયું હતું.

“સર્ગાં સંખંધીએ તને સમજાવ્યો તોય તું સમજ્યો. નહીં. એમના સ્નેહનો ત્યાગ કરી અહીં આવ્યો પણ

શૌચનો મર્મ તું અરાધર સમજ શક્યો નહીં. જે શૌચનું રક્ષણ કરવા તું શરીરને નવરાવી સારે રાખતો હતો, એને સ્નાન કરવાથી પવિત્ર થયેલું માનતો હતો. પણ શરીર તો અંહર અશુયિથીજ ભરેલું છે. હાડ, માંસ, ઇંધિર, આહિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલાને પવિત્ર માનવામાં તેં કાઈ ઓછી ભૂલ કરી નથી? અંતરંગ કોધાદિક શત્રુઓને જીતવાને તો મનની શુદ્ધતા જોઈએ, પવિત્ર વિચારો જોઈએ. આર્તિધ્યાન અને રીતધ્યાનને દૂર કરી મનને ધર્મધ્યાનમાં જોડવું જોઈએ સ્નાન બિચાર્દ શું કરી શકે? એ તો માનવીના પાપને વધારી શકે!" વણી-કનાં વચન સાંસાળી કપિલનો ગર્વ ઓસરી ગયો, કાયામાં કલ્યાણ માનનારાનો હવે હૃદય પલટો થયો.

"જો કપિલ! વસ્તુતાએ અશુયિ તો આપણાં પાપ-કર્મ છ તેજ અશુયિ છ અને પુણ્ય કરેણી તેજ પવિત્રતા-શુયિ એહલે શુદ્ધિ છે. પણ પાણીથી શુદ્ધતા નિરર્થક છે, સર્વે પ્રાણીઓને વિષે દ્વાલાવ, મન, વચન અને કાયાથી દ્વાદિયાને કાયુમાં રાખવી, અને પાપ વિચારથી દૂર રહેવું કોધાદિકનો નિયંત્ર કરવો એથી અધિક શુયિ બીજી કથી છે વારે?

શાસ્ત્રમાં કહ્યું છે કે કુવાના પાણીથી સ્નાન કરેલું અધિમ છે, નહીના વહેતા પાણીથી સ્નાન કરેલું મધ્યમ કહ્યું છે, વાવ અને તલાવમાં સ્નાન કરવાની તો શાસ્ત્ર-કારો સારે ના પાડે છે પણ વસ્તુથી ગળેલા એવા પવિત્ર જળથી પોતાને ઘેર સ્નાન કરેલું તે ઉત્તમ છે. અને તેમાંથી હેવાર્યન માટે કે એવા કોઈ વર્મ કાર્ય નિમિત્તે સ્નાન કરેલું તે ઉત્તમોત્તમ સ્નાન કહેલું છે. બાકી તો વણ્ણા જળથી સ્નાન કરવા છતાં પણ બાધ્યમલનીય અરાધર શુદ્ધ થતી

નથી. તો પછી પાપમળ તો શી રોતે દૂર થઈ શકે ? ધર્મના અર્થજીનો તો બાબુ શુદ્ધિ કરતાં આત્માને શુદ્ધ કરવા તરફ વધારે ધ્યાન આપે. “તેમાંથી અસુક પ્રેરણામાં તો બાબુ અશુચિ પણ મનુષ્યને અપવિત્ર બનાવી શકતી નથી, મોટી હેવ યાત્રા કે મહોત્સવોમાં,-મેળામાં, વિવાહકાર્યમાં, રાજહર્ષન કરવા જતાં, ચિત્ત સંભ્રમયુક્ત હોય ત્યારે, કે સંગ્રહમાં, અને રાજમાર્ગમાં સ્પર્શયોસ્પર્શ્ય માનવીને અપવિત્ર કરતો નથી.”

“લાઇ ! તમે શુચિ અશુચિના બેદનું પ્રકરણ ઠીક સ્પષ્ટ કર્યું, તમારી આ ધર્મ ચર્ચાએ મારા હૃદયમાં બણી સારી અસર કરી પણ તે બણી મોડી થઈ, પહેલેથી આ સમજાણું હોત તો હું એક મહા પાતકમાંથી બચી જત ”.

“હુશે ! ગઈ તિથિનો આધ્યાત્મ પણ વિચાર ન કરે ! જે પવિત્ર કોણ છે એ પણ જરા સમજ લે ! ખૂબનીની અંદર રહેલું પાણી પવિત્ર કહેવાય છે, પતિગ્રતા સ્ત્રીય પવિત્ર કહેવાય છે, તેમજ પ્રજાનું કલ્યાણ કરેનારો રાજ પવિત્ર કહેવાય છે, અને જે અહાચારી છે તે સહાય પવિત્ર ગણ્યાય છે. ક્ષમા, શુલ્વવિચાર અને નિર્મણતાથી મન પવિત્ર ગણ્યાય છે. સાચું બોલનાથી વચન પવિત્ર ગણ્યાય છે. તેમજ અહાર્યાહાહિ કાયાના શુદ્ધ વ્યવહારથી શરીર સ્નાન કર્યા વગર પણ શુદ્ધ થાય છે વળી જે પરસ્પરી અને પરદવ્ય અને પારકી ઈર્ઝા કરવાથી દૂર રહે છે તે વગર-સ્નાને પણ પવિત્ર છે. પરંતુ જેનું ચિત્ત હમેશાં પાપ વ્યાપાર અગર તો બીજાનું ભુદ્ધ ચિત્તવવામાંજ રહ્ત રહેલું છે, તે ચિત્ત જ અશુચિમય છે. જે જીહું બોલી રાત દિવસ બીજાને છેતરી રહ્યો છે તેનુંજ સુખ અશુચિવાળું છે. તેમજ જીવધાતાદિક પાપ કરીને જે દુષ્ટ કાર્ય કરી રહ્યો છે

તેજ અશુચિ કાયાવાળો સમજવો, માટે એ પ્રમાણે શુચિ અશુચિને સમજ, હવે ચાલ આપણે દેશમાં જઈએ ત્યાં જાનીનો સમાગમ પ્રાપ્ત કરી હો કપિલ ! તું તારા પાપનું પ્રાયશ્કિત કરીને શુદ્ધ થા ? ”

પ્રાયશ્કિત લેવાની છંદ્રાવાળો કપિલ વણીકની સાથે ચથાસમયે વહીષુંનો સંજોગ પ્રાપ્ત થતાં સ્વદેશમાં આવ્યો, અને પોતપોતાના કંઠભીજનોને મદ્યા, કપિલ પણ એ મિથ્યાકદાઓહનો ત્યાગ કરી પંડિતોએ આપેલું પ્રાયશ્કિત આપ્યરીને શુદ્ધ થયો ને સર્વ દર્શન સામાન્ય ધર્મને યથાશક્તિએ આભરવા લાગ્યો,

અમિતતેજ ગુરુરાજ કપિલનું આખ્યાન સંભળાવતા રાજને સમજાવવા લાગ્યા કે “હે રાજન ! જેવી રીતે આ કપિલ આદ્રાણ જરા પણ અશુચિના સ્પર્શ માત્રથી ભય પામનારો છતાં અશુચિનું ભક્ષણ કરવા લાગી ગયો તેમ તું પણ હુંખના ભયથી જો અપમૃતું અંગીકાર કરીશાંતાત કરીશ તો મોટા હુંખના લારને પામીશ, જરા તો વિચાર કર, હુંખ શા કારણે આવે છે ? પૂર્વ ભહાન પાપ કરેલું હોય એ પાપથીજ હુંખ આવે છે, પ્રાણીવધ આદિ ભહાન અકાર્યથી ભહાન પાપ ઉપાર્જિત થાય છે, એ પરગ્રાણીવધ કરતાંય આત્મઘાતને અધિક પાપનું કારણ કહેલું છે, માટે ભૂત્યનો વિચાર છાડીને હુંખનો નાશ કરનાર ધર્મનું તું આરાધન કર ”.

ગુરુના ઉપહેશથી રાજના ઝૂદ્ધયમાં કંધક શાંતિ થઈ અને પૂછું કે “લગવન ! એ ત્યાગ કરેલી અને કપાયેલા હાથવાળી મારી પલી અત્યારે ક્યાં હશે ? એ મને હવે મલશે કે ! અને મલશે તો ક્યારે ? ”

“રાજન ! ધીરજ ધર, એક દ્વિષસ પણી તું સંપૂર્ણ

અંગારાંગવાળી, પુત્ર સહિત તારી પત્નીને મલીશ, તેની સાથે ધણા કાળ સુધી રાજ્ય સમૃદ્ધિ ભોગવી પુત્રને રાજ-ગાડીએ બેસાડી પત્ની સહિત રાજપાટ છોડીને હું દીક્ષા અહુણ કરીશ” ગુરુની વાણી સાંલળી સ્વસ્થ થયેલા રાજ-એ નંદનવનમાંજ પડાવ નામ્યો. પત્નીને લીધા સિવાય નગરમાં નહી જવાની પ્રતિજ્ઞાવાળા રાજએ રાત્રી પણ નંદનવનમાંજ વ્યતીત કરી.

૬

મેલાપ.

નંદનવમાં સુખે સૂતેલા શાખરાજને ગુરુના ઉપદેશથી સ્વસ્થ ચિત્ત થવાથી નિર્દા આવી ગાધ. દુઃખમાં પણ મહોન પુરુષેનું પુણ્ય જગતજ હોયછે. ગુરુએ રાજનું ભાવી કથન કહીને શાંત કર્યો, તેમજ આ ભાવી કથનને સૂચયવનાર ને પ્રિયજનને. મેલાપ કરાવનાર એક અપૂર્વ સ્વખન રાજને આપયું. મોટા ભાગ્યને જણાવનાર એ સ્વખનમાં રાજએ શું જોયું ? “કંઈક ઇલવાળી લતા કલપવૃક્ષને લાગેલી તે કેદિકના છેદવાથી ભુનિ ઉપર પડી ગાધ. તે પાછી ઇલવાળી થાધ ને કલપવૃક્ષને લાગી ગાધ.”

એ મંગલમય સ્વખન જોધને રાજ જણૂત થયો, જગત થયા ત્યારે પ્રાતઃકાળ થવાની તૈયારી થતી હતી. ઉદ્ઘાચલ તરફ થવાની તૈયારીમાં પડેલા સૂર્યરાજે પોતાના અહુણ સારથીને રવાને કરી દીધો હતો. જે સૂર્યના આગમનની વધામણી આપી રહ્યો હતો. અદ્ય સમયમાં ઇલવાળી થનારા આ સ્વખનાને રાજએ ગુરુ આગળ નિવેદન કર્યું. ગુરુએ રાજને એ સ્વખનાનો પરમાર્થ સમજાવ્યો.

“ રાજત ! જે તમે પદરાણીનો ત્યાગ કર્યો, તે કલ્પલતા છેદાદ ભૂમિપર પડેલી સમજવી. એ લતા કણવાળી થઈ એટલે રાણી પુત્રવતી સમજવી ને કલ્પવૃક્ષ ને પાછી વળ-ગીગાઈ એટલે તમને પદરાણી આજે મળવી જોઈએ. ચોથા પ્રહુરે તેમાંથી પરોદમાં અવેલું સ્વપ્ન તે દિવસેજ ઝેણને આપનાં થાય છે માટે આજે તમને પુત્ર સહિત કલાવતો મળશે !”

યુદ્ધની વાણી સાંભળી રાજ ઘણો ખુશી થયો. પોતાને આતંક પ્રગટ કરતો તે બોલ્યો “ ભગવન ! આપના પ્રલાવથી મારું સારું થશો ”

સૂરિને વંદન કરી શાંખરાજ નંદનવનમાં પોતાને ઉત્તારે-સ્થાનકે આવ્યો. રાજને વિચાર કરી હતને પોતાની સંસુખ બોલાવી આજ્ઞા કરી. “ ભિત્ર ! જોકે લજાથી હું તને કહેવાને અસમર્થ છું, દુર્ભુદ્ધિવાળા મેં તારી ધર્મભગિનીનું ઘણું અનર્થ કર્યું છે, મારા એ પાપને ભૂલી જાડું શીધ ગતિએ લદ્દને સાથે લઈ તપાસ કરી તારી અહેનને તેડી લાવ ! અન્યથા યુદ્ધએ આધાસન આપ્યા છતાં એ જો નહિ મળે તો અનર્થ હું આવતી કાલે કાઢલક્ષણ કરીશ. માટે ગમે તેમ કરી એને સમજવીને હેઠત ! તું મોદ્ય માન સહિત તેને તેડી લાવ. ”

“ જેવી આજ્ઞા હેવ !” હતે રાજતું વચન અંગીકાર કર્યું. પ્રાતઃકાળમાંજ હતાંદી લદ તેમજ બીજ થોડા પરિવાર સાથે મારતે થાડે લદ્દના અતાવેલા માર્ગ જંગલ તરફ રવાને થયો.

ભાડે લયંકર જંગલમાં કલાવતીને છાડી હતી ત્યાં આવી પહોંચ્યા, જંગલમાં ચારે બાળુએ તેઓ શોધ કરવા લાગ્યા એટલામાં કાણ વીજુણી રહેલા તાપસ ઉપર

દતાની નજર પડી. હર્ષથી ખુશી થયેલો હત તાપસને જોતાંજ તેની પાસે આવી પૂછવા લાગ્યા. “હે તપસ્તી! તમે આ જગતમાં પુત્રવાળી અગર તો નાણક પ્રસવવાળી કોઈ જીતે જોઈ?”

આ તેજ તાપસ હતો કે જેનો આ તરફ આવવાનો રેઝનો અભ્યાસ હતો ને જે કલાવતીને તાપસના આશ્રમમાં તેડી ગયો હતો, કલાવતીના દુઃખની વાતો જણતો હાવાથી તાપસ આ ધેરાંથારેને જોઈ વિચારમાં પડ્યો. “નક્કી એ ગરીબ વરાકી ઉપર આ લોકો આદૃત ઉતારશો.”

ગલરાયેલા તાપસને જોઈ હત બોલ્યો. “બાલો? બાલો! એ જીવિ ક્યાં છે? જોઈ છોય તો જી અતાવો?”

આગેવાન રાજપુરુષનો જવાબ સાંભળી હીમત ધારણું કરતો તે તપસ્તી બોલ્યો. “અરે એ રંક વરાકી ઉપરથી રાજનો કોપ હજુ દૂર થયો નથી શું? વગડામાં એકાકી રજીણાતી સુકી હાથ કંપાવી નાખ્યા તોય રાજ ધરાયા નથી શું?”

સમાચાર મલવાથી તેમજ દેવી હજુ જીતી છે એમ. જાણી રાણ થતો હત-એ રાજપુરુષ બોલ્યો. “અરે ભાઈ! તારી વાત જો કે સત્ય છે છતાં અત્યારે તો બાળ અધી પલદ્યાધ ગાંધ છે. આજની સાંજ સુધીમાં રાજ જો દેવીને નહીં જુઓ તો પશ્ચાત્તાપથી જલતો રાજ કાષ્ટભક્ષણું કરશો માટે અમને જી એ લાઘ્યવતીનાં દર્શન કરાવો?”

હતાની વાણી સાંભળી સસંભ્રમિત થયેલો તે અધાંને તાપસાશ્રમમાં તેડી લાવ્યો. હત વગેરે તાપસ આશ્રમમાં કુલપતિને નભ્યા. દુંકાણમાં કુલપતિને દેવી સંબંધી સર્વે હકીકિત કહી સંભળાવી.

હતાની વાત સાંભળી કુલગુરુએ તરતજ તાપસીઓની.

મહમાંથી કલાવતીને તેડાવી. કુલગુરુની પાસે આવેલી કલાવતી હતા વગેરેને જોઇને પૂર્વનું હુંખ સાંભળી આવવાથી રહી પડી. કારણુકે હૃદયમાં છુપાયેલું-ભુલાયેલું હુંખ પણ પોતાના સ્વજનને જોવાથી તાજુ થાય છે. કલાવતીના ઝેણથી હતા પણ રહવા લાગ્યો છતાં ધીરજ ધરી હતા કલાવતીને કહેવા લાગ્યો.” ભગિનિ ! આ એક દુષ્ટ કર્મનો પરિણામ હતો અને તે તમારો કરેલો તમે લોગવ્યો, રાજણ તો એમાં નિભિત માત્ર હતા. માટે એવી દૈવની ઘાયતમાં તમારે ખેદ ન કરવો ! કારણુકે પ્રાણીઓને આ જગતમાં કે સુખ કે હુંખ પ્રાપ્ત થાય છે એમાં ભીજાઓ તો ઇક્ષત નિભિતભૂત છે બાકી તો ખર કારણ શુભાશુલ કર્મ વિધાકજ છે. સંસારમાં એવા કર્મ વિધાકથીજ શરૂ ભિત્ર થાય છે ત્યારે સ્વજન પણ દુષ્મનની ગરજ સારે છે અને તે તમે જાતે અનુભવ્યું છે જોયું છે. “હે હેવી ! તમે જેવું દ્વારણ હુંખ લોગવ્યું છે તેવું અત્યારે તમારો વિયોગ રાજ લોગવી રહ્યા છે ખલકે તમારાથી અનંત-ગણ્યું. અત્યારે તો પશ્ચાત્તાપથી પીડાતા તમારો વિયોગ રાજ અભિમાં બળી મરવાની તૈયારી કરી રહ્યા છે, તમને જોવાને આકુળ વ્યાકુળ થયેલા રાજ તમને જો સાંજ સુધીમાં નહીં જુઓ તો જરૂર અભિમાં બળી મરશે માટે એમને જીવતા રાખવા હોય તો રથ ઉપર બેસી ચાલો, રાજને ખચ્ચાવો.”

હતની વાણી સાંભળી બેખાકળી બનેલી કલાવતી પતિના દ્વારાને-અવગુણુને ભૂલી જઈ પતિને ભલવાને ઉત્સુક થધ, કારણુકે પતિપ્રતા જીવીઓ પોતાનો પતિ લદો હોય કે ભુંડા, પણ તેના જ હિતને કરનારી હોય છે. કુલ-પતિને નમસ્કાર કરી તાપસ અને તપસ્વિનીઓની રજા

લઈ હળીમળી પોતાના ખાળ યુત્ત્રની સાથે રથમાં એસી, શાંખપુર તરફ ચાલી, હતા વગેરે સર્વે રાજને મહિવાને ઉત્સુક થયેલા શીધગતિએ શાંખપુરનો માર્ગ કાપવા લાગ્યા.

સૂર્ય અસ્તાચલ તરફ વેગથી ધર્સે જતો હતો સારા થ દિવસના પરિશ્રમથી કંધણેલો સૂર્ય સંધ્યાના સોનેરી રંગમાં ડાઢી ગયો હતો દોડાદોડ કરતી આછી પાતળી વાદળીએ જુદાજુદા અલિનયોને ઘતાવતી હસી રહી હતી. સૂર્યનો સારથી અરૂપ પણ પોતાના સ્વામીની પછ્વાડ નાશી જવાની તૈયારી કરતો હતો, સંધ્યાની વાદળની છાયા પ્રકાશને આવરી રહી હતી. છતાં હજુ આતુરતાથી કલાવતીની પ્રતીક્ષા કરનાર રાજની ઉત્સુકતા વધે જતી હતી, “અરે શું? જાનીનું વચન કદમ્બિ મિથ્યા થાય? ન કરે નારાયણ કે કલાવતી કદમ્બ ન આવે તો આવતી કાલની ઉદ્ય પામતી પ્રલાતકાદે તો જરૂર અભિ સાથેજ મારે દોસ્તી કરવી પડશો.”

એ વિચારમાં ચેઠેલા રાજની વિચારશેણિ અધ્યવચ્ચ સરકી ગઈને કલાવતીનો રથ નંદનવનમાં આવેલો રાજને જોયો. હતા વગેરે આવીને મહારાજને નમ્યા. આનંદની વધામણિ આપી મહારાજને હર્ષિત કર્યા. રાજ ત્યાં સલાસ્થાનમાં આવ્યા. મંત્રી, સામંત, મહાજન વગેરેને રાજ છલકાતે હૈયે મહ્યા, મહારાજના હૈયામાં હર્ષ હતો, અધ્યાત્માના હૈયામાં હર્ષ સમાતો નહોતો, નંદનવન અત્યાર સુધી સમશાન કેવું શૂન્યકાર હતું તે હવે કલાવતીના આવ્યા પછી નંદનવન સમુ રમણીય અની ગણું, અનેક પંથરંગી દીપિકાઓનો પ્રકાશ અંધકારનો નારા કરતો અગઝગી રહ્યો મંગલમય વાંદિત્રોનાનાદથી મોદો મહેત્સુધ રહ્યો.

સભાસ્થાનમાં રાજ મંત્રી, સામંતોને મહી લેરી થાડીવારે પોતાના નિવાસસ્થાને આવ્યો. અનેક હીપિકા-એથી જગજગી રહેલા તેજમાં કલાવતીનું પવિત્ર મુખાર્વિંદ જોયું, એ મુખાર્વિંદને જોવાને પણ અસમર્થ એવો રાજ મંદમંદ ડગલાં ભરતો કલાવતીની પાસે આવ્યો. કોથી અધોવહનવાળી કલાવતીએ રાજની સામે દષ્ટિ પણ કરી નહિ. રાજએ પોતાના હાથ એનું ગૌરવહન ઉચ્ચ કરી પોતાની સામે સ્થિર કર્યું. “પ્રિયે ! જરા મારી સામે તો જો ?”

“નિર્બાગિણી એવી મારી સ્તુતિ કરવાથી શું ?  
રાજન !”

“નિર્બાગિણી અને નિર્ઝાણી તો હું છું કે જેણે તારા જેવી સતીમાં શિરોમણિ નારીને વિડંઘના પમાડી-દુઃખી કરી એ મારું અવિચારી કૃત્ય ક્ષમા કર. ?”

“સ્વામિન ! એમાં તમારો શું હોથ, તમારામાં પ્રીતિ-વાળી મારો કંઈ પણ હોથ ન હોવા છતાં તમે મારી કદર્થના કરી એ મારો કર્મનોજ હોથ હશે, અન્યથા ધીજું શું હોઈ શકે ?” કલાવતીએ પોતાના કર્મનો હોથ જણાવી રાજનું મન શાંત કર્યું.

“પતિમાં એક ભક્તિવાળી કુલવંતી નારીએ પતિના છતા હોથને પણ ન જોતાં પોતાના કર્મનોજ હોથ કાઢી આત્મનિંદા કરે છે તે તે સત્ય કરી આવ્યું.”

“હશે ! એ વાત જવાહો, રાજ યુનહેગારને તો ઉચ્ચ શિક્ષા પણ કરે ! પણ કહો તો ખરા કે તમે મને મારા ક્યા અપરાધની શિક્ષા કરી ?”

કલાવતીનો પ્રક્રિ સાંભળી રાજ જાખવાણે પડી ગયો. જે વાતે રાજના છૂદ્યમાં શાંકા જન્માવી હતી તે બાયત કહેવાને પણ અસમર્થ રાજ વિચારમાં પડી ગયો. “પ્રિયે !

જો કે વડ અને ઉમરાના વૃક્ષને ફ્લ હોતાં નથી. ને વંજુલ ( ) વૃક્ષને પણ ફ્લ હોતાં નથી તેવી રીતે તારામાં દ્વાપનો સંભલ નથી છતાંય મારી મૂર્ખતાથી તારામાં દ્વાપની કલ્પના કરીને તારી કદર્થના કરી” રાજાએ પોતાની જખી હકીકિત કલાવતીને કહી સંભળાવી. કલાવતીએ પણ પોતાની બીતા રાજને કહી સંભળાવી.

“પ્રિય ! તારા શીલના પ્રલાવથી તારી આદૃત હૂર થઈ. યાવત ચંદ દિવાકરી તારી નામના થઈ. તારું નામ તો જગતમાં અમર થઈ ગયું તે સાથે મારું આ કલંક-આ અવિચારી કૃત્ય પણ અજરામર થઈ ગયું. લોકો તારાં ગુણગાન કરેશે મારી નિદા કરેશે. તારી શીલસત્રાહ ગાથાને મારી કલંક ગાથાના રાસડા ગાશે.”

રાજાએ કલાવતીના મનનું સમાધાન કરતાં પોતાની નિદા કરવા માંડી. “એ અવિચારી કૃત્યનું પ્રાયશ્ચિત કયા-રહુંય થઈ ગયું હોત, પણ અહીં નજીકમાં રહેલા જ્ઞાની યુર મહારાજે ઉપદેશ આપી મને ધર્મમાં સ્થિર કર્યો. તારા પુનઃ મેલાપની અવિષ્યવાહી સંભળાવી મારો સંશય હૂર કર્યો.” રાજની વાત સંભળીને કલાવતી બોલી. “સ્વામિન ! આપણે બ્રહ્મ હુંએ અને વિજેગમાંથી પુનઃ સુખ અને સમાગમનાં અમૃત સમાન મધુરાં ફ્લ ચાખી-એ છીએ તે આ બાલકના પુણ્યનોઝ પ્રભાવ છે પણ મને એ જ્ઞાની યુર મહારાજનાં દર્શન કરાવો ! જેમનાં દર્શન કરી હું પાપમુક્ત થાઉં.”

“પ્રાતઃકાલે આપણે સાથે વંહન કરવા જાણું ;”

સ્નેહ સંલાપમાં ને કંઈક નિદાના આરામમાં બ્રતેની રાત્રી ક્ષણવારમાં પુરી થઈ, પ્રાતઃકાલે સૂર્યનો ઉદ્ય થતાં પ્રાતઃકૃત્યથી પરવારી પરિવાર સહિત રાજ અને રાણી યુર

મહારાજને નમસ્કાર કરવા આવ્યાં. ગુરુ મહારાજને વાંદી તેમની આગળ એડા, તેમની સાથે આવેલા મંત્રી, સામંત તેમજ બીજા રાજ્યાધિકારી પુરુષો, અન્ય મહાજન વર્ગ, પ્રજાવર્ગ તેમજ સ્ત્રીવર્ગ યોગ્ય આસને એડા, પછી ગુરુ મહારાજે શીલ ધર્મના માહાત્મ્યનું વર્ણન કરવા માંડ્યું.

“શીલ એ પ્રાણીઓનું અપૂર્વ ધન છે. આપત્તિ, દુઃખ અને દારિદ્રને નાશ કરવામાં શીલ મહાન છે. દુર્ભાગ્યાદિક હાથેનો નાશ કરી શીલ ધર્મિણને અપાવે છે. વાદ, વર્ણ, સિંહ અને હાથી આહિ હિંસક પ્રાણીઓના ભયનો નાશ કરે છ. જળ, અભિ, ડાક્ટરી અને શાકિનીઠા ઉરનો નાશ કરી સુખસંપદા પ્રાપ્ત કરાવી સ્વર્ગ અને યાવત મોક્ષની લક્ષ્યમીને અપાવે છે એવા પ્રત્યક્ષ પ્રલાવવાળું” શીલ જગતમાં વિજ્યવંત છે. હે ભવ્યજનનો ! એ શીલનું માહાત્મ્ય તમે પ્રત્યક્ષપણે બોધું છો. શીલના પ્રલાવે કલાવતીના કપાયેલ હાથ નવપદ્લય થઈ એનાં દુઃખ દૂર થયાં છે. સતી કલાવતીનું નામ એના શીલ પ્રલાવથી જુગ જુગ પર્યંત કાયમ રહેશે એવા શીલને પાળવાનો તમે ઉધમ કરો.

શીલથી વિભૂષિત થયેલા નરનારીઓને સમ્યક્તવનો ગુણ આવે તો એમનો એડા પાર ! સમ્યક્તવ અશુલ કર્મોના ક્ષય થકી ઉત્પન્ન થાયછે અશુલ કર્મોના આવરણ વડે દંડાયેલો. સમ્યક્તવ ગુણ જ્યારે આત્મામાં પ્રગટ થાયછે ત્યારે આત્માની અધી પરિણિતિ ઝરી જાય છે સંસારના સ્વરૂપમાં રક્ત થયેલો આત્મા સમ્યક્તવના પ્રગટ થયા પછી સુક્રિના લક્ષ્યવાળો થઈ જાય છે આત્મામાં એ સમ્યક્તવ ગુણ ઉત્પન્ન થવો અહુ દુર્લભ છે. સંસારમાં પુણ્યના પ્રલાવથી સ્વર્ગ કે મનુષ્યના દિવ્ય લોગો મદી શકે છે. અનેક પ્રકારની વિધા પ્રાપ્ત થધ શકે છે પણ સમ્યક્તવની પ્રાપ્તિ તો અવસ્થિતિ પરિ-

પાક થયા વગર થતી નથી, એ સમ્બંધિતવના પ્રલાવથી દેવ શુરૂ અને ધર્મતત્ત્વ જાણવાની અભિલાષા જગત થાય છે પ્રાણીઓને એ વણે તત્વોની મોયાભાગ્યે જ પ્રામિ થાય છે:

જરાડપી રાક્ષસીના પંજામાં જયાં લગી સપ્તાયેલા નથી, મૃત્યુ એ હળ સર્વ નાશની તૈયારી કરી નથી, ત્યાં સુધીમાં એ વણે તત્વનું આરાધન કરી મનુષ્ય લવ સફ્લ કરો, કારણું—

“અહોત ગધ થોડી રહી, ચેતન અધ તો ચેત,  
કાળ ઉદ્રરૂ કેતરે, ઉત્તમ આયુષ્ય ઐત.”

રાગ દ્વેષ કષાય, મોહ અને મિથ્યાત્વનો નાશ કરનાર, આડે કર્મને દ્વારા કરનાર, લોકાલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાને કરીને સહિત, લયરહિત, આયુધ, શસ્ત્ર, અસ્ત્રથી રહિત, શાપ અને અતુશ્રણી વર્ણિત, કામ, મોહ નિદ્રા, તંડ્રા, લુખ, તરસ, હાસ્ય, કીડાહિ હોષોથી રહિત, એ અદાર દ્વારો રહિત તે દેવતત્વ કહેવાય.

સર્વ પ્રાણીઓને હિતકારી, ગુણાદી, સત્યપ્રરૂપક, સત્યભાઈ, શીલવાન, પરિબ્રહ રહિત, શાનુ અને મિત્ર, લોહ અને કાંચન, સ્વી અને તૃણ, સુખ અને દુઃખ એ બધામાં મધ્યસ્થઘૃતિવાળા ગુરુઓ, જીનેશ્વરની આજાના આરાધક કહેવાય છે. તેમજ લિક્ષા માત્રથી આળવિડા ચલાવનાર, કનક અને ચાંદીને તૃણવત ગણનાર, પાપના લેશ પણ પરિચયથી દૂર રહેનાર, છ્રીશ ગુણોને ધારણ કરનાર સારા ચારિત્રવાન, સ્વ અને પર શાસ્ત્રના જાણનાર, જીનેશ્વરના માર્ગના પ્રરૂપક, સાધુના સત્તાવીશ ગુણે કરીને ખડ્દા એવા ગુરુ આરાધવા યોગ્ય જાણવા.

જીનેશ્વર ભગવાને ધર્મથે પ્રકારનો કદ્વી છે—સાધુધર્મ અને શ્રાવકધર્મ, પંચ મહાપ્રાતનું પાલન કરેલું અને રાશ્રી

શાજનનો ત્યાગ કરવો તેમજ પાંચ સમિતિ અને ગ્રણ ગુસ્તિ પાળવી એ સાધુનો ધર્મ જાણવો. સમ્યક્તવ મૂળ ખાર પ્રતિનું પાલન કરવું એ આવકનો ધર્મ. એ રીતે સાધુ અને આવક ધર્મ જીનેથી ભગવાને કહેલો છે. એ પ્રમાણે દેવતાઓ, ગુરુઓ અને ધર્મતત્ત્વને જાણનાર અથવા તે એ ગ્રણ તત્ત્વો ઉપર શ્રદ્ધા કરેનારા સમ્યક્તિ કહેવાય છે. તે સિવાય શાન, દર્શન ને ચારિત્ર ઇપી ને મોક્ષમાર્ગ તેની જે શ્રદ્ધા તે પણ સમ્યક્તવ કહેવાય, જીનભાવિત ધર્મનું મૂલ સમ્યક્તવ કહેવાય.

ચિત્તામણીરણ, જામદેનું અને કદ્યપૃષ્ઠકથી અધિક પ્રભા વધાણા સમ્યક્તવ રેલની જીનેથી ભગવાનો પણ મુક્ત કંઈ પ્રશાંસા કરે છે, એવા સમ્યક્તવપૂર્વક આવકના ધર્મને હે ભાગ્ય જનો ! તમે આરાધો, તમારા આત્માને ભવ સાગરથી તારો. ”

જાની ગુરુરાજ અમિત તેજની ધર્મ વાણી સાંલળીને રાજ સહિત સર્વે પર્ષાંદા પ્રસન્ન થધ ગઈ. મિથ્યાત્વની ગાંડ જેની લેદાધ ગધ છે એવો રાજ મિથ્યાત્વથી રહિત થયો, જ્તાં ગુરુને કહેવા લાગ્યો, “ હે પ્રભો ! અંધકારનો નાશ કરનારી, મહોદ્યનું ડારણ રેલત્રથી આપે વખાણી તે વિબેદી જનોએ અચુક આદરવા યોગ્ય છે, પરન્તુ પ્રિયા અને અપત્યમાં મોહયાલા એવા મારાથી સંસાર હુસ્ત્યાજ્ય છે, માટે મને સમ્યક્તવપૂર્વક આવકનો ધર્મ આપો. ”

શાંખરાજાની વાણી સાંલળીને ગુરુએ રાજને સમ્યક્તવ સૂણ આવકનો ધર્મ ઉચ્ચરાખ્યો. રાજાની સાચે રાણી કલાવતીએ પણ આવિકા ધર્મ અહૃદ્ય કરેં. તેમને ધર્મમાં કિથે કુસીને ગુરુ ત્યાંથી અન્યગ્ર વિહાર કરી ગયા. રાજ રાણી પ્રાતિના સ્થાનકે નંદમધ્યનમાં આવ્યાં.

૧૦

શાખરાજ.

“સંપત્ત ગાં તે સાંપડે, ગયાં વળે છે વહાણ,  
ગયાં ન જોખન સાંપડે, ગયા ન આવે પ્રાણ.”

આ કષણુભંગુર જગતમાં પ્રાણીઓ ક્ષણમાં હું  
બેસાં થાય છે તો ક્ષણમાં શોકસાગરમાં ડુણી જાય છે.  
શાખપુર નગર એ હિન્દસથી શોક સાગરમાં ડંબડીઓ ભારી  
રહ્યું હતું, એક તરફ રાજ મૃત્યુ આટે તૈયાર થઈ ગયો હતો,  
બીજું તરફ જાગલમાં તરફારી કલાવતી મૃત્યુને પોડારી  
રહી હતી. તેમજ એના બાલક માટે લોકોના મનમાં  
અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. એ ખંધાય સંજોગો  
આજે પાછા પલટાઈ ગયા ને જોણીના શીલનો પ્રભાવ  
આજે તો નગરનાં નરનારીઓ રસપૂર્વક ગાંધ રહ્યાં છે  
પુત્ર સહિત કલાવતી નંદનવનમાં આવી ગાંધ ને રાજ  
રાણી કલાવતી અને ભાળ પુત્ર સહિત મોટી ધામધુમથી  
આજે નગર પ્રવેશ કરશે એ આનંદાયક સમાચાર પ્રાત:  
કાળમાંજ સારાય શાખપુર નગરમાં પ્રસરી ગયા.

ક્ષણમાત્રમાં શાખપુર નગરની શોલા ક્રપૂર્વ અની  
ગાંધ, ક્ષણ પહેલાની રમશાન અને શોલા સહિત શાખ-  
પુરી હવે ચેતનવંતી અની ગાંધ, ડેકાણે ડેકાણે મંગલ  
વાહિનો વાગવા લાઘ્યાં. લોકો આનંદી વૃત્ત કરવા  
લાઘ્યા, ડેંડ સંગીતની ધૂન છોડવા લાઘ્યા, નગરીની  
સમધુરીઓ પોતપોતાના મહોલામાં રાસડા લેવા લાઘ્યા,  
ઝામધંદો છાઈને લોકો પોતાના બર આંગણાં સાખુંઝા-  
રવા લાઘ્યા, તોરણો ચંડુવા અને પતાકાઓથી પોતપોતાના  
મડાનની શોલા વધારવામાં લોકો હરીકાઈ કરવા લાઘ્યા,

રાજમાર્ગો ખીજ ધોારી રસ્તાઓ ધ્વજ-પતાકાઓથી સુશોલિત થઈ ગયા. મોટા મોટા દરવાજાઓ અને નાના દરવાજાઓ તોરણે અને પતાકાઓથી શાખુગારાદ્ધ ગયા. અનોહર ધુઘરીઓના નાહો રાજરાખીને આવકાર આપવા લાગ્યાં, સ્લી કે પુરુષ, બાલક કે વૃદ્ધ, અમીર કે ગરીબ પોતપોતાની સંપત્તિ પ્રમાણે નવીન વસ્ત્રાભૂષણ સળ પ્રવેશ મહોત્સવમાં જવાને ઉતાવળ કરી રહ્યાં હતાં. આજે લોકોનો-નગરજનોનો હર્ષ ઉપર હર્ષ ઉલ્લરાદ્ધ જતો હતો.

રાજ-શાખાપુર નરેશ્વર શાખરાજ ગજરાજની અંધાડી ઉપર આરક થઈને યથાસમયે નગરમાં પ્રવેશ કરી રહ્યો હતા. અપૂર્વ શીલ માહાત્મ્ય પામીને અક્ષત અગ્રાપાંગવાળી કલાવતી દુઃખદી મહાસાગરથી પાર ઉતરી ગયેલી આજે મહોન્મત ગજરાજના મહાજણને શાંત કરતી રાજની સાથે નગરમાં પ્રવેશ કરી રહી હતી. પોતાનો ભાવી રાજ પેદો. બાલકુમાર પણ રાજરાખીની સાથે નગરીમાં પ્રવેશ કરતો ગજરાજની વિશાળ પીઠ પર રમી રહ્યો હતો. નગરમાં પ્રવેશ કરતા રાજરાખીનો ઉત્સાહ અપૂર્વ હતો. મંત્રીઓ, રાજ્યાધિકારીઓ, મહાજનોથી એ સામૈયા-વરાધાનો ડાડ ખુલ દમદાર હતો, અનેક મંગલમય વાહિનોના ધરા નાહો કલાવતીના શીલ માહાત્મ્યની સુવાસને નલો-મંડલમાં ફેલાવી રહ્યા કે શું? લોકોના હર્ષનો આવેશ અપૂર્વ હતો.

શાખરાજે અપૂર્વ મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરી પોતાના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજએ દીન દુઃખી અને ગરીબજનોને અજ, વસ્તુ અને દ્રવ્યના દાનથી ન્યાલ ફરી નાખ્યા. બીજાવલી બોલનારા ભાઈ ચારણ કવિઓને ધૂતામાં આપી સુંતોષ પમાજા, એ અપૂર્વ ઉત્સાહમાં

અદ્વિતોને પણ સુઝી કર્યા, ને ખાર દિવસ પર્યેત નગરમાં ભોડો ઉસવ કર્યો. વ્યાપાર, રોજગાર અંધ કરાવીને અધ્યાય નગરના નરનારીઓએ રાજરસોડ લોજન કરી ગાન તાન ને રમત ગમતમાં દિવસો નિર્ગમન કર્યા. રાજીએ એવી રીતે પુત્રનો જન્મોત્સવ કરીને સારાય નગરના શોકસાગરનો નાશ કરી નાખ્યો. એ ખાલ રાજકુમારનું નામ પૂર્ણ કલશ સ્વમને અનુસારે રાજયુઃ સગાં, સ્નેહી ને આમજનોને પણ તેડી લોજન જમાડી હાન અને માનથી આનંદિત કર્યા.

સુખહુંમના અનુભવથી રીઢા થયેલો રાજ ન્યાય-પૂર્વક રાજ્ય કરવા લાભ્યા. ને શાવકના ધર્મનું આરાધન કરતા પોતે પણ ખાર પ્રતોને ઉપયોગપૂર્વક પાલવા લાભ્યા. તેમાંથી શિયલન્દ્રતમાં તો ખજે રાજરાહુંએ ગુરુનો યોગ મેળવીને અન્નચર્યાપ્રત અંગીકાર કરી લીધું. છતાં ખજે અધ્ય સ્નેહપૂર્વક રાજકુમારનું પાલન કરવા લાભ્યા, વાર-વાર યુરુનો ઉપહેશ શ્રવણ કરી રાજ દૂષણ રહિત શાવક-ધર્મને પાળતા હતા. એ સુખશાંતિના સમયમાં-પોતાના રાજ્યશાસનકાલમાં અનેક નવીન લુનમંહિર અંધાવ્યા, અનેક લાર્ણ ચૈત્યોનો તેમણે ઉદ્ઘાર કરાવ્યો, નવીન લુન-ધર્મર લગવાનની પ્રતિમાઓ તૈયાર કરાવી ગુરુમહારાજ યાસે વિધિપૂર્વક લુનાલયોમાં પ્રતિષ્ઠિત કરાવી. મોટા અહોસ્વો પૂર્વક લુનપૂજાઓ રચાવી. ગુરુમહારાજ સાધુસાધ્વીજનોને નમન, સ્તવન, વંદન, આન, પાન, સ્વાદિસ, શાયા, શાસ્ત્ર, વસ્ત્ર, પાત્ર આહિ ધર્મપક્રણ વહેશરાવી તેમની અક્ષિ કરી. તેમજ દીન, દુઃખી અને ગરીબ શાવકોને ધન આપીને ઉદ્ઘાર કર્યો, તેમને કરના એજા-માંથી સુઝી કર્યા. લુનધર્મરના ધર્મનું ગૌરવ વન્દ્રારતો એ

સાથ ધર્મની નિદા કરનારાએને શીક્ષા કરવા લાગ્યો. એ રીતે આવકબર્મનું પાલન કરતાં ઘણો કાળ સુખમાં વ્યતીત કર્યો. દેવતાની માઝે સુખી જીવો જતાકાલને ખુલ્લું જાણતા નથી.

રાજપુત પૂર્ણકલશ પણ શાસ્ત્ર અને શાસ્ત્રનો અલ્યાસું કરી રમણીજનને વદ્ધાલ એવી ભનોહર ચુવાવસ્થાને પામેઠ કામદેવના અવતાર સમે પૂર્ણકલશ ચુવરાજપદ્ધને શાસ્ત્રવતો રાજકાર્યમાં પણ હેંશિયાર થયો.

જીનેકૃતના ભક્તા, તેમજ દેવ, યુર અને ધર્મની ભક્તિ કરેનાર શાખરાજને રાક્ષય લોગવતાં અતુક્કે પ્રૌઢ અવસ્થા આવી. એ ચુવાનીના રમણીય દિવસો પસાર થઈ ગયા, નાગની દેણું સમા કાળા ભ્રમર સમાન શ્યામ મસેતકના કેશ પણ ઉજવળતાને ધારણું કરવા લાગ્યા. ઐતાના મસેતકના કેશ, દાઢી, સુચણના કેશ એક પછી એક ઉજવળતાને ધારણું કરતા જોઈ સંસાર ઉપરથી વૈરાઘ્યવાળા એ રાજની આંખ ઉલ્લંઘી ગઈ.

રાનિના અતુર્થ પ્રહર સમયે અચાનક જામત થયેલા સાંજના મનમાં વૈરાઘ્યની પરપરા વૃદ્ધિ પામવા લાગી. “આ અપાર સંસારસાગરમાં શરીર અને મન સુંધરીનાં આનેક દુઃખોથી આડુલ બ્યાડુણ થયેલો પ્રાણી જીનેકૃત ભગવાને કહેલી રહત્રયી ઇપી નાવ વગર સંસારના પાસે શી રીતે પામી શકે? ચ્યારાશી લાખ જીવ્યોનિમાં રલ્યુન્ય ઇપી ધર્મસામની નરભવમાંજ પ્રાણી મેળવી શકે છે. એ નરભવ પણ પ્રાણીને મહાપુણ્યાનુયોગેજ ભલી શકે છે. ઇશ દ્યાંતે દુર્લભ મનુષ્યભવ કદાચ મહિયો અને બે ધર્મ અવણું ન મહું તોય નકાસું, ધર્મઅવણું કર્યા છતાં બે

ક્રમનું આરાધન કરાય નહી તો એ મનુષ્યપણું પામ્યાની જાર્થકતા શી?

સંસારમાં તો રાજ્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, એને ખરિ-વારાહિકનો મોષ્ટ હુસ્ત્યાભ્ય હોય છે. ચુંબાની, સુખ, સખૂદ્વિ જલતરંગની માફક વિનથી હોવા થતાં એમાંથી જીવાની આસક્તિ છુટ્ટી નથી. રાજ્ય, અથર્વ એ હુર્ગતિને આપનારું છે. વિષયો કિંપાકના ઇલ સમાન ઉપરથીજ રમણીય છે. તો પરંપરાએ જેનાથી હુંઘનીજ પ્રાપ્તિ જીવાની એ એવા ચા સંસારનો ત્યાગ કરી શીખસુખને આપનારું જાંયમલદ્વારાને અંગીડાર કરું તો મારો મનુષ્યભાવ સરેદાં થાય.” એ વૈરાઘ્યની જ્ઞાનતામાં રાજની રાન્નિ પૂર્ણ થઈ ને ગ્રાતાંકાળ થયો. પદ્મરાણી કલાવતીને રાજી થાતાને અભિપ્રાય પૂર્ણથો, રાજનો અભિપ્રાય જાણી કલાવતી ખુશ થઈ ગઈ.

“મહારાજ ! એ વિચાર આપનો અવસરને યોગ્ય છે. જોગો પણ આપણે ધર્માકાલ જોગયા, રાજ્યસાહીભીય ભોયવી, રાજ્યને યોગ્ય પુત્ર પણ થયો, માટે પુત્રને રાજ્ય પારે સ્થાપી આપણે ચારિત લેવું તેજ એક યોગ્ય અવસર અત્યારે છે.” કલાવતીના વચ્ચનથી રાજના ઉત્સાહનો પણ વધારો થયો.

મંત્રીએને યોદાવી તેમતી સંમતિ મેળવી શુભ ખુલ્લરે રાજી પૂર્ણકલશનો રાજ્યાલિષેક કર્યો. પૂર્ણકલશને રાજ્યગાદીએ યેસાડી રાજ્યની સંપૂર્ણ જવાબદી તેને સેંઘી દીધી.

તે સમયે નંદનવનના ઉધાનપાલકે આવીને રાષ્ટ્રને વધામણું આપી. “મહારાજ ! ધર્મ શિષ્યના પરિવારવાળા અમિતતેજ ગુરુરાજ પદ્ધાર્યા છે.” ઉધાનપાલકની મધુરી

બાળી સાંલણીને રાજાએ તેને ન્યાલ કરી દીધો. અવસરને ચોગ્ય ગુરુમહારાજનું આવાગમન જાણીને રાજ ખણું ઝુશી થયો. મહા આડાંઘરપૂર્વક પરિવાર સહિત સંયમની સાવનાવાળો રાજ પ્રિયા સાથે ગુરુમહારાજને વંદન કરવાને નંદનવનમાં આવ્યો. પાંચ અભિગમ સાચવીને ગુરુને નમસ્કાર-વંદના કરી મંત્રી સામંત આદિ પરિવાર સહિત રાજએ સમયને ઉચિત એવી ગુરુની દેશના અવણું કરી. રાજરાણીની સંયમ ભાવનાને જ્ઞાનથી જાણુનારે ગુરુ અવસરને ઉચિત કરવાનું નજ ભૂલે.

દેશનાને અંતે રાજાએ પ્રક્રિયા. “ભગવન! કલાખતી દેવીએ પૂર્વ લવને વિશે એવું શું હૃષ્ટત કરેલું કે નિરપરાધી એવી એ દેવીની અજ્ઞે ભૂલાયો મેં છીદી નાખાવી!”

રાજના પ્રક્રિયા જવાબમાં જ્ઞાનવાન એ ગુરુ મહારાજ બોલ્યા. “રાજન! પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહેંદ્ર-પુર નગરને વિષે નરવિક્રમ નામે રાજ હતો. તેની પદ્ધરાણી લીલાવતીને સુલોચના નામે પુત્રી થઈ. અતુક્રમે તે આળા કામહેવને કીઠા કરવાને કીઠાઅહ સમાન યૌવન વયમાં આવી. એક દિવસે રાજ સલા લરીને એઠા હતો ત્યારે કોઈક પરદેશી પુરુષે રાજસલામાં આવીને એક પોપટ રાજ આગળ લેટ દીર્ઘા, ને એ પોપટના ગુણેણું વર્ણિન કરી રાજને ઝુશી કર્યો. એ પોપટે પણ અનેક સુલાઘિત-શ્લોક વડે રાજને રંલુત કર્યો. પોપટના ગુણેણી પ્રસન્ન થયેલા રાજએ તે પુરુષને ઝુઅ બન આપીને વિદ્યાય કર્યો.

રાજ નરવિક્રમે એ પોપટ પોતાની પ્રિય રાજકુમારી સુલોચનાને અર્પણ કર્યો. પોપટની ચતુરાધીથી રાજ થયેલી રાજકુમારીએ સુવર્ણનું પીજર તૈયાર કરાયું ને દ્રાક્ષ, દાઉમાંણ પીજ, અંજર, આમ્રકળ વગેરે સ્વાદિષ્ટ કર્યો.

તેને ખરવરાવવા લાગી. હું અને સાકર વડે શુક્ત પાણી પીવરાવતી એવો એ પોપટ રાજભાગાને પ્રાણથી પણ અધિક પ્રિય થઈ પડ્યો. એ પોપટ વગર એને ચેન પડતું નહિ. ઘણીકવાર પોતાના ઓળામાં બેસાડી પોપટને રમા-હતી હતી, પોપટ પણ અનેક નવીન શ્લોક સંલગ્ની કુમારીને રાણ કરતો હતો.

એક દિવસે સુલોચના પોતાની સખીઓની સાથે પોપટને લઇને કુસુમાકર નામના વનમાં આવી. એ કુસુમાકર ઉધાનમાં જીનેશ્વર ભગવાનનું ચૈત્ય જોઇ બહુ જ ખુશી થઈ જીનમંહિરમાં પ્રવેશ કરી રાજભાગાએ શ્રી સીમંધર સ્વામીની અતિ આનંદપૂર્વક સુતિ કરી. તે સમયે પેલો પોપટ પણ જીનેશ્વરના બિંભને જોઇ વિચાર કરવા લાગ્યો. “મેં ક્યાંક આવું જોયું છે.” પૂર્વની ભૂલાધ ગયેલી યાદશક્તિને તાજ કરતો હોય તેમ ખુખ એકાગ્રતા પૂર્વક વિચાર કરતાં પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવને પ્રત્યક્ષ જોનાર એ જાતિસ્મરણ જ્ઞાનથી પોપટ શું જોયું?

“ઓહ ! પાછળના ભવમાં અનેક શાસ્ત્રોને ભણ્ણાવી તેમજ ભણ્ણાવવામાં સાવધાન પંડિતોને વિશે શિરોમણિ એવો હું સાધુ હતો. પરંતુ પુસ્તકો અને ઉપધિ સંગ્રહ કરવામાં તત્પર રહી સંયમની શુદ્ધ કિયામાં શિથિલ થયો. એ ભવમાં એવી રીતે કંઈક પ્રતની વિરાધના અને કંઈક માયાને આચરતો ત્યાંથી કાળ કરીને આ ભવમાં હું શુક્ક-પણે ઉત્પન્ન થયો. પૂર્વ ભવમાં હું જાની હોવાથી આ ભવમાં શુક્કની યોનીમાં પણ મને જ્ઞાન થયું. પણ હા ! વિશ ! જ્ઞાનરથી દીપક મારા હૃથમાં પ્રગટ રહેલો છતાં મોહથી અંધ અનીને પુસ્તક અને ઉપધિમાં મુંજાઇને સંય-

મદ્દપી ધન હારી ગયો. છતાં આજે તિર્યંકું ભવમાં પણ મને ત્રિજગતસ્વામી જીનેથીર લગવાતું દર્શાન ખરું એટલું મારું પુષ્ટ્ય છલ્લ જગત છે તો હવે હે લગવન! તમારાં દર્શાન કર્યા વાર હું ભોજનને અહૃણું કરીશ નહિ.” પોપટ એ પ્રમાણે મનમાં વિચાર કરી સુવયમેવ નિશ્ચય કર્યો. તિર્યંચલવના પરાધીનપણાની પોતે નિંદા કરવા લાગ્યો.

સુદોયના પણ જીનેથીર લગવાનને નમી સ્તુતિ કરી પોપટનું પાંજડું લઈને પોતાના સ્થાને ચાલી ગઈ. થીકે દિવસે રાજકુમારીએ પાંજરામાંથી કાઢીને શુક્રને માટે રસ્યાહિષ કરું આવા માટે તૈયાર કર્યાં. તે હરમિયાન નમો અરિહંતાણું બોલતો પોપટ અંગારામાં ઉડી ગયો, તે જીનેથીરને નમબાને બાધ્ય ઉધાનમાં ચાલ્યો ગયો. ત્યાં લુદ્ધિપૂર્વક જીનેથીરને નમીને ઇલ આઢાર ફરતો ઉધાનમાં રમવા લાગ્યો, પરાધીનપણાથી સુક્ત થયેલા એ પંખીના આનંદમાં અત્યારે શી કમીના હતી?

પોપટના ઉડી જવાને રાજભાગાં આહંક કરતી ઝુલ વિલાય કરવા લાગ્યી. રાજભાગાની શાંતિ માટે રાજએ ઝુદ્ધિમાન સુલદોને મોકલી કંસુમાકર ઉધાનમાં એ પોપટને પકડી મંગાવ્યો. પકડાયેલા એ પોપટને રાજએ રાજભાગાને આપ્યો. રાજભાગાએ પોપટને પકડીને કોથથી એની પાંખો છેદી નાખી. “મને છેતરીને નાશી જવાતું ઇલ તું જોગવ, હવે તારાથી કયાંય જવાશે નહિ સમજયો.” એમ કહ્યીને કારાગારની મારુંક પોપટને પાંજરામાં પૂરી દીધેઠ પોપટ પણ મનમાં પદ્ધાતાપ કરતો વિચાર કરવા લાગ્યેટ. “હાય! વિગ્ર! આવી પરાધીનતાને વિકાર થાઓ.”

પિંજરામાં પડેલો પોપટ દુઃખી થયો છતાં વિચાર અને પદ્ધાતાપ કરવા લાગ્યો. “અરે! ભવાંતરમાં સ્વા-

ધિન-સ્વતંત્ર હોવા થતાં પ્રમાણણે પંચમહાશત હૃપિત  
કર્યાં તેનું જ આ ક્રલ છે. અથવા તો આનાથો અધિક વિડ-  
અના આગામી ભવોમાં એ પંચગ્રતને મહીન કરવાથી  
હું સહુન કરીશ. વળી આ ભવમાં પણ હું જીનેથીર  
અભ્યવાનનું દર્શાન કરી શકીશ નહિ". પંજરમાં પૂરાયેલો  
પોપ્ટ આ પ્રમાણે અધિકાધિક પશ્ચાત્તાપ કરવા લાગ્યો.

"હા ! એહિક શોક કરવાથી શું ? હે આત્મા ! શોકનો  
ત્યાગ કર, શોકથી અનેક પ્રકારે કર્મ પંધન થાય છે મારે  
હું હે જીનદર્શાને વિના મારે ખાંચું કદ્દપે નહિ ને જીન-  
દર્શાન હું થશે નહિ કેથી મારે અનશાન કરવું હીક છે."  
એમ વિચારી એ ધૈર્યવાન અને જ્ઞાની પોપ્ટે અનશાન  
અંગીકાર કર્યું, પંચ પરમેષ્ઠિમંત્રને સમરણ કરવા લાગ્યો,  
એ નવકારના ધ્યાનમાં અતુક્તમે પાંચહિવિસ વ્યતીત કરી  
અનશાનના પ્રભાવે સૌધર્મકલ્પમાં મહાન દેવ થયો. સુલો-  
ચના પણ એ શુક્રના દુઃખથી દુઃખિત થયેલી શુક્રની પશ-  
વાડ અનશાન અંગીકાર કરી શુલ્ક પામી. એ દેવની દેવી-  
પણે ઉત્પન્ન થઈ. ત્યાં અન્ને વિપયસુખને લોગવતાં દેવલઘ  
સક્રલ કરવા લાગ્યાં. દેવલઘનું આચુષ્ય પૂર્ણ થતાં એ દેવ  
સૌધર્મ દેવલોકમાંથી ન્યવીને તું શાંખરાજ થયો. અને  
સુલોચના કે દેવી થયેલી તે ત્યાંથી ન્યવીને કલાવતી થઈ.  
પરભવમાં તારી પાંખો છેદી નાખી તે કેરને બફલે આ  
ભવમાં તે તેના અન્ને હાથ છેદી નાખ્યા."

શુક્રના સુખથી પોતાના પરભવ સંખાંધી વૃત્તાંતને  
બાણી વૈરાઘ્યને અધિક શોભાવતાં તે રાજ રાણીએ દીક્ષાની  
પ્રાર્થના કરી. "હું જીગવન ! આ ભવનાદકમાંથી ઉજ્ઝવર  
કરનારી અમને દીક્ષા આપો."

"તમારા કેવાં જ્ઞાનવાનને એમ કરવું તે શુક્ર છે અતે

હે રાજન ! તમે તો ગૂર્ખીર છો માટે સારા કાર્યમાં ઢીલ ન કરવી". ગુરમહારાજે અતુમતિ આપી.

પૂર્ણકલાશ રાજાએ દીક્ષામહોત્સવ કરેલો છે એવા શાખરાજ અને કલાવતીએ ગુરમહારાજની પાસે શુભમુહૂર્તે દીક્ષા ગ્રહણ કરી. ગુરમહારાજ સાથે તાંથી વિહાર કરી જયા.

ગ્રહણ અને આસેવન શિક્ષાથી શિક્ષિત રાજર્ષિએ સારી રીતે શુદ્ધનો અભ્યાસ કર્યો ને શાસ્ત્રના પારગામી થયા. સૌધનો ત્યાગ કરી ક્ષમા ગુણને વારણ કરતા પરિઘહને સહન કરવા લાગ્યા. ઉપર્સર્ગને સમયે પણ ઉદ્દેગને નહિ પામતાં પોતાના સાધુપણામાં અપ્રમતાપણે રહેવા લાગ્યા. પરલવની સંયમ વિરાધનાને યાદ કરતા તે આ લવમાં સાવધાનપૂર્વક ચારિત્રની આરાધના કરવા લાગ્યા. જીવદ્યાની રક્ષા માટે ગમનાગમન પણ યતના પૂર્વક કરતા હતા. યતના પૂર્વક પોલતા હતા, યતના પૂર્વક ઐસતા હતા, આહાર વિહાર પણ યતના પૂર્વક કરતા હતા. સાધુપણામાં સર્વ કંઈ તેઓ યતના પૂર્વક કરતા હતા. એવી રીતે દૂરીખે સાધુપણાની સમાચારીનું આરાધન કરતાં શાખરાજર્ષિનો ડેવલોડ કાલ ચાલ્યો ગયો.

દીર્ઘકાલ પર્યેત ચારિત્રની આરાધના કરીને અંત સમયે શાખરાજર્ષિએ દ્વય અને લાય સંદેખના પૂર્વક અનશન અંગીકાર કર્યું. પોતાના પાપકર્મોની નિદા કરતા ને શુલકરણીને અતુમેદ્ધાત્તા શાખરાજર્ષિએ પંચપરમેષિના ધ્યાનમાં કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મ વિમાનને વિષે પાંચ પદ્ધ્યોપમના આચુષ્યવાળા દેવપણે ઉત્પન્ત થયા. કલાવતી સાધ્વી પણ સંયમનું નિરતિચારપણે આરાધન કરી અંતે અનશન અંગીકાર કરી કાલ કરીને સૌધર્મ દેવલોકને વિષે પદ્મ વિમાનમાં ઉત્પન્ત થયેલા એજ શાખ-

હેવની હવી થઈ, ખેલા સૌધર્મ કલ્પમાં બત્તીશલાઅ વિમાનો છે. દરેક વિમાને એકએક ચૈત્ય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાળ હોય છે. સાત હાથના શરીર પ્રમાણવાળાં અને મનુષ્યની પેડ વિષયસુખ જોગવનારાં હિંદ્ય હેઠધારી એ હેવદેવી સ્વર્ગનાં અનુપમ સુખને ભોગવતા લાગ્યાં, સેવક હેવદેવીનાં કરેલાં ગાયન અને નૃત્યને જોવા લાગ્યાં, અવસરે ત્યાં રહેલા શાચ્છ્યતા જીનપ્રાસાદોને વિષે પૂજને કરતા તેઓ હેવલવ સક્રણ કરવા લાગ્યા, મન ક્રાવે ત્યારે તે નંદીશર દીપે જાય, મનક્રાવે ત્યારે મેરપર્વત ઉપર જઈ કીડા કરે, મનક્રાવે ત્યારે અષ્ટાપદે જઈ જીનશેરને વાંદે, મન ક્રાવે ત્યારે નંદનવનમાં જાય. એવી રીતે પાંચ પદ્યોપમ સુધી એ હેવદેવીએ પોતાનો કાલ ડેવલસુખમાં જ નિર્ગમન કર્યો. હેવલવનાં એ રમણીય સુખો, એ રમણીય ભોગ-વિલાસની વિપુલ સામનીઓ, એ વાપિકાઓ, એ ઉધાનોમાં વિવિધ પ્રકારે કીડા કરતા અને લિન્ફબિન્ન શરીર વડે વિવિધ પ્રકારના ભોગ સુખને ભોગવતા જતા એવા કાલને પણ તેઓ જાણ્યતા નથી. જે ચારિત્રની આરાધના કરવાથી પ્રાંતે મોક્ષનું અનુપમ સુખ મળવાનું છે ત્યાં આવાં પૌદ્ધર-દીક સુખ અચ્યાનક મદે એની તો વાત જ શી?

પંચમકાલમાં પણ એવા ચારિત્રની નિદ્ધ કરનારા તેમજ ચારિત્ર આજે ક્યાં છે? એવું ઘોલનારા જીવો અજ્ઞાન હૈઝી અંધકારમાં જ રખડી રહ્યા છે, પોતાના પાપના ભારને તેઓ વધારી રહ્યા, છે એ સિવાય સાધુઓના વિધમાન-ગુણોને ન જોતાં અછતા હોવોને જોનારા તેઓ બીજું શું કરી શકે?

## પરિચ્છેદ ૨ નો

### કમલસેન અને ગુણસેના

૧

#### કમલસેન.

સ્વર্গના ઢુકડા સમુ પોતનપુરનગર જગતભરમાં અતિ સ્વચ્છ અને પ્રચ્છડ શહેર ગણાતું હતું, નગરના ઊંચા મિનારાએ તેમજ કીલાના યુરણે આડાશ સાથે વાતો કરી રહ્યા હતા, મોયા મોયા આલિશાન અને ભષ્ય પ્રાસાદોથી અમરાવતીની શાલા ઝંખવાઈ જતી હતી, એ પોતનપુરના મહારાજ શાંતુજ્ઞયે સમગ્ર શવુંએને લુતી પ્રજાનું ન્યાયથી રક્ષણ કરીને પોતાતું નામ સાર્વક કરેલું હતું, શુદ્ધ શિયલને પાલન કરનારી વસ્તસેના નામે પદ્ધ રાખી સાથે દેવ સમાન સુખને અનુભવતો શાંતુજ્ઞય રાજ જતા એવા સમયને પણ જાણુંતો નહિ. દેવતાએ પણ ઈર્ષા કરે એવું એ સુખ જાણે શચી અને શચીપતિનું હશે કે શીવ અને પાર્વતીનું સુખ હશે? રાજ્ય અને રમણીનાં સુખોમાં ભશણું બનેલા એ નરપતિ! ખળ, ખુદ્ધિ, સાહસ અને પરાહમ ઉપરેજ મુસ્તાક રહેનાર એ નરનાથના સુખમાં અત્યારે શરી ઉષ્ણપ હતી? અને એ કંઈ પણ ઉષ્ણપ હતી તો માત્ર એક રાજગાઢી સંભારી શકે તેવા રાજકુમારની.

જગતમાં જેએ પૂર્ણ ભાગ્ય લઈને જન્મેલા છે તેમના મનોરથે સફલ થાય છે, ભરતામાં હમેશાં ભરતીજ થયા કરે છે, પુણ્યશાળીને એક પણી એક ભાગદ્ય પ્રસંગે પ્રાપ્ત

અથા જ કરે છે. આવા આગ્યશાળીને ત્યાં હેવો પણ ખુદ અવતાર ધારણ કરે તો એમાં આશ્ર્ય કેવું શું છે ! અરે ! ખુદ દૈવનેજ એમની ચિંતા કરવી પડ તો એમાં નવાદ રી ?

પદ્મશાળી વસંતસેનાએ યથા સમયે ગર્ભધારણ કર્યો. સૌધર્મ દૈવલોકમાં દૈવસવનાં સુખ લોગવીને શાંખરાજને જીવ ત્યાંથી ચ્યાવી વસંતસેનાના ગર્ભમાં ઉત્પત્ત થયો, એ સારા ગર્ભના પ્રભાવથી જીવદ્યા પળાવવી, સાધભિંક બાત્સદ્ય કરવું, દીન, દુઃખી અને અનાશોને છુટે હાથે હાન હેવું, આધ્યારણેને સંતોષ પમાડવો વગેરે હાહદ્દો ઉત્પત્ત થયા. તે અધા રાજએ પૂર્ણ કર્યા, તે દિવસે સ્વમામાં પદ્મશાળીએ સુખે ચૂતાં ચૂતાં કમલથી પરિપૂર્ણ સરોવર જોવું. હું ગર્ભને સારી રીતે પ્રાપ્ત કરતાં પદ્મરાણી વસંત-સેનાએ યથાસમયે પુત્રને જન્મ આપ્યો. વધામસ્તુ આધનાર સુસુખીદાસીનું દારિદ્ર રાજએ દૂર કરી દીઢું, સગાં, સંખાંધી આહિ સવેને આમંત્રી લોજનથી સંતોષ પમાણા. રાજએ મોટો જન્મ મહોત્સવ કર્યો ને સ્વમને અનુસારે રાજકુમારનું નામ પાડ્યું કમલસેન.

રાજના વંશરૂપી નલોમંડલમાં દ્વિતીયાના વંડની માઝેક વૃદ્ધિ પામતો કમલસેન સકલ શાસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પારગામી થયો, નવીન યૌવન વયને પ્રાપ્ત થયો. રમણીજનને વલલલ એ મનોહર યૌવનવથનાં એનાં તેજ, કાંતિ, એનાં વદનની પ્રતિલા, એની ઇન્દ્રાયલરી ગતિ, લાવળયથી નિસરતી એની સુકુમારતા એ અધાં જાણે હેઠ-પણામાંથી સાચે લાવ્યો હોય, ને જાણે બીજો દેવ કુમાર રૂઢ્યી પર આવ્યો કે શું !

પુણ્યની ઘિલેલી કળીની માઝેક યૌવનમાં વિહરવા છતાં એ વૈરાગી હતો, અનેક મહ લરેલી નથીન અલ્લુ-

દ્યવાળી શુવતીએના નેત્ર કટાકથી પણ જે ઘવાતો નહીં  
પુરની રમણીય કાંતિવાળી રમણીયાના હાવલાયોમાં પણ  
જે લોલાતો નહીં. તેમજ નૃય, ગાન, સંગીત આદિ  
અનેક કુહલોમાં પણ જે આકર્ષણી નહીં, એવો વિકાર  
રહિત કમલસેન પરસ્વવના સુકૃતના અભ્યાસથી યૌવન  
છતાં ઈદિયોને દમન કરનાર, ડગલે ને પગલે જીવદ્યા  
પાળવાની કણળ રાખનાર, મુનિની માર્કે સત્ય બોલન  
નાર તેમજ જરૂર પુરતુંજ બોલનાર વિવેકી થયો. કારણ  
કે લોગકુળમાં ઉમજ થયો. હોય કે રાજ્યકુળમાં, પણ  
ભવાંતરના સારા યા માણ સંસ્કારો જળક્યા વિના રહે નહીં.

વસંતમઝતુંએ પોતાના અનેરા આભૂષણાથી દુનિ-  
યાની લીલાને રમણીય બનાવી હતી. ઉધાનોમાં અનેક  
વૃક્ષ, લતાએ લચીપણી પોતાની શોલા વધારી રહી હતી  
વિવિધ પ્રકારની લતાએ પુણ્યોના ભારથી ભડી પડેલી  
ને રજકણુના રણીયાથી વનના વાયુને સુગંધિત કરતી  
રસિક માનવીનાં દિલ બહેલાવી રહી હતી. એ વસંતની  
શોલામાં મહાલવાને ભિત્રોએ કમલસેનને પ્રેરણા કરી.  
કમલસેન ભિત્રોના આથહને વશ થઈ વસંતનો રાગ જોવા-  
ને નંદનવનમાં ગયો. ત્યાં ભિત્રો કમલસેનને પ્રસન્ન કરવાને  
અનેક પ્રકારે કોઈ કરવા લાગ્યા. ઉધાનના આકર્ષણોમાં,  
લોલાયેલા ભિત્રો મજા માણુતા આગળ નિકળી ગયા,  
હરમિયાન કમલસેન કંઈક રૂધન જેવું સાંસર્યું. “આહા !  
પૃથ્વી નિર્નાથા થઈ ગઇ !”

એ શાફદ સાંભળીને કમલસેન ચ્યમક્યો. “પિતાજી  
ન્યાયથી પ્રજાને પાણે છે આ કોણું દુઃખી જી પોકારે  
છે ?” એણે તપાસ કરી પણ કંઈ જણાયું નહીં. “ગુંજા-  
રૂપ કરતા ઓમરાના શાફદોમાં મારી એ ઓમણા થઈ હશે.”

એમ વિચારી ચિત્તને બીજુ ફેરબયું છતાં એ ત્રણાવાર એ શાખદો સાંભળાયા, કંઈક નિશ્ચય કરી કમલસેન શાખાનુસારે આગળ ચાલ્યો. તો દેવમંહિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોગ તે પણ દેવમંહિરમાં આવ્યો, દેવમંહિરમાં પ્રવેશ કરી પેદી સ્ત્રીને કમલસેન પ્રક્રિ કરે ત્યાં તો આશ્રમ્ય !

કમલસેનના જોતા જોતા દેવમંહિર આકાશમાં ચાલવા લાગ્યું. ક્ષણ માત્રમાં ડેલેક હૂર જઈ રમણીય વનપ્રહેશમાં ઉત્તરી ભૂમિ ઉપર સ્થિર થયું. વિસ્મય પામેલો કમલસેન વિચાર કરે તે પહેલાં તો પેદી સ્ત્રી અંદરના લાગમાંથી બહાર આવી પોલી, “હે સ્વામિ ! તમારું કલ્યાણ થાઓ. કુશળ તો છાને ? આ આસન ઉપર બીરાંજે ?”

હે કલ્યાણી ! તું કોણ છે ? ને આ બધું ધન્દળણ જેવું શું છે ? કુમારે અભયબીધી પૂછ્યું.

“હે પ્રાણેશ ! આ બધું તમારે માટે કર્યું છે. મારું નામ અંગલક્ષમી છે. હું આ નગરની પ્રાણ્યાત નાયિકા છું. આજસુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું સનાથા થઈ છું.” અંગલક્ષમીના ઉત્તર સાંભળી કમલસેન ચ્યમક્યો.

“અરે ! આ તું કુલને મહીન કરનાર વચન શું પોલી ? અનાથ અને હુંઘીજનોનું પાલન કરવાથી હું તેમનો નાથ છું પણ પરસ્તીના અહૃણું નહિ. ” એ અંગલક્ષમીના કાલાવાલા છતાં તેનો તિરસ્કાર કરીને કમલસેન દેવમંહિરમાંથી બહાર નિકળી ગયો.

“અરે ! જો તું તને પોતાને બળવાન ને સુખી માનતો હોય તો મારી સામે આવ !” બહાર જતા કમલસેને ચાનક લાગે તેવા શાખદો સાંભળ્યા.

“એહા ! સ્વતંત્ર વિહારી આ વનરાજને રોકનાર તું કોણું ?” કમલસેન ગણયો.

“સ્વતંત્ર વિહારી વનરાજ ?” કરદાકીથી તે પુરુષ બોલ્યો. “ને તું વનરાજ હો તો મારા પ્રહારને સહન કર.” ભયંકરદ્વષ્પને ધારણું કરતો હૃતાંત સમો તે પુરુષ હાથમાં મુદ્દગળને નચાવતો કમલસેન સમક્ષ હાજર થયો.

એ ભયંકર પુરુષને પોતાના જાગ્રત્ત્યમાન અને તેજસ્વી નત્રોથી કરતો કમલસેન બોલ્યો “આવી જા, પહેલો તું ધા કર.”

“પહેલો ધા તું કર.” અદૃહાસ્ય કરતો રાક્ષસ બોલ્યો.

“નિર્દીષ ઉપર હું કદાપિ પ્રહાર કરતો નથી.” પોતાના ખૂબાને જોતો કમલસેન બોલ્યો. કમલસેનના સત્ય અને હિંમતથી પ્રસન્ન થયેલો. તે પુરુષ પોતાની ભયંકરતા સંહરી સૌભય મનોહરદ્વષ્પ ધારણું કરતો બોલ્યો “કુમાર ! તુંજ અંગાલક્ષમીને યોધ્ય છો ! સત્યશાળી છો.”

“અને તમે કોણું ?” પ્રસન્ન થતો કુમાર કમલસેન બોલ્યો.

“વિશાળ એવી ચંપાનગરીનો અધિકાર્યક હું હેવ છું. કુમાર ! પેલી પ્રૌદ નાયિકા, હેવકુલતું આકાશમાં ગમન, પેલો ભયંકર અદૃહાસ્ય કરતો રાક્ષસ એ બધીય મારી માયા તારી પરીક્ષા માટે હતી, માટે તું એ ક્ષમા કર.” ચંપાના અધિકાર્યક હેવે ખુલાસો કર્યો. એ ખુલાસાથી કુમાર વિચારમાં પડ્યો. “આ બધું તમારે કરવાની જરૂર ?”

“તે તમને હેવે અદ્ય સમયમાં જ ખાર પડશો, આ ચંપાનું રાજ્ય અને રાજ્યસુતા તમને વરશો”. એમ કહી હેવ અદૃશ્ય થઈ ગયો.

હેવદર્શન પણી કુમાર કમલસેન ત્યાંથી આગળ ચાલ્યો.

ને શુકુન પણ સારા થયા, ઘર છાઈને વન જાય તોય પુણ્ય-  
વાનેને શું ? એક અહના ગુલામની માર્ક હૈ જ એમની  
ચિંતા ન કરે તો જાય પણ કર્યાં ?

નાના જ અનેક નાના મોય વૃક્ષરાણી સુશો-  
ભિત, કમલાએ કરીને પરિપૂર્ણ, સ્વચ્છ જળથી ભરેલું  
સરોવર જેખું અને જરી સ્નાન કરી પરિશ્રમ ઉતારવાની  
મરજ થછ. જળકીડા કરી કુમાર અહાર નિકળ્યો તો મનો-  
હર સાજથી સુશોભિત અથ્યની લગામ પકડીને ઉલેલા  
એક પુરુષ ઉપર તેની દાઢિ પડી. પોતાની ઉપર દાઢિ પડતાં  
તે પુરુષ બોલ્યો. “હે સ્વામિન ! આ અથ્ય ઉપર આપ  
એસો.”

“તું કોણું છે ? ને મને કર્યાં લઈ જવા છુંછું છે ?”

“ચંપાનગરીના ગુણુસેન રાજ અહીંથી નાના-  
વનમાં કીડા કરવાને આવેલા છે, આપ ત્યાં આવીને ચંપા-  
નરેશના મહેમાન થાયો.”

એ પુરુષની વાત સાંભળી કુમાર અથ્યાર્થ થધને  
આદ્યો. નાનાવનમાં અશોકવૃક્ષની નીચે એડેલા ગુણુસેન  
રાજ અને ભતિવર્ધન મંત્રીએ કુમારનું સ્વાગત કર્યું.  
અનેક વારાલાપ થયા, સમયના જાણ મંત્રીએ રથમાં  
એસાડીને કુમારનો ચંપાનગરીમાં પ્રવેશ કરાવ્યો. ગુણ-  
સેનરાજ પોતાના મહેલમાં ગયા ને કુમારને મંત્રી પોતાના  
આવાસે તેડી લાવ્યો. ખાન, પાન અને સેવા લક્ષ્ણથી  
કુમાર પોતાનું ઘર પણ વિસરી ગયો. ક્ષણની કેમહિનસ  
વહું ગયો ને નિશા આંદી પહોંચ્યી.

રાત્રિને સમયે પુરુષની શથયા સમાન સુકુમાલ શથયામાં  
સુતેલા કુમાર પાસે ભતિવર્ધન મંત્રી આવ્યો, એકાંતનો  
સમય મેળવી બોલ્યો. “રાજકુમાર ! આજ વર્ષોથી અમારું

ચિત્ત અભિમાં રહેલા કાકની માર્ક પ્રજાળી રહ્યાં છે તે તમારો હર્ષનિર્ધી જગથી શાંત થયાં, કારણે કે ઉદાર ભાવનાશાળી પુરુષો હેમેશાં પરોપકાર કરવાના સ્વલ્પાવના હોય છે. માટે હે રાજકુમાર ! તમે આ અંગદેશની રાજલક્ષ્મીને અહૃતુ કરી અમારા સ્વામીના મનોરથું પૂર્ણ કરો. ”

મતિવર્ધનમંત્રીની વાણી સાંભળી કુમાર કંઈક આશ્ર્યે પામ્યો, મંત્રિ ! ગુણુસેન જેવો તમારે નવચુવાન રાજ છતાં તમે નવા રાજની ધર્ષા કરો છો એ ખુબ નવાધિ ભરેલું છે, જરા સ્પષ્ટતાથી કહો ? શું હકીકિત છે તે ? આતુરતાપૂર્વક અંહરનો લેદ જાણવાને ઈચ્છિતા રાજકુમારની ધર્ષા ટુસ કરતો મંત્રી બોલ્યો.

“રાજકુમાર ! આ નગરમાં શ્રીકેતુ નામે રાજ હતો, વૈજ્યંતી નામે પદ્મરાણી હતી, રાજના ચિત્તને અતુસરનારી હતી. ન્યાયથી પ્રજાનું પાલન કરતો એ ધર્મપરાયણ રાજ પ્રાતાનો કાલ સુખમાં વ્યતીત કરતો હતો. એક દિવસે રાજસભામાં વિવિધ વાતાવાય થતાં એક જણે પ્રક્રિયા કર્યો. “આપણા નગરમાં સુખીમાં સુખી કોણું ?”

“ભાગ્યવંતોમાં સુગુણમણિ તુલ્ય વિનયંધર નામે વ્યવહારીયા આપણા નગરમાં દેવતાને પણ છર્યા આવે તેવું સુખ લોગવે છે”. કોઈક લદ્દરાજે જવાબ આપ્યો.

“શું રાજથી ય વધારે ?” કોઈએ શાંકા કરી.

“હા ! વધારે !” એ લડુનિડરપણે બોલ્યો. “મહન-રાજ કામહેવ સમાન એ શોઠ ઇપલાવણ્યવાળો છે. કુષેર-ભંડારીની માર્ક એના ધનલંડાર ભરેલા છે. તેમજ દેવાં-ગનાઓના તિરસ્કાર કરે તેવી અને શોઠનો પડતો બોલ

જીલી લેનારી ચાર પ્રિયાએ છે જે હરરોજ શોઠના ચિત્તને અનુસરનારી-આજ્ઞાંકિત છે.”

“વણીક સ્ત્રીની પ્રેરણસા કરવા જતાં તમે દ્વીપની નિંદા ન કરો.”

“અરે ભાઈ ! નિંદા સુટિનો એમાં સવાલ જ નથી. આતો જગત પ્રસિદ્ધ વાત છે અને તેય આપણા નગરની, આતરી કરી દ્યાને.”

એ વાતચિત એટલેથી અદકી ગઈ, પણ ફૈવ્યોગે એ વાતચીત રાજના મનને અમિત કરતી ગઈ. એ ચારે શુદ્ધતીએ ઉપર રાજ આસક્ત થયો, જગતમાં એક વસ્તુને જેવામાં એટલી બધી આસક્તિ નથી થતી કે એ વસ્તુની અશાંસા સંલળવાથી થાય છે. ત્યારથી અમારો એ ધર્મ-વાન રાજ અધમી-અન્યાયી બની ગયો.

પરસ્પીએની પ્રેરણસા માત્રથી પરાસવ પામેલો એ રાજ અહેનિશ હુક્યાંન કરવા લાગ્યો. એ વણીક રમણી-એને વશ કરવાના ઉપાય ચિત્તવવા લાગ્યો. લોકો પોતાની નિંદા કરે નહિ ને એ ચારે રમણીએ પોતાને આધીન થાય એવો શું ઉપાય ?

એ સ્ત્રીએના વિરહ અભિથી સંતમ થયેલો રાજ રાજકુલમાં પણ ઉદાસ વૃત્તિવાળો થઈ ગયો. કામાભિથી દુષ્ટ થયો છતો પોતાના નિર્મણ કુળને મલીન કરવાને પણ તૈયાર થયો. દુષ્ટ તો રાત્રિએ અંધ હોય છે. પણ કામાંધ તો દિવસ અને રાત્રિએ પણ અંધ હોય છે.

## ૨

### ચાંપાપતિની કથા.

પરસ્પીના રંગથી રંગાયેલો આ વ્યાલિયારી રાજ વિનયંધરને કસાવવાનો વિચાર કરવા લાગ્યો. તે સિવાય

ચારે રમણીઓને પોતાના અંતઃપુરમાં લાવી શકાય નહિં.  
રાજ પ્રજાનો પાલક કહેવાએ એજ પ્રજાનો લક્ષક શી  
રીતે થઈ શકે ? કેાઈ પણ કારણ વગર, વગર ગુનહારે  
નિર્દીષ્ટને શી રીતે હંડી શકે ? લોકોને જણાવવા પૂરતો  
પણ વિનયંધરને ગુનહેગાર તો બનાવવો જોઈએ. સત્તા,  
અભ્યર્થ અને કામથી અંધ થયેલા રાજાઓની ખુદી જ્યારે  
વિકૃત થઈ જાય છે ત્યારે જ ન્યાય અન્યાય, પાપ પુણ્યનેટ  
કે લાવીનો કંઈ પણ વિચાર કર્યો વગર પાપાંધકારમાં  
કંઈ જાનું તે બના. જીવનકભને ડેરવી નાખે છે ને ધતિ-  
હાસના કેમને ઉંઘ્યો વાળી નાખે છે. કારણ કે લાવી જ  
એમનું અંધકારથી ભરેલું હોય ત્યાં બીજું થાય પણ શું ?

રાજના કહેવાથી પુરોહિતે વિનયંધર સાથે કંપટ મૈત્રી  
કરી. વિનયંધર સાથે ખાન, પાન, વાર્તાલાપના પ્રસંગ  
પાડીને સ્નેહની ગાંડ મજબૂત બનાવી. એક હિવસે નિર્દીષ  
વિનયંધર પાસે પુરોહિતે લોજપત્ર ઉપર કંઈક લખાયું.  
પણ નિર્માલિય ગણીને વિનયંધરે ઝગાવી દીધું. એ નિર્મા-  
દ્યગણાતા લોજપત્રને આસ્તેથી વિનયંધરથી ગુમ રીતે  
પુરોહિતે પોતાના ખીરસામાં ડેરવી દીધું ને રાજની પાસે  
આવીને તેમના હાથમાં ધરી દીધું.

રાજસભામાં બેઠેલા રાજએ વિદ્ધાનોની સામે એ  
લોજપત્ર ધરી એમાંના લખાણને વાંચી સંભળાવવાની  
આજા કરી. પંડિતાએ વાંચી વિચારી રાજને કહ્યું. “મહા-  
રાજ ! આતો વિનયંધરનું લખાણ છે, આ આપને ક્યાંથી  
મહિયું ?”

“મારા અંતઃપુરમાંથી આ કાગળ પકડાયો છે. શું  
વિનયંધરનામાં પણ કામડપી પિશાચ ભરાયો છે ? મને  
કહ્યા તો ખરા એમાં શું લખ્યું છે તે ?” રાજએ કહ્યું.

“હે પ્રિય ! હે મૃગાક્ષિ ! તારા વિચોગ વિરહાનલથી અળી રહેલા મારી ચાર પ્રહરની રાત્રિ સહસ્રરાત્રિ પર્યંત લાંખી થમું.” પંડિતે શ્વેષનો ભાવાર્થ કહી સંભળાવ્યો. રાજ કોથથી લાલચોળ અની ગયો. એહા ! વિનયંધર ! અને તે મારા અંતઃપુરમાં ? આ શો ઉત્પાત ?” રાજએ નાટક ભજવવા માંડયું.

“રાજન ! વિનયંધર પવિત્ર અને શીલબ્રતનો ઉપાસક, ધર્માચારી શિરોમણિ છે. એનામાં આ દ્વાપ સંભળી શકે જ નહિ. સુવર્ણમાં શ્યામતા કહિ હોઈ શકે ? દૂધમાં પોરા ન હોઈ શકે. ડોઈક હુર્ઝન મનુષ્યનું આ કાવતદ્વારાય છે. માન સરોવરને વિષે રહેલો હંસલો તો મુક્તા-ક્રણનો જ ચારો ચેરે, રાજન !”

અનેક સલ્ય અને મંત્રીઓની શિખામણ નહિ ગણું-કારતાં રાજએ ડોટ્વાલને હુકમ કર્યો. “જાયો ? એ દુરા-ચારી વ્યલિયારી વિનયંધરને પકડી કારાઅહમાં પૂરીઓ ! એનાં મકાનોને સીલ કરો. ને તેની સ્ત્રીઓને અંતઃપુરમાં ચ્યાકી પહેરા નીચે રાખો.” રાજનો હુકમ સાંભળી તીરની માઝેક ડોટ્વાલ પોતાના સુલદો સાથે છુટ્યો. અધી ચંપા-નગરીમાં હાણુકાર વર્તી રહ્યો, વિનયંધર જેવા પવિત્ર પુરુષ ઉપર આદૃત ઉત્તરેલી જોઈ નગરજનો કદ્યપાંત કરવા લાગ્યા. અરે અવિચારી રાજએ આ શું ઉત્પાત કર્યો ?

રાજનો હુકમ અનુવી ડોટ્વાલ રાજની સન્સુખ આવીને નમ્યો, વિનયંધરને મકાને સીલ કરીને વિનયંધર અને એની ચારે સ્ત્રીઓને ડોટ્વાલે રાજની સમક્ષ હાજર કરી. એ ચારે રમણીઓને પણ લબ્જે એવી આ રમણીઓ અચિત મારેજ ચોણ્ય છે. હું જરૂર એમને મનાવી લઇશા.

રાજાએ વિનયંધરને કારાશહમાં પૂર્ણો ને ચારે સ્કી-  
ઓને અંતપુરમાં મોકલી દીધી. રાજાએ વિનયંધરનો  
પક્ષ કરનારા નાગરિક જનોને કુણું કે “હે લોકો ! જો  
વિનયંધર શુદ્ધ હોય તો તે હિવ્ય કરે તો છાડી દઉ.”  
તિરસ્કાર કરી રાજાએ નાગરિકોને વિદ્યાય કર્યા, ને સલાનું  
કામ પૂર્ણ કરી અંતઃપુરમાં ચાલ્યો ગયો.

અંતઃપુરમાં રહેલી એ ચારે સતી સાંધી સ્કીઓની  
રાજાએ ખાન, પાન, વસ્ત્ર વગેરે માટે સારી વ્યવસ્થા કરી,  
ખુશામત કરી, પણ એ ચારેએ ખાન, પાન, સર્વે તણ  
કુણું, નવકારમંત્રનું સમરણ કરતી તે જુનેશ્વરનું ધ્યાન કરવા  
લાગી. નિશા સમયે રાજાની દાસીઓએ એમનું મન રાજ  
તરફ વાળવાના અનેક પ્રયત્ન કર્યા, છતાં તેની કંધ અસર  
થઈ નહિ ને દાસીઓને તિરસ્કાર કરી કાઢી ભૂકી.

મહનના કાજળથી લીંપાયેલા શ્યામસ્વરૂપ રાજાએ  
રાત્રિ તરફાતાં તરફાતાં પૂર્ણ કરી, દાસીઓએ નિરાશાના  
સ્થભાયાર કહ્યા છતાં પણ નિર્લજ્જ અને નંદિ એ રાજ  
પ્રાતઃકાળે સુંદર વસ્ત્રોથી સજજ થઈ એ ચારે રમણીયોની  
પાસે આવ્યો પણ એ ચારેમાંથી કોઈએ રાજાની સામેય  
નોણું નહિ, કે બોલાવ્યો પણ નહિ. દીપકની જ્યોતમાં  
જલી રહેલો પતંગીયાની માઝે રાજ એમનાં સૌદર્યમાં  
ભુગ્ય થયો છતો વિકારથી એમને નિહાળતો કુચેષા કરવા  
લાગ્યો, નિર્લજ વચ્ચનને બોલતો એ સતીઓને હેરાન  
કરવા લાગ્યો, ત્યાં તો આશ્ર્ય !

સારી આલમમાં મનોહર ગણ્યાતી એ યુવતીઓ  
એકદમ કદ્દિપી અને બેઠાલ અની ગઠ, રૂપમાં હિવાનો  
અનેલો રાજ એકદમ ચોંક્યો. “એહો ! આ શું !”  
રાજાએ પોતાની આંખો ચોણીને નજર કરી તો મોદા

લાંબા દાંતવાળી, ઉંઘના જેવા ઓછ વાળી, વાંકી ચુંકી નાસિકવાળી, જોળી જેવા પેટવાળી, બેઠાલ એ શ્યામ મૂર્તિએને જોઈ રાજ ગલરાયો. “ અરે ! મેં પૂર્વ જેયેહું સૌંદર્ય ક્યાં ? ને આ કુરૂપતા ક્યાં ? ”

પદૃરાણી વૈન્યવંતી પણ રાજના દુરાચારને જાહીને ત્યાં આવી પહેંચી રાજની આ ચેષ્ટા જોઈ નિભાર્સના કરી. “ અરે દુરાચારી ! નૃપ કન્યાનો ત્યાગ કરી આવી અધ્યમ સ્ત્રીમાં દોલાધ ગયા, મને લાગે છે કે હવે તમારો દી કુરી ગયો. ”

લજન પામેલા રાજએ એ ચારે સ્ત્રીએને પોતાના પંજમાંથી સુક્ત કરી ને વિનયંધરને પણ છાડી મૂક્યો. એ ચારે રાજમહેલની ખણાર નીકળી કે તરતજ મૂળ સ્વરૂપમાં આવી ગઈ, આ આશ્ર્ય જોઈ રાજ ખુલ્ય અન્યથ થયો. સતીના તેજથી ભય પામી એનાં ઘરથાર માલમિદકત બધું એમને સોંપી દીધું. સતીએના પ્રત્યક્ષ ચમત્કારથી ભય પામેલો રાજ માટી વિમાસણમાં પડ્યો. “ રહેને પોતાના ઉપર કંઈ આકૃતા ન ઉતરે ! ”

એક હિવસે ચંપાનગરીના પાદે જાની સૂરસેન ગુરુ પધાર્યા, પૌરજન સહિત રાજએ ગુરુને વંહન કરી ધર્મ દેશના સાંભળી. દેશના પછી ધણા વખતથી મનમાં રહેલો સંશય રાજએ ગુરુને પૂછ્યો. “ લગવન ! આ વિનયંધર શ્રેણિએ શું પુણ્ય કરેલું કે જેથી આવી મહાન ઇપવતી સતીએભાં શિરોમણિ ચાર સ્ત્રીએનો ભરથાર થયો ? એ આરે સુરૂપવાન છતાં કુરૂપવાન મારા જેવાભાં આવી તે પાછી મૂળ સ્વરૂપમાં આવી ગાધ. એ બધું સ્પષ્ટતા પૂર્વક આપ કહો ? ”

રાજની શાંકાનું સમાધાન કરવા ગુરુએ વિનયંધરનો

પૂર્વભવ કહેવો શરૂ કર્યો. તે બધા નગરના લોકો, અને ચારે પ્રિયાઓ સહિત વિનયંબર આતુરતા પૂર્વક સાંભળવા લાગ્યા.

“હે રાજન ! એ બધામાં કર્મ એકજ કારણ છે તે તું સાવધાનતા પૂર્વક સાંભળ ! પ્રાચીન કાળને વિષે ગજપુર નગરમાં વિચારખવલ રાજ હતો. તે નગરમાં વૈતાલિક નામે ઉદ્ધાર લાવનાવાણો અને પરોપકાર કરવામાં રસિક ધનિક રહેતો હતો. ફરરોજ તે વૈતાલિક પોતાને બેર તૈયાર કરેલા લોજનમાંથી કોઈ અતિથિને જમાડીને પછી પોતે જમતો હતો. દાન અને બીજાનું લખું કરવાની વૃત્તિવાળા તે વૈતાલિકે એક દિવસે તે ઉત્સર્ધીમાં ઉત્પન્ત થયેલા નવમા જીને થરને ગજપુરની બહાર તિંડુક નામના ઉદ્ઘાનમાં કાઉસગ્ગ ધ્યાને જેયા. જીને થરની બંધ્ય મુદ્રા જોઇ વૈતાલિક ઝુશી થયો છતો એમની સહૃતિ કરવા લાગ્યો, ભક્તિથી એમને વંદના કરવા લાગ્યો. અંતરના ભાવ પૂર્વક સહૃતિ કરતા એ વૈતાલિકે પોતાના આત્માને અનંત પાપના ભલથી પવિત્ર કર્યો. ભવિતવ્યતાના યોગે મહાન લાલ મેળવી તે પોતાને સ્થાને ગયો.

હૈવચોગે તે ભગવાન પણ આહાર સમયે ઝરતા ઝરતા વૈતાલિકને બેર આવીને ઉસા રહ્યા, સાક્ષાત કદમ્બવૃક્ષને અનાયાસે પોતાના બાંગણું આવેલું જાણું વૈતાલિકના હૃદ્દની તો વાત જ શી ? ઝુણું ઝુણું ભગવાનની સહૃતિ કરી મનોહર સ્વાદિષ્ટ એવા મિષાનથી ભગવાનને પ્રતિદાનિત કર્યા. જીને થરને દાન હૈવાથી તુષ્ટમાન થયેલા હૈવતાએ પણ દાનને વખાણ્યા લાગ્યાં ને ત્યાં પંચહિંદ્ય પ્રગટ થયાં. જીને થરને દાનનું પ્રત્યક્ષ ઝૂલ જોઇ વૈતાલિક સમજિ ધારી શુદ્ધ આવક થયો. દાનના પ્રસાવથી વૈતાલિક અતુકુમે પ્રથમ હૈવલોક હૈવતા થયો. હૈવાંગનાઓ સાથે વિવિધ કીઠાને

કરતો તે હેવ આયુઃક્ષયે ત્યાંથી વ્યવીને આ ચંપાનગરીના રેલસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો, માતાપિતાએ એનું વિનયંધર નામ પાડ્યું, તેજ વિનયંધર આ પાતે.”

જીનેથીરને દાનદેવાના પ્રલાવથી વિનયંધર આવું અપૂર્વ સૌભાગ્ય પામ્યો છે. જેના સૌભાગ્યની તારા જેવાને પણ ધર્ષા થાય છે, એના પ્રથળ ભાગ્યના બોગે તું રાજ છતાં એનું અપ્રિય કરવાને શક્તિવાન નથી. એ અધ્યાય ભગવાનને દાન આપ્યાનો ભણિમા છે. અરે આ ઇલ તો એક પ્રાસંગિક ઇલ છે હેવતા અને મનુષ્યનાં ભોગ સુઝો એ તો મુક્તિ જનારા આત્માને માટે સંસારના એક વિસામા છે બાકી તો દાનનું અરેઅર ઇલ તો શીવ વધુની વરમાળા ધારણ કરવી એજ છે. એ ઉત્તમદાનના પ્રલાવથી સૌભાગ્ય, આહિ અનેક ગુણો વિનયંધરને પ્રાપ્ત થયેલા છે. એક હેવજ જેની ચિંતા કરે છે એવા વિનયંધરનાં વિશેષ તે શું વખાણું કરીયે?”

સૂરિએ વિનયંધરનું કથાનક પૂર્ણ કર્યા. એની ચમતકા-રિક કથા સાંભળી બધા આનંદ પામ્યા. રાજ પણ વિનયંધરનું ચરિત્ર સાંભળી ખુશી થયો. હવે વિનયંધરની ચારે પલ્લીઓની પૂર્વભવની કથા ગુજરે કહેવી શરૂ કરી.

### ૩

#### રતિભુંદરી.

“થાય પ્રલાય પૃથ્વીતણો, સિંહ કદિ અડ ખાય  
પૃથ્વીમ સૂર્ય ઉગે કહિ, સતી શરણ ન થાય;”

આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. ત્યાં શત્રુઓની લક્ષ્મીને પોતાના થરણો તળે દ્વારાનાર નર-કેશરી રાજ હતો, તેને કમલસુંદરી નામે રાધીથકી રતિ-

સુદુરી નામે કન્યા થઈ. નરકેશારી રાજને શ્રીહત્ત નામે બુદ્ધિનિધાન મંત્રી હતો, સુમિત્ર નામે વ્યવહારીયો. નગર શોઠ અને સુધેાપ નામે પુરોહિત હતો, મંત્રીને લક્ષ્મણા નામે પ્રિયાથકી બુદ્ધિસુદુરી નામે પુત્રી થઈ, નગરશોઠને લક્ષ્મી નામે પત્નીથકી ઋડિસુદુરી નામે પુત્રી થઈ અને પુરોહિતને લલિતાનામે સ્ત્રીથકી ગુણસુદુરી નામે પુત્રી થઈ.

રાજકુમારી રતિસુદુરી યોગ્ય વયની થતાં પાઠશાળામાં ભણવાને માટે જીવા લાગી તે સમયે તેની સમાન વયવાલી બુદ્ધિસુદુરી, ઋડિસુદુરી અને ગુણસુદુરી પણ એ ક્ષેત્રશાળામાં અલ્યાસ કરવા આવી. પછી તો સમાન વયની ને સરખા સૌદર્યવાળી એ ચારે ખાળાઓને પરસ્પર મૈત્રી થઈ.

સાથે રમે, સાથે જમે અને સાથે અલ્યાસ કરતી એ ચારે ખાળાઓ સ્નેહ સંભંધથી એક બીજાને ઘર જવા આવવા લાગી. એક દિવસે ઋડિસુદુરીને ત્યાં આ ગ્રણે ખાળ સખીઓ વાર્તાવિનોહ કરતી હતી તે દરમિયાન શોઠને ત્યાં આવેલી કોઈ પવિત્ર અને સૌભ્ય વેપને ધારણ કરેનારી સાધીને જોઈ સખીઓએ પૂછ્યું “ઇઝી ! આ નિષ્કલંક અને પવિત્ર આર્યા કોણ છે ?”

“ધર્મનો ઉપહેશ કરનારાં અમારા ધર્મનાં એ પવિત્ર ગુણશ્રી નામે આર્યા છે,” ઋડિસુદુરીએ ખુલાસો કર્યો અને જરાક હુસી.

“એમની સૌભ્ય આકૃતિજી એમના ગુણોને જણાવે છે. આપણે એમને વાંદીયે, કંઈક શિખામણ પણ સાંભળીયે,” રાજખાળ રતિસુદુરી યોદી.

“જરાર ! એમને જે વાંદે છે નમે છે તેમને બન્ય છે. લક્ષ્મિવડે કરીને જે એમને સ્તવે છે તે ધન્યતર છે અને

એમનો ધર્મપદેશ અવણુ કરી ને શક્તિ અનુસારે પાળે છે તે અતિ ધન્યતર છે ઐન !” ઋદ્ધિસુંદરીની વાળું સાંલાણીને બધી ઉલ્લી થધને એ પ્રવર્તિનીની પાસે આવી વંદન કર્યું. પ્રવર્તિનીએ પણ એ ચારેને હિતકારી એવો ધર્મપદેશ આપી એમના આત્માનો ઉદ્ઘાર કર્યો.

સાધ્વીણો ધર્મપદેશ સાંલાણી એ ચારે બેનપણું ખુશી થધ છતી રાજકુમારી ઓલી. “હે ભગવતિ ! ચારિત્ર ધર્મ તમે લીલામાત્રમાં પાળી શકો છો પણ અમારે માટે તે મેરના સરણો અથવા તો તેથીય અધિક છે કારણુંકે ઉત્તમ વૃષભ જ ગાડાના ભારને વહુન કરે છે. નવા અણપળોટિલા વાછરડાએ નહિ. માટે અમારી ઉપર કદણા કરીને અમને શ્રાવક ધર્મ આપો કે જેથી અમારું કલ્યાણ થાય.”

રાજકુમારીનું વચન સાંલાણી પ્રવર્તિનીએ એ ચારેને દેય, ગુરુ અને ધર્મનું રહેસ્ય સમજાવી સમકિતબંત અનાવ્યાં અને તે પછી એમને પરપુરુષના ત્યાગદ્રષ્ટ શિયલપ્રત ઉચ્ચરાયું, સારી રીતે શિયલનો મહિમા સમજાવ્યો ગમે તેવી મુશ્કીઅતમાં કે વિષમ સંયોગોમાં પણ શિયલને સાચવાની ભલામણ કરી પ્રવર્તિની પોતાને સ્થાને ચાલ્યાં ગયાં, એ ચારે સખીઓએ પણ એ નિયમને અંગીકાર કરી ઋદ્ધિસુંદરીની રજ લઈ નણે સાહેલીએ પોતાને મડાને ચાલી ગઈ, તે પછી થોડાક વસંતના વાયરા વહી ગયા, ને રતિસુંદરી પૂર્ણ થૈવનની કળાએ પહોંચી ગઈ, એની ચુવાની અને સૌંદર્યની સુવાસ દેશોદેશ પ્રસરી ગઈ.

એક હિવસે નાંહુરના અધિપતિ ચંદ્ર રાજએ રતિ-સુંદરીની રૂપ રાશિની ઘ્યાતિ સાંલાણી, એને વરવાને

આતુર તેણે પોતાનો હૃત નરકેશરી રાજની ખાસે મોકલ્યો હૃતની વાણી સાંભળી નરકેશરી રાજ ખુશી થયો ને નરકેશરી રાજએ રતિસુંદરીને પોતાના પ્રધાન પુરુષો સાથે નંદપુર મોકલી આપી, સ્વયંવરા આવેલી રતિસુંદરીને ચંદ્રરાજ મોટા મહોત્સવપૂર્વક પરણ્યો, એ રીતે રતિસુંદરીને મેળવી ચંદ્રરાજએ પોતાનો ભનોરથ પૂર્ણ કર્યો.

એક દિવસે ચંદ્રરાજ રાજસભામાં એડા હતો તે દ્વારા ભિયાન કુરૈદેશના મહેંદ્રસિંહ રાજનો હૃત રાજસભામાં પ્રવેશ કરીને ચંદ્રરાજને કહેવા લાગ્યો “રાજન! અમારા રાજએ તમને કહેવરાબું છે કે તમારે ને અમારે વંશપરાથી સ્નેહ સંભંધ વૃદ્ધિ પામતો ચાલ્યો આવે છે. એ સ્નેહને અત્યારે પણ ગમે તેવા સંયોગામાં તમારે નિલાવવો જોઈએ. એ સ્નેહની પરીક્ષા માટે તમારે કોઈ વિષમમાં વિષમ કાર્ય મને કહેનું, જે કાર્ય કરીને હું એ સ્નેહમાં વધારો કરીશ. તમારા પ્રેમને વધારીશ, એવીજ રીતે મારા સ્નેહને વધારવા માટે તમે તમારી નવીન પરછેલી નવોદા રતિસુંદરીને મોકલી આયો.”

હૃતની નિડરવાણી સાંભળી રાજ સહિત સભા દિંગ થઈ ગઈ. “તારા રાજની પ્રીતિ વધારવાની રીત તો ન્યારો છે ભાઈ! તારા રાજએ બીજુ કોઈ કાર્ય ફરમાવ્યું હોત તો હું તારા સ્વામીના ભનોરથ પૂર્ણ કરત, પણ એક ગરીબમાં ગરીબ માણસ પણ સ્વી તો આપી શકતો નથી સમજયો!” ચંદ્રરાજએ હૃતને પ્રત્યુત્તર આપ્યો.

ચંદ્ર રાજનો જવાબ સાંભળવા છતાં જણે મોટી પંડિતાધનો ઘમંડ કરતો અને ચંદ્રરાજનું હિત એના હૈયામાંથી નિતરી રહ્યું હોય તેમ પોતાના સ્વામીના ઐશ્વર્યથી શર્વિષ થયેલો તે બાદ્યો. “તમારી એ નવીન પલીમાં

અમારા સ્વામી વણ્ણાજ પ્રીતિવાળા થઈ ગયા છે તેના વિયોગ પોતાનું રાજકાર્ય પણ સંભારી શકતા નથી માટે છે રાજન! એટા મમત્વ કરી તમારું રાજપાટ ગુમાવણો નહિ, એક ઘીલીને માટે પ્રાસાદ તોડી પાડવાની મહેનત ક૊ણું કરે? માટે અમારા હેવને એ હેવી આપીને તમે ચૃદ્ધિ પામો.”

હૃતના વચનથી કોઈબંધ થયેલા રાજાએ હૃતને બજા મારી બહાર કાઢી મુકાવ્યો, અપમાન પામેલો હૃત ગુસ્સાથી ધમધમતો પોતાને દેશ ચાલ્યો ગયો. રાજ મહેંદ્રસિંહને ચંદ્રરાજના અપમાનની વાતો કહીને ખુલ્લે ઉશ્કેર્યા.

મહેંદ્રસિંહ હૃતની વાણી સાંભળીને ચતુરંગી સેના સહિત પૃથ્વીને ધમધમાવતો ચંદ્રસિંહના સિમાડ આવી પહોંચ્યો. ચંદ્રસિંહ પણ પોતાના લશકર સાથે મહેંદ્રસિંહના સામે આવ્યો. અતે લશકરો સામસામે ખુલ્લે જોસથી લાયાં, ચુદ્રમાં છળ અને બળથી મહેંદ્રસિંહે ચંદ્રસિંહને બાયલ કરીને પકડી લીધ્યો. તેણે પોતાના લશકર માર્કરે નંદુરી હુંદાવી દીધી ને રતિસુંદરીને રાજમહેલમાંથી પકડી મંગાવી. પોતાનું અલિષ સિદ્ધ થવાથી મહેંદ્રસિંહે ચંદ્રસિંહને અંદીઆનાથી મુક્ત કરી એનું રાજ્ય સોંપી દીકું ને પોતે પોતાને દેશ ચાલ્યો ગયો. ત્યાં એક વિશાળ પ્રાસાદમાં રતિસુંદરીને રાખી.

રતિસુંદરીના સૌંદર્યમાં હિવાનો ખનેલો રાજ મહેંદ્રસિંહ ઇવાખદાર વસ્ત્રાલૂષણુથી સજ થઈને રતિસુંદરી પાસે આવ્યો. “પ્રિયે! તારા સવરૂપમાં આશક થયેલા મેં શું નથી કર્યું? ચુદ્રમાં હજરો માણુસોનો નાશ કરાવી નાખ્યો. ચંદ્રસિંહ રાજને ચુદ્રમાં જીતી લઈ એક કોડીનો અનાવી દીધો એની રાજ્ય લક્ષ્મી હુંટી લીધી એ ખુલ્લે

તારે માટે, તને સ્વાધિન કરવા માટે, તારા જેવી સુંદરી પ્રાપ્ત કરી તારા સમાગમ સુખથી આ બળતા લગરને તુસ કરવા માટે, તારા જેવી પ્રિયાને મેળવી સુખી થવા માટે.”

રાજનાં તમલોહ સમાન વચન સાંભળી રતિસુંદરી વિચારમાં પડી. “અરે! આ મારા ઇપ લાવહયને વિકાર થાએઓ, એ ઇપમાં લુણથ બનીને આ પાપી રાજએ કેટલો ઘઢો અનર્થ કર્યો? હજારો ઉત્તમ પુરુષોનો મારા નિમિત્તે નાશ કરી નાખ્યો. મારા પતિને આ ફુષ્ટે પરાસવ પમાડી કુંભી કર્યો, મને અહીં પકડી લાવ્યો, આવા વિષય સમયે હું મારા શિયલનું રક્ષણ શી દીતે કરીશ? છતાંય ગમે તે લોગે પણ મારા શિયલનું હું રક્ષણ કરીશ. હાલમાં તો કાલ વિલંબ કરવા હે; જ્ઞાનીએ જેથું હશે તેમ થશો.”

“રાજન! તમારા સરખા ઉત્તમ પુરુષોને પરસ્તીમાં રક્ત થવું તે યોગ્ય નથી. પોતાની સ્ત્રીમાં સંતોષ માની જે પુરુષો પરસ્તીથી પરાંગમુખ થયેલા છે તેમનેજ ધન્ય છે. નરકમાં જનારા પુરુષોજ પરસ્તીની અભિલાષા કરે છે રાજન!”

એ તારો ઉપદેશ હાલમાં રહેવા હે. હાલમાં તો મારી પદ્ધરાણી અની તું કુરુક્ષેણની મહારાણી થા. રાજ્યલક્ષ્મીને લોગવનારી થા! મારા જલતા લગરને શાંત કરનારી થા! પ્રિયે! મારા અધિરા અને ઉત્સુક મનને જેમ બને તેમ તાકીહ શાંત કર. તુસ કર.”

રાજની આતુરતા અને ઉત્સુકતા જેધ રતિસુંદરી કંપી ઉડી. “મહારાજ! ધિરજ ધરો? ઉતાવળે કાંધ આંખા પાકતા નથી. સમતાનાં ફલ મીઠાજ હોય છે. પહેલા આપને એક પ્રાર્થના કરું છું તે સ્વિકારશો?”

“અને તે તારી પ્રાર્થના શી છે પ્રિયે? અરે તું કહે તો માર્દ ભસ્તાક ઉતારી હાજર કરું, તું કહે તો અધી કુદેશની રાજ્યલક્ષ્મી તારા ચરણમાં હાજર કરું, બોલ? તારો હુકમ હું શી રીતે અદ્દ કરું?” પરસ્ફીના રૂપ લાવણ્યરૂપી દીપકમાં જળી રહેલા પતંગીયાની જેવા પામર પુરુષો એ સિવાય બીજુ કહે પણ શું!

“રાજન! ચાતુર્મસ પર્યાત માર્દ પ્રત પૂર્ણ થવા દો! ત્યાં સુધી શીલસંગની યાચના કરશો નહીં. મારા મહેલમાં આવશો ય નહિ.” રતિસુંહરીના આ ધડકાથી રાજનું હૃદ્ય વચાડું “અરે એ શી રીતે બને? છતાં બલે એ તારી પ્રાર્થના હું માન્ય રાખું છું.” એમ કહી રાજ બવાતે હૃદ્યે ચાલ્યો ગયો, અત્યારે તો એના મનનો અલિલાખ મનમાંજ રહી ગયો.

છેએ વિગયનો ત્યાગ કરી રતિસુંહરીએ આચામલ તરૂપ કરવા માંડું. ને તેમાંથી એક ધાન્યથી નિભાવીને; ચાતુર્મસ પૂર્ણ થતાં તો શરીર હાડ, માંસ અને ચામડી ભર બનાવી હીધું. એ સૌંદર્યમાંથી તેજ, ગૌરવ, છટા અધુંચ ઉડી ગયું ને વહનની કાંતિય કરમાં ગાડ. એ વિડુપ રતિસુંહરીને એક દિવસે અકસ્માત રાજએ જોઈ. એની નરી વરવી ન બિલસ કાંતિ જોઈ રાજ એના મહેલમાં આવ્યો. “પ્રિયે! આ શું? અનેક દાસ દાસીનો પરિવાર તારી સેવામાં હાજર છતાં, મનગમતાં સ્વાદિષ્ટ મિથાજ તારા ચરણમાં આપોએતાં છતાં તારી આ સ્થિતિ કેમ? કયા હુંએ તારી આ સ્થિતિ થઈ છે વારુ?”

“હે હેવ! હું હાલમાં એક મહાન પ્રત કરું છું. એ કલેશકારી અને દુઃસરાંહ પ્રતથી હું દુર્ભલ થઈ છું.” રતિ-એ ઠુંડે કલેજે જવાબ આપ્યો.

“તારે તે વળી અત્યારે પ્રત કેવું? ફુર્દેશાની પદ-  
રાણી થઈને તું જગતને આશ્રમ્ય કરે એવાં અદ્ભૂત  
મતુષ્યસંખ્યાંધી સુખોને લોગવ! સુખ લોગવવાના દિવ-  
સોમાં અત્યારે તે તારે વૈરાગ્ય રહ્યો વળી?” રાજાએ કહ્યું.

“હાડ માંસથી ભરેલો આ દેહ તે જ વૈરાગ્યનું કારણું  
છે મહારાજ! ગમે તેવું શાલાયુક્ત હોવા છતાં આ શરીર  
પાપનું જ ઘર છે. આવા નિર્ણય અને દ્વાપના મંહિરદ્વાર  
આ શરીરને લેવા માત્રથી પણ આપ જેવા ગુણાદ્ય  
પુરુષો મુંઝાદ જાય છે. ઉત્તમ પુરુષોના ચિત્તને પણ જે  
ભાવાવી નાખે એવા આ પારીપિંડ ઉપર વળી મોહ શો?”  
રતિ બોલી.

રતિસુંદરીની વૈરાગ્યમય વાણી પણ મગશૈલ પાંચા-  
ણની માર્ક રાજને કંધ પણ અસર કરી શકી નહિ.  
“કાન્તે! હવે તું તારો તપ પૂર્ણ કર ને મારો અભિ-  
ક્ષાણ પણ તું પૂર્ણ કર. પુણ્યની નાળુક ખીલેલ કળી  
અત્યારે કરમાયેલ છતાં કેવી તેજસ્વી અને આકર્ષક છે?”  
રાજ ચાદ્યો ગયો, રાજ એના તપની પૂર્ણતાની રાહ  
લેવા લાગ્યો.

અનુકૂળે રતિસુંદરીના તપપૂર્ણ થયો તે પહી એક  
દિવસે રાજ રતિસુંદરીના મહેલે આવ્યો. “પ્રિયે! કમ-  
લની સુવાસથી આકર્ષયેલ ભ્રમરની માર્ક હું પણ  
તારામાં લુણ્ય થયો છું. તારા વિયોગરસ્પી દ્વારાનલથી  
પીડાદ રહ્યી છું.” રાજએ પોતાની મનોવેદના જહેર કરી.

“પારણામાં સિનાંધ અને મનોહર લોજન કરવા છતાં  
અત્યારે મારા શરીરમાં સ્કુર્તિ નથી, મારું ભરતક ભરે  
છે. પેટમાં શૂળ આવે છે. શરીરની સંધીના લાગો તુટી  
રહ્યા છે ને તમે તો હજ મારી આવી હાલતમાં પણ

વિલાસનીજ વાત કર્યા કરો છો એ નવાઈની વાત છે !”

“હીપકના તેજમાં અંભાયેલ પતંગીયું બીજે કયાં જથું શકે ? કમલની સુવાસમાં લોભાયેલ અમરની બીજી ગતિ પણ શી ? તારા જેવી જગતમેહિની પ્રિયા સ્વાધીન હોવા છતાં હવે વીરજ પણ શી રીતે રહે ?” રાજની આતુરતા વધી.

રાજનો ખુખ દુરાયહુ જાણી રતિસુંહરીએ રાજથી શુભપણે મહનકળ સુખમાં સુકી દીધું તે પછી રાજની પાસે આવી વાત કરતાં ને રાજને સમજવતાં રાજની આગળ વમન કર્યું. પોતાનું એ ઉચ્ચિષ્ટ લોજન કરીને બહાર વમી કાહેલું રાજને બતાવતી રતિસુંહરી બોલ્યો. “હૈ ! હેહનું આ સ્વરૂપ જુઓ ? આપ જે સૌંદર્યમાં મુંજાઈ ગયા છો એનાં આ મૂલ્ય ? પવિત્ર વસ્તુઓ પણ પૈઠના સંબંધથી અપવિત્ર-અશુચિમય થઈ જાય છે. ઉત્તમ જનો અશુચિનું લક્ષણ કરતા નથી, આપ તો ખાલકથી ચ ખાલ છો કે આ વમેલાનું લોજન કરવા ધર્છો છો.” રતિસુંહરીના કયાખ સાંભળી રાજ ચમક્યો.

“અરે ! શું હું રાંક છું ! શું હું જડ છું કે વમન કરેલું ખાઉં ?” રાજ બોલ્યો.

“ અરે મૂઢમાણસ પણ સમજ શકે તેવી દીવા જેવી વાત આપ કેમ સમજતા નથી ? જે પરસ્ક્રી છે તે વમેલા આહાર જેવી છે. બીજા પુરુષે લોગવેલી સ્ત્રી એ તો વમેલા આહાર જેવી જ ગણાય, તેની સાથે તમે એ વમેલા આહારને પ્રહુણું કરવા ધર્છો છો એ નહીં દીવા જેવું સત્ય કેમ સમજતું નથી રાજન !”

એ બધીય તારી વાત સત્ય છે. પણ રાગી દોષને જોતો નથી, તેમ આ અંગમાં આશક થયેલો હું એક માત્ર તનેજ જોઈ રહ્યો છું.”

“આપ મારા કયા અંગમાં આસકત થયા છો ? ”

“આ જો તારાં હરખુનિના જેવાં ચપળ અને તેજસ્વી નેત્રો જ કેવાં આકર્ષક છે ? એની અદ્ભૂત શોભાનાં તારી આગળ હું શાં વખાણ કરે ? ”

“એમ ? મારાં આ નેત્રો તમને બહુ ગમે છે ? ”  
કંઈક ધરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાળ નથનો ચમકી રહ્યાં. એ નથનોમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું.

“હા પ્રિય ! ” મૂઠ રાજના કામુક હૈયાના દાહ્ય-  
જ્વરને ભૂલાવના હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી.  
કંઈક નિશ્ચય કરી રતિસુંદરી ઉલ્લી થાં. આ પાંચી રાજના  
સકંજમાં પોતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના  
શૂદ્ય આગળ પોતાના દેહને તુચ્છ ગણુતી રતિસુંદરીએ  
તીક્ષ્ણ છુરી લાવીને પોતાનાં બને નેત્રો છેદી રાજની  
આગળ ધર્યા. ” “આપને આ નેત્ર પ્રિય હોય તો દો. ”  
નેત્રો અર્પણ કરતી રતિ બોલી.

નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ  
જોઈને રાજ મહેંદ્રસિંહનો મહન-કામજ્વર એસરી ગયો.  
આલો અનેલો તે શારી આંખે એ વિગતનેત્રા રતિસુંદરીને  
જોવા લાગ્યો. “આહા ! તને અને મને હુંઅકારીએવું આ  
તેં શું કર્યું ? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તેં બહુજ  
વિપરીત કામ કર્યું. ”

“મહારાજ ! તમને અને મને આલોક અને પર-  
લોકમાં હિતકારી એવું આ કામ મેં કર્યું છે. ઔષધ કર્વું  
હોય છે તો તે જ રોગનો નાશ કરી શરીરને નિરોગી  
અનાવે છે. તેમ પરખીના સમાગમથી માનહાનિ, ધન-  
નાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરલવમાં હુંઅ-  
દારિદ્ર, દૌર્બાળ્ય, ક્ષય, કુટુંબ અને જીગંદર આદી રોગ.

ઉત્પત્ત થાય છે. પરસ્યાનું આદિંગન કરેનારને નરકમાં ધરાધગતા લોહ સ્થંભને આદિંગન કરવું પડે છે ને તિર્યંચ ચેનિમાં ખરી કરવાની, શીત, તાપ સહેન કરવા, ભૂખ તરસ તેમજ પરવશતાનાં હુંઘ અતિ કલેશકારી હોય છે. આવા હુંઘડી રોગોથી મારા આ ઔષધદ્વપ કાર્ય વડે આપણે બન્ને છુટી ગયાં. મારા આ કાર્યથી તમારું ને મારું બન્નેનું લોકમાં હિત થશે. પરસ્યીના ગમનથી તમારું દુર્ગતિ ગમન પણ હુંબે અટકી જશે રાજન ! રતિસુંદરીની કામહેવના તાપને નાશ કરેનારી દેશના સંલળી રાજ ઠ'ાગાર થઈ ગયો. એના સાહુસથી જેની ખુદ્દિ આપીઆપ સાનમાં આવી ગઈ છે એવો રાજ પોતાના મસ્તકને ક'પાવતો ઓલયો. “આહ ! સમયને જાણુનારી તું એક મહાન સતી છો, સતીયોમાં સુયુટમણિ સમાન તારા જેવી મહાન સતીનું મારા જેવા પાપીને દર્શન પણ કયાંથી હોય ? હે સાધ્વી ! મારા અપરાધને તું ક્ષમા કર, મારે હુંબે શું કરવું તેની મને આજા કર ?”

સતીની ક્ષમા માગતો રાજ એ હૃથ જોઈ પોતાના અપરાધ અમાવવા લાગ્યો. રાજની શુદ્ધ ભાવના જાણી રતિસુંદરી ઓલી. “ રાજન ! આજથી પરસ્યીને તમે ત્યાગ કરો કે જેથી તમારે લવ ભ્રમણ કરવું પડે નહિ.”

“ આજથી મારે પરસ્યીના ત્યાગ હો ! ” પશ્ચાત્તા-પની અભિમાં દૃઘ થતા રાજએ એ પ્રમાણે ચતુર્થ પ્રતને અંગીકાર કર્યું. ને રતિસુંદરીને પોતાના ગુરુ સ્થાને સ્થાપન કરી સન્માન વધાર્યું. છતાંય એ અંધ રતિસુંદરીને જોઈ રાજ વારંવાર વિલાપ-શોક કરવા લાગ્યો. રાજ્યકાર્યનો ત્યાગ કરી એ પશ્ચાત્તાપના પાવકમાં જલવા લાગ્યો. “ આહ ! આ સતી સાધ્વી ખ્લીનું મેં પાપીએ કેવું અનર્થ

કર્યું ? એના સંસારનું-અરે એ રમણીય એની સુષ્ટિનું મેં સત્યાનાશ વાળી નાખ્યું. એની આંખોનું બલિહાન લીધું. હા ! મારાં પાપ ! એશ્વર્ય અને યૌવનના મહમાં આ સતીના સુખનો મેં નાશ કરી નાખ્યો. ” રાજ મહેંદ્ર-સિંહને પદ્ધાતાપની ભડીમાં બળી ભરતો જાણી સતીએ કાઉસગ્ગ ધ્યાને રહી શાસનદેવીને યાદ કરી.

પંચપરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર એવી અપૂર્વ શીલા માહાત્મ્યવાળી રતિસુંદરીના શીલ માહાત્મ્યથી શાસનદેવી પ્રગટ થઈ. “ હે શીલદ્વપ અપૂર્વ વૈલવવાળી ! તું જ્યાં વંત રહે ! હે સતીયામાં શિરોમણિ ! તારું દદ્યાણ થાયો. હે રાજને પ્રતિયોધ કરનારી ! તારી સર્વે અભિ-લાપા પૂર્ણ થાયો. ” દેવીએ કરેલી સ્તુતિની સાથે સતીનાં વિશાળ નેત્રો પ્રગટ થયાં. રાજ વગેરે સતીનો મહિમા જાણી આશ્વર્ય પાખ્યા. દેવી તો અદરથ થઈ ગઈ, પણ સતીનો મહિમા જગતમાં ગવાઈ રહ્યો, અપૂર્વ નેત્રવાળી ને સંપૂર્ણ અગ્નાપાંગવાળી સુલક્ષણા રતિસુંદરીને જોઈ રાજ વગેરે સર્વે ઝુશી થયા, રાજએ સતીની ઝુણ સ્તુતિ કરી. દાન, માન, શુંગાર, વસ્ત્ર અને આલૂપણથી સતીનો સહાર કરી પોતાના અપરાધની ક્ષમા માળી. સતી રતિસુંદરીને પોતાના વિશ્વાસપાત્ર પ્રધાનો સાથે પતિને ઘેર નંદસુર નગરે મોકદી દીધી. ચંદ્રસિંહ રાજને પ્રધાનોને સુખે રાજએ શું કહેવડાવ્યું ?

“ ચંદ્રસિંહ ! તમે મારે સહોદર બંધુ જેવા છો. ચુદ્જના મેહાનમાં મેં તમને છેતરીને લૃતી લીધા તે મારો અપરાધ તમે અમનો. આ રતિસુંદરી મારી ધર્મભગિની છે. મારી ધર્મયુદ્ધ છે. શાસનદેવીએ જે સતીની રક્ષા કરેલી છે, એવી એ મહાસતી સતીયામાં મુગુદમણિ.

સમાન છે, લેશ પણ કલાંકની શાંકા તમારે કરવી નહિં  
જગતમાં એક માત્ર તમને જ ધન્ય છે કે જેના ગૃહને વિષે  
સાક્ષાત લક્ષ્મીની માઝુક આ મહાસતી વિલાસ કરે છેનું॥

મહેંદ્રસિંહના પ્રધાન પુરુષો સાથે રતિસુંદરી નંદપુર  
નગરના રાજહરથારમાં આવી મહેન્દ્રસિંહના પ્રધાનોએ  
રાજ ચંદ્રસિંહને નમી રાજનો પૂર્વોક્ત સંદેશ કહી સંખણ  
ળાવ્યો. ચંદ્રસિંહ રાજ પ્રધાનોના કથનથી ચમત્કાર પામેલો  
કૃશ રતિસુંદરીને જોઈ રાજ થયો ને રાજપુરષોનું સંમાન  
કરી તેમને વિદાય કર્યા.

રતિસુંદરી પણ રાજ્યલક્ષ્મીનાં સુખ લોગવી આયુઃ  
ક્ષયે અનુક્રમે પ્રથમ કલ્પમાં હેવી થઈ.

#### ૪

### બુદ્ધસુંદરી.

સાકેતપુર નગરના મંત્રીની તનયા બુદ્ધસુંદરી રૂપ,  
લાવણ્ય અને કળા કૌશલ્યયુક્ત એવી ચુવાન અવસ્થામાં  
આવી ત્યારે એના પિતાએ સુસીમા નગરીના સુકૃતિં  
રાજના મંત્રી સાથે પરણાવી. બુદ્ધસુંદરી પરણીને સાસરે  
આવી સુખપૂર્વક પોતાના સમય વ્યતીત કર્તી. કારણ  
કે મંત્રીની પુત્રી અને મંત્રીની પત્નીના ભાગ્યમાં આમીયં શરી?

છતાંય એમના ભાગ્યમાં પણ કુચિત ખામી જોવામાં  
આવે છે. વિધિની કુરાળતામાંય એવી અનેરી લૂલ થઈ  
જાય છે ને એવા સુખી માણસો પર પણ હુંઘની વાદળી  
અવરાદ જાય છે. એક દિવસે રથવાડી જતા રાજ સુકૃ-  
તિએ બુદ્ધસુંદરીને પોતાના મહેલની અગાસી ઉપર  
સખીએ સાથે કીડા કર્તી જોઈ અને રાજ ચમક્યો. અનેક  
રાજપુત્રીએનો સ્વામી છતાં મંત્રી પત્નીને જોઈ એના

સૌંદર્યમાં આશક થયો, એના રૂપથી પરવશ અનેલો રાજ મંત્રીપત્નીને પોતાની પત્ની અનાવવાની અભિલાષા કરવા લાગ્યો. “આહ ! જગતને આશ્રયકારી શું એનું સ્વરૂપ !”

રાજ સુકીર્તિ મનમાં અનેક તર્કવિતર્ક કરતો રાજ-મહેલમાં આવ્યો પણ એને ક્યાંય ચેન પડયું નહિં. નિશાને સમયે હેંશીયાર દાસીને બુદ્ધિસુંદરી પાસે મોકદી. દાસીએ બુદ્ધિસુંદરી પાસે આવી અનેક પ્રકારે વાત કરીને બુદ્ધિને સમજાવવાના અનેક પ્રયત્ન કરી જોયા.

બુદ્ધિસુંદરીએ તો દાસીની નિર્બલ્સના કરીને ડાઢી મૂકી, અપમાનિત દાસીની વાત સાંભળી ગુસ્સે થયેલા રાજએ મંત્રી ઉપર આરોપ મૂકી ઓં સહિત પડી મંગાવ્યો. કામ પિશાચથી જકડાયેલ મનુષ્યને છિતાહિતનું લાન હોતું નથી. એક સામાન્ય માણુસ પણ પરખીમાં લુખ્ય થયો છતો અનેક પ્રકારનાં અકાર્ય કરવા અચકાતો નથી તો પછી આ તો રાજ.

રાજએ મંત્રીને કારાઅહમાં પૂર્યો ને બુદ્ધિસુંદરીને અંતઃપુરમાં મોકદી દીધી. રાત્રિને સમયે રાજ જ્યારે પોતાની અભિલાષા પૂર્ણ કરવાને બુદ્ધિસુંદરી પાસે આવ્યો. ત્યારે શિયલ ભાગથી ભય પાંચલી બુદ્ધ આ નરરાક્ષસ થકી શીલરક્ષણનો ઉપાય ચિંતવતી વિચારમાં પડી ગઈ.

“કેમ ! દાસીની નિર્બલ્સના ને મારી આજાનો ભાગ કરી તું સતીઓમાં શિરોમણિ બની કે શું ? દાસીનું વચન માન્ય કર્યું હોત તો આ આપદી ક્યાંથી હોત ? કારણ કે સમજાવવાથી કામ થતું હોય તો કોઈ બળજઘરી કરે નહિં.”

અને તેથી તમે અમારા ફુડંઘની પાયમાદી કરી

નાખી, અમારી ખીલેલી નવપત્રીવ વાડી વિઘેરી નાખી,  
મારા કરતાં તો તમારા અંતઃપુરમાં રાણીઓ કથાં ઓછી  
દૃપતી છે ? મારામાં તમે-એક અહના હુન જતિમાં તમે  
શું અધીક બેચું કે જેથી અમારી આના ખરાખી કરી  
નાખી રાજ ?” બુદ્ધિસુંદરી બોલી.

“તારામાં શું નથી ? દેવાંગનાઓને લખવે તેંબું  
સૌંદર્ય, લાલિત્ય, કળા, અભિનય સર્વે કંઈ તારામાં છે તે  
અંતઃપુરની રાણીઓમાં નથી. તારી દાસી થવાનેથ લાયક  
નથી. સુંદરી !” રાજને પ્રેમનો ઉલ્લાસ આદી કરવા માંયો.

“એ તમારી મોટી અમણ્ણા છે રાજ ! ઉત્તમ પુરુષો  
કહિ હુનજતિમાં લપયાતા નથી, રાજહંસ મોતીનો ચારો  
ઝૂકી ઠીજાની તરફ નજર સરખી કરે છે શું ? મોટા  
ગંગેંડોના મહું મહીન કરનાર કેશરીસિંહ કદાપિ તૃષ્ણને  
અડકતો નથી રાજન !” બુદ્ધિસુંદરીએ રાજને સમ-  
જવવા માંયો.

“અને છતાંય રાજને ગમે તે રાણી. રાજનોની  
પસંદગી જેની ઉપર ઉત્તરી એનાં તો લાગ્યજ કરી જાય,  
મોટું લાગ્ય હોય ત્યારેજ રાજની મહેરથાની થાય સમજી?  
રાજની રહેમ નજરથી તું રાજયરાણી થાય એમાં ઓદુંય  
શું ? સમજ કે તારે તો આજે અમીના મેહુ વરસ્યા છે કે  
જેથી રાજ તારે આધીન થયા છે.”

“તમારો શું એજ નિશ્ચય છે મહારાજ ?”

“હા ! તારા લાવણ્ય આગળ રાજલક્ષ્મીનો હિસાય  
પણ શું ?”

“તો મારો નિયમ પૂર્ણ થાય ત્યાં લગી આપ રાહ  
જુઓ.” બુદ્ધિસુંદરીએ કાળ વિલંબ કરવાનો ઉપાય  
શાધી કાઢ્યો.

રાજએ બુદ્ધિસુંદરીની વાત ઘવાયલા લુગરે માન્ય કરી-એને રાજ કરી. રાજ પોતાના અંતઃપુરમાં ગયો, મંત્રીને પતની સહિત કારાખણમાં પૂરવાથી નગરીમાં હાહાંકાર થયો. મહાજનવર્ગ આવીને રાજને સમજાવવા લાગ્યો. બીજા પણ મંત્રી વગરેએ રાજને સમજાવ્યો. મહારાજ ! એ મંત્રી નિર્દ્વિષ અને નિષ્કલંક હોવાથી આપે તપાસ કર્યો વગર એને પડી જેલમાં પૂર્યો તે સારું કર્યું નથી. આપ એને છાડી મૂકો.” રાજને ધણ્ણો સમજાવ્યો.

મંત્રીઓના સમજાવવાથી તેમજ લોકોના આગ્રહથી રાજએ પ્રજાને રાજ કરેલા માટે મંત્રીને કારાખણમાંથી ભુક્તા કરી, એનાં ઘરથાર એને સ્વાધીન કર્યો પણ બુદ્ધિસુંદરીને છાડી નહિ. રાજની દાનત લોકો સમજી ગયા, પ્રજા ગમે તેવી તોય સત્તાધારી રાજને શું કરી શકે ?

બુદ્ધિસુંદરીના છુટકારા માટે રાજએ સર્વેને ઉદ્દેશીને કહ્યું. “જો મંત્રી પોતાની નિર્દ્વિષતા માટે કાંઈ પણ હિવ્ય કરે તો હું એની પત્રીને છાડી દઉ.” રાજની આ હકીકત સાંભળી સર્વે હુલાતા હૃદ્યે પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. લોકો તો સમજવી શકે-શિખામણુના એ શાખદ કહું શકે પણ મોગા સાથે વિરોધ કરી આકાતને કોઈ ન નોતરી શકે.

બુદ્ધિસુંદરી પણ કોઈ કોઈ વખતે રાજ આવતો ત્યારે વિનોદની એ વાતો સંભળવી રાજને રાજ કરતી હતી, તે દરમિયાન બુદ્ધિસુંદરીએ પોતાનીજ આએહું નકલ જેવી ભાષ પિંડની એક મનોહર પુતલી તૈયાર કરી. ઇપ, રંગ, છટા, વસ્ત્રાભૂપણથી શણુગારી આકર્ષક બનાવી, પોતાની અધીય કળા, ચતુરાધ એ પુતલી અનાવવા પાછળ અર્યી નાખી. જ્યારે તે તૈયાર થઈ ગઈ ત્યારપણીના.

એક હિવસે રાજ જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યો ત્યારે રાજને એ પુતળી ભતાવી, એ મનોહર કામસ્વરૂપ મૂર્તિને બોઇ રાજ છક્ક થઈ ગયો.

“આહો ! શ્રી સુંદર કારિગરી ! આ તો આખેહુઅ તુંજ.”

“મારા કરતાંય ઇપરંગમાં વધે તેવી છે કે નહિ, રાજ ?”

“એશાક, જરૂર.” રાજએ અતુમતિ આપી.

“આપ રાત હિવસ એને આપના અંતઃપુરમાં રાખો, એને બોઇને આપ જુશી થાવ ને મને આ બંધીખાનામાંથી સુક્ત કરો.” બુદ્ધિ બોલી.

“અ હું ! એ તો નહિ.” “રાજ કટાણું મેં કરીને બોલ્યો.”

“મારા કરતાં આ અવીક છે, રાજન ! એનાથી આપ રાજ થશો મારાથી નહિ.” બુદ્ધિએ દલીલ કરી.

“કારણું ?” આતુરતાથી રાજ બોલ્યો.

“આ મહનથી લરેલી છે, મહનવતી છે ને હું તો મહનરહિત છું.” બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજની આગળ ફેંકી, જમીન ઉપર પછાવાથી એ લાગી ગયેલી વિરૂપ થયેલી પુતળીમાંથી હર્ષિને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજ એ હર્ષિન સહેવાથી ચાર ડગલાં પાછળ હઠી ગયો.

“પ્રિય ! આ શું ? બાલક પણ ન કરે એવું નિધ તે આ શું કર્યું ?”

“રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તો એનાથી હીન છું. જળ અને અભિથી આની શુદ્ધિ તો થઈ શકશે પણ સુવર્ણ અને રત્નાના સંસ્કારથી મારી શુદ્ધિ નહિ થાય !”

“‘એ તારી ભમણા છે પ્રિયે ! કયાં તું અને કયાં આ  
જડ હુંગં લરેલી પુતળી ! કનક અને કથીર કહિ સમાન  
ચાહ રાડે ?’”

“‘રાજ ! તમે પાંડિત થઈ લીંત ભૂલ્યા છો. આ ઉપરથી  
ઝપરંગ લર્યા લલકાયંધ શરીરની અંદર હાડ, માંસ,  
દ્વિધિર સિનાય બીજુ શું છે ? મળ, મૂત્ર અને વિશ્વાથી  
લરેલા આ ગંધ કલેવરમાં રાચી નરકનાં કાર શા માટે  
અખડાવો છો ? માંસમાં આસક્ત માછલાની માડુક સ્વલ્પ  
માત્ર સ્પર્શદીદિયના સુખમાં રક્ત અની મેરથી ય અધિક  
તિર્યં અને નરકગતિનાં હુંઘની અલિલાયા શા માટે  
કરો છો ? હુંતિને આપનારી એવી પરદારાને જે પુરુષ  
સેવતો નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે,  
એલું જ નહી બદ્લે સંસારની ઉત્તમ સંપત્તિને પામે છે.  
પરસ્તી કે પરપુરુષને આદિંગન કરવા માત્રથી નરકાભિની  
ધગધગતી જ્યાણામાં હગ્ય થવાનું ન હોય તો તમારા  
જેવા સજજન પુરુષનો સંગ કોને સુખકારી ન થાય ?’”

“‘પુરુષાને આ સંસારમાં લોગ તો માત્ર અદ્વિકાલના  
પ્રમાણુમાં હોય છે ત્યારે એના ઇલ તરીકે હુંઘ લોગવવાનાં  
તો નરકને વિશે પદ્યોપમ અને સાગરોપમ સુધી હોય છે  
હે રાજન ! તમે તમારા અંતઃપુરની સૌંદર્યશાલિની  
રમણીયો કરતાં ભારામાં શું અધિક જોખું છે કે એ સાગ-  
રોપમ સુધીનાં હુંઘ લોગવવા તૈયાર થયા છો. પ્રજાજન  
જે ગુનહાની શીક્ષા તમારે નરકમાં જઈને અવશ્ય  
લોગવવી પડશે. રાજન ! માટે આ ખોટા કદાચંહ મૂકી  
ન્યાય માર્ગ ચાલો.’”

“‘ખાલિક જલમાં પડુલા વંડના અનેક પ્રતિબિંદને

બેદ જેમ ચંદ એક છતાં અનેક માને છે તેમ મલ, મુત્ર અને વિશાથી ભરેલી બધી સ્વીએ સરખી હોવા છતાં કામીને ઉપરના રૂપ રાગ અને રાપુઠીપથી જુદીજુદી લાસે છે. જાની અને ઉત્તમ જન તો સ્વીને મળમૂત્રની કાયા જ માને છે, એ શુદ્ધ વાતો મોદા ભાગ્યે જ સમજાય છે. રાજુન !”

અવિતબ્યતાના યોગે આ ધીડ રાજના પાણાણ છૂદ્યમાં ઉપદેશરાપી અમીઝરણાતું નિર્મળ નીર નીતરવાથી એનું છૂદ્ય ભીજાયું. છૂદ્યની લાવના ફરી ગઢ, પાપી વિચારે. અહસાઈ ગયા. વિષયરાપી કીડા મગજમાં સળવળતો હતો. તે આપોઆપ નષ્ટ થઈ ગયો એનો કાળજવર ઢાગાર થઈ ગયો. રાજ પશ્ચાતાપ કરતો યોલ્યો. “સતી ! તારી વાણી સત્ય છે સાકરથીય મીઠી તારી વાણી સાંલળી મારી મોહનિદ્રા નાશ પામી ગઈ. મારી લોલુપતા આપોઆપ નષ્ટ થઈ ગઢ. મારાં વિવેક ચક્ષુ આજ ઝુલી ગયાં. પરસ્સીમાં લંપડ અનેલો હું અદોર નરકમાં ડબી જત પણ તેં મને એ ઘાર નરકના અંધકારમાં પડતો થયાવ્યો. તારા જેવી ધર્મ હેનારી મહા ભાગ્યયોજે મળે છે, કહે, હવે મારે શું કરવું ?” પશ્ચાતાપથી અળતા રાજને સન્માર્ગ આવેલો જાણી બુદ્ધિસુંદરી પરમ આનંદ પામી.

“મહારાજ ! તમારા જેવા ઉત્તમ નરને પરસ્પીનો ત્યાગ કરવો એજ યોગ્ય છે જેથી આ સોકમાં તમારી કીર્તિ વધે ને પરલોકમાં પણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આહિ સ્વર્ગની સંપર્ક પ્રાપ્ત થાય.

બુદ્ધિસુંદરીનું વચ્ચન નિર્મળ મનના રાજયે સ્વી-કારી પરસ્પી ત્યાગનો નિયમ અહણ કર્યો. રાજયે બુદ્ધિ-સુંદરીને અમાવી પોતાના અપરાધની માઝી માંગી. હાન:

માનથી એનો સતકારે કર્યો. વસ્ત્રાભૂષણ, અલંકારાદિક  
આપીને રાજાએ ધર્મ અગિનીની માઝે ખુદ્ધિસુંદરીને  
પોતાના મહેલમાંથી વિદ્યાય કરી.

રાજાએ મંત્રીને બોલાવીને એનો સતકાર કરી મંત્રીનો  
હોહો અર્પણ કર્યો. ખુદ્ધિસુંદરીના કાર્યથી ચમત્કૃત થયેલો  
મંત્રી પણ પરિણામ સારું આવેલું જોઈ રાજ થયો. સતી  
ખુદ્ધિસુંદરીની સારાય નગરમાં ઘ્યાતિ થઈ.

શુલાભની સુવાસથી મંદમંદ વાયુની લહરીએ  
સારાય ઉધાનને સુવાસીત બનાવી હે છે, તેમ શુણીજ-  
નોની ઘ્યાતિ પણ સમયને અનુસરીને સારા નગરમાં  
પ્રસરતાં વાર લાગતી નથી.

દીર્ઘકાળ પર્યંત ખુદ્ધિસુંદરી સંસારનાં સુખ ભોગવી  
આંતે પહેલા સૌધર્મકલ્પમાં હેવી તરીકે ઉપજ થઈ.

## ૫

## ખુદ્ધિસુંદરી.

સાકેતપુરની રમણીય બજારો અપૂર્વ શોભાને ધારણ  
કરી રહ્યાં છે, દેશપરદેશના વ્યાપારીઓ વ્યાપારને માટે  
આવે છે, લાભોની ઉથલપાથલ કરી જાય છે. એવાજ કોઈ  
વ્યાપાર નિમિત્તે તાબ્રલિખ્તી નગરીથી આવેલો સુધર્માં  
નામે વણીક બજારમાં પોતાના સંખાંધીની પેઢી ઉપર  
બેઠેલો હતો. શેડ સાથે વ્યાપાર સંખાંધી વાતો કરતો  
પોતાનો અનુભવ વર્ણવી રહ્યો હતો. ત્યાં અચાનક એ  
માર્ગ જતાં કોઈક વ્યક્તિ ઉપર એની નજર ચોંટી ને ત્યાંજ  
દી ગઈ.

પોતાની ચાર પાંચ સખીએ સાથે રૂપસુંદરી ખુદ્ધિ-  
સુંદરી અત્યારે હાસ્ય વિનોદ કરતી ત્યાંથી ચાલી જતી

હતી તે દરમિયાન ઝડિસુંહરી અને સુધર્મની નજર એક થીજા તરફ આકર્ષાઈ.

સખીઓની મીઠી મશકરીથી મુંઝાયેલી ઝડિસુંહરી પોતાને મફાને ચાલી ગઈ. જતાં જતાંય સુધર્મ તરફ દાખિ કરતાં સુધર્મને છીંક આવવાથી નમો જીનેં દ્રાય એ શાખ તેના સુખથી નિકળેલો ઝડિસુંહરીએ-સાંભળ્યો. એ સુરપ વ્યવહારીયાને જૈનધર્મી-પોતાનો સાથમિક સમજ વિશેષ રાજ થઈ. સખીઓએ આ વાત ઝડિતા માતાપિતાને સમજવી હેવાથી એના પિતાએ સુધર્મના કુલ, વ્યવહારની ખાતરી કરી.

સુધર્મ પણ ઝડિસુંહરીને જોતાં એના સ્વરૂપદ્યો  
દીપકના તેજમાં પતાંગીયાની માંડક વિવશ થઈ ગયો, એ  
સ્વરૂપનિશામાંજ ચકચુર થઈ ગયો, એ સુંહરીના ધ્યાનમાં  
થીજા વ્યાપારના વિવારો ય ભૂલી ગયો. “વિધિએ કુરસદે  
ઘડેલી શું એ હેહલતા ! એ સૌંદર્યની સુવાસ હજુ પણ  
લુગરમાંથી ભુસાતી નથી. જગતમાં એ બાળાનો જે  
પતિ થશે તે એકજ ધન્યવાહને પાત્ર છે. આ જીવનમાં જો  
એ મનોહર બાળા ન મળે તો કાંઈ નથી, તે જીવન એણે  
ગણું સમજવું. અરે ! આ બાળા મને શી રીતે મળે ?”

સુભિત્રશેઠ પાસે ઝડિસુંહરીનાં અનેક માગાં આવવા  
લાગ્યાં પણ શેઠની દાખિ કોઈના પર ઠરતી નહિ. ઘણે  
ભાગે તો પોતે જૈનધર્માનુરાગી હોયાથી પુત્રી મિથ્યા-  
તીને-પરથર્મનિ ત્યાં જઈ ધર્મલેહના કરણે હુઃખી થાય  
તેથી અન્ય ધર્મનિ તો ઘસીને સારુ નાજ પાડતા. તેમજ  
થીજા કોઈ કારણે પણ શેઠની પસંગળી ઉત્તરતી નહિ.  
ઝડિસુંહરીનું સુધર્મ તરફ આકર્ષણું જાણીને શેડે સુધર્મના  
સંખ્યમાં ખાતરી કરી લીધી. જૈનધર્મી તેમજ ઇપ અને

ગુણે તે પોતાની પુત્રીને યોગ્ય હોવાથી શેડે પોતાની પુત્રીને શુલ મુહૂર્તે તેની સાથે પરણાવી દીધી.

ભાગ્યશાળી સુધર્મને પ્રાર્થના કર્યા વગર અનાયાસે ઝડિઝસુંદરી પ્રાપ્ત થવાથી લોકો તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પોતે ધર્મની પ્રશંસા કરવા લાગ્યો. કે અપૂર્વ ચિંતામણિ સરખા જૈનધર્મના પ્રલાવથી આ મનોહર બાળાનો વિના પ્રયાસે પોતે સ્વામી થયો હતો.

લમ્બ પણી ડેટલોએ સમય સુધર્મ સાકેતપુરમાં રહીને પણી સસરાની રજા મેળવી પોતાને નગર તાપ્રલિમિતે પ્રિયાની સાથે ચાલ્યો ગયો. ત્યાં બજે જણ્ણાં એવા પ્રેમથી રહેવા લાગ્યાં કે જેઓ ક્ષણમાત્ર પણ જુદાં પડતાં નહિ. શરીર જુદુ છતાં પ્રેમથી એક અલિન્ન એવાં તેનો સંસાર મુખ બોગવતાં ડેટલોએ કાલ ચાલ્યો ગયો.

ધન કમાવા માટે સુધર્મ અનેક વસ્તુઓનાં વહાણ લારીને પ્રિયાની સાથે સમુદ્રની મુસાક્રરીએ ચાલ્યો, સમુદ્રમાં સુસાક્રરી કરતાં તેમણે અક્ષેત્રભાત સાગરને ખળખળતો જોયો, પ્રચંડ વાયુથી સાગરનાં મોણ આકાશ પર્યેત ઉછળવા લાગ્યાં, પ્રચંડ તોકાનવાળા સાગરને જોઈ નાવિકો પણ ગલરાયા, વહાણો સ્થિર કરવા પ્રયત્ન કર્યો પણ સાગરની છાણો સાથે વહાણ અહીં તહીં અથડાવા લાગ્યાં ને અથાંથ જીવનની આશા છાડી પોતપોતાના ધૃષ્ટ હેવને સંલારવા લાગ્યા. સુધર્મ અને ઝડિઝસુંદરીએ તો ખંધી મોહજાળા છાડી સાગારી અણુસન કરી દીધું.

આખરે એ લયંકર તોકાની સાગરની છાણોએ વહાણને લાગી નાખ્યું, માલ, ચહેરે, બાળ, વહાણના નાયિકો, નોકર, ચાકર વગરેયે સાગરમાં જ સમાધિ દીધી, સાગરનાં મોણમાં ડુખાડુખ કરતાં સુધર્મ અને ઝડિઝસુંદરીના

ભાગ્યમાં બીજાઓની માફક સાગર સમાધિ લખાઈ નહોતી  
પુછ્યાતુયોગથી તેમના હાથમાં એક વિશાળ પાઠીચું  
આવ્યું.

સંસારનાં કેટલાંક સુખદુઃખની હવા તેમના ભાગ્યમાં  
સર્જિયેલ હોવાથી મૃત્યુ બીજાઓની માફક તેમને જડપી  
શક્યું નહિં. બજે જણાં એ પાઠીયાનું અવલંબન પામીને  
સસુદ્ધમાં તણાતાં તણાતાં ચાર પાંચ દીવસે જંગલમાં  
સસુદ્ધના મોઝાંથી ધકેલાતાં કિનારે આવી પહેંચ્યાં. સસુ-  
દ્ધની આકૃતમાંથી સહિસત્તામત કિનારે આવી જવાથી  
તેઓ બજે ઝુશી થયાં ને જંગલમાંથી પ્રાણુક ઇલાદિક  
લાવીને નિર્વાહ કરતાં બીજા કોઇ વહ્ણાણની આશાએ ત્યાં  
કિનારા ઉપર રહેવા લાગ્યા. દૂર સસુદ્ધમાં જતા વહ્ણાણનું  
ધ્યાન ઘેંચાય એવી રીતે તેમણે એક ઉર્ધ્વ નિશાન કર્યું.  
પોતાને લીધે પોતાની પ્રાણાધિક પ્રિયાને દુઃખી થતી જોઈ  
સુધર્મ ઘોલ્યો. “પ્રિયે ! તને સાથે લાવીને મેં પાપીએ  
મોટી મુરકેદીમાં મુકી દીધી.”

“સુખદુઃખ એ તો પૂર્વકર્મના વિપાકનાં ઇલ છે.  
સ્વામિન ! માટે એવી હૈવકૃત બાધતોમાં આપે હર્ષશોક  
ન કરવો. ધર્મના મર્મને જાણનારા તમારા જેવા જ્ઞાતા-  
પુરુષે તો કર્મના મર્મને સમજ વિશેષ કરીને ઐહ ન  
કરવો જોઈએ.”

બીજા વહ્ણાણની રાહ જેતાં કેટલોક સમય તેમનો  
પસાર થયો, એક દ્વિવસે સાગરમાંથી પસાર થતા કોઈ  
વહ્ણાણના નાવિકોએ કિનારા ઉપર રહેલ ઐહું નિશાન  
જોવાથી તરાપા ઉપર એક એ નાવિને ઘેસાડી તે તરફ  
મોકલ્યા. પેલા પુરુષો કિનારે આવીને કહેવા લાગ્યા. “આ  
વહ્ણાણનો માલિક મુલોચન સર્થવાહ જંખુદ્વિપ તરફ જાય

છ. તમારી ત્યાં જવાની ઇચ્છા હોય તો ચાલો.”

તે પુરુષની વાણી સાંસળનીને બજેજણું એમની સાથે તરાપા ઉપર એસીને પેલા મોટા વહાણ પાસે આવી પહોંચ્યાં. સુલોચનશેડ સુધર્મની સત્કાર કરી એની આગતા સ્વાગતા કરી. વહાણ આગળ ચાલવા માંડયું. અનુકૂળે સુલોચન સાર્થવાહુ અને સુધર્મને ગાઢ મૈત્રી થઈ. તે દરમિયાન સાર્થવાહુને ઝડધિમુંદરીના રૂપનો નિરો ચઢ્યો.

ઇચ્છિસુંદરીને હાથ કરવાની સાર્થવાહુને તાલાવેલી લાગી. એ સુંદરીના મોહમાં સુધ્ય થયેલો થીજું ચિંતવેય શું? “વિધિએ કેવી ફર્મંકી બતાવી છે એને? આ રૂપ-ગવિતા નારી પ્રેમથી મારા દેહને આલિંગન ન આપે તો આદ્ય યૌવન, ધન અને રૂપ સર્વે નકાખું સમજવું. પણ એ અને શી રીતે? જ્યાંસુધી પોતાનો પતિ એની સાથે હોય ત્યાં લગી એ મારા જેવાની ઇચ્છાય શી રીતે કરે? મહુરાં આપ્રકુળ છાડીને લીંખડાની ઇચ્છા કોઈ ના કરે. છતાંથી કોઈપણ ઉપાયે હાથમાં આવેલી આ તક જવાન દેવાય.”

સુલોચન નામ છતાં કુલોચનવાળો તે સાર્થવાહુ મનમાં અનેક હૃદ સંકલ્પ વિકલ્પ કરતો ચોઅય સમયની રાહ જેવા લાગ્યો. એક રાત્રીએ વહાણમાં બધાય જ્યારે લર નિદ્રામાં હતા તે સમયનો લાલ એણે લીધ્યો. લઘુ-શાંકાને જ્હાને તે ઉલ્લો થયો. સુધર્મની પાસે આવ્યો. લર-નિદ્રામાં પુલા સુધર્મને આસ્તેથી ઉપાડી સસુદ્ધના અગાધ જલમાં ધકેલી દઈ પોતાને સ્થાને આવીને સૂધ ગયો. અધ્યકારમાં કાળું કૃત્ય કરી નિશ્ચિત થઈ ગયો.

પ્રાતઃકાળે ઇચ્છિસુંદરી પોતાના પતિને નહી જેવાથી હૈયાં માથાં ફૂટતી કલ્પાંત કરવા લાગી. વહાણમાં ક્યાંય પતો લાગ્યો. નહિ. ત્યારે નોકર ચાકરોમાંય હાહાકાર થઈ

રહ્યો. સુલોચન સાર્થવાહ પણ ભિત્ર ભિત્ર કરતો. પોકાર કરવા લાગ્યો.

ભિત્રના નામે ઉચ્ચેથી રેદન કરતો. સાર્થવાહ આખરે થાક્યો. એ અભિનય પુરો કરી ઇદ્ધિસુંદરીને આથાસન આપવા લાગ્યો. “હે સુંદરી ! ગાઈ ગુજરી ભૂલી જા. હવે હું શું કરીશ ? મારું શું થશે ? એવી ચિંતા કરીશ નહીં. મારું ઘર તારું પોતાનુંજ જાણું. તારું પોતાનું સમજી ભારા ઘરમાં તું સુખેથી રાજ કર. આ મારું યૌવન, ધન વૈભવ એ બધું હું તારા ચરણમાં હાજર કરું. હું પોતે પણ આજથી તારો ફાસ જું.”

પાપયુદ્ધિ સુલોચનની વાણી સાંભળીને ઝડિસુંદરી મનમાં વિચાર કરવા લાગી. “આહ ! આ પાપીનુંજ બધું કારસ્થાન છે. ભારા ઇપમાં લોભાધને આ હણે ભારા પતિનો ધ્યાત કર્યો લાગે છે. કારણુંકે કામપિશાચથી અહાયેલાને સારા ઓદ્યાતું લાન ક્યાંથી હોય ? તેથી હું પણ હવે ભારા શિયલના રક્ષણ માટે સાગરમાં હોમાધ જાડ. સ્વામિ વિના ભારે જીવીને પણ શું કરવું ? પતિ વગરની કુલવાન સ્ત્રી-એને મરણ એ એકજ શરણ છે” પાપયુદ્ધિ સુલોચનના પંજમાંથી ઝુટવાને ઇદ્ધિ સાગરસમાધિનો. વિચાર કરવા લાગી. અત્યારે એને દિલાસો આપનાર કોઈ નહોતું. અધાય સુલોચનના ભાણુસો હતા. પોતે એકાડી શીલનું રક્ષણ શી રીતે કરી શક્યો, જેથી મરણ એજ એથ છે, એમ સમજી સાગરમાં જાપાપાત કરવાને તૈયાર થઈ. વળી એની વિચારશેણી પલયાધ ગાઈ.

“જૈન શાસનમાં બાલ મરણ નિવિધેણું છે. જીવતો જીવ ઇરીને પણ કલ્યાણને પામે છે, પરન્તુ કામીના હાથ નીચે રહી હું શીલનું રક્ષણ શી રીતે કરીશ ? આ સાગ-

રમાંથી હું જે સલામત કોઈ શહેરમાં જઇ તો તો કોઈ સાધીનો યોગ પામી સંયમને આચરીશ, માટે એટલો સમય કાલ વિલંબ કરીને આ પાપીને યાલાનું તો કેમ?"

મનમાં વિચાર કરીને ઝક્કિ બોલી "હે સાર્થવાહુ ! અત્યારે પતિના મરણથી માઝાં ચિત્ત અસ્વર્થ છે. સાગનનો પાર પામ્યા પછી કોઈ શહેરમાં જવા પછી સમયને ઉચિત હું કરીશ." ઝક્કિસુંદરની આશાપાશથી ખંધાયેલો. સાર્થવાહુ એટલો સમય વીરજ વરીને રહ્યો "મારા કષ્ટભામાં રહેલી આ ગરીબ વરાડી હવે કયાં જશે?"

માણસ શું વિચાર કરે છે? ભાવી શું હોય છે? માનવીના વિચાર અને ભાવીનું વિધાન ભાગ્યેજ એક બીજાને અનુકૂળ હોય છે. સુલોચનના પાપથી સમુદ્ર દેવતા. કોપાયમાન થયા હોય, વાયુ કોપ્યો હોય તેમ ભયંકરવાયુ ઉપ્ત્રન થયો ને સાગરે પણ માઝા મુકવા માંઠી. એ ઉછળતાં મોજાયાના મારાથી વહાણ ભાંગીને લુકો થઈ ગયું. ભાગ્યવશાત ઝક્કિસુંદરીના હાથમાં એક પારીયું આવી. ગયું એ પારીયાના અવલંખનથી સસુદ્ધને તરતી સસુદ્ધના કંડે આવી પહોંચી. ત્યાં પારીયાનું અવલંખન પામીને સસુદ્ર તરી ગયેલો એનો પતિ પુણ્યાનુયોગથી મદ્યો. બજે એક બીજાને જોઈને ઝુશીથયાં, એક બીજાનું વૃત્તાંત બજે એ કંઈ સંભળાયું. અને પોતાની ઉપર અપકાર કરેનાર સુલોચન સાર્થવાહુની આપના સંભળીને ધર્મશ્રેષ્ઠી મનમાં દુઃખ પામ્યો. કારણકે સજજાન પુરૂષો અપકારી ઉપર પણ ઉપકાર કરેનારા હોય છે, અથવા તો એમનો સ્વભાવજ એવો હોય છે કે તે દુર્મનનું ય લખું ચિંતવે.

"હે ગ્રિયે ! અરિહંત અને ગણુંબર લગવાન આદિક મહાપુરુષોને ધન્ય છે કે જેમની નિશામાં રહેતા પાપી.

યુદ્ધ પણ અશુભ ભાવનાને છોડે છે. ત્યારે આપણા સમાનમાં આવેલો આ સાર્થવાહુ એતું પામવાનું તો દૂર રહ્યું બલ્કે પાપ પરિણામવાળો થઈ અભિક હુઃખી થયો !”

સાગરના કંડા ઉપર કરતાં દેવહેવી સમાન આ ચુગલને ત્યાં નજીક રહેલા ગામનો ઠાકોર સાગર સહેલ કરવા આવેલો તેણે જેણું, કોઈ હિવસ નહિ ને આ જગલમાં આ શું ? શું જગહેવતા પોતાની હેવી સાથે કીડા કરવા આવેલ હુશે કે પોતાની વિધાધરી સાથે રમવા આવેલ કોઈ વિધાધર હુશે ! વિચાર કરતાં એ ઠાકોર પાસે આવ્યો ત્યારે એને ખાતરી થઈ કે આ કોઈ ઉત્તમ કુળનાં મનુષ્ય-સ્ત્રીપુરુષ છે. ઠાકોરે મધુર વચ્ચેને તેણું બધુસ્વાગત-સન્માન કર્યું. પોતાના ગામમાં લઈ જઈ તેમને રહેવા માટે એક સંગવડવાળું સારું મકાન આપ્યું. ઠાકોરની સહાય મેળવી વ્યાપારવડે ધન પેઢા કરતો ને ધર્મસાધન કરતો તે સુઅધ્રૂવક ઠાકોરની છાયામાં રહેવા લાગ્યો.

સસુદમાં ડુષ્ટો ને માંછલાંનો શિકાર થતો પેલો પાપી સુલોચન સાર્થવાહુ ભાગ્યયોગે કાણ્ણનો આધાર પામની કષ્ટથી સસુદના કંઠે આવ્યો. સસુદથી બહાર નિકળીને તે જગલમાં અમણું કરતો કોઈક પદ્ધીમાં ગયો. પણ કંઈ આવાનું પ્રાસ થયું નહીં. લુખની પીડાથી વ્યાકુલ થયેલો તે મરેલાં જાનવરેના કલેવરમાંથી ગીધપક્ષીની માર્ક ચુંદીચુંદીને માંસના લોચા ખાવા લાગ્યો. એ માંસ પાચન ન થવાથી અલુર્ણ થયું. વારંવાર વમન થવા લાગ્યું ને તેમાંથી કુદીનો રોગ પેઢા થયો ધર્મજિજનનો ઘાત કરીને કે કામી પુરુષો પોતાની પાપી અભિલાષા પૂર્ણ કરવાની ધર્ષણ રાખે છે તે સુલોચનની માર્ક હુઃખીદુઃખી થઈ જાય છે.

દુઃખ એને દુર્ભાગ્યથી પીડા પામતો સુલોચન લાદ-

કતો લટકતો અનુહમે સુધર્મવાળા ગામમાં આવી પહોંચ્યો.  
જ્યાંત્યાં લીખ માગતો તે રખડતો હતો, ત્યારે જળ ભરવા  
ગયેલી ઝડ્ઝિસુંદરીની નજર એની ઉપર પડી, એને  
આળખવાથી તે સુંદરીએ પતિ પાસે આવીને વાત કરી.  
સુધર્મે સુલોચનને પૈતાને ઘેર તેડી લાવી આગતાસ્વાગતા  
કરી, દવાદાર્થી એનો રોગ નાશ કર્યો ને પ્રથમના જેવો  
નિરોગી દેહવાળો થયો. ગમે તેવો દુર્જન પણ ઉપકાર તળે  
દ્વારા થિયો. શું કરે ! તેમાંય સુલોચન તો કુલવાન હતો. હૈવ-  
વશાત ઝડ્ઝિસુંદરીને જોતાં એની ઝુદ્ધિ કરી ને એ લાન  
ભૂલ્યો, ભૂલથી અનર્થ કરી નાખ્યો, એ પાપતું કલ એને  
અહૃત્યાંજ મલ્યું, ને મનુષ્ય ન સહન કરી શકે તેવી નરક-  
યાતના લોગવી. જેતું યુર કરેલું તેનાજ આશ્રય નીચે  
આવ્યો. છતાં ખૂરાધનો બદલો ભલાઈ કરીને આપ્યો. તેની  
બાત માટે પુષ્ટ ખર્ચ કરીને અપકારનો બદલો ઉપકારથી  
આપ્યો. એ ઉપકાર કાંધ જેવો તેવો નહોતો.

લજજના લારથી અધોસુખ થયેલો સુલોચન કેટલો.  
ફિસાખ કરે, “અરે વિધાતાએ જગતમાં સજજન એને  
ચંદ્રન પરોપકારને માટેજ સજ્યો છે. પરોપકાર કરવાના  
સ્વલ્પવાળા એ બજેમાંય સજજન તો કોઈ અનેરી પ્રભા  
પાડે છે. સજજન ગમે તેવા દુર્જનનો પણ હૃદયપદ્ધો કરાવે  
છે. મેં એમતુ યુર કરવામાં શી કમીના રાખી છે, છતાં એ  
બજે મારા ઉપર ડેખાં અનન્ય ઉપકાર કરનારાં છે. અરે !  
મારાં સુખ એમને શી રીતે બતાવું ! સમુદ્રમાં હું મરી ગયો  
હોત. તો કેવું સાર ! અવતા છતાં પણ આજે હું એમને  
જોવાય સમર્થ નથી.”

એ લજજથી અવનત મુખવાળાને સુધર્મ મધુરવાણીથી  
શિખામણ આપવા લાગ્યો. “અરે ભાઈ ! તમે આઠલું

અવા શોકમાં કેમ છો ? શું કુદુંબનો વિરહ યાદ આવે છે કે ધનનાશની પીડા સાલે છે, અથવા હજુ પણ શરીરમાં કંઈ વ્યાધિ રહી ગયો છે શું ? કહો તો એનો જરૂર ઉપાય કરીયે ? કારણ કે શ્રીમતુમાં સૂક્ષ્માગયેલાં નહીં અતે સરોવર વરસાદના પ્રવાહથી પાણી આખ છે, કૃપાંથી થયેલો બીજનો ચંદ્રમા પણ ધીરેધીરે વૃદ્ધિ પામનિ પણ પૂર્ણ થાય છે. જગતમાં જીવાને તો પાપ કરવાથી હું મલે છે ને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તો એવી આખતમાં ઘેઠ કે આત્મન ન કરતાં સુખના અભિલાષી પુરુષાં હમેશાં ધર્મને આરાધ્યો જોઈએ, અન્ત જન્મભરણના હું અના કારણું પાપનો ત્યાગ કર્યો જોઈએ.” સુધર્મની મહુરવાલ્લીથી સુલોચનની આંખોનાં પડલ ઉદ્ધરી ગયાં.

“સાધે ! તમારા જેવા ધર્મનિ મેં સમુદ્રમાં નાખીને તમારી જે વિડ્યાના કરી છે, તે અધારિ મારા હૃદયને આળે છે. આ મહાસતીની કર્થના કરવામાં મેં શ્રી ઉણપરાખી છે ? એ પાપનું ઇલ મને અહીયાંજ પ્રાપ્ત થણું એવા આ પાપીને યમરાજાને પણ છોડી દીધો. પણ હે મિત્ર ! જ્યાંસુધી હું જીવીશ ત્યાં લગી તારા ઉપકારને સંભારતો હું પશ્ચાત્તાપની લડીમાં બળીશ. એ નરી દીવા જેવી સત્ય વાત છે.”

સુલોચનની વાત સાંભળી ઝડ્ધિમુંદરી બોલી. “સુલોચન ! તમને ધન્ય છે કે કરેલા પાપનો તમને આપલો અધો પશ્ચાત્તાપ થાય છે. કારણ કે પાપીએ તો પાપ કરીને ઉલયા રાજ થાય છે, જ્યારે સજજનો પાપકાર્યથી દૂર ભાગે છે. અહીયાં તો અજ્ઞાનથી થઇ ગયેલા આ પાપમાં તમારો શું દ્વારા ગણાય ? આંધળો માણસ કુવામાં પડી જય એમાં દ્વારા કેને હ્યો ? માટે હે સત્પુરુષ ! આજથી પાપનો ત્યાગ

કરી ધર્મને આચર. વિષનું લક્ષણ સારું; અમિતમાં પ્રવેશ કરવો તેથી સારો પણ હંડિયોના વિષયોને આધીન બની પાપાચાર સેવો તે સારું નથી. કારણ કે સ્પર્શહંડિયને આધીન બનીને ગજરાજ બ'વતને પામે છે. માણલું, ભારત પતંગીયું અને મુગલું એ બધાં માત્ર એક એક હંડિયના વિષયને આધીન બનીને મૃત્યુને આધીન બની જાય છે. તો પછી પાંચહંડિયોના વિષયને વશ પડેલા માનવીની તો વાતજ શી !”

જાહેરસુંદરીની વાણી સાંભળીને સુલોચન સાવધાન થઈ ગયો, એનાં જ્ઞાનલોચન જગત થઈ ગયાં. “હે સુંદરી ! તુજ મારી બેન છો, માતા કહો કે ધર્મચાર્ય કહો અત્યારે તો તુજ મારે ગુરુસમાન છો, બોલ હવે મારે શું કરવું ?”

“આજથી પરનારીનો ત્યાગ કરી શીલિક્ષી આલૂ-ખણુથી સુશોભિત થાયો.” સુંદરીનું વચન અંગીકાર કરી સુલોચને ચોથું અણુપ્રત અંગીકાર કર્યે. પોતાના અપરાધને વારંવાર ખમાવતો તે પોતાના નગર તરફ ચાલ્યો ગયો.

સુધર્મે પણ ત્યાં રહીને ન્યાયથી ઘણું વન ઉપાઈન કરી તે ગામમાં પોતાની કીર્તિક્ષી સુવાસ ફેલાવી ફેલાક સમય પછી પોતાની પ્રિયા સાથે સુધર્મ પણ તાપ્રલિમ્બી નગરીમાં આવ્યો. પોતાના કુલાચારને પાળતો ધર્મકાર્યમાં પ્રીતિવાળો થયો. એ જાહેરસુંદરી પણ આવિકાપણાના કુલાચારને પાળતી અનુકૂમે આણું ક્ષયે પ્રથમ દેવલોકે દ્વીપણામાં ઉત્પત્ત થઈ કષ્ટમાં પણ શીલની રક્ષા કરતારેને જગતમાં શું નથી મળતું ?

૬

### ગુણસુંદરી.

નવયૌવન વયમાં આવેલી ફુમારિકા ગુણસુંદરીએ સાવળ્ય ખુલ્ય આકર્ષક બની ગણું હતું. જ્ઞાણ નૃત્યહેવી સાક્ષાત નૃત્ય કરવાને રંગભૂમિ ઉપર ઉત્તરી પડ્યાં હોય. એવી એની અજાય ચાલ સૌકોઈના દિક્લને લોલાવી રહી હતી. એનો મધુર અને તાલઘણ ગૂપુર રણુકાર, નાળુક ગરફનોનો મરોડ ને ગજગામિનીની માઝુક એની છથા એના લાવળ્યને અદભૂત રીતે શોલાવતાં હતાં. એ અતુપમ ગુણસુંદરી નામ પ્રમાણે ગુણવાળી પણ હતી. નવીન અજ્ઞુદ્યવાળી છતાં ઉચ્છુખલ કે સ્વર્ચંદ્રી નહોંતી, અલિ-માની કે ઉદ્ધત નહોંતી પણ વિનયવાન, ગંભિર તેમજ સમયની જાણુકાર એ બાળા ધર્મરસિકા શીલના આખ-પણવાળી હતી.

સુધેાપ પુરોહિતની આ તનયા પર એકદિવસે તેનીજ જ્ઞાતિના વેદ્યચિની નજર પડી. મોરલીના મધુરા નાહે જેમ મણીધર તાલાયમાન થાય, દીપકની કાંતિને જોઇ પતંગીખ જેમ હાલહળવાલ થાય, તેમ વેદ્યચિ કામની પીડાથી આકુળ બ્યાકુળ થઈ ગયો. મંત્રોથી સ્થાલિત થયેલા નાગની માઝુક જડવત બની ગયેલો. વેદ્યચિ એની ઉપર ચાંદેલી યોતાની દઘિને પણ ખેંચી શક્યો નહીં. સખીઓ સાથે કીડા કરતી બાળા નજરથી દૂર ગાઈ છતાં એની દઘિ તે એ પ્રમાણે જ સ્થિર થઈ ગાઈ.

એના મિત્રોએ એને સમજવી એના ઘર પહોંચાઓ પણ હૃદયશુન્ય બનેલો. વેદ્યચિ ગુણસુંદરીના દૂરને ભૂલી શક્યો નહિં. વારંવાર એ બાળાના સૌંદર્યનું સમરણ

કરતો ને એના વિયોગની પીડાને ભોગવતો તે દુઃખીદુઃખી થઈ ગયો. શાંતિના શિતળતાના અનેક ઉપચારો કરવા છતાંય વેદ્ધિચિનું દુઃખ ઓછું થશું નહિ. ત્યારે એના મિત્રો માર્ગેદ્વારે સર્વે હકીકિત જાણી એનો પિતા વેદશર્મા આલણ પુત્રના દુઃખથી દુઃખી થઈને સુધેાપ પુરોહિત પાસે આવ્યો. તેણે પોતાના પુત્રને માટે ગુણસુંદરીની ભાગણી કરી.

વેદશર્માની વાત સાંભળી સુધેાપ પુરોહિત બોલ્યો. “પંડિતજી ! આપની વાત તો ધાર્ષી મજેહની છે. પણ જરાક અસુર થઈ ગયું. શ્રાવસ્તી નગરના રાજપુરોહિતના પુત્ર પુણ્યશર્માને મેં ગુણીને અર્પણ કરેલી છે, તેની સાથે વિવાહ કરેલો હોવાથી હવે એ બીજાને આપી શકાય નહીં. મોટાએનું વચન અન્યથા થઈ શકે કે ?”

સમજું અને જાણકાર વેદશર્મા સુધેાપ પુરોહિતની વાત સાંભળી નિરાશ થઈ ચાલ્યો ગયો, પણ વેદ્ધિચિ ગુણસુંદરીને ભૂલી શક્યો નહિ. જેમ જેમ એ ભૂલવાનો પ્રથળ કરે તેમ તેમ વેદ્ધિચિ કામથી અધિક સંતમ રહેવા લાગ્યો. એના ભાતા પિતાએ ગુણસુંદરી કરતાં રૂપગુણમાં અધિક કન્યાએ સાથે પાણિઅહુણ કરી આપવાની તત્પરતા હેખાડી પણ ગુણસુંદરીમાં રક્ત થયેલો. વેદ્ધિચિ કંઈ પણ સમજ્યો નહિ. એણે અનેક વશીકરણના, મોહિનિના મત્રો સાધ્યા, દેવતાએની ઉપાસના કરી. માનતા કરી છતાંન તો ગુણસુંદરી મલી કે ન તો દેવતા પ્રસાદ થયા. પુણ્ય વગર જગતમાં શું કંઈ મલી શકે છે ?

યથા સમયે ગુણસુંદરીને પુણ્યશર્માણી પુણ્યશર્મા પરણીં ગયો. વિધિપૂર્વક એ ગુણસુંદરીને અહુણ કરી પુણ્યશર્મા પોતાને નગર પણ ચાલ્યો ગયો. પુણ્યવાનને જગતમાં શું નથી મલતું ? આપીને જ જગતની વસ્તુએ માટે તરફદું.

પડે છે, અરે ! કામની હુક્કેષ્ટા તો જુઓ કે કે પરાક્રમીન અને હુર્ભળ વસ્તુ હોય છે તેની પાછળ માનવી હિવાનો બની જાય છે ને સ્વાધીન અને સુલભ વસ્તુઓની તો પરવાહ પણ કર્સો નથી જગતની આ કેવી વિચિત્રતા !

એ ગુણિયલ ગુણસુંદરીને પુષ્યશર્મા શાવસ્તી લઈ જતાં વેદ્ધચિ તો હાર પીધેલા મત ગજરાજની માઝક ઉંમત બની ગયો, કાર્ય અકાર્યમાં મૂઠ થયેલો વેદ્ધચિ ધંતુરો પીધો હોય તેની માઝક છકી ગયો, માતાપિતાએ સમજવવા છતાં તે મૂર્ખ પોતાનું લર્ણ ધર છોડી, ધજજત, આખરને તિલાંજલિ આપી ગુણસુંદરી પાછળ શાવસ્તી ચાલ્યો ગયો, કામમાં અંધ થયેલા પુરુષોને એ સિવાય બીજુ સૂજે પણ શું ?

શાવસ્તી જતાં રસ્તામાં પર્વતની કંદરામાં ચોર લોકોની પદ્ધી જોઈ ગુણસુંદરી મેલવવાની આશાએ એ દૃષ્ટિ પદ્ધીમાં રહી પદ્ધીપતિની સેવા કરવા લાગ્યો, અનેક સાહસિક કાર્ય કરીને તેણે પદ્ધીપતિની પ્રીતિ સંપાદન કરી લીધી, એકદા વેદ્ધચિના કહેવાથી પદ્ધીપતિએ શાવસ્તીમાં પુષ્યશર્માને મફાને ધાડ પાડવા માટે હેરાઓ મૂક્યા, હેરાઓની આતમીને અનુસારે રાત્રીને સમયે પદ્ધતીપતિએ પુષ્યશર્માને ધેર ધાડ પાડી, બિદ્ધ લોકોએ એના મફાન માંથી બધુ હુંટીને પેલો વેદ્ધચિ ગુણસુંદરીને ઉપાડી ચાલતો થયો, એ રીતે ધાડથી મલેલો માલ ઉડાવીને શિક્ષતાથી તેઓ બધા પદ્ધતીમાં પહોંચી ગયા, પછીતો જાણે રાજ !

પદ્ધતીમાં ગુણસુંદરીને સારી રીતે રાખતો વેદ્ધચિ, એના માન સંભાનમાં કે ખાન પાનમાં ઉણુપ આવવા હતો નહિ, એને પ્રસત્ત કરવા માટે અનેક વાતો કહી.

સંભળાવતો હતો. એક દિવસે ખુશી થયેલી ગુણસુંદરીને તે વાડવે કહ્યું. “હે ભદ્રે ! તારા ગુણોએ માઝં ચિત્ત હરી લીધું છે. તે હવે મને પાણુ આપ. એ ચિત્ત વગર તો સંજ્ઞા રહિત હું મરેલા જેવો છું. તું તો ધર્મને જાણુનારી ને પરોપકારી તેમજ હ્યાવતી છા તેથી મારી ઉપર હવે કૃપા કર ? તું જે કે હૂર હતી તો પણ આતાં કે પીતાં, સુતાં કે બેસ્તાં, જગતાં કે નિદ્રામાં હું તનેજ જેતો હતો, તને મેળવવા માટે હું આલ જમીન એક કરી રહ્યો હતો !”

એ આજાણુની કણને અપ્રિય વાણી સાંભળી ગુણસુંદરી બોલી”, તમે કોણ છા ? મેં તમને કૃત્યાંય જેયા નથી. છતાં તમે કહો છા કે તે માઝં ચિત્ત હરી લીધું એતો આશ્ર્ય !”

ગુણસુંદરીના જવાબમાં વેદ્ધચિએ પોતાની કર્મ-કથા કહી સંભળાવી. એની કથા સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી, “અરે ! અરે ! મારામાં આ ખુલ રાગવાન થયો જણાય છે. આવા અનાર્ય અને કુસ્થાનમાં આ મારા શીલને હું શી રીતે રાખીશ ? શરણ રહિત અને એકાકી માઝં શું થશે ? પણ ગમે તે લોગે હું મારા શીલને રાખી પ્રવર્ત્તિનીએ આપેલા પ્રતને ખંડિત કરીશા નહીં. હજુ આ કંઈક ગુણવાન જણાય છે કે પ્રાર્થના કરીને મારી યાચના કરે છે. બાકી તો પાપી અને ઉદ્ધત પુરુષો તો ખળાતકાર કરવામાં જ શૂરા હોય છે. તો આને પ્રતિ-ઓધી માઝં શીલ રાખું. આને સમજવવા માટે મારે કદાચ માયા કપટ પણ કરવું પડશે જે કેએ કૌઠિલ્ય વિવેકી પુરુષે ન કરવું જોઈએ છતાંય : વર્મથી એ શીલ રક્ષના તે પણ કરવું.”

ગુણસુંદરી ખુલ વિચાર કરીને બોલી. “હે સુંદર !

તમારો મારી ઉપર આવો રાગ હતો છતાં તમે મને જણાયું નહિ. જે મને જણાયું હોત તો નાલકમાં રહેલા. તમને મૂડીને હું વિદેશી સાથે પરણુત નહિ. કારણ કે પડાસમાં જ ઇલદાયક આપ્રવૃક્ષને છાડી દૂર રહેલા કેરળના વૃક્ષની કોણું છચ્છા કરે? આપણાં બન્નેનાં નિર્મળ કુળ હોવાથી આપણે સંપૂર્ણ સુખી થાત. બધુંય સારું થાત. પણ હવે શું? અત્યારે તો આપણે સંબંધ લોકમાં નિંદા પાત્ર થાય ને પરલેકમાં હુર્ગતિને આપનારો થાય. મારે હે ધીર! એ બધી બાધતનો વિચાર કર. જે સજજન હોય છે તે ગંભીર અને વિચારશીલ હોય છે”.

ગુણસુંદરીની મધુરી મધ્યમાખ સમાન વાણી સાંભળી એ વાડવ (આલણ) વિચારમાં પડ્યો. “અહો! આ મારે વિચે રાગવાળી છે મેં જે પૂર્વે એને મારા મનનો અભિપ્રાય જણાયો હોત તો બધુંય સારું થાત, ને અત્યારે આરદો બધો પ્રયાસ મારે કરવો પડત નહિ. તેમ છતાંય પણ હવે એને છાડી કેમ હેવાય? ક્ષુદ્રિત કર્દી મેં આગળ પડેલો ભોજન થાળ પાછો ઠેલી શકે કે?”

વિચાર કરીને તે આલણ બોલ્યો. “હે સુંદરી! તારું કથન જે કે સત્ય છે છતાં તારા વિના હું હવે જીવીશ નહિ, મારું જીવન અત્યારે તારે આધીન છે. અલે કુળને કલંક લાગે, જગતમાં મારી નિંદા થવાની હો તો અલે થાઓ, અહીંથી સિદ્ધા હુર્ગતિમાં તારા સમાગમથી જવાતું હોય તો હું તૈયાર છું પણ મારા જલતા જગરને તો શાંત કર.”

એ વાડવની અંગાર સમી વાણી સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી ગઈ. શરીરના લોગે શીલપાદાવાનો નિશ્ચય કરી ગુણસુંદરી બોલી. “જે તું મારા સંગમાં

સુખનો જ અભિલાષી હોય ને એ ખાતર જ જીવતો હોય  
તો મારે પણ તાર્દું હિત કરવું જોઈએ. પણ હાલમાં ચાર  
માસ પર્યેત મેં મંત્રસિક્ષિને માટે અધ્યાત્મ પાઠચું છે. કે  
મંત્ર સિક્ષ થવાથી તાર્દું ને માર્દું કલ્યાણ થાશે, મારે અ-  
વિધવાપણું અને પુત્રની ઉત્પત્તિ થશે.”

ગુણસુંદરીનું વચન એ આદ્ધારે ઘણા આનંદપૂર્વક  
અંગીકાર કર્યું “વાહ ! શું મારા હિતની કરનારી છે ?”  
ગુણસુંદરીએ પણ અત્યારે કાળવિલાંખ કરવાનું ઉચિત માન્યું.

એ વિશ્વાની આદ્ધારણના ઘરમાં રહેલી ગુણસુંદરી  
એના ઘરનું બધું કામ કરતી ને સારી રસવતી કરીને આદ્ધા-  
રણે જમાડવા લાગી. થોડા દિવસમાં ગુણસુંદરીએ આદ્ધા-  
રણો ઝુય વિશ્વાસ સંપાદન કર્યો. જેથી આદ્ધારણના દીલમાં  
થયું કે “આહા ! શું મારા પર પ્રીતિવાળી છે ?”

કાજલની કંગાલ કોઈમાં રહીને એ ક્ષુદ્ર આદ્ધારણની  
સેવા કરતી ગુણિયલ ગુણસુંદરી આયંબિલતું તપે કરીને  
પોતાની કાયાને દમવા લાગી. સ્નાન, શૂંગારાહિ દરેક  
શાલા તજ દીધી, એવી રીતે ગુણસુંદરીને ચાર ચાર  
માસની અવધિનાં બહાણાં વહી ગયાં. છેલ્સે દિવસે રાત્રીના  
ગુણસુંદરી પોકાર કરવા લાગી, હૈયાં, માથાં કુટ્ટી ખૂસો  
મારવા લાગી. એના આ ચિંતકાર ને ચિંતાવવાથી વેહેચિ  
ગલરાઈ ગયો. “શું છે ? શું છે ?”

“અરે ! શ્રોણની વ્યાધિથી હું મરી જાઉ છું.” પેટની  
પીડા તરફ અંગુલી નિર્દેશ કરતી પોલી. આદ્ધારે મણિ-  
મંત્ર આહિ અનેક ઉપચાર કરવા છતાં એ સુંદરી ભૂમિપર  
આપોયી લોટવા લાગી. પ્રાતઃકાળે શુહકાર્ય કરવા છતાંથી  
આકંદ કરવા લાગી. “અરે સુંદર ! તારા શુહને યોધ્ય હું  
ન હોવાથી દુર્લાગ્યવાળી છું. શું કરં ? પેટની પીડા તો

ચીડ છે તે ઉપરાંત મારા મસ્તકે વેહના થાય છે. મારા અંગાપાંગ લડકે બળે છે. મારા શરીરની સંધીઓ તુઠી રહી છે. કર્યાં જાઉ ! શું કર્યાં !”

“અરે ! મને સ્વામીના વિદોગનું હુંખ નથી પણ તારા ઉપર મારાથી કાંઈ ઉપકાર થયો. નહિએ હુંખ મને અધીક ચીડ છે મારા માટે હુંખ સહન કરવા છતાં તને કાંઈ ફ્લા-મલ્લાં નહિ. ભૂગલો જેમ દૂરથી સુગજળ જોઈને દ્વારે છે પણ આપરે નિરાશ થાય. પણ એમાં તું શું કરે ? મેં પરલવમાં મારા સુખને માટે ડેઢલાને હુંખી કર્યા હુશે. કોઈને કુડાં આળ દીધાં હુશે. પારકાં ધન ચોર્યાં હુશે તેમજ પરસ્પરી ઉપર ઘણાઠકાર કર્યા હુશે. તે મારાં પાપ અત્યારે મને ઉદ્ય આવ્યાં. હે સુંદર ! અત્યારે વગરઅગ્નિએ પણ હું ખળી જાઉ છું-મરી જાઉ છું. હુંખ સહન કરવાને અશક્ત એવી મને તું કાશની ચિતા ખડકાવી ખળી મરવાની “રણ આપ.”

“હે લદે ! અધીરી ન થા ! મારા પ્રાણુના લોગે પણ હું તારો રોગ દૂર કરીશા. લાઘ્યયોગે તને આ હુંખ પ્રામ થયું છે પણ તું હવે શ્રાવસ્તી જ ! ત્યાં વૈધની ઔષધિથી તારો રોગ દૂર થશે.”

“ત્યાં હવે હું શી રીતે જાઉ ? લોકો મને શું કહે ? મારો સ્વામી મને ઘરમાં શી રીતે રાખે ? પુરુષો તો જીમેશાં ઇષ્યાવાળા હોય છે માટે હવે તો તુંજ વિચાર કર કે મારે મરણ વગર ભીજ કોનું શરણ છે અત્યારે ?” ગુણુ-સુંદરીનાં વચન સાંભળી આદ્ધણ ગળગણો થયો.

“અરે ! તારું હુંખ હું જોવાને અસમર્થ છું. લડકતી લયંકર અભિ જવાલાને હું શી રીતે જોઈ શકું ? માટે તું તારે મુશીથી તારા નગરમાં જ, તને તારા ગાંબે

જવામાં હું સહાય કરીશા, કારણું જીવતર સલામત હોશે  
તો કલે સૌ સારાં વાનાં થશો.”

“હે સોભ્ય ! જેમ તમને સુખ પડે તેમ કરો.”

ગુણુસુંદરીને રથમાં બેસાડીને વેદ્ધચિ શ્રાવસ્તીની  
સીમાએ આંદ્યો, નગરની સમીપે આવીને બોલ્યો, “હે  
સુભગે ! તું તારા પતિને ઘેર જા, હું પણ હવે મારો  
નગર તરફ જઈશા.” તેદીજની વાણી સાંલળી ગુણુસુંદરી  
બોલ્યો, “હવે બીજી વાતથી સર્યું. આજથી તું મારો  
સાધ છે માટે સુખેથી નિઃરંકપણે મારી સાથે મારા નગરમાં  
ચાલ. એનની સાથે આવવામાં શું ભાઈને લજના હોય?”

ભાવીનો વિચાર કરતો વેદ્ધચિ રથને હંકતાં નગ-  
રીમાં પુણ્યશર્માને મકાને પહોંચ્યો, પુણ્યશર્મા પોતાની  
પત્નીને જેઠ ઝુશી થયો, “હે નાથ ! બિલ્લ લોકો ધાડ  
પાડીને મને લઈ ગયેલા તે આ બાંધવે મને તેમના પંજા-  
માંથી છાણવી. માટે એનું બહુ માન કરો.” પ્રિયાનું  
વચન સાંલળી રાજી થયેલો પુણ્યશર્મા બોલ્યો, “હે સુંદર !  
કાગડાના દોગામાં હંસની માડક તમારે લીલલના સહ-  
વાસમાં રહેવું ચોગ્ય નથી. માટે સુખેથી અહીં રહો,  
અહીંથાં રહેતાં તમને કંધ ત્યૂનતા રહેશે નહીં.”

પુણ્યશર્માનાં મધુરાં વચનથી અધિક લજનતુર થયેલો  
વેદ્ધચિ મનમાં વિચાર કરવા લાગ્યો. “કોયલના શાખ  
માડક શી એના વચનની મધુરતા ! કામહેવ જેવો તો આ  
સ્વરૂપવાન છે. સમુદ્રની માડક ગંભીર અને કેવો ઉમદા  
હિલાવર હિલનો છે ! આ લાગ્યવાનતું મેં વગર કારણે  
અનર્થ કર્યું. અરે ! મારામાં ને એનામાં કેટલું અંતર ?  
ક્યાં એની સજજનતા ને કયાં મારી હુર્જનતા ? હજીનની  
માડક બીલાડા લોલુપતાથી હુદની લરેલી દોષીને ભાગતો

નથી શું ! આ ગુણિયલ ગુજરાતું હરી આવા નરરેલને છાડીને મારા જેવા અખમ નર સાથે રમે ખરી ? રાજહંસી તો માનસરોવરમાં રહેલા કમલનેજ સેવે લીધાને રહ્લિ. કુદા ઉપાયે કરીને પણ એણે પોતાનું શીલ પાઠયું મે ભાગા આત્માનો નરકમાંથી ઉદ્ધાર કર્યો. હવે આજથી આ મહાસતીના શીલને સંભારતો કદમ્પિ હું આવો અપરાધ કરીશા નહિ.”

ઉપકારના લારથી નામ થયેલા વેદ્ધચિત્તે અવસરે અલ્યંગ, ઉક્તાનથી સ્નાન વગેરે કરાવી ખાનપાનથી દૂસું કર્યો. નિશા સમયે સારી ડ્ર્પાળી સુંવાળી મખમલની સુઅં શર્યામાં પોઠાડયો. શરેમ અતે લજાથી નાશી જવાની છંઘાવાળો વેદ્ધચિ મધ્યરાત્રીને સમયે શર્યામાંથી છીઠી શુપચુપ ચાલવાની તૈયારી કરવા લાગ્યો છતોં મરીએ આગળનું આગળ !

અકુસમાતું એક સાથે એને હંશ દીધો ને પોકાર કરેતો ત્યાં હગલો થઈ પડ્યો, પુષ્યશર્મા વગેરે પરિવાર એકઢો થઈ ગયો. દીપકના પ્રકાશમાં સર્પને નાશી જતાં પુષ્યશર્માએ જોયો, તરતજ નગરમાંથી અનેક મંત્ર તંત્રના બાણુકરોને બોલાવ્યા. ગાડીએને બોલાવ્યા પણ એમની મહેનત બ્યર્થ ગઈ ને વેદ્ધચિની વાચા પણ થંબ થઈ ગઇ ને બેલાન થઈ ગયો. આખરે બધા નારીપાસ થઈ ચાલ્યા ગયા. “શુ કરીયે એનું મોત આંથું એ બહાને.”

હવે વેદ્ધચિ મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો, ને પુષ્યશર્મા નિરાશ હતાશ થઈ ગયો. પ્રાતઃકાળના સૂર્યે પોતાનો રથ હવે છાડી મુક્યો હતો, બેલાન વેદ્ધચિ આ જગતની છલલામાં છલલી હવા આઈ રહ્યો હતો. વિષના તીવ્ર આંદ્રાભુથી તેના છલલા શાસોશ્યાસ ચાલી રહ્યા હતા પોતાના.

સ્નેહુને સર્પદંશથી મૃત્યુ પામતો જેઈ પુણ્યશર્મા કંઈપી ઉદ્ઘ્યો, “અસ થધ રહ્યું હવે ખેલ ખલાસ.”

એકાએક કંઈક નિશ્ચય કરી ગુણસુંદરી હાથમાં જળની આંજલી લઈ ત્યાં હાજર થધ સર્વેની સમક્ષ તે નિહરપણે આદી, “હે શાસનહેવ ! મારું શીલ જે નિષ્કલંક હોય તો આ સર્પવિપ ઉતરી જને,” એ પ્રમાણે બોલતી ગુણસુંદરીએ વણવાર જળ લઈને પોતાના હાથથી એને સિંચન કર્યું. અધાના આશ્ર્ય વચ્ચે વેદિચિ સાંનેતાજે ભૂમિ ઉપરથી એડા થઈ ગયો જણે નિદામાંથી જગત થયો હોય તેમ, આજુભાજુયે જોતો અજાયણ થઈ ગયો. એણે શું જોયું ?

લોકો ધૂપ, દીપ, ફુફુંભ ને પુણ્યથી આ મહાસતીની પૂજા કરી રહ્યા હતા. “હે મહાસતી ! તું ચિરં જીવ ! જય પામ,” સમજ ન પડવાથી વેદિચિના પૂછવાથી અધાએ ખુલાસો કર્યો, જે સાંલળની વેદિચિ ચક્કિત થઈ ગયો એ મહાસતીનો વખાણ કરતો બોલ્યો હે બહેન ! હું શું કરે ?”

“પરદારાગમનનો ત્યાગ કરી મારા અને તારા ઉપર ઉપકાર કર,” ગુણસુંદરીના વચનથી તેણે એ પ્રત અંગીકાર કર્યું, પછી તો ગુણસુંદરીને પોતાનાં પાપ ખમાવી તે પોતાને સ્થાને ગયો. ગુણસુંદરી પણ કાળે કરીને આચુક્ષયે પ્રથમ કલ્પમાં દેવીપણે ઉત્તેજ થધ.

## ૭

“પરહેશમાં.”

“અડા અડાઈ ના કરે, અડા ન બોલે બોલ હીરા સુલસેં ના કહે, લાખ હમારા મોલ.”

એ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી જીવનને રુણવત ગણીને શીલને પાળી અનુકૂળે

સ્વર્ગમાં રતિસુંદર નામના વિમાનમાં દૈવીપણે ઉષ્મન થઈ,  
ત્યાં દેવલઘનાં અનુપમસુખો લોગવી આ ચંપાનગરીમાં  
ડાંચનશેડને ત્યાં વસુંધરા નામની સ્ત્રીથી રતિસુંદરીનો  
જન્મ થયો તેનું નામ તારા, કુષેરશેડને ત્યાં પદ્મની નામે  
સ્ત્રીથી બુદ્ધિસુંદરીનો જન્મ થયો તેનું નામ શ્રીમતી,  
ધરણશેડને ત્યાં લક્ષ્મી નામે સ્ત્રીથી ઋદ્ધિસુંદરીનો જન્મ  
થયો તેનું નામ વિનયવતી અને પુણ્યસાર શેડને ત્યાં  
વસુશ્રી નામે સ્ત્રીથકી ઉષ્મન થયેલી ગુણસુંદરીનું નામ  
દૈવી ! સરોવરમાં જેમ રાજમરાદી શોલે તેમ એ ધના-  
ધ્યોના કુળને શોભાવતી શાસ્ત્રકળાનો અલ્યાસ કરી જૈન  
ધર્મથી સુવાસિત થયેલી અનુકૂળે તે યૌવન વયમાં આવી.

તીર્થેકર લગવાનને પરલઘનમાં આપેલા દાનના પ્રલાવે  
વિનયંધર શેડને એ ચારે બાળાઓ પરણી. સમકાળ અને  
આર પ્રતને શોભાવતી એ ચારે બાળાઓના પુણ્યને યોગ્ય  
વિનયંધર હતો, કારણું વિધિ પણ સરખેસરખાંનો મેલાપ  
કરાવી આપે છે પરલઘના અલ્યાસથી આ ભવમાં પણ  
તેઓ ધર્મમાં પ્રીતિવાળાં થઈને પ્રાણું લોગે શીલ પાલ-  
વામાં સાવધાન છે. હું રાજન ! દેવતાનો સહાયવાળા  
અને ધર્મરસિક એવાં એમને જે વિદ્ધ કરે છે તે સત્તર  
નાશ પામે છે, તેં તો બધું નજરોનજર જોયું છે. સુરૂ-  
વાન છતાં શાસનદેવીઓ એમનું સ્વરૂપ બિલત્સ બનાવી  
એમની રક્ષા કરી ને ક્ષણવારમાં પાછ મૂળ સ્વરૂપ થઈ  
ગયું એ બધોય એમના શીલનો પ્રલાવ !

એ શીલવતીઓના હુંકાર માત્રથી ગમે તેવો મહા-  
વિદ્યાવાન નર પણ બધી જસ્તમ થઈ જાય. પણ સમ્યક્તવાા  
પ્રલાવથી હ્યાપૂર્ણ હૃહ્યવાળી એ સ્ત્રીઓએ તેં હુંપુ-  
આપવા છતાં લગાર પણ તારું મારું ચિત્તબુંનથી, જોઈ  
એમની ઉદાર ભાવના ?

જાની ગુરુની વાખી સાંભળી રાજ્ય શ્રીકેતુ (ચંદ્ર-  
ભતી)નાં મિથ્યાત્વ પડલ હૂર થતાં એનાં જ્ઞાન નેત્રો ઝુલ્લી  
ગયાં. “હે ભગવન ! એમનાં જીવિતને ધન્ય છે કે એમનાં  
વૃત્તાંત પણ એકાંતે હિતકારી અને મનોહર છે, હું તો  
પાપરસિક, સતીનેસાંતાપનાર, મહાન હુરાચારી હું છતાંય  
આર્દ્ર પુષ્ય જાગ્રત છે કે આપનો ધર્મપદેશ સાંભળવાને હું  
ભાગ્યવાન થયો હું. હે ભગવન ! આજથી એ દુર્ઘર શીલ-  
ક્રત મારે હો. યાવત જીવન પર્યંત મારે એ પ્રત  
મંજુર હો.”

વિનયંધર શોઠ હાથ બોડી બોલ્યો. “હે ભગવન !  
આપના ધર્મપદેશથી અમારો સાંસારિક મોહ નષ્ટ થયોન  
અમને ચારિત્રન આપીને અમારો ઉદ્ધાર કરો !”

“તમારે માટે તે યોગ્ય છે માટે સારા કાર્યમાં વિનયંધ  
કરવો નહિ.” ગુરુએ અનુભતિ આપી. ગુરુને વાંદીને સર્વે  
શીતપોતાને સ્થાને ગયા. વિનયંધર શોઠ ચારે પ્રિયાઓ  
સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યો. આવો અપૂર્વ અવ-  
સર જોઈ શ્રીકેતુની દીક્ષાની લાવના પણ વૃદ્ધિ પામી.  
મંત્રીઓએ સમજલવવા છતાં એની ઉત્તમ ભાવનાનો વેગ  
અદ્દી શક્યો નહિ. છમાસના ગર્ભવાળી પદ્મરાણી વૈજ્ય-  
વંતીનો રાજગાઢી ઉપર અભિષેક કરી રાજાએ પણ વિન-  
યંધરની સાથે દીક્ષા અહૃણ કરી.

રાજ, વિનયંધર, એની ચારે પ્રિયાઓ તેમજ બીજા  
કેદલાક લાવિક પુરુષોની એ પ્રમાણે દીક્ષા થઈ ને જ્ય-  
જ્યકાર વતી રહ્યો. પછી તો ગુરુ મહારાજ પરિવાર સાથે  
વિહાર કરી ગયા.

ગર્ભનું પાલન કરતાં વૈજ્યવંતી રાખીને એક પુત્રીના  
પ્રસ્તુ થયો. પુત્રીના જન્મથી હુંખી થયેદી રાખીએ

તરતજ મંત્રીને ખથર મોકલાવી, વિધિની વિચિત્રતાને ચિંતાવતા મંત્રીએ પુત્રીની વાત જોપવીને તરતજ રાજ્યમાં પુત્ર જન્મની વધામણી જાહેર કરીને ગુમ રીતે એ કન્યાને ઉછરવા માંડી, પુરુષનાં વસ્ત ધારણ કરાવી શાસ્ત અને શાસ્તની યોગ્ય તાલિમ અપાવતાં અનુકૂળે તે યૌવનવયમાં આવવાથી પદ્ધરાણી ચિંતાતુર થયાં. આ પુરુષરૂપે રહેલી કન્યાને હુંવે પરણાવવી જોઈએ.

મંત્રીએ પુરતો વિચાર કરી એક પ્રભાવિક યદ્ધાનું આરાધન કરવાથી ચંપાનો અધિકાર્યક યક્ષ પ્રસન્ન થઈને યોધ્યો. “ત્રીજે દિવસે પોતાનપુરે નગરના રાજકુમાર કમલસેનને ચંપાતાંગરીની ઘણારના સરોવરને કાંડ લાવીને સુડી દૃઢિ તે આ ખાળાને માટે યોગ્ય વર છે, ચંપાની રાજ્યલક્ષ્મીના સ્વામી પણ તેજ થશે, આ ખાળાનો પરાખવનો અત્ય પણ એજ હતો.”

એ યક્ષના આદેશથી તમારા પર રાગવાળી એ રોજ આળા સાથે હું મંત્રી ભત્તિવર્ધન તમારી રાહ જોતો એ ઉધાનમાં અશોકવૃક્ષની છાયામાં એઠા હતો. તે પણીનું વૃત્તાંત આપ જાણો છો.” મંત્રી ભત્તિવર્ધને રાજકુમાર કમલસેન આગળ ચંપાપતિની કથા એ રીતે સખાતે કરી.

રાજકુમારે પણ મંત્રીનું વચન અંગીકાર કર્યું. આજ સુધી રાજકુમારના વેષમાં રહેલી રાજકુમારી ગુણસેના શુલ ચુહુંતે અને શુલ દિવસે મોદ્ય આડાંખરપૂર્વક કમલસેનની સાથે પરણી ગઈ. એ નિભિસે મોદ્ય વર્ધાપત્ર મહોત્સવ થયો, તે સાથે કમલસેનનો ચંપાની ગાઢીએ સંજ્યાલિષેક પણ થઈ ગયો. રાજકુમાર કમલસેન મહારાજ કમલસેન થયા, ચંપાતાંગરીના-અંગદેશના ભાગ્ય-વિધાતા થયા.

રાજ્ય અને રમણીનાં સુખ લોગવતા મહારાજ કમલસેન સુખમાં પોતાનો કાલ નિર્ગમન કરતા હતા, તે દરમિયાન વત્સ દેશના અધિપતિ સમરસિંહનો એક વાચાળ હૃત એક દિવસે ચંપાની રાજસભામાં હાજર થઈને મહારાજ કમલસેનને કહેવા લાગ્યો, “રાજન! વંશપરંપરાથી આવેલી રાજલક્ષ્મી પણ હુંથી લોગવાય છે તો તમે આ ન ઘણીયાતી રાજ્યલક્ષ્મી સુખેથી શી રીતે લોગવશો? તમારે રાજ્ય લોગવનું હોય તો અમારી આજા માનો, અથવા રાજ્ય છાડી પલાયન થઈયાવ કે સામે ચુક્ક આપો; એ સિવાય ચોયો. ઉપાય નથી, પૃથ્વી કંંઈ રાજ વગરની નથી સમજયા?”

હૃતની વાણી સાંસારી મનમાં કોપ ધારણ કરવા છતાં હસ્તીને બોલ્યો, “જા! તારો એ સિંહ નામધારી રાજને ચુક્કના મેદાને મોકલ! હું પણ એની સામે આવું છું: કહેકે કે: જાપણા અજ્ઞેનો ન્યાય ત્યાં થશો.”

હૃત કંંઈ બોલવા જતો હતો પણ કંઈ ન બોલવા દેતાં ગણે પડીને સલસામાંથી કાઢી ચુક્ક્યો. અપમાનથી ધમધમતો હૃત ચાલ્યો ગયો.

અજે લશકરો પછી તો સામસામે ગોડવાધ ગંધાં. મહાસાગર સમી એ પ્રચ્છં સેનાના રક્તપાતની લીતિથી હ્યાળુ હૃદ્યવાળા કમલસેનનું હૃદ્ય કમ્ભું, “આ હા! આ ધમણી અને અભિમાની રાજાની ધર્ષાવૃત્તિથી લાખો માણુસોનો ક્ષય થઈ જશો, એના કરતાં તો અમે અજે જ લડીયે તેઓ કેવું સારુ!”

કમલસેને પોતાનો અભિપ્રાય હૃત દ્વારા સમરસિંહ રાજને જણાવ્યો. પોતાને બળવાન માનનારે સમરસિંહે તે વાત ઝડ સ્વીકારી લીધી. સમરસિંહ પણ નામ પ્રમાણેજ

ગુણવાળો હતો. પ્રૌઢ વયનો છતાં પોતાના બળથી તે જગતને તૃષ્ણ માત્ર ગણનારો હતો. ત્યાં આ બાળક કમલસેનનો એને શું હિસાબ !

સિંહની માડક ગર્જના કરતા બને રહે ચાયા. બને એક ભીજના વાને ચુકાવતા એક ભીજ પર ઘા કરવાની તક શોવા લાગ્યા. પોતપોતાનાં અનેક આખુદો એકથીજો સામે ઝેંકવા લાગ્યા. લાલા, મુહુગલ, ઝરસી, તલવાર વગેરેનો ઉપયોગ કરતા શાનુને થકવા લાગ્યા. પૂર્વના વેરને સંભારી જાણે ડકરો. લડતા હોય એમ લડતા આખે શાસ્ત્રાસ્થી પરવારી તેઓ હાથાહાથની લડાઈ ઉપર આવી ગયા. બને શૂરવીરો પોતાના અદ્ભૂત પરાક્રમનો પરિચય કરાવતા હતા, કણુમાં કુમારન ઉત હેખાતી તો કણુમા સમરસિંહની.

અક્રમાત સમરસિંહને ઘા લાગવાથી તે રણભૂમિ ઉપર મૂર્ખિત થઈને પડ્યો, એના લશકરમાં હાહાકાર થયો. રાજ કમલસેન શાસ્ત્રને ઝેંકી દ્ધ અટ એ રાજનું ભસ્તક પોતાના પોળામાં લઈ લીધું. શીતલ જળ મંગાવી સિંચન કરી ભીજ પણ અનેક ઉપયાર કરી સમરસિંહને સાવધાન કર્યો. હિમત આપતાં કમલસેન બોલ્યો. “હે રાજન ! તમે નામથી જેવા સમરસિંહ છો તેવા કાર્યથી પણ છો, માટે પેઠ ન કરો. પ્રસન્ન થાયો ને ઝેણીને શાસ્ત્રથણું કરો !”

કમલસેન રાજની વાણી સાંભળી સમરસિંહ વિચારમાં પડ્યો. “એં હો ! શું એની ગંલીરતા, શું એનું પરાક્રમ, શી એની આનદાની ? કોઈ રાજવંશી ઉત્તમ નર જણાય છે. વૃદ્ધ થવા છતાં મારી લોલ વૃત્તિ ક્યાં ! બાલક છતાં એની વિનયશીલતા ક્યાં ? હવે તો મારે આ લોગોસક્તિ છાડીને યોગાલ્યાસ કરવો એજ કલ્યાણકારી છે.” એમ

વિચારી સમરસિંહ બોલ્યો. “હે પરાક્રમી ! ચુદ્ધમાં હારી ગયેલા એવા મારી સાથે તારે લડવું ચોભ્ય નથી. જેથી મારી આડ કન્યાએ અને વત્સહેશની રાજ્યલક્ષ્મીને તું અહૃણુ કર !”

સમરસિંહની વાણી સાંલળી ચમત્કાર પામેલો કુમાર બોલ્યો. “આપનું રાજ્ય આપજ કોણવો. મારે આપની રાજ્યલક્ષ્મી જોઈતી નથી મહારાજ !”

“હું તો હવે પરલોકને વિષે હિતકારી એવું ઉત્તમ ચારિત્ર ગહુણુ કરીશ.” એમ કહી સમરસિંહ ચુદ્ધભૂમિ પરજ દીક્ષા લેવાને તૈયાર થયો. કમલસેન નૃપતાના સમજાવવા છતાં એ મહા માનીએ વૈરાઘ્યશી સુધર્માચાર્ય પાસે દીક્ષા અહૃણુ કરી જેથી સમરસિંહના સામંતરાખ્યાએ કુમલસેનને પોતાની રાજ્યધાનીમાં લાવી આડે કન્યાએ પરણાવી વત્સહેશની ગાદીનો અલિપેક કર્યો. બ્રતે રાજ્ય લક્ષ્મીના અધીથર કમલસેન ચંપાનગરીમાં રહીને શાસન કરવા લાગ્યો.

એક દિવસે પોતાનપુરથી શરુંજયરાજનો હૃત આવીને કમલસેન રાજને નમ્યો. પિતા તરફથી હૃતને આવેલો જાણી સિહાસનાર્દ થયેલા કમલસેન નૃપતિએ પિતાના ઝૂશાલ સમાચાર પૂછ્યા.

રાજના પ્રમેના જવાબમાં સ્વચ્છ આશયવાળો તે હૃત બોલ્યો. “હે સ્વામિન ! વસંત યાત્રામાં ગયેલા આપ કંઠ પણ કારણ પિતાને જણાવ્યા સિવાય ચાલ્યા ગયા. પાણળથી ચારે તરફ શોધ કરતાં આપનો પત્તો ન લાગવાથી નગરના લોકો હાહાકાર કરતા રાજ પાસે આવ્યા. કણુ પહેલાંને બધો આનંદ શોકમાં પલચાઈ ગયા. રાજ પણ હુંખી હુંખી થઈ ગયા. તમારા વિશેગે

તમારાં માતા પિતા કે દુઃખ લોગવે છે તેનું વર્ણન કરવાને ડોઢ શક્તિમાન નથી. એવા દુઃખમાં સમય વ્યતીત કરતોં હાલમાં તમારા ગુણેનું વર્ણન ડોડુક વૈતાલિકના ભુષેષી સાંભળી કંઈક સ્વાસ્થ્ય પામેલા રાજાએ મને આપણી પાસે મોકદ્યો છે માટે હે દ્વા ! આપના દર્શનથી હું આપ માતાપિતાને રાજ કરો ?”

દૂતની વાણી સાંભળી રાજ વિચારમાં પડ્યા.  
“અહું ! માતાપિતાનો મારી ઉપર ગાઠ સ્નેહ છે કેનેથી આદિસો દીર્ઘકાલ જવા છતાંય તેઓ મને ભૂલ્યા નથી. હું તો રાજ્ય અને રમણીમાં માતાપિતાને ભૂલી ગયો છું અતાં હવે મારે ત્યાં જઈને માતાપિતાના મનને હર્ષ પમાદ્વો જોઈએ”.

રાજાએ વિચાર કરી મતિવર્ધન મંત્રીને રાજ્ય ઉપર અધિકિત કરી પોતાના વતન જવાની મોટા આડંબર ખૂર્દક તૈયારી કરી. અનેક હાથી, બોડા, રથ, પાયદળ-ડ્રિપ ચતુરંગી સેના તથા પોતાની પ્રિયાએ સહિત કમલસેને પ્રસ્થાન કર્યું.

માર્ગમાં અનેક રાજાએના લેટણુંને સ્વીકારતો, તેમની મહેમાનગતિનો સ્વાદ ચાખતો કમલસેન પોતનપુરના માર્ગ ચાલ્યો. અનેક નગર, શહેરના લોકોથી જોવાતો, દીન અને દુઃખી જનોના દુઃખને દૂર કરતો, અનમંદિરોમાં પૂજને રચાવતો. તેમજ લુર્ણ એવા લુન પ્રાસાહનો ઉદ્ઘાર કરતો રાજ, જૈન શાસનની પ્રલાવના વધારતો હતો. રાજ કમલસેન ચતુરંગી સેના સહિત પ્રયાણ કરતો અનુકૂળે પોતનપુરના સીમાઓ આવી પહોંચ્યો. એ હિંગવિભાગી પુત્રના આગમનનો વૃત્તાંત જાણી માતા પિતાના હર્ષનો કંધ પાર ન રહ્યો.

સાર્વ પોતનપુર રાજકુમારની અપૂર્વ ઝડ્ધિ જોવાને  
ઉલટયું, નગરને શાષ્ટ્રગ્રરવામાં ઝડ્ધિમાનોએ પોતાની ઝડ્ધિ  
અર્થી નાખી, રાજકુમારના પ્રવેશ મહોત્સવ આણ માટી  
ધ્વામદૂમ થવાં લાગ્યી, રાજમાર્ગી, નાનામોયા રસ્તાએહ  
તોરણો અને પથરંગી વાવટાએથી શોલવા લાગ્યા, અનેક  
પ્રકારે માંગલિક વાદિઓ વાગવા લાગ્યાં, એવા મોયા મહો-  
ત્સવપૂર્વક કમલસેન નૃપ પોતનપુરમાં પ્રવેશ કરી પિતાના  
અરણ્ણને વિષે નમ્યો,

“શ્રેષ્ઠ શુ ? સાખ્તાભ્ય કે સંયમ ?”

ધેંકાત્પદ્મ મૃદ : સ્વર્ણ, નવનીતં ચ તક્રતઃ ।

રત્નં યથોપલાત્સાર, નૃત્વાદ્ય ધર્માર્જિનં તથા ॥૧॥

ભાવાર્થ—આ જગતમાં સારભૂત શું છે ? જેમ કાદવમાં  
ઉત્પજ્ઞ થયેલું કમલ સારભૂત છે, જેમ માટીમાંથી ઉત્પજ્ઞ થયેલું  
સુવર્ણ સારભૂત છે, ધાસમાંથી નિકળેલું માખણ જેમ સાર-  
ભૂત છે, અને પથરની જાતિમાં જેમ રત્ન સારભૂત છે  
તેવી રીતે મનુષ્ય જન્મમાં ધર્મ ઉપાઈન કર્યો તે સારભૂત છે.

દ્વિંદ્વિજયી પુત્ર કમલસેનને પિતાએ સ્નેહથી આદિ-  
ગન કર્યું, સમૃદ્ધિ સહિત પુત્રને જોઈને એ પિતાના વાતસ-  
દ્વયની સીમા રહેતી નથી, આખાય નગરના નરનારીઓના  
આનંદની તો વાત જ શી ? અનેક સૌભાગ્યવંતીએએ  
કંદ્યાક પૂર્વક જોયેલો એ રાજકુમાર કનલસેન આજે તો  
કોઈ જુદ્દો જ હતો, રાજમહેલમાં પિતાને નમ્યા પછી  
માતાનેય નમ્યો.

પુત્રના વિયોગથી દુઃખી થતી માતા જણે પોતાનું  
દુઃખ બહાર કાઢતી હોય તેવી રીતે હૃત્કુને વહેવડાવતી

ઓદી “વત્સ ! તુંતો અમને સુકીને જતો રહ્યો પણ તારા જવા છતાં તારા વિચોગે પણ અમે જીવીએ છીએ તે અમે વજમાડુક કડોર હૈયાનાં છીએ તેથી જ. આજે અમારા મોયા પુષ્ટે તારો મેલાપ થયો. રે પુત્ર ! વહ્લાની શાખાઓની પેઠ તું રાજ્યકર્ણદ્વિ, પુત્ર, કલત્ર સહિત વૃદ્ધિ પામ, જ્ય પામ !”

પોતાની ભાતાની આશિષ મેળવી બીજી ભાતાઓને પણ નમ્યો. તે પછી પ્રથાનાહિક સર્વેને મલી લેટી કુશાલતા પૂછી. વૃદ્ધજનો સંતોષ પામ્યા.

રાજસભામાં રાજએ કમલસેનને પૂછ્યું. “હે પુત્ર ! અહીંથી નિકળી ગયા પછી તને આ બધી સાહેબી શ્રી રીતે મલી તે સર્વે સ્પષ્ટતાપૂર્વક કહે ?”

વડીલનું વચન અલંદ્ય જાણી કમલસેને પોતાની હકીકત બધી કહી સંભળાની, કમલસેનની હકીકત સાંભળી બધા સસ્યો. આશ્ર્ય પામ્યા. કુમારની વાત સાંભળી શરૂંજ્ય રાજ પણ મસ્તકને કંપાવતો ઓદ્યો. “અહો ! આશ્ર્યની વાત છે. જુઓ તો ખરા ? જગતમાં કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિતામણિથી ય અધિક મહિમાવાળો ધર્મ જ્યવંતો વર્તે છે, કે જેના પ્રભાવથી મનુષ્યપણાએ સર્વે સમાન હોવા છતાં ધર્મથી મનુષ્ય કેવો મહાન અની રહે છે. પ્રાણીને ધર્મના પ્રભાવથી શું નથી મલતું ? નિષ્કલુંક અને ઉચ્ચ કુળમાં જન્મ, અખંડિત દીર્ઘ આચુષ્ય, ઐશ્વર્ય, ભૂજાખળ, શરીરે નિરોળીપણ, અપરિમિત લક્ષ્મી, અતુપમ લોગો, યશ અને કીર્તિ, એ બધુંય ધર્મ થકી મલે છે, એવા કલ્યાણકારી ધર્મથી જગતમાં કોણ મહાન છે ? એવા ધર્મને ઉપાઈન કરવામાં આગસુ માસે હું આ રાજ્યપિંજરમાં પૂરાઈ રહેવું શું યોગ્ય છે ?”

રાજએ તરતજ જ્યોતિર્વિદ પુરુષોને બોલાવી સારામાં સારું મુહૂર્ત જોવરાવ્યું. ઉત્તમ મુહૂર્તને વિષે રાજએ ભંત્રિઓને કુમારનો રાજ્યાલિષેક કરવાની આજ્ઞા કરી. મોટા મહોત્સવો મંડાયા. પોતાનુરે એકવાર ઇર્દીને પાછી સ્વર્ગની શોલા ધારણ કરી, નવીન વસ્ત્રાભૂપણોથી સજજ થયેલા નાગરિકો મોજમજાહ અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. બાલકથી વૃદ્ધ પર્યેત અને રંકથી રાય પર્યેત સર્વ શું જી કે શું પુરુષ બધાના મોજશોખ પૂરા કરવા માટે નગરમાં અનેક દથળે નાચયણ્ણો, ડીડા, રમતો, ગાન, તાન અને સંગીતના દેખાવો રાજ્ય તરફથી ચોજવામાં આવ્યા હતા. શુલ મુહૂર્તે રાજ અને ભંત્રિઓએ કુમાર કમલસેનનો રાજ્યાલિષેક કરી દીધો. કુમારકમલસેન પોતાનુરેના નરપતિ કમલસેન થયા, ન્રણત્રણ મહારાજ્યના સ્વામી થયા.

શર્કુંજયરાજએ હવે કર્મદૈપ શત્રુઓને જીતવા માટે શીલધરગુરુની પાસે ચારિત્રિધી રલને અહૃણ કર્યું. મોહ આચાર્યી સંસારની અદીનો ત્યાગ કર્યો. એ મહાસુનિ રાજ્યિ જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યાથી અષ્ટ કર્મનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીવપુરી નગરીને વિષે ગયો, અજરામર સુખના ભોક્તા થયા.

મહારાજ કમલસેન ન્યાયથી પૃથ્વીનું પાલન કરતા નવીન ચંદ્રમાની માર્ક પોતાના પ્રતાપને વધારતા દેવતાની માર્ક પોતાનો કાલ સુખમાં વ્યતીત કરતા હતા, જૈન શાસનની શોલાને વધારતા ને સાંપ્રાણ્યલક્ષ્મીને લોગવતાં તેમનો ઘણો સમય લોગમાં ચાલ્યો ગયો. તે દરમિયાન મહારાજ કમલસેનને વઠવૃક્ષની માર્ક અનેક પુત્ર પૌત્રાદિક પરિવાર થયો, એમની ખુવાવસ્થા વિજળીના અખડારાની

માર્ગક પસાર થઈ ગઈ. પલિત જે દૂર હતો તે માથા ઉપર સ્વાર થઈ ગયો. એ લોગ એ સાગ્રાબ્ય લક્ષ્મીને લોગવીને મહારાજ થાડી ગયા.

અરે વૃક્ષનાં એક દિવસનાં નવપદ્મલવ પાંડાંય કાળે કરીને વિરાગતાને ધારણું કરે છે તો પછી મતુષ્ય જેવો મતુષ્ય જ્ઞાનવાન થઇનેથ જે વૈરાગ્ય ન પામે તો એ તૃણાંથકી પણ હુલકો સમજવો, જગત ઉપર ઓષ્ઠમ રહુનો પંઝે ફરી વળ્યો. શું રાય કે શું રંક બ્ધાય તાપની વ્યથાથી આકૃપાવ્યાકુળ થઈ ગયા. લોકો ઉપવનોમાં શું કે ઉપવનોમાં શું શિતલતા પ્રાપ્ત કરવાને તલાવમાં શું કે હોજમાં પડી રહેતા તોય તાપની વ્યથા તેમની એાઢી થતી નહિ. એમની પ્રાર્થના સાંસથિવાને મેઘરાજય નવરા ન હોતા, પ્રસ્વેહથી રેખાએ થયેલા લોકો એવા લાંબા દિવસોમાં કરે પણ શું? મહાનમાં કે બહાર ક્યાંય શાંતિ નહોતી એ ઓષ્ઠમરહુના લાંબા દિવસોય પૂર્ણ થઈ ગયા ને તે પછી વર્ષરિતુ આવી.

જળથી ભરેલી અનેક નવીન વાદળીઓ આકાશ મંડલમાં દોડધામ કરવા લાગી. સૂર્યના તીવ્ર તાપને બુદ્ધે સારોય દિવસ ઘનઘોર સમાન રહેવા લાગ્યો. સૂર્યનાં તો દર્શને દૂર્લભ હતાં. પ્રદ્યમના મેઘની માર્ગક ચોથારે વર્ષાદુરી પડ્યો એ મેઘની ગર્જનાથી લોકોનાં હૈયાં વધુકવા લાગ્યાં, વિજળીના કડાકા લડાકા થવા લાગ્યા, એવા મેઘની ધારાથી લોકો રાજ થયા, મેઘે પણ વરસાવવામાં કંઈ મળ્યા રાખી નહિ. પૃથ્વી જળમય બની ગઈ. નદીનાળાં જળથી ઉભરાઈ જવા લાગ્યાં, નહીંએ પોતાની માજા સુકવા માંડી. કંઢા પર રહેલા વૃક્ષોને લાગી નાખતી પોતાનપુરની તોક્કાની નહીનાં પાણી સમુદ્રની પેંડ આકા-

શામાં ઉછળતાં ખવા નગરતા જનોને ભય પમાડી રહ્યાં હતાં. એ નદીના પ્રચંડ પ્રવાહમાં અનેક ઝાડનાં ઝાડ તણાઈ જતાં હતાં અનેક મતુલ્યે મોતના ડાચામાં છોમા-  
ઠને ચાલ્યાં જતા હતા. હિસુક જીવોનાં કલેવરો પ્રવાહના  
દીધમાં એચાઈ જતાં હતાં. એ અતિવૃષ્ટિથી તોકાની  
નદીનાં પૂર જોવાને રાજ ગજરદ થઈને પ્રજા અમાત્યાહિ-  
કાની સાથે આવ્યો. એ તોકાની નદીનાં તોકાન વૃદ્ધિ  
પામતાં હોવાથી લોકો તો ભયથી નાસ ભાગ કરવા લાગ્યા.  
એ વધતાં જતાં નદીનાં પાણી કૌતુત ભરી નજરે રાજ  
નિહાળી રહ્યો હતો. જળની સાથે મસ્તી કરનારા તારાઓ  
પણ આવા તોકાની જળમાં પ્રવેશ કરવાને હિંમતવાત  
નહોતા થતા. રાજ પાણી કર્યો. ને એવાં એ પ્રલય સમા  
નદીનાં પ્રચંડ પૂર પણ બીજે દિવસે તો ઓસરી ગયાં.

બીજે દિવસે નદીને પોતાના મૂળ સ્વરૂપમાં શાંત  
અને મંદમંદગતિએ વહી જતી રાજએ જોઈ. અત્યારે કેદ-  
લાક લોકો જળ સાથે મસ્તી કરતા કીડા કરી રહ્યા હતા.  
નગરની નારીઓ પાણીનાં એડાં ભરી પોતપોતાને મડાને  
જઈ રહી હતી. એ ગાઈકાલનું ને આજનું નદીનું વૈચિન્ય  
જોઈ રાજની વિચારશેણિ પલયાઈ ગાઈ.

“ઓહો ! આ ઉદ્ધત નદીની માઝેક માણુસ પણ  
ખુલ્ય સમૃદ્ધિ, એશ્વર્ય અને સત્તાને પામી અનેકને સંતાપ  
કરનારો થાય છે. એશ્વર્ય અને યૌવનની એ ધીમાં અને  
કને પીડા કરવામાં પાછુવાળીને તે જોતો નથી. એ એશ્વર્ય,  
સત્તારૂપ બાદ્ય પરિઅહ્નો ત્યાગ કરી પોતાના આત્મગુણો-  
માંજ જે રમણ કરે છે તે બીજાને સુખકારી થાય છે. અરે  
જે રાજએ પોતાની સત્તા અને પરાક્રમના પ્રતાપે અનેક  
રાજએને તાણેદાર બનાવે છે, રણસંઘામાં અનેક વૈરી-

ગણનો નાશ કરી પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, અનેક પ્રાસાદો અનાવી રાજુ થાય છે, તેને પણ શયન માટે ઝડપ એકજ પલંગની જરૂર પડે છે. રથ, હાથી કે અથ્ય પણ માત્ર એકજ ઉપલોગમાં આવે છે વસ્તુ, આભૂપણ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એ અધીય સામચ્ચી ઉપલોગમાં આવતી નથી. અમુક પ્રમાણ જેટલીજ તે લોગવવાની હોય છે તો આ તે મેળવેજ જાય છે, એ લોલનો તે કંઈ થાલ છે?

અનેક આરંભ સમારંભ કરીને આત્મા મેળવે છે છતાં એ અધીય સાહેબી તો પોતાના ઉપલોગને અદ્વિતીયાની લોગવે છે અજ્ઞાનથી મૂઢ થયેલા આ પામર જીવની અજ્ઞાનતાનીય કંઈ હુદ ! એજ પુરુષાને ધન્ય છે કે જેમણે આ પાપ સમૃદ્ધિનો વિવેકપૂર્વક સમજીને ત્યાગ કર્યો છે. મહારાજ કમલસેનની વૈરાગ્ય લાવના વૃદ્ધિ પામી એમની લોગ લાલસા, વિષયવાસના, મોહમમતા અધીય હવે ઠંડી પડી ગઈ, મંત્રીઓ વગેરેની સલાહ લઈ પદ્ધરાણી ગુણસેનાના પુત્ર સુવેણને રાજ્યપદે સ્થાપન કર્યો. રાજ્યની એ મોટી જવાખારીથી પાતે મુક્ત થયા.

શ્રીશીલંધરસૂરિના શિષ્ય શ્રીસંયમસિંહ યુર્દુ પાશ્વે દેશના સાંભળી વધતા પરિણામની ધારાએ ગુણસેના આદિ પરિવાર સહીત રાજી ચારિત્ર અહૃતું કર્યું રાજ્યિ છુટ, અહૃમ વગેરેની તપસ્યા કરતા ને કાયાને દમતા હતા, ઉપરાંત સાવધાનપણે નિરતિચારે ચારિત્ર પાલતાં તેઓ ભુનિયોની નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા. એ પ્રમાણે ચારિત્રનું આરાધન કરી કમલસેન રાજ્યિ પાંચમા દેવલોકે દરશ સાગરોપમના આચુષ્યવાળા દેવ થયા, ગુણસેના સાધ્વી પણ કાળ કરીને તે દેવલોકમાં ઉત્તેજ થઈ તાં બન્ને ભિત્રદેવ થયા.

ખરિષ્ટુંહ ૩ ને

હેવસિંહ અને કનકસુંહરી.

૧

પાંચમા ભવમાં.

શૂરસેન દેશની રાજ્યધાની મિથિલા નગરીના રમણીય રાજ્ય મહેલો પોતાની યશ કલગીથી આકાશગણને શીખાવતો હોયને શું ? એ મિથિલાના સૌંદર્યના તેજે નશોમંડળ જાણે જગહળી રહ્યું હોય શું ! એવી ભવ્ય અને તેજસ્વી ધ્રમારતો ગગન સાથે ગેલ કરી રહી હતી, એ મનોહર મિથિલાના રમ્ય રાજમહેલમાં રાજરાણી શુક્તાવદી અત્યારે રાજ્ય લક્ષ્મીના સંપૂર્ણ લોગોપલોગો હાજરાહજુર છતાં ઉદાસ હતી, એચેન હતી, એ મૃગનયન ચસુઓ કવચિત અશુદ્ધિદુઓને ગીરાવી હતી હતી. પોતાના ડાબા હુસ્ત ઉપર હડપચીને ટેકાવી તેના ઉપર મસ્તકનો લાર ઝીંકી હતી ગમગીન ને ચિંતાતુર હતી, સંપૂર્ણ સુખસાહેણીમાં ગરક થયેલા માનવીનેય લાગ્યમાં ખામી તો અવશ્ય હોય છે કારણે તેમનેય એક અલિલાપા પૂર્ણ થદ ત્યાં બીજી નવીન ધર્શા તૈયારજ હોય છે. આશાઓનો તે કંઈ અંત છે !

રાજसલામાંથી અંતઃપુરમાં આવેલો મેઘ મહીપતિ ખદ્રરાણીને આજે ઉદાસ અને ગમગીન બેઇ વિચારમાં પૂછ્યો “લોગવિલાસની આદદી બધી સામગી હોવા છતા રાણીને એવા તે કયા સુખની ઉણ્ણપ છે કે કેથી આદદી બધી આજ નારાજ થદ ગઈ છે” રાજએ પૂછ્યું. “હેવી ! આજે આ બધું શું છે ? તમારા મનમાં શું દુઃખ છે ?

તમારી દરેક અભિલાષા પૂર્ણ કરવા છતાં એવી કંઈ ઘણા અધૂરી રહી ગાં છે કે જેથી વહન ઉપર આયલ્વી અધી જ્ઞાની છવાઈ રહી છે ?” રાજની વાણી સાંભળી રાણી ગદગદ કંઠે અચુને પાડતી બોલી.

“હે હેવ ! રાજકાર્યમાં વ્યાચ થયેલા આપને એ વાત કહેવાથી શું થાય ? જગતમાં તો એજ સ્થીએને ધન્ય છે કે જેએના ઉત્સંગમાં નાનકડો બાલક ફીડ કરતો હોય, એ પુત્ર રહિત મારે હેવે જીવિતનું પણ કામ શું ?”

“પ્રિયે ! એવી હૈવાધીન વસ્તુએમાં હર્ષ શોક શું ? પરાકમને આધીન હોય તો એને મેળવતાં વારે ન લાગે ? મારે એવી બાધ્યતામાં શોક ન કરતાં ધીર્યનું અવલંખન ધારણ કરો. જે થાય તે જોયા કરો.”

“સ્વામિન ! તમારી વાત કંઈ ગળે ઉત્તરે તેવી બરાધર નથી. મણિ, મંત્ર, તંત્ર અને હેવનો પ્રભાવ અચિત્ય હોય છે. તેમની સેવા, પૂજા, અચ્છા કરવાથી માનવીના મનોરથો સિદ્ધ થાય છે. આપ એ બાધ્યતા ધ્યાનમાં લ્યો તો આપની કામના કેમ અપૂર્ણ રહે ?”

“હેવી તારી અભિલાષા પૂર્ણ કરીશ. વિષાદનો ત્યાગ કરી ધીરજ ધર.” રાજ મનમાં કંઈકનિશ્ચય ફરી રાણીને આસ્થાસન આપતાં બોલ્યો.

‘મણિ મંત્રના આરાધન કરતાં કેાઢું હેવનું આરાધન કરું તો શીધિતાથી કાર્ય પૂર્ણ થાય’ એમ નિશ્ચય કરી કાળી ચતુર્દશીની રાત્રીએ હાથમાં તલવારને ધારણ કર્યો સાંજ રમશાન ભૂમિમાં ચાલ્યો ગયો. પોતાના ખૂલાંઝ અવસ્થે વનહેવતાએને સંભળાવતો બોલ્યો. “હે હેવ-તાએ ! સાંભળો ? હું મારા દેહમાં રહેલું માંસ તમને અર્પણ કરીશ અદલામાં જને એક પુત્ર આપો.”

રાજના શાખાઓ સાંભળી કોઈક ભૂત આકાશમાં રહી-  
ને બોલ્યો. “હે રાજ ! માંસથી પુત્ર પ્રાપ્તિ ન થાય,  
મસ્તક આપે તો કદાચિત થાય તો થાય.”

“જો એમ હોય તો મસ્તક લે ?” એમ કહી રાજન  
એ મસ્તકની વેળી પકડીને બીજા હાથની તલવાર ગરફન  
ઉપર જીકી.

એના સાહસથી પ્રસન્ન થયેલો. દેવતા એનો હાથ  
પકડી બોલ્યો. “સખૂર ! એ સાહસિક વીર ! સખૂર ! તારે  
પુત્ર જરૂર થશો !”

“જો પુત્ર જરૂર થશો તો પછી એનાં મૂલ્ય આ મસ્તકથી  
વસૂલ કર ?” રાજનાં વચન સાંભળી દેવ પ્રસન્ન થિયાને  
બોલ્યો. “નરેશ્વર ! સાહસ એજ એનાં મૂલ્ય કહેવાય  
મસ્તક નહિ.”

દેવતાના વરદાનથી રાજ પણ ઝુશી થયો. ને પોતાની  
તલવાર ભ્યાન કરી. રાજની પ્રતીતિ માટે દેવ બોલ્યો.  
“આજે રાત્રીએ તમારી રાણી સ્વમામામાં ઉત્સંગે ખેલતા  
કેસરીના ઘચ્યાને જોઈ જાગૃત થશો.” એમ કહી દેવતા  
અદ્વિત્ય થઈ ગયો. ને રાજ પોતાના મકાને આવ્યો.

તે દિવસની નિશા સમયે શાંખરાજનો જીવ પાંચમાં  
ભવને વિષે સુકૃતાવળી પદ્મરાણીની કુદ્ધિને વિષે છીપમાં  
મોતીની માર્કડ અભિદેવ લોકમાંથી ન્યવીને ઉત્પન્ન થયો.  
તે સમયે સુએ સૂતેલી રાણીએ પોતાના ઉત્સંગમાં સિંહના  
ઘચ્યાને ખેલતો જેયો. સ્વમ જોઈને જગેલી રાણીએ રાજની  
પાસે આવી પોતાનું સ્વમ કહી સંભળાયું. રાજએ દેવની  
વાણી યાહ કરીને કહ્યું “તમારે સિંહ સમાન પરાક્રમી  
પુત્ર થશો.”

રાજનાં વચનથી હર્ષ પામેલી પદ્મરાણી સુકૃતાવળી

ગર્ભનું સારી રીતે પોપણું કરવા લાગી. પૂર્ણ સમયે સારા સુહુત્તને ચોગે રાણીએ પુત્રનો જન્મ આપ્યો. રાજાએ મોટો વધ્યાપન મહોત્સવ કર્યો. ખારમે દિવસે રાજાએ પુત્રનું નામ દેવસિંહ રામણું. રાજ્યમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો ને પ્રજા તરફથી અનેક વધામણાં થયાં.

રાજકુમાર વૃદ્ધિ પામતો શાસ્ત્ર અને શાસ્ત્રની કળામાં નિપુણ થયો. મનોહર એવી યુવાવસ્થામાં ગાન, તાન અને સંગીત વિશારદ પુરુષોથી સુતિ કરાતો હેવકુમારની માઝેક શોભતો. રાજકુમાર નવીન તારણ્ય અવસ્થાને શોભાવવા લાગ્યો.

ગુણસેનાનો લુધ પંચમ સ્વર્ગથી આયુઃક્ષયે વિશાલા નગરીમાં જાતશરૂ નામે રાજાની કનકમંજરી રાણીથડી કન્યાપણે ઉત્પન્ન થયો. એનું નામ કનકસુંદરી. કળાનો અભ્યાસ કરતી ને વૃદ્ધિ પામતી નવીન યૌવનને આંગણે આવેલી કનકસુંદરીને પૂર્વના સંસ્કારથી વિષય તરફ પ્રીતિ જ નહોતી જણાતી. સમયને જાણુનારી સખીએ અનેક પ્રકારની રચિક વાર્તાલાપ કરતી છતાં રાજભાગા કનકસુંદરીને તે સખીએનો રસોલ્લાસ સાંભળવોય ગમતો નહિ. પુરુષનું નામ પણ જેણુને સાંભળનું ગમતું નહિ તો પછી વિવાહ માણેની તો વાત જ શી?

રાજભાગાની વિરક્ત ભાવનાથી રાજરાણી ચિંતાતુર થયાં, રાજાએ મંત્રીને એનો ઉપાય પૂછ્યો. “હે મંત્રીન! આ ભાગાની વિવાહ તરફ ઇચ્છિ જયત કરવાને શું કરવું?”

રાજાને ચિંતાતુર જોઇ મંત્રી બોલ્યો. “મહારાજ! આ ભાગાએ કદાચ પૂર્વ લવને વિષે કોઈ ઉત્તમ દેવકુમાર જેવા પુરુષ સાથે સ્નેહ સંબંધ બાંધ્યો હુશે જેથી એનું મન એ પુરુષ સિવાય થીજે ક્યાંય આકર્ષાશી નહિ.”

“પણ એના પૂર્વ લખના પતિની આપણુંને શી રીતે ખબર પડે ! આપણે એને શી રીતે શાધી શકીએ કે જેથી તેઓ બનેનો મેળાપ થાય ?”

રાજની વાત સાંલળી મંત્રી વિચારમાં પડ્યો. “મહા-રાજ ! એક રસ્તો છે.”

“શા ?” રાજએ આતુરતાથી મંત્રીની સામે જોઇ પૂછ્યું.

“હશહેશના રાજકુમારોનાં ચિત્રો તૈયાર કરાવી રાજ-કુમારીને અતાવો એ રાજકુમારોમાં જે એનો લખાંતરનો પતિ કોઈ હશે તો એને જોતાંજ રાજકુમારી તુરતજ પ્રેમ ધારણ કરશે.” મંત્રીની દલીલ રાજના હૃદયમાં ઉત્તરી ગઈ.

રાજએ ચિત્રકારોને બોલાવી રાજકુમારોની છખીએ આદેખી લાવવાને દેશપરદેશ રવાને કર્યા. તેમણે અનેક રાજકુમારોનાં ચિત્રપટ રાજની આગળ હાજર કર્યાં. રાજએ એ દરેક ચિત્રપટા રાજકુમારીને જોવા માટે મોકલાયાં.

રાજકુમારીએ ઘધાં ચિત્રપટા ઉપલક દિશિએ જોઇને દૂરીઝી હુદસેલી હીધાં અને કોઈની તરફ એતું આકર્ષણું થયું નહિ. દરમિયાન એક દિવસે ભિથિલાનગરીથી આખેલા ચિત્રકારતું ચિત્રેણું ત્યાંના રાજકુમાર હેવસિંહતું ચિત્રપટ રાજકુમારીના હાથમાં પડ્યું. રાજકુમારીની નજર એ ચિત્રપટ જોતાંજ સિથર થઈ ગઈ. “અહો ! શું એતું સૌંદર્ય ! આ તે હેવકુમાર કે રાજકુમાર !”

“હેવકુમાર નહિ રાજકુમાર.” સખીએ હસી પડી.

“કયાંના રાજકુમાર ?” કંઈક ક્ષોલ પામેલી કનક-સુંદરી બોલી.

“ભિથિલાનગરીના !” એક સખી હસી.

“જે ખાળાના એ પતિ થશે તે ખાળાના સૌખ્યમાં.

સુખમાં શું ખામી હોશે ?” રાજકુમારી ચિત્રપથના સ્વરૂપને જેતી એની પ્રશાંસા કરવા લાગી.

“જરાય નહિ, રાજધાના ! તારા ભાગ્ય અદ્ભુત છે.”

“મારાં શી રીતે ? શું મને એ પ્રાપ્ત થઈ શકે કે ?”

“શા માટે નહિ ?” સખીએ રાજકુમારીને કહ્યું. “આ ચિત્રપથને જોતાં સ્થિતીએ તો મોહ પામે પણ પુરુષોય આતે જોતાં એકાથ થધ જાય તો એમાં આશ્ર્ય શું ? રાજ-સભામાં રાજ વગેરે બધાય આ રૂપને જોઇ સ્તર્યથ થધ ગયા હતા, આ સ્વરૂપ આગળ બધી સભા નિસ્તેજ થધ ગઈ, જાંખી થધુ.”

“સખી ! તું પ્રશાંસા કરે છે તેવાજ આ રાજકુમાર છે બલકે તેથીય વધારે. મારા જેવી ને આ ઉત્તમ નરની આમિ શી રીતે થધ શકે ?”

કનકસુંદરીનાં વચન સાંલળી એક ચતુર સખી બોલી. “સખી ! આ પુરુષને યોગ્ય એવું એક નર્સ સૌંદર્ય ભરેલું વર્ણ સ્વરૂપ ચિત્રપથમાં આલેખ !”

રાજકુમારીએ પોતાનું સૌંદર્ય આખેહુય રીતે ચિત્રપથમાં આલેખી દીધું. રાજકુમારીની ચિત્રકળાની પ્રશાંસા કરતી સખીએઓ એ ચિત્રપથ રાજની સમક્ષ હાજર કર્યું સાથે સાથે રાજકુમારીની અભિલાષા પણ વ્યક્ત કરી દીધી. રાજકુમારીના અભિપ્રાયને જાણી રાજ ખુશી થયા, એ લાવણ્યના લાંડાર સમાન રાજકુમારીનું ચિત્રપથ જોઇ પોતાના પ્રવાન પુરુષોને વિવાહ માટે મિથિલાનગરી તરરે રવાને કરી દીધા. તેઓએ મિથિલાનગરીમાં મેઘરાજની સભામાં આવી રાજને પ્રાર્થના કરીને કનકસુંદરી રાજકુમાર હેવસિહુને આપી.

મેઘરાજએ એ પ્રવાન પુરુષોની વિનંતિ સ્વીકારી

રાજકુમાર હેવસિંહને પોતાની ચતુરંગી સેના સહિત પોતાના પ્રધાન પુરુષો સાથે વિશાળા તરફ મોકદ્યો અવિનિષ્ઠન પ્રયાણ કરતો હેવસિંહ અનુકૂમે વિશાળા નગરીએ આવી પહોંચ્યો.

જીતશરૂ રાજએ પોતાના ભાવી જમાતાનું સામૈયું કરી તેમનો સત્કાર કર્યો ને ઉતારા વગેરે માટે યોગ્ય ગ્રાડ-વણું કરી. નિર્ધાર કરેલા એક શુલ દિવસે બન્ને વરવધુનાં માટી ધામદુમપૂર્વક લગ્ન થધ ગયાં, વિશાળાનગરીમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો.

એ વિવાહ ઉત્સવની સમાપ્તિ પછી કેટલાક દિવસ સુધી થ્યસુરના આયહુથી હેવસિંહ કુમાર વિશાળાનગરીમાં રહ્યા, એકદા અહુસ્પતિ સરખા જ્ઞાની એવા સુરાગુર નામે સૂરીશર વિશાળાના ઉધાનમાં પવાર્યા, સર્વ સંતાપને હરનારી, ને ભાવ્ય જનોને પ્રતિષ્ઠોધ કરેનારી તેમની દેશના સાંલળવાને પુરુજન સહિત રાજ જીતશરૂ, અને પ્રિયા સહિત હેવસિંહ કુમાર સર્વે આબ્યા, ગુર મહારાજને વાંદ્દી તેમની આગળ પોતપોતાને યોગ્ય સ્થાનકે બેડા, સૂરીશરે મધુર ધ્વનિથી ધર્મેપદેશ આપ્યો “હે ભાવ્યો ! આ સંસાર કારાયહ સમાન છે તેની હુંએ કરીને લેઢી શકાય એવી કષાયદૃપી દિવાલો છે, રાગદ્વેષદૃપી એનાં કમાડ-હરવાળ છે, એ કારાગારમાં અજ્ઞાનદૃપી અંધકાર ઘીચાઘીય ભરેલું છે, સંસારી જીવો એ કારાયહમાં પૂરાયેલા કેદી જેવા છે એ કેદીએ કુદુંબદૃપી ગાઠ બંધનથી બંધાયેલા છે, ધષ્ટ, અનિષ્ટ, સંયોગ અને વિનોગ રોગ, શોકદ્રશ ક્ષુદ્ર જંતુએ પ્રાણીએને પીડા કરી રહ્યા છે, કર્માના સારાં માડાં ઝેલને બોગવતા પ્રાણીએ ત્રાહીત્રાહી પોકારી રહ્યા છે, જે કર્માને વૃદ્ધીની દ્વારા નથી આવતી, તેમજ બાલકને પણ નથીએ.

છીઅતા નથી, નિર્ધનને પણ સતાવે છે ને ધનવાનને પણ.

“અરે યારે ગતિમાં એવી કોઈ પણ વિટાખણા નથી કે જીવોએ પરશુરામણે અનંતીવાર ન લોગવી હોય. એવા આ દુઃખદ સંસારમાં તમારા જેવા યુદ્ધભાનો ‘જે થવાનું હશે તે થશે’ એમ માનીને નિશાંકપણે રાચે, માચે, તે ચોગ્ય નથી, આડત આવે તે પહેલાંજ ડાઢા પુરુષોએ જગ્યા જરૂર જોઈએ મનુષ્યલવ પામીને તેને ચોગ્ય કારવધ કરી મનુષ્યલવને સર્કળ બનાવવો જોઈએ, ધર્મનું આરાધન કરીને આપહાયોનો નાશ કરી આ લોક અને પરલોકમાં સુખ સંપત્તિ મેલવવી. મોક્ષ પણ એ ધર્મારાધનવડેજ લખ્ય થઈ શકે છે. જીનેથરની સેવા કરવાથી તેમની આજાનું આરાધન કરવાથી પણ ધર્મ સાધી શકાય છે. અરે ! કદ્વ-વૃક્ષ સમાન ફળને આપવાવાળી જીનેથરની સેવા જીવોને શું શું નથી આપતી ?

૨

### જીનેન્દ્ર પૂજનું કલા

દ્વયસ્તવ અને ભાવસ્તવ એ બને પ્રકારે જીનેથરની આજાનું આરાધન થઈ શકે છે ભાવસ્તવના સમ્યગ્ પ્રકારના આરાધનથી પ્રાણી આડ ભવસુધીમાં અવશ્ય સંસાર થકી સુકાઈ જાય છે એ ભાવસ્તવના આરાધક પંચમહા પ્રત વારો, પંચ સમિતિ અને ત્રણ ગુસ્તિર્પ અથ પ્રવચન માતાના ધારક, ક્ષમાદિક દશ પ્રકારના સાધુના ધર્મવડે વિલૂષિત, ઉપસર્ગ, પરિસહને સહન કરનારા સાધુએઓ હોએ શકે.

જીત્મ, જરા અને મરણથી રહિત, શોક, સંતાપ,

આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત એવા અનંત મોક્ષ-  
સુખની જે તમારે જરૂર હોય તો તમે જ્ઞાનથી ભગવાનની  
આજાતું આરાધન કરો ભાવસ્તવથી જ્ઞાનાતું પાલન  
કરી પુરુષાર્થ ઈશ્વરી શીધિતાએ સુક્રિના સુખ મેળવો.  
ભાવસ્તવ આરાધનાને અશક્ત હો તો પછી દ્રવ્યસ્તવ.

ચારિત ધર્મની અલિલાપાએ સમકિતપૂર્વક પંચ  
અષુદ્ધત, ત્રણ ગુણપ્રત અને ચાર શિક્ષાપ્રતતું પાલન  
કરો, જ્ઞાનમંહિર બંધાવો, પ્રતિમાએ પદરાવો, પ્રતિ  
દિવસે વિવિધ પ્રકારે જ્ઞાનેખરની પૂજાએ રચાવો, મહા-  
પૂજા રચાએઓ, સુપાત્રને વિષે દ્વાન આપી તમારી લક્ષ્મીનો  
સહઉપયોગ કરો. એ પ્રકારે ગૃહસ્થ ધર્મતું આરાધન કરી  
મનોહર આશયવાળા પ્રાણીએ જંસારને ક્ષીણું કરી નાખી,  
હેવલવનાં સુખોને લોગવી અતુફે શીવલક્ષ્મીને પણ  
લોગવે છો.

જે ભવ્ય જીવો શુભાશયપૂર્વક જ્ઞાનમંહિર બંધાવે છે  
તે લઘુતાથી ભવસાગર તરી જાય છે જ્ઞાનેદ્વારને કરાવ-  
નારા ઉત્તમ પુરુષો ગાઢ પાણોથી મૂકાધ જાય છે, તેમજ  
જ્ઞાનેખરની પ્રતિમા ભરાવનારા ભવ્ય જીવો રોગ, શોક,  
લચ, આધિ વ્યાધિથી રહિત થઈને અદ્ય સમયમાં ઉત્કૃષ્ટ  
એવી સિદ્ધિ રમણીને વરે છે. જેએ અરિહંત ભગવાનની  
પ્રતિષ્ઠા કરાવે છે તેમની સ્વર્ગને વિષે પણ અપૂર્વ પ્રતિષ્ઠા  
હોય છે મતુષ્યદોકમાં તેમનાં દુઃખ, દ્વારદ અને દૌર્લભ્ય  
નાશ પામી જાય છે અરે! ભાવથી કરાયેલી ભગવાનની  
પ્રતિષ્ઠા પ્રાણીએની કર્ત અલિલાપાને પૂર્ણ નથી કરતી?

ગૃહસ્થની લક્ષ્મી ધર્મકાર્યમાં, જીન ભવન કે પ્રતિષ્ઠા-  
દિક કાર્યમાં વપરાતી ઉત્તમ ઝ્લને આપનારી થાય છે  
અન્યથા લક્ષ્મી તો દુર્ગાતિમાં લઈ જનારી થાય, માટે

સુખના અર્�ી જનોએ પોતાની લક્ષમી સારા કાર્યોમાં વાપ્સ રવી જોઈએ. એવી રીતે વિધિપૂર્વક કરેલ દવ્યસ્તવ જ લાવસ્તવનું કારણભૂત થને.

સાત આડ ભવમાંતે જીનધર્મ પ્રાપ્તિના દુલ્લઘ્રાપ સ્વર્ગ અને મનુષ્યમાં શાતાવેદનીયને અનુભવતો શિવસંપહ્લો પામે છે. અરે! વિધિપૂર્વક આરાધન કરનારની આ તો વાત છે, બાકી તો અનાલોગ-દેખાડેખીયે ધર્મનું આરાધન કરનાર, જીનેશ્વરની પૂજા કરનાર શુકુંગલાની માર્કે પણ પરંપરાએ કલ્યાણને પામે છે. માટે હે અન્ય જનો! યતિધર્મ અને ગૃહસ્થધર્મ સિવાય ત્રીજે ઉપાય સંસાર કારાઅહુથી છુટવાને નથી. એમ જાણ્યા છતાં વિલંબ કરવો તમારે ઉચિત નથી. કારણું પ્રાણીઓને ધર્મની સામની ભળવી દુર્લભ છે. ચોરાસી લાખ લવયોનીમાં જામણ કરતા જીવને મનુષ્ય જન્મ પામવો તે દુર્લભ છે તેમાંથી ધર્મની સામની તો લખુકર્મી જીવને પ્રાપ્ત થાય છે એવી દુર્લભ સામનીને પામીને કોણું પ્રમાદ કરે?”

ગુરુમહારાજની અમૃતમય દેશના સાંભળીને કેટલાક જીવોએ કર્મના લધુપણાથી તરતજ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક અશક્તોએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. કેટલાકે સમકિત ગ્રહણ કર્યે, દેવસિંહકુમારે પંચ અણુદ્રત ગ્રહણ કરીને પૂછ્યું: “ભગવન! દવ્યસ્તવ કરવાવડે શુકુંગલાની કલ્યાણ પ્રાપ્ત કેવી રીતે થઈ તે આ સભાના બોધને માટે આપ કૃપા કરીને કહો?”

કુમાર દેવસિંહનો પ્રશ્ન સાંભળી દવ્યજનોના હિતને માટે ગુરુ મહારાજે શુકુંગલનું કથાનક કહેવું શરૂ કર્યું. “આ દક્ષિણાર્થ ભરતમાં વૈતાદ્ય પર્વતની સમીપે સિદ્ધી કર નામતું રમણીય ઉધાન આવેલું છે, સદાકાળ દ્રળને

આપનારાં એવાં અનેક વૃક્ષો, લતાઓ મંજરીઓ, પુષ્પો અને ઇણોથી લચી ગયેલા એ વનની અપૂર્વ શાલાથી નલોમંડલમાં તારાગણુની જેમ તે વિદ્ધાનોત્તો પ્રશાંસાને પામેલું હતું. જ્યાં કિન્ઝરનાં મિથુનો હરહુમેશ કીડા કરી રહ્યાં છે કોકિલાઓ પોતાનાં મધુરાં ગાનથી કિન્ઝર મિથુનના આનંદમાં વૃક્ષિ કરી રહી છે અને અમરાનાં જીથ પોતાના ચુંબરવોથી મંત્રોના પાડા ભણી રહ્યા છે કે શું! એવાં લતાશુહેલામાં કીડા કરવાને હવમિથુનને આકર્પણાં હોય શું!

સ્વર્ગના ફુકડા સમા એ રમણીય વનમંડલમાં વિદ્યાધરોએ નિર્મિતા જીનમંડપમાં સ્વર્ણપીડ ઉપર પદ્મરાગ મણિરસ્તનથી રચાયેલી અહેત અગવાનની પ્રતિમા હતી. વિદ્યા સાધવાને માટે આવતા અનેક વિદ્યાધર વિદ્યાધરીથી પૂજાતા એ અગવાન કલ્પવૃક્ષ સમાન અમોદ કલને આપનારા હતા. તે વનમાં જીન ચૈત્યની સમીપે રહેલા એક વિશાળ આંગ્રેજી ઉપર પરસ્પર ગાડ સ્નેહવાળું એક શુક ચુગલ રહેતું હતું. તિર્યાંચ યોનિમાં હોવા છતાં સરળ પરિણામની, લધુકર્મની, અને ભાડા પરિણામથી રહિત એ કીર ચુગલ હરોજ વિદ્યાધરોથી એ અગવાનને પૂજાતા જોઈને લદ્દક પરિણામી થયું હતું. હરોજના એ નિરક્ષણથી તેમને પણ એ અગવાન તરફ અમંદ આનંદ થવા લાગ્યો. કારણું ગમે તેવા સ્થાન વિશેષમાં હોવા છતાંય ભાવિ કલ્યાણની પ્રાપ્તિવાળા ઉત્તમ જીવાને અજ્ઞાનપણુંમાં પણ ઉત્તમ પદ્ધાર્થ ઉપર શું પ્રીતિ નથી થતી? ત્યારે ગુરુ કર્મી જીવા જ્ઞાનવાન હોવા છતાં પણ ઉત્તમ વસ્તુ તરફ અનાદરવાળા હોય છે એ નર્દૂ દીપક જેવું સત્ય કોણ નથી જાણું?

અરિહંત ભગવાનના બિંઘને જોઈને કેચ્ચાને અપીતિ થાય છે તેમના ભારે કર્મિપણાની અમે શું વાત કરીયે? તેથીજ સુજ્ઞ પુરુષે અર્હનું બિંઘ તેમજ તેમના લિંગ (વેષ) ને જોઈને વેર વિરોધનો ત્યાગ કરવો જોઈએ. મિદ્યાત્વઇપી અંધકારનો નાશ થઈને જ્યારે સમકિતિદ્વપુ સૂર્યનો આત્મામાં પ્રકાશ થાય છે ત્યારે જ હેવ ગુરુ અને ધર્મ આહિ ઉત્તમ પદાર્થ ઉપર આત્માને અવશ્ય પીતિ થાય છે. જે સમકિતિની પ્રાપ્તિ જ્ઞાનીઓએ દુર્લભમાં દુર્લભ વર્ષાવી છે, શિવ સોખાનનું પ્રથમ પગથીથું એ સમકિત.

સુંદર ભાવની પરંપરાથી વૃદ્ધિ પામતા પરિણામે એક દિવસે એ કીર ચુગલને ભગવાનને પૂજવાનો વિચાર થયો. ભાવિ કલ્યાણવાળા જીવોને જે શક્ય છે, વિદ્યાધર રહિત ભગવાનને એકાડી જોઈને આગ્રવૃક્ષની મંજરીએ લાવી એકદા એ શુક્લશુક્લીએ ભાવથી ઉદ્ઘાસ પામતાં એ ભગવાનને પૂજ્યા. ભગવાનના ચરણ, કર્ણ અને મસ્તકને સહકાર મંજરીથી શાણુગાર્યા અને ભાવના-પ્રાર્થના કરી.

જ્યારે જ્યારે એકાંત અવસર મળતો ત્યારે તે સમયનો લાલ એ શુક્લશુક્લી લેતાં ને જીનેકિરને સહકારમંજરીથી અને વનના પુષ્પાથી અર્થતાં, એ શુલભાવ અને શુલકાર્યને પરિણામે એ અનેએ તિર્યચ નામકર્મનો નાશ કરી શાતા-વેહનીય સહિત મનુષ્યનું આયુ બાંધ્યું. અનાલોગપણે કરેલી પ્રણ જીનું પૂજા પ્રાણીને શું નથી આપતી?

જ ખુદીપના મહાવિદ્ધ ક્ષેત્રમાં રમણીય નામે વિજયને વિશે શ્રીમંદુર નગરના નરશોભર રાજની કીર્તિમતી રાણીની ઇક્ષિને વિશે પેલો શુક કાલ કરીને પુત્રપણે ઉત્પત્ત થયો, તે સમયે ઉત્તમ ગર્ભના પ્રભાવથી રાણીએ સ્વમામાં સૂર્યમંડળ સરખું તેજસ્વી કુંડલ જેયું, સ્વમ જોઈ રાણી

જાગી ને સ્વમાની વાત રાજને કહી સંભળાવી. વિચાર-વાન રાજએ કહ્યું. “હલી ! મોટા રાજ્યનો ખણી એલે તારે ભાગ્યવાન પુત્ર થશો.”

રાજનાં કુર્ણમધુર વચન સંભળીને હુર્દ્દ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પોપણ કરવા લાગી. અનુકૂળે શુદ્ધ સુહુતે રાણીએ પુત્રનો જન્મ આપ્યો. તેની નામનિક્ષેપનના સ્થાનમાંથી બહુ મૂલ્યવાન રલોનો ચદ નિકળ્યો. એ રલનો નિધિ બેઠને રાજ વગેરે સર્વ ભાલ-રાજકુમારના ભાગ્યની પ્રશાંસા કરવા લાગ્યા. પુત્રજન્મનો મોટા ઉત્સવ કરી રાજએ રાજકુમારનું નામ ‘નિધિકુંડલ’ રાખ્યું.

ભાગ્યદ્રમાની કાંતિને ધારણુ કરતો નિધિકુંડલ અનુકૂળે યૌવનવયના આંગણે આવીને ઉલ્લો. એ રમણીય યૌવનવય, ઔથ્યા, વૈભવ, ઠકુરાઈ સુદૃપ રમણીજનનો સમાગમ છતાંય નિધિકુંડલ સુનિની માડક ઇપવતી રમણીયો. તરફ દિન પણ કરતો નહિ. ભાગ્યવશતઃ સ્વયંવરા આવેલી મોટા મોટા રાજાઓની ભાગ્યવતી કન્યાઓ તરફ પણ વીતરાગની માડક નજર કરતો નહિ. ગજેંદના મહતું મહન કરવાની તાકાત છતાં, ધનુર્ધારીઓમાં અગ્રણી છતાં પરાયા જીવને લેશ પણ દુઃખ થાય તેવું કાર્ય કરતો નહિ. વિષની માડક તે માંસ અને દાઢથી દૂર રહેતો હતો. એવા અનેક ગુણોથી અલંકૃત થયેલો તે કુમાર માતાપિતાને આનંદ આપતો ભિત્રોની સાથે કીડા કરતો અનેક નવીન કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યો.

શુકી પણ લદ્દક ભાવે ત્યાંથી મરણ પામીને તેજ વિજયમાં વિજયાવતી નગરીને વિષે રલયું રાજની સુવપ્રા

પુરાણી થડી સારા સ્વમથી સૂચિત પુત્રીપણે ઉત્પત્ત થઈ,  
રાજાએ તેનું નામ રાખ્યું પુરંદરયશા !

પુરંદરયશાએ અનુફરે કામુક જનને મોહક એવા  
યૌવનવયમાં પ્રવેશ કર્યો. સુવર્ણ સમાન કાંતિવાળી, મનોહર  
ચંદ્રસુખી બાળા પુરંદરયશા સખીઓની સાથે કીડા કરતી  
હતી. યૌવનરૂપી રમણીય વનમાં વિહાર કરતી છતાં યૌવનને  
યોગ્ય હાવ, ભાવ કે ચેષ્ટાએ. તેણું ગમતી નહિ. સખી-  
અપના શૃંગાર રસની કથા સાંસારબાનાય અખાડા કરતી  
હતી. તેમજ અન્યજનોની કીડા કે ચેષ્ટા અથવા તેમનાં  
કુઠુલા તરફ નજર સરખી પણ કરતી નહિ. અરે વિલાસી  
સ્ત્રીઓ સાથે ભાવણ પણ કરતી નહિ. શાંત સુધારસમાં  
દીન બાળા પુરંદરયશા સખીઓ સાથે નિર્દોષ કીડા  
કરતી હતી. અહેત ભગવાનના કહેલા ધર્મમાં સાનધાન  
મનવાળી બાળાને પોતાના વિવાહની વાતે ગમતી નહિ.

રાણી સુવપ્રા પોતાની ઇન્યા પુરંદરયશાને પુરુષના  
સમાગમથી રહિત, ને વૈરાગ્ય તરફ વળેલી, સખીઓના  
સુખથી સાંસારણીને ચિંતાદુર થઈ, તેણું રાજાને કહું.

“હે સ્વામિન ! આપ સજકાજના વ્યવસાયમાં  
કુદ્દાં વ્યવસાય તદ્દન ભૂલી ગયા છો. જરા આપ આપની  
કન્યા તરફ ઘ્યાલ તો કરો. ”

“હા ! એના સગપણ માટે વિચાર કરવાનો છે શું !  
પણ પહેલાં એનો શું વિચાર છે તે તો જાણી લો. ”  
રાજાએ કહું.

“એનો વિચાર ? એનો વિચાર તો ચિંતા કરાવે તેવો  
છે. મહારાજ !”

“હું !” રાજ વિચારમાં પડ્યો. “જરા સ્પષ્ટતાથી  
કહો. શી હકીકત છે ?”

“અરે હેવ ! શું વાત કહું ? અને તો વિવાહની વાતે યાભતી નથી, તો પછી લગ્ન તો એ કરેજ શાની!” રાણીને ધડકો સાંભળી રાજ ચિંતાતુર થયો.

“અનો સ્વયંબર કરીયે, અનેક રાજકુમારો સ્વયં-  
બરમાં આવશે, મુશ્રીને કોઈક તો પસંદ પડશેજ.”

“લગ્ન તરફ એની અલિઝચિ જગત ન થાય તો પછી  
સ્વયંબર પણ શા કામગો ?”

“ઢીક છે તો મને વિચાર કરવા ધો.” રાજએ વાતને  
કંકી કરી.

ઓને દિવસે રાજસભામાં રાજએ ભંગ્રીઓની સંમુખ  
એ વિચાર રજુ કર્યો. “હે ભંગ્રીન ! તારુષ્ય અવસ્થા  
પ્રાપ્ત થયા છતાં રાજકુન્યા વિવાહને છંઘતી નથી તો એ  
માટે શું ઉપાય કરવો ?”

“હે સ્વામિન ! યૌવન વયમાં તો અનંગના રંગો  
અનેક પ્રકારે જેવાય છે યૌવનમાં આવેલા દરેક પ્રાણીને  
અનંગ હેવ અનેક રંગોથી રંગ્યા વગર રહેતો નથી નિઃ-  
સત્ય અને પાચી જીવો ઉપર એની જાહેર અસર મુખજ  
જોરદાર હોય છે કિનુ મહાત્માજનોને તે બિચારો રંક શું  
કરી શકે !” ભંગ્રી ભતિસાગરે વિચાર કરીને કહું.

“તો શું રાજમુશ્રી લગ્ન નહિ કરે ત્યારે ? લગ્ન નહિ  
કરે તો શું દીક્ષા લેશો ?”

“હેવ ! એક રસ્તો છે. એ નિર્વિકારી બાળાને પણ  
કદાચ એનો પરભવનો પતિ મલે ન એની સાથે એ લગ્નથી  
નોદાયે અરી.”

“પણ એના પતિને આપણે શરીરીને આળખી શકીયે ?”

“આપણે આળખાની જરૂર નથી.”

“ત્યારે ?”

“એ પ્રેતેજ એળાખી લેશે.”

“શી રીતે?”

“દેરેક રાજકુમારોનાં ચિત્ર લાવીને બતાવો, એની અંદર જો કોઈ એનો પરભવનો પતિ હોશે તો તેની ઉપર એ દષ્ટિ કરશે.”

રતનચૂડ રાજાએ અનેક ચિત્રકારોને જુદાજુદા દેશમાં રવાને કર્યા, પ્રતિ દિવસ અનેક રાજકુમારોની પ્રતિકૃતિ (છથી) રાજની પાસે આવવા લાગી. એ દેરેક ચિત્રો રાજભાગાને બતાવવા છતાં રાજભાગાએ કોઈનાય તરફ ધ્યાન આપ્યું નહિ. એક દિવસે રાજની પાસે એક મનો-હુર ચિત્રપદ આવ્યું જેને જોઇને રાજ સહિત બંધ દંગ થઈ ગયા. એ ચિત્ર રાજભાગાને બતાવ્યું. એ ચિત્રને જોતાં રાજભાગાની દષ્ટિ ઠરી. અનિમેષ નથને તેની તરફ જોઇ રહી. એનાં રોમરાય વિકસવર થયાં. “આહા ! કેવું મનોહર હૈ ? સખી ! આ કોણ ઉત્તમ નર હોશે, જેને જોઇને હું ઝુશ થાઉં છું.”

રાજભાગાની હંચા સખીએ રાજની આગળ પ્રદશિત કરી. રાજકુમારીની અભિલાષા જાણી રાજાએ એ ચિત્રપદ લાવનારને પૂછ્યું. “ચિત્રકાર ! કહે, આ ચિત્રપદ ક્યા રાજકુમારનું છે ? એના આચાર વિચાર અને સ્વભાવનું વર્ણિન કરો.”

રાજના પૂછવાથી તે ચિત્રકારો પોદ્યા. “હેવ ! શ્રીમં-હરપુરનગરના નરશેખર રાજનો આ રાજકુમાર, નિવિકુંદલ એનું નામ. યૌવન વય, ધન, વૈલબ, ઠકુરાધ, ઔદ્ધર્ય, પરાક્રમ, ઝુદ્ધ અને અનેક કળાઓનો ભંડાર, તેમજ ધીર, વીર, ગંભિરતાદિક અનેક ગુણે કરીને વિલૂષ્ણિત, સદાચારચાન હોવા. છતાંય એનામાં એકજ માત્ર હોષ છે કે કે સ્વયંવરા આવેલી કન્યાઓની સામે નજર પણ કરતો નથી.”

એ ચિત્રકારની વાણી સાંસળી રાજએ મંત્રી સામે જોયું. મંત્રીના કહેવાથી રાજએ પુરંદરયશાસું યથાર્થ સ્વદ્ધ્ય ચિત્રપટ ઉપર આસેખાવી ઓલવામાં બતુર એવા નિપુણ પુરુષો સાથે એ ચિત્રપટ શ્રીમંદરપુરનગર તરફ નરશોભર રાજ પાસે મોકલ્યું.

સંધ્યા સમયે એ પુરુષો શ્રીમંદરપુર આવી પહોંચ્યા ને નરશોભર રાજને મલ્યા. એ ચિત્રને જોઈ રાજ ખુશી થયા, ને એ પુરુષોને ઉતારા માટે વ્યવસ્થા કરાવી આરામ માટે તેમને રજ આપી. રાજ નરશોભર પણ રાજકુમારની વિરક્ત આવનાથી ચિંતાતુર રહેતો હતો. સ્વચંચરા આવેલી કન્યાઓ સાથે પાળિઅહુણ કરવા માટે રાજએ કુમારને ઘણ્ણો સમજાવ્યો. પણ વેરાયવાન એ કુમારે એ રાજકન્યાઓ તરફ દશ્ટિ માત્ર કરીને જોઈયે નહિ. ત્યારે આ પુરંદરયશાસું ચિત્રપટ જોઈને રાજકુમારનું મન આકર્ષાસે શું?

## ૩

## પુરંદરયશા.

“વાહ ! તેવું અદ્ભૂત સૌંદર્ય ! આવું જગત મોહનીયત્વ તો મેં આજેજ જોયું ? આ તે ગાંધર્વ કન્યા કે નાગકન્યા, વિદ્યાધરભાગા કે દેવભાગા ! શું મનુષ્યમાં તે આવું સૌંદર્ય સાંસળી શકે ?” દેવતાએને કીડા કરવાને જાહેનવન સમાન રમણીય ઉધાનમાં ફરતા એક નવજ્વાનની નજર સુવર્ણનાં સોપાનવાળી રમણીય વાદૂડીના કંડે જીશેલી ભાગા ઉપર પડી. એ દશ્ટિ ત્યાંજ સિથર થધ ગઢું શીઝમ ફુના તાપથી લેશ પામેલો માત્રની વૃક્ષની છાચાને જોઈ લલગાય તેમ ચા નવજ્વાનની નજર પડતાં ખૂબે વ જોગેલી વસ્તુમાં એનું ચિત્ત લુણ્ણ થઈ ગયું. ગુલક ત્યાં-

જ સ્થાંલી ગયો. કેમ લોહચુંખક લોલાને આકર્ષે તેની આકૃક રૂપનાં જાહેરી આકર્ષાઈ મંહમંદ ડગલાં ભરતો તે એ લાગાની નજીક આવ્યો. આળા એ મનમોહક નવજવાનને બેધ શરમાઈ ગઈ. “કોણ છે એ?”

“આળા ! શરમાઈશ નહિ એ તો હું.” નવજવાન કંઠમાં માધુર્યતાને ધારણ કરતો મૃદુ ભાષાએ બોલ્યો.

એ પ્રલાવશાળી નરરતનના મનોહર વફનને બેધ લંજાતુર થયેલી આળા કંઈ પણ બોલી શકી નહિં પ્રેમથી નિતરતાં એનાં વિશાળ વચ્છુએ શરમથી નીચે નમી જતાં હતાં. લંજાનાં આવરણ એના મનોહર મુખને બોલતાં અટકાવતાં હતાં. હૈથું બોલવાની આતુરતા ધરાવતું, એ પુરુષના પ્રેમની ઝંખના કરતી આળા બોલે પણ શું?

“આળા ! તું આ વાવડીમાંથી-પાતાલમાંથી વિહાર કરવા આવેલી નાગકન્યા છે કે સ્વર્ગમાંથી આવેલી દેવકન્યા છે? બોલ તો ખરી?”

જવાબમાં એ આળા કંઈ પણ બોલી શકી નહિં, એ નવજવાન અધીરો થધ ગયો જણે પોતાની માલિકીની ચીજ હોય તેમ એની પાસે આવી એનો ડેળના ગર્ભથીએ સુકોમલ મનોહર હાથ પકડ્યો “કેમ કંઈ મુંગાવ્રત લીધું છે?”

નિશાનો ચતુર્થ પ્રહુર પૂર્ણ થવાની તૈયારીમાં હતો પ્રાતઃકાળના મંગલમય વાહિનોના મધુર શબ્દોથી નિદ્રિત નરનારી જાગ્રત થતાં હતાં, રાજકોરે બંદિજનો પ્રાતઃકાળનાં અધૂરાં સ્તોત્રો ભાણી રહ્યા હતાં, એ મધુરા સ્તોત્રોના શબ્દો-એ સ્વર્મ સૂચિમાં પ્રેમ વિહાર કરતા આ નવજવાનને જાગ્રત કર્યો. એ નવજવાન તે શ્રીમંદ્રપુરના રાજ નરશે-અરનો કુમાર નિધિકુંડલ.

એબાકળો ને ગલરાખથી આકૃગંધ્યાકૃળ થયેલો

નિધિકુંડલ ચારે તરફ નજર કરવા લાગ્યો એ રમણીશ  
નંદનવન ક્યાં? એ મનોહર વાવડી ક્યાં? એ અદ્ભુત  
લાખષ્ણ્ણવાળી પાતાલ કંન્યા ક્યાં?

ગાંડાની માઝે રાજમહેલમાં ચારેકાર જોવા લાગ્યો,  
દોડાદોડ કરવા લાગ્યો પણ એ સ્વમસુંદરી તો હાથમાં  
આવેલી નરી સરી ગાધ કે શું?

એ સ્વમ સુંદરીના અદરથ્ય થવાથી વ્યાકુળ થયેલા  
સ્નેહકુમારે પાતળી નેતરની સોટીથી એ બંધીજનોને છુડવા  
માંડ્યા “હુણો! આરી પ્રિયા ક્યાં ગાધ?”

વ્યાકુળ રાજકુમારને કંઈ મણ ચેન પણ નહિ.  
“અરે! એ ખાળા કોણું હશે? મેં નામે પૂછ્યું નહિ. એ  
કંઈ બોલીય નહિ. હાય વિધિ! વિધિ!” કુમાર નિધિ-  
કુંડલ બિતાતુર થધ ગયો પોતાના આવાસમાં સુઠીયો  
વાળી જુસ્સામાં ને જુસ્સામાં આમતેમ આંદો મારતો કે  
કંઈક વિચારતો.

રાજકુમારના મિત્રો આવી પહોંચ્યા. રાજકુમારને  
પ્રેસલ કરવાને એમણે અનેક પ્રયત્ન કર્યા. છતાં રૈજની  
માઝે હાજર ન તો હસે કે ન તો સીધો જવાબ આપો.

“મિત્રો! રાજકુમારનું કંઈક ગુમ થયું છે. તપાસ  
કરો,” એક ચતુર મિત્ર રાજકુમારનું મન પર્તીનિ બોલ્યો.

“અરાખર છે! તારું ચતુરનામ વ્યાજણી છે. શોધી  
આપ મારું કે ગુમ થયું છે તે,” રાજકુમાર બોલ્યો.

“કુણી જગોએ ગુમ થયું છે? શું ગુમ થયું છે. આપ  
અહો એટલે અમે ત્યાં તપાસ કરીએ.” એ મિત્ર વિશેષ  
બાણ્ણવાના આશયથી કુમારને પૂછ્યું.

“મિત્રો! સ્વમસુંદરી. આહા! જણે કે તૈયેઓ  
સુંદરી શું એનું સ્વરૂપ! એ મનમોહક અદ્ભુત લાખણ્ણ  
બનું ત્યાં!

“રાજકુમાર ! એતું નામ, ડામ, ડેકાણ તો કહો.”

“એ તો હુંય નથી જાણતો, આજ સુધી મેં એને કૃયાંય જોઈ નથી. એના જેવું લાવણ્ય પણ જેવું નથી.”  
નિરાશ થતો ખિત્રવદને રાજકુમાર બોલ્યો.

કુમારની હડીકિતથી ભિત્રો પણ ચિંતાતુર થયા, અવાય વિચારમાં પડ્યા કે હવે કરવું શું. એ સ્વમસુંદરીને શાખવિય શી રીતે.

એ ચિંતાતુર રાજકુમાર એને તેના ભિત્રો સમક્ષ એક રાજસેવક આવીને ઉલ્લો રહ્યો. “રાજકુમાર ! રલચૂડ રાજના સેવકો આપનાં દર્શિન કરવાની રજ માગે છે, રાજએ એમને આપની પાસે મોકલ્યા છે. આપને કંઈક અદ્ભૂત ઘટાવવા માગે છે.” રાજસેવકની વાણી સંભળી કુમારે અહુમતિ આપી.

રલચૂડ રાજના સેવકોએ રાજકુમારની પાસે આવી નમસ્કાર કરી પેણું અદ્ભૂત લાવણ્ય થુક્તા ચિત્રપટ રાજકુમારના હાથમાં સુકથું. એ ચિત્રને જોતાંજ વિહુવળતા થુક્તા નેત્રવાળો કુમાર બોલ્યો. “એજ ! એજ ! સ્વમસુંદરી, ભિત્રો !”

“કુમાર ! આ તો કોઈ દેવીનું ચિત્ર જણાય છે. સ્વન મ્રમાં આપણે કોઈ દેવીનાં દર્શિન થયાં લાગે છે કે શું ?”  
ચિત્રપટને જોતાં ભિત્રોએ અલિપ્રાય આપ્યો.

“આ કોણ દેવીનું ચિત્ર છે ?” રાજકુમારે ભિત્રોની સંભતિથી આગંતુક રાજસેવકોને પૂછ્યું. એના ભિત્રોએ પણ દેવીની વાત જાણવાને કાન સરવા કર્યા.

“સ્વામિન ! આ કાંઈ દેવીનું ચિત્ર નથી. પણ દેવીના ચૌંદર્યનું હરણ કરીને વિધાતાએ એક મનુષ્યકન્યા નિર્માણ કરી છે તેનું આ ચિત્ર છે.”

“મનુષ્ય કન્યા ?” રાજકુમાર તાજુષ થયો. “કોણી આ કન્યા ?”

“વિન્યાવતી નરેશ રત્નચૂડ નરપતિની આ કુંવરી, એનું નામ પુરંદરયશા !” રત્નચૂડના રાજસેવકોમાંથી એક ચતુર પુરુષ વિચાર કરીને બોલ્યો.

રાજસેવકોના વચનથી સંતોષ પામી હૃષીત રાજકુમારે એક લાખ દીનાર (રોકડનાણું) આપીને એમને વિદ્ધાય કર્યા.

રાજકુમાર નિધિકુંડલ એકાયતાથી એ ચિત્રપદ્ધની ભાગા પુરંદરયશાને જોતો બોલ્યો, “મિત્રો ! સ્વમ્ભામાંથી સરી ગયેલી ભારી સ્વમ્ભસુંદરી આ.” રાજકુમારે પોતાની સ્વમ્ભની હકીકત કહી સંભળાવી.

રાજકુમારની હકીકત સંભળણી મિત્રો વિચારમાં પડ્યા. “રાજકુમારને આ ભાગાનાં સ્વમ્ભામાં દર્શન થાય છે. એજ ભાગા ચિત્રપદ્ધમાં આલેખાઈ છતી રાજકુમાર પાસે આવે છે નક્કી એમાં ફૈવનો કંઈક સંકેત છે. રાજકુમાર ! એમને તો લાગે છે કે નક્કી કોઈ હેવીએ તમને સ્વમ્ભામાં એ ભાગાનાં દર્શન કરાવી મુલાકાત કરાવી છે તમારા લાગ્યમાં એ ભાગા ચોક્કસપણે લખાઈ છે.”

“મિત્રોની હકીકત સંભળણી નિધિકુંડલ હસીને બોલ્યો. “મને પણ આ ભાગા છાણ છે.”

એ વૈરાગ્યવાન કુમારનું મન આ ભાગામાં રક્ત થયેલું જાણી ઝુશી થયેલા રાજાએ મંત્રીએ સાથે મંત્રણ કરી, એક મંત્રીને પરિવાર સહીત વિન્યાવતીનગરીએ મોકદ્યો. તે મંત્રી વિન્યાવતીમાં આવી રાજને મલી પુરંદરયશા સાથે નિધિકુંડલનું લભ નક્કી કરી મૂહૂર્ત જેવરાંધું: લભ સુમય નક્કી કરી મંત્રીએ તાંથી શ્રીમંદરપુર આવી પોતાના

રાજને સર્વે હડીકત કહી સાંભળાવી રાજએ કુમારના પ્રયાણ માટે મુહૂર્ત જોવરાયું.

એક સારા મુહૂર્તે રાજએ નિધિકુંડલ કુમારને હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે સુલદો તેમજ ઉત્તમ કળાકૃતિઓ અંત્રીઓ સાથે વિજ્ઞાવતીના માર્ગ રવાને કર્યો. અંદિત પ્રયાણ કરતાં નિધિકુંડલ કુમાર મહા અરણ્યમાં આવ્યો કે સમયે હૈવયોગે કુમારનો અચ્છ સમૃદ્ધાયથી વિઝુયો પડી અન્યત્ર ચાલ્યો ગયો. અચ્છથી હરાયેલ કુમાર એકાકીપણે વનમાં ભટકતો નિશા સમયે જગતપણે વનમાં સમય વ્યતીત કરવા લાગ્યો.

એ લયંકર અરણ્યમાં ભધ્યરાત્રીને સમયે જગત રહેલા તે નિધિકુંડલ કુમારે ઇદન કરતી કોઈક સ્ત્રીનો શાખા સાંભળ્યો. “આ લયંકર જગંગલમાં સ્ત્રીનું ઇદન ! નક્કી એ તો કોઈ ખાપી રાક્ષસનું કારસ્તાન, જોવા તો હે.” દુઃખી સ્ત્રીના ઇદનથી દુઃખી થયેલો કુમાર શાખને અનુસારે એ ઇદન કરતી સ્ત્રીની નાલક આવી પહોંચ્યો. દશ માર્ગમાં રહેતે વી રીતે ગુસ્પણે કુમાર એની ચિકિત્સા જોવા લાગ્યો, સાંભળવા લાગ્યો.

અમ્રિની જ્વાળાએ વનને પ્રકાશિત કરી રહી હતી, એવા અમ્રિકુંડની સમીપે સ્નાન કરાવેલી, રક્તચંહનાં લેપવાળી, રાતાકણેરની માળાને ગળામાં ધારણ કરેલી, સુંદર સ્વરૂપવાન કુમારીકાને કાપાલિકે મંડલમાં ઉલ્લી રાખેલી હતી. યોગી હૃથમાં મસ્તકને છેદન કરવાવાળી કર્તિકાને લધને તેની પાસે ઉલ્લો છતો, હેવીની સુતિ કરતો હતો. “હે લગવતિ ! હે ત્રિશુલ ધારીણી ! હે હેવી ! આ આગારપ બલિને અહૃણુ કરો.”

યોગીએ ખાળા તરફ કરીને છલ્લાં છલ્લાં કહ્યું. “હે

કલ્યાણી ! તું હવે તારા છષ્ટ હેવનું સમરણ કર. તારે કોઈનું શરણ સંભારવું હોય તો યાદ કર. તારા જીવિતનો અંત. હવે હાથ વેંતમાંજ છે બાળા !”

“અરે યોગી ! મારી આવી દુરાવસ્થામાં હું કેને સંભાળું ? શરણ કરવાને ચોથ્ય તારા જેવા યોગી પણ લક્ષક થાય છે છતાંય સર્વ જગતના જીવાને હિતકારી લગ્નવાન વીતરાગનું મારે શરણ હો. ને બીજું વડીલ-જનોએ આપેલા ને મેં મનથી વરેલા નરશોભર રાજના પુત્ર નિધિકુંડલ કુમારનું મારે શરણ હો.”

પ્રચછતપણે રહેલા નિધિકુંડલ કુમારે પોતાનું નામ સાંખજયું. “એમાહે ! આ બાળા મારું નામ શી રીતે જાણું ! આ બાળાને આ નરરાક્ષસના પંજમાંથી હવે તો મારે બચાવવી જોઈએ.” રાજકુમાર બાળાને બચાવવા માટે તૈયાર થઈ ગયો.

યોગીએ હેવીના અલિદાન માટે પોતાની કર્તીકવાળે હાથ ઉંચ્યો કર્યો.

“બાળા ! હેંરીયાર !”

“અભરદાર !” મંદમંદ ડગલાં ભરતાં યોગીના પાછળ આવેલા કુમારે એક ઝુણ મારી કર્તીકવાળો યોગીને હાથ પડી લીધો. યોગી આ આકસ્મિક ઘનાવથી ચમકી ગયો. “અરે આવા લયંકર અરણ્યમાં આ પુરુષ ક્યાંથી ?”

“હુણ ! પાણિ ! આ બાળાને હણીને શું તું તારો પોતાનો નાશ ચાહે છે ?” કુમારે નાડ પાડી. અમિની જ્વાળાઓના તેજમાં એનો પ્રભાવશાળી ચહેરો જોઈ યોગી સ્થંભી ગયો. એનાં પરાહેલ, સાહુસ અને સમય-સુચકતા જોઈ યોગી દંગ થઈ ગયો.

“અરે ઉત્તમ ! તું મારા કાર્યમાં વિધી ના કર. મૂર્વે

મેં લક્ષ્ણિથી જવાલિની હેવીની આરાધના કરી હતી. આ અત્રીસ લક્ષ્ણવાળી બાળાના લોગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારું પણ કામ થશે.” કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યો.

“અરે મૂઠ ! પાપી ! યોગીનો વેપ ધારણ કરવા છતાંય ચંડાલથી પણ અધિક કુર્મને તો છાહતો નથી, આવા પાપ કરતાં તું લજ્જા કેમ પામતો નથી ! આવા તુચ્છ કાર્યથી તારા પ્રતનો તું નાશ ના કર. જીવનો ઘાત કરવો એ મહા પાપ છે એવું શું તું નથી જાણતો ? આવા પાપ કુર્મથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે ?” કુમારે જીવદ્યાને ઉપદેશ આપી કાપાલિકને પ્રતિયોગ પમાદયો.

લય અને પ્રીતિને ધારણ કરતો કાપાલિક બોલ્યો. “હે સાહસિક ! હે નરોત્તમ ! તેં મને નરકમાં પડતો અચ્યાંયો, ગુરુ પાસે જઈને આ પાપનું હવે હું પ્રાયશ્ક્રિત કરીશ. વિજયાવતીના સ્વામીની આ કન્યા મેં હરી છે આ કન્યા તમે તેના પિતાને આપને.” કુમારને કન્યા અર્પણ કરીને યોગી બાલ્યો ગયો.

## ૪

### નિધિકુંડલ.

“આ કન્યા કોણું હુશે ? મારું નામ તે શી રીતે જાણું શકે ? શું આ કન્યા પોતેજ પુરું દરથશા હુશે ત્યારે !” કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડ્યો પોતાનો સંશય દૂર કરવાને તેણે બાળાને પૂછ્યું. “બાળા ! તારું નામ શું ? તેં નિધિકુંડલનું નામ યાદ કર્યું તો તું તેને કયાંથી જાણે ? શું તું તેને ઓળાએ છે કે ?”

કુમારનો પ્રક્રિયા સાંભળી બાળા વિચારમાં પડી. “આ

પુરુષની વાણી સાંભળીને મને મહાન આનંદ થાય છે. એને જોવા માત્રથી પણ મારા શરીરનાં રોમરાય વિકસનર થાય છે કંઈકંઈ સાવના હૈયામાં હાલી ઉઠે છે માટે જરૂર આજ મારા પતિ હોય, નહિતર બીજા પુરુષમાં મારુ મન કહાપિ રમે નહિ.”

“હે સુજા ! મારો ધતિહાસ નગરીમાં ગયા પછી તમને કહીશ.” મનમાં કંઈક વિચાર કરી આપા પુરંદરથાયશા પોલી. “પણ આપ આ લયંકર અરણુંમાં શીરીતે આવી ચઢા તે વાત કહો ? આપના શરીરે કુશલતા છે ન ?”

“હે સુલોચના ! તારા સુખરૂપી ચંદ્રનું દર્શન કરીને મારો આનંદ રૂપ સભુદ આજે વૃદ્ધિ પામ્યો. મને લાગે છે કે તારા પુષ્યથી પ્રેરાયેલો હું મારા પરિવારથી વિભુટા પડીને અકુસમાત અહીં આવી ચઢ્યો છું.” કુમારે પોતાની ઘધી હકીકત કહી સાંભળાવી. એ રીતે વાતચિતમાં તેમની નિશા ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગઈ.

પ્રાતઃકાળ થતાં તો પગલાને અનુસારે સૈન્ય આવી પહોંચ્યું ને કુમારનો જયજયકાર કર્યો. કુમાર અને કુમારિકાને જોઇ થધા ખુશી થયા. આગળ ચાલતાં સુખપૂર્વક અનુકૂમે તેઓ વિજયાવતી નગરીએ આવી પહોંચ્યા. રત્નચૂડ રાજાએ રાજકુમાર તથા તેના પરિવારનું સન્માન કર્યું. પુરંદરયશાની હકીકત જાણી રાજ પોતાના ભાવી જમાતા ઉપર અધિક પ્રસન્ન થયો. શુલ સુહૂતે મોટી ધામદુમપૂર્વક ઘનેનાં લગ્ન થઈ ગયાં.

કેટલાક હિવસ પછી રત્નચૂડ રાજની રજ લાધ નિધિ-કુંડલ પોતાની પ્રિયા અને પરિવાર સાથે પોતાના નગરે આવ્યો. પિતાએ કુમારનો પ્રવેશ મહોત્સવ કર્યો. નિધિ-

કુંડલ પિતાની છાયામાં દેવતાની માર્ક સુખ ભોગવતો  
પોતાનો કાલ વ્યતીત કરતો:હતો, સુખમાં મહુષ્યો દેવતાની  
માર્ક જતા કાલને પણ જાણતા નથી.

એકદ્વા નરશોભર રાજ શત્રુની સામે ચુંદે ચહેરા, ત્યાં  
શત્રુ સાથે ચુંદ્ધ કરતાં રાજને કારમેં ધા લાગ્યો, એ ઘાની  
પીડાથી રાજ નરશોભર આચુષ્ય પૂર્ણ કરીને પરલોક  
સિધાવી ગયા. પિતાના મરણથી રાજકુમાર હુંથી હુંથી  
જઈ ગયો. રાજ્ય અને લોગથી વિરક્ત થઈ ગયો. “અરે  
અરે ! લક્ષ્મી, જીવિત, યૌવન, પરિવાર બધુ અનિત્ય છે.  
જે કાલે હોય છે તે આજે નથી હોઠું, જે આજે છે તે  
કાલે નથી હોઠું. લોગો એ તો રોગોને કરનારો છે. સંયોગ  
છ ત્યાં એક હિવસે વિયોગ આવવાનો છે. સંસારની એવી  
ક્ષણુભંગુર બાબતોમાં ગ્રાણીને સુખ તે ક્યાંથી હોય ?  
હે જીવ ! સંસારના એવા કયા સુખમાં તું રાચી માચીને  
આનંદ માની રહ્યો છે કે પોતાને અમર માનીને સંસારના  
મોહમાં લપદાધ રહ્યો છે ? પણ અરે મૂઢ ! તું એટલુંચ નથી  
જાણતો કે—જન્મ, જરા અને મૃત્યુ, રોગ, શોક અને  
સંતાપ પ્રતિહિવસ તારો નાશ કરી રહ્યા છે. માતાપિતાને  
વિષે જે સ્નેહ છે તે પણ હુંખદાયી છે. આ તો બધું  
પંખીના મેળા જેવું છે રાત્રીએ એકત્ર થયેલાં પંખીઓ  
પ્રાતઃકાળે વૃક્ષ ઉપરથી જેમ લિન લિન ભાર્ગ ઉરી જાય  
છ તેમજ માતાપિતાદિક પરિવાર પણ મૃત્યુ પણી કંચીકણી  
શતિમાં ચાલ્યો જાય છે તે આપણે શી રીતે જાણીએ ?

અરે આ હુંખમય સંસારમાં માતા અરીને પ્રિયા  
થાય છે ને પ્રિયા તે બીજા જન્મમાં માતા થાય છે. પુત્ર  
તે પિતા થાય છે ને પિતા પુત્રપણાને પામે છે. શત્રુ હોય  
છે તે ભાઈ થાય છે. ત્યારે ભાઈ કૃચિત શત્રુપણે ઉત્પન્ત

શાય છે, એવા સ્વરૂપવાળા આ ભયંકર સંસારમાં રહેલા ખામર પ્રાણીઓની મોહદ્દા તો જુઓ !”

આ હુનિયામાં કુદુંઘ સ્નેહ તો સ્વરેના સરખે અથવા ઈંડ્રિયાના જેવો છે. કારણું કે પરમ વજ્ઞાલ અને કેના વગર એક ક્ષણું ભર પણ રહી શકતું નથી એવા પરમ પ્રાણાધિકને પણ મૃત્યુ જોતાં જોતાં હરી જાય છે. કાયમના વિજેતા થઈ જાય છે. એ હુંખની વાત શું કરીયે ?”

પિતાના મૃત્યુથી શોકઅસ્તત નિધિકુંડલ કુમારનો કેટાં કાલ વ્યતીત થયો પિતાનું સાંપ્રાણ્ય લોગવવા છતાંય કેને રાજ્ય કે લોગનો આનંદ નથી. સંસારનું એ અનિત્ય સ્વરૂપ કેના હૈયામાંથી અસી શકતું નથી. એવા પ્રાણીને સંસારમાં લોગની મધ્યમાં રહેવા છતાંય ક્યાંથી સુખ હોય ?

અન્યદી જગતજીવના પરમ કલ્યાણને કરેતા, અભયદાનને દેવામાં પ્રવીષુ શ્રીમત અનંતવીર્ય તીર્થેકર લગવાન ત્યાં સમવસર્યા, દેવતાઓએ સમવસરણની રચના કરી. એ સમવસરણમાં રહેલ બારે પર્દાની આગળ લગવાન દેશના દેવા લાગ્યા. પોતાની દેશનાથી અનેક ભવ્યજ્ઞનોને પ્રતિષેષ કરવા લાગ્યા.

એ વધામણિ વનપાલકે આવીને રાજ નિધિકુંડલને આપી. “હે મહારાજ ! તમારા પુણ્ય પ્રભાવથી પ્રેરાઇને ભગવાન અનંતવીર્ય તીર્થેકર પદ્ધાર્યા છે—સમવસર્યા છે.” વનપાલકની વધામણિ સાંભળી રાજએ ખુશી થઈને પારિતોપિક (ઈનામ) આપીને તેનું દારિદ્ર હૂર કર્યું. શાકેને હૂર કરી અંતઃપુર સહિત તેમજ મંત્રી, સામંત અને સેનાપતિ આહિ ચતુરંગ સેના સાથે લગવાતને વાંહવાતને રાજ મોદા આડંખરપૂર્વક ચાલ્યો.

સમવસરણ જોઈને રાજ ચિન્હનો ત્યાગ કરી ત્રણ

પ્રદક્ષિણાપૂર્વક જીનેશ્વરને નમીને પોતે પોતાને યોગ્યસ્થાનકે બેઠો. બીજે પરિવાર પણ પોતપોતાને યોગ્ય સ્થાનકે બેઠો. અગવાને રાજના ઉપકારને માટે દેશના દેવી શરૂ કરી.

“આ પારાવાર રહિત સંસારમાં પ્રાણીઓ ચારાસી લાખ જીવયોનિમાં પરિબ્રાન્ણ કરે છે. એમને મનુષ્ય-ભવ પ્રાપ્ત થવો બધુ જ હુર્લાલ છે એ મનુષ્યભવ દરે દાખાંતે પણ હુર્લાલ કર્યો છે. એવો હુર્લાલ મનુષ્યભવ પામીને પણ જો માણુસ સંસારમાં રાચી માયીને હારી જાય, ધર્મકર્મ વગર એ લાખેણું મનુષ્યજીવન નકારું જાય તો પણી એ દોદાલો નરભવ ઝીરીને શી રીતે પ્રાપ્ત થાય?

મનુષ્યભવમાં મનુષ્યપણુંએ સર્વે સમાન હોવા છતાં ઉચ્ચ, નીચ, ગરીબ તવંગર, અમીર ઇકીર, રંક અને રાજ એ બધો તરફાવત પોતપોતાના કર્મને લખને સંસારમાં જોવાય છે. કેટલાક ધર્મજીનો આત્મહિતમાં ભર્ત હોય છે ત્યારે કેટલાક પાપકાર્યમાં રવ્યાપવ્યા આનંદ માની રહ્યા છે. મનુષ્યભવમાં પણ આર્થિક્ષેત્રમાં ઉત્પન્ન થનારને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવાનો સંભવ રહે છે, અનાર્થને નહિ. ઉત્તમ જાતિ, ઉત્તમ દેશ, દીર્ଘયુષ્ય, નિરોગીપણ, બેષ્ટ બુદ્ધિ અને પુણ્યાતુથી ધી પુણ્યથી મળેલી સંપત્તિ એ બધીય એક એકથી હુર્લાલ વસ્તુઓ મોદા પુણ્યાતુયોગથી જ મલી શકે છે, એ સામગ્રીને મેળવી જેઓ એનો સહ ઉપયોગ કરી આત્મહિત સાધે છે. તેઓ જ ભવસાગર તરી જાય છે. આ હુંઘથી ભરેલા નરભવને પામીને મનુષ્ય સહઉપયોગ કરે તો જ બાળ જીતી જાય છે નહિતર મનુષ્ય-પણ પામ્યાની સાર્થકતા પણ શી?

નારકીમાં નરકના જીવો સહાકાલ હુંઘમાં પોતાનો કાલ વ્યતીત કરે છે તિર્યંચાને પણ ભૂખ, તરસ, પરવરશતા,

તાપ, ધાદ વગેરેનું અપાર હુંઘ હોય છે ને મતુષ્ય કેવા મતુષ્યમાં પણ હુંઘ કર્યાં આણું છે? પ્રથમ તો ગર્ભવાસનાં હુંઘ કાંઈ કર્યાં તેવાં નથી. તે પછી અચ્ચપણનું મલીન-પણું હુળ વિષાદિકથી લેપાણું વગેરે, ચુવાવસ્થામાં વિરહાદિકનું હુંઘ, રેણ, શોક, સંતાપ તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિની અનેક પીડાએ પ્રાણીને ગળે વળગેલી હોય છે. અને વૃદ્ધાવસ્થા તો હેઠીતી રીતે નરી પીડા ઇપ જ છે એવા મતુષ્ય ભવમાં પણ પ્રાણીને ક્યાંથી સુખ હોય?"

ભગવાનની દેશના સાંલણી રાજ નિધિકુંડલ જીને શ્વરને નમીને પોતાની નગરીમાં ગયો. સારા સુહૃત્તે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી સાતે ક્ષેત્રમાં ધનને વાપણું, પત્ની સહિત રાજએ કર્મનો નાશ કરેનારી ભગવાન સમીપે દીક્ષા અહુણું કરી. દીક્ષાને સારી રીતે આરાધીને આયુઃક્ષયે અન્ને જણું પ્રથમ સુર્વર્મ દેવલોકમાં સુરમિશુનપણે ઉત્પન્ન થયાં-દેવહેવીપણે ઉત્પન્ન થઇને દેવભવનાં વિવિધ પ્રકારનાં સુખો લોગવવા લાયાં. કષ્ટથી આરાવત કરેલા સંયમતું સત્યક્રિલ તો મોક્ષપ્રાપ્તિ છે, મોક્ષે જવા માટે દેવભવ તો વિસામાઇપ છે.

#### ૫ લલિતાંગ.

મહા કર્ણ વિજયને વિષે વિજય નામના નગરમાં મહાસેન રાજની ચંદ્ર નામે પદરાણી હતી. વિવિધ ઉપાયાથી પુત્રની અભિલાષાવાળાં તેમને ત્યાં પાંચ પદ્ધોપમનું આયુ પૂર્ણ કરીને નિધિકુંડલનો પુણ્યવાત જીવ પુત્ર પણે ઉત્પત્ત થયો. પુત્ર જન્મથી હર્ષિત થયેલા રાજ મહાસેને

મેદો જન્મમહોત્સવ કરી રાજકુમારનું લલિતાંગ નામ  
પાડ્યું. યોગ્ય વચ્ચે કલાને શિખતો રાજકુમાર રમણીજનને  
વહ્નિલ નંદનવન સમાન યૌવનવયના આંગણે આવ્યો.  
મિત્રાની મધ્યમાં શોભતો લલિતાંગ નવીન યૌવનવાળો  
છતાં વિકાર રહિત હતો, એથર્ય સંપત્ત છતાં અહુંકાર  
વગરનો ને અળવાન છતાં ધીજને પરમ આનંદનું કારણ  
હતો. લલિતાંગ નામ પ્રમાણેના ગુણોવાળો ખરેખર મનો-  
હૃર અંગોપાંગવાળો ભાગ્યવાન હતો.

તે જ વિષયને વિષે પરમ લૂધણ નગરના રાજ પુણ્ય-  
કેઠુની રલમાળા નામે હેવી થડી પુરંદરેયશાનો જીવ  
પુત્રી પણે ઉત્પત્ત થઈ. એનું નામ ઉન્માદ્યાંતી. ઉન્માદ્યાંતી  
અતુક્ષે ભાણી ગણી યૌવન વયને પામી, ચુવાન છતાં વિષ-  
યથી પરાજસુખ તે બાળાને વિષયના કોઈ પણ સાધન તરફ  
પ્રીતિ થતી નહિ.

કુમારીને વૈરાગી જાણીને માતાએ કહ્યું “વત્સે ! વર  
વગર કન્યા શોભતી નથી. તે તું જાણુતી નથી કે?”

“માતા ! જે ચારે કલામાં હેંદીયાર નર હશે તેને  
હું પરણીશ.” કન્યાએ માતાના મનનું સમાધાન કરતાં કહ્યું,  
“એ ચાર કલા કર્યી છે તે કહે તો વારં ?”

“જ્યોતિષ કલા, નલોગામી વિમાન રચવાની કળા,  
રાધાવેશ કલા અને વિષથી-ગાડી મંત્ર કલા, એ ચારે  
કલામાં નિષ્ણાત નરને હું વરીશ.” કુમારીની એ પ્રતિજ્ઞા  
જાણીને પદરાણીએ રાજને વાત કરી. રાજએ એવા વરની  
પરીક્ષા માટે સ્વયં વરની રચના કરી. દેશ દેશાંતરથી રાજ-  
કુમારોને તેડાવ્યા. અનેક રાજકુમારો પોતપોતાના પરિવાર  
સાથે પરમલૂધણ નગરમાં એકવ્ર થયા. રાજએ તેમનું  
સાન્માનનું કરી સત્કાર્યા.

સુહૃત્તને હિવસે સર્વ રાજકુમારો મળિયા જરીત  
સ્વયંબર મંડપમાં પોત પોતાના આસને બિરાન્યા. સ્વયં-  
બર મંડપની મધ્યમાં રાધાએ કરીને ચુક્તા સ્તમલની ર્યના  
કરી હતી. લલિતાંગ કુમાર પણ ત્યાં હાજર હતો. તેણે  
સર્વેની અજાયથી વચ્ચે રાધાવેધની સાધના કરી. લલિત-  
ાંગને જોઈ લવાંતરના સ્નેહથી રાજકુમારી અત્યંત સંતુષ્ટ  
થયેલી હર્ષ પામી. રાજકુમારી મનથી લલિતાંગને વરી  
ચૂકી. લલિતાંગ સાથેના લગ્ન ઉપાયને ચિંતવતી મનમાં  
કંઈક શોચ કરવા લાગી.

રાજભાગાને જોવા માત્રથી કામાતુર થયેલો કોઈક  
ઐયર મોહનીમન્દ્રથી સુખ કરતો રાજભાગાને હરીને  
ચાલ્યો ગયો.

ક્ષણવારમાં બધું વ્યવસ્થિત થતાં રાજકુમારી અદૃશ્ય  
થયેલી જણાઈ. રાજ વગેરે પરિવાર હાહાકાર કરવા લાગ્યો.  
અથા રાજકુમારો એકત્ર થઈ રાજકુમારીની શોધ માટે  
વિચાર કરવા લાગ્યા. તેમને ઉદેશીને રાજ યોધ્યો. “હે  
રાજકુમારો ! કોઈ દુષ્ટ વિદ્યાધર રાજકુમારીને હરી ગયો  
છે ને હર્ષને સ્થાને અત્યારે વિષાદ છવાઈ રહ્યો છે કિંતુ  
જે બળવાન પુરુષ તે વિદ્યાધર પાસેથી મારી કન્યાને પાછી  
લાવશે તેને હું મારી કન્યા આપીશા તો તે માટે તમે સૌ  
તમારી શક્તિ પ્રમાણે ઉધમ કરો ?”

રાજની ઉદ્ઘોષણા સાંભળીને પોતાની બળવાન  
ભૂલાયાને જોતો લલિતાંગ યોધ્યો. “અરે ! કોઈ એવો  
પુરુષ છે કે મને તે દુષ્ટ કયાં છે તે બતાવો ?”

લલિતાંગ કુમારની વાત સાંભળીને એક થીજે રાજ-  
કુમાર યોધ્યો. “જ્યોતિષ લગ્નના બળથી તે હું જાણું  
શકું હું કે રાજકુમારીને લઇને તે વિદ્યાધર ખુખ ફૂર જાણે

રહ્યો છે. તેણું સ્થાનક પણ હું જણું છું તે કહો તો ખતાવું. પણ મને ત્યાં કોઈ લઇ જાય તો ખતાવી શકાય”.

એ રાજકુમારની વાત સાંલળી કોઈક જીજા રાજકુમારે પોતાની વિદ્યારાંકિત વડે આકાશગામી વિમાન તૈયાર કર્યું. એ વિમાનમાં લલિતાંગાહિ કુમારો કોષથી ધમધમતા પોતાના આચુંધો સહિત એસીને ચાલ્યા. પેલા નિમિત્ત કહેનાર રાજકુમારની વાણીને અનુસારે તેઓ પેલા હુણ વિદ્યાધરની સમીપે આવી પહોંચ્યા.

બનુખરી લલિતાંગ એ વિદ્યાધરને જોઈ ગઈયો. “અરે હુણ ! પરમાંસ અહેણું કરીને તેં તાર ખગ નામ સાર્થક કર્યું છે. વિદ્યાધર થધને છલથી તું પરદારા હરીને નાશી ગયો. તારી જાતને તું લજાવી ગયો. સિહ નામ ધારી છતાં તું દ્વિશ્વાળ જેવો રંક થધ ગયો”. લલિતાંગનાં વચ્ચને નહિ સહુન કરતો વિદ્યાધર હૃદયમાં અમર્ષને ધારણ કરતો ફન્યાને એક ખાળું મુકી લલિતાંગની સામે આવી ચુક કરવા લાગ્યો.

અને અથંકરે ચુક કરવા લાગ્યા, ચુકમાં તીકણું શરે વડે કરીને લલિતાંગે તે વિદ્યાધરને મારી નાખ્યો. વિદ્યાધરને મારીને ઉદ્માદ્યાંતી પાસે આવ્યા તો તેણીને મરેલી જોઈ બધા વિચારમાં પડ્યા. ચિકિત્સા કરતાં સર્ફના દંશથી મૂર્ચિંછત થયેલી નિશ્ચય કરીને ગાડી મંત્રના જાણ એક રાજકુમારે ચિક ગાડી વિદ્યાવડેકરીને સળવન કરી.

રાજભાગાને વિમાનમાં એસાડી સર્વે રાજકુમારે રાજાની પાસે આવ્યા, રાજકુમારી એના પિતાને સ્વાધીન કરી તેમણે પોતપોતાની પરાક્રમ ગાથા કહી સંભાવી.

એ ચારે રાજકુમારો રાજભાગાને પરણવાને આતુર થયા છતા પરસ્પર વિવાહ કરવા લાગ્યા, રાજ પણ મિતાછર

થયો છતો એમના વિવાહને નિવારી શક્યો નહિ. એ ચારે કન્યા માટે હક્કાર હતા. લલિતાંગ વિદ્યાધરને મારી નાંખ્યો હતો. બીજાએ જન્યોતિષ્ય લભથી વિદ્યાધરને બતાવ્યો હતો. બીજાએ વિમાન રચીને બધાને વિદ્યાધર પાસે લઈ જવામાં સહાય કરી હતી ને ચોથા મૃત રાજકુમારોને સળવન કરનાર હતો. એ ચારે રાજકુમારો સમાન રૂપવાળા, મહા-સામંતના કુમારો, બળવાન અને કન્યા મેળવવામાં દ્દ્રુત પ્રતિજ્ઞાવાળા હોવાથી રાજ વિષાદમાં પડી ગયો. જેથી વ્રલ્લનું અપમાન કરી એકને કન્યા આપવાની રાજાની દ્વિમત ચાલી નહિ. અથવા તો આ ચારેમાંથી આ કન્યાને ચોથ્ય વર કોણું હશે તે પણ જણાનું નહિ. કન્યાની પ્રતિજ્ઞા ચારેજણે પૂર્ણ કરેલી હોવાથી એકને કન્યા આપી શકાઈ નહી. ત્યારે મંત્રી વર્જેરે બધા એમના વિવાહને રાજવા અસર્મર્થ થયા છતા બહુજ દુઃખી થયા.

આ હડીકત સાંભળી રાજવાળા મનમાં દુઃખને ધારણું કરતી વિચાર કરવા લાગી. “ અહો ! આ મારા રૂપને વિકાર થાયો. જે રૂપમાં લોલાઠ આ ચારે ઉત્તમ નર-રત્નો પરસ્પર વિવાહને કરતા ક્લેશ કરે છે. જો કે મારું અન લલિતાંગ તરફ આકર્ષયિદું છે છતાં મારા દુલ્લાઘથી હું તેમને મેલવી શકું તેમ નથી. ને પિતાલ પણ દુઃખી થયા છતા વિવાહને લાગી શકતા નથી. એવા મારા જીવિતને વિકાર છે. આ આપત્તિમાંથી જીવવાને મરણ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. જેકે આત્મવાત કરવો નિષિદ્ધ છે, છતાં કવચિત શુદ્ધ પણ છે.”

રાજકુમારીએ આ દુઃખમાંથી જીવવાને પિતાને વિનાંતિ કરી. “ પિતાલ ! આપ વિવાહ ન કરો, આપ મને કાણ લાક્ષણું કરવાની રણ આપો કે જેથી આ આપત્તિમાંથી

હું મુજા થાર્ણ ને ભારા મૃત્યુથી રાજકુમારો આપોઆપ કલેશ કરતા વિરમણ-પોતપોતાને વતન ચાલ્યા જશે.”

રાજકુમારીની વાત સાંસળી રાજએ સુષુદ્ધમંત્રીની સન્મુખ જેણું. “અરે મંત્રી ! નિપદ્ધ સાગરમાં હથી જતાં એવા મારી તું કેમ ઉપેક્ષા કરે છે ? મંત્રી તો તે જ કહેવાય કે જે વિષમકાર્યને પણ સરખાં કરી નાખે. સુરકેલીમાંથી પણ માર્ગ કાઢે. ” દુઃખથી પીડાતા રાજને જોઈ મંત્રી એલયો. “ મહારાજ ! રાજઘાળા ભલે કાણ અક્ષણ કરે. આપ અતુમતિ આપો. ”

“અરે ! તું ભાનમાં છે ને ? આ તું શું બોલે છે ?” રાજ ઝાંઠી આંખે મંત્રી સામે જોઈ રહ્યો.

“ હેઠ ! હું સત્ય કહું છું. પરિણામ એવું સુંદર આવશ્ય કે જેથી કન્યા અને વરને સુખ થશે. તેમજ આપણી આપદા પણ ઘાળાના આ કાર્યથી નાશ પામી જશે.”

રાજએ નગરની બહાર ચંદ્રકાષ્ઠની ચિતા રચાવી તૈયાર કરાવી. રાજઘાળા પણ સ્નાન કરી પવિત્ર થઈ ચિતામાં બળી ભરવાને ત્યાં આવી. રાજ અને મંત્રી વગેરે પરિવાર લેગો થઈ ગયો-ખંધા શોકસાગરમાં ભગ થઈ ગયા.

સુષુદ્ધ મંત્રીએ પેલા ચારે રાજકુમારોને ત્યાં બોલાવી મધુર વાણીથી કહું. “તમે ચારે સમાન ઇપગુણવાળા રાજકુમારો અમારે માન્ય છો. તેથી ત્રણતું અપમાન કરીને એકને અમે રાજપુત્રી શ્રી રીતે આપીએ ? માટે આ કન્યાને અમ્રિમાં બળી ભરવાની તમે રજ આપો, તમારે પણ એ ઘાઘતનો શોક ન કરવો છતાંય તમારામાં જે કન્યા ઉપર ગાઢ પ્રીતિવાળો હોય તે કન્યાની સાથે

ખળી મરવા તૈયાર થાય તો એમાં અમારી અનુમતિ છે. લદે એ બંને જણ અભિનલક્ષણ કરો.”

મંત્રીની વાણી સાંલળી ચારે રાજકુમારો વિચારમાં પડ્યા. “અહો ! આ મંત્રીનું યુદ્ધિભલ તો જુઓ ? અમારો વિવાહ એ યુદ્ધિશાળીએ આપોઆપ લાગી નાખ્યો. તેથી અમારું માન પણ બંદિત કર્યા વગર.”

રાજકુમારોએ હુલાતા હૃદયે રાજભાગાને અનુમતિ આપી. રાજકુમારીએ પણ યાચકેને દાન આપીને ચિતામાં પ્રવેશ કર્યો. ચારે બાળુએથી અભિન પ્રલલિત થયો. ધૂમાડાથી ચારે કોર અંબકાર છવાઈ રહ્યો. એની સાથે કાણ લક્ષણ કરવાની રાજકુમારોમાંથી કોઇની હિંમત ચાલી નહિ પણ લલિતાંગ આકુળ વ્યાકુળ છતાં “અનાથ એવી મારી પ્રિયાને શું અભિ બાળી નાખશે ? એના વગર મારે લવિત શું પણ શું પ્રયોજન છે ?” એમ વિચારતો ચિતામાં પડવાને તૈયાર થયો. મંત્રી, સામંતાદિકે વાર્યા છતાં તે એકદમ ચિતામાં ઝૂઠી પડ્યો. બધાને વિસ્મય પમાડતો લલિતાંગ એ ધૂમાડાથી ઘનઘોર ચિતામાં બળી મરવાને પ્રિયાનો સાથીદાર થયો.

“અરે ! અરે ! આપ આ શું કરો છો ? મારા જેવી એક તુચ્છ સ્લીની ખાતર આપ જેવા નરરેલને અકાળે મરણ ન ધટે.” રાજકુમાર લલિતાંગને ચિતામાં પડતો બોધ સ્નેહોક્ષાસપૂર્વક રાજભાગ બોલી.

ચિતામાં એ બનેની ચારેકાર અભિનની જવાગાએ સળગી રહી હતી. ધૂમાડાથી આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું, એવા લયંકર મૃત્યુની પરવાહ કર્યા વગર લલિતાંગ પ્રિયાને જવાથ આપવા લાગ્યો, તે દરમિયાન એક અનાવ અન્યો.

ચિતાની નીચેના લોંયરામાં મંત્રીએ છાઉદા પુરુષોએ  
લોંયરાનાં ક્ષાર ઉઘાડી ચિતાના કાળને આધાં પાછાં કરી  
અગિન સ્પર્શી તે પહેલાં એ બન્નેને એ અંદર એંચી લઘ  
લોંયરાનાં ક્ષાર બંધ કરી દીધાં જેથી અગિન તેમને સ્પર્શી  
શકી નહિએ, એ પુરુષોએ એ બન્ને સ્લી પુરુષને લેધ લોંય-  
રાની વાટે બહાર આવી મંત્રીશના મકાનમાં હાજર કર્યા,  
મંત્રી અક્ષત અંગવાળાં એ બન્નેને જોધ ઝુશી થયો, તે  
રાત તેમને પોતાના મકાનમાં છુપાવી દીધાં.

ચિતા તો લડભાઈ સળગવા લાગી, એ અમૃજન્વા-  
ળાએ આકાશને સ્પર્શતી ચાલી જતી હતી. રાજકુમારે  
લલિતાંગનું સાહસબેધ બધા વિસ્મય પામ્યા છતા ચિતાની  
જવાળાને બેવા પણ અસમર્થ સર્વ વિવિધ વાર્તાલાપ  
કરતા ચાલ્યા ગયા, રાજકુમારે પણ શોકમમ થયેલા  
ત્યાંથી ચાલ્યા ગયા. રાજ વર્ગે પરિવાર પણ પુત્રીના  
મરણથી શોકાહુર થયો છતો નગરને વિષે ચાલ્યો ગયો.  
યથી તો ચિતાની રાખ પણ રાખમાં મલી ગઈ.

## ૬

### લગત.

રાજકુમારીના મૃત્યુના શોકથી ઉદાસ રાજ પ્રાત:-  
કણે રાજસભામાં બેઠેલો છે પણ તેના વદન ઉપર ગમ-  
ગિની-જ્વાનિ છ્વાધ ગાઈ હતી. રાજના શોકને જુલાવવા  
માટે મંત્રીએ અનેક પ્રકારના રસમય વાર્તાલાપો કરી  
રહ્યા હતા, પણ રાજનો શોક દૂર થતો નહોંતો, સલામાં  
પણ લોકો લલિતાંગના સાહસને વર્ણવી રહ્યા હતા. મંત્રીએ  
અને રાજ પણ તાજુખ થઈ ગયા હતા કે “લલિતાંગ  
ખુબ વર્ઝાહારી હેખાડી, લલિતાંગ જેવો પત્નીસ્નેહ કેઢનો,

હશે શું ! શું એનું સાહસ ! કેવો એનો આત્મવિશ્વાસ !  
કેવો એનો સનેહ !”

“મંત્રી ! તમે કહેતા હતા કે પરિણામ સારું આવશે  
તમારું સારું પરિણામ તે આજ કે બીજું ? નાહક નરી  
યે ઉત્તમ જીવોની હત્યા કરાવી નાખી !” ઉદાસ વહેને  
રાજ મંત્રીને કંઈક ઠપકો આપતો હોય તે થ્યે બોલ્યો.

“મને લાગે છે કે હજુ પણ એથી સારું પરિણામ  
આવશે રાજન !” મંત્રી સુષુદ્ધ સુષ્ઠમાં હસતો બોલ્યો  
યોતાની કારવામળની કોઈને ખખર નહોતી. રાજએ ચિત્તા  
તૈયાર કરાવી પણ મંત્રીએ કોંચદ તૈયાર કરાવી ખચાવની  
કે તૈયારી કરી હતી તેની મંત્રી સિવાય કોઈને ભાલુભ  
નહોતી. ખખાય સમજ્યા કે આ અને જીવાનાત્મા  
સંસારની મોજ જોયા વગર આ ફાનીફુનિયા છાડી ચાલ્યા  
ગયા હતા.

“હજુ એથી ય સારું !” રાજની આંખ ચમકી. “શું  
હજુ કોઈનો લોગ લેવાનો બાકી છે શું ?”

“ના મહારાજ, આપ જરી ઘિરજ રાખો. પ્રથમ  
પેલા પ્રણે રાજકુમારો હવે શું કરવા માગે છે તે તો જાહીએ.”  
મંત્રીએ કહ્યું.

“હા ! બોલાવો.” રાજએ પહેરેગીશાને આજા કરી.

રાજની આજાથી એ પ્રણે રાજકુમારો રાજની સભામાં  
આવીને હાજર થયા. રાજએ તેમને પ્રશ્ન પૂછ્યો, તેના  
જવાબમાં રાજકુમારો બોલ્યા.

“મહારાજ ! અમે હવે અમારા ઢેશ જવાની તૈયારી  
કરી રહ્યા છીએ, આજને આજ અમે અહીંથી ચાલ્યા  
જવા માગીએ છીએ.”

“તમારા જોવા શાણા અને સમજુ રાજકુમારોને તેજ

ચોઅય છે. કારણ કે હવે તમારો ઈન્સારે પતી ગયો છે. રાજકુમારી અભિમાં બળીને લસમ થઈ ગઈ ને તમે તમારો જીવ વહ્યાલો ગણ્ણી તમારો હુક તમે જતો કર્યો છો.” મંત્રી સુષુદ્ધિએ રાજકુમારોને દિલાસો આપતાં મુદ્દાની વાત કરી.

“રાજકુમારી તો બળી લસમ થઈ ગઈ, હવે હક્કો કંઠ સવાલજ રહેતો નથી. મંત્રીજ !” રાજકુમારોમાંથી એક જણ પોત્યો.

“છતાંય એ તો તમે પણ કણુલ કરશો કે લલિતાંગે જીવને જોખમમાં નાખી પોતાનું ખલિદાન આપી દીધું. સાહસથી એણે પોતાનો હુક સાખીત કર્યો કેમ ખરેને ?”

“હુક સાખીત થયો કે ન થયો, એથી શું ? હુક સાખીત કરવા જતાં એણે પોતાનો જન ખોયો. આ ભવમાં હવે એ કયાં પાછો આવવાનો છે અને કદાચ આવે તો યે શું !” રાજકુમાર હસ્યો.

“રાજકુમાર ! માનો કે કદાચ દેવતાની સહાયથી પાછો આવે તો ?” મંત્રીની આંખ હસી ને રાજકુમારોને પ્રશ્ન કર્યો.

“આવે તો એ ભલે એનો હુક લોગવે, એમાં અમારે શું ?” રાજકુમાર સમજતો હતો કે પોતાની સગી આંખે અભિમાં બળી ભરેલાં જોયેલાં કહ્યા પાછાં આવ્યાં નથી આવશેય નહિ. માત્ર આ તો મંત્રીની વાગ્યતુરતા હતી.

“તે તમારી વાત ન્યાય પુરસ્સર છે. કદાચ માનો કે અને દેવતાની સહાયથી અહીંથાં હાજર થાય તો લલિતાંગજ રાજકુમારીને ચોઅય ગણ્ણાય.” મંત્રીની વાત રાજકુમારોએ પણ અંગીકાર કરતાં કહ્યું. “મંત્રીથર ! શું તમારામાં એવી કોઈ શક્તિ છે કે એ અભિથી અળેલાંને તમે જીવતાં અહીં હાજર કરો !”

“હા, કેમ નહિ? શું તમારે એ આશ્ર્ય જોવું છે.”  
મંત્રીએ એક પુરુષને ધસારત કરી.

“જોતા જઈએ ત્યારે, જે એ બને જીવતાં હાજર  
થાય તો અમેય એમનાં લગ્નનો લહાવો લેતા જઈએ.”  
રાજકુમાર જાણું હતો કે મંત્રી ડંડા પહોરની હાંડી રહ્યો  
છે કારણું કે જે ઘટના ખતરી અસંભવિત છે તે મનુષ્ય  
ખનાવી શકે તેવી તેની તાકાત હોતી નથી. મંત્રી કાંતો  
ગાંડા થઈ ગયો છે અથવા તો માત્ર કુહુહલ કરી રહ્યો છે.  
અને નકામો કાલક્ષેપ કરી રહ્યો છે.

એ વાતચિત દરમિયાન લલિતાંગ અને રાજકુમારી  
રાજસભામાં આવીને હાજર થયાં. બધા અભયધીની હંગ  
થઈ ગયા-ઇંદ્રી આંખે જોઈ રહ્યા. રાજ તો આ ખનાવથી  
ખુશી ખુશી થઈ ગયો.

અક્ષમાત આકાશમાં મેટો કડકો થાય અને ભર  
અરણ્યમાં રહેલા બીજુણ માનવીનું હૈથું ધડકે તેની માર્ક  
રાજકુમારેનાં હૃદય ધડક્યાં, અસંભવિત ઘટના ખનેલી  
પોતાની સંગી આંખોએ જોઈ. અરે! આ તે સ્વરૂપ છે કે  
માયા? શું આ સત્ય છે! પોતાની આંખો ચોણી ખુખ્ય  
ધારી ધારીને જોવા લાગ્યા. “આ શી રીતે બન્યું? કાલે  
અશ્રિમાં હૃદય થયેલાં આ આંખોએ જોયેલાં તે સત્ય કે  
આ સત્ય!” રાજકુમારો મોદ્ય વિમાસણું પડ્યા.

“રાજકુમાર! લલિતાંગ અને રાજકુમારીને તમે જુઓ  
છો તે સત્ય છે. આ કાંધ મારી માયા કે ઈદ્રજલ નથી.”  
મંત્રીએ ખુલાસો કર્યો.

રાજકુમારો પણ અભયથ થયા. રાજકુમારીને સાક્ષાત  
હાજર-જીવતી જગતી જોઈ પણ હવે તેઓએ પોતાનો  
હુક યુમાંયો હોવાથી વાદવિવાદનો અંત આવી ગયો.  
હતો એથ્યે ઉપાય શું?

“રાજકુમારો ! આ અધું તમારી પરીક્ષા માટે હતું. તમારા ચારેના વિવાહનો અંત કોઈપણ રીતે ન આવવાથી તમારા ચારેમાંથી રાજભાગા માટે ચોઅય નર કોણું છે તેની આ અભિ પરીક્ષા હતી. જેમાં તમે ત્રણે હારી ગયા છો, રાજકુમાર લલિતાંગ રાજભાગા માટે ચોઅય સાચિત થયા છે.” સુખુદ્વિ મંત્રીએ રાજકુમારો આગળ ઝુલાસો કર્યો. જે સાંભળી રાજસભા પણ મંત્રીની ઘુદ્વિની તારીફ કરવા લાગી.

મંત્રીએ પણ અગિન પરીક્ષામાંથી બન્નેને શી રીતે બ્યાવી લેવામાં આવ્યાં તે હકીકત કહી સંસ્કારી મંત્રીની હકીકત સાંભળી રાજકુમારોના મનતું પણ સમાધાન થઈ ગયું.

રાજએ મોઢા આડંખર પૂર્વક લલિતાંગ અને રાજકુમારીનાં લભ કરી દીધાં. ઐલા ત્રણે રાજકુમારો એ વિવાહ ઉત્સવમાં ભાગ લઈને પોતારોતાને વતન ચાલ્યા ગયા. રાજકુમાર લલિતાંગ શ્વસુરના આચહથી ત્યાં રહ્યો.

કેલાક દ્વિવસ પછી લલિતાંગ સાસુસસરાની-રાજાની આજ્ઞા મેળવી પોતાને વતન જવાને તૈયાર થયો, રાજએ પણ લલિતાંગનો આચહ જાણી પુત્રીને સાસરે વળાવી. કરકરીયાવરમાં ખુખ હાથી બોડા રથ પાયદળ અને જર-જરેરાત, વસ્ત્રાભૂપણ આપી પુત્રીની મનોકામના પૂર્ણ કરી.

એક સારા દ્વિવસે રાજકુમાર લલિતાંગ પોતાની પ્રિયા તેમજ પરિવાર સાથે પોતાને વતન જવાને રવાના થયો.

રાજએ પોતાના પુત્રને પરિવાર સહિત આવેલો જાણી એનો મોટા પ્રવેશ મહોત્સવ કર્યો. નગરનાં નરનારીઓ કુમારની વધુનાં દર્શાન કરી વખાણું કરવા લાગ્યાં. નગરમાં અનેક સ્થળે લોકોથી સતકાર કરતો અને પૂજાતો

રાજકુમાર પ્રિયા સહિત રાજમહેલમાં આવી પહોંચ્યો  
અને પિતાને નમ્યો.

ધણે હિવસે પુત્રને કુશલક્ષેમ આવેલો બેઈ રાજ  
ખુશી થતો પુત્રને બેટચો. પિતાને નમીને લલિતાંગ પોતાની  
માતાને નમ્યો. સર્વેને મલી બેટી પોતાના આવાસે આવ્યો.  
પ્રિયા ઉન્માદ્યંતી સાથે પંચ વિધ સુખને બોગવતો સુખમાં  
કાલ નિર્ગમન કરવા લાગ્યો.

અન્યદી રાજએ પુત્રને યોગ્ય જાણી એના રાજ્યા-  
લિખેકની મંત્રીઓને આજા કરી. જ્યોતિષીને બોલાવી  
શુભબુદ્ધૂર્ત જોવરાયું.

એ રાજ્યાલિખેક નિમિત્તે નગરમાં મોટા પછી મહો-  
ત્સવ થયો. લોકો આનંદમાં ભર્સત રહેવા લાગ્યાં, શોક  
સંતાપ અધ્યાત્મિક થધ ગયાં ને શુભ હિવસે લલિતાં-  
ગનો રાજ્યાલિખેક થધ ગયો. કુમાર લલિતાંગ નરપતિ  
લલિતાંગ થયો, રાજએ રાજ્યની જવાબદીથી મુક્ત થધ  
આતમહિત સાધ્યું. રાજ લલિતાંગ પણ ન્યાયથી પ્રજાનું  
પાલન કરતો પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યો.

## ૭

## વૈરાગ્ય.

અર્થાનામર્જને દુઃख-મર્જિતાનાં ચ રક્ષણે ।

આયે દુઃખં વ્યયે દુઃખં, ધિગથોડનર્થમાજનમ् ॥૧॥

ભાવાર્થ-ધન ઉપાર્જન કરવામાં દુઃખ રહેલું છે.  
રક્ષણ કરવામાં પણ અનેક ચિંતાએ રહેલી છે. ધનના  
આવવામાં તેમજ નાશ પામવામાં દુઃખ રહેલું છે એવા  
અનર્થને કરતારા ધનને વિકાર થાએા.

શરદીલિલા હિવસો સુષ્પિના સૌંદર્યની શોભામાં વધારે। કરી રહ્યા છે, વધારીલિલા ઘનઘોર આકાશ અત્યારે સ્વચ્છ અને નિર્મળ હૃદ્યાય છે આકાશમાં કંચિત વાદળીઓ અનેક સ્વરૂપને ધારણ કરતી પાછી વિખરાઈ જાય છે, શરદીલિલા સૂર્ય પણ પોતાના પ્રકાશથી જગતને આનંદ આપી રહ્યો છે એ શરદીલિલા મોજને માણુસા માનવીએ આને મન તો એવું હતું કે આ ભવ મીડા તો પરલાવ કોણે હીડા.

એ શરદીલિલા એક હિવસે લલિતાંગનૃપ પોતાની પ્રિયા સાથે વિવિધ કીડા કરતો ગોખમાં એઠો હતો, સમય સાંજનો હોવાથી આકાશમાં અનેક પંચરંગી વાદળ એકઠાં મળીને વિખરાઈ જતાં હતાં, નવીન નવીન સ્વરૂપને ધારણ કરી વિખરાઈ જતાં એ વાદળને કંઈ વાર લાગતી નહોંતી. રાજાએ અક્ષરમાત આકાશ તરફ દાખિ કરી તો વાદળથી અનેલો પંચવર્ણવાળો મનોહર પ્રાસાદ નજરે પડ્યો જાણે ઉત્તમ અને કળાનિપુણ કારીગરનો અનાવેલો હોય ! એવા મનોહર પ્રાસાદને જોઈ રાજ મુશ્રી થયો, રાજ વાદળથી અનેલા પ્રાસાદના સૌંદર્યને એક ચિંતે જોઈ રહ્યો.

ક્ષણવાર પણી જ્યારે રાજની નજર પ્રાસાદ ઉપર પડી કે તે મહેલાનાં વાદળ ધીરે ધીરે વિખરાવા લાગ્યાં, એ પંચવર્ણયુક્ત પ્રાસાદ છેદાઈ શ્રીષ્ટિવિશ્વિર્ણિર્ણિ-છિભલિન થધ ગયો ને રાજ અમુકથો “પ્રિયે ! આકાશમાં રહેલા પ્રાસાદને જોવામાં પણ વિધિએ વિજ્ઞ કર્યું.”

“શ્રી રીતે !” પદ્મરાખી કે જે રાજની વાતમાં રસ લેતી હતી તે બોલી.

“શું કહું હેવી ! શરદીલિલા વાદળની ચપળતા તો જો ? સારો અને મનોહર આકૃતિવાળો અભ્રપ્રાસાદ પણ

એક ક્ષણમાં વાયુથી વિખરાઇ ગયો—નષ્ટ થઈ ગયો।  
એહને બારણ કરતો રાજ બોલ્યો,

“‘વાહણો એ તો એવો સ્વભાવ જ છે કે એકઠાં  
મળીને ક્ષણમાં વિખરાઇ જય,’ રાજીને રાજના મનતું  
સમાચારન કર્યું,

“અને એવીજ આ હુનિયાની વસુદુઓ ધન, યૌવન,  
વૈભવ, એદ્યદ્વારા અને જીવિત બધુંચ એક દિન નષ્ટ થઈ  
જવાનું કેમ અર્થને? મોટા પરાડુભથી મેળવેલી આ લક્ષ્મી  
પણ નાશ પામી જવાની, અથવા તો અને છાડીને આપણેય  
જતા રહેવાનું જ ને?”

“આચુ પૂર્ણ થતાં આ સંસારમાં કોઈ પણ ક્ષણવારે  
રહી શકતું નથી હેવ !”

“તારી વાત સત્ય છે હવી! યૌવન, લક્ષ્મી, જીવિત  
બધું કમલપત્ર પર રહેલા જળ બિંદુની માર્કે ચ્યપળ છે,  
વિદ્યુતના અખદારાની માર્કે ક્ષણમાં નાશ પામી જવા-  
વાળું છે છતાં પણ મનુષ્યો પરલોક સાધવામાં ઉત્સાહ  
બારણ કરતા નથી, એ ઓછી નવાઈભરી વાત છે?”

“આ લોકના સુખમાં ભન્ન થયેલા માનવીને પર-  
ભવની કાંઈ પડી નથી, માનવી કુદાંચ પરિવારાદિકની  
ઉપાધિમાંથી મુક્ત થાય ત્યારે પરલોકને સંભારે ને?”

“હે સુલોચને! મોહમાં મુંજાયેલ મનુષ્ય કાંઈ હેઠી  
શકતો નથી, પણ આ પ્રાસાદની માર્કે અનિત્ય આચુષ્ય  
પુર થતાં હાથી, અથ, રથ અને પાયદળાદિ ચતુરંગ  
અળના જોતાં જોતાં મૃત્યુ માનવીને હરી લે છે ત્યારે એ  
શું કરી શકે છે ?”

“પરવશ પરલો માનવી શું કરે? એનો જો ત્યાં  
ઉપાય ચાલે તો મૃત્યુને પણ છેતરવાને તૈયાર થાય ?”

“છતાં સ્વાધીનપણે માનવી ધર્મની સામગ્રી મેળવવાના પ્રયાસ કરતો નથી એ તેની મૂઢતા ઓછી છે કંઈ?”

“કુદુંબ પરિવારમાં સુંભાગેલ પુરુષ અચ્છામાં માત પિતાના લાડમાં ને ડીડા કરવામાં કાળ વ્યતીત કરે છે. મહને વધારનારી તારુણ્ય અવસ્થા રમણીજનના વિલાસોમાં ને વૃદ્ધાવસ્થા તો ધર્મારાધન કરવામાં નકામી હોવાથી પુત્રાદિકું સુખ જોઈને પરાધીનપણે પસાર કરે છે. મતુષ્યના જીવનનો આ સામાન્ય કુમ હોય છે બાકી તો વિરલાજ ધર્મારાધન કરી આત્મહિત સાધો જય છે. સ્વામિ!”

“હો ગમેતેમ આ અસાર કાયામાં કંઈસાર નથી, સત્ત ધારુથી પોષાયલ અશુચિમય આ શરીરનો ડાઢ્યા પુરુષો ધર્મારાધનવડે સહઉપયોગ કરે છે કારણુકે શબ્દ, રૂપ, રૂસ, ગંધ અને સ્પર્શાદિક લોગો તો પરમાર્થથી રોગાનેજ કરનારા છે. આ નવયૌવન શરીર, ખાન, પાન, વસ્ત્ર, આલરણાદિક તો ક્ષણભંગુર છે જે પ્રભાતે દેખાય છે તે મધ્યાતંકે જોવાતા નથી. જે મધ્યાનહે જોવાય છે તે રાત્રી એ દેખાતા નથી ને રાત્રીએ દેખાય છે તે કાલે દેખાતા નથી, જ્યાં જન્મ, જરા અને સૂત્રુ મતુષ્યની પાછળજ લાગેલાં છે એવા આ ભયંકર સંસારમાં માનવીને સુખ કચાંથી હોય?

આ અસાર સંસારમાં મનદૂષી મુગદો શાંતદૂષી સુધારસના પાનનો ત્યાગ કરી ગુણા તરફે તરફ હોડાહોડ કરી રહ્યો છે. તો પ્રિયે ! આવા અસાર અને ક્ષણભંગુર લોગોથી હવે સર્વે.” રાજ લલિતાંગે પોતાની ધૂંછા વ્યક્તા કરી.

“સ્વામિ ! આપનો વિચાર થાય છે. આપણે લોગો પણ ધણા લોગવ્યા, હવે આત્મહિત તરફ પણ આપણે ખ્યાલ આપવો જોઈએ.”

રાજરાણીએ એ વૈરાગ્યથી ભરેલા હૃદય વડે દિવસ ખસાર કર્યો. થીજા દિવસના પ્રભાતે ઉધાનપાલકે વધામણું આપ્યું. “હે દેવ ! આપ જય પામો, વિજય પામો, લક્ષ્મી, સૌભાગ્ય અને અશ્વર્યથી આપ વૃદ્ધિ પામો, આપની નગરીના ઉધાનમાં જીનેશ્વર ભગવાન પખાર્યા છે. દેવતાએએ સમવસરણુંની રેચના કરેલી છે, તેમાં બિરાજેલા ભગવાન સાધ્ય જીવાને ધર્મ સંભળાવી રહ્યા છે.”

ઉધાનપાલકની વધામણું સાંલળી રાજ ખુશી થઈ ગયો, એક લક્ષ હીનાર ઉધાનપાલકને ધનામ આપીને અંતઃપુર સહિત રાજ જીનેશ્વરને વંદન કરવાને ચાલ્યો.

સમવસરણ દખિગોચર થતાં પાંચ અભિગમ સાચવી રાજચિન્હનો ત્યાગ કરી રાજ સમવસરણમાં આવ્યો. વિધિ-પૂર્વક જીનેશ્વરને વાંદી પોતાને યોગ્ય સ્થાનકે એસી ભગવાનની દેશના સાંલળવા લાગ્યો, જીનેશ્વરની વાણીને સાંલળી રાજ મોહનો પરાજય કરી પ્રિયા સહિત નગરમાં આવ્યો.

રાજએ મંત્રીએને ઘોલાવી પોતાના પુત્રની રાજ્યાભિષેક માટે તૈયારી કરવા હુકમ આપ્યો. મુહૂર્ત જોવરાવી મંત્રીએએ બધી તૈયારી કરી, શુલ મુહૂર્તે રાજએ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. નગરમાં આનંદમંગલ વતીધરથાં.

રાજ્યની જેભમહારી દૂર કરી રાજ લલિતાંગ પોતાની પ્રિયા ઉત્તમાદ્યંતી સાથ જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પાંચ સમિતિ અને ત્રણ ગુમિથી ગુસ્ત એવા તે લલિતાંગ રાજચિંદ્ર બાર પ્રકારના તપને આચરતા નિરતિચાર પણે સંયમની આરાવના કરવા લાગ્યા.

નિરતિચારપણે સંયમને પાળી પ્રાંતે સમાધિપૂર્વક કાલ કરી ધર્શાન દેવલોકને વિષે પાંચ પલ્યોપમના આયુષ્યે

હેવપણે ઉત્પત્ત થયા, ઉનમાદ્યંતી સાધ્વી પણ સંલેખના પૂર્વક સમાધિથી કાલ કરીને તેજ હેવની હેવી પણ ઉત્પત્ત થઈ.

ઇશાન હેવલોકમાં અહૃતીશ લાખ વિમાનો રહેલાં છે, તેમનો શાસક ધર્ષાનેંદ્ર એ સાગરોપમથી અધિક આયુ-ષ્વાળો અને સાત હુથના શરીરને ધારણ કરનારો પ્રચાડ શક્તિશાલી છે. વિમાનોમાં દરેક વિમાને એક એક જીન ચૈત્ય હોય છે દરેક ચૈત્યમાં એકસોએંશી જીન પ્રતિમા શાસ્વતાપણે રહેલાં છે. ત્યાં પણ જીનેશ્વરની અક્ષિત કરતો ને વિહુરમાન જીનેશ્વરને વંદન, નમન કરતો તે હેવ પોતાની હેવી સાથે સુખમાં કાલ વ્યતીત કરેવા લાગ્યો; વૈક્રિય લખિષ વડે લિન લિન શરીરની રચના કરતો તે વિવિધ ભોગને ભોગવતો હતો.

હેવતાએનાં ઇપ, એમનાં સૌભાગ્ય, એમની અપૂર્વ ઝડિ અમાપ, અખુટ હોય છે. એની ઇજી સમૃદ્ધિની આપણે શી કલ્પના કરી શકીય. એમને રહેવાનાં વિમાનો પણ મણિરત્નાથી જરૂરાં હોય છે; રલથી નિર્ભિત એ વિમાનોના રથંલો હોય છે એ બધુંચ હિવ્યશક્તિવાળું અને શાથ્યત હોય છે. વૈક્રિય શરીરથી ભોગો ભોગવતાં તેમને કંધ જુગના જુગ વહી જય છે છતાં તેમના ભોગની સમાપ્તિ થતી નથી. તેમના ઇક્ષ્ટ એક નાયકમાં પણ સેંકડા વધો વહી જય છે તેઓ મન ચાહે તેવાં ઇપ ધારણ કરી ભોગ ભોગવી શકે છે. એવા એ હિવ્ય શક્તિને ધારણ કરનારાના સુખોની કેટલી વ્યાખ્યા કરીયે?

૮

### વિદ્યાધર બાળા,

આ જંબુદ્ધીપના સુકુમાં વિજ્ઞયમાં વિશ્વપુરી નગરીના રાજ સુરતેજ નરપતિની પુણ્યાવતી નામે પહોંચી હતી, તેની દુક્ષિને વિષે લલિતાંગ દેવનો જીવ ત્યાંથી અચીવે પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મોત્સવ કરીને ભાતાપિતાએ એ આગામું નામ પાડ્યું દેવસેન, શાસ્ત્ર અને શાસ્ત્રકળાનો પારગામી થઈને દેવસેન રમણીય અને મહનને મહાલવાને યોગ્ય એવી યૌવન વયમાં આવ્યો છતાંય મનોહર લલના-ઓના કટાક્ષ બાળોથી વિદ્યાંયો નહિ.

ઉન્માદ્યાત્તીના જીવ દ્વી અવમાંથી આખુણ્ય પૂર્ણ થતાં તેજ વિજ્ઞયને વિષે વૈતાઠ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં સુરસુંદર નામે નગરનો રવિકરણ રાજ હતો તેની રવિ-કાન્તા નામે પ્રિયા થકી પુત્રી પણે ઉત્પન્ન થઈ, તેનું નામ ચંદ્રકાંતા.

ચંદ્રકાંતા સ્ત્રીની ચોસઢે કળામાં નિપુણ થઈ યૌવન-વયમાં આવી. છતાં એને પુરુષનું નામે ગમતું નહિ. તો લઘનની તે વાત જ શી? સખીઓ દેવકુમાર સમાન પરાક્રમી વિદ્યાધરોના પરાક્રમનાં તેની આગળ વર્ણન કરેતી હતી. પણ સાંભળવા જેટલીય તત્પરતા તે બતાવતી નહિ. ચંદ્રકાંતાના વિરક્તાપણાથી એના ભાતા પિતાને ચિંતા થઈ.

અન્યત્રા ચંદ્રકાંતા પોતાની સાહેલીઓ સાથે કીડા કરવાને પર્વતના શિખર ઉપર આવી, ત્યાં અચાનક કિંનર ચુગલથી તાલ બદ્ધ ગવાતું મનોહર ગીત સાંભળ્યું. એ અપૂર્વ ગીતમાં દેવસેન કુમારના રૂપ, ગુણનું વર્ણન સાંભ-

ઘાતા એ વિદ્યાધર ખાળા પૂર્વલખના સ્નેહથી હેવસેન તરફ  
રાગવાળી થઈ, હેવસેનનું નામ સાંખળતાં તેણીને આનંદ  
થયો, તેણીનાં રોમરાય વિકસ્ત્વર થયાં.

ચંદ્રકંતાની પ્રેરણાથી તેની પ્રિયંકરી નામે સખી  
કિન્નરના ચુગલ પાસે આવીને પૂછવા લાગી. “આ તાલ-  
ખદ્ધ ગાયનમાં તમે જેની કીર્તિ ગાથાની મનોહર યશ  
કલગીનું વર્ણન કર્યું તે હેવસેન કોણ ?”

પ્રિયંકરીની લજાસાને તૃપ્ત કરતાં તે નરનારી (કિન્નર  
મિથુન ) બોલ્યાં. “તને શી વાત કર્યાં એના ગુણોની;  
ગુણો એ એવી એક આકષ્યક વસ્તુ છે કે હેવતા હોં કે મલુષ્ય,  
પણ તેના ગુણોનું ગુણોનુરાગી એવા પાંડિત પુરુષો વર્ણન  
કરે છે, એ સહજ છે. અમે પૃથ્વીના સૌદર્યનું નિરક્ષણ  
કરતાં અનુકૂળે વિશ્વપુરી નગરીના બાહ્યોધાનમાં આવ્યાં  
ત્યાં અમે હેવકુમાર જેવો હેવસેન કુમાર દાન વડે કરીને  
યાચકાને હર્ષ પમાડતો જેયો. તે ખુદ્ધિનિધાન માની પુરુષ-  
ઓને માન આપીને તેમનો સહાર કરીને જુશી કરતો હતો  
મિત્રાને મધુરા વચ્ચે કરીને હર્ષિત કરતો એવા હેવસેનના  
હૃથી લજા પામીને અંગ જ કે કામહેવ તે અનંગપણાને  
પ્રાપ્ત થયો. એની સૌભ્યતાની હરીક્ષાધ કરવા જતાં ચંદ્ર  
કલંકિત થયો. તેમજ તેના જેવા પ્રતાપી થવાને સૂર્યો  
હળર હાથ કર્યા તો પણ તેની અરોધરી કરી શક્યો નહિં.  
જેની ખુદ્ધિથી જીતાઈ ગયેલા અહસ્પતિ, શુક અને બુધ  
આ લોકથી હૂર જતા રહ્યા, કિ બહુના ? અમે એનું  
વિશેષ તે શું વર્ણન કરીયે ?” ધ્રત્યાદિ હેવસેન કુમારના  
ગુણોનું વર્ણન કરતું તે કિન્નર મિથુન ત્યાંથી ચાલ્યું ગયું.

એ કિન્નરચુગલની વાત સાંખળી પ્રિયંકર સખી  
ચંદ્રકંતા પાસે આવીને તેણીને કહેવા લાગી. “હે સ્વા-

મિનિ ! ચાલોં હવે આપણે આપણા નગરમાં જઈએ. આપણને અહીં આવ્યાને વણ્ણો સમય થવાથી માતાપિતા ચિંતા કરતાં હશે” સખીના વચનથી ચંદ્રકાંતા પોતાના નગરમાં આવી.

ચંદ્રકાંતાનું મન હેવસેનકુમારમાં સંલઘ થવાથી પ્રિય-કર સખીએ એ વાત એની માતાને કહી સંલળાવી. એક સમર્થ શક્તિશાળી વિધાધર નરેશની દુહિતા સામાન્ય અદૈપશક્તિવાળા ભૂચરને પરણે તે વાત ચંદ્રકાંતાના બાંધવાને ગમી નહિ. તેએ પોતાની લગીનીના મનને અન્ય દિશામાં વાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

“ચંદ્ર ! હજુ તું નાદાન છે. વિધાધર અને મનુષ્યમાં રહેલ આસમાન જમીન જેઠેલો તડાવત સમજવાની તને વાર છે. બાકી તો ક્યાં શક્તિસંપન્ન વિધાધર ને ક્યાં નિઃસત્ત્વ મનુષ્ય, વિધાધરો સ્વતંત્ર રીતે મન ઇવે ત્યાં સર્વત્ર જઈ શકે છે. ક્ષણમાં અષ્ટાપદ ઉપર તો ક્ષણમાં નંદનવનમાં, કોઈ સમયે નંદીથર દીપમાં તો કોઈ સમયે બેદ પર્વતના રમણીય ઉપવનમાં.

હેવતાની માર્ક વિધાધરો પોતાના મનોરથો વિધા વડે કરીને સિદ્ધ કરે છે. વિધા વડે કરીને ગમે ત્યારે ગમે તેવું સ્વરૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે છે. યાચકોને ધ્યાચિત દાન આપે છે. એવા અસ્થિલિત પ્રતાપવાળા લાભવાન વિધાધરો ક્યાં ને વિધાતાએ નરરૂપે કીડા જેવા બુદ્ધા મનુષ્યો ક્યાં ? હીન, અનાથ, ગરીબ અને રાંકની માર્ક વારંવાર પરાલવને પામનારા અને બ્યર્થ મનોરથ વાળા પામર મનુષ્યની સરખામણી વિધાધરો સાથે શું કહ્ય થઈ શકે ?”.

“નેણો કર્મલૂભિમાં વિહાર કરતા અરિહંત લગવાનને

વાંદવાને સમર્થ નથી. મોહનો તાશ કરેનારી તેમની દેશના પણ સાંભળવાને જેવો શક્તિવાન નથી. એવા ભૂયારી મનુષ્યોનું બળ, ઝુદ્ધિ, ઇપ અને વિજ્ઞાન વિદ્યાધરોની પાસે સસુદ્ધની આગળ આયોચ્ચીયાના જેવું છે. વિદ્યાધરો દીંલા માત્રમાં જેમનો પરાલય કરી શકે છે. જેમની પાસેથી ગમે તેવી વસ્તુને પણ જોતાં જોતાં હરી શકે છે એવા સમર્થ વિદ્યાધરોનો ત્યાગ કરી તને પૃથ્વીના કીડા જેવા મનુષ્ય તરફ શું જોઈને પ્રીતિ થાય છે?"

યોતાના અંધુચોની અને સ્વજનોની શિખામણને હૈયામાં ધારણ કરતી ચંદ્રકાંતા બોલી. "યોતાની સ્તુતિ અને પારકી નિંદા એતો રાગદ્રોષના પરિણામથી થઈ શકે. પરન્તુ મધ્યસ્થ પુરુષો તો વિચાર કરે તો માલુમ પડે કે વિદ્યાધર અને મનુષ્યપણામાં નુભવના સમાનપણા થકી લગલગ સરાયુ જ છે. જન્મ, જરા, મૃત્યુ અને દોગાં દ્વિક લાયો જેમ મનુષ્ય-ભૂયારીને વળગેલા છે તેમ વિદ્યાધરને પણ વળગેલા છે.

તમે એમ કહેશો કે વિદ્યાધરો આકાશગામી હોવાથી ગમે ત્યાં જઈ શકે છે તો આકાશને વિષે તો પંખીઓ પણ ઉડીને ગમે ત્યાં જઈ શકે છે. ઇપ પરાવર્તન નથી લોકો. પણ આયેહુથ રીતે કરી શકે છે, માટે વિજ્ઞાન પુરુષો પ્રાપ્ત થયેલી વસ્તુનો ગર્વ કરતા નથી. વિદ્યાધરો જ્યારે વિજ્ઞાન બણથી શરૂને જીતી શકે છે. ત્યારે ભૂયર મનુષ્યો પોતાના આઙુઅલથી દુરમનને મારે છે. માટે મધ્યસ્થ થઈને વિચાર કરો કે મનુષ્ય અને વિદ્યાધરમાં કોણું વખાણુંબા યોગ્ય છે તે.

મનુષ્યમાં જે વિદ્યાધરની જાતિ ઉત્તમ મનાતી હોતા તો અરિહંત, ચક્રવર્તી, ખલદેવ અને વાસુદેવ તમારી ઉત્તમ જાતિમાં ડેમ ઉસેનું થતા નથી? અરે ભૂયર-મનુ-

ઘ્યમાં ઉમજ થઈને તેએઓ તમારા જેવા પરાહુમી વિદ્યાધરોને પણ વશ કરે છે તે સમયે તમારી વિદ્યા કચાં જતી રહે છે?

ચંદ્રકાંતાની ખુલ્લિયુક્ત વાણી સાંલાળી એના ભાષિયો વગેરે મૌન થઈ ગયા. વિદ્યાધરરાદ રવિકિરણે પણ જાણું કે દેવસેનકુમાર વગર આ કન્યા અન્યને પરણશે નહિ. પરભવના સ્નેહથી તે એનામાં રાગવાળી થઈ છે પણ દેવસેનનો આ કન્યા ઉપર રાગ કેવો છે તેની પરીક્ષા કરવી જોઈએ.

રવિકિરણ વિદ્યાધરરાજે એક કન્યાના સમાન સ્વરૂપ-વાળું ચિત્રપટ તૈયાર કરી વિશ્વપુરીનાગરીને વિષે રાજ પાસે મોકલ્યું, એ ચિત્રપટને જોતાંજ રાજકુમાર એ કન્યામાં ગાઠ રાગવાળો થઈ ગયો.

રાજ રવિકિરણે પોતાની પુત્રી સાથે ચંડાળનું સ્વરૂપ ધારણ કરી ગાંધર્વ બની વીણાને વગાડતો રાજની સભામાં આવ્યો તેના મધુર ગાયનથી દેવસેન કુમાર વગર અધી સભા ઝુશી થઈ ગઈ. દેવસેન કુમાર તો એ ચંડાલની સાથે આવેલી ચંડાલ પુત્રીને જેવામાંજ લીન થઈ ગયો હતો. વારંવાર એ ચંડાલીને જેવા છતાં અતૃપ્ત ફૂદ્યવાળો દેવસેન રાજસભાના અપવાહને પણ ન ગણુકારતાં એ ચંડાલીને ઝાઢી આંખે જોઇ રહ્યો. અનેક વખત ગાયન કરતા એ ચંડાલના ગાયનની એને કંધ પરવા નહોતી. એને દરકાર હતી પેલી ચંડાલની કુમારિકાની.

ઐચેર પણ કુમારની પ્રીતિની પરીક્ષા કરીને ચાલ્યો ગયો. પણી વિવાહની સામચી તૈયાર કરીને રવિકિરણ પોતાના પરિવાર સાથે વિશ્વપુરના ઉદ્ઘાનમાં આવ્યો અને રાજને પણ વધામણું મોકલ્યું.

સુરતેજ રાજએ પણ વિવાહની તૈયારી કરી વિધા-

થરણું સંત્માન કર્યું, એનો સતકાર કરી નગરની ખણાર  
એમના સ્થાન માટે રાજાને વ્યવસ્થા કરી.

એક સારા સુલ્લોત્ત દેવસેન અને ચંદ્રકાંતાના વિવાહ  
મોટા આડાંખર પૂર્વક થઇ ગયા. વિધાધર માટે પોતાની  
પુત્રીને કન્યાહાનમાં પુષ્કળ જરાઝવેરાત, વસ્ત્રાભરણ વગેરે  
હિંય વસ્તુઓ આપી. વિધાધર રવિકિરણ કેટલાક હિંસ  
પછી સુરતેજ રાજાની રજ લઈ પોતાના પરિવાર સાથે  
પોતાની રાજધાની વૈતાઠ્ય તરફ ચાલ્યો ગયો. તે ત્યાંથી  
હિંય લોગોને પોતાની પુત્રી માટે દરરોજ મોકલવા લાગ્યો.

## ૬

## દેવસેન

પ્રતિહિંસ થિસુર તરફથી આવતા હિંય લોગોને  
લોગવતો દેવસેન કુમાર દેવતાની માડક સુખમાં કાળ  
વ્યતિત કરતો હતો લોકો ચંદ્રકાંત અને દેવસેન કુમારના  
લોગોની પ્રશાંસા કરવા લાગ્યાં. મતુષ્ય ભવનાં અદ્ભુત  
સુખોને તેમના એશ્વર્ય જગતમાં એમના ઉત્કૃષ્ટ લાઘ્યની  
સૂચના કરતાં હતાં, કારણકે પુષ્પયશાળી મતુષ્યોને પ્રયાસ  
કરવાની કાંઈ જરૂર પડતી નથી ખૂદ વિધાતાજ નાજરની  
માડક એની સેવામાં હાજર રહી એના લાઘ્યને યોગ્ય  
વસ્તુ મેલવી હવાની તજવીજ કરે છે.

દેવસેનના પિતા સુરતેજ નરપતિએ પણ ગુરુ મહા-  
રાજની ધર્મહેશના સાંભળી દેવસેન કુમારને પોતાનું મોક  
રાજ્ય અર્પણ કરી દીધું. તે વિશુદ્ધ પરિણામની ધારાએ  
આરિત્રિપી રતન અંગીકાર કરી આત્મ કલ્યાણ સાંધી લીધું.

પ્રજાનું ન્યાયથી પાલન કરતા દેવસેન નરપતિ કુર્જ-  
નોને શિક્ષા કરી સજજનોનું રક્ષણ કરતાં ધર્મથી પ્રજાની

રક્ષા કરતા હતા, ધર્મપૂર્વક અર્થ અને કામની સાથના કરતા રાજ દેવસેન અતુપમ લોગોને પણ લોગવતા હતાં ન્યાયથી રાજ્ય કરતાં દેવસેન નરપતિને ચંદ્રકાંતા પદ-રાજીથી એક પુત્રનો જન્મ થયો એનું નામ શૂરસેન.

એ દિવ્ય કાંતિવાળ શૂરસેનવડે સૂર્યના ઉદ્ઘયથી જેમ પૂર્વ દિશા શોલી રહે તેવી રીતે મહાહેવી ચંદ્રકાંતા પણ શોલી રહી હતી. આણ ચંદ્રમાની મારુક અતુક્રમે વૃદ્ધિને પામતો શૂરસેન શક્તિ અને શાસ્કની કળામાં પ્રવિષુ થયો, નવચુવાન થયો.

હરોજ ચંદ્રકાંતાના પિતા વિદ્યાધરરાજ રવિકુરણ તરફથી દિવ્ય લોગો આવ્યે જતા હતા, મતુષ્યના લોગો ઉપરાંત વિદ્યાધરના દિવ્ય લોગોને લોગવતાં આ સુખી ચુગલને પણ એક દિવસ વિદ્ય આવ્યું, વિદ્યાધરરાજ રવિકુરણ ચિતાની વ્યાક્ષિત્તતાથી પોતાની પુત્રીને દિવ્યલોગ મોકદી શક્યો નહિં, પિતા તરફથી એક દિવસ એ લોગોની પ્રાપ્તિ ન થવાથી ચંદ્રકાંતાના મનમાં અનેક ઉથલપાથલ શરૂ ગઈ.

એ દિવ્ય લોગના રોજના અલ્યાસથી એક દિવસ એ દિવ્ય લોગની વસ્તુઓનું સ્થાન સાંધારણ વસ્તુઓએ લેવાથી ચંદ્રકાંતાને અધુ નિરસ લાગ્યું. એના મનમાં કંઈ કંઈ વિચાર આવી ગયા. “આહા ! આજે પિતાએ કંઈ ના મોકદ્યું, શું આજે એ મને ભૂલી ગયા ! શું મારી ઉપર કોપાયમાન થયા ! અથવા તો શું મારી ઉપર નિઃસ્નેહ-વાળા થયા ?” અભિથી દંડ થયેલી માલતીની લતાની મારુક ચંદ્રકાંતા રથામવદનવાળી થઈ ગઈ, હિમથી બધી ગયેલી કમલિની મારુક એના વહન પર ઝુખ જ્યાની અથરાધ ગઈ.

“હે સ્વામિનિ ! શોક ના કરો. બીજાની આપેદી વસુઅથી હુમેશાં સુખ રહેતું નથી. માટે એવા લાભા-લાભમાં ડાઢા પુરુષો હર્ષશોક કરતા નથી. એવી અપમાન જનક પરાશા રાખવામાં ફાયદો પણ શો ! તેથી સંજન પુરુષો સંતોષને ધારણ કરી ગમે તેવી અવસ્થામાં પણ પોતાને સુખી માને છે.” સખીએ હિલાસો આપ્યો.

સખીની વાત સાંભળીને ચંદ્રકાંતા કહેવા લાગી. “હે સખી ! પારકી આશા સહાય નિરાશા ! પર આશા ઉપર જીવનનું જે અવલંબન છે તે પરાલવનું સ્થાનક છે. જે શાણાદિક કામલોગે. બીજા પાસેથી પ્રાર્થના કરીને લોગવવા છંછે છે તે પંચેંદ્રિયના પરાધિનપણુથકી નિશ્ચય-પણું પરાલવ પામે છે. એ લોગોને લોગવ્યા છતાં પણ પ્રાણીએ રહિને પામતા નથી. તો પછી લોગવ્યા છતાં. એવા લોગોનું અભિમાન પણ શું ! જરૂર આ બધા મોહના વિલાસો માત્ર છે. માટે હું તો હવે સ્વાધીન એવી પ્રવાનેજ અંગીકાર કરીશા, પરાધીન એવા આ કામ લોગાથી સર્હે.”

ચંદ્રકાંતાનાં વૈરાયયુક્ત વચન સાંભળીને સખીએ એના ચરણમાં નમસ્કાર કરતાં બોલી. “હે મહાદેવી ! પૃથ્વી ઉપર હેવસેન ભુપાળ રાજ્ય કરે છે તે આપને કાંઈ પરાધીન નથી. માટે આનું હસવાયોગ્ય બોલવું તમને યોગ્યનથી.”

“અરે ! આ સંસારનું સુખ મેં જોયું, સ્નેહીજનોનો સ્નેહ પણ જોયો. મુખે મધુરાં પણ પરિણામે કિપાકના ફૂલસમાન કરવા વિચાકવાળાં આ ભવસુખમાં સંજનનો જણ્યા પછી કાંઈ લુણ્ય થતા નથી. કારણું ધર્મનો ત્યાગ કરીને જે વિષયોની અભિલાષા કરે છે તે અમૃતનો ત્યાગ કરીને વિષનુંજ ભક્ષણ કરે છે. કદ્યું છે કે—

યતનેન પાપાનિ સમાચરંતિ, ધર્મ પ્રસંગાદપિ નાચરંતિ ।  
આશ્ર્યમેતદ્વિ મનુષ્યલોકે, ક્ષીરં પરિત્યજ્ય વિષ પિવંતિ ॥

**ભાવાર્થ—** રાતદિવસ મનુષ્ય નિઃશાંકપણે સંસારનાં પાપકાર્ય કરી રહ્યો છે. છતાં પર્વતીથિએ પણ ધર્મમાં લેશ પણ ઉધ્ભવ કરતો નથી, મનુષ્ય લોકનું એ આશ્ર્ય કાંઈ ઓણું છે કે હૃથનો ત્યાગ કરીને તે વિષનું પાન કરી રહ્યા છે.

માટે હે સખીએ ! પરમ શાંતિનું સ્થાન એવું સુનિખણું જ સુખદાયી છે. સંસારના સુખમાં લુખધ થઇને એ પરમસુખથી હું ઠગાધ ગાધ છું, વિષયો, કંડાધ, પરિવાર એ તો બધાં હુર્ગતિનાં કારણભૂત છે માટે મારે તો હવે અમણીધર્મ કલ્યાણરૂપ થાએ.

એ દરમિયાન પ્રતિહારીએ આવીને કહ્યું: “હે મહા-હેવી ! મહારાજ શ્રીસુએ કહેવરાબ્ધું છે કે શ્રી વિજયનામા તીર્થકરને વંદન કરવાને હું જાઉ છું ને તમે પણ તરાથી આવો !”

પ્રતિહારીના વચન સાંભળી તેને પુષ્કળ દાનથી રાજ કરી વસ્ત્રાલંકર ધારણ કરી રાણી રાજ સાથે જ્ઞનેશ્વરને વાંદવાને ચાલી. સમવસરણમાં વિધિપૂર્વક જ્ઞનેશ્વરને નમી વાંદી ચોઘ્યસ્થાનકે બેઢાં, ભગવાને દેશના દેવી શરૂ કરી.

હે ભાવ્યો ! આ ભયંકર સંસાર સમુદ્રમાં હુંઘ એ સાગર સમાન છે ત્યારે સુખ સાગરના પિંડ સમાન છે.

નરકગતિમાં પાપને કરનારા નારકીએ શરીત અને ઉષણ વેદના તેમજ શાસ્ત્રના વા, તપ્તવાલુકા અને શાદમલિ વૃક્ષના પત્રાદ્વિકથી થતી ભયંકર વેદના સહન કરી રહ્યા છે નિત્ય દશ પ્રકારની વેદના નારકીએ લોગવી રહ્યા છે. એક એકથી અનંતગુણીવેદના લોગવતા તેમને ત્યાં કોધનું શરણ નથી.

તિર્યંગતિમાં શીત, ઉષણુ, ભૂખ, તરસ, અંધન, ભારવહન આદિ અનેક પ્રકારનાં તેમને હુંખ સહન કરવાં પડે છે. એ હુંખો આપણે નજરે પણ જોઈ શકીએ છીએ.

દેવતાએને પણ ઈર્યા, વિષાદ, કોથ, લોલાદિક હોબો-વડે કરીને અનેક વિટભણાએ લોગવવી પડે છે. અથુ ઇદ્ધિવાળાએ મહુર્વિકની લોગ સામથી તેમજ તેમની ઉત્તમ દેવાંગનાએ જોઈ ઈર્યાથી બળી જાય છે. બળી ભરણ અવસરે તેમને અધિક હુંખ થાય છે, એ દેવતાએના લોગ, સમૃદ્ધિ, સાધ્યાથી છાડીને જવાના વિચાર માત્રથી પણ દેવતાએ કંપી ઉડે છે તો પછી અંતકાલના સમયે તો તેમના હુંખની વાતજ શી ?

મનુષ્યમાં પણ જરૂર, જરા અને મૃત્યુના હુંખ ઉપરાંત, દૌર્લભ્ય, દારિદ્ર રોગ, શોક, વિયોગ આદિ અનેક હુંખો રહેલાં છે, માટે હે બંધો ! આ ભયંકર હુંખાથી ઝુટવાને તમે અવિનાશી અને નિરાભાવ એવી મુક્તિની સાધના કરો. અને એ મુક્તિની સાધના માટે તમે જૈન ધર્મને વિષે આદરવાળા થાઓ.”

ભગવાનની દેશના સાંભળી દેવસેન નૃપે નગરમાં જઈ શૂરસેનને રાજ્યગાઢી પર સ્થાપન કરી જીનમંહિ રેમાં અષાનિહુકા મહોત્સવ કર્યો, સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધનનો વ્યય કરી દીન, અનાથ અને ગરીબ જનોને છુટે હાથે દાન આપી સાધ્યમિન્કને સંતોષી પરિશ્રહનો ત્યાગ કરી દેવી ચંદ્રકંતા સાથે જીનેશ્વરની પાસે દીક્ષા અહૃણ કરી, વિષય વિકારનો ત્યાગ કરી દર્શવિદ્ય સમાચારીપૂર્વક સત્તરે પ્રકારના સંયમનું આરાધન કરવા લાગ્યા. આરે પ્રકારના તપને કરતા દેવસેન રાજ્યિ સમતા રસને ઝીલતા સાંધુના ગુણોથી શોલવા લાગ્યા.

સિદ્ધાંતના ઉચ્ચય તત્વને જાણતા રાજ્યિ ભણી ગણી ને શાસ્ત્રના પારગામી થયા, ને અપ્રમત્તપણે ચારિત્રનું આરાધન કરેતા કર્મદીપી મહાથી આત્માને શુદ્ધ કરેવા લાગ્યા, બાર પ્રકારના તપને તપતા રાજ્યિ પાપદ્રપ કર્મનિ આપીને ભર્તમ કરેવા લાગ્યા. સંસારની મોહ માયાનો ત્યાગ કરી એક મુક્તિમાંજ લક્ષ્ય રાખી તેઓ નિરતિચાર-પણે ચારિત્રની આરાધના કરેતા હતા, એ રીતે કેલાક વર્પ પર્યંત તેમણે સંયમની આરાધના કરી.

પ્રાંતે દેવસેન રાજ્યિએ સંદેખના પૂર્વક આરાધના કરી, અનશન અંગીકાર કર્યે સુકૃત્યની અતુમોહના અને દુષ્કૃત્યની નિંદા કરેતા તેઓ પાપની આલોચના કરેવા લાગ્યા, મનમાં જીનેથીરતું ધ્યાન ધરતા તેઓ એક સિદ્ધોના ધ્યાનમાંજ લયદીન થધ ગયા. અનશન પ્રતમાં-શુલ ધ્યાનમાં રહેલા રાજ્યિ દેવસેન કાલ કરીને પંચમદેવલોક-અળદેવલોકને વિષે અછેમદ્રપણે ઉમ્મત થયા. દરા સાગરો-પમના આયુષ્યવાળા દેવસેન રાજ્યિ નરતાથ પછી સુર-નાથ થયા. ચંદ્રકાંતા પણ તે દેવલોકને વિષે દરા સાગરો-પમના આયુષ્યવાળો દેવ થયો, ત્યાં પૂર્વના સંસ્કારથી અજે મિત્રો થયા.

૧૦

### જનપૂજાતું આતિમ ઝલ.

આ ભરતક્ષેત્રના ભધ્યઅંડને વિષે રમણીય કુર્કેશા આવેલો છે ત્યાં ગજપુર નગરના રાજ શ્રીવાહનને લક્ષ્મી નામે પદરાણાની કુક્ષિને વિષે ચૌદ સ્વમ્ભરી સૂચિત દેવ-સેનનો જવ અળદેવલોકમાંથી ચ્યવીને ઉમ્મત થયો અને ચંદ્રકાંતાનો જવ ત્યાંતું દરા સાગરોપમનું આયુષ્ય પૂર્ણ

કરી શ્રીવાહન રાજના બુદ્ધિસાગર મંત્રીની સુદૃતા નામે  
પ્રિયાથકી પુત્રપણે ઉપ્ત્રન થયો. રાજપુત્રનું નામ પ્રિયંકર  
અને મંત્રી પુત્રનું નામ ભતિસાગર પાડ્યું.

બુદ્ધિને પામતા બને કુમારો પરભવના સ્નેહથી આ  
લઘુમાં પણ એક ધીજના વિચોગને સહન નહી કરેતા  
સાથે રમતા, સાથે ખાતા ને સાથેજ ઐલતા હતા, વિધા-  
લ્યાસ પણ સાથે કરેતા ને સાથેજ રહેતા હતા. ક્ષણભરની  
જુહાઈ પણ તેઓ સહન કરી શકતા નહિ. શાસ્ત્ર શાસ્ત્ર  
અને કળા કૌશલ્યમાં પાવરવા બની ગયા. કે કરીને  
સ્ત્રીજનાને પ્રીતિ કરવામાં સુલલ નવીન યૌવનને આંગણે  
આવ્યા, તેઓ લલિત લલનાઓને પ્રાર્થના કરવાચોય થયા.

શ્રીવાહન નરપતિએ રાજકુમાર પ્રિયંકરને યૌવન  
અવસ્થામાં આવેલો જાણી અનેક રાજઓની કન્યાઓ  
સાથે પાણિયહુણ કરાવ્યું. મંત્રીએ પણ ભતિસાગરને  
અનેક મંત્રી પુત્રીઓ સાથે પરણાવ્યો. પોતાપોતાની પત્ની  
સાથે અતુપમ સુખને લોગવતા રાજકુમાર અને મંત્રીપુત્ર,  
જતા એવા ડાલને પણ જાણતા નહિ. જીવને સુખમાં સમય  
શિધતાથી પસાર થધ જાય છે ત્યારે હુંમાં...

એક દિવસે શ્રીવાહન નરપતિએ ગુરુનો ઉપદેશ શ્રવણ  
કરી સંસારસાગરને અસાર જાણુતા અને વિષયોને નિરસ  
માનતા તેમજ સ્ત્રીઓને નરકની હુતી સમાન ગણુનારા  
તેમણે રાજકુમાર પ્રિયંકરને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, દેવ  
મંહિરીમાં ભહાન પૂજાઓ રચાવી, અથાષનિક મહોત્સવ-  
પૂર્વક સંસારસાગરને તારનારી દીક્ષાને શ્રીશુતસાગર ગુર  
પાસે અહુણ કરી. પોતાના સ્વામિ સાથે બુદ્ધિસાગર  
મંત્રીએ પણ ભતિસાગરને મંત્રીપદ સ્થાપન કરી ચાંડ એલું  
ભોક્ષ લક્ષ્મીને આપનારં ચારિત્ર આંગીકાર કર્યું. એ રીતે

અજેએ પોતપોતાનું આત્મહિત કર્યું, ને સંસારની ઉપાદ્વિધી મુક્ત થયા.

રાજ્યગાહી લોગવતાં ને ન્યાયથી પ્રભાનું પાલન કરતાં પ્રિયંકર નરપતિના શાસ્ત્રાગારમાં ચક્રેલ ઉત્તેજ થયું. એ હિવ્ય ચક્રના પ્રભાવથી પ્રિયંકર નરપતિએ પદ અંડ ભર્તાને લુતી લીધું ને પ્રિયંકર ચક્રવર્તી થયા, બનીસ હળર મુખુટઘ રાજેએ એમની સેવા કરવા લાગ્યા. ચોસઠ હળર રમણીજનના પ્રિયતમ-સ્વામી થયા. ચૌદ રેલના સ્વામી એવા પ્રિયંકર ચક્રવર્તી પોતાના પરાક્રમથી ઉપાર્જન કરેલા ચક્રવર્તીના મનોહર લોગોને લોગવવા લાગ્યા. મોદ્ય સાઓન્યવાળા અને પદ અંડની સાધ્યાભીવાળા ચક્રીને અનેક મંત્રીએ હોવા છતાં પણ મતિસાગર મંત્રી સમાન હોઈ પ્રિય નહોંનું. પરભવના સ્નેહ સંધંધથી આ ભવમાં પણ એમના જીવનમાં પ્રિયમાં પ્રિય મતિસાગર હતા. કે જેદ્દી પ્રીતિ એમને પોતાની રમણીએમાં કે સ્ત્રીરેલમાં પણ નહોંતી.

મતિસાગર પણ હેવતાની માર્ક ચક્રવર્તીની સેવા કરતા હતા. પોતાનું ચિત્ત અને વિત્ત અગર તો સર્વસ્વ મંત્રીને ચક્રીજ હતા. એ પ્રમાણે અન્ને ગાઢ પ્રીતિવાળાને એક બીજામાં અજય આકર્ષણે ધારણ કરેનારા તેઓ પણ આ સ્નેહનું વાસ્તવિક કારણ સમજી શકતા નહિ. જેથી જ્ઞાની પાસે એનો ઝુલાસો મેળવવાને અન્ને આતુર હતા.

એક હિવસે સુખલ નામે તીર્થીકર ભગવાન ગજપુર નગરના ઉધાનમાં સમવસર્યા, પણ છત્ર, ભામંડલ, ધર્મચક, સિંહાસન, ચામર, દુંહલિ, સુર પુણ્યવૃષ્ટિ અને અશોકદુક્ષ એ આડે પ્રીતિહાર્યથી શોભતા જનેથે.

ભવ્યજનોને ખારે પર્વિદ્ધ આગળ દેશના આપવા લાગ્યા.

જુનેથીરનું આગમન સાંભળીને તેઓ અને-ચડી અને મંત્રી પોતપોતાના અંતઃપુરાદિક પરિવાર સાથે ભોયા આડં-બરપૂર્વક જુનેથીરને વાંદવાને આવ્યા. સમવસરણ દશ્ટિ જોયર થતાં રાજયિનહુનો ત્યાગ કરી સમવસરણમાં આવ્યા, જુનેથીરને નમી વાંદીને યોગ્ય સ્થાનકે બેઠા.

હે ભવ્યો ! જન્મ, જરા અને મૃત્યુથી હુઃખ પૂર્ણ એવા આ ભવાર્ષિકને વિષે પુણ્યરૂપ વહ્ણાણમાં આડંથદિને તમે સમુદ્રને તરવાનો પ્રયત્ન કરો, આ અસાર સંસાર સમુદ્રમાં વિધિરૂપ ધીવર દ્વારણ હુઃખદાયી એવા મૃત્યુરૂપી મહાભાગવતે કરીને વિષચોના આકર્ષણુથી-ચીધીયાથી સમગ્ર પ્રાણીએને પકડી લે છે ને કર્મઝર્ષી કુઠારવતે કરીને તેમનાં છેદન કરી નાખે છે. અજ્ઞાની જનો તો એ કષ્ટને ભોગવે પણ ગુણવાન અને સમજુ પુરુષો પણ આવા ભવ-સાગરમાં ડલ્લી મરે છે છતાં તરવાનો પ્રયત્ન નથી કરતા એ એછું આશ્ર્ય છે ?

સંસારમાં કેટલાક દીક્ષાના અર્થી હોવા છતાં કાળ વિલંઘ કરવા જતાં એમના મનોરથો અપૂર્ણ રહી જાય છે ને હુઃખી હુઃખી થધ જાય છે. કેટલાક જ્ઞાનીજનો સંસાર તરવામાં કુશળ છતાં કુશાહૃદિપ કદાચહ્ના વશથી પાતા-લમાં ડલ્લી જાય છે. કેટલાક સંસાર સમુદ્રને તરીને કાંઠ આવ્યા છતા ત્યાંથી પ્રમાદરૂપી કાઢવમાં મગ થઈ નીચે પડે છે. માટે હે ભવ્યો ! તમે બોધ પામો ! બોધ પામો ! ભોગરૂપી રોગીયાથી લયંકર આ સંસારના મોહમાં ન લય-દાવ ! અપ્રમત્તરૂપી વહ્ણાણમાં આડંથદિને આ સંસાર સાગરનું ઉલંઘન કરી અનંતસુખના ધામ સુક્ષ્મિનગરને તમે પામો.

સુપ્રભ જીનેશ્વરની દેશના શ્રવણ કરી મોહરીપી અંધ-  
કારને નાશ થતાં જ્ઞાનરૂપી લોચન ઉઘડી ગયાં છે જેનાં  
એવા ચક્કવતી યોાલ્યા. હે ભગવાન ! આપની વાણી સત્ય  
છે. ધર્મરૂપી નાન વગર સંસારસમુદ્ર તરી શકતો નથી, પુત્ર,  
કલત્ર આદિના સ્નેહથી બંધાધને જાત્યંધ ઐઠે પ્રાણી પ્રિય  
કે અપ્રિય કંધ જોઈ શકતો નથી. પરંતુ આપના પ્રસા-  
દથી અમે શુદ્ધ તત્વને જાહેરું, છતાં મારે અને મંત્રી મતિ-  
સાગરના અર્દસપરસ ગાઠ આકર્ષણ પ્રીતિના સંખ્યાંધનો  
આપ પ્રકાશ કરો.

ચક્કવતીના પ્રક્રિયા જવાબમાં જીનેશ્વરે શુકના ભવથી  
તે ચક્કિના ભવસુધીનો એ બજેનો પરલબનો સંખ્યાંધ કહી  
સંભળાવ્યો. તમે બન્ને સરખુ પુષ્ય ઉપાજ્ઞન કરેલું છે ને  
કલ પણ સરખુ લોભન્યું છે, તમે શુકના ભવમાં જીને-  
શ્વરની પૂજા કરી તેજી તમે બીજ વાવેલું તે પુષ્યદ્વારી  
વૃક્ષ અત્યારે ફાલેલું ખીલેલું છે અને કેનું કલ તો તમારે  
સિદ્ધ ગતિ પ્રાપ્ત કરીને લેવાનું છે. પ્રભુનું વચન સંભળિની  
બન્નેને જતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે બન્ને  
એ પોતાના પૂર્વ લવ જોયા, જ્ઞાનથી વૈરાઘ્ય સન્મુખ  
થયેલા ચક્કી અને મંત્રી બન્ને ચારિત્ર લેવાને તૈયાર થયા.

જીનેશ્વરને વાંદી ચક્કી અને મંત્રી પોતાના પરિવાર  
સાથે નગરમાં ગયા. ચારિત્રને અહેલુ કરવાની પ્રયત્ન  
આકંક્ષાવાળા ચક્કીએ પદ્ધ ખંડનું મોટી સમૃદ્ધિવાળું રાજ્ય  
તૃપ્તિની માર્ક ગણી પોતાના જેઠ પુત્રને સૌંઘી હીધું. પુત્ર,  
કલત્ર અને સ્નેહી જીનોના સ્નેહની મજબુત સંકળ પણ  
તંતુની માર્ક તોડી નાભી. ચોસડ હજાર સ્વીચ્છાના સ્ને-  
હોનો ત્યાગ કરી કથીરની જેમ ગણી તેમને છાડી હીધી.  
ત્રોમના હીન વચન કે રૂધન તરફ પણ ધ્યાન ન આપતાં  
ચક્કી હીક્ષા લેવાને તૈયાર થયા.

જ ખંડની સાથ્યથીનો ત્યાગ કરી પ્રિયંકર ચહીએ મંત્રી ભતિસાગર સાથે લગવાનની પાસે હીક્ષા અંગીકાર કરી.

આમ રાજ અને મંત્રી ચારિત્રને પાળતા તપ તેજથી શોલવા લાગ્યા, અનુકૂળે તપદપ અભિથી કર્મરૂપી કાણે તેમણે બાળી લસમ કરી નાખ્યા. ને સંસારરૂપી સાગરનો પાર પામ્યા. આથુઃપૂર્વ કરી તેઓ અનંત, અવ્યાખ્યાય સુખના લેાગવનારા થયા, એ પ્રમાણે અજ્ઞાનથી કરેલું દ્વિયસ્તવ પણ પરંપરાએ વિશેષ સુખના હેતુદપ થયું તો જ્ઞાનયોગથી અહુમાનપૂર્વક શક્તાદપ અમૃતવડે કરીને જો દ્વિયસ્તવ કરવામાં આવે તો જરૂર કલ્યાણને કરનાર થાયા. એ પ્રમાણે ગુરુ પાસેથી દ્વિયસ્તવ સંભંધી કથાને સાંલળી પ્રિયા સહિત દેવસિંહ કુમાર ધર્મ પામીને પોતાને સ્થાનકે ગયો. ગુરુ મહારાજ પણ વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.

૧૧

### શાવકુ ધર્મરાધન.

ચલાવિભૂતિઃક્ષણમંગિયૌવનં, કૃતાંતદન્તાન્તરવર્તિં જીવિતમ् ।  
તથાપ્યવજ્ઞા પરલોકસાધને, અહો નૃણાં વિસ્મયકારિ ચેષ્ટિતમ् ॥

ભાવાર્થ—લક્ષ્મી, ઘૈથ્ર્ય, ઠકુરાધ, સંપત્તિએ એ બધી ચપળ છે. યૌવન ક્ષણલંગુર છે, કાલાંતરે વિનથરે થવાનું છે અને જીવિત તો યમની એ દાહોની વચ્ચે રહેલું છે છતાંય મનુષ્યો પરલોકને વિષે સુખ કરનાર ધર્મ સાધવાની અવજ્ઞા કરે છે તે ખરેખર એમનું ચેષ્ટિત આશ્ર્ય-કારી નથી શું!

થસુરના નગરમાં સુખથી કાલ નિર્ગમન કરતો દેવ-સિંહ કુમાર યથાશક્તિ ધર્મનાં અનુષ્ઠાન કરવાનું પણ

જૂદી જતો નહિ. પણ માતાપિતાનું સમરણ થવાથી હેવસિંહ કુમારે સ્વદેશ તરફ જવાની તૈયારી કરી, રાજની અતુલા લઈ મેટી ઝડ્ધિસિંહ અને સમૃદ્ધિપૂર્વક વાહિનોના મધુરા નાદોથી જેણે પ્રસ્થાન કર્યું છે એવા હેવસિંહ કુમારે પોતાના સૈન્યની સાથે સ્વદેશના માર્ગે પ્રયાણ કર્યું, પ્રિયાની સાથે આમ, નગર, આરામાહિ જોતો, પદ્ધતીને વિષે પદ્ધતીપતિથી પૂજાતો ને માની રાજાઓથી માન મેળવતો ગિરિ, નદી, તલાવ, વાવ આદિમાં કીડા કરતો, પર્વત, નગર, શહેર વગેરેમાં જીનેશ્વરની પૂજાને રવાવતો, હુંઘી જનોને દાનથી રાજ કરતો, અતુક્તમે મધુરા નગરીમાં આવ્યો.

પિતાએ મોટા આડંખરપૂર્વક પ્રવેશ મહોત્સવ કર્યો, સકલ જનોને દાન માન દિલ્લી અને મનોહર વાણીથી સંતોષ પમાડતો હેવસિંહ કુમાર પોતાના નગરમાં મોટા આડંખર સાથે આવ્યો, નગરના નરનારીઓથી વારંવાર જોવાતો હેવસિંહ ઘણે સમયે નગરમાં આવવાથી સર્વેના હર્ષનું કારણ થયો ને રાજ વગેરે પરમ આનંદ પામ્યા.

એકદા પરમ ભાગ્યવાળા હેવસિંહને પોતાની પાટે સ્થાપન કરી મેધરથ રાજાએ વૈરાઘ્યના રંગથી રંગાઠને મુનિની પાસે ચારિત્ર અંગીકાર કરી મુક્તિની લક્ષ્મીને મેળવી લીધી, હેવસિંહ નરપતિએ ચુદ્ધ કર્યા વગર અનેક દુર્બિન્ત રાજાઓને પોતાના પ્રતાપથી વશ કરી લીધા ને ન્યાયથી એકચેકે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો.

સંસારનાં સુખ જોગવીને થાકી રહેલો નરનાથ હેવસિંહ એક હિવસ પ્રાતઃકાળે નિદામાંથી જગત થયેલો વિચાર કરવા લાગ્યો “આ પૃથ્વી ઉપર જે રાજાઓએ પોતાના રાજપાઠનો ત્યાગ કરી દીક્ષા :અંગીકાર કરી છે

તેમનેજ એક માત્ર ધન્ય છે અને હું તો અધન્ય છું કે જાણવા છતાં વિરતિ પ્રાપ્ત કરવાનો ઉદ્ધમ કરતો નથી. એ મોહરાજનો મારા ઉપર કેટલો બધો પ્રભાવ છે તે સચ્ચે છે. પિશાચીની માર્ક લોગની લાલસા મને વળગેલી છે જેથી અધારિ ધંતુરો પીધેલાની માર્ક હું એમાં મુંજાઈ ગયેલો હું. દુષ્ટ કામડીપી કિરાતે માર્દ વિવેક રત્ન હુંટી લીધું છે. દંડિયદીપી લુંભરાઓએ માર્દ ભાવડીપી ધન લુંટવામાં મણા રાખી નથી. જેથી દુષ્ટ ચારિત્ર મોહનીય કર્મડીપ શયતાનને હું શી રીતે જીતી લાઘશ? અથવા તો તેને જીતવાનો ઉપાય પૂર્વ સૂરીધરે ભતાવેલો એવો દ્રવ્યસ્તવ હું આદર, કે જેનાથી મને ભાવસ્તવની પ્રાપ્તિ થાય."

એક રમણીય સુપ્રભાતે જાગત થયેલો રાજ એ પ્રમાણે ભાવના ભાવતો દ્રવ્યસ્તવ આદરવાને તૈયાર થયો. એક પ્રશસ્ત મુહૂર્ત જોવરાવી તે સારા સુહૃત્તે શુદ્ધ પૂર્ણીને જોવરાવી કેટલાક સૂત્રવારોને જીનમંહિર તૈયાર કરવાની આજા કરી, કેટલાકને જીન પ્રતિમા તૈયાર કરવાને ઝે-માધ્યું, પાતે પણ અફાર્યદિને ધારણ કરતો એ ધર્મ કાર્ય તરફ અપૂર્વ ઉત્સાહ ધારણ કરવા લાગ્યો.

જીન પ્રાસાદ અને જીન પ્રતિમા તૈયાર થતાં સારા સુહૃત્તે રાજએ ગીતાર્થ યુરની પાસે અર્હતિંધને વિધિ વિધાન કરવાપૂર્વક મંહિરને વિષે સ્થાપન કરાવ્યા. તે નિભિતે મોટા પ્રતિષ્ઠામહોત્સવ કર્યો.

પ્રિયા સહિત રાજ એ જીન પ્રાસાદમાં પ્રણે કાલ જીનપૂજન કરવા લાગ્યો. શરીરનાં અને મનનાં પાપને એ રીતે દૂર કરવા લાગ્યો. એ ભાવ્ય જીનમંહિરમાં પાત્રો નૃત્ય કરવા લાગ્યાં. ગવૈયા પુરુષો ગાયન કરવા લાગ્યા. કિન્જર ખુગલો

અનગુણનું પોતાના મધુર સ્વરે ગાન કરવા લાગ્યાં. રાજ કોઈ કોઈ સમયે રથયાત્રા કરતો, મહાપૂજના મહોત્સવે કરતો ઉધાપન ઉજવતો હતો, જે મહાપૂજના ઉત્સવો અનેક લોકોના દર્શનના કારણભૂત થતા હતા. એ નિમિત્તે રાજ હાન આપતો હતો કે જેથી લોકો રાજની અન ભક્તિનાં વાખાણ કરતા હતા, બીજા અનમંહિરોમાં પણ અન પૂજાઓને રચાવતો મોટા મહોત્સવોને કરતો પોતાના સમકિતને શોલાવવા લાગ્યો, જૈનધર્મને જગત ભરમાં પ્રસિદ્ધ કરી લોકોને પણ ધર્મના અપૂર્વ રાંગી બનાવ્યા.

રાજ જૈનશાસનના પ્રભાવક થવાથી પ્રજા પણ જૈનધર્માનુરાગી થઈ છતી અનેથરની ભક્તિ કરવા લાગી, સાધુઓને હાન આપી પોતાનો ભાનવલબ સર્કલ કરવા લાગી. અનેથરની પૂજામાં પ્રીતિ ધારણ કરી જૈન શાસનનો ઉદ્ઘોત કરવા લાગી, એ પ્રમાણે દ્રવ્યસ્તવપૂર્વક ભાવથી જૈનધર્મનું આરાધન કરતાં દેવસિંહ નરપતિ વૃદ્ધ થઈ ગયા.

અમણુધર્મને અંગીકાર કરવાની ઇચ્છાવાળા ભાવ સંયમી નરપતિ વિચાર કરવા લાગ્યા. “ગૃહસ્થ ધર્મરિપી તરફનું કલ અમણુધર્મ તો હવે મારે માટે તો ચોણ છે પણ શું કરું? મારો પુત્ર હજુ બાલક છે, જેથી તેનો ત્યાગ કરવાને હું શક્તિવાન નથી. પરન્તુ હાલમાં તો એ ભાલક કુમારને રાજ્યે સ્થાપન કરી હું નિર્બિધારવાળો થાડિ, જ્યારે આ મોટા થશે ત્યારે હું પ્રવજ્યા અંગીકાર કરીશ.”

રાજએ સર્વ જનની સંમતિથી નરસિંહ કુમારનો રાજ્યાલિષેક કર્યો ને આવકાં પંચ અણુપ્રતને ધારણ કરતો નરપતિ દેવસિંહ રાજ્યની ઉપાધિથી મુક્ત થઈને ધર્મના અતુધાનની ડિયામાં રક્ત થયો. વિવિધ પ્રકારનાં તપને કરતાં રાજએ પોતાની કાયા શોષવી નાખી, ચારિત્ર

ત હોવા છતાં ભાવચારિત્ર અથવા ચારિત્રના પરિણામને ધારણ કરતો રાજ દોષરહિત અનશનને કરીને કાલધર્મ પામી સાતમા મહાશુક દેવલોકને વિષે સતર સાગરોપમના આયુવાળો દેવ થયો, ત્યાં ધર્મરૂપી કદ્યવૃદ્ધના ક્લને લોગવવા લાગ્યો.

કનકસુંદરી પણ રાજની સાથે વિશુદ્ધ એવા શ્રાવિકા ધર્મનું આરાધન કરી અનેક પ્રકારનાં તપને કરતી શરીરે ક્ષીણ તેજવાળી થઈ છતી મરણ પામીને સાતમા સ્વર્ગને વિષે તે જ વિમાનમાં સતરસાગરોપમના આયુવાળો દેવ થયો.

### પરિચ્છેદ ૪ થો।

હેવરથ અને રત્નાવલી.

—(૦)—

૧

સાતમા ભવમાં.

ગ્રણમ્ય પરયા ભક્ત્યા, પાર્શ્વનાથ જિનોત્તમમ્ય ।

ચતુર્થસર્ગસંબંધઃ પ્રોચ્યતે શુદ્ધભાષયા ॥૧॥

ભાવાર્થ—અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિવડે કરીને જોને વિષે ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ચોથા સર્ગનો સંખ્યાં શુદ્ધ ગુજરાતી ભાષામાં હું કહીશા

આ જાણુદ્વારાના પૂર્વવિદેહને વિષે સુકૃષ્ણ નામની વિજયમાં સુરપુરી સદ્ધા અયોધ્યા નામે નગર આવેલું છે, કે જે શહેરના પ્રાસાદોની ઉપર મધુર કિલકિલાઈ કરતાં

મહુરો નૃત્ય કરી રહ્યા હતા. અશોની ખરીઓથી આકાશમાં ઉડતી ધૂલિ વજરાનેના મહાલથી સિંચાતી છતી આર્દ્રતા ધારણ કરી રહી હતી. નગરીના રમણીય અને વિશાળ હિંદ્રા પ્રાસાદો નલોમંડલ સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હોય ને શું !

એ રમણીય અને વિશાળ દેશનો ધણી વિમલકીર્તિ નામે રાજ, એનાં અંતઃપુરની રાણીઓમાં પ્રિયમતી નામે પદ્મરાણી, તેની કુક્ષિને વિષે સાતમા સ્વર્ગથી વ્યવીને અંવસિંહનો લુલ ઉપ્ત્ર થયો, પદ્મરાણીએ સ્વમામાં સુશોનાલિત અને શાણગારલોલા દિવ્ય રથ જોયો, એ સ્વમ રાજને કહેવાથી રાજએ કહું. “તમારે ઉત્તમ, રાજલોગને યોઽય મુલક્ષણવંત પુત્ર થશો.”

પટિના વચનથી હર્ષ પાંજેલી રાણી ગર્ભતું સારી રીતે પોપણ કરવા લાગી. પૂર્ણ દિવસે શુલગહુના યોગ આવ્યે છતે રાણીએ પુત્રનો જન્મ આપ્યો. રાજએ મોટા જન્મમહોત્સવ કર્યો. બારે દિવસે સ્વમને અનુસારે રાજકુમારનું નામ રાખ્યું હેવરથ.

હેવરથ રાજકુમાર દ્વિતીયાના ચંદ્રની માઝુક વૃજિ પામવા લાગ્યો. યોઽય વયનો થતાં શાસ્ત્ર અને શાસ્ત્રની કળાનો અભ્યાસ કરી તેમાં નિપુણ થયો. સુંદર આકૃતિવાળો તે રાજકુમાર સરલ, શાંત, સંતોષી, દ્વાર્ગુ, સત્ય લાખી સજજનોને પ્રિય મહુર વાણી બોલનાર એવા અનેક શુષ્ણોએ કરી ગુણવાન થયો. અનુકૂમે કામહેવને હીડા કરવાને નાનવન સમાન યૌવનવયમાં આવ્યો.

લુલનને આનંદ આપનારં યૌવનવય છતાં લલિત દ્વારનાએ હેવરથને પોતાના નેત્ર કદ્યકથી મોહ પમાડી શકી નહિ, વિષયોથી વિરક્ત એવો તે કુમાર પોતાના

મિત્રો સાથે પણ નિર્દેખ જોછિ કરતો ને સજજનોને આનંદ પમાડતો, પરેપકાર કરીને યોતાના હિવસો સુખમાં વ્યતીત કરતો હતો, તારણ્ય વયમાં પણ સ્થીયો તરફ અરસિક એવો તે રાજકુમાર શાસ્કોના અગાધ તત્વોનું ચિંતાવન કરતો એના આનંદમાં જ મસ્ત બની રહ્યો હતો.

તે વિજયને વિષે સુપ્રતિક નામે નગરમાં રવિતેજ નામે રાજને ત્યાં વસંતસેના નામે પઢુરાણીને એક પુત્રી થધ, કનકસુંદરીનો। જીવ મહાશુક હેવલોકનાં સુખ લોગવી રવિતેજ રાજને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયો, સ્વમામાં રનાવલી જોવાથી રાજએ પુત્રીનું વામ રત્નાવલી રાજણું રત્નાવલી ભણી ગણી યૌવનવયમાં આવી. યૌવનવયમાં આવેલી રત્નાવલીના સૌંદર્યની અને એના ગુણોની સુવાસ દેશપરદેશ પ્રસરી ગઈ, એ કમળની સુવાસનાના સોલી અનેક રાજકુમારો તરફથી એની માગણી થધ, છતાં વિષયાથી વિરક્ત રત્નાવલી તત્વોના ચિંતાવનમાં જ રમણ કરતી અને લગ્નની વાત પણ કરતી નહિ.

વિવાહને યોગ્ય થયા છતાં રત્નાવલીની લગ્ન તરફ ઉપેક્ષા જોઈ રાજએ સ્વયંવરની તૈયારી કરી, હૃતો મોકલીને દેશપરદેશથી અનેક રાજકુમારોને તેડાવ્યા, એક ચતુર હૃતને અચોધ્યા વિમલકીર્તિ રાજની પાસે મોકલ્યો. તે હૃતે રાજસભામાં પ્રવેશ કરી રાજને પ્રાર્થના કરી, “હે પ્રભો ! રવિતેજ રાજએ આપને વિનંતિ કરી છે કે આપે હેવરથ કુમારને સ્વયંવરમંડપમાં મોકલવા, આ અમારી રાજકુન્યાની સંભતિથી રવાયેલા સ્વયંવરમાં અનેક રાજકુમારોની સાથે હેવરથકુમાર પણ ભલે આવે, આવો યોગ્ય અવસર કોને ન ઇચ્છે ? રાજકુમારના આવવાથી બધું સાર થશો.” હૃતની વાળી સાંભળી રાજએ હેવરથકુમારને યોલા-

વીને કહ્યું. “રાજકુમાર ! રવિતેજ રાજાએ પોતપોતાના લાગ્યનો નિર્ણય કરવાને અનેક રાજકુમારોને તેડાવ્યા છે. તો એ સ્વયંવર મંડપમાં જવાને તું પણ તૈયાર થા, કે કેથી ભાગ્યાભાગ્યનો નિર્ણય થાય ?”

દાક્ષિણ્યતાથી પિતાનું વચન અંગીકાર કરી પોતાની ના મરણ છતાં દેવરથકુમારે સ્વયંવરમાં જવાની તૈયારી કરી. ચતુરંગી સેના અને સુલટોના સમૃદ્ધાય સાથે રાજકુમારે શુલભુલૂર્ણે પ્રયાણ કર્યું. અનેક ગામ, નગર પર્વત અને નદીનાળાંને જોતો રાજકુમાર એક અરવીમાં આવ્યો.

એ લયંકર અરણ્યમાં છેદાયેલી પાંખવાળા પક્ષીની માડક કોઈ સુંદર અને નવજવાન પુરુષને દીનતા ધારણ કરેલો ને ભૂમિપર પડેલો રાજકુમારે જોયો, એ ભાગ્યવાન નરને જોઈ રાજકુમાર વિચારમાં પડ્યો. “કેવો ભાગ્યવાન-સૌભાગ્યવાન છે છતાં અત્યારે દીન રંકના જેવો થઈ ગયો છે.”

રાજકુમાર એ નરની પાસે આવીને બોલ્યો. “હે ભાગ્યવાન ! તારા જેવો પુરુષ આવી રીતે એકાકી આ ભયંકર જગંગલમાં કયાંથી ? આકાશમાં ઉછળી વારંવાર ભૂમિ પર કેમ પડી જય છે ?”

એ રાજકુમારની વાણી સાંભળી તે પુરુષ બોલ્યો. તમે જે કે જવાની તરાવાળા જણાઓ છો છતાં મારી થાડી વાત પણ સાંભળો. આ વિજયમાં વૈતાત્ય પર્વત ઉપર કુંઠલપુર નામે નગરનો શ્રીધ્વજ નામે વિદ્યાધરોનો રાજ છે તેનો ચંદ્રગતિ નામે હું પુત્ર છું. પોતાના વંશમાં ચાલી આવતી વિદ્યાર્થી મરણ સુજઘ આકાશમાં ગમન કરતો હું ચાલ્યો. જતો હતો, તે સમયે વસ્ત્રથી આચાદિત એક મૂર્ખાહર ભાગાને મૂર્ખિંદિત સ્થિતિમાં જોઈ, તેની સખીએં

એની પાસે આઈંદ કરી રહી હતી તે મને જોઈને યોદી,  
“હે ઉતામ ! અહીં આવ ! અહીં આવ ! આ ગંધર્વ  
રાજકુન્યા આશીર્વિપ સર્પના વિપથી મૂર્ચિત થઈ ગાડ છે  
તેને શિધતાથી જીવિતદાન આપીને સજજ કર.”

એ સખીઓનાં વચન સાંભળી હ્યાથી કોમલ હૃદય-  
વાળા મેં જલ મંગાવી મારી પાસે રહેલી રત્નમય મુદ્રિકાથી  
પ્રક્ષાલિત કરીને એ જલનો તેના શરીર ઉપર અલિષેક  
કર્યો. તે સમયે તેના વામ હૃસ્તમાં રહેલી મુદ્રિકા મેં  
અહુણ કરી. એ મણિરત્નના અચિત્ય પ્રભાવથી સુલેદો  
માણસ એઠો થાય તેમ તે ખાળા સાવધ થઈ ગાડ. પર-  
પુરુષને જોઈ લજનથી વસ્ત્રના પાલવમાં પોતાના નાળુક  
અંગોને ઝુપાવતી સખીઓ તરફ નજર કરતી યોદી.  
“અરે ! આ બધુ છે શું ? તમારી આંખમાં તો અશુ છે  
ને તમે હસો છો કેમ ? ને આ મહનાવતાર પુરુષ કોણું છે  
સે તો કહો ?”

“બહેન ! આપણે અહીંયાં કીલા કરવાને આવેલાં તે  
દરમિયાન અચાનક કૃષ્ણસર્પના કરવાથી તું યેલાન  
ઘની ગઈ. જેથી અમે રડતાં હતાં પણ આ ઉતામપુરુષે  
તને સાવધ કરવાથી અમે ખુશી થયાં.” સખીઓએ ખુલાસો  
કરવાથી તે ખાળા મારી તરફ રાગદશ્ટિથી જોતી વિસ્મય  
ખામતી વળી યોદી. “અરે ! અરે ! મારી મુદ્રિકા  
ક્યાં ગાડ ?”

“અરે બહેન ! તારી મુદ્રિકા તો તારા ઉપકારીના  
હાથને શોભાવે છે ન એની મુદ્રિકા તારા હાથને.”

લજનથી નાનુભૂખી તે ખાળા ક્ષણમાં મારી તરફ તો  
ક્ષણમાં સખીઓ તરફ જોતી શું યોલવું તેના વિચારમાં  
ખડી ગઈ. તે દરમિયાન પ્રતિહારીએ નિવેદન કરવાથી એના

ખિતા ગંધર્વરાજ આવી પહોંચ્યા. મારી હકીકત જાણી તે રાજએ પોતાની પુત્રીને મારી સાથે પરણાવી દીધી, અમે અજ્ઞેયે સુખમાં વણે કાલ વ્યતીત કર્યો.

એકદા દક્ષિણસુદ્રને કિનારે ઉધાનમાં અમે કીડા કરવા ગયા, ત્યાંથી મારી પ્રિયા સાથે પાણો કરી મારા નગરમાં હું જતો હતો ત્યારે ભાર્ગમાં મારી ફેઠને પુત્ર સુમેધ નામે વિદ્યાધર ભદ્ર્યો મને જોઈને છિંદ્યાથી બળતો મારી સામે લડવાને આવ્યો, હું પણ તેની સાથે લડવાને તૈયાર થયો.

દૈવવશાત્ ચિત્તની વ્યાપ્તાથી વિદ્યાનું એક પદ ભૂલી ગયો, જેથી હું ભૂમિ ઉપર પડી ગયો, એ મારી ગઢલતનો લાલ લઈતે મારી પ્રિયાને લઇ ચાલ્યો ગયો. હું એ ભૂલેલા પદને ઘણું ચાદ કર્યા છું પણ ચાદ ન આવવાથી ઉડવા જતાં વારંવાર ભૂમિ ઉપર પડી જાઉ છું.” તે વિદ્યાધરે પોતાની વાર્તા એ રીતે ફંકાણમાં કહી સંભળાવી.

ચંદ્રગતિ વિદ્યાધરની હકીકતથી હંખી થયેલો દેવ-રથકુમાર બોલ્યો. “લાઈ! તમારા જેવા સમર્થ પુરુષનો હું શું ઉપકાર કરી શકું, તથાપિ તમારી વિદ્યાનો કદ્વપ તમને જેઠેલો ચાદ હોય તેથેલો ભણી જાઓ.”

રાજકુમારની મધુર વાણી સાંભળી વિદ્યાધર એ આકાશગામી વિદ્યાનો કદ્વપ પોતાને ચાદ હતો તેથેલો ભણી ગયો. પણ એમાંનો છદ્દલો ભાગ ચાદ આવ્યો નહિ, તેથી ચાદ હતો તેથેલો બોલીને અટકી ગયો.

પગનુસારી લભિષથી રાજકુમાર આગળનાં પદ કહી સંભળાવતાં બોલ્યો.” આકીનો ચાદ આ પ્રમાણે છે કે નહિ ?”

“અરાધર એમ છે.” વિદ્યાધર તે પણ સાંભળીને પોતાની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરતો બાબ્યો. રાજકુમારને પણ એ વિદ્યા સિદ્ધ થાઈ ગઈ.

“હે મિત્ર ! તમારા જેવા ચુણવંત પુરુષ કૃત્યાત્મક હોય છે. મારા સારા ભાગ્યે મને તમારું દર્શન થયું” ને મારું કાર્ય સિદ્ધ થયું, પણ મારે હુંબે મારા શત્રુની ઘણર લેવા જરૂર જોઈએ. તેથી મને કે તમને કાલક્ષેપ પાલવે તેમ નથી, જ્તાં તમારો ઉપકાર મારી ઉપર અપાર છે તેના અદાલામાં મારી પાસેથી આ વૈકિય વિદ્યાને અહૃત્ય કરો જે પાડ કરવાથી જ સિદ્ધ થશે.” ચંદ્રગતિ વિદ્યાધર રાજકુમારને વિદ્યા આપીને મહુર વચનથી ઉપકાર માનતો આદ્યો ગયો.

રાજકુમાર પણ બન્ને વિદ્યાઓથી શોભતો ને અતિ અળવાન થયેલો આગળ ચાદ્યો તે સુપ્રતિષ્ઠપુર નગરે આવી પહોંચ્યો.

ચંદ્રગતિ વિદ્યાધર ઉપર ઉપકાર કરવાથી એના મનમાં હુએ હતો, પરોપકારીઓના સ્વભાવજ એવો હોય છે કે જેએ પારકા ઉપર ઉપકાર કરીને રાજ થાય છે. રાજકુમારને તો ઉપકાર કરવા જતાં એ મહા વિદ્યાનો લાલ થયો. એ અધ્યાંય પૂર્વના સુકૃતનાં ફળ.

## ૨

### સ્વયંબર.

રવિતેજ રાજાએ સ્વયંબરને સુશોભિત અનાવવા માટે અથાગ પરિશ્રમ લીધો હતો. એના ઝુદ્ધિસાગર મંત્રી એએ એ વિશાળ મંદ્યમાં રાજકુમારોના આસન પણ એવી ઝુણીથી ગોઠવેલાં કે ડોધને એમાં પોતાનું અપમાન

જણ્યાય નહિ. એ હરમિયાન દૂતોક્ષારા અનેક દેશના રાજ-કુમારો પણ પોતાના પરિવાર સાથે આવી ગયેલા હતા. તેમના સ્વાગત માટે યોજેલા રાજપુરિયોએ તેમને માટે બ્યવસ્થા કરી હતી. આ તરફ મનોહર દેવસભા સમાન સ્વયંબર મંડપ પણ તૈયાર થધ ગયો.

સ્વયંબરના દિવસે રાજકુમારો સુશોભિત વસ્ત્રાલંકારોથી સુસળજ થધને મંડપમાં આવવા લાગ્યા, તેમને મંડપના પુરિયા પોતપોતાને યોગ્ય સ્થાનકે ઘેસાડવા લાગ્યા. સારાય નગરમાં આજે સ્વયંબરના દિવસનો ઉત્સવ હતો, અનેક વાદિઓના વેરા નાહથી આકાશ છવાઈ રહ્યું હતું. નગરને પણ ધ્વજ, પતાકાઓથી સુશોભિત અનાવ્યું હતું; નગરનાં નરનારી આજે કામધંધાથી પરવારીને આનંદ માંજ મશગુલ હતાં.

મંડપમાં જવાને તૈયારી કરતા દેવરથ કુમારના મનમાં એકાએક નવીન વિચાર સુદૂર્યો. “અરે! આ સુંહર અલંકાર અને આભૂષણોથી રાજભાગાં લોલાઈ જશે શું! અનેક રાજકુમારો પોતપોતાના વૈભવથી અન્યને અંણ નાખતા શુંગાર સજવામાં આજે ન્યૂનતા રાખશે નહિ. છતાંય વિજ્ઞાનવતી રાજભાગાં બધામાંથી માત્ર એકજ વરને વરશે. માટે આવા સ્વયંબરનો હર્ષ શોક શો? જેનું મોઢ તપોષણ હશે ને અવાંતરમાં કન્યા સાથે જેનો ઇણાણ અંધ હશે તે જ ચા બધામાં જીતી જશે-ભાડી બધાને પરાસવ તો સમાનજ ગણુશો તો મારા પુણ્યના નિર્ણય માટે હું પણ કંઈક કૌતુક કરેં.”

દેવરથ કુમારે પોતાની સરખી આકૃતિવાળા પોતાના ભિત્રને પોતાનું પદ અર્પણ કરી સ્વયંબર મંડપમાં મોકલ્યો. વૈક્રિય લઘિધથી પોતે પોતાનું કુર્ઝ અનાવી હાથમાં વીણા-

ને વગાડતો એક ગંધર્વ બની ગયો. હાથમાં વીજણાને વગાડતો તે વિદ્યપ ગંધર્વ લોકોને ઝુશી કરતો નગરમાં ચાલ્યો. અનુકુમે તે સ્વયંવર મંડપમાં પ્રવેશ કરી વીજણા-વગાડતો સર્વનાં મન રંજન કરવા લાગ્યો.

યથાસમયે સખીઓના પરિવાર સાથે મનોહર વસ્ત્રાલંકારથી સજજ ભાગા રત્નાવલી સ્વયંવર મંડપમાં પોતાના નાળુક હસ્તકમલમાં સુંદર વરમાળને ધારણ કરતી ને મંહમં ડગલાં ભરતી આવી પહોંચ્યી. શાંતિનું મોળુ અથે ફરી રહ્યું, અધાય રાજકુમારોની દષ્ટિ એ રાજભાગા ઉપર પડી ને ત્યાંજ એ સૌંદર્યદૃપ સૌરભમાં સિથર થઈ ગઈ, તેઓ પોતપોતાની કદ્વિપના પ્રમાણે હૃદયમાં એના ઇપગુણનું વર્ણન કરવા લાગ્યા.

અનેક રાજકુમારોની દષ્ટિ પોતાના ઉપર સમકાળે ઘડવા છતાં પણ ગલરાયા વગર ધીર્યથી ડગલાં ભરતી રાજ તનયા રત્નાવલી મંડપમાં આવી, એક નિપુણ હાસી રાજકુમારોના ઇપ, ગુણ અને શક્તિનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તેતે રાજકુમારને છાડીને મંડપમાં ભાગા આગળ વધતી ગઈ. રાજભાગાને વરવાને આતુર થયેલા રાજકુંવરોને નિરાશ કરતી ભાગા મંડપના અનેક રાજકુંવરોનાં વર્ણન સાંલળતી પણ કોઇના તરફ એનું મન આકર્ષણું નહિ. વરમાળ એના હાથમાં રહી ગઈ. અધાય રાજકુમારોના મનમાં ગમગિની ને ઉદ્દાસીનતા છવાડ ગઈ.

તે છેક છેલ્લા આસન સુધી આવી ગઈ પણ એની વર-માળ કોઇના કંઠમાં આરોપાઈ નહિ. હીરા, માણેક અને રત્નોના અલંકારથી જળહળી રહેલા અધાય રાજકુમારો એને વેંતીયા જેવા લાગ્યા હશે, ઇપવાન અને ગુણવાન રાજકુમારો એને મન કોડી સમાન હશે, પોતાની દષ્ટિ

કોઈની ઉપર ન ઠરવાથી એણે એક નિઃધ્યાસ મુક્યો, એક વાર ફરીને દશ્ટિથી બધા રાજકુમારોને નિરખો લીધા.

એના પિતાને ખાડુ હુંઅ થયું, શું બધાય રાજકુમારો-માંથી કોઈ રાજકુમાર કન્યાને પસંદ પડયો નહિ?

આજની સ્વયંવર સભા ત્યારે શું નિષ્ટળ થવા સર્જા-ચેલી હો ? આ ઉજ્જ્વલ રાજભાગા બધાય રાજકુમારોનો અનાદર કરી શું તેમનાં ખુલ્લાં અપમાન કરેશો ? બધાય રાજવંશીઓનાં અપમાન કરવાનું ફ્રેલ એને જરૂર લોગા-વંનું પડશે ગમે તે એક રાજવંશીને તો એને વરવં જ પડશે, પણ ત્યાંતો આશ્રય !

જેનાં યશોગાન કોઈએ ગાયાં નથી, જે સામાન્યવેશમાં હુથમાં વીણાને ધારણું કરી ભીજાને આનંદ ઉપજલી રહ્યો છે, એવો પેલો ગંધર્વ એ ભાગાની દશ્ટિએ પણો, એ ઉપરથી સામાન્ય જણાતા જવાનને જોતાં એના મનમાં કંદ્ધક લાવો જાયત થયા ને એની વરમાળ પછી તો એનાજ કંદ્ધમાં પડી-ઠરી.

કોઈ લયંકર ધડકો થતાં જેમ બધા સ્તરખ થઈ જય તેમ રાજકુમારીના આ બનાવે બધાય રાજકુમારો ક્ષોલ આમી દિંગ્યુઠ થઈ ગયા, બનાવટી શાંતિને ધારણું કરી રહેલા રાજકુમારો સાવધ થધને પોતાના અપમાનનો બદલો લેવાને તૈયાર થઈ ગયા ને ધીમો કોલાહલ શરૂ થયો, શાંત દેવાલય સરખી સ્વયંવર સલા રણસંગ્રહની માર્કે ખળ-લળી ઉઠી.

કુમાર દેવરથના સુભોટાને એ બનાવની બણ થતાં સાર થયું સાર થયું પોલતા વિજયનાં વાદિત્રો વગાડવા લાગ્યા, પણ રાજ રવિતેજના મનમાં ક્રાસકો પણો, “અરે ! કન્યા એક સામાન્ય વીણાધારીને વરી એ સાર કર્ય નહિ.

અથવા તો અવિતબ્યતા બલવાન છે, છતાં આ આળા એક સામાન્ય પુરુષ સાથે તો નજ રમે, રાજલક્ષ્મી ક્યારે પણ તુંછ પુણ્યવાળાની ઈચ્છા કરે છે શું? અત્યારે તો એણે જે નરને પસંદ કર્યો તેનું મારે ગૌરવ કરવું જોઈએ.”

રણજંગ સમાવી પેલા વીણાધારીને હણી નાખવાને તૈયાર થયેલા રાજકુમારોને નિવારી કેઠલાક ડાઢ્યા રાજવંશીએ. રાજની પાસે આવી કહેવા લાગ્યા. “રાજન! જો તમારે આ વીણાધારીને કન્યા આપવાની હતી તો રાજકુમારોને ઘોલાવી તેમનાં અપમાન કરવાની જરૂર નહોંતી. રાજવંશીએની નજર સમક્ષ કન્યા વીણાધારીને વરી શકશે નહીં. મારે કન્યાએ કરેલી ભૂલ તમે સુધારો કોઈ રાજવંશીને કન્યા આપો.”

એ રાજવંશીનાં વચન સાંભળીને શાંતિને ધારણ કરતો રાજ રવિતેજ પોલ્યો. “અરે, સ્વયંવરમાં કન્યા પોતાની ભરણીથી ગમે તેને વરે એમાં ભીજની માનહાની નો સવાલજ કયાં છે? છતાંથી તમારો કોષ કાણુમાં ન રહેતો હોય તો લડવાને હું પણ તૈયાર છું.”

“અરે લાધાઓ! પોયા અલિમાનથી ઉદ્ધત અની પોતાના કુળને કલાંકિત કરેલા નહિ, આ સામાન્ય વીણાધારી જણ્ણાતો નર કોઈ અસામાન્ય નર સમજી દ્યો, તમારાં બધા કરતાં એનું પુણ્ય જ્વલંત હોવાથી બધાય રાજવંશી અને અપકાણંધ રાજકુમારોને છાડી કન્યાનું ચિત્ત ત્યાં આકર્ષણું છે તેણુંથી નથી સમજતા. આ ગુણવાન અને કલાવાન તેમજ પ્રતાપી નરનો દ્વેષ કરી તમે સારે કાઢશો નહિ.” રાજકુમાર દેવરથના મિત્ર, નકદી દેવરથે એ લડવા તૈયાર થયેલા રાજવંશીએને સમજાવતાં કહ્યું.

અળથી પોતાને ઉદ્ધત અને પરાક્રમી માનતા સર્વો

રાજકુમારો એ શિખામણુની વાતનો અનાદર કરી પોતા-પોતાના સૈન્ય સાથે લડવાને તૈયાર થઈ ગયા. તેમની સામે રવિતેજ રાજ પણ પોતાના સૈન્ય સાથે ચડી આવ્યો. રવિતેજ રાજને ચુદ્રે ચડતો જોઈ પેલો સામાન્ય વીણાધારી રાજને નિવારતો બોલ્યો. “મહારાજ ! તમે પ્રેક્ષક તરીકે જુઓ કે હું એમનું રણકૌતુક કેવી રીતે પૂર્ણ કરું છું તે.”

રાજને અટકાવી સામાન્ય વીણાધારી નર રથ ઉપર આડથ થઈને એ રાજકુમારોની સામે આવી ચુદ્ર કરવા લાગ્યો. ધનુષ્ય ઉપર બાણ ચાદરી એક પણી એક બાળુને છાડતો તે નર હ્યાથી કોઈના રથની ધળ છેદી નાખતો, કોઈના સારથીને તો કોઈનું ધનુષ્ય તોડી નાખતો, કોઈના અદ્યને તો કોઈના હાથી અગર કોઈના રથને તુકશાન કરતા એ સામાન્ય નરે બધાઓને મુંઝવી દીધા, શત્રુસેના કુમારના ભારાથી અસ્તલબ્યસ્તપણે નાસ ભાગ કરવા લાગ્યો.

વિચારમાં પડેલા શત્રુઓ મનમાં લજના પામતા “અરે આ એકલો હોવા છતાં આપણને મુજવે છે શું ?” અને બધાઓને જોરથી તેઓ ચુદ્ર કરવા લાગ્યા.

એ બળવાન પુરુષે હ્યા લાલી કોઈને ન ભારતાં વિદ્યા-વડ કરીને નાગપાશથી બધાને પ્રતિભદ્ર કરી મૂર્ચિષ્ઠત કરી દીધા. ચુદ્રની પૂર્ણહુતિ પણી એના પરાક્રમથી બધા આશ્ર્ય પામ્યા.

રવિતેજ રાજ પણ આ નરનું પરાક્રમ જોઈ તાજુથ થઈ ગયો. “આ પરાક્રમી નર કોણ હશે ?” મનમાં વિચાર કરતો તે વારવાર એ સામાન્ય વીણાધારીને જોવા લાગ્યો. રાજના મનનું સમાધાન કરવાને કુમારનો ભિત્ર બોલ્યો.

“રાજન ! શત્રુઓના ગર્વનું મહીન કરનાર આ ઉત્તમ અને બળવાન પુરુષ જ અમારો નેતા, તેમજ વિમલકીર્તિં

રાજનો પુત્ર દેવરથકુમારે તે આ પોતેજ ! કોઈપણ હેતુથી મને તેના પદ ઉપર સ્થાપન કરી રૂપ પરાવર્તન કરીને તે સામાન્ય વીણાધારી અનેલા છે.” કુમારના ભિન્નનો ખુલાસો સંભળી રાજ ખુશી થયો છતો બોલ્યો.

“હે નરોત્તમ ! તારા આવા અપૂર્વ પરાક્રમથી જ તારં પોતાનું કુલ જણાઈ આવે છે. તારા શૌર્યથી અમાર અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામી ગયું, તારા જ્ઞાન નર-વીરોથી આ પૂર્ણી રત્નગર્ભ કહેવાય છે.”

રાજની આજ્ઞાથી સ્વયંવરનો વિધિ પૂર્ણ થયો. માંગલિક વાદિત્ર વિવિધ આલાપ સંલાપ પૂર્વક વાગવાદાયાં. રાજકુમારે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી નાગ-પાશથી અંધાચેલ સર્વે કુમારોને મુક્ત કર્યો. રાજકુમારો પણ દેવરથતું સ્વરૂપ જાણીને કુમારને અમાવી હષ્ટીત થયેલા પોતાના નગરમાં ગયા.

રાજએ મોટી ધામધુમ પૂર્વક કુમારના પરાક્રમથી રંઘત થયેલી રત્નાવલીનાં લમ કુમારની સાથે કરી દીધાં. સ્વયંવરતું એકંદરે પરિણામ સારં આવેલું હોવાથી રાજના આનંદનો પાર રહ્યો નહિ. લોકો પણ પોતપોતાની મતિ અનુસાર કોઈ રાજકુમારની પ્રશંસા કરતા તો કોઈ રાજભાગની કરતા.

એક સામાન્ય વીણાધારીને વરેલી રાજભાગા પણ બોધ ખુલ્લી જતાં મોટા રાજવંશી, પરાક્રમી અને પ્રતાપી નરેના કંઠમાં વરમાળ પડેલી જાણી એના આનંદની તે વાતજ શી ? લખાંતરતું તપોથળ શું કામ કરે છે ? લાઘુ જ્યારે સંપૂર્ણપણે અનુકૂળ હોય છે ત્યારે ખોટામાંથી પણ સારં થાય છે તો પછી સામાન્ય વીણાધારીમાંથી મોહાર રાજવંશી પ્રતાપી નર અને એમાં તે નવાધ શી ?

કેટલાક દ્વિવસ સુધી થિસુરના આગહથી દેવરથકુમારે ત્યાં રહ્યો, પછી થિસુરની રજા લઈ પોતાની પ્રિયા સાથે પોતાની માતૃભૂમિ તરફ જવાની તૈયારી કરી માતાપિતાએ વળાવેલી તે કન્યા પિતાએ આપેલો અખૂર્વા દાયને ગહણુ કરી પુતિની સાથે સાસરે ચાલ્યો.

પિતાનું મકાન છાડવાથી ઉદાસ અને અશુ પાડતી બાળાને માર્ગમાં અનેક પ્રકારે એના મનને દેવરથકુમારે અહુર વચ્ચનથી રીજવવાનો પ્રયત્ન કરતો હતો. “પ્રિયે ! જો ! જો ! આ હરિણ પોતાના બાળકને ગહણુ કરીને વેગથી ધસી આવતા વાદ તરફ રોપથી ડેવનું ધસી રહ્યું છે ? જગાલનાં આ વાંદરાં આપણુને જોઇને કેવાં નાસભાગ કરી રહ્યાં છે ??”

## ૩

## પંચપરમેષ્ઠી સમરણનું ઝળ.

દેવરથકુમાર પરિવાર સહિત પોતાને નગર આવી પહોંચ્યો. રાજાએ પ્રવેશ મહોસુલ કરેલો છે એવો દેવરથ ચોટા આડંખરપૂર્વક નગરમાં આવી પિતાને નમ્યો. રાજકુમારના ભિત્રના મુખેથી કુમારની પરાક્રમ ગાથા સાંસળીને રાજ રૈમાંચ અનુભવતો ખુખ ખુશી થયો. આકાશ સાથે વાતો કરતા એવા પ્રાસાહમાં નિવાસસ્થાન આપી રાજાએ રાજકુમારના સુખની સર્વે સામની તેમાં લારી દીધી. રતનાવલી સાથે સુખ લોગવતો કુમાર ત્યાં દેવતાની માર્ક પોતાની ખુવાની સર્કલ કરવા લાગ્યો.

એકદા ધર્મવસુ નામે આચાર્ય અયોધ્યાના ઉધાનમાં પંથાર્યા, મેઘના આગમનથી મયુરની જેમ ગુરુઆગમનથી હર્ષ પામેલો રાજ પરિવાર સહિત શુરુને વાંદવાને આવ્યો.

વિધિ પૂર્વક શુદ્ધને વાંદી તેમની આગળ ધર્મોપદેશ સાંભળવાને બેઠો. રાજના મનોભાવ વૈરાઘ્યવાળા જાણીને ખૂર્ચિ રાજને ઉદ્દેશી પર્ષદ્ધા આગળ દેશના દેવા લાયા.

“આ સમશાન જેવા સંસારમાં પ્રાણીએ જ્ઞાનરૂપી શૈતનનોનો નાશ કરીને મૃતકની તુલ્ય થાય છે. હુંખ, દાસિદ્ધ અને હૌરાંઘ ચિત્તામાં પ્રજ્વલતા અભિસમાન છે. જે સંસારમાં આદુળવ્યાદુળ થયેલું ચિત્ત ધુમાડાના સરખુ છે. કેટલાક અપરાધી જીવો કપાયરૂપી શૂલીવડે કોશાય છે. કેટલાક દુરાશાદ્વપ રજનુથી બંધાયા છતાં કુમતરૂપ વૃક્ષને બાથ લીડી રહ્યા છે. સંસારમાં કેટલાક જીવો વિષયસુખ રૂપી વિષનું પાન કરી રહ્યા છે જ્યારે કેટલાક મોહમાં સુંઝાંયા છતાં ચારાશીલાખ ચાનીરૂપી વંશની જાલમાં ધેકેલાઈ જાય છે. સંસારી જીવોને પાખંડીરૂપી કેટલાય પલિતો વળગેલા છે વળી જીવીએ તો શાકિની સમાન પુરુષના આત્મહિતનો નાશ કરવાવાળી છે. એવા રાગથી બંધાયેલા પ્રાણીએ જગતમાં શું શું નથી કરતા ?

રાજકુથા, ભક્તકુથા, સ્ત્રીકુથા અને દેશકુથામાં મશાળા અનેલા જીવોને ધર્મકુથા કરવાની નવરાશજ કયાં છે કુસંસારના એ બધાય ઉપદ્વોથી નહિ સુંઝાયેલો. પ્રાણી જ સિદ્ધિના કારણરૂપ એવા ચારિત્રરૂપી મહા વિધાને સાધે છે.

જ્ઞાની પુરુષને આ સંસારરૂપી રમશાનને વિષે સિદ્ધિને પ્રાપ્ત કરવા જતાં જો પૂર્વે કરેલી વિદંબનાએ કદર્થના નથી પમાડી શકતી તો તે શિવપુરીમાં સુખે સુખે ચાલ્યો જાય છે. સમ્યગું જ્ઞાનવંત પુરુષ જ જ્ઞાની થધ શકે છે. આપુણેનાં વચ્ચન સાંભળવાથી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ રહિત, અજ્ઞાન, મોહ અને ભિથ્યાત્મ રહિત, પ્રાણીએને હિતકારક શ્રી તીર્થકરદેવ જ આપુરુષ કહેવાય

છ. કારણુ કે પરમાર્થથી તો રાગ દ્રેષ્ટ, અજ્ઞાનાદિક હાવેં  
તેમના જ ક્ષય થયેલા છે.

માટે હે લભ્ય ! પંચપરમેષ્ઠીના સમરણુ કરવામાં તેમજ  
એમની સુતિ કરવામાં અવશ્ય પ્રયત્નશીલ થાયો, જે  
જીનેથેરના દર્શનથી પરંપરાએ તમારું કહ્યાણુ થાય. એ  
ઉપર એક દાંતંત સાંભળો.

આ જીબુદ્ધીપના ભરતક્ષેત્રમાં સદ્ગ્રામ નામના ગામમાં  
સુંગત નામે એક પામર રહેતો હતો. એક હિવસે તે  
ગામમાં આવેલા સાધુઓને રાત્રી વ્યતીત કરવા માટે  
તેણે ઉપાક્ષય આપ્યો ને ઉપરથી તેમની વૈયાવચ્ચ કરી  
સેવા લક્ષ્ણ કરી. સુનિએ એ પામરને યોગ્ય જાણીને પાપનો  
નાશ કરનારી ધર્મહેશના આપી.

“આ જગતમાં પ્રાણીઓને ધર્મ થકી શું નથી મલતું ?  
મહારતા પર્વત સમાન ઉન્નત ગજરાણે, વાખુવેગવાળા  
અધ્યો, વરણમાં નમસ્કાર કરતા સુગુરયાદ્ર સામંત નૃપ  
તિએં, બુદ્ધિનિધાન મંત્રીએં, ઇપ અને ગુણે કરીને લલિત  
દ્વાલનાએં, દેશ, આમ, નગર, શહેર ચુક્તા પૃથ્વી મંડલ  
તેમજ સુવર્ણ અને રત્નાથી ભરેલા ભરપુર લંડાએ, ગાન-  
તાન, નાટક અને મોટા ગગનચુંભિત પ્રાસાદો તેમજ  
હેવ હુલ્લાલ એવા મનોહર લોગો એ બધુંય ધર્મથી મળી  
શકે છે માટે ધર્મનાં એવાં હૃદાં કલ જાણીને હે સંગત !  
હું ધર્મતું આરાધન કર કે જેથી આ ભવમાં તેમજ ભવાં-  
બરમાં તારું સારું થાય”.

સુનિરાજનો એ પ્રમાણે સુવારસ સમાન ઉપહેશ  
સાંસણીને શ્રદ્ધાને ધારણુ કરતો સંગત એલયો. “હે ભગ-  
વન ! મને લાગે છે કે આપ મારી ઉપર એકાંત વાતસદ્ય-  
વંત છો પરન્તુ અનાર્ય અને પામર-સુર્ખ એવા મને એ

ધર્મ કરવાનું સૌભાગ્ય શી રીતે પ્રાપ્ત થાય ? માટે ગૃહસ્થને ઉચ્ચિત એવા મારેયોગ્ય મને ધર્મ આપો ” પામરની વાણી સાંભળી ગુરુમહારાજ યોદ્યા કે :—

“તારે પંચપરમેષ્ઠીમંત્રનું ત્રણે સંદ્યાએ દરરોજ સમરણ કરવું, લોજન અવસરે, શયનકાલે પવિત્ર થઈને ત્રણ, પાંચ કે આઠવાર દરરોજ સમરણ કરવું,” એ પ્રમાણે મુનિરાજ પંચપરમેષ્ઠી નમસ્કારમંત્ર આપીને ચાલ્યા ગયા.

સંગત પણ તે હિવસથી પંચપરમેષ્ઠીનું સમરણ કરવા લાગ્યો. પ્રતિહિવસ પંચપરમેષ્ઠીનું સમરણ કરતો ને નિષ્પાત્ત જીવન ચુંઝારતો તે વણોકાલ જીવીને અંતે વિશુદ્ધ ભાવથી મરણ પામીને પરમેષ્ઠી મંત્રના પ્રભાવથી નંદીપુર નગરના પદ્માનન રાજની કુલુદિની પ્રિયાથકી પુત્રપુણે ઉત્પત્ત થયો. સ્વમામાં રતનો સમૂહ જોવાથી ભાતાપિતાએ કુંબસ્નું નામ રતનશિખ પાડ્યું; કલાથી શોભતો રતનશિખ વૃદ્ધિ પામતો અતુક્ષે યૌવનવયમાં આવ્યો.

પુષ્યથી આકષયિદી લક્ષ્મીની માર્ક કુમારના ગુણોથી રંજીત થયેદી કોશલાદિપતિની કીશાલ્યા નામે કન્યા સ્વરૂપ વરા આવેદી તેને મોટા આડાંધરપૂર્વક રાજકુમાર પરણ્યો, એ રાજભાગા સાથે કુમાર અતુપમ કોગાને લોગવવા લાગ્યો.

એક હિવસે કુલુદિની દેવીએ રાજના મસ્તક ઉપરનો શ્વેતકેશ રાજને અતાવવાથી રાજને વૈરાગ્ય ઉત્પત્ત થયો. રતનશિખ કુમારને પોતાની પાટે સ્થાપન કરી રાજ પત્ની ખસ્તિ વનવાસી તાપસ થયો. રતનશિખ અનેક સામંત અને મંત્રી વડે શોભતો મોટા પૃથ્વી મંડલનો શાસક થયો. રાજસભામાં કથા-વાર્તા વિનોદમાં પોતાનો સમય પસાર કરતો હતો. સારી સારી કથાઓ કહેતારા પંડિતોને દાત,

માનથી તે સંતોષ પમાડતો હતો, એક દિવસે કોઈ કથાકારે રાજસભામાં રાજની આગળ વીરાંગન અને સુભિત્રનું કથાનક શરે કહ્યું.

વિજયપુર નગરના રાજ સુરાંગહને ગુણવાન અને લાભશાળી વીરાંગન નામે પુત્ર હતો. પ્રધાનપુત્ર સુભિત્ર સાથે અને ગાઠ ભિત્રતા થધ. એકદા ઉધાનમાં કીડા કરતાં રાજકુમારે સુભિત્રને કહ્યું. “ભિત્ર ! પુષ્યની પરીક્ષા કરવા માટે આપણે દેશાંતર જાધારે, અનેક કૌતુકથી બરેલી પૃથ્વીને જોઇએ, સજજન અને હુર્જનની પણ પરીક્ષા કરીયે, કારણ કે ધન, કીર્તિ, ધર્મ, વિદ્યા, વિજ્ઞાન અને પુરૂષાર્થ એ બધું પ્રાયઃ કરીને પરદેશમાં જ પુરૂષને પ્રાપ્ત થાય છે”.

રાજકુમાર વીરાંગની વાત સાંભળી સુભિત્ર બોલ્યો. ભિત્ર ! તમે કહ્યું તે બરાબર છે. પરન્તુ આપણે પરદેશ જાધારે ને એક શહેર કે એક રાજની સુલાક્ષણ લઈ પાણ આવીય એમાં બતુરાઈ શી ? પણ અનેક નગર અને શહેરો જોઇયે, સેંકડો વિજ્ઞાનવિદ્યાનો અભ્યાસ કરીયે, ધર્મ સભાઓની સેવા કરીયે, પરદેશમાં અનેક સ્થાનકોનો ફરીને આપણે અનુભવ કરીયે”.

તારી વાત તો ઠીક છે પણ માતા પિતાનો ત્યાગ કરી આપણે શી રીતે જધ શકીયે ? જો છાનામાના-ગુપ્યુપ જતા રહીયે તો એમને ઘણું હુંઘ થાય અને રજ લઈને જાધારે તો જવા ન હે. રાજપુત્રે પરદેશ જવા માણી મુરકેલી રણું કરી.

“ત્યારે આપણે એનો કંઈક ઉપાય કરીયે” સુભિત્રે કહ્યું. તે પછી કેટલાક દિવસ પસાર થયા ને એક દિવસે ઉધાનમાં અને ભિત્રો આનંદ જોષિ કરતા હતા તે દરમિયાન શરણ, શરણ પોકારતો કોઈક પુરૂષ રાજકુમારના બરણને વળગી

પડ્યો. તેની પાછળ પકડવાને છુટેલા રાજપુરેષો કુમાર પાસે આવીને બોલ્યા. “રાજકુમાર! એને છાડી ઘો. આ દુષ્ટ ચોરે સુદૃત ઓણીના મફાનમાં ખાતર પાડીને જુથ ધન ચોણું છે ને હવે રાજએ એને શુણી અડાવવાનો હુકમ કર્યો છે તેમાંથી છદ્દકી જવાને તે અમારા હાથમાંથી નાશી તમારે શરણે આવેલો છે, માટે અમને સ્વાધિન કરો અને મહારાજની આજાનો અમલ કરવા ઘો.” રાજપુરેષોની વાણી સાંસળી વીરાંગન બોલ્યો—

“ને કે આ ચોર છે તેને આશરો આપી રાજાજાનો ભંગ કરવો વ્યાજથી નથી છતાં આ મારે શરણે આવેલો હોવાથી એને હવે તમારાથી હણી શકાશે નહિ. પિતાને કહો કે એને છાડી મૂકો.”

રાજપુરેષોએ રાજકુમારનો નિશ્ચય બાણીને રાજ આગળ જઈ એ વાત નિવેહિત કરી. આજા ભંગ થવાથી ચુસ્સે થયેલા રાજએ રાજકુમારને દેશનિકાલ કર્યો. કુમાર શાતાના મિત્રની સાથે ઝુશી થયો. છતો પરદેશ ચાલ્યો. વિહેશ જતાં માર્ગમાં રાજકુમારને પુણ્યોદ્યને સૂચવનારા અનેક સારા શુક્લ થયા.

## ૪

### એ મિત્રો.

શ્રમણસ્તુરગો રાજા, મયુરઃ કુંજરો વૃષઃ ।

પ્રસ્થાને વા પ્રવેશે વા, સર્વસિદ્ધિપ્રદાયકઃ ॥૧॥

**લાલાર્થ**—સાંધુ, અસ્થ, રાજ, મયુર, હાથી અને અળદ પરદેશ ગમન કરનાર સુસાક્રને નગરમાંથી નિકાલતાં કે અન્ય નગરમાં પ્રવેશ કરતાં જો સામા મળે તો શુક્લ લેનારનાં મનોવાંચિત સફળ થાય છે.

કન્યા, ગાય, શાખ, ભોરી, હણી, રેલી, કુલી, પ્રેજાંદાંલતો અમ્રિ, અધ્યે, રાજ, હાથી, જલ લરેલો ધડો, ધવળ, શાખાંદી પુરુષ, રાંધેણું-પકાવેલું અત્ર, વૈશ્યા, સૌલાભ્યધાર્તી સ્ત્રી આદિક જે સામા મળે તો પરહેશ ગમન કરનારે વ્યક્તિનું મંગલ થાય છે.

શુલશુકરને નિકળેલા વીરાંગન અને તેનો ભિત્ર પરહેશ ગમન કરતાં અનુફ્રમે ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી જયા. શૂલ શકુને નિકળેલા હોવાથી તેમના મનમાં જે કે ઉત્તસાહ હતો છતાં પરિશ્રમથી કંદાળેલા હોવાથી અથંકર અટવીમાં એક મોદા ઘયાદાર વૃક્ષની છાયામાં આરામ લેવાને બને જણ્ણા બેઠા. રાત્રી પણ ત્યાંજ પસાર કરવાનો તેમણે વિચાર કર્યો.

નિશા સમયે રાજકુમાર વીરાંગન પરિશ્રમથી કંદાંગતો નિદ્રાવશ થયો ને પ્રધાન પુત્ર સુભિત્ર તેની રક્ષા કરતો જયત રહ્યો.

એ ઘયાદાર વડલાના વૃક્ષમાં નિવાસ કરીને રહેલો લામુરગ્રલ નામનો યક્ષ (હેવ) આ બને મુસાઈરનાં સ્વરૂપ અને સૌલાભ્યથી આકર્ષાદી પ્રસન્ન થયો. અવધિજ્ઞાનથી તેમનું વૃત્તાંત જાણુને સુભિત્ર આગળ પ્રગટ થધને બોલ્યો. “હું વત્સ ! તમે બને મારા મોદા અતિથિ છો, તો કહો કે તમારા બનેનું હું શું આતિથ્ય કરું ?”

પ્રસન્ન થયેલા હેવતાને પ્રત્યક્ષ-પોતાની સમક્ષ પ્રગટ થયેલો જોઇ ખુશી થતો સુભિત્ર બોલ્યો. “હેવ ! હું એ કરીને થધ શકે એવું તમારું દર્શાન મને થયુ તેથી હું માનું હું કે મારા સર્વે મનોરથ્યા સકુલ થયા, કારણું મોદા લાભ્યથીજ કોઈ વિરલાને હેવદર્શાન થાય છે.”

“સુજાગ પુરુષોમાં યાચના સિવાય સર્વે યુણે હેઠાં

છ. સજજન પુરુષો અન્ય હુંથી જીવોનો ઉદ્ધાર કરે છે પણ  
પોતે કોઈની પણ પ્રાર્થના કરતા નથી. છતાંય દેવદર્શન  
અમોદ હોય છે, વચ્ચા જતું નથી.

આ એ મણિરલ તને આપું છું. આ નીલમણિ ત્રણ  
ઉપવાસને અંતે રાજ્યને આપે છે, ત્યારે આ રક્તમણિ  
“ઓ હી” મંત્રથી જાપ કરવાવડે મનોવાંચિત પૂરે છે. પહેલો  
રાજકુમારને યોગ્ય છે ત્યારે બીજો તારે યોગ્ય છે.

દેવતાની વાણી સાંલળી દેવે આપેલા એ ભણ્ણાં  
અહણ કરતો સુભિત્ર ખુશી થતો ચિંતવવા લાગ્યો, “‘પૂર્વે-  
પાર્વત પુષ્ય મનુષ્યને જગત થયું છતું વનમાં કે ગમે ત્યાં  
સહ્ય કરે છે છીદીદારની માર્ક તે માણસની આગળ ને  
આગળજ ચાલે છે. આ કુમારને ધન્ય છે કે જેનો ઉપકાર  
કરવા માટે દેવતાએ પણ પ્રગટ થાય છે.” તેણે દેવતાની  
પણ સ્તુતિ કરી.

અન્ને રતનો આપીને થક અદૃશ્ય થઈ ગયો. રાજ-  
કુમાર પણ યથા સમયે જગત થયો. પ્રાતઃકાળે તેઓ  
અન્ને ત્યાંથી આગળ ચાલ્યા. ને ત્રણ દિવસ સુધી સુભિત્રે  
રાજકુમારને ક્લા વગેરેનો નિષેધ કરીને અપવાસ કરાય્યા  
અને કંઈધ્ય ખાવા દીધું નહિ. ત્રણ ઉપવાસ પણી સુભિત્ર  
અને રાજકુમાર મહાસાલપુર નગરના ઉદ્ઘાનમાં આવ્યા,  
ત્યાં પેણું નીલરલ થતાવીને રાજકુમારને કહ્યું, “હે મિત્ર !  
આ રતની તમે પૂજા કરો, કે જેના પ્રલાવથી તમે મહા-  
રાજ થશો.”

રતને બેદ વિસ્તિત થચેલો રાજકુમાર બોલ્યો.  
“હે મિત્ર ! તને આ ક્યાંથી પ્રાપ્ત થયું ?”

“કુમાર ! તમારા ભાગ્યથી મને એ પ્રાપ્ત થચેલ છે.  
એનો ધતિહાસ તમને રાજ્ય મળ્યા પણી કહીશ,” પ્રધાન

પુત્રની વાણી સાંલળી રાજકુમારે એ નીલારલની પૂજા કરી, “આ રલના પ્રલાવથી શ્રી રીતે રાજ્ય પ્રાપ્તિ થશે?” ધર્ત્યાદિક ચિંતન કરતો તે આપું વૃક્ષની નીચે બેડા.

પોતાના ભિત્રને ત્યાં છાડી નાલુક લટાકું જમાં જઈને સુભિત્રે પુષ્પાદિકથી પોતાના રક્ત રલની પૂજા કરીને સ્નાન માટે વિલેપનાદિક સામચીની યાચના કરી. તરત જ

શિના પ્રલાવથી દિવ્ય અંગમહીન કરેનારાએએ પ્રગટ થઈ તેલવડે મહીન કરી બન્નેને સ્નાન કરાયું, દિવ્ય સ્ત્રી ઓએ પ્રગટ થઈને તે બન્નેને મનગમતાં લોજન કરાયાં. પછી દિવ્ય તાંખુલ અણ્ણું કર્યા, તે મણિના પ્રલાવથી દિવ્ય શુંગાર ધારણું કરી તેણો સ્વસ્થ થયા, તે પછી અંગમહીન કરેનારા અને દિવ્ય સ્ત્રીઓ બધું અદૃશ્ય થઈ ગયું.

હું મહાશાલ નગરનો રાજ અપૂર્વ ભરણું પામેલો હોવાથી મંત્રીઓ રાજ્ય વ્યવસ્થા માટે વિચારમાં પડ્યા, છેવટે પંચ દિવ્યના નિર્ણય પર આવી તેમણે પંચ દિવ્ય કર્યાં, તે અનુકૂમે ઉધાનમાં વીરાંગન કુમાર પાસે આવ્યાં, કુમારને જોઈ ગર્જના કરતા ગજરાને પોતાની સુંદરમાં રહેલા કલશવડે કુમારનો અલિષેક કરી પોતાના સ્કર્ષે કુમારને બેસાડ્યો. ચામર અને છત કુમારની આજુભાજુ શોલી રહ્યાં, એ પંચ દિવ્યની પાછળ રહેલા મંત્રી આહિ રાજપુરષોએ જ્યજ્ય શાખ પોકાર્યા.

નગરમાં પ્રવેશ કરવા માટે મંત્રીઓએ નમસ્કાર કરીને કુમારને પ્રાર્થના કરી. એ પ્રસંગનો લાલ લાલ મંત્રી-પુત્ર સુભિત્ર પોતાના ભિત્રને રાજ્ય પ્રાપ્ત થયું જાણી ત્યાંથી ઘસી ગયો ગુમ્પણે એ જ નગરમાં રહીને ભિત્રના સુખને જોતાં સ્વતંત્રપણે મોજ કરવાને તેણે વિચાર કર્યો, અને એ ગરણમાંથી નગર તરફ સરકી ગયો.

સુમિત્રને નહિ જોવાથી વીરાંગદ રાજાએ મંત્રીઓને કહ્યું “પણ મારે મિત્ર મારી પાસે હતો તે અત્યારે ક્યાં છઈકી ગયો ? મંત્રી ! તેની જલદી શાખ કરાવો.”

મંત્રીના મોકલેલા સર્વે સુલટોએ નગરમાં અને બહાર તપાસ કરી પણ ક્યાંય ન મળવાથી પાછા આવી નિરાશા-જનક સમાચાર કહ્યું સંભળાવ્યા.

મિત્રના વિચારથી વ્યાચચિત્વવાળા રાજાએ મંત્રીઓના આગ્રહથી મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો, અને મંત્રી ઓએ તેનો રાજ્યાલિષેક કર્યો, તે સાથે આડ રાજકન્યા-ઓને પણ પરણાવી. દ્વારાંગના સમાન એ રૂપવતી લલ-નાએ સાથે કીડા કરતો વીરાંગદ સુખમાં કાલ નિર્ગમન કરતો હતો, અખંડ શાસનથી ઉત્તમ રાજાની માર્કેક રાજ્યને પાલવા છતાં એ સુખમાં પણ મિત્રવિચારઙ્ય કંદક રાજાના હૃદ્યમાં અહનીંશ અટક્યા કરતો હતો.

મહાશાલ નગરમાં મોજથી કીડા કરતા સુમિત્રને એક હિવસ નરવૈરિણી રતિસેના નામની વેશયાએ જોયો. સ્નેહ રૂપી મીડી નજરથી વારેવાર તેને જોવાથી પુત્રીની ભમતા જાણીને તેની વૃદ્ધમાતાએ સુમિત્રને પોતાની પાસે પોલાવ્યો. સૌભ્ય આકૃતિવાળો જાણી તેણીએ પણ તેનો સતકાર કર્યો. રતિસેનાના સ્નેહપાશમાં ઘંધાગેલ સુમિત્ર પણ પોતાનો સમય ત્યાં જ સુખમાં નિર્ગમન કરતો. એની દ્વય ઈચ્છાને પેલા માણિના પ્રલાવથી પૂર્વવા લાગ્યો.

કવચિત ગુણવાન પુરુષો પણ નારીના કદાક બાણે વીધાયા છતા પાપ માર્ગ ચાલ્યા જાય છે. ગણિકામાં સાચો શ્રેમ હોતો નથી. જ્યાં લગી પેસો હોય છે ત્યાં સુધી જ એ સંબંધ રાખે છે. પણ ગુણવાનના ગુણોની એને કદર નથી. માખી છે તે હુર્ગંધમય એવી વિષા ઉપર જ એસે

છે, ચંહન ઉપર નહિ. ધનની અર્થી એવી વેશયા ચંડાલને પણ દુષ્ટે છે. અરે કોઈયા સાથે પણ જે દ્રવ્ય લાલ થતો હોય તો રમે.

વેશયાની નીતિને જાણવા છતાં પણ સુભિત્રે ડેરલોક સંમય રતિસેનાના સહ્યાસમાં પસાર કર્યો. મણિના પ્રલાઘથી ભૂપણ, અલંકાર :વગેરેથી એણે કુદિનીની મહા દુષ્ટીને પણ પૂર્ણ કરી. વારંવાર એ પ્રમાણે કુદિનીની ધનેશ્છા પૂર્ણ થવાથી એ દુષ્ટ કુદિની વિચારમાં પડી.

“અહો વિતામણિ રેલ વગર આટલું બધું ધન કોણ આપી શકે ? ડાઇ પણ ઉપાયથી એની પાસેનો મણિ મારે પડાવી લેવા જોઈએ”, એ પ્રમાણે દુષ્ટ કુદિની અતુકુળ સંમયની રાહ જોવા લાગી.

અન્યથા પોતાનાં વસ્ત્ર દૂર સુકીને સુભિત્ર સ્નાન કરવાને એડો, તે સંમયનો લાલ લઈ પેદી કુદિનીએ એનાં વસ્ત્રો તપાસવા માંડ્યાં, તો એક વસ્ત્રને છે મણિ આંદેલો, તે આ દુષ્ટાએ છાડી લઈ સંતાડી દીધો.

કુદિનીએ ધનની માગણી કરવાથી સુભિત્રે એકાંતમાં જઈ પેલા મણિની પૂજા કરવા માટે તપાસ કરી પણ તે નહિ મલવાથી ભિન્ન ચિત્તવાળા તેણે બરના માણુસોની જડતી લેવા માંડી. તેની આવી ચેષ્ટા જોઈ ગુસ્સે થયેલી પેદી કુદિની સુભિત્રને ધમકાવતી ઓલી. “અરે ! તારી પાસે ધન ન હોય તો સર્યું, અમારા ઉપર ખોટાં આપના સુક.”

એ કુદિનીની કુદિલતાથી સુભિત્રે વિચાર્યું, “નક્કી આ દુષ્ટાએ જ મારો મણિ હરી લઈ તસ્કરવિદ્યા ચલાવી છે. હવે શું થાય ? શું રાજની આગળ ઝરીયાદ કરેં ? અહીંયાં હવે આ દુષ્ટ મને રહેવા હેઠે પણ નહિ. માટે અત્યારે

તો અહીંથી જવામાં જ સાર છે”。 એમ વિચારી તે રતિ-  
સેનાના મકાનમાંથી નિકળી ગયો। રાજને ઇરિયાદ કરેવા  
જતાં અનમાં વિચાર થયો કે આવી નમાલી વાત રાજને  
કહેવા કરતાં હાલમાં પરહેશ જવું એજ ઠીક છે, એમ  
ચિંતવી દેશાવર ચાલ્યો ગયો।

“અરે જગતમાં અજ્ઞાનને ધિક્કાર થાયો, તેની  
ઈચ્છા સુજણ દ્વારા આપવા છતાં એ લોલી સ્ત્રીએ મને  
છતરીને મણું લઈ લીધો પણ એની પૂજા વિધિની ઓને  
અભર ન હોવાથી એને કંધ લાલ થશે નહિ. એક પત્થરના  
દુકડા કરતાં એને કંધ અધિક લાલ થશે નહિ. હવે શું  
ઉપાય કરું કે કેથી એ દુષ્ટને કંધક ચમતકાર બતાવી મારો  
મણિ હાથ કરું?” ધ્યાનિક વિચાર કરતો તે અનુકૂળે હોઢિ  
શૂન્ય નગરમાં આવ્યો. બધું ઉધાનવાળા અને રેમણુંથી  
એવા તે નગરને જોઈ આશ્ર્ય પામેલો સુભિત્ર નગરમાં  
પ્રવેશ કરતો રાજમંહિર તરફ ચાલ્યો.

મનુષ્ય રહિત એવા રાજમંહિરની સમભી ભૂમિકાએ  
મનમાં આશ્ર્ય પામતો તે ઉપર ચઢી ગયો, સાતમી  
ભૂમિએ ચારે તરફ નજર કરતાં તે સુભિત્રને સાંકળથી બંધા-  
ચેલ એ હસ્તિની જોવામાં આવી. એમનાં અંગ કુંકું મધ્યી  
વિલેપન કરેલાં હતાં, કપુરની સુગંધથી એમનાં મસ્તક  
સુવાસિત હતાં. ને એમની ગ્રીવાએ પુણ્યની માળા હતી  
એવી એ કરિણી ચુગલને જોઈ “આ શું?” એમ ચિંત-  
વતાં વળી ચારે તરફ જોવા લાગ્યો.

સામે ગોખમાં એણે શૈત અને કૃષ્ણ અંજન ચુક્કા  
એ દ્વારાદીએ જોઈ, અંજન માટે સળી પણ ત્યાં પડેલી  
હોવાથી એને કંઈક જોઈ જાણાયો.

એ કરલી ચુગલની અંખ જોતા શુદ્ધ અંજનચુક્કા

જણાયાથી એણે ધાર્યું કે સહેદ અંજનના પ્રયોગ વડે આ બન્ને સ્વીએને કરલી કરેલી છે. તો કૃષ્ણ અંજનથી એમને મૂળ સ્વરૂપ પ્રણાય થતું હશે. એમ વિચારી તરત જ એણે પેદી સળી વડે કૃષ્ણ અંજન એમની આંખમાં આંજણું.

તરત જ તે બજે સુંદર મનુષ્ય સ્વીએનો બની ગઈ, સુભિત્ર એમને મનુષ્ય સ્વરૂપમાં બેન્ધ નવાધ પામતો ને તેમની કુશળતા પૂછતો બધી હકીકત પૂછવા લાગે. આ બધું છ શું? તમે કોણ છો? ને આ બધું શી રીતે બત્યું?

સુભિત્રના જવાખમાં એક સ્વીયોદી. “હે સુંદર! ગંગાનદીની ઉત્તર હિશાએ ભદ્રક નામે શહેર આવેલું છે, ત્યાં ગંગાદિય નામે બ્રહ્મ રહેતો હતો. તેને વસુદ્વારા નામે ખલી થકી આડ પુત્રો ઉપર એ પુત્રીએ અવતરી, એકનું નામ જયા અને બીજનું નામ વિજયા.

એ બન્ને બહેનો જ્યારે યૌવન વયમાં આવી, તે સમયે ગંગાના તટ ઉપર એક શર્મિક નામે પરિપ્રાજક રહેતો હતો. કિયાવાન અને શૌય ધર્મમાં તત્પર, બોલવામાં હાજર જવાથી, વૈદ્ય અને નિમિત્તનો જણનાર, બાધ્યથી ઉદ્દાર અને સુંદર આચારવાળો છતાં અંતરમાં કૂરે પરિણામી એ પરિપ્રાજકને એક હિવસે પારણાને માટે મારા પિતાએ આમંત્રણ આપ્યું.

પરિપ્રાજકનો સત્કાર કરી બહુ માનથી તેને જમવા એસાદ્યો, પિતાની આજ્ઞાથી અમે બન્ને તેની બન્ને બાજુએ એસીને પવન નાખવા લાગ્યાં, મનોહર એવાં પક્વાન્ન, શાક, દાલાદિક લોજન છતાં અમારા ઇપમાં આશક થયેલો તે વારંવાર અમને બેતો ને નિઃધાસ મૂકતો કંઈક ચિંતવવા લાગ્યો.

સંસારમાં મતુષ્યજનમ ધારણુ કરી જ્યે જ્યે કે તપુ કરો, ધ્યાન કરો કે ધનિદ્યનું દમન કરો, પણ રંલા સમાન આ મનોહર ભાગાચો સાથે જો લોગ ન લોગવ્યા તો અધુંય વ્યર્થ. આ સંસારમાં સારંગલોચના એ એકજ માત્ર સારભૂત છે. એ સારંગ લોચનાથી કોણ સ્નોલ નથી પામ્યું? દૃવાંગનાઓથી અદ્ધા, ગંગા અને ગૌરી થડી મહાદેવ તેમજ ગોપાંગના થડી ગોવિંદ, તો પછી મારા જેવો આવી સુંહર સુંહરીએને જોઇ ચલાયમાન થાય એમાં નવાઈ પણ શી ?”

સુંહર લોજનનો ત્યાગ કરીને વ્યગ ચિત્તવાળા પરિ-પ્રાજકને મારા પિતાએ પૂછ્યું. “આપ શું તત્ત્વ ચિત્તવનમાં પડી ગયા, લોજન ઠંડું પડી જશે તો પછી એમાં મજા નહીં આવે”. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિ-પ્રાજક લોજન કરવામાં મંહ આહરવાળો થઈ ગયો.

“હુંખુથી હંઘ થયેલાને સુંહર લોજનથી પણ શું ?” એમ કહેતો એ હુર્યુદ્ધિ હાથ ધોઇને ઉડી ગયો. તેને એકાંતમાં બેઢીએ પૂછ્યું. “હે તપસ્વી ! તમારે શું હુંખ છે ?”

બ્રેધીની વાણી સાંભળીને તાપસ એલયો. “સંસારની મોહમાયાનો ત્યાગ કરેલો છે એવા અમારે તમારા જેવાનો સરંગ હુંખદાયી છે છતાં એકાંત લક્ષ્ણ એવા તમારા જેવા સજજન જનતું હુંખ જોવાને હું શક્તિમાન નથી. પણ એવાત હાલમાં તમને કહીશ નહિં.” એમ કહીને પરિપ્રાજક પોતાના અઠમાં ચાલ્યો ગયો.

## ૫

## કરબી ચુગલની કથા

પરિદ્રાજકના વચનથી શાંકાશીલ થયેલો એઝી પણ ધીરજ છાડીને પરિદ્રાજકની પૂંડે હોડ્યો, એકાતમાં એ પરિદ્રાજકને નમી હાથ જોડી એની સુતિ કરતો બોલ્યો. “હુંપા કરીને આપ કહો. માર્દ અહિત જે હેખાતું હોય તે સ્પષ્ટતાથી કહો ?”

“કંઈ કહેવાય તેમ નથી, એક તરફ વ્યાપ અને બીજી તરફ નહીં ના. ન્યાયે આવી બાબતોમાં મારા જેવા ઉત્તમ સાંકુઓએ પહુંં જોઇએ નહિં”.

તપસ્વીની વાણીથી અધિક શાંકાશીલ થયેલા તેણે પૂછ્યું: “આપ જરૂર મને કહો”. આપ જેવા મહાન પુરુષાનો ભક્ત હોવા છતાં હું હુંભી થાઉં એ શું તમને દઈ છે ?”.

“એકાંતે મારે વિષે ભક્તિવાળા તને મારે કહેવું જોઇએ, જે સાંસારાની કુલકષણવાળી પુત્રીએ. તારા કુળનો ક્ષય કરનારી છે. એ જાણુને સરસ અને સુંદર લોજનમાં પણ માર્દ મન લાગ્યું નહિં. તારી વારંવાર પ્રેરણા છતાં હું લોજનનો સ્વાહ પણ લઈ શક્યો નહિં. અફસોસ !”

“ત્યારે એનો ઉપાય ?” આતુરતાથી શેડ પૂછ્યું:

“એનો ઉપાય તો ઘની શકે-શાંતિ પણ થઈ શકે, પણ તે તારાથી ઘની શકે તેમ નથી”. પરિદ્રાજકે એને ડામાડાળ ઘનાવી દીધો.

“કુળની શાંતિને માટે કઠીણકાર્ય પણ હું કરીશ, આપ શાંતિથી કહો.”

“પોતાનું કલ્યાણ ઈચ્છિનારે કુલક્ષણું વંત વસ્તુઓ ગમે તેવી પ્રિય હોય તો પણ તેનો ત્યાગ કરવો જઈએ, તારી મૃત્ત્વિન્દોને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં વહેતી સુક, કે જેથી તારા કુળનું કુશળ થાય”  
તાપ્યનાં વચન સ્વીકારી એવિ પોતાને મદાને આવ્યો.

એક દિવસે અમને બજેને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં તાપ્યના કહેવા પ્રમાણે તે પેટી વહેતી-તરતી સુકી હીધી, ને ધર જઈને અમારું શોક કાર્ય કર્યું.

આ વાત જાણી ખુશી થયેલો પરિવાજક પોતાના મઠમાં આવી પોતાના શિષ્યોને કહેવા લાગ્યો, “અરે શિષ્યો ! મારી લક્ષ્ણથી પ્રસન્ન થઈને ગંગા દેવીએ હિમાલયથી મારી મંત્રની સિદ્ધિ માટે પૂણેપકરણું કરેલી. એક પેટી ગંગાના પ્રવાહમાં તરતી સુકી છે. તે આજે આવી પહોંચશો. માટે તમે શિધપણે જઈને અહણ કરો. ને તેને ઉધાડશા વગર મારી પાસે લાવો, જો ઉધાડશો તો મંત્રમાં વિના થશો.” પરિવાજકની વાતથી વિસ્મય પામેલા શિષ્યો મઠથી હૂર એ ગાઉ પ્રમાણું ભૂમિએ ચાલ્યા ગયા.

ગંગાના કંડે આવેલી એ તીર્થભૂમિએ જઈને ગંગામાં પેટીને શાખતા આમતેમ કરવા લાગ્યા, દરમિયાન વચ્ચમાં એક ઘટના ઘની ગઈ.

તે ભદ્રક શહેરનો સુલુમ નામે રાજ નાવમાં ઐસીને ગંગા નદીની સહેલ કરી રહ્યો હતો તેણે અકસ્માત આ મંજુષાને જોવાથી પોતાના માણસો મારકુંતે અહણ કરાવી નદીને કંડે રહેલા પોતાના મહેલમાં મંગાવી ને તુરતજ ઉધારવી તો અદ્ભુત સ્વરૂપવાળી અમને જોઈને તે મોહ પામી ગયો. પોતાના મંત્રીને કહેવા લાગ્યો, “અરે મંત્રી !

આ આશ્રમ્ય તો જે ??” ને અમારા રૂપની તારીઝ કરવા લાગી ગયો.

રાજની આવી વ્યાકૃતા છતાં હુંખની મારી અમે કંઈ બોલી શકી નહિ, પણ રાજનો અનોભાવ જાણુંને મંત્રી બોલ્યો. “સ્વામી ! આવી શ્રુતગારથી શાષ્ટગરેલી કન્યાએ કારણ વગર કોઈ ત્યાગ કરે નહિ, કોઈએ પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે ગંગામાં આ બેને બાળને વહેતી મૂકી હોય, માટે આ કન્યાએને અહૃણ કરી બીજી બેનીએ સ્વામીએ મંજુષામાં પૂરી વહેતી મુકી ધો.”

“અરે ગંગાને વળી સ્વામીનું શું કામ ? એ વાનરી-એને પૂરી પેઠી વહેતી મુકી ધોને એથે પત્થુ” વચ્ચમાં એક જણ બોલ્યો.

રાજને આ વિચાર પસંદ પડવાથી જંગલમાંથી એ વાનરીએ મંગાવી મંજુષામાં સ્થાપન કરી પેઠી હતી તેમ બંધ કરીને ગંગામાં પાણી તરતી મૂકી દીધી.

કેટલાક સમયથાન મંજુષા ગંગાના પ્રવાહમાં તરતી આવતી એ શિષ્યાએ જોવાથી ગુરુની વાણીની પ્રશાંસા કરતા તેમણે એ મંજુષાને અહૃણ કરી. ગુરુ પાસે લાવી ગુરુને અર્પણ કરી. ગુરુએ એક ગુરુ એરાદામાં તે પેઠી મૂકાવી.

આજના હિવસને ધન્ય માનતો તે પરિત્રાજક સૂર્ય અસ્ત થયા પછી પોતાના શિષ્યાને કહેવા લાગ્યો. “હું શિષ્યો ! તમે બંધા આજે ભડના દ્વારને તાળુ મારીને હુર રાત્રી વ્યતીત કરજો. કોઈની થૂમ સાંભળો. તો પણ તમે મઠ પાસે આવશો નહિ, મારો મંત્ર સિદ્ધ થયા પછી હું તમને બોલાવીશ,” શિષ્યો પણ ગુરુનું વચ્ચન અંગીકાર કરી મઠને તાળું લગાવી મધ્યથી હુર થયા.

શિલો પરિત્રાજક મનમાં શોમાંચ અનુભવતો પેઠી

સમીપે આવીને બોલ્યો, “હે લડે ! ગંગાદેવીએ પ્રસન્ન થઈને તમારા અજ્ઞેનો વર થવાનું મને વરદાન આપ્યું છે. તો હવ જેવા મારી યાચનાનો લંગ તમારે ન કરવો, હું આજથી તમારો કિકર છું.” એવા મંત્રને ભણુતાં, પૈટી ઉધારીને પરિત્રાજકે પૈટીમાં પોતાનો હાથ નાંખ્યો તેટાં લામાં તો ચપળ સ્વભાવવાળી અને પૈટીમાં પુરાઈ રહેવાથી કોધાયમાન થયેલી, તેમજ ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલી એ વાનરીઓએ અને વહુરી નાખ્યો.

વાનરીઓના ગ્રાસથી ભૂમેભૂમ પાડતો પરિત્રાજક ધમપણા કરવા લાગ્યો. “અરે શિષ્યો ! હોડા ! હોડા ! આ હૃષ વાનરીઓએ મને ઝાડી આધો-મારી નાખ્યો.” એ પ્રમાણે વિલાપ કરતો તે ભૂર્ચિંધિત થઈને ભૂમિ પર પડી ગયો તેની ભૂમે સાંભળવા છતાં તેના શિષ્યોમાંથી કોઈ તેની પાસે આવ્યું નહિ.

એ ભૂમિ પર પડેલા પરિત્રાજકના શરીરને ચુંથતી તેના હાડ માંસનું લક્ષણું કરતી ને ઇધીરનું પાન કરતી વાનરીઓથી રાત્રીના ચારે પ્રહુર વિદીર્ણ થતો પરિત્રાજક મરણ પામીને અજ્ઞાન તપથી અજ્ઞાનથી ભરેલો રાક્ષસ થયો. વાનરીઓ પણ ત્યાંથી લાગ મલતાં નાશી ગઈ, પ્રાતાંકાળે શિષ્યો ગુરુને મરણ પામેલા જાણી તેમની ઉત્તર કિયા કરતા શોક કરવા લાગ્યા.

રાક્ષસ થયેલા પરિત્રાજકે વિલંગજ્ઞાનથી સુભૂમ રાજનો આ બધો વ્યતિકર જાણી તરતજ સુભૂમ રાજને મારી નાખ્યો, એના જુલમથી નગરના લોકો નાશી ગયા, પણ પરલખના ગ્રેમથી અમો અજ્ઞેને તે મીઠી નજરે જોતો, તે જ્યારે બહાર જાય છે ત્યારે શ્વેત અંજનથી કરલીદ્દે અનાવે છે અને આવે છે ત્યારે કૃપણંજનથી જીર્ણે પ્રગટ કરે છે.

આ અમારી કથા છે. આ રાક્ષસના પંજમાં આજ કેટલાય સમયથી આ કેદખાનામાં પહેલાં અમે હેરાન થઈ રહ્યાં છીએ, તો હે સન્જન ! આ યમના બંધુસમાન પાંચીના પંજમાંથી અમને સુક્ત કર.” એ ભાળાએ એ પ્રમાણે પોતાની વાત પૂરી કરી.

તેમની વાત સાંભળી દ્વારા કોમલ હૃદયવાળો સુભિત્ર બોલ્યો. “તે રાક્ષસ ક્યારે ગયો છે ને ક્યારે આવશે ?”

તે રાક્ષસ રાક્ષસદીપમાં જાય છે તે એ ત્રણ હિવસે આવે છે. અહીંથાં એની મરણ પડે ત્યાં સુધી અડવા-ડીથ, પખવાડીથું રહે છે ને પછી પાછા ચાલ્યો. જાય છે. પરંતુ આજ રાત્રે તે જરૂર આવશે. માટે હે સુંદર ! આજની રાત તમે લોંઘરામાં રહો, પ્રલાતે તેના જવા પછી આપણું જેમ ચોખ્ય લાગશે તેમ કરશું.” સુભિત્રને એ વિચાર ચોખ્ય લાગવાથી તે નીચે ઉતરી ભૂમિશુદ્ધમાં છૂપાઈ ગયો, તે પહેલાં શ્વેતાંજનથી તે બન્ને ભાળાએને કરલીઝે કરી હતી તેવી વ્યવસ્થા કરી હીધી.

સાંધ્યા સમયે રાક્ષસ આવી પહોંચ્યો. તે બન્ને કરલી ખુગલને મૂળ સ્વરૂપ ધારણ કરાવતો બોલ્યો. “છી ! છી ! મનુષ્ય ગંધ અહીં કર્યાંથી ?” “અહીં મનુષ્ય કર્યાંથી ! અમે બન્નેજ માત્ર મનુષ્ય તો છીએ : સિવાય કોઈ નહિ.” તે બન્ને સીએઓ રાક્ષસને વિદ્યાસ પમાડતી બોલી.

તેમના વચનથી વિદ્યાસ પામેલો. રાક્ષસ રાત્રી વ્યાલી કરીને પ્રાતઃકાળે જવાની તૈયારી કરવા લાગ્યો. પોતાને કરલી બનાવે તે પહેલાં એ બન્ને ભાળાએ બોલી. અન્યમે એકલી અહીં જાય પામીએ છીએ માટે તમારે લરાખી આવનું.”

રાક્ષસ એમનું વચન સાંભળી-અંગીકાર કરી કરલી

કરીને ચાલ્યો ગયો, તેને ગયેલો જાણી સુમિત્ર શિધપણે ભૂમિગૃહથી ઉપર આવી એ બન્ને કરલી યુગલને કૃષ્ણાંજનથી મૂળસ્વરણે પ્રગટ કરી.

એ બન્ને મહા રૂપવાન કન્યાએને અટ નીચે ઉતારી તેણે બન્નેને કરલી બનાવી દીધી, એકની ઉપર રત્ન વગેરે અવેરાત લાણું અને બીજી ઉપર પોતે એઠા, પેદી ખેતે અંજનની ડી તેમજ સણીએ સાથે લઈને શીધતાથી મહાશાલપુર નગર તરફ ચાલ્યો.

તેને મહાશાલપુર તરફ જતાં ભાર્ગમાં એક સિદ્ધ પુરુષ મહ્યા, એ મંત્રસિદ્ધ પુરુષને પોતાની સર્વે હકી-કૃતથી માહૃતગાર કર્યા, સિદ્ધ પુરુષે એની બીના સાંભળી સુમિત્રને આધ્યાત્મન આપ્યું.

પછિવાડે રાક્ષસ કોથથી ધમધમતો ને પૃથ્વીને કંપ્યા-વતો ત્યાં આવી પહોંચ્યો, એ લયંકર રાક્ષસને જોઇ સુમિત્ર તો નાસી ગયો પણ પેલા સિદ્ધ પુરુષે મંત્ર વિદ્યાથી એ ખળવાન રાક્ષસને થાંલાવી દીધી.

મંત્રની અપૂર્વ શક્તિથી રાક્ષસનો મહ ગણી ગયો, મંત્રસિદ્ધ પુરુષને નમસ્કાર કરતો એલ્યો. “હે મહા ભાગ ! મને મુક્તા કર, ખળવાન એવા અમારાથી પણ મંત્રશક્તિ અધિક ખળવાન છે તે મેં આજેજ જાણ્યું !”

“આ સુમિત્ર સાથેના વૈરનો ત્યાગ કર !” એ સિદ્ધ પુરુષે રાક્ષસને હકોયાં કહ્યું.

“તમે કહેશો તેમ કરીશા, પણ આ મારી એ પ્રિયાએ અમે પાછી અપાવો, ” રાક્ષસે કહ્યું.

અરે અથમ ! આ પરસ્ક્રી તારે શું કામની છે ? ખૂબે પણ એ સ્વીએના લોલથી તું અકાળ મરણ પામી પલિત રાક્ષસ થયો છે માટે હવે રો એથ પામી તેમનો ત્યાગ

કર. સિદ્ધ પુરુષના વચનથી બોધ પામેલા રાક્ષસે તેનું વચન અંગીકાર કર્યું, પછી તો સુભિત્રને ખમાવી બને સ્ત્રીઓ અને દોલત તેને અર્પણ કરી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો.

સુભિત્ર પણ સિદ્ધ પુરુષનો ઉપકાર માનતો ને એના ગુણોને યાદ કરતો મહાશાલપુર નગરમાં આવ્યો. ત્યાં ભાડે મકાન રાખી બને પ્રિયાઓ સાથે સુખ બોગવતો આનંદમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો.

### ૬

#### મેદાપ.

મહાશાલપુરમાં વૃદ્ધ અજ્ઞાયે ભણિની ચોરી કર્યા પછી શુખ્યુપ સમયવતીનિ સુભિત્ર તો નિકળી ગયો. સુભિત્રના જતા રહેવાની અખરથી અજ્ઞા તો રાજ થઈ ગઈ હતી. “ઠીક થયુ તે ટાંત્રા પાણીએ ખસ ગઈ.”

સુભિત્રના જવાથી રતિસેના તો દુઃખી દુઃખી થઈ ગઈ, તેણીએ તો આનપાન તળુ દીધાં, સ્નાન કરવું, વસ્ત્રાંકાર ધારણ કરવા એ પણ છોડી દીધું. સુભિત્ર ઉપર એક પ્રીતિવાળી રતિસેનાને ત્રણ ઉપવાસ થયા, એક સુભિત્રનોજ જાપ કરતી ને તેનામાંજ એક લક્ષીવાળી રતિસેનાનું મન કયાંય રમતું નહિ.

રતિસેનાની આ સ્થિતિ જોધ એની માતા કુદિની ગભરાણી “હાય ! આમ તો પુત્રી મરી જશે શું ?” મનમાં વલેખાપાત કરતી રતિસેના પાસે આવીને બોલી. “અરે પુત્રી ! તને થયું છે શું ? આ નગરમાં અનેક ધનવાન અને ઇપવાન નવજવાનો એક એકથી અધિક છે. તારં રસસર્યું મન કોઈનીય સાથે નથી રમતું શું ? મન ગમતાં બોજન કર. આપણે તો એક ધનનેજ વરીએ મળુષ્યને નહિ.” કુદિનીએ રતિસેનાને સમજાવવા માંડી.

કુદ્રિનીનાં વચન સાંભળીને સુભિત્રમાં એક નિધાનાળી રતિસેના બોલી. “અનેક નદીઓના સંગમે કરીને પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, અભિ જેમ જેમ કાઢુને અહેણું કરે છે તેમ તેમ તેની ભૂખ વૃદ્ધિ પામે છે. તેમ હે પાપિણી! મારા સ્વામીએ તને ધનથી માલમાલ કરવા છતાંથી તારું પેટ ભરાયું નહિ, પણ યાદ રાખજે અભિ મારા શરીરનો સલે સ્પર્શ કરે કિંતુ સુભિત્રને છાડીને બીજે સુંદરમાં સુંદર ગણ્યાતો નર પણ મારા શરીરને નહિ સ્પર્શી શકે!”

રતિસેનાને અનેક રીતે સમજાવવા છતાં એતો નિશ્ચય અહંગ જાણીને કુદ્રિનીએ આખરે નમતું મૂકીને સુભિત્રને શોધી કાઢવાનું કણુલ કરી પારણું કરાવ્યું. ત્યારથી અક્ષા નગરના ચારે ખુણે શોધ કરતી લમવા લાગી. પણ સુભિત્ર જની ભાગ કાંઈ મળી શકી નહિ.

કેઠેલોક સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસે કુદ્રિની બજારમાંથી જતી હતી તે સમીપે રથની અંદર વસ્ત્રાલ કારથી સુસજજ ઘેઠેલા સુભિત્રને જોઇ તેની પાસે ઢાડી આવી.

“હું સુંદર! હે મહાભાગ! તું આમ એકાડી અમને કહ્યા વગર જતો રહ્યો તે સારું કર્યું નહિ, મારી નિર્દોષ પુત્રી તારા વિરહથી દુઃખનો અતુલવ કરતી ભરવા પડેલી છે તો તું ત્યાં આવીને મારી પુત્રીને લુવિતદાન આપ. અરે! એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અમે તારી શોધ ન કરી હોય. છતાં બહારથી મનોહર પણ અંદરથી કઠોર કૂદ્યવાળા તેં અમને નિર્દોષને તજી દીવાં એ કાંઈ સારું કર્યું કહેવાય નહિ.”

માયા કષ્ટ ભરેલાં કુદ્રિનીનાં વચન સાંભળી એના હોવભાવ જોઇ સુભિત્ર વિચારમાં પડયો. “અહો! હજુ

પણ એ પોતાની ભાયા છાડતી નથી. પોતાના પાપને કુપાવી ઝરીને પણ મને કઈ આશાએ હળવા આવી હો? પણ ભાયાથી ગ્રહણ કરેલું મારું ચિત્તામણિ હું પણ ભાયાં વડે કરીને ગ્રહણ કરું તો જ અરો. એ તો “શઠં પ્રતિ શાઠં કુર્યાતું”

મનમાં વિચાર કરી સુભિત્ર મધુર ભાષાએ બોલ્યો. “અરે! તમે મને મહ્યાં તે સારું થયું. હજુ તો ગઈ કાલેજ હું આ નગરમાં આવેલો છું, પણ કાર્યની વ્યવતાથી તમને મળવા અવાયું નથી તો મારું કરણે. હૂર દેશથી હું પુષ્કળ બન કરી લાવેલો તેની વ્યવરસ્થા કરીને અનતા લગ્ની સાંજના આપીશ, અરે હૂર હોવા છતાં એક પણ દિવસું તમને હું ભૂલ્યો નથી, દિવસે શું કે રાત્રે શું આતાં કે પીતાં પણ તમારું સમરણ હૈયામાંથી હૂર થતું હોય તો મને તમારા સમ છે દ્યો.”

સુભિત્રની મધુર વાણી સાંભળીને તે અક્ષાએ વિચાર્યું “આ ભારા પાપને જાણુંતો નથી તેથી ભલે એ આવેજ એનું ધન વાતવાતમાં ન પડાવું તો મારું નામ અક્ષા નહિં. પણ પેણ રેલ તો હું એને આપીશજ નહિં.” એમ વિચારતી સુભિત્રને આમંત્રણ આપી તે કુદિની ચાલી ગઢ, રતિસેનાને પણ એ હર્ષના સમાચારથી ખુશી કરી.

સાયંકાળે સુભિત્ર તૈયાર થઈને પેદી શેતાંજનની ગણી ગ્રહણ કરીને રતિસેનાના મડાન તરફ ચાલ્યો. રતિસેના પાસે આવીને આડી અવળી વાતોથી તેજીને ખુશી કરી, “જો પ્રિયા! તને કંઈક આશ્ર્ય ભતાવું!”

એ આશ્ર્ય જોવાને આતુર થયેલી રતિસેનાની આમંત્રણ પેણ શ્વેતાંજનનું અંજન કરી કરલી (હાથિણી) અતાવીમાં પોતાને મડાને ચાલ્યો ગયો.

પ્રાતઃકાળે કુદ્રિનીએ પોતાની પુત્રીને બદલે હાથિણી જેવાથી છાતી કુટ્ઠી માથાં પછાડવા લાગી, અના પોકા-રથી આડાશી પાડાશી લેગાં થથ ગયાં, એમના પૂછવાથી અક્ષા બોલી. “આ હૃષા રાક્ષસીઝપ કરલી મારી પુત્રીને આઈ ગઈ, હું શું કર? કચાં જાઉ?”

“અરે! તારી પુત્રી સાથે હાલમાં કોણ રહેતું હતું?” એક જણે પૂછ્યું. “કોઈક પરદેશી, જેનું નામ, ધમ હું કંધ જાણુતી નથી.” અક્ષા બોલી.

કુદ્રિનીના જવાબમાં લોકો બોલ્યા. “નક્કી તારી પુત્રીના કંભક અપરાધથી એ પરદેશીએ જ તેણુંને કરલી કરેલી જણાય છે તો જટ રાજસભામાં પોકાર પાડ, નહિં તર એ પરદેશી નાસી જશે.”

લોકોની સલાહથી કુદ્રિનીએ વીરાંગન રાજની સભામાં ઝરિયાદ કરી પોતાની હકીકત કહી સંભળાવી. કુદ્રિનીની આ રસભરી કથા સાંસથી રાજ સહિત રાજસભા હાસ્ય અકિત ઘની. રાજ વિચારમાં પડ્યો. “આવી શક્તિ ધરાવનાર પુરુષ કોણ હો ! રખેને મારો ભિત્ર તો ન હોય!”

રાજએ રાજપુરુષોને હુકમ કર્યો, “આ અક્ષા ડાશીની સાથે આપણા નગરમાં એ પુરુષની તપાસ કરો. ઓં ડાશી ને પુરુષને બતાવે તેને આહરમાન સહિત રાજસભામાં હાજર કરો.”

રાજની આજાથી રાજપુરુષો નગરમાં અમતા અમતા ન્યાં સુભિત્ર રહેતો હતો. ત્યાં આવી પહોંચ્યા. કુદ્રિનીના આતાવવાથી એ પુરુષને સમજાવીને રાજપુરુષોએ રાજસભામાં તેડી લાવી રાજની સમક્ષ રજુ કર્યો.

રાજપુરુષો સાથે હૂરથી આવતા સુભિત્રને એણાખીને રાજ એકદમ સિંહાસનથી ઉઠીને એ પુરુષને લેટી પડ્યો.

“હું ધૂર્તરાજ ! કુશળ તો છા ને ?” રાજ સુભિત્રને લેટી હસીને બોલ્યો.

એ હાથ જોડી નમસ્કાર કરતો સુભિત્ર બોલ્યો “હેવની કૃપાવડે.”

“મિત્ર ! આ ઊશીની પુત્રીને તેં કરલી શા માટે અનાવી તેનું કારણ મને વિસ્તારથી કહે.”

રાજના પૂછવાથી સુભિત્ર મૃદુ હાસ્ય કરતો બોલ્યો. “મહારાજ ! જંગલમાં વનવૃક્ષનાં પાંદડાં તે સુષેષ્ઠી ચરે, ને આ ઊશીને ગામાંતરે જવું હોય તો તેના ઉપર એસીને જધ રાડે, એના લોજનનોય એને ખર્ચ નહિ, તેથી મેં એને કરલી અનાવી છે. હેવ !”

તેનાં હાસ્યજનક વચ્ચે સાંલળી ધમધમી રહેલી કુદ્દિની બોલી, “હે ધૂર્ત ! હે જાહેર ! રાજસલામાં રાજની આગળ તો સાચુ બોલ જરી, તારં ડહાપણ તો જોડું, પ્રથમ મારી પુત્રીને સંજ કર, પછી તારા ડહાપણની વાત કર.”

ઊશીની વાત સાંલળી સુભિત્ર બોલ્યો. “ઉતાવળી ન થા, જરા ધીરી થા ધીરી, મોદ્ય પૈટવાલી રાસલી (ગંગાડી) અનાવીને તને લોકોની વિદ્ધા ચરાવું ત્યારેજ મારં ડહાપણ તો તને જણાશો, સમજુ ? હજુ ડાહી થઈને મારો મણિ પાછો આપ !”

સુભિત્રની વાત સાંલળી રાજ બોલ્યો “કયો મણિ ?”

“સ્વામી ! જેના પ્રભાવથી આપણે જંગલમાં મન ભાવતાં લોજન કરતા હતા, ઘરની માર્ક રહેતા હતા, એ મણિ આણે ચારી લીધો છે હેવ !” સુભિત્રની વાત સાંલળી આંખ લાલચોળ કરતો રાજ ઊશીને ડારતો ગંધેરી “રે હુણ ! આ વાત ખરી છે ? સાચું બોલજે નહીં તર તારી આના ખરાણી થઈ જશે.”

રાજના રોષથી ભયથી છૂઝતી હુદ્ધિની સુમિત્રના પગમાં નમસ્કાર કરતી ઓદી. “મને માર્દ કર, તારો મણિ અહેણુ કરીને પણ મને રાજના ભયમાંથી મુક્ત કર.”

સુમિત્રે રાજને સમજવવાથી રાજએ એને લય મુક્ત કરી, તાસીએ મણિ લાવીને સુમિત્રને સ્વાધીન કર્યો. સુમિત્રે રતિસેનાને સજજ કરી, રતિસેના પોતાની માતાના સ્વરૂપને જાણી સુમિત્રમાં ગાડ પ્રીતિવાળી થયેલી હોવાથી અફ્કાએ રતિસેના સુમિત્રને આપી. રાજના આદેશથી રતિસેનાને મેળવી સુમિત્ર આનંદ પામ્યો.

રાજએ સુમિત્રને પોતાના મહેલની બાજુએ મનોહર એને ગગન ચુંબિત રંગમહેલ નિવાસ માટે આપ્યો. તણે પ્રિયાએ સાથે મોજ કરતો સુમિત્ર રાજના પ્રસાદથી મિત્રમાંથી મંત્રી થયો.

એક દિવસે રાજ સુમિત્રને કહેવા લાગ્યો, “હે મિત્ર ! તને મણિનો લાસ શી રીતે થયો ? તેમજ મને મુક્તિને તું કેમ જતો રહ્યો ? આરક્ષે બધો વખત તું કયાં રહ્યો ? શું સુખદુઃખ લોગવ્યું ? તે તમામ વૃત્તાંત મને કહે.” રાજની જ્ઞાસા રૂપ કરવાને સુમિત્રે મણિ સંઘંધી તેમજ બીજો પણ પોતાનો સર્વ વૃત્તાંત રાજને કહી સંભળાવ્યો, જે સાંભળીને આશ્ર્ય પામેલો રાજ ઓદ્ધયો.

“જગતમાં લક્ષમી ઉદ્ઘમથકી મલે છે. પથ્યાહારથકી શરીર નિરોગી નથી રહેતું શું ? પુણ્યથી સ્વર્ગ કે અપ્રવર્ગ પણ મલેજ.

“હે પ્રલે ! પુણ્ય વિના વ્યવસાય પણ દ્રોતરાંની માર્દક નિષ્કળ જય છે. જગતના પરમ પદાર્થ તો પુણ્ય વગર નથી મલી શકતા, આપને વિના ઉદ્ઘે રાજ્ય લક્ષમીની પ્રાપ્તિ થઈ તે પણ પુણ્યના ઉદ્ઘથીજ સમજવી.”

સુમિત્રે રાજને પુષ્યનો મહિમા સમજાવતાં પેલા શૂન્ય નગરને કરીને વસાવવાની વાત પણ કરી દીધી.

કેટલોક કાલ સુખમાં વ્યતીત કર્યા પછી રાજ સુમિત્રને લઈને તે શૂન્ય નગર મહાપુર તરફ ગયો, એ શૂન્ય નગર મહાપુરને કરી વસાવી એક ભાણુસને તેના કારલાર માટે પસંદ કરી પોતાની આણ પ્રવર્તાવી. રાજ વીરાંગણ સુમિત્ર સાથે મહાશાલપુર નગરે આવ્યા, બન્ને લોગસુખ-ઇપી સસુદમાં મમ થયેલા પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા. “રતનશિખ રાજની સભામાં એક કથાકારે આ પ્રમાણે પોતાની વાર્તા પૂરી કરી, મુશી થયેલા રાજ એ લેટ આપીને એનેથ મુશી કર્યો.

## ૭

## રતનશિખ

વીરાંગણ અને સુમિત્રની કથા સાંભળી આશ્વય પામેલો રતનશિખ રાજ તેમના લારે પુષ્યની પ્રશાસા કરતો મનમાં વિચાર કરવા લાગ્યો. “હું પણ પરદેશમાં જઈને માર્દ લાગ્ય અજમાઉ તો ! વીરાંગણની માડક માર્દ પણ પુષ્ય કેટલું છે તેની પરીક્ષા તો કરી જોઉ.”

એક દિવસે રાજ રતનશિખે પોતાનો એ પરદેશ ગમનનો અભિપ્રાય પૂર્ણભદ્ર મંત્રોને નિવેદિત કર્યો. પુષ્યના ઇલરૂપે મળેલું મોડ રાજ્ય છાઢી વિદેશ ગમન ધર્યાનાર રાજની વાત સાંભળીને નવાધ પામેલો મંત્રી બોલ્યો. “હું ! આપની ધર્યાની આઉકોણ આવી શકે તેમ છે, અતાં પણ હું આપને કંધક વિનાંતિ કરવા ધર્યાંછું છું.”

મંત્રીએ આહકતરી રીતે વિદેશગમનની મુરકેદીએ સૂચવવી શરૂ કરી. “વિદેશ હુંએ કરીને ગમન કરવા

શોભય છે. હગલેને પગલે વિદ્રોહનો એમાં પાર નથી. પળ મેળવીને શત્રુઓ એવી તક જવા હેતા નથી. આપ સુકોમલ કાયાવાળા છો તેથી ભાગ્યથી પ્રાપ્ત થયેલું આ રાજ્ય હેણે સ્વામી! આપ લોગવો. પૂર્વ પુષ્યના સાક્ષાત કલ સમાન આ મોડું રાજ્ય આપને મલવા છતાં આપ એથી વિશેષ કયા કેલને ધર્યા છો વાર?"

મંત્રીએ સારી રીતે સમજાવવા છતાં રાજ્યએ પોતાનો નિશ્ચય છોડ્યો નહિ. નિશા સમયે ને રાત્રીના ચતુર્થ પ્રહૃતે હાથમાં માત્ર એક ખ્રદ્દગને ધારણ કરીને ગુપ્યુપ રાજ્ય નગર બહાર નિકળી ગયો. સારા શકુનથી ગ્રાત્સાહિત થયેલો રલનિષિઅ ઉત્તર દિશા તરફ ચાલ્યો.

મનોરથદ્વારા રથમાં આર્દ્ર થધને પુષ્યરૂપી સૈન્યથી પરવરેલો અને સંતોષદ્વારા મંત્રીએ યુક્ત રલનિષિઅ અનેક આમ, નગર, પર્વત, નદી, નાળાં, વગેરેને જોતો, નવીન કૌતુકને નિહાળતો સુનિની ભાડુક ક્ષમાને ધારણ કરતો, ભૂખ અને રૂપાને સહન કરતો, પૃથ્વી ઉપર શયન કરી સુખદુઃખમાં સમાન વૃત્તિને ધારણ કરતો હતો. દેશ-કોશની હવાને નિહાળતો રલનિષિઅ અતુક્તે ભયંકરે એટલીમાં આવ્યો.

એ ભયંકરે એટલીમાં તે હિંમતપૂર્વક ડેઈનો પણ લય રાખ્યા સિવાય આગળ વધ્યો તો એક ભયંકરે અને વિકરાળ, વિચિત્ર ગજરાજ એણે જોયો. એ વિકરાળ ને મહોન્મત હસ્તી નિરંકુશપણે વનની હવા લોગવતો હતો. તે દરમિયાન તેની નજર સામે આવી રહેલા આ નર પર પડી.

પોતાની સામે આવતા આ નરને જોઈ હુંવાપુરાં થયેલો. ને ધીજાની હાજરીને નહિ સહન કરનારો ગજરાજ કીધથી ધમધમતો એ પુરુષને હણુવાને તેની તરફ ધસ્યો.

યોતાની સામે દોડચા આવતા એ વિકરાળ ગજરાજને જોઈ, એ નર (રલશિખ) સાવધ થઇ ગયો. હુસ્તી સાથે તુલ્લ કરતો ને એને ભાગાડીને-દોડાવીને થકવી નાખતા રલશિખે શિધપણે હાથીને વશ કર્યો. હાથી પરિશ્રમિત થઇને મહરહિત થઈ ગયો.

આકાશમાંથી મનોહર અને સુગંધમય પુષ્પોની શુંઘેદી એક સુંદર પુષ્પમાળા એ વિજયી રલશિખના કંઠમાં પડવાથી રલશિખે ઉંચ્ચે નજર કરી તો ઈંદ્રની મનોહર અપ્સરા સમાન એણે વિધાધર બાળાએને જોઈ, એમના સુખેથી સાંસારયું. “સાર થયુ, સાર થયુ” એમ ઘોલતી તોણીએ ચાલી ગઈ.

રલશિખ પણ એ પર્વત સમાન ગજરાજ ઉપર આરંદ થઇને પેલી સુગંધમય પુષ્પમાળથી શોભતો ઉત્તર દિશાએ ચાલ્યો. આગળ જતાં તેણે મનોહર અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર જોયુ, એ જળમાં કીડા કરવાને હાથીને છુટો સુકી પોતે ભૂમિ ઉપર કુદી પડ્યો.

એ જલતું પાન કરી સ્તનાનથી શ્રમને ફૂર કરતો રાજ રલશિખ સરોવરને કાંડે રહેલા એક મેદા વૃક્ષની નીચે એઠો, તેની આગળ કેદીક ચુવતીએ હિંય વસ્તોને લઇને આવી. હિંય વસ્તોને આપી તાંખુલાફિક્વડે રાજનો સત્કાર કરતી તે રમણીયા બોલી. “અપૂર્વ હેવ એવા આપનું સ્વાગત હો ! આપનો વિજય હો !”

“હું અપૂર્વ હેવ ડેવી રીતે ?” રાજએ વિસ્મય પામની પૂછ્યું.

“ધણા કાલ સુધી સેવા કરીયે ત્યારે હેવતાએ તો બે પ્રસન્ન થયા હોય તો સુખને આપે છે ત્યારે આપે તો દશ્ચિ માત્રથી અમારી સખીને સુખ આપ્યું એ અપૂર્વતાં નહિ તો બીજુ શું ?” એક સખી બોલી.

એ સ્ત્રીઓનાં વચન સાંભળી રાજ બોલ્યો. “કોણ તમારી સખી? તેણીએ મને ક્યારે જોયો?” રાજની વાત સાંભળીને સખી બોલી કે-

“હે વીર! સાંભળો. ઉત્તર દિશાને વિષે વૈતાથ્ય નામે પર્વત પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં પોતાની પાંખોને ફેલાવતો પૃથ્વીનો જણે માનદંડ હોય તેવી રીતે રહેલો છે. ત્યાં સુરસંગીતપુર નામે નગરમાં સુરણ નામે વિધાધરોનો રાજ હતો, તેને લિન્ગલિન રાણીએ થડી શશિવેગ અને સુરવેગ નામે બે પુત્રો થયા.

અન્યદી વૈરાઘ્યમય હૃદયવાળા સૂરણે વડીલપુત્ર શશિવેગને રાજ્ય સમર્પણ કરી દીક્ષા અહેણ કરી આત્મ સાધના કરી. શશિવેગ પાસેથી રાજ્યની લજાસાનાળા સુરવેગે પોતાના માભા સુવેગનો આશ્રય અહેણ કરી તેની મહદ્ધથી સૈન્ય વડે શશિવેગના નગરને દેરી લીધું. મંત્રીએના કહેવાથી રાજનગરનો ત્યાગ કરી શશિવેગ પોતાના પરિવાર સાથે ચાલ્યો ગયો.

આ મહા અટવીમાં રહેલા સુગિરિ પર્વત ઉપર નવીન નગરની સ્થાપના કરીને સૈન્ય સાથે શશિવેગ રહ્યો. અનુકૂળે તેની ચંદ્રપ્રભા નામે પુત્રી યુવાવસ્થામાં રમવા લાગી. તેને જોઈને નિમિત્તિએનો કહું. “હે રાજન! જે પુરુષ આ બાલાને પરણશે તેની સહાયથી તમને રાજ્ય મલશે.”

નિમિત્તિએની વાણી સાંભળી રાજ બોલ્યો. “આ બાળાનો પતિ કોણ થશે? ને એ ઓળખાય પણ શી રીતે?”

સુશ્રિવપુર નગરના રાજ વસુતેજસનો ભદ્રાન્મતા ગજરાજ આલાન સ્થંભને તોડી જંગલમાં ચાલ્યો જશે. તેને જે વશ કરશે તે જ આ બાળાનો પતિ સમજજો. નિમિત્તજ્ઞ પુરુષે રાજને ઓળખાણ આપી.

“આજે તમે એ હુદ્દમ હાથીને વશ કરવાથી વિમાનમાં રહેલી એ ભાગાએ તમારા કંઠમાં પુણ્યમાળ નાખી ને આ વસ્ત્રાભરણ પણ તેણુંને મોકલાવ્યું છે. તમને જોતાંજ એ ભાગા તમારા પર પ્રીતિવાળી થયેલી છે.” વિધાધરીએ રલશિખને વાત કહી સંભળાવી.

તે વાત હરમિયાન કેટલાક ઘાઉસવારો ત્યાં આવી પહોંચ્યા. રલશિખ પાસે આવી એક ઘાઉસવારે નમન કરી પૂછ્યું. “મહોન્મત ગજરાજ પર આડિ થયેલો પુરુષ કયાં ગયો તે તમે પ્રસન્ન થઇને કહો. તેના શરીરને કુશલ તો છે ને?”

એ પુરુષનો પ્રક્રિયા સંભળી વિધાધરી બોલી. “શું ગજેન્ક્રના ચોરને તમે પડડવા આવ્યા છો વાં?”

“ના, ના, એમ નહિં. અમારા સ્વામી તેમના પરાકરણી ખુશી થયા છતા તેમનું દર્શન ચાહે છે.” ઐદો પુરુષ બોલ્યો.

“આ પરાકરણીએ જ આ મહોન્મત હુસ્તીને વશ કર્યો છે. એમના સિવાય બીજાનું આવું પરાકર કયાંથી હોય? તમારા સ્વામીને એ સમાચાર કહો કે જેથી તેઓ અહીં આવીને ભલે જુએ.” વિધાધરી બોલી.

વિધાધરીની વાત સંભળીને ઘાઉસવારોએ પોતાના નગરમાં જઈને પોતાના રાજને એ સમાચાર કહ્યા. રાજ વસુતેજસ ખુશી થતો એ પુરુષને પોતાના નગરમાં લઈ જવાને તે સરોવરને કંઠે આવ્યો.

વિધાધરીએના ચાલ્યા જવાથી સરોવરને કંઠે રહેલા એકાડી રલશિખને તે માનપૂર્વક પોતાના નગરમાં તેડી લાવ્યો. રાજસભામાં યોગ્ય આસને બેસાડી વસુતેજસ રાજ બોલ્યો. “હે વીર! મારે આડ કન્યાએ છે તેને

પરણુને આ મારુ રાજ્ય પણ તમે અહૃષુ કરો, સંસારના સ્વરૂપથી ભય પામેલો હું હવે સંયમને અહૃષુ કરીશ.

કુમારે તેનું વચ્ચેન અંગીકાર કરવાથી ચાર કન્યાઓ સાથે પાણીઅહૃષુ કરાવી રાજ્યાભિષેક પણ કરી દીધોં ઉપરથી કંઈક શિખામણની વાત કહી સંભળાવતાં રાજ ઘોલ્યો.

“હે કુમાર ! આ લોક અને પરલોક વિરદ્ધનો ત્યાગ કરવો, ન્યાયથી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું, રાજ જો પ્રજાનું ન્યાયથી પાલન કરે તો પ્રજા જે ધર્મ કરે તેનો છુંદો ભાગ રાજને મળે, પાપી રાજ હોય તો પ્રજાના પાપનો છુંદો ભાગ રાજને મળે માટે શાઠનું હમન કરીને સજજન પુરુષેનું તારે રક્ષણ કરવું, તેથી હે રાજન ! તમે પ્રજાનું એવી ઇડી રીતે પાલન કરજો કે તે અમને કદાચિ સંભાળો નહિન,” નવા રાજને સારી રીતે શિખામણ આપી સંયમ અહૃષુ કરવાને તેણે રાજની અતુમતિ માણી.

નવા રાજએ ઇડી રીતે દીક્ષા મહોત્સવ કરેલો છે એવા વસુતેજસ રાજએ સદગુર પાસે દીક્ષા અહૃષુ કરી, રત્નશિખ રાજએ ગુરુ પાસે સમકિત અહૃષુ કરી, ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગ્યો.

શશિવેગ રાજએ આ સમાચાર જાણુને પોતાની કન્યા ચંદ્રપ્રભાને રત્નશિખ રાજ સાથે પરણાવી, ને એક હુલર વિધા આપી સંપૂર્ણ શક્તિવાન બનાવ્યો, આ વૃસાંત જાણુને સુરવેગનો મામો સુવેગ કોથથી હાથીનું રૂપ કરી રત્નશિખને મારવાને આવ્યો.

રાજના ઉધાનમાં એક વિચિત્ર હસ્તીની વાત જાણુની રાજ હસ્તીને પકડવાને આવ્યો, અનેક ઉપાયને જાણુનારો રાજએ આપ્યે એ ગજરાજને પકડી પાડીને ઉપર ચઢી

એઠા કે હાથીએ આકાશમાં ઉડવા માંડયું, ગજરાજની આ ચેષ્ટા જોઈ રાજાએ વજુ મુઢીથી એની પીડી પર ઘા કર્યો, મુણિના પ્રહારથી વ્યાકુળ થયેલો ગજ “નમોર્હ-દ્રમયઃ” કહેતો ભૂમિ પર પડી મૂર્ચિંધિત થઈ ગયો.

“અરે મેં સાવર્ભિકની આશાતના કરી” એમ બોલતો રલશિખ એના મૂળસ્વરૂપને જોઈ વ્યાકુળ થઈ ગયો, શીત જળ અને પવનથી એને સાવધ કરી રલશિખ બોલ્યો. “અરે! તને ધન્ય છે કે હુંખમાં પણ તું જીનેથીર ભગવાનના નામને છોડતો નથી, લાઈ! અજાણતાં મેં તારી આશાતના કરી છે તે મારો અપરાધને તું ક્ષમા કર.”

રલશિખના વચનથી શાંત થયેલો વિદ્યાધર બોલ્યો. “હું રાજન! તમારે કાંઈ હોષ નથી, મેં જેવું કર્યું છું તેવુંજ આ ભવમાં મને ફ્લ પ્રાપ્ત થયું; માણસ અજ્ઞાનતાથી પાપ કરે છે પણ તેના ફ્લને જાણતો નથી, કારણુંકે મધુર હૃથનું પાન કરનારે માર્જર લાકડીના ભયને જોતો નથી.”

“તમે કોણ છો ને આ બધું તમારે શા માટે કરવું પડયું?” રલશિખે પૂછ્યું તેના જવાબમાં વિદ્યાધર બોલ્યો.

### ૮ વિદ્યાધરોતું એક્ષર્ય.

“આ વैતાધ્ય પર્વત ઉપર ચક્કપુર નામે નગરનો અધિપતિ સુવેગ નામે હું વિદ્યાધર છું. સુરવેગ મારો ભાણેજ થતો હોવાથી તેનો પક્ષપાત કરીને શશિવેળ વિદ્યાધરને એના પિતાએ રાજ્ય આપેલું હોવા છતાં એને રાજ્ય પરથી હૂર કરીને મેં ભાણેજને રાજ્ય અપાવ્યું.

હાલમાં મેં જ્યારે સાંભળ્યું કે જામાતાની સહાયથી

શશિવેગ મારા લાણેજ પાસેથી રાજ્ય અહેણ કરવાને દુચ્છિ છે તારે તમને મારવાની છચ્છાએ ગજતું ઇપ કરીને શીક્ષણગતિએ તમારા ઉદ્ઘાનમાં આવ્યો પણ તમે દ્વારાણુએ શિક્ષા કરીને પણ મને પ્રતિષ્ઠોધ્યો. કારણુકે રેણીને વૈદે આપેલું તીજુ અને કહવું ઔપદ્ધ પણ ગુણુકારી થાય છે.

આ વિષમય સંસારને જાણ્યા પણી ડાઢ્યો પુરુષ તેની જળમાં ફૂસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળો હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરો, જેથી નિર્મણ એવા સંયમને હું આરાધું.

એ દરમિયાન સુવેગ રાજના અનેક વિદ્યાર્થર સુભાટો આવી પહોંચ્યા. શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો પણ ચુદ્ધના સીધણ જગતે બદલે અહીંયાં તો શાંત રસના તરંગો ઉછળી રહ્યા હતા. રાજ્યાદ છાડીને સંયમનો અભિલાષી સુવેગ કરીને રત્નશિખને કહેવા લાગ્યો “હે ધર્મબંધુ ! રાજ્યને અહેણ કર, મને સંયમમાં વિધન ના કર !” સુવેગની આ વાત સાંભળી તેના સુભાટો આશ્ર્ય પામ્યા.

સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિવેગ ઓદ્યો, “હે સાહસિક ! જગતમાં એક તમનેજ ધન્ય છે કે આવું વિદ્યાર્થરેના અશ્ર્યવાળું મોહક સાંગ્રાજ્ય તૃણની માર્ક છાડવાને તમે તૈયાર થયા છો, છતાં હાલમાં તો તમે તમારું રાજ્ય લોગવો. સમય આવ્યે સંયમને આરાધનો કેમકે યૌવનવયમાં દિદ્ધિય નિયંત્ર હુર્જય છે. પવનથી કંપાયમાન ધ્વજના જેવું ચંચળ મન છે માટે લીધેલા પ્રતનો લાંગ થાય તો મહા અનર્થનો કરેનાર છે જેથી અત્યારે તો ઝડી રીતે રાજ્યને લોગવો.”

રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વૈરા-

અથી ભરેલા હૃદ્યવાળો સુવેગ વિધાધરેશ્વર ચાર એવા ચારિત્રને જ અંગીકાર કરતો હતો, પોતાના રાજ્યની વ્યવસ્થા કરી રત્નશિખ શશિવેગની સાથે ચક્કાયુર નગરે ગયો, અનુષુદ્ધમે રત્નશિખ સમસ્ત બ્રેણિનો અધિપતી થયો ને શશિવેગ સાથે રત્નશિખ વિશાળ સુખનો અનુભવ કરવા લાગ્યો, વિધાધરોનું અપૂર્વ ઐથર્ય અને સાઓન્ય ભોગવવા લાગ્યો.

શશિવેગ વિધાધરે પોતાના ભાઈ સુરવેગની ઉપેક્ષા કરવા છતાં પોતાનું રાજ્ય પડાવી લેવા છતાં તે શશિવેગ મનમાં કંઈ પણ આશું લાવતો નહિ, તો પણ પોતાના માંમાના વૃત્તાંતની જ્યારે સુરવેગને અખર પડી ત્યારે તેના મનમાં કંઈક વિચાર આવ્યા, એ વિચારમાંથી એને વૈરાઘ્ય જોગો, એ વૈરાઘ્યરંગથી રંગાયેલ સુરવેગ પોતાના ભાઈને માટે રાજ્ય છાડીને ચાલી નીકળ્યો, એ મહાતુલભાવે રડા એવા ચારિત્રને અંગીકાર કર્યું.

વિધાધરોના અપૂર્વ ઐથર્યને ભોગવતો રત્નશિખ એના સુખ, સાધ્યાંસી, અને સૌભાગ્યનો તે કંઈ પાર ન હતો અવાંતરનો સંગત પામરનો એ જીવ, જેનું જીવન પણ સુસ્કેલી ભરેલું આજે હતું, એ પામરનો જીવ રત્નશિખની સુખ સમૃદ્ધિ મનુષ્યલભના સુખની લગભગ પરાકાશાએ પહેંચેલી હતી.

એ રત્નશિખ પોતાના આત્માને ધન્ય માનતો ને સમકિતની આરાધના કરતાં પૃથ્વીમંડળ ઉપર રહેલાં શ્રાધ્યત જીનેથરોનાં વૈત્યોને વાંદવા લાગ્યો, સાધુઓને નમસ્કાર કરતો, સાધ્યમિકની લક્ષ્ણ કરતો દીન, હીન અને ગરીબજનોનો ઉદ્ધાર કરતો તે પ્રજાનું સારી રીતે પાલન કરવા લાગ્યો એના રાજ્યમાં ચોરી, જારી, વિજારી, લુચ્યાઈ

અથુ અદરથ થઈ ગયું, રાજ્યામાં ગુનહારોનું પ્રમાણ નામની  
શિખ થઈ ગયું.

સાતે ક્ષેમમાં એણે વનનો વ્યય કરવા માંયો. પ્રતિ-  
માચ્યો જરાવી અંજનશલાકાવડે પ્રલાવિક અનાવી છું-  
માંહિરોમાં પ્રતિક્ષા કરવા લાગ્યો. સ્નાતવિધિમાં, છું-  
પૂજન, અર્થન તેમજ યાત્રાવિધિમાં ઝુખ વનનો વ્યય  
કરવા લાગ્યો, સંબન્ધી પૂજા, શાસ્ત્ર લાઘાવવામાં વનનો  
સદ્ગુર્યોગ કરી શાસનની પ્રલાવના કરવા લાગ્યો.

રતનશિખ રાજ્યે અનેક લાખ વર્ષું પ્રમાણ વિશ્લાષ  
સાગ્રાન્ય સુખ લોગયું, હેવતાની માર્ક સુખ અને  
ભોગોની રસિકતાઓમાં એને જતા એવા કાલની પણ ખણર  
પડતી નહિ, એ ભાગ્યશાળીના ઇડા ભાગ્યોગે સાકેતપુર  
નગરના ઉધાનને વિષે શ્રીસુયશ નામા તીર્થેકર ભગવાન  
મામવસર્યા જાણી મોટા આડંભરથી ત્યાં જઈને જીનેથીર  
લગવાનને નમ્યો, સુતિ કરી ઉચિત સ્થાનકે એસી જીને  
શીરની પાપ નાશ કરનારી દેશના સાંભળવા લાગ્યો.

હે ભાગ્યો ! આ સંસારદ્વારા વનમાં સર્વે જીવો કર્મને  
આધીન રહેલા છે પોત્યોતાના કર્મને અતુસારે તેઓ ઉંચ  
નીચ ગતિમાં ચાલ્યા જાય છે. કોઈ નરકમાં જાય છે તો  
કોઈ પુષ્યરૂપી જાતુ એકદું કરી હેવલોકે જાય છે કોઈ  
મનુષ્ય થાય છે તો ભાયા કપટમાં રચેલા કોઈ તિર્યં  
ગતિમાં ચાલ્યા જાય છે, મતુષ્ય લઘમાં પણ જીવોને કર્મ  
ચીતાનો અપૂર્વ પ્રલાવ ખતાવે છે કોઈ રાજ તો કોઈ રંક,  
કોઈ પંહિત તો કોઈ સૂર્ય, કોઈ શ્રીમંત તો કોઈ ગરીબ,  
કોઈ સૌલાઘ્યવાળા તો કોઈ હર્ષાંગી, કોઈ દાતાર તો કોઈ  
કૃષ્ણ, કોઈ સુખી તો કોઈ હુંઘી, કોઈ પૂજનિક ફુને છે  
તો કોઈ અપમાન પામે છે; કોઈ દૃપવાન તો કોઈ કદ્વિપી

કોઈ સજજન તો કોઈ હર્જન, કોઈ મહુર કંઠવાળા  
તો કોઈ કર્કશા કંઠવાલા, કોઈ કીર્તિને વરેલા તો કોઈ  
અપયરણના લાગી, કોઈ આનણ તો કોઈ ક્ષત્રીય, ખુંગા,  
અંધા, બહેરા, પંગુ, કાણા, કોઢીયા એ બધો સંસારમાં  
કર્મ રાજનો જ માત્ર પ્રલાવ છે.

આ પારાવાર રહિત સંસારમાં શાસ્ત્રના કુદ્દોધમાં  
મોહ પામેલા જીવો ચારે ગતિમાં ભન્યા કરે છે. પાખંડી  
અને ધૂર્તી પુરુષો તેમને મિથ્યા શાસ્ત્ર વચ્ચનમાં મુંજવીને  
હુર્યોનિર્દ્દીપી કુંડમાં પાડી નાખે છે. આવા સંસારદીપી  
ગહુન અરણ્યમાં મોક્ષનો માર્ગ બતાવનારા જ્ઞાની તો  
મોદ્ય ભાગ્ય યોગેજ મલે છે. માટે ધર્મર્દ્દીપી ભાગુ પેદા  
કરવા માટે આત્માએ નિરંતર ઉધમ કરવો જોઈએ.

જીનેશ્વરની દેશના ઇપી અમૃતની ધારાથી સિંચાયેલો  
રલશિખ નૃપતિ બોલ્યો. “હે લગવાન ! ભવાંતરમાં મે  
એવું શું સુકૃત કરેલું છે કે આ ભવમાં મને સુખ ઉપર  
સુખ પ્રાપ્ત થાય છે ?”

રલશિખની વાણી સાંભળીને જીનેશ્વર બોલ્યા. “પર-  
ભવમાં તું પામરના ભવમાં નિરંતર યુરુંએ આપેલા પંચ-  
પરમેષ્ઠી નમસ્કારનું સમરણ કરતો હતો, એ પંચપરમેષ્ઠી  
નમસ્કારના સમરણના પ્રલાવે આ ભવમાં તું જગતને  
આક્ષર્યકારી મહાસુખને પ્રાપ્ત થયો છે-વિદ્યાધર થયો છે.

હે લાભ્યવાન ! નવકારના જાપથી સમ્યક્ત્વ પ્રાપ્ત  
થાય છે. સમ્યક્ત્વથી વિરતિ આવે છે. વિરતિ થકી મોક્ષ  
પ્રાપ્ત થાય છે અને મોક્ષથકી અક્ષયસુખ મલે છે. સંસારનું  
જે ઉત્કૃષ્ટ સુખ છે એ તો નમસ્કાર જાપનું તારે અદ્ય ઝૂલ  
સમજવું. કિનુ મોક્ષપ્રાપ્તિ એ જ એનું સંપૂર્ણ ઝૂલ છે.”

પોતાના ભવ સાંભળી પ્રસુહિત થયેલા રાજ રતન-

શિખે નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્યગાડી ઉપર સ્થાપન કર્યો, પછી ચારિત્ર લેવાની આકંક્ષાવાલા રલશિખે શ્રી તીર્થીકર ભગવાન સમીપે સંયમ સ્વીકાર્યું, ક્ષ્પકશ્રેણી પર આર્થ થઈ કર્મ અમાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વીમંડળ પર વિહાર કરેતા અનેક અવ્ય લુલોને પ્રતિષ્ઠાવ કરી રલશિખ મોક્ષે ગયા.”

ધર્મવસુ ગુરુએ પંચ પરમેષ્ઠી જાપ ઉપર રલશિખનું કહેલું દાખાંત સાંલળીને ધર્મરસિક વિમલકીર્તિ રાજીએ હેવરથકુમારને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા અહણ કરી, પોતાનું આત્મકલ્યાણ સાંદ્યું.

## ૬

### સમ્યકૃત્વધર્મની આરાધના.

હેવરથકુમાર હવે હેવરથ નરપતિ થયા, ઇપુત્તી રાજી રલાવદી સાથે વિવિધ લોગોને લોગવતો રાજ્યનું પાલન કરવા લાગ્યો, સમ્યકૃત્વવાન અને ધાર્મિક વિધાનને ધારણ કરેનાર હેવરથ અહનિંશ પંચપરમેષ્ઠી નમસ્કારના જાપ જર્યા કરેતો હતો. એ પ્રમાણે રાજ્યસુખનો અનુભવ કરેતા અને શ્રાવક ધર્મનું આરાધન કરેતા હેવરથ નરપતિનો ખુખ કાલ ચાંદ્યો ગયો, કેમકે કાળ કાંધ કોઈના માટે થાલતો નથી.

ધર્મનો જાણ એ રાજ એક દિવસ વિચાર કરવા લાગ્યો. “આ જગતમાં ધર્મના પ્રલાવથી મને ખુખ રાજ્યલક્ષ્મી મલી છે તો મારે સત્પાત્રમાં વાપરીને એ લક્ષ્મીનો સફુપ્રોગ કરવો જોઈએ.”

ધર્મતત્ત્વ અને લક્ષ્મીની અનિત્યતાને ચિંતવતો રાજ સમ્યકૃત, અલુપ્રત, ગુણપ્રત અને શિક્ષાપ્રત વડે શોભતો રલાવદી સાથે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગની

સાધના કરતો જૈનશાસનની શોભા વધારતો પ્રભાવનાનાં  
અનેક કાર્યો કરવા લાગ્યો.

નરપતિએ અનેક જીનથી ભગવાનના પ્રાસાદ કરાવ્યા. અનેક જીનપ્રતિમાઓ ભરાવી, સમ્યકૃતવની શુદ્ધિને માટે અનેક રથયાત્રાના મહોત્સવો કર્યા ચતુર્વિંદ્ય સંઘની સાથે અનેક વાર તીર્થયાત્રાઓ કરી. સાધર્મિકની ભક્તિ કરીને રાજાએ અનેક હીન, હુંખી અને ગરીબ જૈનધર્મબુદ્ધોના ઉદ્ધાર કર્યા ને શાસનની નિદા કરેનારા, જૈન શાસનની પ્રભાવનામાં અંતરાય કરેનારા અનેકને નિવાર્ય. પોતાના રાજ્યમાંથી સાતે વ્યસનનો નાશ કરાવી નાખ્યો. રાજ્યનું રૂઢી રીતે પાદન કરતો અને ધર્મની પ્રભાવનાનાં કાર્ય કરતો રાજ પોતાનો પાછલો કાલ નિર્ગમન કરતો હતો.

મહારાજી રત્નાવલીનો ધવલ નામે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો ત્યારે રાજાને આ ભવ ઉપર વૈરાઘ્ય પેદા થયો. સંસારની અનિત્યતાનું ચિંતયન કરતો રાજ રાજ્ય ગાહીપર ધવલકુમારને સ્થાપન કરી રાજ્યભારથી ઝુક્યા થયો.

રાજ રાજ્યભારથી ઝુક્યા તો થયો છતાં વીરાન્તરાય કર્મના ઉદ્યથી આરિત્રને ગ્રહણ કરવાને અશક્ત હોવાથી સંસારની ઉપાધિથી ઝુક્યા રહ્યીને એકાંતે ધર્મસાધન કરવા લાગ્યો. ને ચતુર્વિંદ્ય સંઘની પૂજા કરવા લાગ્યો, તેમજ પૌષધમાં અને શાસ્ત્ર અલ્યાસમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો. આવશ્યકાદિક કિયામાં પ્રીતિવાળો રાજ સાધુની સમાન જીવનની ભર્યાદાવાળો થઈ ગયો. એ ધર્મરિવન કરવામાં પ્રીતિવાળા રાજનો કેટલોક સમય ચાલ્યો ગયો. ત્પ કશવાથી જેણે કાયાને ગાળી નાખી છે એવા

રાજને રત્નાવલી સાથે એ રીતે ધર્મનું આરાધન કરેતાં  
અનુકૂળે અંત સમય આવી પહોંચ્યો.

અંતસમયે રાજને આરાધના કરી ચોરાસી લાગ્ય  
જીવાચોનીને ખમાવવા લાગ્યો. આ ભવનાં અને ભવાં-  
તરનાં પાપકર્માની નિદા કરતો તે સુકૃત્યની અનુમોદના  
કરવા લાગ્યો. સંસારની અનિત્યતાની ભાવના ભાવતો  
રાજ સંસાર અને મોક્ષ, જન્મ અને મરણ, કનક અને  
કથીરમાં સમાન-મધ્યસ્થવૃત્તિવાળો થઈ ગયો.

અંતસમયે રાજ પંચપરમેષ્ઠીના સમરણમાં એકચિત-  
વાળો થયો. થડો મરણ પામીને આનત હેવલોકમાં ઓગ-  
ઝીશ સાગરોપમના આચુષ્યવાળો. ઉત્તમ હેવ થયો.

પદ્ધરાણી રત્નાવલી પણ રાજની માર્ક શાવિકાધર્મનું  
શુદ્ધ ભાવથી આરાધન કરી કાલ કરીને નવમા આનત-  
હેવલોકમાં ઓગઝીશ સાગરોપમના આચુષ્યવાળો. ઉત્તમ  
હેવ થયો. ભવાંતરના સ્નેહથી ત્યાં પણ મિત્રપણે રહેલા  
અને હેવો હેવલબનાં અપૂર્વ સુખ લોગવતા સુખમાં કાલ  
નિર્ગમન કરવા લાગ્યા.

નવમા, દશમા, અગ્રીયારમા અને બારમા હેવલોકે  
સામાન્ય રીતે નણ હાથનું શરીર હોય છે અને હેવતાઓનાં  
આચુષ્ય ઓગઝીશથી ભાવીશ સાગરોપમ સુધી હોય છે.  
નેટલા વર્ષનું આચુષ્ય તેટલા હજાર વર્ષે તેમને આહારની  
ધૂઢ્છા થાય છે ને તેટલા પખવાડીએ તેઓ ધાર્યાંધીસ લે  
છે, મનમાં વિચાર કરવા વડે તેઓ મનોહર પુદ્ગલોને  
ગ્રહણ કરતા આહાર કરે છે તેથી હેવતાઓ મનોભક્ષી કહે-  
વાય છે, તેઓ શુક્લલેશ્યાનાળા ને સમયતુરસ્ત સંસ્થાન-  
વાળા હોય છે વૈકિય શરીરને ધારણ કરનારા અને પૃથ્વીથી  
ચાર અંગુલ હમેશાં ઉચ્ચે રહે છે.

નવમા દેવલોકના હેવો મન પ્રવિચારી હોય છે એથે ત્યાં હેવીએનું ગમન હોતું નથી જેથી તેઓ મનવડે કરીને વ્યલિચાર-સુશ્રત સુખના લોગવનારા હોય છે. જે હેવીની તેઓ ધચ્છા કરે છે તે હેવી પણ પોતાના સ્થાનકે રહીને મન વડે તે દેવને પોતાનો વિષય કરે છે-ચિત્તવન કરે છે છતાં તેમને અનંતગઢું સુખ થાય છે. તેમના એક નાટકમાં અસંખ્યાતો કાળ યાને હજારો વર્ષ વહી જાય છે એવા સુખમાં તેઓ જતા એવા કાળને પણ જાણતા નથી.

### પરિચ્છેદ ૫ મો

### પૂર્ણીયંદ્ર અને પુષ્પસુંદરી

૧

#### નવમા લવમાં.

સર્વાર્થસિદ્ધિદાતારં, ત્રાતારં સકલાંગિનામ् ।  
નત્વા શંखેશ્વરં પાર્શ્વ, પંચમઃ સર્ગ ઉચ્યતે ॥૧॥

ભાવાર્થ—જગતના સર્વે અર્થ અને કામની સિદ્ધિને આપનારા તેમજ ભવ્ય જીવોનું સંસારના ભય થકી રક્ષણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને હેવે પાંચમો સર્ગ-પાંચમો પરિચ્છેદ કહેવાય છે.

જઘનુદ્ધીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પલ નામે સાતમી વિજયને વિષે શિવા નામે નગરીનો અધિપતિ, સિંહ સમાન પરાક્રમી, અને નામ પ્રમાણે ગુણોવાળો સિદ્ધસેન

નામે રાજ હતો, એ નરપતિને પ્રિયંગુમંજરી નામે પદ્મરાણી હતી. સુખ, સૌભાગ્ય અને ઝડદિસિદ્ધિએ કરીને સંસારમાં અપૂર્વ સુખને લોગવતાં આ બુગલને કયા સુખની ન્યૂનતા હતી ?

નવમા દેવલોકમાં દેવતાનાં ઓગણીસ સાગરોપમ સુધી અપૂર્વ સુખ લોગવીને થાકૃતે પુષ્ટે દેવરથ રાજનો જીવ ત્યાંથી આચુ ક્ષયે વ્યવી પ્રિયંગુમંજરીના ઉદ્રમાં ઉત્પત્ત થયો. સ્વમામાં સંપૂર્ણ ચંદ્રને જોઈ જાગ્રત થયેદી રાણી નૃપ સમીપે જઈને સ્વમને કહેવા લાગી. પદ્મરાણીનું સ્વમ સાંસળી રાજ યોદ્યા. “ દેવી ! તમારે ચંદ્રની તુલ્ય સૌભય પ્રકૃતિવાળો પુત્ર થશો.”

ગર્ભનું સારી રીતે પાલન કરતી રાણીને ઉત્તમ ગર્ભના પ્રલાવથી સારા સારા દ્વાહં થયા તે સર્વે રાજએ પૂર્ણ કર્યા. અતુક્રમે શુલગ્રહના યોગે રાણીએ પુત્રનો જન્મ આયે, રાજએ પુત્ર જન્મનો મહોસુવ કરી ખારમે દિવસે સ્વમને અતુસારે પુત્રનું નામ રાઘવું પૂર્ણચંદ્ર.

પંચ ધાત્રીઓથી લાલન પાલન કરતો પૂર્ણચંદ્ર ચ્છાય વયનો થતાં કળા અને કાવ્યનો અભ્યાસ કરતાં શાસ્ત્રનો પારંગામી થયો. નવીન યૌવનદ્વારી લાગ્યોદ્યવાળો થયો. તે નવીન કળા શીખવાના વ્યસનવાળો હતો. પણ જુગા-રતું વ્યસન એને વળગ્યું નહોંતું, નવીન કાવ્ય બનાવી એમાંજ રમ્યા કરતો હતો. પણ પરસ્સીની વાર્તા કરવામાં લજના ધારણ કરનારો પૂર્ણચંદ્ર સજજનને મધુર વચ્ચનવડે સંતોષ આપી ખલપુરુષોને શિક્ષા કરનારો થયો.

મુગયા, મધ અને માંસ વિગેરે સાત વ્યસનથી રહિત સ્વર્ણની સમાન મોદા પ્રતાપવાળો. અને રાજનીતિનો જાણ પૂર્ણચંદ્ર તત્વના ચિંતવનમાં પોતાનો સમય વ્યતીત કરતો

હતો. નવીન યૌવનઙ્દ્રી અલખુદ્યવાળો છતાં વિષય વિકાશેને આધિન ન ઘનતાં હેવ, ગુરુ અને માતાપિતાની ભક્તિ કરનારો થયો.

પદ્મરાણી મહાદેવી પ્રિયાંગુમંજરીને વિશાળ નામે આંધ્રચ સિંહસેન રાજનો સામંત હતો. તેને જ્યા નામે પતની હતી. મહાદેવી રત્નાવલીનો જીવ નવમા સ્વર્ગમાંથી ચ્યવી જ્યાદેવીની કુક્ષિએ ઉત્તેજ થયો. સ્વમાભાં પુષ્પમાળા જોવાથી અનુકૂમે જત્તમ થયા પછી સગાંસંચંધીની અનુમતિથી પુરીનું નામ રાખ્યું પુષ્પસુંહરી.

અનુકૂમે વયમાં વૃદ્ધિ પામતી પુષ્પસુંહરી ભાણી ગણી અનેક નવીન કલાચ્ચોનો અલ્યાસ કરતી યૌવનને આંગણે આવી, એ મનોહર અંગોપાંગવાળી ને સુંદર રૂપ રાશિએ શોભતી બાળા નવીન યૌવનવયમાં અધિક સૌંદર્ય તેજે શોભના લાગી.

બાળાના વદનની સૌભ્યતા અને સૌંદર્યતાથી શર્માછને ચંદ્ર આકાશમંડલમાં ચાલ્યો ગયો. એ વિશાળ કંતિવાળાં અને તેજથુક્ત લોચનને જોઈ લજ્જાત થઈને કુમણી જલમાં સંતાર્ણ ગયું, બાળાના શરીરના મનોહર અવયવો એનો ઘાટીલો અને સુશોભિત વર્ણ સુવર્ણની કંતિને પણ જાંખી પાડી હેતો હતો. નાગની ઇણું સમાન એના અદ્ભુત શ્યામસ્વરૂપ કેશકલાપે ભ્રમરની પંક્તિની શ્યામતાને પણ જીતી લીધી હતી.

હાથિણીના અચ્ચાના કુંભસ્થળ સમાન બાળાના સ્તન ચુગલ એ નાળુક તત્તુના સૌંદર્યમાં અસાધારણ વધારો કરી રહ્યા હતા. નિતંબ કટી પ્રદેશ ભારે અને શોભાયમાન હતો એવી એ બાળાના સૌંદર્યનાં અધિક તે શું વર્ણન કરીએ?

મધુર ભાષિણી એ બાળામાં સ્થીને ઉચિત ગુણો સ્વર-  
ભાવિક રીતે રહેલા હતા, સરળસ્વભાવી, સ્થિરસ્વભાવી  
તેમજ લજાવડે નમ્રમુખી એવી તે બાળા કલામાં કુશળ  
હોવા હતાં વિવેકી અને વિનયવતી હતી.

પૃથ્વીમંડલ ઉપર વસંતરતુનાં આગમન શર થયાં,  
અના પ્રભાવથી ઉધાનો નવપદ્ધારિત અને ક્ષાલ્યાં કુલ્યાં  
ઘનીને આકર્ષક અની રહ્યાં હતાં, મંજરીઓથી લચી  
પડેલાં સહકારનાં વૃક્ષોની શોભા અપૂર્વ હતી, માધવી  
આદિ લતાઓ પુષ્પોને વિકસાવતી પોતાની મનોહર અને  
દ્વિલભુશ સુવાસથી ઉધાનની હવાને ઉત્તેજિત કરી રહી  
હતી. કેદિલાઓનાં સુમધુર ગીત વસંતના રાગમાં અપૂર્વ  
સાથ આપી રહ્યાં હતાં.

એ વસંતના એક દિવસે બાળા પુણ્યાને પિતાની  
અતુભતિથી ભાતાએ સાહેલીઓ સાથે ઉધાનમાં કીડા કરે  
વાને મોકદી. ઉધાનમાં આવીને પુષ્પોની સુવાસનો અતુ-  
ભવ કરતી ને પંચરંગી પુષ્પો સાથે ગેલ કરતી બાળા  
ઉધાન-વનની શોભાને જેતી આનંદ કીડા કરી રહી હતી.

“સખી પુણ્ય ! જો પોતાના પતિ વસંતરાજને પ્રાપ્ત  
કરીને આ વનરાજ કેવી કિલકિલાઈ ખીલી રહી છે ?  
પુન્જાગવડે કરીને આ નાગવદ્ધી લતા શોભે છે ને એ નાગ-  
વલ્લીવડે પુન્જાગ વૃક્ષ કેવું શોભી રહ્યું છે ? તેવીજ રીતે  
મનોહર લાવણ્યવાળી તારા જેવી બાળા પતિવડે કરીને  
શોભે.” સખીઓ બાળા પુણ્યાને અનેક વાણી વિનોદવડે  
કરીને ખુશ કરવા લાગી.

એ પ્રમાણે વિનોદ કરી રહેલી સખીઓ સાથે બાળા  
પુણ્યા વનની શોભા નિરખીને લતામંડપમાં આવી વીણાના

સુર સાથે પોતાના કંઈને મેળવતી પોતાની ગીત કળાને  
સાર્થક કરવા લાગી.

રાજકુમાર પૂર્ણચંદ્ર પણ એ સમયે વસંતરાજની  
મોજનો સ્વાદ લેવાને ભિન્નોની સાથે ઉધાનમાં આવેલો.  
હુતો ઉધાનની શોભાને નિરખતો ને વસંતની અનુભવમ  
દીલા જોઈ હરખાતો, ભિન્નો સાથે વિનોદ કરતો એ રાજ-  
કુમાર એકાએક પુણ્યાની દશ્ટિએ આકષાયા.

મહુર આલાપપૂર્વક વીણાના તારને મેળવતી પુણ્યા  
કુમારીની દશ્ટિ અચાનક એ કુમાર પર પડતાં પરલવના  
સંબંધથી ત્યાંજ સ્થંભી ગઈ, “અરે ! આ તે વસંતરાજનો  
મિત્ર કામદેવ કે શું ?”

યૌવન વયવડે મનોહર અંગોપાંગવાળા, ને અતિ  
સુંદર સ્વરૂપવાળા કામદેવના અનુજબંધુ સમાન પૂર્ણચંદ્ર  
કુમારને જોઈ પરલવના સ્નેહ સંબંધથી બાળ વિગત  
શૈતનાવાળી થઈ થકી રોમાંચને અનુભવતી, આંખોનાં  
પોચચાને સકોચી હેતી મૂર્ચિત થઈ ગઈ. મોહના બાળ-  
વડે ઘાયલ થઈને પૃથ્વી પર ઢળી પડી.

સખીઓએ શીતજલ અને મંદમંદ પવનની લહેરો-  
વડે સ્વરૂપ કરેલી બાળા પુણ્યા સખીને કહેવા લાગી.  
“સખી ! રતુરાજ વસંતરાજની સરખો દ્વિલને તોલાવનાર  
આ સુંદર ચુવાન કોણું છે ? શું આ તે કામદેવ કે સૂર્ય-  
દેવ, અથવા તો સૌભ્ય આકૃતિવાન સુર કે વિદ્વાધર ?”

“સખી પુણ્યા ! કામદેવના સમાન તારા સરખી સાહે-  
લીના દ્વિલને તોલાવનાર આ પૂર્ણચંદ્ર રાજકુમાર. આ  
કામદેવ નથી કેમકે તે તો શરીર વગરનો છે, સૂર્ય પણ નથી  
તે તો બહુ તાપને આપનારો છે. આંખોનાં પોચચાન  
સ્થિર ન હોવાથી સુર પણ નથી. આ તો વિચક્ષણ ને

ચયપળ નથનવાળો રાજકુમાર છે. તેમજ વિદ્યાધર પણ નથી. તે તો ઐગર-આકાશવિહારી હોય છે, ત્યારે આ તો ભૂમિ વિહારી રાજકુમાર છે !” પુણ્યાના જવાખમાં સખી બોલી.

“તારો વાત સત્ય છે સખી ! વિધાતાએ આ જગતમાં દરેક ઉત્તમ વસ્તુઓ માંથી સારા ગુણ અહૃતું કરીને મને લાગે છે કે આ યુવાન નરની રચના કરેલી છે. ચંદ્રમા પાસેથી સૌભ્યતા, સમુદ્ર કનેથી ગંભીરતા, સૂર્ય પાસેથી પ્રતાપ, કુષેર ભંડારી પાસેથી ત્યાગ-દાન, હંદ્ર પાસેથી પ્રભુત્વ, કામહેવ પાસેથી સૌંદર્ય, અમૃત પાસેથી માધુર્ય સિંહ પાસેથી બળ, સુરગુરુ પાસેથી ચતુરાઈ અને મેરુ પર્વત પાસેથી ધૈર્ય એ ગુણો અહૃતું કરીનેજ વિધાતાએ આ નરની લાવના-રચના કરી છે કે શું ?” સખી પુણ્યા કામહેવના બાણથી વીધાયેલી છતી એ નરની તારીઝ કરતી બોલી.

“તારું કહેવું સત્ય છે સખી ! સિંહસેન રાજના કુલ-ઇપી નસોમંડળમાં ચંદ્રસમાન આ પૂર્ણચંદ્ર કુમારના અંગોપાંગને તું કટાક્ષપૂર્વક જોઈ રહી છે કે શું ? તેમને તું બરાબર ઓળખે છે એ તારી ફોર્નના કુમાર.” અશોકાનામની સખી કંઈક મૃહુ હાસ્ય કરતી પુણ્યાને કહેવા લાગી.

અશોકાના કથનને પુણ્ય આપતી સુદૃતા બોલી.  
“સખી ! જો ! જો ! રાજકુમાર આપણને જોઈ ખમચાઈ ગયા. એમને આમંત્રણ આપી બોલાવ, આપણે બધાં વિનોદ કરીયે, નહિતર અવિનય થશે.”

સખીઓના વચનથી લજાતુર થયેલી પુણ્યાવતી બોલી. “તમને યોગ્ય લાગે તેમ કરો.”

પુણ્યાની અનુમતિથી સખીએ આમંત્રણ કરેલ રાજ-

કુમાર ત્યાં લતાકુંજમાં આવીને ચોળ્ય આસને બેઠો પુષ્પા-  
કુમારીને પોતાના નેત્ર વડે બેઠ દર્શનના ક્લને પ્રામ કરતો  
રાજકુમાર બાળાને એક દિશાને જોતો એની ઉપર રાગવાળો  
થયો. બજે એકખીજને જોવા લાગ્યા.

એક સરખી વયવાળાં, ઝપવાળાં અને ગુણવાળાંને  
પરલુચના સારા સંસ્કારથી પ્રીતિ થતાં વાર લાગતી નથી,  
પ્રીતિથી પ્રસન્ન થયેલો કુમાર પોછ્યો “હે સુંદરી ! તમારો  
વીણા ઉપરનો કાયુ સારો જણાય છે તો ભારા મનના  
વિનાદને માટે કંઈક ગાવ.”

“કુમાર ! તમારા દર્શનથી ક્ષોલ પામેલા આ અમારાં  
બહેન પુષ્પા લજલ વડે નાખ સુખવાળાં હુવે વીણા ઉપરનો  
પોતાનો કાયુ જમાવી શકશે નહિ. માટે હુવે તો આપજ  
એ વીણાને બજલી એના હૃદયને આનંદ આપો”. એમ  
કહુને સુદૃતાએ વીણા રાજકુમારના હાથમાં આપી.

વીણાને અહુણ કરી રાજકુમાર પોતાના હાથની ડોમલ  
અંગુલીઓને એના તાર ઉપર ફેરવતો પોતાનો કાયુ એના-  
પર જમાવવા લાગ્યો.

સખીઓની પ્રશંસા સંભળતે છતે રાજકુમારે  
વીણાના તારની અણજણાઈ સાથે પોતાના ડોમણ કંઠના  
સૂર આલાપ સંલાપપૂર્વક મેળવી દીધા. કુમારેના મધુરા  
ગાનથી સખીઓ મસ્તકને ધૂણાવતી ઝૂલ્ય આનંદ પામી.

વીણાના મનોહર અને મધુરા ગાનની મોજ ભાણુતાં  
બધાં આનંદથી આલી રહ્યાં હતાં. સ્વગરીય સંગીતના  
રસની છાપો. ઉછળી રહી હતી. એ મસ્ત આનંદમાં  
પુષ્પાની ધાવમાતાએ આવીને વિધન ઉપસ્થિત કર્યું. “વાહ !  
ઠીક, બધાં અહીંયાં લેગાં થયાં છો ?” ધાવમાતાએ  
એમના રંગમાં ભંગ પાડ્યો.

રાજકુમારને નમસ્કાર કરી પુણ્યકુમારી તરફ મેં કરીને બોલી, “હે વત્સ ! તારા વિના તારી ભાતા લોજન કરતી નથી ભાડે સત્તવર ઘેર ચાલો”.

ધાવમાતાના વચનથી પુણ્ય સખીઓ સાથે ઘેર ચાલી ગઈ પણ તેનું મન તો રાજકુમારની પાસે જ મૂકીને ગઈ. રાજકુમારના દર્શનની પુનઃઅભિલાષાવાળી ભાગા દુઃખે દુઃખે પણ પોતાના મકાન તરફ ચાલી ગઈ.

સખીઓએ તેની ભાતાને તેના દિલની વાત કહી સાંભળાવવાથી તેની ભાતાએ પણ એને આધ્યાસન આપ્યું. એની ભાતાએ પ્રિયંવદા નામે સખીને અધી વાત સમજાવી.

“પ્રિયંવદા પુણ્ય પાસે આવીને તેને આધ્યાસન આપતાં બોલી. “સખી ! ચંદ્રની એક કલા પણ પ્રાણી-એને સુખ આપે છે. ત્યારે આ કુમાર પૂર્ણચંદ હોવા છતાં તેને કેમ સુખ નથી થતું ?”

સખી પ્રિયંવદા ! આજે માર્દ મન કોણ જાણે કેમ અમી રહ્યું છે તેનો કંધક ઉપાય બતાવને ? પુણ્ય સુંદરી બોલી.

“હે સ્વામિની ! તને સુખ કરનારી એક વાત કહું તે સાંભળ, કે સાંભળવાથી તાર્દ મન પ્રસન્ન થશે-શાંત થશે”, પ્રિયંવદા મનમાં કંધક નિશ્ચય કરીને બોલી,

“કહે, ” આતુરતાથી બાલા પુણ્ય પોતાને લગતી વાત સાંભળવાને તૈયાર થઈ.

“ગાઈ કાલે તારી ફોઈને તારા પિતાએ કહ્યું હતું કે આ અમારી પુત્રી પૂર્ણચંદને યોગ્ય છે. અજે રૂપ, ગુણ અને વધે એક ભીજને યોગ્ય હોવાથી એમનો સંખ્યંબ્ય પૂર્ણ સુખવાળો થશે. પરન્તુ અત્યારે તો અને વિવાહની વાત પણ સાંભળતાં નથી તેમજ તેમને અન્યોઅન્ય

સ્નેહ પણ સંભવતો નથી, તો પછી એ શી રીતે અને ?”  
વિશાલ સામંત પોતાની ઝેણ સાથે વાત કરતાં જરા  
થાલ્યો.

“તો તેમો એક બીજાને મળે અને વાતથિત કરે  
તેવી વ્યવસ્થા કરવી જોઈએ”. વિશાલ સામંતની વાત  
સાંભળીને તારી ઝેાઈ પ્રિયંગુમંજરીએ તે વાત કણુલ  
કરી એની પ્રશાંસા કરી. તે પછી અનેએ એક ખુક્તિ-  
ગ્રાજના બડી કાઢી તે મુજબ આજે ઉધાનમાં તમો બજેનો  
મેળાપ થયો. તમારી એક બીજાની સ્નેહની વાત સાંભળીને  
અધાં ખુરી થયાં છે ને મને લાગે છે કે તારી મરણ  
હશે તો વિવાહોત્સવ જલદિથી ઉજવાધ પણ જશે”.

પ્રિયંવદાની રસભરી ને અનુકૂળ વાત સાંભળીને પુણ્યા  
ખુરી થતી બોલી. “સખી પ્રિયંવદા ! તું જેવી નામથી  
પ્રિયંવદા છે તેવી અર્થથી પણ છે. આજે તો તેં પ્રિય વાત  
કહીને તારં નામ સાર્થક કર્યું”.

કુમાર પૂર્ણાચંદ્રને પણ તેના મિત્રોએ આ ખુક્તિ સમ-  
જવીને ખુરી કર્યો. અનેએ ધીરજથી ડેખલોક સમય  
પસાર કર્યો.

પછી તો રાજાએ અને વિશાલ સામંતે વિવાહ કાર્યનો  
આરંભ કર્યો. મુહૂર્ત જોવરાવી શુલ મુહૂર્તે મોદા મહો-  
ત્સવપૂર્વક વિશાલસામંતે પોતાની કન્યા રાજકુમાર  
પૂર્ણાચંદ્રને પરણાવી હીધી. તે સમયે ખાન, પાન, અને  
ગાન તાનથી આખુય નગર રસસાગરની લહેરોને અનુ-  
સવવા લાગ્યું.

રાજકુમાર પુણ્યસુંહરી-નવોદા પત્ની સાથે પોતાના  
મહેસુંમાં રહ્યો છતો દેવતાની માર્ક પાંચપ્રકારનાં વિષય-  
સુખને ભોગવવા લાગ્યો.

૨

### શ્રીસુરસુંદરસ્તુરીક્ષર.

એક હિવસે રાજસભામાં ઘેડેલા રાજને વનપાલકે આવીને નમસ્કાર કરી રાજની બિજ્ઞાવલી બોલતાં વિનંતિ કરી. “મહારાજ ! આપનો જય થાએ ! વિજય થાએ ! પુણ્યશાલ વનમાં મૂર્તિમાન ધર્મ છોય એવા મુનિ સસુધાયથી પરવરેલા શ્રીસુરસુંદર ગુરુમહારાજ પદ્ધારેલા છે. વનપાલકની વાણી સાંભળીને રોમાંચ અનુભવતા રાજએ ખુલ્લ હાન આપી વનપાલકનું હારિધ્રિપી વૃક્ષ છેદી નાખ્યું.

સ્તુરીક્ષરને વાંદવાને ઉત્સુક થયેલો રાજ પુત્ર કલત્ર અને સ્ત્રી આહિકના પરિવાર સાથે મોટા આડંખર પૂર્વંક વાંદવાને ચાલ્યો. ગુરુની પાસે આવી નગીને તેમની સુતિ કરતો તે ધર્મ સાંભળવાને તેમની આગળ ઘેડો. સ્તુરીક્ષર પણ આ ચોંચળું જાણીને ધર્મહેશના દેવા લાગ્યા.

“હુ લંબ્યો ! જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક અને અયથી આડુણ વ્યાડુણ એવી દુર્ગતિને વિષે પાપના ક્ષણ-ક્ષણ અનંતકાલ પર્યાત મહાદુદ્ધ લોગવ્યાં છતાં હજુ પણ સંસાર તરફ ઉદ્ઘાસીનતા થતી નથી, ન ધર્મને વિષે નિર્દિષ્ટ ધર્મી થધને સંસારમાં રાચીમાચી રહ્યા છો. પણ હવે પ્રમાણનો ત્યાગ કરી યતનથી ધર્મનું આરાધન કરો. કારણુંકે આ જગતમાં તો પ્રાણીએને પ્રમાણ સમાન કોઈ શરૂ નથી ત્યારે ધર્મ સમાન કોઈ મિત્ર નથી.

મઙ્ગ વિષયકસાયા, નિદા, વિગહા ય પંચમી ભણિયા ।

એ પંચ પમાયા, જીવં પાડંતિ સંસારે ॥!॥

**ભાવાર્થ**—મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાણો જીવના લયંકર શરૂઆતો છે. એ પાંચ શરૂઆતો જીવને સંસાર સાગરમાં ડખાવી ધર્મ પ્રાપ્તિ થવા હેતા નથી. ધર્મનિ એ પાંચ પ્રમાણોમાંથી કોઈને કોઈ વિધન કરવાને તૈયાર હોય છે. માટે એ પાંચે પ્રમાણ છાડવા.

જ્યારે પ્રમાણ જીવને સંસારમાં પાડે છે. ત્યારે ધર્મ જીવને સંસારમાં સુખની પરપરાને પમાડી અંતે મોક્ષની જ્ઞાનભીને આપે છે. જગતમાં ઉદ્દૃષ્ટ મંગળદ્વિપર્વત ભલુષ્ય અને સુરની લક્ષ્મી તેમજ મુક્તિને આપવાવાળો હોવાથી જીવને તે કરવા ચો઱્ય છે. યતનથી તે આહરવા ચો઱્ય છે, ધર્મ બંધુની માઝક સ્નેહ રાખે છે. કદ્યદુમની માઝક ધર્મનિધિને આપે છે. ગુરુની માઝક સંદગ્યશુભમાં પ્રીતિ કરાવી આપે છે. સ્વામીની માઝક રાજ્યલક્ષ્મીનિ દેનારો છે. પિતાની માઝક વાતસલ્ય રાખે છે, ત્યારે માતાની માઝક ધર્મ જીવનું પોતણું કરે છે. એવા ધર્મનું સેવન કરવાથી ચિત્તામણિ અને કદ્યપવૃક્ષની ધર્મ શું શું નથી આપતો ?

ધૂહને આગ લાગવા છતાં જે પુરષો નિરાંતે સૂધ રહે છે, અગાધ જલમાં ડુષ્પવા છતાં જે લેશ પણ પોતાની હરકાર કરતા નથી, એવા મૂર્ખ જીવો સંસારમાં હુંઘીદુઃખી થવા છતાં ધર્મને વિષે જરાય ઉદ્ઘમ કરતા નથી. વળી હે લભ્ય જીવો ! સાંભળો.

ચોર લોકો મડાનને લુટી રહ્યા છે તેમજ અરિમંડલ પ્રહાર કરવાને ધર્મની રહ્યું છે છતાં જે વિદ્યાસથી સાવધ થતો નથી, એવા મૂર્ખ જનો મતુષ્યભસ્વમાં ધર્મ કરવાની મળેલી તકને ગુમાવશે તો પછી તે તક કયારે મળશે ?

હે લભ્યો ! આ સંસારદી ભવાટ્યીમાં ભાનવીઓને સંપૂર્ણ રીતે ધર્મ સામગ્રી મળવી હુર્લાલ છે. પ્રથમ તો

હશ દ્વારાંતે દુર્લભ મનુષ્યપણું આ ચોરાસીલાખ જીવા-  
ઘોનીમાં કેટલું બધું દુર્લભ છે તેનો જરા વિચાર કરો.  
અને મનુષ્યપણું કદાચ મલણું પણ અનાર્થ થયા તો ? માટે  
આર્થીક્રોન મલણું કાંઈ સુગમ-સહેલું નથી, આર્થીક્રોનમાં  
પણ વિશુદ્ધકુળમાં જન્મ થવો એ દુર્લભ છે. તે થડી  
હોવા છતાં જે અદ્વાચુવાણો હોય તો ? માટે હીર્દાય પણ  
મહાભાગ્યઘોગે મલે છે-દુર્લભ છે.

હીર્દાય થડી પણ આરોગ્યના દુર્લભ છે. તે થડી પણ  
ધર્માચાર્યનો સમાગમ પ્રાણીને અતિદુર્લભ છે, આચાર્યનો  
સંચોગ થવા છતાંય વસ્તુતત્વ સમજવાની બુદ્ધિ મલબી  
દુર્લભ છે. અને તે થડી પણ તત્વશ્રદ્ધા દુર્લભ છે. તેમજ  
વિરતિ તો એથીય દુર્લભ છે માટે હે પ્રાણીઓ ! પ્રમાણે  
ત્યાગ કરી તમે ધર્મને વિષે ઉધ્બંધાણા થાઓ. ગુરુમહા-  
રાજની દેશના સાંસણીને રાજ વગેરે બધા પ્રસન્ન થયા,  
ધર્મના અનુરાગી થયા.

મનોહર કાંતિવાળા અને જીવાન અવસ્થાવાળા  
આચાર્યને જોઇ વારંવાર મનમાં અનેક વિચાર કર્સો પૂર્ણ-  
બંદ ઘોલ્યો. “અગવન ! સાઓન્ય લક્ષ્મીના લોાગને યોગ્ય  
અથવા તો કોઇ ધનાદ્યને યોગ્ય આપના હેઠની આવી  
અપૂર્વ કાંતિ હોવા છતાં યૌવનવયમાં આપને પ્રત ગ્રહણ  
કરવા યોગ્ય શી રીતે અને કૃત્ય સંજોગમાં વૈરાગ્ય થયો,  
તે આપના વૈરાગ્યનું કારણ કહો.” રાજકુમારે ગુરુમહા-  
રાજના વૈરાગ્યનું કારણ પૂછ્યું.

“કુમાર ! તમારા જેવા ઉત્તમ નરને તો ડગલે ને  
પગલે સંસારમાં વૈરાગ્યનાં કારણ જણાય છે છતાં કેમ  
પૂછ્યું પડે છે ? આ જગતમાં કેટલાક વિશાળ એવી

સાધ્યાન્ય લક્ષ્મીને ભોગવે છે. ત્યારે કેટલાક મહિંદ્રિક અમાપ દૃષ્ટિ સિદ્ધિવાળા પણ જોવાય છે. કેટલાક પરતંત્રદ્વિપી હારડી-સાંકળથી અંધાયેલા તેમની સેવા કરનારાય નજરે નથી જોતા શું ?

કેટલાક કદ્વપૃષ્ઠક પાસેથી મનોવાંચિષ્ઠ ઝલને મેળવતા સુખ અને લોગમાં પ્રોત્િવાળા થફને ચિત્તા કે દુઃખને બાણુતા નથી ત્યારે કેટલાકને પોતાના ઉદર ભરવાના પણ સાંસા હોય છે, કેટલાક ઓછ અને નવસુંદર ચુવતીએના હાસ્યવિલાસોમાં રમતા મોટા સૌલાભ્યવાળા હોય છે ત્યારે કેટલાક હૌરાભ્યથી હાજેલા શ્યામ સુખવાળા પણ નથી હોતા શું ?

આ ભવાયટ્વીમાં જરૂર, જરા, મરણ, વિપત્તિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શોક, ધીષનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, કારાગ્રહ નિવાસ એ બધુંથી લુધને મતુધ્ય-ભવમાં પણ સહેન કરવું પડે છે. ઉત્તમ નરને એ બધાં શું વૈરાઘ્યનાં કારણ નથી થતાં ? છતાંય આ દુઃખથી ભરેલા સંસારમાં મને વૈરાઘ્ય શ્રી રીતે થયો તેનું કારણ સંસા.

શુરૂમહારાજે પોતાનું ચરિત્ર કહેવા અગાઉ સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસ્તાવના કરીને સંસારનું કંઈક ઉપલબ્ધ સ્વરૂપ સમજાવી પોતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું, જે લભ્ય-જનોના ઉપકાર માટે-યોગ માટે પણ થઈ શકે.

શુરૂમહારાજનું ચરિત્રસાંભળવાને રાજ, કુમાર આદિક સર્વે પરિવાર સાવધાન થયો. શુરૂએ પોતાનું કથન શરૂ કર્યું.

૩

### સુરીક્ષરની આત્મકથા

આ વિજયમાં રતનપુર નામે નગરનો રહીશ નામું  
પ્રમાણે ગુણવાળો સુધન નામે ભાતઘર અને તવંગર શેડ  
રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે  
સુંદર પુત્ર થયો, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ  
અત્રીસ ઇપવતી કન્યાએ પરણાવી. એ અત્રીસે પત્ની-  
નવોઢા નારીએ સાથે દેવસમાન સુખને લોગવતો તે સુખમાં  
કાળ વ્યતીત કરતો હતો.

અન્યદી એનાં ભાતાપિતા એ સાંસારની સુસાઈરી  
ખુરી કરી ચાલ્યાં ગયાં, તેમના મરણની ચિત્તાથી વ્યાકૂળ  
થયેલો સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરં-  
પરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિત્તા કરવા લાગ્યો. એ  
વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એનો શોક નાથ થયો.

કારણ કે પ્રિયજનનો વિયોગ થવાથી કોઈ મરીજતું  
નથી અથવા તો ઘરણારનો તાગ કરી કોઈ સાંદુથતું  
નથી, એ હૃદયનો વા પણ ધીરે ધીરે ઘસાઈ-ઝુસાઈ જાય છે.  
અત્યાંત રાગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર  
શોક રહીત થધ ગવો, છતાં સ્ત્રીએના વ્યલિચારની  
શાંકાવાળો તે ચલથી પણ સ્ત્રીએનું રક્ષણ કરવા લાગ્યો,  
તેમને તેમના પિતાને ઘર પણ જવાદેતો નહિ. તેમજ  
શાતાને ઘર કોઈ અન્યપુરુષ તો શું પણ સ્વજન સંખ-  
કીએને પણ આવવાની તેણે મના કરી દીધી.

વધારે શું કહું ? એક ધર્માલુપણાથી તેણે બહાર જવાનું  
પણ છાડી દીધું ને કદાચ જવું પડે તો મકાનને દરવાજે  
તાળું લગાવી સ્ત્રીએને મકાનમાં પૂરીને બહાર જતો હતો.

એવી રીતે તાજુ દઈને બહાર જવા છતાંચ તેના મનમાં અનેક દુષ્ટ વિકલ્પ થયા કરેતા હતા. એ દુવિંકલ્પના કાર્યાથી તે બહાર પણ અધિક સમય ન થાલતાં જટ પાછા કરેતો હતો. કોઈ પણ તેને બેર આવતું તેને તે સહન કરી શકતો નહિ. એ સુરસુંદર તે હું પૈતે.

બિક્ષુકોએ માર્દ ધર પછીતો તણ દીધું અને જૈન સાધુઓએ તો વિશેષ કરીને છાડ્યું. છતાંચ ભવિતવ્યતા અળવાન છે. એક દિવસે કાર્યની વ્યાતાથી દ્વરવાળે ખંધં કર્યા વગર હું અજરમાં ગયો. ને મારા અજરમાં ગયા પછી એક સુનિએ મારા મડાનમાં પ્રવેશ કર્યો. સુનિને બેઈ પ્રસન્ન થતી મારી સ્થીએઓ બોલી, “ઓહો આજે તો આપણો લાગ્યોધ્ય થયો”.

પ્રસન્ન થયેલી મારી સ્થીએઓ સુનિને બેસવા માટે આસન આપ્યું, એ સુનિને અકદખ્ય હોવા છતાં પણ એ જ્ઞાની સુનિ ભવિષ્યમાં લાલ થવાનો જાણ્યુને તે ઉપર બેઠા. તેમની આજુભાજુ મારી સ્થીએ સુનિને વચમાં રાખીને બેઠી. સુનિ તેમને ધર્મપદેશ દેવા લાગ્યા.

એ દરમિયાન, અજરમાં ગયેલો સુરસુંદર-હું પૈતે કાર્ય પતાવીને જટ આવી પહોંચ્યો ને જોખું તો એકાંતમાં મારી સ્થીએની મધ્યમાં મેં એક સુનિને જોયા. એ દ્વપ્વાન સુનિને જેઈ મને એમને માટે કંધક વિચારો આવી ગયા. “આ સુનિને હું કથી રીતે ન શી રીતે શીક્ષા કરે?”

પ્રચ્છન્નપણે છુપાઈને હું તેમની ચેષ્ટા બેવા લાગ્યો. શ્રાવથી ધમધમી રહેલા મેં તેમને માટે અનેક દુષ્ટ વિચાર કર્યા. “અરે! આ કુશમણુ અત્યારે એકાંતમાં મારી સ્થીએની મધ્યમાં એસીને મજાક ઉડાવે છે પણ એના શરીરના આઠ અગોમાં હું પાંચ પાંચ લાડીના પ્રહાર

કરીશ ત્યારે જ મારા કોથને હું શાંત કરીશ. છતાં પણ ખાલમાં તો ઝુપાધને મને તેની ચેષ્ટા જોવા હે, કે એ શું કરે છે ?”

એ પ્રમાણે મનમાં વિચાર કરતો હું ઝુપાધને ઉલ્લો રહ્યો. મુનિએ પણ પોતાની દેશના શરૂ કરી “હે ભાગ્ય-વતી ! ધ્યાન દ્ધને તમે સાંલળો, જુનેદ્ધર ભગવાને સવે ધર્માંતું મૂળ દ્વારા કહેલું છે. તો ડાહ્યા જનોએ દ્વારા પાળવા માટે પ્રયત્ન કર્યો. જગતમાં પાખડી મતતા ન્રણસિને ત્રેસઠ લેછ છે તે બધાય જીવદ્વાના સિદ્ધાંતને તો માન્ય રાખે છે, માટે જ્યાં દ્વારા છે ત્યાં જ ધર્મ છે, જ્યાં દ્વારાનું આરાધન થાય છે ત્યાં તપ, જપ, દાન, ધ્યાન અને કિયા બધુંચ શોલી ઉઠે છે. પૂજા પણ તેની સર્કણ થાય છે. પણ દ્વારા વગર કરેલી એ સર્વે ધર્મકિયા વ્યર્થ થાય છે.

દ્વાના પ્રભાવથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. સંપદા, આરોગ્ય, સૌભાગ્ય, લોગ, કીર્તિ, મતિ, જુદ્ધ અને ધૂતિ એ બધાય દ્વારા કલ્પલતાનાં રૂળ છે. દ્વા એ સ્વર્ગ-ગમન માટે સોયાન-પગથીયાં સરખી છે. દ્વા મોક્ષને અપાવનારી છે. દુર્ગતિનાં દ્વાર અંધ કરવાને દ્વા અર્ગલા-જુગળ સમાન છે. એવી દ્વા પાલનારને જગતમાં શું શું નથી મળતું ?

જીવોની હિંસા એ પ્રાણીઓને કઠવા કરું આપે છે. જીવહિંસા કરનારને સર્વે અનર્થી, આપદાઓ, વ્યાધિઓ સુલલ હોય છે. હિંસકપ્રાણીઓ ભવાંતરને વિશે ગર્ભાવ-સ્થામાં, જન્મ થતાં કે બાલપણમાં અથવા યૌવન વયમાં આવતાં જ મૃત્યુ પાની જાય છે. તેઓ અદ્યપજીવી થઇને લોગ લોગવ્યા વગર ચાલ્યા જાય છે. આ જગતમાં મુંગા, અંધા, બહેરા, ઓખડા, પાંગળા, કુખડા, કોઢીયા, જડ,

શાળી, શોક, લય, ક્ષુધાર્ત, કુર્લંગ, હુંસવર એ બધાંય જીવહિંસાનાં કૃળ છે. જે પ્રાણીએ હિંસા થકી વિરામ પામતા નથી તે અતિ હુંખને પામે છે, ને જે હિંસાનો ત્યાગ કરે છે તે સુખી થાય છે. જે હિંસક હોય છે, તે નિર્દ્દ્ય-પણે પોતાના પિતાનો પણ ઘાત કરીને નરકાદિ હુર્ગતિમાં ચાલ્યા જાય છે, તેએ શરૂંજીયરાજ અને શુરુકુમારની માડુક હુંખને ભજનારો થાય છે.

“એ શરૂંજીય ને શૂર ડેણું હતા ને હિંસાથી તેમને શું કૃળ મટયું તે કહેણો.” સ્થીએના પૂછવાથી મુનિએ શરૂંજીયરાજ અને શુરુકુમાર-પિતાપુત્રનું દિશાંત કહેવું શરૂ કર્યું.

પૂર્વે એ વિજયમાં વિજયપુર નામે નગર હતું તે નગરના અધિપતિ શરૂંજીયરાજને શૂર અને ચંદ નામે અને પુત્રો હતા, વડીલ પુત્ર શૂરને ચુવરાજપદ આપ્યું ને ચંદને કંઈ પણ ન આપવાથી તે રિસાઇ વિદેશ ચાલ્યો ગયો.

ચંદ વિદેશમાંબમતો અનુકૂમે રત્નપુરનગરના ઉદ્ઘાનમાં આવ્યો, ત્યાં એક મુનિને જોઈ તેમને નમસ્કાર કરી તેમની આગળ ઘેડો, મુનિએ દ્વારા મની ઉપદેશ આપ્યો.

જીવદ્યાનો ઉપદેશ સાંભળી એધ પામેલા ચંદે સંચામ સિવાંય પંચિદ્રિય જીવનો વધ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તે પછી તે રત્નપુરનગરના રાજ જ્યસેન નરપતિની સેવા કરવા લાગ્યો, અનુકૂમે તે રાજનો વિદ્યાસુ થવાથી એક હિવસે રાજએ આનગીમાં કહું, કુંભ નામનો સામંત મહા બળવાન અને અભિમાની થઈ ગયો છે માટે ગુરૂ રીતે ત્યાં જઈને એને મારી નાખ.” રાજનાં વચ્ચેન સાંભળી ચંદ એલાગ્યો.

“મહારાજ ! એ પાપ મારાથી નહી થાય, સંચામ સંવાય કોઈ પણ પ્રાણીવધ ન કરવાનો મેં ગુરુ પાસે નિયમ

અહુણુ કરેલો છે.” ચંદ્રનાં વચનથી રાજ ખુશી થયો ને તેને પોતાનો અંગરક્ષક બનાવ્યો. સામંતકન્યા પરણાવી અને સુખી કર્યા-પોતાના પુત્ર જેવો કર્યો.

અન્યહા મોટાં સૈન્ય લઈને ચંદ્રે કુંભરાજને પડકાર્યો. અલિમાની કુંભરાજ તેની સામે આવ્યો, બનેનો રણ-સંઘામ પૂરાલોસમાં ચાલ્યો, એ ચુદ્ધમાં ચંદ્રે કુંભરાજને પકડી બાંધી જયસેન રાજની સમક્ષ હાજર કર્યો. રાજએ પોતાની આજ્ઞા મનાવી કુંભરાજને છાડી દીધો ને ચંદ્રનો સારી રીતે સત્કાર કર્યો. તે પછી ચંદ્રકુમાર પણ સુખમાં દિવસો પસાર કરતો હતો.

યુવરાજપદ્થી અસંતુષ્ટ શૂરકુમાર પિતાને મારીને તેના રાજ્યની ઈચ્છા કરતો અતુફૂળ સમયની રાહ જોવા લાગ્યો.

એક દિવસે રાત્રીને સમયે શૂરકુમારે રાજના શયન-ગૃહમાં ધૂસી જઈ રાજ ઉપર તલવાર ચલાવી દીધી. એ ધસારાથી જગત થયેલી રાણીએ બૂમાખૂમ કરવાથી ચોકી-દારો હોડી આવ્યા. તેમણે નાશી જતા ખુનીને પકડી લીધો. નિશાસમયે આરક્ષકોએ બાંધેલો. તે ખુની પ્રાતઃ-કાળે શૂરકુમાર તરીકે માલુમ પડવાથી રાજ આગળ વાત કરી, ધોની પીડાથી દુઃખી થતા રાજએ પુત્રને દેશ-નિકાલ કર્યો.

ત્યાર પછી તરત જ રાજએ મંત્રીઓની સાથે એકમત થઈ ચંદ્રકુમારની તપાસ કરાવી, તેને તેડાવી રાજપાટ સેંચી હીથું. તે પછી થાડ દિવસે રાજ વેદનાથી મૃત્યુ પામી ગયો.

રાજ મૃત્યુ પામીને વાઘ થયો. શૂરકુમાર પિતાનો વાત કરી કલાંકિત થયેલો. અને જંગલમાં કુકર્મ કરી

આજિવિકા ચલાવતો હતો તેને પેલા વાંચે એક હિવસે મારી નાખ્યો, તે મરીને લિધ્ય થયો, એક હિવસ તે લિધ્ય વનમાં ગયો તેને પણ પેલા વાંચે મારી નાખ્યો. એ લિધ્યના હુંડ્યોએ વાધનેય મારી નાખ્યો. અને મરણ પામીને અદ્વીમાં કલલ અને વરાહ થયા.

પૂર્વના વેરથી અને ચુદ્ધ કરેવા લાગ્યા. તેમને કોઈ શિકારીએ મારી નાખ્યા. મરણ પામીને અને કલલ થયા, પોતાના ટોળામાંથી ભ્રષ્ટ થયેલા તેઓ અને ચુદ્ધ કરેવા લાગ્યા. લિધ્યોએ ચુક્લિથી તેમને પકડી લીધા ને ચંદ્રરાજને અર્પણ કર્યા. ત્યાં પણ ચુદ્ધ કરતા તેઓને રાજાએ મહા-મુશ્કેલીએ જુદા કર્યા.

એ સમયે ત્યાં ડેવલી ભગવાન સમવસર્યા, તેમનો ઉપદેશ સાંભળી રાજાએ આ અને હસ્તિઓનો વૃત્તાંત પૂછ્યો.

ડેવલી ભગવાનના મુખથી એ કલલચુગલનો વૃત્તાંત જણ્ણી વૈરાગ્ય પામેલા ચંદ્રરાજએ પોતાના પુત્રને ગાહી ઉપર બેસાડી ચારિત્ર અહણ કર્યું. શુદ્ધ ચારિત્ર પાળીને તે સ્વર્ગ ગયો.

પેલા અને ગળો-કલલો કોધથી ધમધમતા મરણ પામીને પ્રથમ નરકે ગયા. ત્યાં પરમાધારી કૃતવેદના, ક્ષેત્રકૃતવેદના અને અન્યોઅન્યકૃત વેદના ધણા કાલ પર્યેત લોગવીને વારંવાર અનેક કુયોનિમાં ભ્રમણ કરશે, માટે હે શાવિકાએ ! હિંસાથી થતા હોંચા અને હ્યાથી થતા ગુણોને જાણી તમે હિંસાનો ત્યાગ કરો.” સુનિ હ્યાનો ઉપદેશ આપીને વિરભ્યા.

સુનિના ઉપદેશથી વૈરાગ્ય પામેલી તે સીએઓ પહેલું સ્થુલપ્રાણતિપાત વિરમણ અણુપ્રત અંગીકાર કર્યું. ૪૧-

ક્ષયારૂપી પ્રતના આરાધવાથી મેં વિચાર કર્યો. “આ મુનિએ સારું કર્યું, કારણ કે આ સ્ત્રીએ કદાચ કોપાયમાન થઈજશે તો પણ હું મારું અનિષ્ટ કરી શકશે નહિ. જેથી આ મુનિને મારે હરેક અંગમાં પાંચપાંચ પ્રહાર કરવા હતા તેમાંથી એક ઓછા કરી હું વેચારચાર પ્રહાર કરીશ.”

૪

### મૃષાવાદ વિરમણુન્તત.

એ મુનિએ ત્યારપણી આગળ ચલાવ્યું. “હું શ્રાવિ-  
કાએ ! ત્રણ વર્ગને સુખકારી તેમજ સ્વર્ગ અને મોક્ષને  
આપનારી સત્યલાપા તમારે યોલવી. કારણ કે સત્યવાદી  
સર્વને પ્રિય તેમજ વિશ્વાસપાત્ર હોય છે. હેવતા અને  
દાનવો પણ એની આજા પ્રમાણે વર્તે છે, તો માનવીની  
તો વાતજ શી ?

સત્યવાદીને જલ, અભિ આહિ તેમજ બીજુ હિંદુ  
વસ્તુએ પણ અનિષ્ટ કરતી નથી. લોકો પણ તેના નિર્મલ  
યશનો ચારે ખાળુએ વિસ્તાર કરે છે.

જેવી રીતે સત્ય વચન અનેક લાભને કરેનારું છે તેવી  
રીતે અસત્ય વચન નિર્ણનીય છે. જુઠ યોલનારાનો ભાતા,  
પિતા, ભાઈ કે ભિત્રો કોઈ વિશ્વાસ કરતા નથી. અલીક  
વચન યોલનારા જીવો સુખના રોગવાળા, અનાદેય કર્મ-  
વાળા સુંગા, દુઃસ્વરવાળા થાય છે. અસત્યયોલનારા જીવોને  
શ્રૂત્વા છેદાદિ દુઃખો પણ સહન કરવાં પડે છે, વધારે શું  
કહુંએ અનૃતભાષી જનો-ખલ પુરુષો સર્પ સમાન કર્યા છે.  
માટે હે વિવેકશાલિની ! તમારે ઝોથ, લોલ, લય કે હાસ્યથી  
પણ કદાપિ જુદું યોલવું નહિ.

સત્ય એલાનાર પ્રાણી કોઈને પણ હતો નથી. ધન્યની માર્ક સરળ સ્વભાવી થઈને સર્વનો વિશ્વાસ મેળવે છે, ત્યારે ધરણની માર્ક અદીકલાખી પોતાને અને પરને હળી મનુષ્યભલ હારી જાય છે.

“એ ધન્ય અને ધરણ કોણ હતા ? અને તેઓએ શું કર્યું ? તે જરા સ્પષ્ટતાથી કહો.” એમ સ્વીએના પૂછવાથી મુનિ એલાયા.

આ વિજ્યના સુનંદર નામે નગરમાં સુદર્શા શ્રેષ્ઠિના ધન્ય અને ધરણ નામે એ પુત્રો હતો. ધન્ય સજજન, સૌભ્ય પ્રકૃતિવાન, સત્યવાહી અને પ્રિયંવહ હતો. ત્યારે ધરણ એથી વિપરીત હતો. લિત્ર લિત્ર સ્વભાવવાળા હોવા છતાં એ અનેમાં ગાઢ સ્નેહ હતો.

એકદા ધરણે વિચાર કર્યો. “આ ધન્યની ધજજત આખરે સારી હોવાથી મારો કોઈ લાવ પૂછતું નથી. ને એ જીવે છે ત્યાં લગી મારો લાવ કોઈ પૂછવાનુંય નથી. તો એનો ઉપાય કર્દું તો બોડું શું ?” એમ વિચારતા ધરણે માયા વડે કરીને મીઠું મીઠું એલાતાં એકાંતમાં ધન્યને કહ્યું.

“હે લાઈ ! તું મને પ્રાણુથી પણ અધિક પ્રિય છે તો મારો એક મનોરથ તું પૂર્ણ કર, કે આપણે પરદેશ જઈને પોતાની શક્તિથી ધન ઉપાઈન કરીએ, કેમકે ધન ધગર લોકમાં માન મલતું નથી. લોકમાં પણ કહ્યું છે કે ફરિદી, વ્યાધિવાળો, મૂર્ખ, પ્રવાસી અને પરાધીન આણવિકાવાળો એ પાંચે જગતમાં જીવતા છતાં મરેલા છે.

વાખ અને હાથીએથી લરપુર વનમાં રહેવું સારુ, ઘૃષ્ણનાં પાંડાં કે ઝલ, ઝુલ આઈને રહેવું સારુ, તૃણના સંથારા પર શયન કરેવું સારુ, તેમજ વનમાં રહીને જાડની.

છાલનાં વસ્ત્ર પહેરવાં સારાં પણ પોતાના કુદ્દાજીનોની મધ્યમાં ધનરહિતપણે રહેવું સારું નથી.

માટે હે ખંડ્યો ! પરદેશમાં જર્જ આપણે ધન ઉપાર્જન કરીયો, કારણ કે નિર્વન અને મૃતકમાં મને તો કાંઈ તરફાવત લાગતો નથી, મૃતકને જેમ કોઈ જોતું નથી તેમ નિર્વન તરફ પણ કોઈ નજર કરતું નથી.”

ધરણની આ પ્રમાણેની પરદેશગમનની વાત સાંભળીને ધન્ય બોલ્યો, “ખંડ્યો ! તારી વાત તો ખરી છે પણ મહેનત વગર ધન શી રીતે મળે ?”

ધન્યની વાત સાંભળી ધરણ બોલ્યો, “અરે ખંડું ! ધન પેઢા કરવું એ તો મારે ડાઢા હાથનું કામ છે જે પરસેવો ઉતારી મહેનત કરી પેઢા કરવામાં વાર છે પણ કોઈનો કાન તોડવો, કોઈની ગાંડ છાડવી, કે ખીસ્સાં કાતરવાં, આતર પાડવાં, ચોરી કરવી આહિ ઉપાય વડે કરીને ધનને આપણે ઉપાર્જન કરશું.” તેની વાત સાંભળી ધન્ય ચોંક્યો.

“શાંત પાપ ! શાંત પાપ ! આ પ્રકારનું દુષ્પયન તું કરીને ના બોલ. ‘પરવંચન મહા પાપ’ એ શું તું ભૂલી ગયો ? એની વિચારણા કે એ સંખ્યી વાતચીત કરવી તે પણ સંતાપને કરનારી થાય છે માટે દેવગુરુનું સમરણ કરી એ પાપનું નિવારણ કર.”

પોતાના કથનની વિપરીત અસર થતી જાહીને ધરણ ધન્યની વાતને અંગીકાર કરી પોતાની વાતની દિશા ફેરવતો બોલ્યો—“એવા અકાર્યર્થી ધન પેઢા થતું નથી એં તો ફક્ત તારી પરીક્ષા કરવા માટે કંદું હતું કે એ વાતમાં તું સંમતિ આપે છે કે નહિ. પરદેશમાં કોઈક ધન વાતની સેવા કરી તેની પાસેથી દવ્ય લઇને આપણે વ્યાપાર કરશું” ધરણ એ રીતે ધન્યને વિશ્વાસ પમાડી પરદેશ

ગમનની વાત કણુલ કરાવી. તે પછી એક દિવસે માતા પિતાને કહ્યા વગર તેઓ ખાનગી રીતે નગરમાંથી નિકલી ગયા.

માર્ગમાં જતાં ધરણે વિચાર કરો. “મોદો ભાઈ કદાચ પાછા બેર જય તો તે સારુ નહિં. માટે એ બેર ન જય એવો ઉપાય કરું.” એમ ચિત્તવીને ધરણે પોલ્યો-હે ભાઈ ! જગતમાં મરુષ્યનો ધર્મે જય છે કે પાપે જય.”

ધરણની વાત સાંભળી અચ્છો પામી ધન્ય પોલ્યો, “અરે શું તું એટલું નથી જાણતો કે જગતમાં ધર્મે જય અને પાપે જય છે.”

“અરે આતો તમે જગતની ઉક્તિ કહી છે પણ તત્ત્વ તો તમે જાણતા નથી. આજકાલ જય તો પાપથીજ થાય છે ધર્મથી નહિં.” ધરણે પોતાનો કષો અરો કરવા માંડ્યો.

અતે ભાઈઓ એ રીતે વિવાદ ચડયા ત્યારે ધરણે કહું કે, “આગળ જે ગામ આવે ત્યાં લોકોને પૂછી આપણે નિર્ણય કરીશું પણ એમાં જે ઓદો પડે તે જીતનારને એક લોચન આપે.”

ધન્યે તે વાત કણુલ કરી. “જે કે મારો પક્ષ સાચો છે છતાં હું નાના ભાઇનું લોચન લઈશા નહિં.” વિચાર કરતા તેઓ આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. એ લોકોએ કહું કે, ભાઈ આજે તો પાપ થકી જય હેઠાય છે ધર્મથી નહિં.” આ અજ્ઞાતી અને મૂર્ખ લોકોની વાણી સાંભળી ધરણે રાજુ થયો.

ઓજે દિવસે ત્યાંથી આગળ જતાં તેમણે માર્ગમાં ઘીણ ચક્ષુનું પણ કરીને આગળ જતાં કોઈ ગામ આવ્યું ત્યાં લોકોને પૂછ્યું, તો તેઓ પણ પોલ્યા કે “આજે તો ધર્મી સીધાય છે ત્યારે પાપીના પોથાર છે પંડિત પુરુષ

વિચાર રીલ અને ચિંતાતુર હોય છે ત્યારે મૂર્ખ સુખેથી જીવે છે. સજજન સંતાપ પામે છે ત્યારે દુર્જન વિલાસ કરે છે. દાતાર નિર્વન હોય છે ત્યારે વનવાન દૃપણ છે એ જગતની વિચિત્રતા નથી તો શું ? લોકો બોલ્યા-

“તેથીજ પાપનો જય છે ધર્મનો નહિ.” એવી અજ્ઞાની લોકોની વાણી સાંભળી ધરણ ખુલ્લ પ્રસન્ન થયો ને બન્ને આગળ ચાલ્યા.

આર્ગમાં ધરણ બોલ્યો “હે લાઈ ! મારાં બન્ને નેત્રો અને આપી હે અથવા તો સરત કરી નથી એમ કહે.” ધરણની નક્કાધ પ્રકાશવા માંડી.

તેનું વચન સાંભળી ધન્ય બોલ્યો. “મેં શરત કરેલી ના શીરીતે કહેવાય ? હું શરત પ્રમાણે નેત્રો હારી ગયો છું તો હું તેનો ઝાવે તેમ ઉપયોગ કર.”

પાપી ધરણે આકડાનું હૂંઘ આંખમાં ભરીને તેનાં અજે નેત્રો ફેડી નાખ્યાં. ધન્યને એ રીતે અંધે અનાવી કપદી ધરણ વિલાપ કરવા લાગ્યો. “અરે ! અરે ! મેં પાપીઓએ આ શું કર્યું ? મોટા લાઈને મેં મોટા અનર્થ કર્યો, સંખંધીઓને હું શું મૈં અતાવીશ ?”

વિલાપ કરતા ધરણને શાંત કરતો ધન્ય બોલ્યો—અરે ભાઈ ! એ અધો કર્મનો વિલાસ છે એમાં તારે ઐહ કરવો નહિ.”

વાતો કરતા બન્ને આગળ ચાલ્યા. તેથામાં સહસા ધરણ બોલ્યો. અરે ભાઈ ! સિંહ આપણને હણવાને ધસી આવે છે જીવે શું થશે.”

“તો હું શીધ નાસી જ ને આપણા કુળનું રક્ષણ કર.” ધન્યે એને તુરત નાશી જવાની પ્રેરણ કરી. દુષ્ટ ધરણ ધન્યની વાતનો તરતજ અમલ કર્યો. પોતાને કૃત

કૃત્ય માનતો ધન્યને છાડી પોતાના ગામ તરફ નાશી ગયો। અંધ થયેલો ધન્ય જંગલમાં આમ તેમ લઘુકતો એક મોદા વૃક્ષની નીચે આવીને બેઠો, અને તો હવે રાત્રી ને હિવસ સરખાજ હતા, તે અંધ હોવા છતાં તેમજ ધરણે છેતરીને નેત્રો હરવા છતાં એના વિચારો કેવા? “આહા મારો ભાઈ એકાકી કયાં ગયો હશે? તેનું શું શયું હશે?”

નાના ભાઇના કુશલ ભાઈ શોક કરતા ધન્યને જ્ઞાનથી જાણીને વન-દેવતા પ્રગટ થઇને બોલી “અરે ધન્ય! હુર્જન શિરોમણિ અને આત્મોહ કરનાર એ ધરણની ચિંતાથી સર્વું હવે! નેત્ર રોગને નાશ કરનારી આ ગુટિકાને ગ્રહણ કર.” ગુટિકાને ધન્યના હાથમાં આપી હવી પોતાને સ્થાનકે ગઈ.

હવી ગયા પછી ધન્ય ગુટિકાના અંજનને પોતાની આંખમાં અંજન કરવા લાગ્યો કે તુરતજ હેવીના પ્રભાવ થકી ધન્ય હિવ્ય નેત્રો વાળો થઈ ગયો, રાત્રી ત્યાં વ્યતીત કરી તે હેવીમાં ભક્તિવાળો ધન્ય ત્યાંથી આગળ ચાલતાં અતુક્તે સુલદનગરમાં આવ્યો.

સુલદનગરમાં લમતા ધન્યે પરહ વાગતો સાંભળ્યો, રાજપુરેથો ચકલે ચકલે ઉદ્ઘોષણા કરતા હતા કે, જે રાજકુમારીના નેત્રોને સજજ કરશે તેને રાજ અર્ધ રાજ્ય અને રાજકુમારી પણ આપશે.”

ધન્યે એ ઉદ્ઘોષણા સાંસણી પરહનો સ્પર્શ કર્યો, ઐલી હેવીની આપેલી ગુટિકાથી રાજકુમારીને હિવ્ય નેત્રો-વાળી ખનાવી દીધી. ધન્યની કૃતિથી અભયથ થયેલા રાજએ પોતાની પુત્રી પરણાવી રાજ્યનો અર્ધભાગ આપી પોતાના સરખો કરી દીધો, સત્યના પ્રભાવથી આખરે પણ ધન્ય રાજસુતા તેમજ રાજ્ય મેળવીને સુખી થયો.

એક હિવસે ધન્ય રાજસસામાંથી પાછો કરતો હતો ત્યારે ટીલાંટપકાં કરેલો એક લિંગુક મળ્યો. “ સુનંદપુરથી આવેલા આ વિપ્રને કંઈક દક્ષિણા આપો. ” એ લિંગુકે અની આગળ પ્રાર્થના કરી.

પોતાના નગરનો આબણ જાણી ધન્ય તેને પોતાને ઘર તેડી લાવ્યો. મોદક વગેરેથી એને તૃતે કરી માતા પિતાના કુશલ સમાચાર પૂછ્યા. ઉત્તમ વસ્તુ અને પોતાના નામની મુદ્રિકા આપી એને વિદાય કર્યો. વિપ્રે સુનંદપુર આવીને ધન્યના માતા પિતાને ધન્યનો લેખ આપી કુશલ સમાચાર કર્યા. ધન્યની કુશળતા તેમજ રાજ્ય પ્રાપ્તીથી પિતાએ ઝુશી થધ વર્ધાપન મહોત્સવ કર્યો.

ધન્યની કુશળતા અને રાજ્યપ્રાપ્તીથી પાછી ધરણને ચિંતા થઈ. “ અરે ! એવા લયંકર જગતમાં એ લુલતો રહ્યોજ શી રીતે ? રાજ્ય લક્ષ્મી અને રાજ્ય સુતા પરણ્યો એ તો નવાઈની વાત ! જે અહીં આવશે તો મારી વાત ઝુલ્લી પડી જશે, મારે ત્યાં જઈ એનો કંઈક ઉપાય કરવા હૈ. ”

માતા પિતાની રજા લઈ ભાઇને જોવાના ઝડાને તે ધરણ સુલદનગર આવીને ભાઈને ભદ્યો ધન્ય પોતાના ભાઈને ભલવાથી ઘણો ઝુશી થયો ધન્યની સમૃદ્ધિ બેછ ધરણ વિચાર કરવા લાગ્યો. “ ધર્મનો જય, આ જગતમાં સત્ત્ય છે તે જેકે ધન્યના દક્ષાંતથી સાખિત થયું છે. છતાં હું કંઈક એવું કરું કે જેથી એની સમૃદ્ધિ બધી હવામાં ઉડી જાય ને દુઃખી દુઃખી થધ જાય. ”

મનમાં વિચારને ગોપવી એણે થાડા કાલ પસાર કર્યો. નગરમાં રજા વગેરે સર્વનો ધરણ માનિતો થયો, ધન્યનો ભાઇ હોવાથી નોકર, આકર તેમજ નગરના લોકો પણ

એને માન આપવા લાગ્યા, એક હિવસે આનગીમાં રાજને કહેવા લાગ્યો, “મહારાજ ! આપ બુદ્ધિમાન છતાં પણ આપને ધન્ય ઠગી ગયો.”

ધરણુની વાણી સાંભળી વિસ્મય થઈને સાંજે અભય વચન આપીને ધરણને પૂછ્યું, “કહે સત્ય વાત શું છે.”

“સ્વામી ! ધન્ય તો ચંડાળનો પુત્ર છે. દુરાયારી હોવાથી રાજને એને નગર ઘણાર કાઢી મુકેલો તે આપના નગરમાં આવી આપને ઇસાવી ગયો.” ધરણુની વાત સાંભળી રાજ ચમક્યો.

“ધરણ ! એ વાત નગરમાં તું કોઈને કહીશા નહિ. હું એવું કરીશા કે જેથી ધન્યના સ્થાનકે તને સ્થાપન કરી માલમાલ ઘનાવીશા.” રાજની વાત સાંભળી ધરણુની ખુશાલીનો તો કંઈ પાર રહ્યો નહિ.

નિશા સમગ્રે રાજને ધન્યને મારી નાખવાને ધન્યના મકાનમાં શુસ્ત રીતે મારાયો મૂક્યા. મધ્ય રાત્રીને સમગ્રે અચાનક ધન્યના મસ્તકમાં વેહના થવાથી ધન્યને વેશ પહેરીને ધરણ રાજસભામાં જવાને પ્રાતઃકાળે નિકાયો, તેને પેલા મારાયોએ મારી નાખ્યો ને ત્યાંથી છપાંથ ગણ્યી ગયા.

ભાઇના શોકથી બ્યાકુળ થયેલો ધન્ય શોકથી નિવૃત્તિ પાર્યો નહિ ત્યારે રાજને એના ભાઇની કુરિલતાની અધી વાત સમજાવી શોક સુક્રા કર્યો. ધીરે ધીરે શોકનો ત્યાગ કરતો ધન્ય સુખમાં કાલ વ્યતિત કરવા લાગ્યો.

એક હિવસે વિજય કેવલી અગવાન ત્યાં સમવસર્યા, રાજાદ્વિક સર્વે તેમને વાંદવાને આવ્યા, તેમને વંદન કરી તેમની ધર્મહેશના સાંભળી ધન્યે અવસર મેળાવીને પૂછ્યું.

“અગવાન ! મારો ભાઈ નિષ્પારણ આરી ઉપર દેખ કરતો હતો તેનું કારણ શું ? તે મરણ પામીને કયાં ગયો ? તે આપ કહો.”

બન્ધુના જવાબમાં કેવલી અગવાન યોદ્યા. “તું નામ થકી જેવો ધન્ય છે તેવો અર્થથી પણ છે. સત્યવાદી અને જનમાન્ય તારામાં ને અનામાં બહુ ફેર છે. પરલવના વેરથી આ ભવમાં ધરણ તારો ભાઈ હોવા છતાં દેખી થયો હતો, તે મરીને માતાંગની પુત્રી થયો છે. યૌવન-વયમાં અને ચંડાલ સાથે પરણાવી. તે સર્પ દંશથી મૃત્યુ પામીને હાલમાં તે ધોણીની પુત્રીપણે ઉત્પત્ત થયો છે. દુર્ગાંધ, દુઃસ્વર, ભુંગી, બહેરી, કૃદ્વપવાળી એવા અનેક દ્વારાથી ભરેલી અત્યારે છે.” સંસારના સ્વરૂપથી ભય પામેલો ધન્ય મસ્તક ધૂષાવવા લાગ્યો.

કેવલી અગવાનની વાણી સંભળી વૈરાય પામેલા થન્યે પોતાના પહુંચ ઉપર પુત્રને સ્થાપન કરી દીક્ષા અહુણુ કરી દેવલોકે ગયો. પરંપરાએ ધન્ય પોતાના સત્યપણાણી મોકાની લક્ષ્મીને વરશે.

પેદો ધરણ પોતાની દુર્ભુદ્ધિથી અનેક જુઠ અને કુકુર્મને કરતો ભવાટ્ટીમાં વણો કાલ ભમશો. માટે હે ધર્મ-શીલાઓ ! સન્ય અને અસત્યના ગુણ દોષ જાળીને અસત્યનો ત્યાગ કરી સત્યને અહુણુ કરો. મુનિ બીજા પ્રતાનું વિવેચન કરી દણંતથી તે સ્ત્રીઓને પ્રતિષ્ઠાય કરીને વિરાધ્યા. એ મુનિની દેશના સંભળીને સ્ત્રીઓ ઘણી જુશી થધી છતી ગુરુ પાસે બીજુ અલુપ્રત અંગીકાર કર્યું.

તેમની આ પ્રમાણેની હી ભાવનાથી હે કુમાર ! શ્રી વિચાર કર્યો કે. “મુનિએ આતો સારું કર્યું. તેઓ હવે આરાથી કંઈ પણ છુપાવી શકશો નહિ. કંઈ પણ જુદુ

ઓલીને તે હવે મને છેતરી શકશે નહિ. માટે આ મુનિને મારે કે દરેક અંગમાં ચાર ચાર પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક પ્રહાર ઓછો કરી હવે હું તેમને પ્રત્યેક અંગ વણું વણું પ્રહાર કરીશ. એ એ પ્રહારનો મેં ત્યાગ કર્યો, આ પ્રમાણે વિચાર કરતો અને પ્રચૂનપણે ઉલેકો હું હવે સુરસુંદર મુનિ આગળ શું ઓલે છે અને ખીંચો ઉપર તેની શું અસર થાય છે તેની પ્રતીક્ષા કરતો-વાઠ જોતો ઉલો રહ્યો.

## ૫

### ત્રીજું સ્થુલઅદત્તાદાનવિરમણુવત.

“હું શાવિડાએ ! અદત્તાદાન સંખાંધી વ્યાખ્યા સાંભળો. ડાદ્યા પુરુષો કયારે પણ કોઈનું હરામનું દવ્ય, અહણ કરતા નથી. ભગવાને ચૌર્યકર્મને પાપનું મૂળાકહેલું છે. કોઈ જીવને પ્રહાર કર્યો હોય તેની વેદના કરતાં તેના સર્વસ્વ હરણની વેદના તેને અધિક હુંઘી કરે છે, માટે ખાસ કાળજી રાખીને પણ બીજના દવ્યનું હરણ કરતાં આપકવું.

આ લોકમાં પણ એ પાપનાં ઝલ વંદ, બંધન કે કારાગહમાં પૂરાધને લોગવવાં પડે છે. હાથ પગનો છેદ થાય છે. કવચિત એ પાપનાં ઇણ શૂળી ઉપર અઢીને પણ લોગવવાં પડે છે. પરલખમાં દાસપણું, દારિદ્ર તેમજ તિર્યાંગતિમાં જધને પણ લોગવવાં પડે છે. પરદવ્યના હરનારા નારકીમાં પણ ઉત્પન્ન થધને ત્યાં વિવિધ પ્રકારની યાતનાએ સહન કરે છે.

પરદવ્યનો ત્યાગ કરનારાનું ધન આલોકમાં પણ વૃદ્ધિ પામે છે. તેમનાં ગમે તેવાં નિષમકાર્ય પણ આ

પ્રતના મહિમાથી સિદ્ધ થાય છે, પરલોકમાં અતિગળ દ્વયના લોક્ષા થઈ તેને પુષ્ટ લાલ મળે છે. ચારીના નિયમ ઉપર સિદ્ધહાત અને કપિલહું દિશાંત ઓખાયક છે તે સાંભળવાથી તમને લાલ થશે.

આવકાયોના પૂછવાથી મુનિએ તે સિદ્ધહાતનું આપ્યાન કહેવા માંડયું. આ વિજયમાં વિશાળા નામની નગરીને વિષે માતૃહત અને વસુહત નામના અન્ને વણીક મિત્રો અદ્યપદ્ધિવાળા ને સામાન્ય આળવિકા ચલાવતા રહેતા હતા. માતૃહતે ગ્રીજું અણુપ્રત અહેણ કરેલું હોવાથી ન્યાયથી વ્યાપાર કરી દ્વય મેળવતો અને કોઈને ઠગવાની વૃત્તિ રાખતો નહિ.

વસુહત ખોયાં તોલ, માપ વગેરે રાખી ઓણું આપીને વંધારે પડાવી લેવાની કુદ્દનીતિને ધારણ કરતો વ્યાપારમાં ખુલ્લ પ્રપંચ સેવતો હતો. એવો પાપ વ્યાપાર કરવા છતાં પણ વસુહતનું બનતો વૃદ્ધિ પામ્યું નહિ પણ પાપ તો વધ્યું હતું; એની એ બિચારાને શી અખર હોય?

અન્યથા તે બન્ને મિત્રો થોડાંક કરીયાણાં લઈને વ્યાપાર કરવા માટે પુંડુર નગરમાં ગયા. ત્યાં વસુતેજ રાજ રાજ્ય કરતો હતો, તેના લંડાર માટે એક લંડારીની જરૂર હતી, પણ તેને વિદ્યાસપાત્ર લંડારી ન મળવાથી સારા લંડારીની પરીક્ષા માટે માર્ગમાં એક રલજડીત કુંળ સુલદો પાસે સુકાંધું ને આળુખાળું સુલદો ઝુપાવી દીધા. રાજના ભયથી નગરના લોકોએ તો એ કુંળને અહેણ કર્યું નહિ. કેમકે જાણી જોઈને કોણ મૂર્ખ હોય કે આઝેતને નોતરે?

માર્ગમાં આવતા પેલા અન્ને મિત્રોએ એ કુંદલ જોવાથી વસુહતની હાઠ વળગી. “વાહ! શુ” મળજુનાં

કુંડળ છે એ ! લક્ષ્મી તો કંઈ અમારી વાર જ બેઇ રહી છે ને ?” કોઈને નહી જેવાથી વસુહત કુંડલ લેવાને હોયા. તેને માતૃહતે વાર્યો, “મિત્ર ! આ વિષતુલ્ય કુંડલની લઈશ નહી”, અને નિવારી બજે આગળ ચાલ્યા. માતૃહતે વસુહતને બોધ માટે એક દાખાંત કલ્યું.

કોઈએક નગરમાં દેવ અને યશસ નામે એવણીક સરખો વ્યાપાર કરી ગુજરાન ચલાવતા હતા. દેવ અહતાદાનના નિયમવાળો હતો. ત્યારે યશ નિયમ રહિત હતો. એક દિવસ અને થાડીઘણી મુડી સાથે લઈને પરહેશ ચાલ્યા.

માર્ગમાં એક કુંડલ પણલું બન્નેએ જોયું પણ નિયમસંગના લયથી દેવે તો એના સામુય જોયું નહિ. જ્યારે યશે એ લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એને દેવે અટકાવી હીથે, દેવની લજાથી યશ કુંડલ ન લેતાં આગળ ચાલ્યો. છતાં દેવથી ગુમ રીતે તે કુંડલ અહેણ કરીને તેની સાથે ચાલ્યો.

યશ મનમાં વિચાર કરવા લાગ્યો કે “નિસ્પૂણ એવા આ દેવને ધન્ય છે. જો કે એ જાણતો નથી છતાં આ કુંડલનાં કરીયાણાં અહેણ કરી હું અર્વ ભાગ દેવને આપીશ.” તે પછી કોઈક નગરમાં તેઓ પહોંચ્યા, ત્યાં કુંડલ વેવી બણું દવ્ય લઈને કરીયાણાં અરીધાં, તેના વિલાગ પાડી જ્યારે દેવને સમજણું પાડી આપવા લાગ્યો તો દેવે તે લેવાની ના પાડી ને પોતાની મૂરીનાં જે આધ્યાં હતાં તે અહેણ કરી લીધાં.

તે રાતના યશના મકાનમાં ધાડ પડી ને કરીયાણાં સહિત બધું હુંદાઈ ગયું. દુઃખી થયેલો યશ દેવ પાસે આંખીને રહવા લાગ્યો. તેની દુઃખી ફેશા બેઇ દેવ બોલ્યો, “મિત્ર ! અન્યાયથી ભેળવેલ પદીર્થ મહા અનર્થને કરું

નારો થાય છે તે તું પ્રત્યક્ષ જો, ને અડતાદાનનો નિયમ,  
અહણ કર.”

દેવના કહેવાથી ચંદ્રો પણ તે નિયમ અંગીકાર કર્યો.  
થીજે હિવસે દૂરદેશના વ્યાપારીએ કરીયાણું ખરીદવા  
આવ્યા, એ વ્યાપારમાં દેવને અમણે લાલ થયો તે જોઈને  
યશ સત્યશ્રાવક થયો, માટે હે વસુદત્ત ! ન્યાયથી દવ્ય  
મેળવનારનું કલ્યાણ થાય છે, અન્યાયથી નહિ. “માતૃહતે  
દ્ધાંતપૂર્વક વસુદત્તને ઉપદેશ કર્યો”.

સારી રીતે ઉપદેશપૂર્વક નિવારવા છતાં વસુદત્તે એ  
દુંડલ ગુપ્તયુપ ઉપાડી લીધું તેથી પ્રચ્છત્ર રહેલા રાજપુરેષાએ  
તરતજ એને પકડી લીધ્યો, જેથી માતૃહત મુખ દુઃખી થયો  
ત્યારે એ રાજપુરેષાએ એને સમજાવ્યો. “ઉત્તમ ! તમે ઐદ  
ના કરો, રાજ તારી ઉપર પ્રસન્ન થઈને તને ઈનામ  
આપશો”.

“તમે પ્રસન્ન થયા હો તો ભારા આ મિત્રને મુક્ત  
કરો, એટલે મને ઈનામ મળ્યું એમ સમજુશ, વધારે ઈનામ  
મની મારે જરૂર નથી, બાલ્યસ્વભાવથી આટલો ગુણ્ણો  
વસુદત્તનો માફ કરો,” માતૃહતે રાજપુરેષાને વિનાલિ કરી.

રાજપુરેષા વસુદત્તને મુક્ત કરીને બોલ્યા, “હે મહા-  
પુરુષ ! તારા વચનથી અમે આને છોડી હીધો પણ તું  
એક વાર રાજની આગળ ચાલ.”

રાજપુરેષાએ માતૃહતે રાજની સમક્ષ હાજર કરી  
સર્વે હકીકત કહી સંભળાવી. રાજએ તેની હકીકતથી  
આહિતગાર થઈ તેના ઉપર પ્રસત્ર થઈને પોતાના ભંડારનો  
તેને ઉપરી-ભંડારી-કોશાધ્યક્ષ બનાવ્યો. માતૃહત પોતાના  
નિયમમાં અચળ રહેવાથી રાજની કૃપા મેળવી સુખી થયો,  
માતૃહત અતુક્તે સમાચિ પૂર્વક મૃત્યુ પામીને આજ

વિજયમાં ચંદ્રાભા નગરીના શ્રેષ્ઠી પુરંદરને ત્યાં પુત્રપણું ઉત્પત્ત થયો, તેનું નામ સ્થાપન કર્યું સિદ્ધહસ્ત, તે કળામાં કુશલ થધને અલુકુમે ઘૌવનવયમાં આવ્યો.

વસુદત્ત પણ કુર્કર્મથી આળવિકા ચલાવતો ભરણ પામીને કોઈ આધારના કુળમાં ઉત્પત્ત થયો તેનું નામ કપિલ, દરિદી હોવા છતાં કપિલને એના માતાપિતાએ પરણાવ્યો, તેની સાથે વિવયસુખ લોગવતાં તેને બહુ પુત્રો થયા.

માતાપિતાના ભરણ પામવા પછી દારિદ્રથી દુઃખી થયેલો કપિલ સ્થીના તિરસ્કારથી દવ્ય ઉપાજ્ઞન કરવાને ચાલ્યો ગયો, પણ પાપના ઉદ્યથી તેને કાંઈ લાભ થયો નહિ-દુઃખી દુઃખી થઈ ગયો.

પારાવાર દુઃખમાં અદ્દતા એ કપિલને એક દિવસે કોઈ કાપાલિક સાથે લેટો થયો, ધનનો અર્થી જાણીને કપિલને તે કાપાલિકે કહ્યું, “જો તારે ધનનીજ જરૂર હોય તો ચંદ્રાભા નગરના ઉધાનમાં રહેલી આશાપૂરિકા દેવીની આરાધના કર, તો તારી આશા સર્જલ થશે.”

કાપાલિકનાં વચન સાંભળી કપિલ ચંદ્રાભા નગરીએ આવી પુણાદિકથી દેવીની પૂજા કરી ધ્યાન, મૌન અને ઉપવાસથી દેવીની આરાધના કરવા લાગ્યો, પણ દિવસ વહી ગયા ત્યારે રાત્રિને સમયે દેવી બોલી, “તું શા માટે અહીં એડો છે?”

“ધન માટે” કુંકમાં કપિલ બોલ્યો.

“કોઈ દિવસ તેં કોઈને કાંઈ આખ્યું છે કે તું ધન માગો છે.” દેવીના કહેવા છતાં તે કપિલ બોલ્યો, “હે દેવી! ધન વગર આ હનિયામાં જીવતર જેર સમાન છે માટે ધન નહીં આપે તો તારા ક્ષારે હું તો મરીશા.” તેને નિશ્ચય

જાણુને હેવીએ એક ગુસ્તક આપ્યું, “પાંચસો ઇપીયા આપે તેને આપજે.” એમ કહી હેવી અદરથ થઈ ગઈ.

કપિલ ગુસ્તક લઈને અધ્યા નગરમાં ઇરો પણ કોઈએ પાંચસો ઇપીયા આપ્યા નહિ. જેથી છેવે તે ઇરતો કરતો સિદ્ધહંતના માર્ગન આગળ આવ્યો. સિદ્ધહંતે એ ગુસ્તક બોઈ એમાંથી પ્રથમ શ્લોક વાંચ્યો. ‘પ્રામૃત્યમર્થ લખતે મૃતુષ્યઃ’ એના તત્ત્વનો નિશ્ચય કરી સિદ્ધહંતે પાંચસો ઇપિયા આપી હીધા તે લઈને કપિલ પોતાના નગર તરફ ચાલ્યો ગયો. પણ માર્ગમાં લુંધારાએએ મારીને એની પાસેથી ઇપિયા પડાવી લીધા. નરીઓએ ડગલાં આગળનું આગળ.

રાત્રીને સમયે પિતાએ પાંચસો ઇપિયાની વાત જાણુને સિદ્ધહંત ઉપર ગુસ્તે થઈ અપશાખ કહેવા પૂર્વક ઘરમાંથી કાઢી સુક્યો. નગરના દરવાજા બંધ હોવાથી દરવાજા નાલ કોઈ દેવમંહિરમાં તે સૂછુ ગયો, પોતાના હાથમાં ગુસ્તક રાખીને તે ચિંતારહિત થઈને નિરાધિન થઈ ગયો. પુષ્યશ્વર ભાગ્યવાનોની ચિંતા કરે છે.

## ૬

### સિદ્ધહંત.

ચંદ્રાસા નગરીના રાજને એક પુત્રી હતી. તેવી જ રીતે મંત્રી, શ્રેષ્ઠી અને પુરોહિતને એક એક પુત્રી થઈ. એ ચારે એકજ શાળામાં જાણી ગણી અનુકૂમે યૌવનવયમાં આવી. ચારે સહીપણી હોવાથી વણેખાખરો વખત તે સાથેજ પસાર કરતી હતી. યૌવનવયમાં આવેલી એ ચારે ભાળાએ વિચાર કરવા લાગી. “પિતા આપણને જુદે જુદે પરણા-વશે ત્યારે આપણે એક બીજનો વિયોગ શ્રી રીતે સહન કરશું!”

વિચારને અંતે તેમણે નિર્ણય કર્યો કે આપણે એકજ વરને વરી જવું. જેથી જુદાઈનો સમય આવે જ નહિં. વરને પસંદ કરવાનું કામ રાજકુમારીને સમર્પણ કર્યું. રાજકુમારી જે વરને વરે એ વરને બીજું નણે સખીઓએ કખુલ રાખ્યો, એવો સંકેત કરી જુદાં પડ્યાં.

રાજસભામાં આવેલા કોઈ રાજસેવકના સહાચારથી રાજકુંવરીની નજર તેના ઉપર ઠર્યી એક હિવસ તેને આનગીમાં રાજકુંવરીએ પોતાની પાસે મોલાવી પોતાના મનની વાત તેની આગળ કહી સંભળાવી. રાજકુંવરીની વાત સાંલથી રાજસેવક ચિંતાતુર થયો. પણ વિચાર કરીને એણે રાજકુંવરીની વિનાંતિને કખુલ રાખી નહિં.

પોતાની વિનાંતિ અફ્રણ જવાથી રાજકુંવરીએ હમ લીડાવ્યો. “લક્ષ્મી ચાંદ્લો કરવા આવે છે ત્યારે તું કંપાળ ધોવા જય છે. પણ મારી માગણી તારે કખુલવીજ પડશે જો નહિં કરીશ તો મારા માણસો દ્વારા તને મરાવી નાભીશ તે યાર રાખજો.”

રાજકુંવરીના હમ દેવાથી જય પામેલો. એ રાજસેવક રાજકુંવરીની વાણીને આધિન થયો. રાજસેવકે પોતાની વાત કખુલ કરવાથી કુંવરીએ અસુક હિવસનો સંકેત કર્યો ને કદું કે તે હિવસે દરવાજ નાલુક પેલા દેવમંહિરમાં તારે રાત્રીને સમયે આવવું, હું પણ વિવાહની સામગ્રી લઈને ત્યાં આવી હાજર થઈશ.” સંકેત કરીને તે રાજસેવકને કુંવરીએ વિદાય કર્યો.

રાજસેવક પોતાના સ્થાને જઈને પણ વિચાર કરવા લાગ્યો. “અરે ! આ રાક્ષસીના પંજામાં ફૂસાયા નથીત્યાં લગીજ મને સુખ છે, સ્થિતી તો પિશાચીની માઝેક છણ કરી છેતરનારી છે, બધાવાનને પણ બડીના છંડો લાગમાં તોડી નાખે છે તો મારું તે શું ગળુ ?”

રાત હિવસ ચિતા કરતો રાજસેવક હિવસ વ્યતીત  
કરતો હતો આખરે સંકેતનો હિવસ પણ આવી પહોંચ્યો  
ત્યારે તેણે પાછા વિચાર કર્યો, “સ્ત્રીની ખાતર હું મારા  
નિર્મળ કુળને કલાંકિત કરીશા નહિ. રાજ પોતાનો સ્વામી,  
હોવાથી સ્વામીદ્રોહ કર્યો પણ મારે શું બ્યાજખી છે ?”  
ધત્યાહિ વિચાર કરી રાત્રીને સમયે તે નગર બહાર ચાલ્યો  
ગયો અને સંકેતને સ્થળે ગયો નહિ.

હૈવયોગે રાજકુમારીએ કે સમયે પેલા રાજસેવકને  
હેવમંહિરમાં આવવાનો સંકેત કરેલો. તે સમયે તે રાજ-  
સેવકને બદલે સિદ્ધદાત એ હેવમંહિરમાં દાખલ થઈ નિરાંતે  
સુધ ગયો, વિવાહની સામની લાધને રાજકુમારી પોતાની  
સખીએ સાથે રાત્રીના પહેલા પ્રહૃતે તે હેવકુલમાં આવી,  
પહોંચ્યી, ભરબુધમાં પડેલા તે પુરુષને રાજસેવક ધારી  
પોતાના કોમલ હાથનો સ્પર્શ કરી જગત કર્યો, ને પોતાના  
હાથ કંકણ પહેરી ગાંધર્વ વિધિથી તેની સાથે લગ્ન  
કરી લીધાં.

લમકાર્યથી પરવારીને રાજકુમારી બોલી, “હે સ્વામી !  
વાહન તૈયાર કર્યું છે કે નહિ ? આપણે પ્રાતઃકાળે તો ગુમ,  
રીતે પલાયન કરી જવાનું છે નહી તો રાજ જણે તો શું  
થાય ?” રાજકુમારીનાં વચન સાંભળી સિદ્ધદાત બોલ્યો,

“સવારની વાત સવારે, હું મને નિરાંતે ઉઘ લેવા,  
દે.” એમ કહી કપથનિદ્રાથી સિદ્ધદાત સુધ ગયો. પણ  
રાજકુમારીનું મન શંકાશીલ થયું “અરે આ તો તે પુરુષ  
કે નહિ.”

રાજકુમારીએ દીપક પ્રકટાવીને એ પુરુષને જોગે તો,  
સુકુમાર અને મનોહર અંગવાળા તેને જોધ મનમાં ઝુશી  
થઈ, એ દરમિયાન તેના મસ્તક પાસે પડેલી પુરિતકા તરફે

એની નજર ગઈ, તો એ પુસ્તકમાં એણે પેલા શ્લોકનું પ્રથમ પાદ “પ્રાત્મવ્યભર્થ લલતે મતુષ્યः” એના આગળ સંખીથી પોતાની આંખમાંથી અંજન કાઢીને લખ્યું, “હેવોપિ તં લંઘયિતું ન શકતાઃ” તે પછી રાજકુમારી પોતાની સખીઓ સાથે પોતાના મંહિરે ચાલી ગઈ.

ભીજે પ્રહેરે મંત્રીપુત્રી આવી પહોંચ્યી, રાજકુમારીએ આજના સંકેત સમાવાર ત્રણે સખીઓને જણાવ્યા હતા. ને તે સંકેત સુજાય ચારે સખીઓએ ચારે પ્રહેર પોતપોતાના લભ માટે નક્કી કરેલા હોવાથી ક્રમ સુજાય ભીજે પ્રહેરે મંત્રીપુત્રીએ આવીને ગાંધર્વ વિધિથી પોતાનું લંજન કર્યે આદ્યાપી લીધું તે પછી પેલા પુસ્તકમાં એપદ પછી વિચાર કરી તેણુંને ત્રીજુ પહ લખ્યું. “તરસમાન શોકો ન ચ વિસમય મે.” પોતાનું કાર્ય સમાપ્ત કરી મંત્રીસુતા ચાલી ગઈ, ને પછી તો ત્રીજેપ્રહેરે શ્રેષ્ઠસુતા સખીઓ સાથે આવી.

શ્રેષ્ઠ સુતાએ પણ એ પુરુષ સાથે ગાંધર્વ વિધિએ લભ કરી પેલી પુસ્તકા નજરે પડતાં તેનાં પાનાં ફેરવવા માંડ્યાં તો પહેલાનાં ત્રણ પાદ વાંચી આગળ ચોથું પાદ વિચાર કરીને પોતે લખ્યું “યદ્વસમહીયઃ નહિ તત્પરે પામ” શ્લોક પૂર્ણ કરીને તે ચાલી ગઈ. ચતુર્થ પ્રહેરે પુરોહિત સુતા આવી પહોંચ્યી, તેણુંને આ બધી હકીકત જાણીને નવીન શ્લોક એ પુસ્તકમાં લખવા માટે વિચાર કર્યો. પ્રથમ શ્લોકના પરામર્શનો અયાદ કરતાં એણે વિચાર્યું “પ્રાત્મ થવા યોગ્ય વસ્તુ મતુષ્યને મલે છે. હેવતા પણ તેમાં વિધન કરવાને શક્તિમાન નથી. તેમાં દીલગીર કે નવાઈ જેવું શું છે? જે અમારું છે તે બીજાનું શ્રી રીતે થઈ શકે?” એ પ્રમાણે વિચાર કરી પુરોહિત આગામે લખ્યું:

વ્યવસાયં દધાત્યન્યે, ફલમન્યેન મુજ્યતે ।

પર્યાસં વ્યવસાયેન, પ્રમાણં વિધિરેવ નઃ ॥ ૧ ॥

ભાવાર્થ—આ જગતની વિચિત્રતા તો જુઓ. ઉધમ કોઈ કરે છે તારે કંલ તો કોઈ બીજેજ લઈ જય છે— લોગવે છે, તો પછી એવા ઉધમ વડે કરીને શું? અમારે તો ભાગ્ય એ એકજ પ્રમાણભૂત છે.

પુરોહિત બાળ પણ પોતાનું કાર્ય સમાઝે કરીને સખીઓ સાથે ચાલી ગઇ. પ્રાતઃકાળ થતાં ચારે બાળાઓની સખીઓએ વિચાર કર્યો. “ જે આપણે આપણી ભાતાને આ વાત નહિ કરીયે તો ગુનહામાં આવશું.” એમ વિચારી સખીઓએ એમની ભાતાને વાત કર્યો. ભાતાએ પોતપોતાના પતિને એ સમાચાર આપી દીધા. રાજએ વિચાર કરી પ્રધાનોને પોલાવી આડેશ કર્યો. “ હે મંત્રીઓ ! હેવ કુળમાં રહેલા એ ભાગ્યવંત પુરુષને મોદા આડંખર પૂર્વક રાજમંહિરમાં તેડી લાવો.”

રાજના હુકમથી મંત્રીઓ લુણ્ણ હેવ મંહિરમાં આવીને સિદ્ધાતની પાસે ઉલા રહ્યા. મંગલમય વાહિંન એક તરફ વાગવા લાગ્યાં. બીજા તરફ બંધી જનો જય જય શણ્ણ ઉચ્ચાર કરવા લાગ્યા. સૌભાગ્યવંતીઓ મંગલમય ગીતો ગાવા લાગ્યી. એ મંગલમય શણ્ણોથી જાગત થયેલા સિદ્ધાતને પછુણ્ણતી ઉપર બેસાડી મોદા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવી રાજમંહિરમાં લાવ્યા, લોકેના મુખથી પુરંદર સુતને જાણીને રાજ બહુજ ઝુશી થયો.

સિદ્ધાતને ઘર બહાર કાઢ્યા પછી તુરેતજ એના પિતાને પસ્તાવો થવાથી આખી રાત્રી એની શોધમાં વ્યતીત કરી, પ્રાતઃકાળે લોકેના મુખેથી પોતાના પુત્રની

અદ્ભૂત વાત સાંભળી પુરંદર શેડ રાજસભામાં આવ્યો,  
અન્ય કન્યાઓનાં માતાપિતા પણ પોતાના જમાઈને લોઈ  
આશી થયા.

રાજએ ચારે કન્યાઓનો વિવાહ આરંભ્યો ને શુસ્ત  
સુધૂતે રાજએ ત્રણ કન્યાઓ સાથે પોતાની કુંવરી  
પણ સિદ્ધહાતને પરણાની દીધી, પહેરામણીમાં રાજએ  
પાંચસો ગામ આપ્યાં.

મંત્રી વગેરેએ પણ પોત પોતાના વૈભવને અતુસારે  
કુર્માચન અવસરે પુષ્કળ ધન આપી જમાઈને સંતુષ્ટ  
કર્યો, રાજએ આપેલા મહેલમાં સિદ્ધહાત ચારે પ્રિયાઓ  
સાથે અતુપમ સુખને લોગવતો કાલ વ્યતીત કરવા લાગ્યો.

એકદા તે નગરના ઉધાનમાં ગુણુશેખરસૂરિ પદાર્થી,  
રાજ વગેરે સર્વે તેમને વાંદવાને આવ્યા, ચાર પ્રિયાઓ  
સાથે સિદ્ધહાત પણ ગુરુને વાંદવા આવ્યો તેમના ઉપકારને  
માટે ગુરુએ ધર્મ દેશના આપી.

ગુરુની દેશના સાંભળી પોતાનો પૂર્વ ભવ જાણી  
વૈસાય પામેલા સિદ્ધહાતે ગુરુ પાસે દીક્ષા અહેણ કરી, ચિર-  
કાલ પર્યાત ચારિત્રિને પાણી સ્વર્ગી ગયો ને અતુક્ષે મોક્ષે  
જશે.” મુનિની ત્રીજા પ્રતની વ્યાખ્યા સાંભળીને હે  
કુમાર ! મારી સ્ત્રીઓએ ત્રીજી પ્રત અહેણ કર્યું;

તેમના આ પ્રતથી મેં પણ જાણ્યું “કે હું આ  
સ્ત્રીઓ મારાથી ગુમ રીતે ધનને રાખી શક્યો નહિ.  
અથવા તો મને ડાંનિને ધન અહેણ કરશે નહિ. કેથી હું  
મુનિને એ એ પ્રહાર કરીશ.” મુનિએ પોતાની દેશના  
આગામ ચલાવી.

૭

### ચોથું પરસ્યીગમન વિરમણુંત

હે મુશિલાઓ ! સર્વ ગ્રતમાં શિરોમણિ, મહા મંગલકારી, કલ્યાણનું કરનાર એવું જે શીલગ્રત તેનો મહિમા સાંભળો. આ ગ્રત તો કુલવંતી સ્વીને શોભા રૂપ છે. આ જીવન પર્યંત આ ગ્રત તેમને આરાધવા થાગ્ય છે મનથી પણ કુલવંતીએ પર પુરુષની ઈચ્છા ન કરવી જોઈએ, પર નરને સરાગ દિશ્યી જોવો એ પણ મહા પાપનું કારણ છે. આ જન્મ પર્યંત જે શુદ્ધ સતી નારી છે તેને વેરી, વારી, અભિ, વ્યાધ, વैતાળાદિક કોધ પણ વિપત્તિએ પરાલવ પમાડી શકતી નથી. સતી સ્વીએ જગતમાં ભાન, પૂજા અને સત્કારને પામે છે. એ સતી નારીના તેજ અને પ્રતાપ અદ્ભૂત હોય છે ગમે તેવો અળવાન કે વિધાવાન પણ સતીના તેજ આગળ હારી જાય છે. પૃથ્વી મંડળ ઉપર તેના ઉજવળા યશાની પ્રખ્યાતિ સર્વત્ર વિસ્તાર પામે છે. એનો જ્ય જ્ય થાય છે.

આ લોકમાં સૌલાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, અને ચિત્તની નિર્ભૂતિ-શાંતિ તેણીને થાય છે ત્યારે પરલોકમાં સંતી નારી સ્વર્ગ, અને અપવર્ગ (સુક્ષ્મિ) ની લક્ષ્મીને પામે છે. દેવતાએ પણ શીલગ્રતધારીને નમે છે. એની સેવામાં, એને સહાય કરવામાં, એની આજા ઉદ્ઘાવવામાં હાજર નાજર રહે છે.

જેએ શીલથી ભુષ થયેલા છે તેમની ફશા શોચનીય હોય છે તેમની નાસિકા, ઓષ્ઠ, કર, પાદાદિક ઈદ્રિયાનો છુદ થઈ જાય છે. વધ, અંધન, ધન ક્ષય આદિ અનેક આપદ્ધાએ એને માટે તૈયારજ હોય છે.

કુશીલા સ્થી પરબવે કુદ્રપવાલી, ડુર્ભગા, વંદ્યા, ભગંદરાહિ મહારોગની પીડાવાળી, રંડા, કરંડા અને નિંદાને પાત્ર થાય છે. અરે એના ઉત્કૃષ્ટ પાપતું તો આ લખમાં પણ એને ઇલ મલે છે.

કુશીલ પ્રાણીએને મનુષ્ય લખમાં અગોપાંગતું છેદાવું વગેરે હોષે પ્રાસ થાય છે. તિર્યંચ ગતિમાં વધ, બંધન, તાડન, તર્જન, ભારારોપણ, સુવા તુષા સહન આહિ અનેક હોષે સહન કરવા પડે છે. નરક ગતિમાં પરમાધા-મીએ તેને વજુભિમાં ઝેંકી મહા વ્યથા ઉપજવે છે અભિથી ધગધગતી લોહની પુતળી સાથે આલિંગન કરવે છે. કિ બહુના ? દુઃખશીલવાળાને માટે આ જગતમાંની કંઈ આપહા તૈયાર નથી ?

શીલિ કરી સુખ સાંપ્રાણ્ય પામેલી શીલસુંદરીનું દિશાંત મનત કરવા યોગ્ય હોવાથી તે તમારે સાંભળવા યોગ્ય છે. મુનિએ શીલસુંદરીની કથા કહી સાંભળાવી.

આ વિન્યભાં વિન્યવર્ધન નામે નગરને વિષે વસુ-પાલ નામે શ્રેષ્ઠી, તેને સુમાલા નામે સ્થી હતી, તેમને જીના-ગમને જાણુનારી સુંદરી નામે પુત્રી થર્ધ, કલામાં કુશલ તેમજ ધર્મકાર્યભાં પ્રીતિવાળી સુંદરી અતુક્ષે યૌવન વયમાં આવી.

એના પિતાએ અનેક સુંદર કુમારોને એની યાચના કરવા છતાં ભિથ્યાતી હોવાથી ન આપતાં સુલદ નામે શ્રેષ્ઠ પુત્રને આપી. કેથી :લોકો એના ભાગ્યનાં વખાણુ કરવા લાગ્યા. જે નિરાશ થયા તેએ પોતાની નિંદા કરવા લાગ્યા.

એ નગરમાં એ વિપ્રપુત્ર અને એ વણિકપુત્ર એ ચારે પરસ્પર પ્રીતિવાળા થધને દરરોજ આનંદ ગોઢી કરતા

હતા. સુંદરોના ઇપ ગુણ સાંભળીને એ ચારે એની તરફ આકર્ષિયા. એના સંગમની અભિલાષાવાળા તેઓ સારાં સારાં વસ્તુ પહેરીને એ સુંદરોના મકાન આગળથી રોજ નિકળતા હતા ને બંસી વગાડતા હતા, ગાયન કરેતા હતા. એના મકાન આગળ અનેક ચેષ્ટાઓ કરવા પૂર્વીક સુંદરીના ચિત્તને આકર્ષિયાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

તેમની આવી દુષ્પ્રેષણોવા છતાં સુંદરીએ એમની તરફ જરાયે ધ્યાન આપ્યું નહિ કે નજર સરખીપણ જ્યારે કરી નહિ ત્યારે તેમણે ધનથી વશ કરી કોઈ પરિવાજિકાને શીખવી સુંદરી પાસે મોકલી, કારણું કે—

પોતાને સ્ત્રી હોવા છતાં નીચ પુરુષ પરસ્તીમાં લાપદ થાય છે. સ્વચ્છ જગઠી ભરેલું સરોવર છતાં કાગડો સ્ત્રીના મસ્તક પર રહેલા કુંભના જગની છંચણ કરતો નથી શું ?

એ પરિવાજિકા સુંદરી પાસે આવી છતાં તે મિથ્યાલી હોવાથી સુંદરીએ તેનો આદરસત્કાર કર્યો નહિ. છતાંથી પોતાના કાર્યમાં ઉત્સુકતાવાળી પરિવાજિકા એની પાસે ઘેરી ને શિખામણ આપવા લાગી. “સખી ! દ્વારાધર્મ સર્વે ધર્મવાળાઓને માન્ય છે, તેમાંય શાવકો તો સર્વે જીવની રક્ષા માટે અતિ સાવધ હોય છે, કોઇને દુઃખી કરતા નથી, દુઃખીયાતું પણ પોતાના સર્વસ્વના લોગે તેઓ રક્ષણ કરે છે તો તું પણ તારે માટે તરફદી રહેલા અને મુખુને માટે આતુર થયેલા તેમને જીવાડ, એમની આશા પૂર્ણ કર.”

“અરે કુલીન સ્ત્રીઓના કુળને કલંક લગાડનારું આ તું શું એલો. આવું મહાપાપ અમારે શું ચોઅય છે ? તમારા સરખી પ્રતધારીઓને આવું પ્રિયત્ત એલાવું પણ ચોઅય નથી. જે પ્રાણી ભીજને પાપ જુર્ઝિ આપી અવણે

આર્જ એંચી જાય છે તે પોતાના આત્માને તેમજ ખીજાને હુંગતિમાં પડું છે.”

સુંદરીની વાણી સાંભળીને અલિમાની પરિપ્રાજિકા કહી ધમકાવીને ચાલી ગઈ. “અરે ! તુ મારી સતીયોમાં શિરોમણિ છુ તે હવે જેઘ લેવાશે.”

પરિપ્રાજિકાએ તે પુરુષોને સર્વે હકીકત કહી સાંભળાવીને શિખામણ આપી કે “અરે ! જો તમારે જીવિતની ધંઢા હોય તો એ સુંદરીની ધંઢા કરવી છોડી ધો.” એ હુણેને શિખામણ આપી પરિપ્રાજિકા ચાલી ગઈ છતાંય એ દુર્લલિત પુરુષોની અલિલાપા તો અધિક પ્રાણલિત થધ.

હવે એ પુરુષોએ કોઈ મંત્ર સિદ્ધ પુરુષને સાધ્યો, મંત્રસિક્ષના કહેવાથી કૃષ્ણ ચતુર્દર્શીની રાત્રીએ એ ચારે પુરુષા રમશાનમાં આવ્યા, ત્યાં પવિત્ર ભૂમિમાં મંડળને આલેખી તેમાં બેસીને મંત્રની અધિકારક દેવીની પૂજા કરી વિધિપૂર્વક આરાધના કરવાથી મંત્રથી આકૃપાયિલી દેવી હાજર થધ. તેને પેલા મંત્રસિદ્ધ પુરુષ સુંદરીને હાજર કર્યા કૃમાંધુ.

પિતાને ઘેર રહેલી પૌષ્ઠ્રતબાલી સુંદરીને દેવીએ સિદ્ધપુરુષ પાસે હાજર કરતાં દેવી બોલી “અરે પાપી ! આવા પાપકાર્યમાં મને જેડી તારી શક્તિનો તેં દુર્યોગ કરો.” એમ કહીને અદરથ થધ ગઈ.

એ સિદ્ધપુરુષ પેલા ચારે દુષ્પ પુરુષોને ખતાવતાં કણું. “જુઓ આ સુંદરી, કે જેની તમે ધંઢા કરો છો તે આ રહી, હવે તમને જેમ ઝેં તેમ કરો.

સિદ્ધપુરુષનાં વચન સાંભળી એ ચારે દુર્લલિત પુરુષો સુંદરી સાથે રમવાને આતુર થયેલા જે સુંદરીને પ્રથમ સ્પર્શ કરે તે પહેલો રૂમે એવી શરત કરીને હોડ્યા, પણ

વનહેવીએ તેમને અધવચ સ્થંભાવી દીધા. એ ચારે કુલાં-  
ગારેને સ્થંભિત થયેલા જેઠ સિદ્ધ ભયથી કંપવા લાગ્યો,  
આડુળાંબ્યાઢુણ થયેલો સિદ્ધપુરુષ સુંદરીના ચરણમાં  
મસ્તક મૂકતો બોલ્યો.

“હે ભગવતિ ! હે ઘાગિની ! તારા આ ભાહાત્મયને  
હું પામર જાણતો ન હોવાથી મેં આ અકાર્ય કરેલું છે તો  
મારા આ એક અપરાધની તું ક્ષમા કર. હવેથી આવો  
અપરાધ હું કરીશ નહિ, રંક એવા તારે શરણે આવેલાને  
તું અભય આપ,” એ સ્થિતિમાં પ્રાતઃકાળ થયો ને  
અધું નગર હુલોણે ચદ્યું, ને લોકો લેગા થતા ગયા,  
રાજ પણ ખખર પડતાં મંત્રી આહિ પરિવાર સાથે ત્યાં  
આવી પહોંચ્યો. રાજએ પેલા ચારે સ્થંભિત પુરુષને પૂછ્યું.

“કુરાચારીએ ! આ શું છે ? તે સત્ય કહો, “રાજના  
પૂછ્યા છતાં જ્યારે જવાબ ન મળ્યો ત્યારે સુંદરીને પૂછ્યું.  
શરમથી સુંદરી પણ કાંઈ જવાબ આપી ન શકવાથી  
અભયવચન મેળવી ચેલા સિદ્ધપુરુષે સર્વે હકીકત કહી  
સંભળાવી. દેવીએ પણ તે પુરુષને મુક્ત કરવાથી તેમણે  
પણ તે પ્રમાણે વૃત્તાંત કહી સંભળાંબ્યું, તેમની વાત સંભળી  
કોપાયમાન થયેલો રાજ બોલ્યો, “પાપીએ ! મારા નગ-  
રમાં રહીને આવાં પાપકર્મ કરો છો ? સત્તી સ્ત્રીએને હેરાત  
કરો છો ?” પછી તો એ ચારેને કારાગ્હમાં પૂરી દીધા.

રાજ પેલા સિદ્ધપુરુષને કહેવા લાગ્યો “પાપી ! તું  
કોઈ વખતે મારા અન્તાંપુરનો પણ વિનાશ કરીશ. તને  
અભય વચન આપેલું હોવાથી તને માર્ત્તો નથી પણ તું  
મારા રાજ્યની હુદા બહાર જ”. રાજએ એને દેશનિકાલ  
કર્યો. પૌરજન સહિત રાજ સુંદરીના ચરણને નમસ્કાર  
કરતો એના પિતા વસુપાલ શોકને કહેવા લાગ્યો “શોક !

આ જગતમાં એક તમનેજ ધન્ય છે કે જેના ધેર આવી મહાસતી પુત્રી છે.”

રાજની વાણી સાંભળો હૃતજ્ઞ એવો શોઠ હાથ જોડી બોલ્યો “હેવ ! આપને જ એક આ પૃથ્વી પર ધન્યવાદ છે કે જેમના રાજ્યમાં આવી મહાસતી વસે છે.” શોઠની વાણીથી સંતોષ પામેલા રાજએ તેના પિતા અને પતિને રાજ્યકરથી મુક્તા કર્યા, સુંદરીને મહા કીમતી વસ્ત્રાલંકાર આપ્યા, મોટા મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવી તેનું શીલસુંદરી નામ જાહેર કર્યું.

શીલના માહાભ્યથી પ્રસિદ્ધ થયેલી શીલસુંદરી ચિર-કાલપર્યત સુખ લોગવી અતુક્તમે કાલ કરી સ્વર્ગ ગંધ. પરંપરાએ તેણે મુક્તા લક્ષ્મી પ્રાપ્ત કરી. ત્યારે પેલા હુર્લ-લિત પુરુષોનું રાજએ સર્વસ્વ હુરી લઈ કારાયહુમાં આંકેલા, તાં ઘણેલા કાલ કલેશને લોગવતા મૃત્યુ પામીને હુર્ગાતિમાં ગયા.”

એ પ્રમાણે શીલ અને અશીલના ગુણ હોથ જાણીને હે ભદ્ર ! તમે શીલ પાલવામાં આદરવાલા થાઓ “મુનિ-એ શીલપ્રત ઉપર એ પ્રમાણે યોધ કરવાથી મારી સર્વે સ્ત્રીઓએ પરયુદ્ધનો નિયમ અંગીકાર કરો ચોણું અછુપ્રત અહુણુ કર્યું.”

હે પૂર્ણચંદ્ર કુમાર ! તેમના આ નિયમ અહુણ કરવાથી હું અહુજ પ્રસન્ન થયો. આજ સુધી મને કે વહેમ, શાંકા તેમજ સ્ત્રીઓના વ્યલિયારની શાંકા રહ્યા કરતી હતી તે આજથી હવે નષ્ટ થવાથી હું મુનિ ઉપર પણ ખુખ્ય પ્રસન્ન થયો “વાહ ! મુનિએ આ દામ તો સારું કર્યું.”

પરમ સંતોષને અતુભવતા મેં મુનિને પ્રત્યેક અંગે અણે પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક ઓછા કરી

નાભી હવે મુનિને એકએકજ પ્રહાર કરીશ એમ ચિંતવતો  
સું આગળ શું બને છે તે જણવાને થોસબો.

૮

### પાંચમું પરિથિતપરિમાણુ વત.

“હે નિર્મણ શીળવંતીએ ! તમારે હવે પરિથિતનું  
પરિમાણ કરવું જોઈએ. જીવને જેમજેમ પરિથિત વધે છે  
તેમતેમ લોલ, ચિતા, વ્યવસાય વૃદ્ધિ પામે છે જગતમાં  
એક પુત્રીવાળાને થાડક હુઃખ-ચિતા હોય છે પણ જેમ  
જેમ અધિક પુત્રીએ હોય છે તેમતેમ અમણી ચિતા વધે  
જાય છે. એવી રીતે હાર્થી, ઘાડા રથ, થહુ, હાઈ વૃદ્ધિ પામે  
છે ત્યારે તેને લગતી ચિતા પણ વધે છે.

પરિથિતથી રહિત સંતોષને ધારણું કરનાર સાંધુએને  
જે સુખ હોય છે તે સુખ પરિથિતધારી એવા મહાનને પણ  
નથી મલી શકતું, પરિથિતમાં પ્રીતિવાળો લોલી કાર્ય-  
કાર્યને પણ જાણતો નથી. પરિથિતની ખાતર અનેક પાપ-  
કર્મ કરી કલેશ પામે છે. આ જીવમાં લોલી લોકોનો તિર-  
સ્કાર પામે છે. પરલવમાં તે નરક અને તિર્યંગતિમાં  
જઇને અનાંત હુઃખ લોગવે છે. જે પરિથિતનું પરિમાણ  
કરે છે તે ગુણાકરની માફક સુખી થાય છે, અને નથી કરતા  
તે પરિથિતમાં રક્ત થધને અનેક છળકપટ કરી પાપમાં  
આગળ વધે છે ને ગુણાકરની માફક હુઃખી થાય છે.

મુનિની અમૃતમય વાણી સાંભળીને મારી સ્નીએએ  
ગુણાકર અને ગુણાધરનો વૃત્તાંત પૂછવાથી મુનિએ તે  
વૃત્તાંત કહેવું શકે કર્યું.

આ જ વિજયને વિષે જયસ્થળ સંજીવેશમાં વિહુ  
અને સુવિહુ નામે બે વણિક લાધાએ રહેતા હતા. તેમાં

કે વિહુ હતો તેનો વ્યવહાર બરોખર ન હતો, લોકમાં એની આભરણ નહોતી. તે યાચકોને ઘેર આવવા હેતો નહિ. સજજનોને પણ કલેશ કરનારો હોવાથી તેમજ તે ખાનપાનમાં પણ કૃપણુનો લાઈ હતો. મહા કલેશ અને માયા કપ્યથી તે ધન ઉપાર્જન કરતો હતો. યાચકો-સિક્ષકો એની નિંદા કરતા હતા, સ્વજનો-સગાં સંબંધીઓ એનો શોક કરતા હતા. શ્રીમંતજનો એને થિકારતા હતા, પંડિત પુરુષો એની હાંસી કરતા હતા. છતે દ્વારે પણ તે દરિદ્રીની માર્કે પોતાનો સમય વ્યતીત કરતો હતો.

બીજે સુવિહુ ઇડા મનવાળો, સંતોષી, સત્પાત્રમાં હાનદેવાની રૂચિવાળો, સદાચારી, મહુરલાખી, વિવેકી, સજજનોની સંગત કરનારો, હાનવડે અર્થજિજનના મનેન રૂથ પૂરનારો હતો. સંપત્તિના પ્રમાણમાં સુખમાં પોતાનો સમય વ્યતીત કરતો તે સુવિહુ સજજનોને માન્ય હતો.

એક દિવસે તપને પારણે કોઈ મહાત્મા સુવિહુના અકાને આવ્યા. સુવિહુએ મિથાત્ર વડે એ મુનિને પ્રતિલાભિત કર્યા. જેથી તેણે લોગ કર્મ વાળું મતુષ્ય આદું બાંધ્યા. પેલા વિહુએ હસીને મશકરી કરી કહ્યું, “વ્યાપારમાં આગસુઅા લોકોના ધરમાંથી ચોરી કરે છે એવાને આપવાથી શું થાય ?” મુનિની નિંદા કરતાં વિહુને નીચગોત્ર બાંધ્યું.

એકદા કેટલાક ચોરોએ વિહુએ એકાંતમાં એક વાત નિવેદન કરી, “વિહુ ! આ ગિરિના મૂળમાં ખુલ ધન છે પણ અમારી પાસે એવી સામની નથી. તો તું સહાય કર, અમે તને એમાંથી લાગ આપીશું.”

ચોરના વચનથી વિહુએ એમને સર્વ સામની પૂરી ધારી. સર્વ સાહિત્ય સાથે લઈને કુદુંધીજનોને કહી ચોરોની સાથે શત્રીએ પર્વતની તળેરીમાં ગયો. ત્યાં પલાશવંદની

શાખાના મૂળમાં ધન હોવું જોઈએ એવો વિહુને અલિ-  
પ્રાય આપ્યો. કારણ કે ‘ઘૃષ્ણવદ્ધ’ વા ભવેદ દ્વયં, ધ્રુવ’  
બિદ્વપત્રાશચ્યો’

ચારોએ પણ ત્યાં તપાસ કરી તો માલૂમ પડ્યું કે  
નીચે ધન છે પણ એની પરીક્ષા કરવી જોઈએ કે ત્યાંકેવા  
પ્રકારનું ધન છે. એ વૃક્ષના મૂળમાં ધા કરતાં બે રક્ત રસ  
નિકળે તો રત્ના, પીળો નીકળે તો સુવર્ણ અને શૈતવર્ણ-  
વાળો. રસ નિકળે તો રષ્યા-રષ્યુ નિકળે.

શસ્ત્રો વડે પ્રહાર કરતાં રક્તરસ જોઈને બધા ઝુશ્ટી  
થયા કે ‘રત્ના હોવાં જોઈએ.’ પૂજા, અલિ વગેરે કરીને એ  
નિધિને ચારોએ કાઢી સર્વની સમક્ષ હાજર કર્યો. રત્નનો  
દગ જોઈને બધા હષ્ઠીત થયા. ચારોએ હવે વિહુને ગાડ  
દેવાને મોકદ્યો.

વિહુ ગાડ દેવાને ગામમાં ગયો તે સમયનો લાલ  
લઇને ચારો એ રત્નાને અહુણ કરી નાશી ગયા. ગાડ  
લઇને આવેલો વિહુ પોતાના સાથીતોને ન જોવાથી દુઃખનો  
સાર્યો મુર્ચિંધત થઈ ગયો. વનના શીતવાયુથી સાવધ થયેલો  
તે મહા દુઃખને અનુભવતો પ્રાતઃકાળ પહેલાં ઘેર આવ્યો.  
કોઈ હેરાએ તેની આ હકીકત જાણુને રાજ આગળ વાત  
જાહેર કરવાથી રાજએ વિહુને બોલાવી પૂછ્યું. વિહુએ  
ભય પામીને રાજને સત્ય હકીકત કહી સંભળાવી.

ચારને સહાય કરવાથી રાજએ તેનું ધન લુંટી લઈ  
નગર અહુાર કાઢી મૂક્યો જેથી વિહુ બહુ દુઃખી થયો.  
વિહુ મરણ પામીને પોતાના ધરના આંગણામાં કુતરો  
થયો. આપો દિવસ તે ધરના આંગણામાં એસી રહેતો  
છતાં તેને કોઈ આવાતું આપતું નહિ. બૂખ અને રૂપાથી  
અરણ પામીને તે બિલાડા થયો. બિલાડાના ભવમાં અતેક

પાપ કરી લોકો વડે ભૂત્યુ પામી ચંડાલ થયો, અનેક પાપ-કાર્યમાં પ્રીતિવાળો થઈ હિંસાને કરતો તે ત્યાંથી પ્રથમ નારકીએ ગયો, ત્યાં પરમાધારી અને ક્ષેત્રની વેદના સહન કરવા લાગ્યો.

સુવિહુ ન્યાયથી ત્રણે વર્ગને સાધન કરતો મરણુ પામીને ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તમ ચુગલીએ થયો, દ્વા પ્રકારના કદમ્બ-વૃક્ષથી મનોભિલાષને પૂર્ણ કરતો ત્રણ પદ્ધ્યોપમનું આચુ પાળી પહેલા દેવલોકે મહાકાંતિવાળો દેવ થયો, ત્યાં પણ દિવ્ય લોગોને લોગવતો, નાટક અને ગીતમાં કાળ નિર્ગમન કરતાં એક પદ્ધ્યોપમ આચુ વિતાવી આજ વિજયના જ્યાસ્થલ નગરમાં પદ્મદેવ શૈલીનો ગુણાકર નામે પુત્ર થયો, કુમે કરીને તે યૌવનવયમાં આવ્યો.

વિહુનો જીવ નરકમાંથી નિકળીને તે જ નગરમાં ધન-જ્યા શેઠનો ગુણુધર નામે પુત્ર થયો, યૌવનવયમાં આવતાં તેને પૂર્વલભના અસ્યાસથી ગુણાકર સાથે મૈત્રી થઈ, નવીન વનતી અભિલાષાવાળા તેઓ એક દિવસ ઉદ્ઘાનમાં ગયા, ત્યાં તેમણે ધર્મદેવ નામે મુનિને જોયા, મુનિને નમસ્કાર કરી તેમણે ધનપ્રાપ્તિનો ઉપાય પૂછ્યો, તેના જ્વાખમાં મુનિએ કહ્યું, “ધર્મસાધન કરો, જેથી આલોક અને પરલોકમાં આપદાનો ત્યાગ કરી ધન મેળવશો, પાપ કરનારને સંપત્તિએ ક્યાંય પણ મલતી નથી, માટે સતોષને ધારણ કરી લોલનો ત્યાગ કરો, મોટો રાજ-વિરાજ પણ લોલને વશ થઈને હુંથી થાય છે, લોલી કરોડપતિ હોય છતાં તે દરિદ્રી જ છે કારણ કે છતે દ્વંદ્યે તે ખાતો, પણ નથી દાન પણ આપતો નથી, સંતોષદૃપ અમૃતનું ધાન કરતારો ગમે તેવો હોય તોપણ ડેશિપતિથી તે અધિક છે, સો યોજન ફૂર રહેલી વર્સુને મેળવવા લોલી-

ઉધમ કરે છે ત્યારે સંતોષી નજીક રહેલી વસ્તુમાં પણ આહરવાળો થતો નથી. માટે હે સુલગ ! સર્વથા પરિઅહનો ત્યાગ કરવાને શક્તિવાન ન હો. તો પણ તમારે ઈચ્છા-એનું પરિમાણ તો અવસ્થ કરવું. જે ઈચ્છાએને રોકતો નથી તે ધન મેળવવા માટે અનેક પ્રકારના કલેશને પામે છે. જેમ જેમ લાલ વધે જાય છે તેમ તેમ લાલ વૃદ્ધિ પામે છે, માટે સમજુજ્ઞનોએ ઉપાધિથી જાય પામીને પરિઅહનું પ્રમાણ કરવું. સુનિનો ઉપરેશ સાંભળી પ્રસ્તર થયેલા ગુણાકરે પોતાની મરળુભૂજખ પરિઅહનું પ્રમાણ કર્યું. શ્રદ્ધા રહિત એવા ગુણધરે એ બધું મિથ્યા માનીને કંઈ પણ પ્રત લીધું નહિ.

ગુણધરના વિચારો પણ એવાજ હતા. “જે પુરુષો આગળ વધતી એવી પોતાની ઈચ્છાને રોકે છે, અને સંતોષને ધારણ કરે છે. તેને હૈવ કંઈ પણ અવિક આપતો નથી. તેણે પોતાનું ભાય વેચી આધેલું છે. આ ભારો ભિત્ર તો મૂર્ખ છે જેને એ સુનિએ છેતરો છે” જુદી જુદી ભાવનાને ધારણ કરતા તેઓ બતે પોત પોતાને ઘેર ગયા.

અન્યદી પોતાના ભિત્રને કઢ્યા વગર ગુણધર પરદેશમાં ધન કમાવા ગયો, ત્યાં તેને વ્યાપારમાં બહુ લાલ થયો. વધારે લાલ મેળવવા ત્યાંથી દૂર દેશાંતરે ગયો. ત્યાં પણ એને ખુલ્લ લાલ થયો, ત્યાંથી તે પોતાના દેશ તરફ ચાહ્યો ને માર્ગમાં ભયંકર અથવી આવી.

કદ્યપાંતકાળના અંગિન સમાન ભયંકર હાવાનલને જોઈ સેવકો નાશી ગયા ધન એને માલનાં ભરેલાં ગાડાં બધી ગયાં, બળદો મરી ગયા ત્યારે થાકીને જીવિતની આશાએ ગુણધર પણ પદાર્થ થઈ ગયો. સાત દિવસે કોઈક સંક્રિયેશમાં આવ્યો તો ત્યાં કોઈ ફ્યાળુએ એને જોજન કરાવી

પોતાના મઠમાં આશરો આપ્યો, તેની હકીકિત જાણીને તેની ઈચ્છા તુસે કરવા માટે પર્વતના મૂળમાં કોઈ ઔપદિક અતાવીને કહું “‘આને ખરાબર ઓળખાભી લે ને મધ્યરાત્રીએ આવી વિધિપૂર્વક એને અહેણ કરજે’”.

તેઓ અને પાણા મઠમાં આવ્યા, નિશા સમયે તે સાંધુએ ગુણુધરને કહું, “‘હે વત્સ ! મારી શક્તિથી તું ત્યાં જઈ જવલત્પ્રેલા ઔપધીને વામ હાથમાં અહેણ કરી ગાઢ સુઠીવાળીને લઈ આવ, પણ પાણ કરીને જોધશ નહિ, ને કંઈ પણ લય મનમાં લાવીશ નહિ, કે જે ઔપધીના પ્રતાપથી તારું દારિદ હૂર થશે-તું સુખી થધશા’, સાંધુનાં વચન સાંલળી નિર્ભય થઈ તે ત્યાં ગયો, કહેલી વિધિને અનુસારે સુઠીમાં ઔપધીને અહેણ કરી પાણ કર્યો તે સમયે અદૃષ્ટાસ્ય કરતો એક રાક્ષસ કુતકારને કરતો પર્વતની તળે-દીએ આવ્યો એ રાક્ષસનો કર્કશ અને લયંકર શાખદ સાંલળી લય પામેલો તે કંઈક-જરા પાણ જોઈ આગળ ચાલ્યો, પણ પેલી ઔપધી એની મુઠીમાંથી અદરશ્ય થઈ ગઈ, હુઃખી થયેલો તે પેલા લિંગી પાસે આવી પોતાનું વૃતાંત કહેવા લાગ્યો.

લિંગીએ એનું કથન સાંલળી કહું: “‘વત્સ ! તું સાહસિક અને ઉધમી તો જરૂર છે પણ તારો પુણ્યોહય ન હોવાથી તારી મહેનત નકામી લય છે. બદકે એનું પરિણામ સારું આવતું નથી, તો એવા નકામા ઉધમથી વિરામ પામી સંતોષ ધારણ કરી વેર જા, નાહક કલેશ ના લોગવ, ’”

લિંગીએ શિખામણ આપવા છતાં તે પોતાના ગામ તરફ ન જતાં મલય સનિવેશમાં ગયો ત્યાં કોઈ પરિવાન જક સાથે એને મેલાપ થયો, ગુણુધરનું વૃતાંત જાણીને

તેણે કહ્યું. “વનમાં રક્ત હુંઘને આપનાર સુહિ (થાર) ને જો જેથી તારં દારિદ્ર નાશ પામશે”.

ગુણવદરે કહ્યું કે “તમે સાથે ચાલો, આપણે ખને તેની તપાસ કરીયે,” નિશ્ચય કરીને અને ચાલ્યા. એ થારને શોધતા તેઓ આગળ જાગલમાં ગયા ત્યાં એ સુહિને જોઈ. સિદ્ધિયોગ આવ્યો. ત્યારે શુલ્ષ હિવસે પરિવાજકે એ સુહિને અભિમંત્રી એક કુંડ ખનાવી એમાં અભિ પ્રજ્વલિત કર્યો.

ઉત્તમ એવા સુગંધમય કાષ્ટમાં એ સુહિને સોઝરીતે ગુણવરના મસ્તક પર સ્થાપન કરી, ગુણવરને અભિકુંડમાં છોમવાને તેનો હાથ અહેણું કરીને ચાલ્યો. ગુણવરને પણ વહેંમ આવ્યો કે રેખેને મને આ કાયાલિક અભિકુંડમાં છોમે.”

કાયાલિકના પંજામાંથી બળવડે છુટવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો. બ્રજે અરસપરસ હેંશા તોંશી કરતા લડતા હતા, તેમ કરતાં તેઓ અભિકુંડ સમીપ આવી પહોંચ્યા. તેમની લડાઈ બેઈ કોઈ ગોવાળીયા ભૂસો મારવા લાગ્યો. તેની બૂમ સંલળી મૃગયા રમવાને નિકળેલો કોઈ રાજ-કુમાર ત્યાં આવી પહોંચ્યો.

ગુણવદરે પોતાની દુઃખ કથા કહી સંલળાવવાથી રાજ-કુમારે ગુસ્સે થઈ પેલા કાયાલિકની નિર્ભિત્તસના કરી. સુહિ તેના મસ્તકપર સ્થાન કરી કાયાલિકને અભિકુંડમાં છોમી દીધ્યો. જે ક્ષણમાં સુવર્ણ પુરુષ થઈ ગયો. પછી ગુણવરને થાડંક ભાટુ આપી વિસર્જન કર્યો. ને રાજકુમાર એ સુવર્ણ પુરુષ લઈ પોતાના સેવકો સાથે પોતાના રાજ્યમાં ગયો.

૬

## ગુણુકર અને ગુણુધર

રાજકુમારની સહાયથી મુત્યુથી બચેલો ગુણુધર.  
પોતાના ગામ તરફ ચાલ્યો, માર્ગમાં તેને કોઈ મંત્રવાદી  
પુરુષ મલ્યો તે બન્નેને ભિન્તા થધ એ મંત્રવાદીને શક્તિ-  
સંપન્ન જાણીને ગુણુધરે પોતાના હુંઘની વાત તેને કહી  
સંભળાવી, ભિન્ત બનેલા તેઓ બન્ને મુસાફરી કરતા  
કોઈક સંનિવેશમાં ગયા, લોજનનો અવસર થવાથી પેલા  
મંત્રવાદીએ કહ્યું, “ભિન્ત ! શું આવાની દૃષ્ટિ છે ?

માંત્રિકની પરીક્ષા કરવાના હેતુથી ગુણુધર પોલ્યો,  
“સિંહકેશરીયા મોદક, પણ તે આ જગ્યાએ મલે શ્રી  
રીતે ? ”

“ મલે ! ” એમ કહીને એ સિદ્ધ પુરુષે ક્ષણુવાર  
ધ્યાન કરી મંત્ર શક્તિથી સિંહકેશરીયા મોદક ઉત્પન્ન  
કર્યા, તેની આવી શક્તિથી વિસ્મય પામેલા ગુણુધરે તથા  
ધીજા મુસાફરોએ એ મોદક આરોગ્યા, સંદ્યા સમયે ધીથી  
પરીપૂર્ણ વિષ્ણુર, ધીજે દિવસે ક્ષીર એ પ્રમાણે એ સિદ્ધ  
પુરુષ મંત્રશક્તિથી નવીન નવીન મિથાન પ્રગટ કરી.  
ગુણુધરને વૃત્ત કરતો હતો.

તેની આવી શક્તિથી અજાયણ થયેલા ગુણુધરે પૂછ્યું,  
“ હે શક્તિશાળી ! હે ઉત્તમ ! આવી શક્તિએ તને  
કયાંથી પ્રાપ્ત થઈ ? ”

ગુણુધરના જવાખમાં મંત્રસિદ્ધ પુરુષ પોલ્યો, “મહા-  
દ્વારિદ્રથી હુંઘી થયેલો હું બહુ દેશ જર્ઝ્યો. ત્યારે કોઈક  
મંત્ર શક્તિનો જાણનાર કાપાલિક મલ્યો તેની ખુખ સેવા  
કરી મેં તેને પ્રસન્ન કર્યો, મારી ઉપર પ્રસન્ન થઇને તેણે

મને આ વૈતાળમંત્ર આપ્યો, જે મેં આહરથી સિદ્ધ કરેલો હોવાથી એના પ્રભાવથી આપણે ખંડું મેળવીએ છીએ. એના પ્રભાવથી હું હવે ઘેરજમને સુખી થઈશ. ” અન્યોઅન્ય વાર્તાલાપ કરતા તેઓ આગળ ચાલ્યા, આગળ જતાં ખેના માર્ગ લિન્ન લિન્ન આવવાથી એ માંત્રિક બોલ્યો “ આ કુંકો રસ્તો તમારા નગરે તરફનો હોવાથી હવે આપણે જુદ્ધ પડશું તો કહો તમને શું આપુ ? ”

કૃદિધનથી પણ સંતોષ નહિ પામનારો ગુણધર બોલ્યો. “ મારી ઉપર પ્રસન્ન થઈને મને એ વૈતાળમંત્ર આપો ! ”

“ ધાર્મિક અને પરોપકારી પુરુષજ એને સિદ્ધ કરી શકે છે અન્યથા તો એમાં પ્રાણસંહેષ જ રહેલો છે. ” માંત્રિકે સારી રીતે સમજાવવા છતાં ગુણધર એ મંત્રની માગણી કરવાથી એ સિદ્ધપુરૂષ વિવિધ સહિત વૈતાળિક મંત્ર આપીને પોતાના વતન તરફ ચાલ્યો ગયો. ગુણધર પણ તાંથી આગળ ચાલતાં તે સુસીમા નગરીએ પોતાના મામાને ઘેર ગયો કેટલોક કાળ ત્યાં સુખમાં વ્યતીત કર્યા પણ તે મંત્ર સાધવાનો તેણે વિચાર કર્યો.

પોતાના મામાને સઘળી હકીકિત નિવેદન કરી કૃપણ ચતુર્દશીની રાત્રીએ રમસાનમાં જઈને ન્રિકોણ કુંડ કરી તે વિવિધ પ્રકારનાં હોમ દ્રવ્યથી હવન કરવા લાગ્યો. કૃદ્ર ઉપદ્રવોથી તે જ્યારે ચલાયમાન થયો નહિ. ત્યારે તેની નીચેનું પૃથ્વીચક ભમવા લાગ્યું. લયંકર ગર્જનાઓ થવા લાગી. તેથી તે જરા લય વ્યાકુળ થવાથી મંત્રનું એકપદ ભૂલી ગયો ને વૈતાળ છળ પામીને બોલ્યો.

“ અરે પાપી ! આવા તુચ્છ પરાક્રમથી તું મને વશ કરવા માગે છે ? ” “ એ પ્રકારે એની નિર્ભત્સના કરતો તે લાક્ષીથી પ્રહાર કરતો હોકોયો. વૈતાળના ભયથી વ્યાકુળ થયેલો તે ત્યાંજ મૂર્ચિંદ્ર થઈ ગયો.

પ્રભાતે એનો મામો એને પોતાના ઘર તેડી લાવ્યો કેચલાક હિવસે તે જ્યારે સાંજે થયો ત્યારે ગુણુધરનો મામો એને જ્યસ્થળ નગરે તેડી ગયો. ત્યાં એના સ્વજનોએ એને આધ્યાત્મન આપ્યું, પરંતુ દુર્જન પુરુષોથી નિંદાતો તે લોકોની હાંસી પાત્ર થવાથી અતિ લજાતુર પણે પોતાની નિંદાને નહિ સહન કરતો ગણે ઇંસોખાઈ દુર્યોન પૂર્વક તે આ સંસારની કલેશમય મુસાફરી પૂર્ણ કરી ગયો.

છતાંય પાપીને ભરવાથી કોઈ દુઃખનો છેડા આવતો નથી. દુર્યોનથી ભરણું પામીને ગુણુધર પોતાના કૃત્યને અનુસારે નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓને-પીડાઓને સહન કરતો દુઃખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. ત્યાંથી નિકળીને તર્યંચ યોનીમાં આવી ઇરી પાછો નરકમાં જશે. એવી રીતે નારકી, તર્યંચ, મતુષ્ય એમ દેવતામાં એકાંત દુઃખનેજ લોગવશે. દેવતામાં તે કવચિત મુખ લોગવશે છતાં પણ આ પારાવાર સંસારમાં ગુણુધર દુઃખ માત્રનો જ લોક્તા થશે.

સમુદ્રની માર્ક મર્યાદાવાળો, ધનાદ્ય, લોકોની આશાને પૂરનારો ગુણુકર સંસારમાં ખૂબ પ્રતિક્રિયા પામ્યો. ગુણુધરનું આ પ્રમાણે અકાળ મુત્યુ જાણી વિશેષ વૈરાગ્યને ધારણ કરનારો ગુણુકર પાંચમા અણુપ્રતને સારી રીતે પાળી સ્વર્ગ ગયો કેમે કરીને મોક્ષે જશે. “મુનિએ એ દ્યાંત પૂર્ણ કર્યું. એ પરિશ્રણ પરિમાણના ગુણ અને

દ્વારા જાણીને મારી સ્ત્રીઓએ દુઃખાઓનું પરિમાણ કરી પાંચમું અણુપ્રત અહેણ કર્યું.

મારી સ્ત્રીઓને પાંચે અણુપ્રત આપી ધર્મશીલા અનાવનાર આ મહા મુનિ ઉપર મેં કેવી હુષ વિચારણા કરી ? અરે પેલા વિહુની માર્ક મારી શી દશા થણે ? ” એમ ચિંતવતો હું પ્રગટ થઈને મુનિના વરણમાં પડ્યો. મારો સર્વ અપરાધ કહીને હું તેમને અમાવવા લાગ્યો. “ હે લગ્યવાન ! હાસ્યથી પણ મુનિ માટે હુષ વિચાર કરેનાર પેલા વિહુની માર્ક આ લવ સાગરમાં ડલ્યી જાઉ. અનંત દુઃખનો લોક્ષા થાડ તે પહેલાં મને એ પાપથી સુક્ત થવાનો ઉપાય બતાવો. ” મારો પશ્વાત્તાપ જાણી મુનિ બોલ્યા.

“ ત્રણ જગતને માન્ય, અન્ધાચારી અને કષાય રહિત એવા સાંદું માટે આવો વિચાર કરવો એ મહા પાપ છે. ચારિત્ર અહેણ કર્યા વગર આ પાપથી તું સુક્ત થધ શકીશ નહિ. માટે હે લાગ્યવાન ! આ સાંસારની અનિત્યતાનું સુમરણ કર. કામ લોગનાં સુખ દુર્ગતિને આપનારાં છે. એ શું તું નથી જાણુતો ? સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, દેહ આહ્વા સર્વ સંયોગો અનિત્ય છે. ને મૃત્યુનો વાટજ જોયા કરે છે. તે કયારે પકડશો તેની કોઈ ને ખખર નથી. ઝાનીજ એ એ બધું જાણી શકે છે. તુંચ એવાં સાંસારિક સુખોનો ત્યાગ કરી. એકાંત સુક્ષ્મિસુખને આપનારા સંયમને અહેણ કર, પરનિંદાનો ત્યાગ કર, શમતાદ્યપ અમૃત વડે તારા આત્માને રૂપે કર, સંતોષને ધારણ કર, ઝોધને ફૂર કર, લોકને છાડ, પોતાની આત્મશલાઘા સંલણીને એમાં રાણ થા નહિ ને માયાને છાડી હે. મદ, આળસ વર્જરે દ્વારાનો ત્યાગ કરી સંયમને અંગીકાર કરવાથી તું આ પાપકર્મ

ઇપી પાંજરામાંથી હુમેશને માટે સુકા થમશા.”

મુનિની એ અખંડ વાગધારા-હેશના સંભળી હે  
કુમાર ! મારી મોહ નિદ્રા નાશ પામી ગઈ. તેમજ મારી  
વિવેક ચક્ષુ પણ ઉઘડી ગઈ મારી વિચાર ક્રેણુને ક્ષણ  
વારમાં પલટાઈ જતાં વાર લાગી નહિ.

“અરે, આ તપવડે કરીને કૃશ થયેલા શરીરવાળા  
મહામુનિએ આજે મારે આંગણે પવારી મને શું નથી  
આખું ? મારી પત્નીએ સહિત મારો તો આજે તેમણે  
ઉદ્ધાર કરો, જેથી આજે મારે તો મનુષ્યદ્વિપ કદ્યપદ્યક્ષ મહા  
ક્રસને આપનારે થયું. સંસારદી સમુદ્રમાં ડુધી જતા  
મને આજે વહાણ પ્રાપ્ત થયું જેનાથી હું અવસાગરનો  
પાર પામીશ. સાતરાજ ઉચ્ચે રહેલા શિવપુરનગરમાં જવા-  
ને આજે મને જણે આકાશગામી વિધા પ્રાપ્ત થઈ કે શું ?  
સંયમનું દાન કરેનારા આ મહામુનિઓજ ખરા ઉપકારી છે.

એ પ્રમાણે વિચાર કરી મારી પત્નીઓની સાથે સહ-  
મત થઈ મારી લક્ષ્મી મેં સાતે ક્ષેત્રમાં વાપરી નાખીને  
ચારિત્ર લેવાની ભાવનાવાળા મેં એ મહામુનિના ગુરુ  
મહારાજ શ્રીમિષણેનસૂરીથરની પાસે સર્વે ઉપાધિનો  
ત્યાગ કરી દીક્ષાને અંગીકાર કરી, જ્ઞાન ધ્યાનનો અભ્યાસ  
કરી તેમના પસાયથી શુલ સંયમરીપી લક્ષ્મીને પાળવા-  
વાળો થયો. કેમકે પાપાણના ઢકડાને ટાંકણાવડે કોરીને  
સારી રીતે જ્યારે તેને ઘડવામાં આવે છે ત્યારે તે હેવ-  
પણાને પામી જગત વંદનીય થાય છે તેમ ગુરુદીપી સુત્ર-  
ધારવડે શિક્ષિત થયેલો હું આજે હેવની માર્ક સંયમના  
પ્રભાવથી વંદનીય થયો. ગુરુએ પોતાનુ ચારિત્ર કહી  
સંભળાવ્યું.

૧૦

## પૂર્ણચંદ્ર નરપતિ.

સુરસુંદરસૂરીથરના વૈરાયનું કારણું સાંભળી રાખ્ય  
સહિત બધી સલા દંગ થધ ગાધ, તેમના ચરિત્રથી વૈરા-  
યના રંગવાલો નરપતિ સિહેસેન ગુરુની સ્તુતિ કરતાં  
ઓદ્યો. “હે ભગવન ! આપનેજ એક જગતમાં ધન્ય છે  
કે જેમનું ચારિત્ર આશ્ર્યકારી ને સાંભળનારને લાલ કર-  
નાડે છે. જેથી અરેખર આપજ એક પુણ્યવાન છો, ત્યાગી-  
આમાં પણ આપ એક છો. કે જેમણે જગતને આશ્ર્ય  
કરનારી રમા, અને રમણીએના સમુહને ક્ષણમાત્રમાં  
પુણ્યની જેમ તળ દીધો, આપે મોક્ષનો માર્ગ બ્રહ્મણ  
કરી દીધો.

હે સ્વામી ! મારા સરખા સત્ત્વ વગરના પુરુષો તો  
વિષય અને કષાયમાં મુંઝાઈ ગયા છતાં હજી પણ સંસાર  
છાડવાને સમર્થ નથી થતા, તો પણ શબ્દ, રૂપ, રસ,  
ગંધ અને સ્પર્શાદિક લોગો મેં ઘણા કાલ પર્યાત લોગવ્યા  
હોવાથી હવે હે પ્રભો ! તમારી પાસે નિરવધ એવી તત્ત્વ  
વિદ્યા જે સંયમ તેને હું બ્રહ્મણ કરીશ.

નરપતિ ગુરુ મહારાજને વિનંતિ કરીને નગરમાં ગયો.  
મંત્રીએ સામતો અને સેનાપતિએને સાક્ષી રાખીને  
પૂર્ણચંદ્ર કુમારનો રાજ્યાભિષેક કરી દીધો તે નિમિત્તે મોટા  
મહોત્સવ કર્યો. એ રીતે રાજ્ય ચિંતા પુત્રને લણાવી પાતે  
રાજકાર્યથી નિવૃત્ત થયો. પછી જીનેથરની મોટી પૂજાએ  
રચાવી તે નિમિત્તે મોટા અષાહિકા મહોત્સવ કર્યો, ને  
શાસનનો મોટા પ્રભાવ વધારી રાજએ દીક્ષા માટે તૈયારી કર્યો.  
તવા નરપતિએ મોટી ધામદુમપૂર્વક નરપતિનો દીક્ષા

મહોત્સવ કર્યો, ને સિંહસેન નરપતિએ ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરુની પાસેથી ઉચ્ચરેલાં મહાપ્રતને હૃદીરીતે પાલન લાગ્યા. એ પ્રકારની અહુણ અને આસેધન શિક્ષાને ગુરુ પાસેથી ધારણ કરતા, કપાયોને વશ કરીને શાંત પ્રકૃતિવાળા તેમજ ઈદિયોનું દમન કરીને વિષય વિકારોને વશ કરતારા સિંહસેન મુનિ છુટ, અહુમ આહિ તપસ્યા કરતા ને જ્ઞાન ધ્યાનમાં પ્રીતિવાળા તેમજ સંસાર અને મોક્ષમાં સમાન વૃત્તિવાળા એવા મહામુનિ થયા.

પૂર્ણિયંડ નરપતિ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન કરતા, મેરુની માઝક સ્થિર સ્વભાવવાળા તેમજ સર્વાંગ રાજ્ય લક્ષ્મીથી શોસતા ન્યાયથી પ્રજાનું પાલન કરતા હતા. એ ન્યાયી અને પરાહુમી રાજનો કર્પૂરના સમૂહની માઝક ઉજ્જવળ યશ જગત ઉપર વિસ્તાર પામ્યો, ને શ્રાવકનાં અણુપ્રતને પાળવામાં દદ નિશ્ચયવાળા જ્ઞાન અને દર્શનની ભક્તિ કરતા શાસનનો મહિમા વધારવા લાગ્યા. શાસન પ્રભાવક તેમજ શ્રાવક ધર્મને પાળવામાં દદ પ્રતિજ્ઞા છોવા છુટાનું તે રણવાત્તામાં કાયર નહોતા, હુદ્ધમાં શરૂઆતાના સમુદ્ધાયને જીતી પોતાની કીર્તિ દિગાંત પર્યાત તેમણે ફેલાવી હતી.

અણુપ્રતની માઝક ગુણપ્રત અને શિક્ષાપ્રતને પાલવામાં પ્રીતિવાળા હીન, અનાથ અને રંકજનોનો ઉદ્ધાર કરતા તેમણે સીદાતા શ્રાવકોના મનોરથ પૂર્ણ કરી સાધન સંખ્ય બનાવી ધર્મમાં સ્થિર કર્યા. એ રીતે શ્રાવકોના ઉદ્ધાર માટે રાજને છુટે હાથે દાન આપવા માંડયું, જીન અંદિરામાં પૂજાએ રચાવી, જીનાલયો અંધાવી પ્રતિમાએ સ્થાપન કરાવી, સાતે ક્ષેત્રમાં રાજ્યલક્ષ્મીનો સહિયયે કરતો રાજ પૂર્ણિયંડ શાસન પ્રભાવક થયો.

પરાહુમવડ મોદ્ય શત્રુઓને પણ વશ કરતો રાજ રાજ્ય અને રમણીના સુખવિનોદોમાં જતા એવા કાલને પણ જાણુતો નહીં. બહુ કાળ પર્યાત રાજ રાજ્યસુખને લોગવતો અનુક્રમે પૌઠ વયમાં આવ્યો.

પૂર્ણચંદ્ર રાજને વીરોત્તરનામે પુત્ર થયો તે પણ વૃદ્ધિ પામતો નવીન યૌવન વયમાં આવ્યો ને યુવરાજ પદવી પામ્યો. ચાંચ વયના-કંપચંદ્રારી રાજકુમારને જોઈ રાજએ ધીરધીરે તેને રાજ્યની જવાબદારીએ સાંપવા માંડી.

પદરાણી પુષ્પસુંદરી પણ સમ્યક્તવપૂર્વક પાંચ અણુ-પ્રત તેમજ ગુણુપ્રત અને શિક્ષાપ્રતને શુદ્ધભાવે પાળતી પરમ આવિકા થાય. એ રીતે આવક્ષર્મને આરાધતાં તે પતિપની સુખમાં સમય વ્યતીત કરતાં હતાં.

એ દરમિયાન પૂર્ણચંદ્ર નરપતિને પોતાના પિતા સિંહસેન મહામુનિના મોક્ષ ગયાના સમાચાર મદ્યા ને સંસારના રંગમાં રંગાયેલા નરપતિની વિચારશૈલી પદ્ધાઈ ગાય, સંસાર ઉપર નિર્વેદ પ્રગટ થતાં એમના મનમાં વૈરાઘ્યની લહેરે ઉડવા લાગી. ઉત્તમ પુરુષોની ભાવના પણ ગમે તેવા સંજોગોમાં ઉત્તમજ હોય છે જેનેની અવિત્તવ્યતા સારી હોય છે એને ગમે તેવા સંજોગોમાં પણ ધર્મ કરવાની ભાવના થાય છે તેમને ધર્મ કરવાની તક મલે છે.

“એ મહામુનિ મારા પિતાને ધન્ય છે કે જેમણે કોમલ અંગવાળા છતાં મોહના વિલાસોનો ત્યાગ કરી સંયમના કષ્ટને સહન કરતાં દુઃકર કાર્ય સાધી લીધું, આ ભવસાગર તરી પાર ઉત્તરી ગયા. ત્યારે હું અલપસત્તવાળો શ્રી પાપમાં આસક્ત થઈ ગયો. અરે ! જરાઅવસ્થા આવી તોપણ વિષય લોલુપ થાયને દેહાદિકની અનિત્યતાને જાણવા

શાંતિ કેન ધર્મને આરાધવામાં પ્રમાદ કરું છું. હા ! એ  
મારા પ્રમાદને વિકાર થાયો.”

એ ચિંતાહુર નરપતિના મનને શાંત કરતી પુણ્યસુંદરી  
ઓલી. હે સ્વામી ! ઐદ શા માટે કરો છો ? ઉદ્ઘમ કર-  
નારનાં કાર્ય સિદ્ધ થાય છે હજુ બાળ હાથથી કંઈ ગઈ  
નથો. નિઃસત્ત્વ નારીઓજ શેડ તો કરે છે. હે નાથ !  
સત્ત્વવંત તો કાર્યમાં ઉદ્ઘમવાળા થાય છે માટે પુત્રને રાજ્યે  
સ્થાપન કરી રાજ્યચિંતાથી મુક્ત થાવ. અભિચર્ય પ્રતને  
યાવત જીવ સુધી પાણો, શ્રીસુરસુંદર ગુરુ આવે ત્યાંસુધી  
સંઘળો. કાળ ધર્મઆરાધનમાં નિર્ગમન કરો, ને ગુરુમહા-  
રાજ પધારે ત્યારે તમારા મનોરથ સિદ્ધ કરનો.” પદ્ધરાણી  
પુણ્યસુંદરીની વાત સાંલળી રાજ ઝુશી થયો.

“હે દેવી ! તમે સારું કહું. “એમ કહી રાજએ  
રાણીનું વચન માન્ય કરી. વીરોત્તર રાજકુમારને રાજ્યા-  
સને સ્થાપી દીધો. રાજ્યની તમામ ચિંતાથી પરવારી  
રાજએ ઉપાધિથી સર્વથા મુક્ત થઈ ધર્મમાં પોતાનો કાલ  
વ્યતીત કરવા લાગ્યો.

દેરોજ તે સંપૂર્ણ શાંતિથી એક ચિંતે જીનેથેરની  
પૂજા કરવા લાગ્યો. સામાયિક કરતો. પૌષ્ઠ્રવતમાં પ્રીતિ-  
વાળો. થધ અખંડપણે પૌષ્ઠ્રવતને આચરવા લાગ્યો.  
શાસ્ત્ર અધ્યયન, પરમેષ્ઠી જાપ, તત્વચિંતવનમાં એ શુલ-  
સમય વ્યતીત કરતો. પણ પ્રમાદનું સેવન કરતો નહિ. અનિ-  
ત્યત્વલાવના ભાવતો રાજ પોતાના દેહના ભમત્વનો  
પણ ત્યાગ કરવા લાગ્યો. દાન, શિયલ, તપ અને લાવ  
એ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરતો. રાજ ધર્મધ્યાનમાં  
જ સમય પસાર કરવા લાગ્યો. રાણી પણ રાજની માફક  
તપથી કૃશ થયેલી ધર્મકિયામાં પ્રીતિને ધારણ કરતી  
ગુરુમહારાજના આગમનની રાહ જોવા લાગી.

ભાવી ખળવાન છે. કોઈની આશા જગતમાં કંઈ  
અધીય પૂરી થતી નથી. ગુરુમહારાજના આવાગમનની  
રાહ જેતા નરપતિ પૂર્ણચંદ્રને અન્યદી અતિસારની ઉત્ત્ર  
વેદના થઈ. શરીર ઉપરથી પણ મમતા રહિત એવો રાજ  
શરીરની ઉત્ત્ર પીડાથી હુંખને અતુલવતો પોતાનો અંત-  
કાળ નજિક જાણી ધર્મભાવના ભાવવા લાગ્યો.

“જે દેશ, જે નગર અને જે ભૂમિને એ સૂરીથર  
સ્પર્શી રહ્યા છે તે દેશ, નગર અને ભૂમિને ધન્ય છે. અદે  
એ સુનિઘ્નાને પણ ધન્ય છે કે જેઓ મારા ગુરુ એ ધર્મ-  
ચાર્યના પાદદ્રથની સેવા કરી રહ્યા છે, જે દિવસે હું  
શુદ્ધના ચરણ કમલને વાંદીશ તે ધન્ય દિવસ મારે કચારે  
આવશે? સાધુઘ્નાની ઉત્તમ દિનચર્યા હું કચારે આચરીશા?  
શુદ્ધના સુખમાંથી નિકળેલી અમૃતરસથી ભરેલી આગમ-  
વાણી હું કચારે સાંભળીશા?

સંસારદ્દી અરણ્યમાં ભમવાથી ભયલીત થયેલ,  
કષાયના શાંત થવાથી સમતાદ્વારા રસથી ભરેલ, તેમજ  
તૃણ અને ભણુમાં સમાન વૃત્તિવાળું એવું સુસાધુપણું હું  
કચારે કરીશ? આ લોકના સંતાપને હરનારી, પાપદ્રોપી  
કાદ્વનોના નાશ કરનારી, સુધારસના સસુદ્ર સમાન એવી  
સાધુઘ્નાની જ્ઞાન ગોઢી પુરુષોને ઉત્તમ એવા નિર્વિજ્ઞ  
સુખને આપે છે.

ધર્મભાવનામાં એક ચિત્તવાળો રાજ રોગની પીડાને  
સહન કરતો શરીરનો ત્યાગ કરી કાલ કરીને અગીયારમાં  
આરણ દેવલોકમાં ઉત્પત્ત થયો. રાણી પણ કાળ કરીને  
ત્યાંજ ઉત્પત્ત થઈ અને મિત્ર દેવ થયા.

પરિચ્છેદ ૬ ટો.

થરસેન અને સુક્તાવલી

૧

મિથિલા નરેશ

લક્ષ્મી-કીર્તિ-ધૃતિ-બુદ્ધિ,-ઋદ્ધિ-સિદ્ધિ-વિધાયકમું ।  
નત્વા શંખેશરં પાર્શ્વનાથમઙ્રે કર્થાં બ્રુવે ॥

ભાવાર્થ—લક્ષ્મી, કીર્તિ, ધીરજ, બુદ્ધિ, ઋદ્ધિ તથા સકલ મનોરથની સિદ્ધિને કરેનારા સંખેશર પાર્શ્વનાથને નમસ્કાર કરી હુવે કથાનો વ્યાગળનો ભાગ કહું છું.

સુર્યની કંતિ સાથે જ્યારે મિથિલા નગરીની તેજસ્વી દિવાલેની કંતિ એક થઈ જાય છે ત્યારે એ નગરી અપૂર્વ શોભાને ધારણ કરે છે. જગતભરમાં પોતાના ૩૫, ગુણે તેમજ વૈભવે કરીને પ્રસિદ્ધિપુણુને પામેલી એ નગરીની જાહેરલાલી વૃદ્ધિ પામે જતી હતી, એના વિશાળ અને મનોહર રાજમાર્ગો, અનેક ગગનચુંભિત વિશાળ ધમારતો, જગતભરમાં જ્યાતિ પામેલાં ઉદ્ઘોગમંદિરો, વિશાળ, સુંદર, રમણીય અને નવપદ્ધતિ ઇલ-કુલથી વિકસ્યર થયેલી લતાઓથી શોભતા ઉધાનો, અગિયાઓ અને સહ્કાર, પુનાગ, રાયણ, અશોક, આસોપાલવ આહિ ધૃક્ષો નગરીની શોભા વધારી રહ્યા હતો.

એ મિથિલા નગરીનો શાસક નરસિંહ નામે નરપતિ પોતાના તેજ અને પ્રરાક્ષમથી મહીમંડળના શત્રુ રાજોને પણ લુતી નરસિંહ નામને સાર્થક કરી રહ્યો હતો. શીલ ગુણેકરીને શોભતી અને દોષથી રહિત, કલાનિપુણ અને મનોહર ગુણમાલા નામે રાજની પદ્ધરાણી હતી,

અનેક રાણીઓમાં મુગુધમણી તુલ્ય એ પદ્ધતેવી સાથે પાંચે  
પ્રકારનાં વિષયસુખ લોગવતા રાજાએ ક્ષાણની જેમ ઘણો-  
કાલ પસાર કર્યો.

એકદા એકાંતમાં બેઠેલા નરપતિની આગળ કોઈ  
ચરપુરષે રાજની બિદ્ધાવલી બોલતાં વિનંતિ કરી “હે  
દ્વ ! આપ જ્ય પામો ! વિજ્ય પામો ! નિશા સમયે  
નગરીનું નિરીક્ષણ કરતાં મેં જે હકીકત સાંલળી છે તે  
આપ શ્વાસ કરો. નરસિંહ રાજ રાજેશ્વર જ્ય પામો”.

એક સ્ત્રી બોલી.

તેના જવાખમાં બીજી સ્ત્રી કદાણું મેં કરતી બોલી.  
આ રાજ તો નામથી નરસિંહ છે કાર્યથી નહિ, કાર્યથી તો  
અને નર જંથુક કહીયે તોય ચાલે. પુત્રરૂપી ધનથી રહિત  
હોવા છ્ટાં તે છતી શક્તિએ પણ ઉધ્ભ કરતો નથી, એનું  
નામ નરસિંહ છે શું ? ”

આ જગતમાં ગમે તેથી અને ગમે તેવી કિયા કરો  
પણ ઉદેશ રહિત અગરતો મંત્ર વગરની કિયા નકામી છે.  
કેમકે નેત્ર વગરના અથાગ અને અપાર સૌંદર્યનો પણ  
ઉપયોગ શો ? તેમજ શીલ વગરનું પણ જેમ તપ નકાણું  
છે એવી રીતે પુત્ર વિનાનું વિશાળ કુળ પણ શા કામનું ?  
એ તો પુત્રથી જ એ બધી શોભા છે”.

ચરપુરણની વાત સાંલળી રાજાએ મંત્રીઓને બોલાવી  
પુત્રની પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો, તેના જવાખમાં મંત્રી  
બોલ્યો. “હે સ્વામિન ! આપણા નગરમાં વિચિત્ર વેષને  
ધારણ કરનારો એક યોગી આવ્યો છે. તે અનેક મંત્ર તંત્ર  
અને સામર્થ્યવાળો હોવાથી આપ એની પાસે પુત્રની  
માગણી કરો. દોકો એની શક્તિનાં બહુ વખાણું કરે છે.  
તે જનોનાં અભિલાષિતને પૂરે છે”.

મંત્રીની વાત સાંલળી નરસિંહ રાજએ રાજસેવકોને મોકદી એ યોગીને પોતાની પાસે બોલાવી પૂછ્યું:  
“યોગીરાજ ! તમારામાં કેટલી શક્તિ છે”?

રાજની વાત સાંલળી યોગી મેં મલકાવતો બોલ્યો.  
“રાજન ! પૂછવાથી શું ? આપ કંઈક કાર્ય ફરમાવો.  
આપ કહો તો પાતાલમાં રહેલી નાગ કન્યાને આપની સેવામાં હાજર કરો. કહો તો શત્રુઓના સમુદ્ધાયને આપના ચરણમાં નમાવું. હુંએ કરીને મેળવી શકાય એવી ગજ, અંધ્ય, રથાહિક સમૃદ્ધિ આપને મેલવી આપું”.

“હું એટલી બધાં તમારી અદ્ભુત શક્તિ છે તો નાગેંક કન્યાને અહીં હાજર કરો”. રાજએ આશ્ર્ય પામતાં કહ્યું.

યોગીએ ક્ષણમાત્ર ધ્યાન કરીને હૃદયમાં કંઈક મંત્રનું ચિંતવન કરતાં એના આકર્ષણીય રત્નાભરણીય વિલૂષ્ટિ નાગેંક પલીની યોગીની આગળ હાજર થઈ. “શું આજ્ઞા છે ?” તે બોલ્યો.

રાજ તરફ અંગુલી નિર્દ્દીશ કરતો યોગી બોલ્યો.  
આ રાજની આજ્ઞાનો અમલ કરો, મારી નહિ”.

નાગાંગના યોગીની પાસેથી રાજની આગળ હાથ જોડીને ઉલ્લી રહી ને બોલી. “હું સ્વામી ! હુકમ કરો  
તમારી કદ આજ્ઞાનો હું અમલ કરો ? ફરમાવો !”

એ નાગેંક પલીને જોઈ એની વાણીથી આશ્ર્ય પામતો નરપતિ બોલ્યો. “લદે ! તું કોણ છે ? કેમ આવી છે ?”

“હું નાગરાજની પલી છું. યોગીરાજની શક્તિથી નાગલોકમાંથી અહીં આવું છું”. તે સ્વી બોલી.

યોગીની અપૂર્વ શક્તિ પર વિશ્વાસ કરતા રાજએ

નમસ્કાર કરી તે સ્થીને રજ આપી, નાગપત્નીના અદશ્ય થવા પછી રાજાએ યોગીને એકાંત સ્થળે લાવી કર્યું.  
“તમારી આવી અપૂર્વ શક્તિ આશ્ર્ય પમાડ તેવી છે,  
તમે જ્યારે આવી અદ્ભૂત શક્તિ ધરાવો છો તો મને એક  
પુત્ર આપો, મારાં દુઃખ હૂર કરો”.

“હે રાજુ ! મોટા માહાત્મ્યવાળા મારે એ કાર્ય શું  
હિસાધમાં છે ? સમુદ્રનો પાર કરનારેને ખાયોચીયાનો  
હિસાધ ન હોય. કૃષ્ણ અતુર્દ્શીના દિવસે રાત્રિને સમયે  
ખડુગ હાથમાં ધારણું કરી તમારે એકલાએ પિતૃવનમાં  
આવવું. ત્યાં જવાલિની દેવી તમને પુત્ર આપશે. બીજ  
પણ તમારી અભિલાષા પૂરી કરશે. તેમજ તમારી સહા-  
યથી મારી ઉપર પણ એ દેવી પ્રસન્ન થશે”.

યોગીની વાત અંગીકાર કરી રાજાએ યોગીને વિદ્યા  
કર્યો. એ વાત મંત્રીઓએ જાહીને રાજાને કર્યું. “મહા-  
રાજ ! આપ એકાકી ત્યાં જાઓ એતો ઠીક નહિ એવા  
માયાવી યોગીનો વિદ્યાસ ન કરવો, જગતમાં જ્યો તો  
કર્મધીન ને લિન્ન લિન્ન સ્વભાવવાળા હોય છે તેમાંથી  
યોગીઓનો તો વિશેષ કરીને વિદ્યાસ કરવો નહિ”.

તેમ છતાં રાજાએ યોગીની વાત અંગીકાર કરી  
હોવાથી કૃષ્ણ અતુર્દ્શીની રાત્રીએ સંદ્યા સમયે પિતૃ  
વનમાં ( સ્મશાનમાં ) આવ્યો. યોગી પણ સર્વ સામગ્રી  
સાથે ત્યાં આવી હીપક પ્રગરાવી મંડલ આલેખી મંત્ર  
જપવા એઠો. તેણે દેવતાઓને અલિ બાકુળ આપી રાજાને  
કહ્યું. “હે સાહસિક ! દક્ષિણ દિશાએ જતાં મોઢં વડલાં  
વૃક્ષ આવે છે. એની શાખાએ એક શાખ ખાંધેલું છે તે  
લાવીને અહીં હાજર કર.”

યોગીની વાણી સાંભળી રાજા એ દિશા તરફ વડલા

નણુક આવ્યો. વડલાની શાખા ઉપર ચઢી તેની સાથે બાંધેલા મૃતકના બંધ કાપી એ મૃતકને લઈ રાજ વહની નીચે ઉત્થે. તે દરમિયાન મૃતક દૂરીને એ શાખાએ જાછ વળાયું. રાજ કરીને વૃક્ષ ઉપર ચઢ્યો મૃતકના બંધ કાપી મૃતકની સાથે નીચે ઉત્થે.

રાજના સાહસની પરીક્ષા કરતો એ મૃતકની અંદર રહેલો બ્યંતર બોલ્યો. “હે રાજન ! જો મારો થીછા નહિ છાડે તો હું તને મારી નાખીશ. અંડ અંડ તારા કુકડા કરી ભૂતોને બલિદાન આપીશ.” બ્યંતરના હાકોટવા છતાં રાજએ પોતાનું મૌન છોડ્યું નહિ. બ્યંતરને કંઈ પણ જવાબ ન મલવાથી રાજને લયલીત કરવા માટે હજરો લયંકર રૂપો પ્રગટ કરી લયંકર ત્રાંડા પાડવા લાગ્યો. તોપણ બ્યંતરની એ લયંકરતા રાજના હૃત્યને લેશ પણ સ્પર્શી નહિ શકવાથી રાજના સત્યથી પ્રસન્ન થયેલો બ્યંતર બોલ્યો.

હે વીર ! હે ધીર ! પોતાના કાર્યને પાર પાડનારા-  
આમાં હું મુશુદ્ભણી છે. તારા નિશ્ચયપણાથી હું પ્રસન્ન  
થયો છું. કિનુ એક સત્ય વાત સાંભળ. રાજન ! હું પુત્રની  
આકંક્ષાવાળો છું. છતાં પ્રસન્ન થયેલો આ યોગી તારી  
આશા પૂરશો નહિ. યોગી માયાવી છે, ને હું સરલ સ્વ-  
ભાવી છે. તારા દેહનું બલિદાન કરી યોગી પોતાની વિધા  
સિદ્ધ કરવા ચાહે છે. ધંદજળાથી નાગતારી બતાવવાથી  
હું તો એનો વિશ્વાસુ બની ગયો છે પણ એક દુર્જન શિરો-  
ભણી યોગી તારે ત્યાગ કરવા ચોઅ છે. માટે એ ખલનો  
વિશ્વાસ ન કરતાં હું કહું તે સાંભળ. અળ પુરુષો પોતાના  
અદ્ય કાર્ય માટે મહાન પુરુષોને કષ્માં ઉતારે છે. કોઢીયા  
માદ્ધિકાના અલાવ માટે સૂર્યસ્તને શું નથી ઈચ્છિતો !

મૃગલાને તૃણમાં, મીનને જળમાં, તેમજ સજજન પુરુષાને  
સંતોષમાં પ્રાપ્તિ હોવા છતાં, શિકારી, ધીયર અને દુર્જનો  
એમના નિષ્કારણ વૈરી શું નથી થતા ? આથીકરીને  
સ્વામીનું મન નીચ-ખુશામતખોર તરફ આકર્ષય છે  
કેમકે તેલથી દીપક જેવો તેજસ્વી દેખાય છે તેવો ધીથી  
દેખાતો નથી. નિયજન પરના કાર્યનો નાશ કરવાને શક્તિ-  
વાન છે પણ કાર્યને સાધવા શક્તિવાન નથી. મુખક ક્ષેડાને  
ક્રોડવા-તોડવા સમજે છે, જેડવાને-સાંધવાને નહિ. માટે  
કંઈકના સરખા દુર્જન તે તો દૂરથીજ તજવા.

હે રાજુ ! મારા વચ્ચનથી સાત રાત્રી પછી સૂર્યના  
સ્વભાવી સુચિત તારે પુત્ર થશે. આ યોગી તારા શરી-  
રનો નાશ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે માટે તું તારં  
ખદ્ગ એને આપીશ નહિ. તારા ખદ્ગના પ્રતાયે મારી  
સહાયથી તું એ યોગીને લૃતી લધશ. “ એ વ્યંતરેનાં  
વચ્ચન શ્રવણ કરી રાજ મૃતકની સાથે યોગી પાસે આવ્યો.  
યોગી મૃતકને જોઈ મનમાં ખુશ થયો.

યોગીએ રક્તાચંદ્રનો મૃતકને લેપ કરી કણવીરની  
રક્ત પુષ્પની માળા આરોપણ કરાવી. મૃતકની પૂજા કરી  
મંદિરમાં સ્થાપન કર્યા પછી રાજને કહ્યું “ હે તૃપ ! હવે  
તમારું ખદ્ગ મને આપો. કે જેથી ખદ્ગ આ મૃતકના  
હૃથમાં ધારણ કરાવું.”

વ્યંતરેના વચ્ચને યાદ કરી રાજએ ખદ્ગ આપ્યું  
નહિ. યોગીએ રાજને ઘણેણ સમજાયો છતાં જ્યારે  
રાજએ ખદ્ગ ન આપ્યું ત્યારે કોવાયમાન થઈને યોગી  
રાજને મારવા ધસ્યો ત્યારે રાજ યોગીને ગળાચીમાંથી  
પકડતો યોદ્યો “ પાપી ! તારા જેવા સાધુને મારી મારં  
પુરુષાર્થ કલંકીત કરીશ નહિ. માટે મારી નજરથી દૂર

થઈ તારા આત્માનું રક્ષણ કર ” રાજએ યોગીની નિર્ભર્ત્સના કરી સુઝ કર્યો.

ભયથી વશ થયેલો યોગી રાજને ‘ગ્રહસંહોરણા નામનો મણિ આપીને ત્યાંથી રાજને ખમાવી પોતાના સ્થાનકે ચાલ્યો ગયો. રાજ પણ પ્રાતઃકાળ થતાં તો પોતાના રાજભુવનમાં આવી ગયો.

મંત્રીઓ વગેરે આગળ રાજએ રાત્રી સંઘંધી યોગીનું વૃત્તાંત કહી સંભળાવ્યું. રાજનું વૃત્તાંત સંભળી મંત્રીઓ ખુશી થયા. રાજના આનંદ-હર્ષ નિમિત્તે નગરમાં મેઠો મહોત્સવ કર્યો. નગરીના લોકોના આનંદની પણ વાત શી !

એ માયાવી યોગીનો વિચાર રાજના લોગે પોતાની વિદ્યા સિદ્ધ કરવાનો હોવાથી એણે માયા જળ વિષાવી રાજને ખરાખર છકામાં લીધો હતો પણ જેનું પુણ્ય જોર કરે છે તે ખળવાન છે તેને દેવતાએ પણ સહાય કરે છે આપરે તો ધર્મીનો જય અને પાપીનો ક્ષય એ જગમાન્ય સિદ્ધાંત સાચોજ ફરે છે.

## ૨

### અગીયારમા લવમાં

આરણ દેવલોકમાં એકવીશ સાગરેપમનું આયુષ્ય પુરું કરી પૂર્ણચંદ્ર રાજનો જ્ય સાતમી રાત્રીને અંતે ગુણુમાળા પદરાણીની કુક્ષિમાં ઉત્પત્તન થયો. મહાદેવીએ તે સમયે સ્વમાવસ્થામાં સંપૂર્ણ રીત્યા સુશોલિત અને તેજસ્વી અર્ક્મંડળ જોયું. સ્વમ જોઇને જાગત થયેલાં દેવીએ પ્રાતઃકાળે રાજને પોતાનું સ્વમ નિવેદન કર્યું. રાજએ વ્યાંતરના વચ્ચને અતુસારે કહ્યું “ દેવી ! તમારે નથનને આનંદકારી રાજ્ય લારને વહુન કરનાર યોગ્ય પુત્ર થશો.”

રાજનાં એ અપૂર્વ વચ્ચન સંભળી નવીન મેઘનાં

ઉદ્ઘે મધુરી જેમ પરમ આનંદ પામે તેવી રીતે હૃષિને  
ધારણ કરતી મહાદેવી ગર્ભતું સારી રીતે પાલન કરવા  
લાગી. સાતમે મહિને રાણીને દોહદ ઉત્પન્ન થયો. સમગ્ર  
સૈન્ય સહિત હું રાજ્ય દીલાનો અનુભવ કરતી વનકીડા  
કરવા જઈનું” રાજ્યએ રાણીની એ અલિલાખા પૂર્ણ કરી  
કેમકે સ્નેહના વશ થકી માણસ શું શું નથી કરતો?

પદરાણી ગુણમાળા ગંધહુસિત ઉપર આદિ થઈ,  
મંત્રીઓ એની આજુ આજુએ રહ્યા, સામંત નરપતિઓ  
એની સેવા કરવા લાગ્યા, રમણીઓ એની સ્તુતિ કરવા  
લાગી. અદ્ભૂત દાન વડે દીન, અનાથ અને રંકજનોને  
સંતોષ પમાડતી, ભાઈ ચારણે વડે બિજ્ઞાવળી યોદાવાતી  
નગરીની બહાર રાજની સાથે અરણ્યમાં વનકીડા કરવા  
લાગી.

એ સમયે કરણ સ્વરે ઇદન કરતી કોઈક સ્ત્રીનો શાખ  
સાંલળી રાણી યોદી “હે રવામીન! મને લાગે છે કે  
વિદાધરી ઇદન કરે છે તો તેની પાસે જઈને કંઈક ઉપકાર  
કરીયે. કારણકે શાસ્ત્ર યોવને માટે, ધન દાનને માટે.  
અવિત ધર્મારાધન માટે અને પંડિત પુરુષોનું શરીર પરોપ-  
કાર માટે હોય છે.”

રાણીનાં વચ્ચન સાંલળી અને જણા શાખદને અનુસારે  
તે સ્થળે ગયાં કે જ્યાં પ્રહારની પીડાથી આકૂળ વ્યાકૂળ  
થયેલો વિદાધર મહાવ્યથા અનુભવી રહ્યો હતો. તેની  
આગળ હિંદ્ય સ્વરૂપા વિદાધરી આંખમાંથી અશ્રૂપાડતી  
ઇદન કરી રહી હતી. તેને જોઈને કરણાપૂર્ણ હૃદયવાળા  
રાજ્યએ યોગીએ આપેલા મહિને જળમાં પ્રક્ષાલિત કરી એ  
જલના સિંચન વડે ધાવને ઇજવી દેવાથી પ્રાપ્ત ચેતના-  
વાળો વિદાધર સાવધ થઈ રાજને કહેવા લાગ્યો. “અહો!

અમારો ભાગ્યોછ્ય છે કે તમારા જેવા સજજનોતો અમને સમાગમ થયો।”

“તમારા જેવા સત્પુરુષોને વિશ્વાતા પુણ્યના પરમાણુઓથી બનાવે છે, તોપણું તમારા જેવા ભાગ્યશાળીને આકૃત ક્યાંથી? છતાં સંપત્તિ અને વિપત્તિ મહાન પુરુષોને હોય છે, હીન પુરુષને નહિ, ક્ષય અને બુદ્ધિ ચંદ્રને હોય છે અગણિત એવા તારાઓને નહિ. તો હે મિત્ર! તમને આ કષ્ટ દી રીતે પ્રાપ્ત થયું તે કહો।”

રાજની વાત સાંલળી વિધાધરે પોતાનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું. “હે સજજન! દેવતાઓથી અધિકૃત વૈતાદ્ય પર્વતની ઉત્તર અણિમાં રતનધર્મપુર નગરને વિષે જ્યાંત રાજ રાજ્ય કરતો હતો તેનો જ્યવેગ નામે હું પુત્ર.

એ જ વૈતાદ્યની ઉત્તર અણીના કુંભપુર નગરનો ધરનામે રાજ હતો તેણે મારી મોટી બેનને મારા પિતાપાસે માણી પણ તેનું અદ્ય આયુષ જાણીને મારા પિતાએ કન્યા આપી નહિ. અને સચ્ચાલપુરપતિ અનંતવેગ વિધાધરને આપી. એ વૃત્તાંત જાણી કોપ પામેલો ધરરાજ મારાપિતા સામે ચુદ્ધ કરવાને આવ્યો. મોટું રણચુદ્ધ થયું તેમાં મારા પિતાએ ધરરાજને મારી નાખ્યો.

તેનો પુત્ર કિન્નર અમારા પર વૈરને ધારણ કરતો મને શત્રુનો પુત્ર જાણી છિદ્રને શોધતો તે સમયની રાહ જોવા લાગ્યો. એકદા મારી પ્રિયા સાથે કીડા કરવાને તમારા નગરની સમીપે આ અરણ્યમાં આવ્યો. અહીંથાં મારી પ્રિયા સાથે કીડા કરતો જાણી મને તીવ્ર પ્રહાર કરીને નાશી ગયો, તેના પ્રહારની પીડાથી હું મૂર્ચિંત થઈગયો, મારી આવી દશા જોઈ મારી પ્રિયા દુઃખથી ઝફન કરવા લાગી. તેનો ઝફન ધ્વનિ સાંલળી તમે આવી પહોંચ્યા તે પછીની હુકીકત તો તમે જાણો છો.”

જયવેગ વિદ્યાધરની હકીકત સાંભળી રાજ બોલ્યો  
“પ્રમાણીને અથવા તો કોઈને છેતરીને ધા કરવો એ  
સજજનનું કામ નથી.”

“હો” તમારા જેવાનાં દર્શન થવાથી મારે તો  
આપણા પણ સ’પણ ઇય થઇ.” રાજ એ પ્રકારે ઉપકાર  
માનતા વિદ્યાધરને તેની પ્રિયા સહિત પોતાના સ્થાનકે  
તેડી લાંઘ્યો, ત્યાં તેમનો સારી રીતે સત્કાર કર્યો. પદરાણી  
અને તે વિદ્યાધરીને સહૃદાયાં થયાં. રાજની મહેમાનીનો  
સ્વાદ ચાખી વિદ્યાધર પોતાની પ્રિયા સહિત પોતાના  
સ્થાનકે ચાદ્યો ગયો.

પૂર્ણ સમયે સારા અહેનો ચોગ થયે છતે પદરાણીએ  
પુત્રનો જન્મ આપ્યો. વધામણિ આપનાર ચેટીને રાજએ  
મુગુઠને વળ્ણને સર્વે આભરણ આપી દીધાં. રાજએ મોટા  
જન્મ મહોત્સવ કર્યો. દીન અને રંકજનેને ઝુબ હાન દીધાં.  
સ્વરમને અનુસારે રાજએ સગાં સંબંધીની સાક્ષીએ એ  
પુત્રનું નામ રાખ્યું શૂરસેન.

પોતાના ભિત્રને ત્યાં પુત્રનો જન્મ જાણી જયવેગ  
વિદ્યાધર પોતાની પ્રિયા સાથે ત્યાં આવી પહોંચ્યો. એમને  
જોઈને રાજરાણી પણ ખૂબ ઝુશી થયાં. કુમારના અદ્ભૂત  
ઝપથી પ્રસન્ન થયેલી રવિકાંતા વિદ્યાધરી પોતાના હિંય  
આભરણથી એને શાખુગારવા લાગી છતી રાણીને કહેવા  
લાગી. “સાખી ! કોઈનિભિત્તિયે મને કહ્યું છે કે તારે પ્રથમ  
ગર્ભે કન્યા આવશે, તેથી જો મારે પુત્રીનો જન્મ થશે તો  
એ કન્યાને હું આ કુમાર સાથે પરણાવીશ.”

વિદ્યાધરીનું વચ્ચેન સાંભળી રાણી બોલી. “પ્રિય  
સાખી ! દેહ માત્રથીજ આપણે જુદ્ધ છીએ મનથી નહિ.  
માટે તને જેમ રૂએ તેમ કરજે.

રાણીએ પણ વિદ્યાધરીના દાન અને માનથી સારી રીતે સતકાર કર્યો. માન, અને આન, પાન આહિ રાજના સતકાર અને સંતમાનથી ખુશી થયેલાં વિદ્યાધર અને વિદ્યાધરી પોતાના રાજ્યમાં ચાલ્યાં ગયાં.

વૈતાદ્યના પોતાના રમણીય નગરમાં રાજ્ય કરતા એ વિદ્યાધરને પોતાની વિદ્યાધરી સાથે લોગોને લોગવતાં પુષ્પ સુંદરીના જીવ અગ્રીયારમા સ્વર્ગથી ચ્યાની એ વિદ્યાધરીની કુક્ષીમાં કન્યાદ્યે ઉત્પન્ત થયો. તે સમયે રવિકાંતાએ સ્વર્પનામાં મનોહર કંતિવાળી મોતીની ભાળા જોઈ.

ગર્ભનું પોપણ કરતાં એ વિદ્યાધરીને અનુકમે પૂર્ણ માસે પુત્રીના જન્મ થયો. સુંદર અગોપાંગવાળીને કન્યાને જોઈ માતા પિતા ખુશી થયાં, પુત્રીના જન્મ મહોત્સવ કરી રાજીએ સ્વર્પને અનુસારે એનું નામ રાખ્યું સુક્તાવદી.

સમયને જતાં કંધ વાર લાગતી નથી. કલાનો અલ્યાસ કરતાં શુરસેન સુક્તાવદી બંને અનુકમે યૌવનવયમાં આવ્યા. જીનેથીરની પૂજા અને સાધુજનની ભક્તિ કરતાં, ચંદ્રના જેવા ઉજવણ યશવાળાં, તે તીવ્ર વિષય કષાયથી રહિત લોકોને હર્ષન વડે આનંદ આપનારાં થયાં.

એકદા જ્યેષ્ઠ, વિદ્યાધર પોતાની વિદ્યાધરની સમૃદ્ધિને વિસ્તારતો પોતાના પરિવાર સહિત પુત્રીના લમ્બ માટે ભિથિલા નગરીએ આવી પહોંચ્યો. સેના સહિત મોટા પરિવારવાળા વિદ્યાધરનું રાજીએ સંતમાન કર્યું ને એમના, ઉતારા માટે બ્યવસ્થા કરી. રાજ, મંત્રીઓ, રાજપુરુષો એમની સરલરા કરવા લાભ્યા. કુમાર અને કુમારીના વિદ્યાહ નિભિતે નગરીને સુશોભિત કરી સ્વર્ગપુરી સમાન બનાવી એક શુદ્ધ દિવસે મોટા મહોત્સવપૂર્વક કુમાર કુમારીનાં લગ્ય થધ ગયાં. કરમોચન સમયે વિદ્યાધરે બંહુ રેતન અને

સુવર્ણથી કોઈ દવ્ય હાન, આખ્યું તે પછી મુત્રિને  
સારી રીતે શિખામણું આપી પ્રિયા સહિત વિધાધરરાજ  
પોતાના નગરે તરફ ચાલ્યો ગયો.

માતા પિતાના વતન તરફ જવાથી વિધાધરખાળા  
સુકૃતાવલી શોક કરવા લાગી. માતા પિતાનો વિયોગ એને  
વારંવાર યાદ આવવાથી બાળા ઉદાસ રહેવા લાગી.  
કંઈપણ વિનોદના સાધનોમાં એને આનંદ આવતો નહિ.  
જ્ઞાતાં પૂર્વલભના સ્નેહથી રાજકુમાર નાજરની માર્કે એની  
આગળ હાજર રહી એના મનોવિનોદ માટે અનેક પ્રયત્ન  
કરતો હતો.

દેવહુર્લભ નાટક બતાવી એના મનને રીજવવા તે  
પ્રયત્ન કરતો હતો. ગીત, નૃત્ય વગેરે અનેક મનોહર દરશયો  
એના આનંદ માટે પ્રતિક્ષણે એની નજર સમક્ષ હાજર  
રહેતાં હતાં. એનેક વિજ્ઞાન ભર્યાં કૌતુકો વડે પણ એ  
વિધાધરતનયાને રીજવવાના પ્રયત્ન થતા હતા. પૂર્વના  
સ્નેહને આ લઘમાં એનેક રીતે એ બાળા સમક્ષ પ્રગટ  
કરતો શૂરસેન એના શોકને લૂલવી સુખને ભોગવતો ક્ષણ-  
ની માર્કે સમયને પસાર કરતો હતો. સમય જતાં વિધા-  
ધરખાળા પણ ભાંતા પિતાના વિયોગને લૂલી કુમાર સાથે  
સુખમાં સમય વ્યતીત કરવા લાગી.

૩

### શરસેનને રાજ્યપ્રાપ્તિ

દેવ સમાન ભોગોને ભોગવતાં તેઓ ખન્ને જતા એવા  
સમયને પણ જાણતાં નહિ. એક દિવસે સુખમાં કાળ નિર્ગમન  
કરતાં મુકૃતાવલીએ પોતાના સ્વામીને પ્રશ્ન પૂછ્યો હે,  
સ્વામિન! વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને મનને આનંદ આપે

તેવા વિનોદને માટે કંઈક પ્રક્રિયા પૂછો. “સુક્તાવલીનાં વચ્ચન સાંલળી કુમાર બોલ્યો.

“હે કાંતે ! વિશ્વિદું જીવન શું ? સામર્થ્યને સૂચન કરનાર પદ કર્યું ? તેમજ તારા વહનની ઉપમા આવી શકાય એવી વસ્તુ શી ? એકજ શાખમાં નણે જવાબ આવી જવા જોઈએ.”

પતિનો પ્રક્રિયાની સુક્તાવલી બોલી. “કમલ” ‘ક’ એટલે જળ, ‘અલ’ એટલે સામર્થ્ય એ બેને અળી સુખની ઉપમા માટે શાખ થયો કમલ કેમ ખરું નાં “સ્વામી !”

“ધરાધર છે. હવે તમેજ પૂછો ત્યારે”

“સ્વર્ગત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય ? એકપણ શરૂઆતે હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !” સુક્તાવલીનાં વચ્ચન સાંલળી કુમાર બોલ્યો.”

“સુક્તાવલી.”

સુક્તા એટલે મોતી છીપમાં ઉત્પત્ત થાય, ખળી માણુસ શરૂઆતે હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ મોતીની માળા કહેવાય,

પુનઃસુક્તાવલીએ પૂછશું. સસુદ્ર થડી હરિને શું મહિં ? કર્યું અન્ત પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આવી શકાય ?”

જવાબમાં કુમાર બોલ્યો “હરિને સસુદ્ર થડી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરેસ અન્ત પુષ્ટીકારક થતું નથી. હાથ પગને” તામરેસ કહેતાં રક્ત કમલની ઉપમા આવી શકાય.”

“કામદેવ કોણ છે ? જગતનો આવાર કોણ છે ? કમલિનીને પ્રિય કોણ ? તેમજ મારા મનને મોહ પમાડ નાર કોણ ?”

જ્યાયમાં કુમાર બોલ્યો, “ સુર કહેતાં દેવતા કામહેવ  
હેવ છે, સૂર કહેતાં સૂર્ય જગતનો આધાર છે કમલિનીને  
પ્રિય પણ સૂર્ય છે. કેમકે સૂર્યના કિરણો કમલિનીને વિકસવર  
કરે છે. ને સુક્તાવલીનો મેનમોહન સુરસેન કુમાર છે.”

એ પ્રમાણે શાખના વિનોદમાં એ નવ પરણીત ચુગલ  
પોતાનો કાલ સુખમાં વ્યતીત કરતું હતું. દેવતાનો માડુક  
તેમને જતા એવા કાલની પણ અધર પડતી નહિ.

અન્યથાં નરસિંહ રાજ સ્નાન કાર્યથી પરવારી અલા-  
કાર ધારણું કરવાને આરીસા ભુવનમાં આવ્યા, આરીસામાં  
પોતાના દેહની શોભાને જેતાં તેમને વૈરાગ્ય આવ્યો.  
“ યૌવનવયમાં જે શરીર મજબુત, મનોહર હોય છે તેની  
વૃદ્ધાવસ્થામાં શી હશા થાય છે? અમરની કાંતિ સમાન  
શ્યામ કેશ પણ આ અવસ્થામાં કપાસના જેવા શ્વેત થઈ  
જાય છે. હાથના ગંડસ્થલની માડુક જે જંધાએ ચુવાની  
કાળમાં જણાતી હતી તે કીક જંધા માડુક અત્યારે કેવી  
હુદ્દાલ થધ ગાઈ છે? આવા અનિત્ય અને અસાર શરીરને  
માટે મેં અજ્ઞાનીએ અત્યાર લગ્ની ઘડું કષ લોગવધું છતાં  
આત્મ હિત કર્યું નહિ. અરે! આ દુઃખપૂર્ણ સંસારમાં  
કાંધ સુકૃત કર્યું નહિ.”

એ રીતે ભાવના ભાવતાં નરસિંહ રાજને જાતિસ્મરણં  
જ્ઞાન ઉત્પન્ન થયું ને વૈરાગ્યથી રંગાયેલો. રાજ પ્રત્યેક-  
બુદ્ધ થયો. સિંહના જેવા પરાકર્મી રાજ પણી તો પંચ  
ભુષિ લોચ કરી સંયમ અહણું કરવા તૈયાર થયો. દેવતાએ  
સાદુવેષ અર્પણ કરવાથી એ વેપને ધારણ કરી નરસિંહ  
રાજનિ ઘૃહદ્યપ ગહેરમાંથી અહાર નિકળી પૃથ્વી ઉધ્રુવ  
વિહાર કરતા લભ્ય જનોને બોધ કરવા લાગ્યા.

પિતાની તાગવૃત્તિથી શોક અસ્તા

મંત્રીઓએ સમજાવી તેનો રાજ્યાલિષેક કર્યો. રાજ્ય-  
સુખનો અનુભવ કરતાં સુરસેન રાજનો બહુ કાળ ચાલ્યો  
ગયો, ત્યારે મુક્તાવલી પદરાણીને ચંદ્રસેન નામે મુન થયો.  
કુમાર ચંદ્રસેન પણ વૃદ્ધિ પામતો કલાઓનો પારંગામી  
થધ યૌવનવયમાં આવ્યો. પિતાએ તેને આડ રાજકન્યાએ  
પરણાવી. તેની સાથે વિષય સુખ લોગવતો ચંદ્રસેન  
પિતાની છાયામાં સુખમાં સમય પસાર કરતો હતો.

અન્યાં શરતકલ આવી પહોંચ્યો. તે સમયે રાજ  
મંત્રીઓના કહેવાથી અશ્વોની પરીક્ષા કરવા માટે હૃદાદં  
થધને નગરની બહાર ઓવ્યો. ત્યાં અશ્વોને દોડાવી એમની  
ગુણુદોષની પરીક્ષા કરતાં મધ્યાહ્ન સમય થયો, ત્યારે  
તાપથી વ્યાકુળ થયેલો રાજ ત્યાં વૃક્ષની છાયામાં આરામ  
લેવાને માટે એડો.

તે સમયે સૂર્યની સામે દશ્ટિ સ્થાપન કરી ધ્યાન અને  
તપને કરતા મુનિ ઉપર દશ્ટિ પડતાં રાજ તરતજ એ  
મુનિ પાસે આવીને નમ્યો. મુનિની ઉમ તપસ્યા વડે  
લક્ષ્મિથી રોમાંચ અનુભવતો રાજ સ્તુતિ કરવા લાગ્યો.

સ્તુતિ કરી પરિવાર સહિત રાજ હાથ નેડી મુનિની  
આગળ એડો. મુનિએ પણ ધ્યાન પૂર્ણ કરી રાજને ધર્મ  
હેશના આપી.

હે રાજન ! ડાઢો માણસ રોમની માર્ક લોગમાં  
રક્ત થતો નથી. અસાર અને અસ્થિર લોગોને રોગનું મૂળ  
તેમજ દુર્ગતિને આપનારા જણીને તે તળ હે છે. લોગ-  
વિષયે લોગકાલે તો મધુરા હોય છે પણ એનાં પરિણામ  
દાહણાલયં કરે છે. હે રાજન ! દુઃખબી નિરંતર પીડા  
આમતા નારકીઓને લોગ સામની હોંતી નથી. વિવેક  
રહિત પશુઓને પણ તથાપ્રકારની સામગ્રોનો અલાવ  
હોય છે.

મનુષ્યમાં લોગ સામચી હોવા છતાં પ્રિય વિજોગ, રીણાદિ તેમજ અદ્ય કાળ માટેના લોગો હોય છે. દેવતા-એને પણ લોગ સામચી શાથ્યતી હોતી નથી. એવા લોગો પંડિતના મનને મોહ્ન પમાડી શકતા નથી તો એ અસાર લોગોનો ત્યાગ કરી તમારે આત્મહિતસાધી લેવું.”

મુનિની વાણી સાંલળી રાજ નગરમાં ચાલ્યો ગયો, મુનિના ગુણુને નિશા સમયે પણ યાહ કરતો રાજ નિર્દ્દા વશ થઈ ગયો. આદ્ય મુહૂર્તે દેવ દુંદુલિથી રાજની નિર્દ્દા નાશ પામી. મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયેલું જાણી રાજ ભાગ આડંખરથી મુનિને વાંદવા આવ્યો.

દેવતાએથી મહોત્ત્સવ પૂર્વક પૂજાતા મુનિને જોઇ રાજ અધિક હૃપ્પવાન બાઈ કેવલીને નમી સ્તુતિ કરી એ હાથ જોડી મુનિના મુખમાંથી નિકળતા વાક્યામૃતતુ પાન કરવા લાગ્યો.

એ સમયે ડોઈ તેજસ્વી અને જય જય શાખણ કરતો દેવપુરૂષ મુનિના ચરણુમાં નમ્યો તેને જોઇને ઝુશી થયેલા રાજએ કેવલી લગવાનને પૂછ્યું. “હે લગવન ! આ કોણ પુરૂષ છે ? આપની ઉપર અત્યંત લક્ષ્ણિવાળો છે એનું કારણ શું ?

રાજનો પ્રશ્ન સાંલળી કેવલી લગવાને એ પુરૂષનું અસ્ત્રિ પર્ષાંહ આગળ સર્વના લાલને માટે કહેવું શરૂ કર્યું.

#### ૪

### રાત્રિલોજનતું ફેલા.

જેમ જેમ સમ્યકત્વ શુદ્ધ થાય છે તેમ તેમ દેવશુર અને ધર્મ ઉપર શુદ્ધ લક્ષ્ણરાગ જાગે છે તેમાંથી વળી આ પુરૂષની લક્ષ્ણિતું કારણ હે રાજન ! તું સાંલળ.

પદ્માખાંડ નગરમાં ધનવાન ઈશ્વર અને ધનેશ્વર નામે એ વણિક મિત્રો રહેતા હતા. ઈશ્વર જૈન ધર્મમાં પ્રીતિ વાળો તેમજ રાત્રીસોજનના ત્યાગરૂપ પ્રતિવાળો ધર્માનુરાગી હતો ત્યારે મિથ્યાત્વધર્મથી દુષ્પિત ધનેશ્વર વિપરીત બુદ્ધિનો હોવા છતાં પણ અને કચ્ચે કંઈક મિત્રતા હતી.

પ્રતિદિવસ દિવસના આડમા ભાગે લોજન કરવામાં તત્પર ઈશ્વરને જાણીને કહાયહું ધનેશ્વર ધર્મની નિંદા કરવા લાગ્યો. “આહો ! આ અજ્ઞાની ઈશ્વરની ચેષ્ટા તો જુઓ ! દિવસમાં એ વાર લોજન કરે છે પરંતુ શાસ્ત્રમાં સદ્ગુરૂ પવિત્ર કહેલું નક્તાપત (રાત્રીસોજન) કર્યારે પણ કરતો નથી.”

ધનેશ્વરની વાત સાંસારણી ઈશ્વર બોલ્યો. “મિત્ર ! કહાયહુમાં સાવધાન પણ ધર્મની નિંદા કરી આત્માને લવ સાગરમાં ડુલાવનાર નિવિડ પાપકર્મ વડે તું શા ભણી અંધાય છે ? બુદ્ધિમાનોએ તો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ, અદ્ય હોષ વાળાને આહરી બહુ હોષવાળું છાડી ઢેવું જોઈએ. એઠાનાંક અદ્યહોષ વાળું લોજન કરી મહાહોષવાળા માંસાદિકનો ત્યાગ કર્યો. પરદવ્ય હરણ, અને પરસ્સીસેવન એ બહુ હોષવાળા પાપનો પણ ત્યાગ કરી આવકે સ્વદવ્ય અને સ્વપ્સ્નીમાંજ સંતોષ ધારણ કરવો તેમજ રાત્રી સોજન (નક્તાપત)માં તો પારાવાર હોષ હોવાથી વિવેકી પુરુષે તેનો અવશ્ય ત્યાગ કર્યો ચોગ્ય છે.

રાત્રીસોજનના હોષાનો તો પાર નથી જ્યારે ગુણ એક પણ નથી અને અનેક જીવોની વિરાધના રાત્રી લોજનમાં રહેલી છે. દિવસે લોજન કરવાથી તૃપ્તિ ન થછ તો રાત્રી લોજન કરનારને તૃપ્તિ થશે નહિં.

‘રાત્રિ સોજન ને પ્રાણી કરતો નથી તેતું જવતર’

અર્ધું તપમાં જય છે તો રાત્રી બોજનના દોષ જાળી એમાંથી નિવૃત્ત કરવી એ લાલકારી છે. છતાંય કદાચહું ધારણ કરી જાળી જોઈને આડે રસ્તે દોરાવું એ ખુલ્લજ તુકશાન કરેનાર થશે. પેલા આભ્યાસુન્ને ગધેડાનું પુછડ પકડી રાંઝું તો ગધેડાની લાતો ખાઈને મહાબ્યથાને પામ્યો. તેમ મોટા કહાચહું ધારણ કરવાથી અતિ દુઃખ સહુન કરવું પડે છે છથ્યરની સત્યવાત સાંભળવા છતાં ધનેશ્વરે પોતાનો મમતવ મૂક્યો. નહિ.

એ નક્તત્રતમાં પીતિવાળો ધનેશ્વર આર્ત્યાને મરણ પામીને વાગેળમાં ઉત્પન્ન થયો. ત્યાં મરણ પામી પાંચ વાર વાગેળનો ભવ પામ્યો, એ વાર ચામાચીહીયામાં ઉત્પન્ન થયો, એ વાર ધુલડના ભવમાં, એ વાર શિયાળના ભવમાં લમી મરણપામી વિશાળાપુરીમાં દેવયુસ આહ્લાણુની નન્દા નામની પતની થકીપુત્ર પણે ઉત્પન્ન થયો. તે જન્મથીજ રોગી થયો એક રોગ ભણે તો ભીજ એ જવા ઉત્પન્ન થાય, મોતના મેમાન એવા તે પુત્રનું નામપણ ન પાડવાથી ગામમાં રોગ નામે તે પ્રસિદ્ધ થયો ને વિશ્વામાં રહેલા કીડાની માડક તે વૃદ્ધિ પામવા લાગ્યો. કારણકે દુઃખમાં પણ હિવસો તો જય છેજ.

અન્યથા શાવકના પ્રતને ધારણ કરનારો છથ્યર સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાને ઉત્સુક થયો. શ્રી ધર્મેશ્વરયુદ્ધ પાસે દીક્ષા અહુણ કરી પૃથ્વી ઉપર વિહાર કરતાં તે મુનિ વિશાળાપુરીમાં આવ્યા. પક્ષ ઉપવાસના ધારણા નિમિત્તે નિકળેલા તે મુનિને પેલા દેવયુસ આહ્લાણું જોયા. તેમને નમસ્કાર કરી પ્રતિ લાલિત કરી પોતાના પુત્રના રોગનું કારણ પૂછ્યું.

હે ભાગ્યવાન ! જોગરીએ જતાં વાર્તા કરવાનો પણ

અમારો આચાર નથી. તો પણ તું ધર્મદીપી ઔષધને આચાર, એમ કહી મુનિચાલ્યા ગયા. પાછળથી પુત્રની સાથે તે આશાણ પણ એ મુનિની પાસે આવી ધર્મદીપી ઔષધ પૂછવા લાગ્યો.

મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું. “રોગની શાંતિને માટે પ્રથમ રોગનું કારણ જાણવું જોઈએ. એ કારણનો ત્યાગ કરવાથી તેમજ ઔષધદીપી ધર્મતું સેવન કરવાથી સૌ સારુ થશે, રોગના કારણભૂત, જીવહિસા, અસત્ય, ચોરી મૈથુન અને પરિછુ તેમજ રાત્રીલોજનને જાહી એને છાડી હેવાં.

પંચપરમેષ્ઠિનો જપ, કષાય અને ઈદ્રિયનું દમન, યથારાજિદાન, પાપની નિંદા-ગર્હા, એ બધાં ધર્મોષધ જીણવાં. જેના સેવનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.” મુનિએ વિસ્તારથી ધર્મના સ્વરૂપનું વર્ણન કરવાથી આશાણ પુત્ર સહિત સમકિતને પામી શાવકના પ્રતને પાલનાર થયો. કર્મને રોગનું મૂળ જાહી દફ શક્ષાવાળા તેમણે ધીરજથી સહિત કરતાં કાળ વ્યતીત કર્યો.

તેમની પરીક્ષા કરવાને પ્રથમ દેવલોકમાંથી એ દેવતાએ વૈદ ધનીને આવ્યા. તેમણે મખ, માંસ, માખણ અને હારથી મિશ્રિત દવાએ ખવરાવવાના અનેક પ્રયત્ન કર્યા, છતાં તેઓ પોતાના નિશ્ચયથી ડયા નહિ. જેથી દેવતાએ એ પ્રસન્ન થઇ એ છાકરાને નિરોગી કર્યો. તેમનાં વખાણ કરી દેવતાએ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લોકમાં અરોગા નામથી તે પ્રસિદ્ધ થયો.

તે અરોગ ધર્મમાં વિશેષ તત્પર રહીને અતુક્તે મરણ પામી સ્વર્ગ હવ થયો, તે હવ અવધિજાને મને ધર્મચાર્ય

જાણી નમવાને આવ્યો છે. મને ડેવળી જાણીને તે વિશેષ કરીને નૃત્ય કરતો પોતાના હર્ષને જણાવવા લાગ્યો.

ઇથેર ડેવલીના વચ્ચનથી રાત્રી લોજનના અનેક દોષો જાણી અનેક લોકોએ રાત્રી લોજનનો ત્યાગ કર્યો.

## ૫

### સૂરસેનની દીક્ષા

શ્રી ઇથેર ડેવલીના ઉપદેશ સાંભળી વૈરાઘ્યવાન તેમજ પેલા હેવનો વૃત્તાંત સાંભળી સંસારના સ્વરૂપને વિચારતા રાજ સૂરસેન એ હાથ મસ્તકે લગાડતાં બોલ્યા. ભગવન ! આપને ધન્ય છે કે આપે વ્યાધિથી પીડાયેલા એંધુર પુરુષનો ઉદ્ધાર કર્યો. આ હેવ પણ કૃતજ્ઞ છે કે પોતાના ઉપકારી ગુરુ ઉપર આવી અપૂર્વ ભક્તિ છે. મેં પણ સાંધુ અને શ્રાવક ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું તેમાં સુનિ ધર્મ તો એકાંતે મોક્ષ આપનારો છે ત્યારે શ્રાવક ધર્મ સ્વર્ગાદિ સુખને કરેનારો છે, તો હે ભગવન ! જો મારી ચોયતા હોય તો મને સંયમલક્ષ્મી આપો ! ”

રાજની વાત સાંભળી સુનિ બોલ્યા. “ રાજન ! તું ચારિત્ર લક્ષ્મીને ચોય છે. તો પ્રતિધ્યંધનો ત્યાગ કરી સંયમને પ્રહૃષ્ટ કર ! ”

ગુરુની વાણી સાંભળી રાજ નગરમાં ગયો, ત્યાં હર્ષવાન થયેલો. રાજ મંત્રીએ અને પત્નીને કહેવા લાગ્યો. “ જલભિદુની માઝુક આચુષ્ય ચપળ છે. સંયોગનો અંત વિચોગમાં આવનારો છે. અર્થ છે તે અનર્થને કરેનારો છે. સ્નેહ પણ દુઃખનું મૂળ છે. માટે વિદ્ધાને સંસારમાં પ્રીતિ કરવી યુક્ત નથી. અનંત સુખને આપનાર મોક્ષ સ્વાધીન છતાં સ્વરૂપ અને ધંદભાલ તુલ્ય આ સંસાર સુખમાં ફોણ

રતિ કરે ? તપથી પ્રાપ્ત થનારાં મુક્તીનાં સુખ પોતાને સ્વાધીન હોવા છતાં આ અસાર સંસારમાં કોણું રહે ?

માટે આ રાજ્ય, રમણી, હાથી, ઘોડા અને રથાદિક સર્વનો ત્યાગ કરી હું અમણુધર્મની ઉપાસના કરવાની ઈચ્છાનાળો થયો. શું” સૂરસેન રાજની વૈરાજ્યમયવાણી સાંભળી રાણી મુક્તાવલી એમાં અનુમતિ આપતી ઓલ્ડી “હે સ્વામી ! આપની વાણી સત્ય છે. આપે લોગો પણ લોગવ્યા, મિત્રોને પણ સંતોષ્યા, સામંત વર્ગને ઝુશ્ચિ કર્યા, પુત્ર પણ વૃદ્ધિ પામ્યો, વિશ્વમાં કીર્તિ પણ વિસ્તાર પામી. નર જન્મનાં પુણ્ય ઇલ આપે લોગવ્યા ને હવે જે ચારિત્ર અંગીકાર કરીથે તો જગતમાં આપણને શું નથી પ્રાપ્ત થયું ? ”

“ માટે હે સ્વામી ! ક્ષણ માત્ર પણ હવે એ કાર્ય માટે વિલંબ ના કરો. સંયમ ઇપી નાય વડે અવ સાગર ઉતરી જાયો. કારણ કે ગુરુનો જોગ પામવો હુર્દાલ છે. વળી સારા કાર્યમાં વિધો પણ ઘણું આવે છે. ”

રાણી મુક્તાવલીનાં વચ્ચે સાંભળી મંત્રી ઓલ્ડી. ધર્મી પુરુષોને કોઈપણ વિધન કરી શકતું નથી. ”

રાજાએ ચંદ્રસેન કુમારને શુભમુહૂર્તે પોતાની પાટ સ્થાપન કર્યો. નવા રાજને શિખામણ આપી. “હે વત્સ ! નરકને આપનારા આ રાજ્યમાં આસક્તિ ન રાખવી. કારા-બણ સમાન અને પરાધીન એવા રાજ્યને પામી લોચન છતાં માણુસ બંધ થઈ જાય છે. સત્તાના મહમાં લાન લૂલી જાય છે. વગર મહિરાએ પણ એ રાજ્ય ઉત્તમાદને કરેનાડું છે. તેમજ વગર સાંકળે પણ બંધન જેવું છે માટે તેમાં બહુ સુંઝાઈ જવું નહિં. પ્રજાને પુત્રની માર્ક પાળવી અને અનીતિ હુરાચારનો રાજ્યમાંથી નાશ કરવો મંત્રી-

આની હિતવાતાની અનાદર કરવો નહિએ." ઈત્યાદિક ઉપદેશ આપી રાજએ જુનમંદિરોમાં અષ્ટાલિકા ઉત્સવ કરી આવકના સભુહણે, વસ્ત્ર, રફ્તા, સુવર્ણ, મણિ માણ્ણેક વગેચેનું દાન આપી ચંદ્રસેન રાજએ મહોસવ કર્યો છે એવા રાજએ ગુરુપાસે આવી પ્રિયા સહિત દીક્ષા અહૃણ કરી.

અનુકૂમે તેઓ રાજરાણી અળીયાર અંગનાં જ્ઞાતા થયાં. નિરતિચારપણે ચારિત્ર પામતાં ઇડી ભાવના વડે આત્માને નિર્મણ કરવા લાગ્યાં. તપ્રદ્યો અમ્રિ વડે કરીને તેમણે મહાન ગાઢ કર્મ પણ બાળી નાખ્યા ને આત્માને પાપથી રહિત-શુદ્ધ કર્યો. જુનમતના જાણ એવા તેમણે મિથ્યાત્વ ઇપી વૃક્ષનો નાશ કરી રાગ અને દ્વેષરૂપ અન્ને શનુંઘોનો નાશ કર્યો.

આર્તિધ્યાન અને રૌદ્રધ્યાન ઇપી ચોરે ચારિત્ર ઇપી ધનતું હરણ કરી જતા હતા. તેમને જીતીને વશ કરી દીધા. સંયમ્દ્રધી સાગ્રાજ્યલક્ષ્મીને પામતાં ગણ ગારવ ઇપી અરિત્રિકનો નિર્મભત્વદ્રધી શાસ્ત્ર વડે નાશ કરી નાખ્યો. કીધાદિક ચારે કુપાયોને પોતાના ચારિત્રના, પ્રભાવે મંહ પ્રતાપવાળા કરી દીધા. કામહેવના માહાત્મ્યનો વિદ્ધસ કરી દીધા. ને પ્રમાદાહિ દોષોને હંગાવી હૂર કર્યો. એ પ્રમાણે અપ્રમતાપણે ચારિત્ર ધર્મતું આરાધન કરતા મોક્ષની લક્ષ્મી તેમણે નાણક કરી. દીર્ઘકાલપર્યાત ચારિત્રને પાળી અંત સમયે તેમણે એક માસતું અણુસણું કરી દીધું.

નર અવતું આયુષ્ય પૂર્ણ કરી રહા ચારિત્રના પ્રતાપે પ્રથમ બૈવેયકને વિષે ત્રૈવીશ સાગરોપમના આયુષ્યવાળા અનુકૂમે તે અન્ને ઉત્તમ હેવ થયા અને ધંડની પદ્ધતીને પ્રાપ્ત થયા.

ચૌદ રાજલોકદ્રધી પુરુષના ગળા સ્થાનકે બૈવેયક

આવેલાં છે ત્યાં નવે ગ્રેવેયકનાં પ્રણસે અહાર વિમાન આવેલા છે. દરેક વિમાને જુન ભવન હોય છે. એ દેવતાઓ વિષય કૃપાયથી રહિત હોય છે. તે છતાં નીચેના દેવો કરતાં તેમને અનંતગણું સુખ હોય છે. તેમને પુરુષવેહાદ્ય મંહ હોવાથી વિષય તરક તેમનું મન જતું નથી અને તે વિષય રહિત હોય છે. તેઓ એ હાથથી અધિક શરીરવાળાં અને શુદ્ધ શુક્લલેશ્યાવંત હોય છે.

### પરિચ્છેદ ૭ મો

### પદ્મોત્તર અને હરિશ્વર

૧

### વનમાલા

આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે ઉત્તર દિશાએ ગર્જનપુર નામે નગર હતું. એ નગરનો અધિપતિ સુરેપતિ નામે મહાપરાઙ્મભી રાજુ હતો. રાજને સતી નામની પદ્મ-વી હતી તે પદ્મવીની કુક્ષીને વિષે શૂરસેન રાજનો જીવ પ્રથમ ગ્રેવેયકથી વ્યવીને ઉત્પન્ન થયો. તે રાત્રીને વિષે હંસ અને સારસથી શોભાયમાન પદ્મકરને જોઈ રાણી જાગી. રાજ પાસે જઈ સ્વમાનનો પરમાર્થ પૂછ્યો. “તમારે સુંદર અને તેજસ્વી પુત્ર થશો” રાજનાં એ વચ્ચન સાંસથી રાજુ થબેલી રાણી સારી રીતે ગર્ભનું પાલન કરવા લાગી.

અનેક સારાસારા દોહુદ થયા. સર્વે રાજએ પૂર્ણ કર્યા. કંઈક અધિક નવમાસ વ્યતિક્રમ્યા ત્યારે શુલ્ષ અહુ અને સૌરા નક્ષત્રના યોગે નયનને આનંદ કારી એવા મનોહર પુત્રનો જત્તમ આપ્યો, નિવેદન કરનારી ચેટીને રાજએ

ખુખદાન આપી દાસીપણામાંથી સુક્ત કરી મેટ્ટે વર્ધાપન  
મહોત્સવ કર્યો.

વર્ધાપન મહોત્સવ કરી રાજીએ પુત્રનું નામ પાઠયું  
પદ્મોત્તર.

દ્વિતીયાના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો તે કલાઓમાં  
વિશારદ થઈ હુનિયાને આશ્ર્યકારી યૌવનવયમાં આવ્યો.  
વૈલવ, ઐશ્વર્ય, અને ઠકુરાઈ હોવા છતાં દ્વાલુ, દાનેશરી,  
સજજનપ્રિય, શાંત, દાંત, સૌખ્યમૂર્તિ, અને દક્ષિણયવાન  
હતો. મિથ્યાત્વીના કુળમાં ઉત્પન્ન થવા છતાં યજીની વાત  
પણ અને ઇચ્છતી નહિ. આદ્ભુતનું ઓચિત્ય પણ માત્ર  
પિતાના ચિત્તની અનુકૂળતા માટે કરતો હતો. આદ્ભુતોના  
પુરાણોની કલ્પનાકારી કથાએ પણ અના ચિત્તને ઉદ્દેશ  
કારી થતી હતી. આદ્ભુતોના વાતાવરણમાં વૃદ્ધિ પામેલો  
હોવાથી તે જેન ધર્મથી વંચિત હતો, કારણકે જવેરીના  
સંસ્કાર વિના શુદ્ધ મણિ પણ નિર્મણપણાને પામે છે કે!

વૈતાદ્ય પર્વતની દક્ષિણ બ્રેણિમાં સુભૌમપુર નામે  
નગરનો અધિપતિ તારવેગ નામે રાજ હતો. તેની કમલ-  
માલા નામે રાણીથકી સુક્તાવલીનો જીવ પુત્રપણે ઉત્પત્ત  
થયો, સ્વપ્રામાં સિંહના બાળકને જોવાથી તેનું નામ રાણ્યું  
હરિવેગ. અતુક્તે વિદ્યાધરની લક્ષ્મીથી લાલનપાલન  
કરતો હરિવેગ યૌવન વયમાં આવ્યો.

એ સમયે મધુરા નગરીના ચંદ્રધવજ નામે રાજને  
એ સ્ત્રીઓથકી એકએક પુત્રી થઈ. શશિલેખા અને સૂર્ય-  
લેખા, એ બજે પુત્રીઓ જ્યારે યૌવન વયમાં આવી. ત્યારે  
પિતાએ એમનો સ્વયંધર કર્યો. દેશોદેશના રાજકુમારેને  
આમંત્રણ કરવાને હૂતો રવાને થયા, એક હૂત ગર્જનપુર

નગરે આવી સુરપતિ રાજને વિનંતિ કરી સ્વયંવરની હકીકત કહી સંભળાવી કુમારને માટે આમંત્રણ કર્યું.

પિતાની આજાથી પદોત્તર કુમારે પોતાના પરિવાર સહિત મશુરા નગરી તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાણ કરતાં પ્રન, પર્વત, નદી, વાવ, શહેર અને નગરોનું નિરીક્ષણ કરતાં તેઓ વનમાં રહેલા મહોદ્ય નામે તાપસાશ્રમ નાણક આવ્યા, ખજુરી, નાળીયેર, દ્રાક્ષ, પુનાગ, નાગરવેલા, નારંગ અને સહકારાહિક અનેક વૃક્ષરાણથી શાલી રહેલા આશ્રમને જોઈ કુમારે ત્યાં પડાવ નાખ્યો અને પોતે તાપસાશ્રમમાં તાપસપતિને નમયાને આવ્યો.

તાપસપતિને નમી એમની સામે બેઠા, તે વારે તાપસપતિ પણ અને ઉત્તમ અતિથિ જાણી (સુરપતિ નૃપ પુત્ર) એને લાયક એક મનોહર કન્યાને બોલાવી કુમાર આગળ છાજર કરી. એ મનોહર બાળાનું ઇપ સૌંદર્ય જોઈ કુમાર દિગ્ભૂટ થઈ વિચાર કરવા લાગ્યો. “અરે ! શું આતે નાગ કન્યા કે પાતાળ કન્યા, અને તેથે રષિ આશ્રમમાં કયાંથી ?

કુમારને શંકાશીલ ને વિચારમાં પડેલો જાણી તાપસપતિએ અનો ઝુલાસો કરવા માંડ્યો. કુમાર પણ એ કન્યા સંબંધે વૃત્તાંત સાંભળવા લાગ્યો.

“ઉત્તર દિશાએ સુરભિપુર નગરમાં વસંત રાજ રાજ્ય કરતો હતો તેને પુણ્યમાલા આહિ ધણી રાણીએ હતી. પુણ્યમાલાને ગુણુમાલા નામે પુત્રી થઈ. રાજકુમારી ઉપર રાજને અપૂર્વ ગ્રેમ હોવાથી યૌવનવયમાં અનેક રાજકુમારો અને વરવાને આતુર છતાં રાજએ પોતાની કન્યા ડોધને આપી નહિ.

એકદા ચંપાનગરનો શુવરાજ શુકુમાર મોયા સૈન્ય સાથે ફરતો ફરતો ત્યાં આવ્યો. રાજએ અનો આદરસત્કાર

કર્ચો, શુકુમારના મંત્રીએએ સારી રીતે રાજને સમજાવવાથી રાજએ પોતાની ગુણમાલા પુત્રી ગુણવાન શુકુરાજકુમાર સાથે પરણાવી હીધી.

રાજએ આપેલા રાજભુવનમાં પ્રિયા સાથે નિવાસ કરેતા રાજકુમારમાં સિથરતા, ગંભિરતા, હાક્ષિષયતા, આહિ અનેક ગુણા હોવા છતાં ચંદ્રમામાં કલાંકની માર્ક એક દૂષણ હતું તેને મુગયાનું વ્યસન ખુબ લાગેલું હોવાથી રોજ દૂરદૂર તે શિકાર કરવાને જગતમાં જઈ, અનેક નિર્ણાય પ્રાણીએને હણી નાંખતો હતો.

રાજએ પોતાના જમાતાને બોધ કરવા માટે સુસુખ નામના એક લદ્દને આજા કરી, સુસુખે શુકુમારની પાસે આવી ઉપદેશ આપવા માંડ્યો, “ઉત્તમ જનોએ જગતમાં લજાકારી એવું આ પ્રાણીવધનું પાપ શા માટે કરવું જોઈએ ? હીન, અનાથ અને પ્રમાદી તેમજ નાશી જતા જવોને પાછળ પડીને વા કરવા એ ક્ષત્રિય કુલાચાર ન કહેવાય રાજકુમાર !

અન્યને પીડા કરવાથી વિવિધ પ્રકારની વ્યાધિએ પ્રાણીએને લોગવવી પડે છે, અકાલે મરણ આવે છે. ધીજના પ્રાણીનો વિશેષ કરવાથી પોતાને વિરહામિથી દર્ઢન થવું પડે છે. ગર્ભપાત કરનાર, આળકની હત્યા કરનાર જવોલબ અપત્યરહિત થાય છે. એકના પ્રાણીનો નાશ થાય છે ત્યારે એના લોગે ધીજને આનંદ થાય છે. એકનું ઘર બધે છે ત્યારે ધીજે મૂર્ખ એને અજવાળું માની ખૂશી થાય છે. મુળમાં તૃણ નાખેલા શરૂને પણ શૂરવીરે અભય આપે છે ત્યારે આ તૃણ અક્ષણ કરનારા પશુએને મારી નાખવા એમાં કઈ નીતિ છે ? અરે ! શૌર્ય પણ શું ?”

એ લદ્દનો ઉપદેશ સાંભળી કુમાર કંધક નિવૃત્તિ

પામ્યો પણ મનથી એણે ત્યાગ કર્યો નહિ, એકદા પિતાજી મેડલેલા પુરુષોના કહેવાથી કુમાર રાજની રજ લઈ પોતાની આસત્ર પ્રસૂતા પત્નીની સાથે પોતાના નગર તરફ ચાલ્યો, તે પ્રયાણ કરતાં આ તાપસાશ્રમની નજીક આવી પહોંચ્યો.

અનેક વનચર પશુઓને કિલકિલાઈ કરતાં જોઈ શું કુમારની મૃગયાવૃત્તિ સતેજ થઈ, તે પોતાના અથ્યને એ પશુઓ તરફ હોડાવ્યો, દૈવયોગ માર્ગમાં તણુથી આચળ્છા-દિત એક ખાધમાં અસ્વ પડી ગયો અસ્વના દખાણુથી કુમાર મહાબ્યથાને પામ્યો, એના સુલેટો હાહાકાર કરતા આવી પહોંચ્યા તેમણે કુમારને ખાઈમાંથી ખહાર કાઢ્યો. પતિના દુઃખની વાત સાંભળી ગુણુમાલા પણ હાહાકાર કરતી પોકાર કરવા લાગી, એની ભાતા અને પિતાને સમાચાર મલવાથી તે પણ ત્યાં આવી પહોંચ્યા છતોય એ દિવસ મહાબ્યથા લોગવી કુમાર ધાની પીડાથી મૃત્યુ પામી ગયો મૃગયાર્થી પાપનું ઇણ એ રીતે એને તરતજ પ્રગટ થયું, ગુણુમાલા પતિની સાથે બળી મરવાને તૈયાર થઈ પણ એના ભાતાપિતાએ એને સમજવી શાંત કરી, એ ઇથી કરતી પુત્રીના દુઃખથી દુઃખી થયેલાં રાજરાણી આ તપોવનમાં કુલપતિની પાસે આવ્યાં.

કુલપતિએ તેમને વૈરાઘ્યનો ઉપદેશ કરી શાંત કર્યા, એ ઉપદેશથી સંસાર પરથી ઉદ્દાસ થઈ ગયેલાં રાજરાણીએ તાપસી દીક્ષા લેવાનો વિચાર કર્યો, માયા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તે પછી વસંતરાજ, પુષ્પમાલા અને આસત્ર પ્રસૂતા ગુણુમાલાએ દીક્ષા અહેણું કરી.

કેલાક દિવસ પછી ગુણુમાલાએ મનોહર પુત્રીનો જન્મ આપ્યા ભાદ શૂલ રોગની વ્યાધિથી પીડાતી રે કાલ-

થમે પામી ગણ, પુત્રીના મરણથી હાખી થયેલી પુષ્પ-  
માલાએ સ્તરનપાનવરે તે મનોહર બાળિકાને ઉચ્છેરવા માંડી.  
વનમાલા નામે વૃદ્ધિ પામતી એ આળા નવીન થૈવનને  
આંગણે આવી.

વસંતમુનિને પોતાના પદે સ્થાપન કરી કુલપતિ પણ  
સ્વર્ગ ગયા, પુષ્પમાલા પણ હેવવશાત કાળથમ્ પામી  
ગણ, તે વસંતમુનિ હું પોતે.

મારા ગુરુએ મને કહેલું હતું કે ‘આ આળાનો જે  
પતિ થશે તે મોટા મહારાજ-રાજધિરાજ થશે’ તો આ  
આળા વનમાલાને અહણ કરી મને આ મોહ બંધનમાંથી  
હેં કુમાર! તું મુક્ત કર.

વસંત રાજધિનું વચન અંગીકાર કરી કુમારે આશ્ર-  
મમાં વિવાહની ચોણ સામાની મેલવી વનમાલા સાથે  
પાણિઅહણ કર્યું વસ્ત્ર આલરણ કંઈક હતાં તે વનમાલાને  
આપી દીધાં, તેમજ પોતાનાં આલરણ અને સિદ્ધ વैતાલિ  
વિદ્યા મુનિએ કુમારને આપી, એ રીતે એક મહાન ઉપા-  
ધિમાંથી ઇથિ સુક્ત થયા.

એ નવોદા પ્રિયા સાથે ડેલાક દિવસ ત્યાં સ્થિરતા  
કરી પછી ઇચ્છિની-કુલપતિની અગુજા મેલવી પદ્મોત્તરકુમાર  
મથુરાને માર્ગ ચાલ્યો.

## ૨

### મથુરા નગરીમાં

પદ્મોત્તરકુમાર મથુરા નગરીમાં આવી પહોંચ્યો, રાજ-  
એ તેનું સન્માન કરી તેના નિવાસ માટે જોઈવણું કરી,  
દૃશ્યેશના રાજાઓ અને રાજકુમારા આવ્યા હતા, આખુય

નગર તેમજ વ્યાસપાસનાં ઉધાન અને વન માણસોથી ઉભરાઈ ગયાં.

સ્વયંવરના સમયે મંડપ અનેક રાજકુમારો અને રાજાઓના અળહળાટથી ખળખળી રહ્યો. હીરા, માણેક, મોતી અને રત્નાથી વિલુપ્તિ રાજકુમારોના તેજનો પાર નહોંતો, પોતપોતાના મંચ પર ગોઠવાયેલા રાજકુમારો અને રાજાઓના મનમાં કંઈકંઈ અભિલાષાએ તોડુને ચઢેલી હતી. રાજ્યકંન્યાને વરવાની ઘેલથામાં તેઓ તેના આગમનની માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા હતા.

યથા સમયે અને કંન્યાએ હાથમાં વરમાલને ધારણું કરી મહા કીમતી વસ્ત્રાભરણમાં સજજ થઈને ગજગામિની ચાલે ચાલી મંડપમાં આવી પહોંચ્યી. સખીઓથી વીંટળાયેલી એ બાળાએ પોતાના સૌંદર્યથી અને ગૌરવથી સલામ મંડપને ક્ષોલ ઉત્પત્ત કરતી, અંધા રાજકુમારોને દૃપના જાહેરી સ્થાનિત કરતી મંડપમાં પોતપોતાના મંચ પર રહેલા રાજકુમારોનું અવલોકન કરવા લાગી. રાજકુમારોનો ઉપરનો લપકાદાર ઠોરો જોઇ બાળાએ મનમાં જરીક હસી.

દાસીએ નિવેહન કરેલા રાજકુમારોનો ત્યાગ કરતી અને બાળાએ પદ્મોત્તર કુમાર બેડો હતો ત્યાં આવી પહોંચ્યી. સર્વાંગ સુંદર પદ્મોત્તર કુમારને જોઇ અને બાળાએની દશ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈ ને એ પુરુષ સૌંદર્યમાં મુખ્ય થયેલી બાળાએની વરમાળ એ પુરુષ તરફ આકર્ષિતી એના કંઈમાં પડી.

એકજ તરને અને બાળાએ વરવાથી મંડપમાં ઝુલ્લ ખળખળાટ પેદા થયો. રાજાએ અને રાજકુમારો જાણું કે

પોતાનું ભારે અપમાન થઈ ગયું હોય તેમ રોપથી હલા-  
મટી રહેલા શસ્ત્રો સંભાળવા લાગ્યા.

સાકેતપુરખિનિહરરાજ રાજકુમારોને ઉશ્કેરતોએલયો,  
“ અરે ! આ રાજાએ જે પદ્મોત્તરને ઘનને કન્યાએઓ આપ-  
વાની હતી તો અન્ય રાજકુમારોને અપમાન કરવા શામાણ  
ઘોલાવ્યા ? એ રાજાએ તો આપણાં નાક કાખ્યાં.”

રાજાએ પોતપોતાના સૈન્ય સહિત રણસંભામ માટે  
આતુર થયો છતા પદ્મને મારવાને તૈયાર થઈ ગયા, જેથી  
ચંદ્રદવજ રાજાપણ પોતાના સૈન્ય સાથે કુમારની પાસે  
આવ્યો, ચંદ્રદવજને રણ કરવાને ઉત્સુક જાણી સાકેતપુર-  
ખિનો એક વિક્રાન હૃત તેમની પાસે આવી વિનંતી  
કરવા લાગ્યો.

“ રાજન ! એક કન્યા તમે ગમે તે રાજકુમારોને આપી  
રાજાએના કોપનું નિવારણ કરો નહીંતર સર્વે રાજાએના  
કોપથી તમારા જમાતાનું લુચન જોખમાતાં વાર લાગશે  
નહિ. જે કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે તેને માટે  
અનેક પુરુષરતનો ક્ષય કરવો એ શું ડાહુપણનો માર્ગ  
છે ? ગમે તેવો શૂરવીર પણ એકલો હોય તો અનેક સુલભ  
દ્યાથી તેનો પરાલન શક્ય છે કારણકે ડીડીએનો સમુદ્ધાર  
પણ સર્પને તાણી જાય છે. અળવાન અને તેજસ્વી સૂર્યને  
વૃદ્ધણનો સમુહ શું આચ્છાદિત નથી કરતો ! માટે વિચાર  
કુરીતે કાર્ય કરવામાં ડહાપણ છે.” હૃતની વાણી સાંલળી  
રાજકુમારે તેના તિરસ્કાર કરી કાઢી સુકયો. ચંદ્રદવજ,  
રાજા અને તેના સૈન્યને અદ્યકાવી પોતે એકલોઝ રથારદ  
થથું રણ સંભામમાં ધસી આવ્યો.

અનેક રાજા અને તેમન્ના સૈન્યના સમુદ્ધારે આતુ આફાડુ  
રથારદ રાજકુમારોને જોયો, તે રાજ વિહર અદ્યહાસય કરતો

બોલ્યો. “ અરે ! બાલક ! નાશી જ ! નાસી જ ! પીડ  
ખતાવતા તને અમે કદાપિ મારશું નહિ. ” વિહુરતુપત્ની  
વાની સાંલળી કંઈક હસીને પદ્મોત્તર બોલ્યો રાજન !  
રણમાં ચુંઝ કરવાને આવેલો નર-પુરુષ કદાપિ પુંડ ફેરવતો  
નથી, તમારી તાકાત અજમાવો ! તમારી અલિલાધા પૂરી  
કરો. ”

પછી તો રણ સંઘામની શરૂઆત થઈ ને કુમારે સિદ્ધ  
વૈતાલીનું સ્મરણ કર્યું, તે વિદ્યાના પ્રભાવથી શત્રુઓ જે  
જે શાસ્ત્રો છોડતા તે શાસ્ત્રોથી તે પોતેજ હણવા લાગ્યા.  
કુમારની આ અપૂર્વ શક્તિથી શત્રુરાજુઓ કુમારના ચર-  
ણમાં પડ્યા, કુમારનો જ્યયજ્યકાર થયો કુમારે સિદ્ધ  
વૈતાલી વિદ્યા સંહારી લીધી.

ચંદ્રધવજ રાજુએ વિહુરાદિક રાજુઓનું સન્માન કરીને  
વિદ્યાય કર્યાને બન્ને કન્યાઓ સાથે કુમારનો વિવાહોત્સવ  
થયો. મોટી ધામદુમપૂર્વક એ વિવાહ પ્રસંગથી સારાય  
નગરમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ચંદ્રધવજ રાજના  
અધ્યક્ષથી કેરદોક કાળ કુમાર શિસુરનગરમાં રહ્યો. ત્યાં  
બન્ને મનમોહક મોહના સાથે વિવિધ પ્રકારે સુખને  
લોગવવા લાગ્યો.

અન્યથા શિસુરની રજ લઈને કુમાર બન્ને પ્રિયાઓ  
સાથે પોતાના પરિવાર સહિત પોતાના નગર તરફ ચાલ્યો.  
પોતાના સૈન્યથી પૃથ્વીને આચાહિત કરતો કબે કરીને પોતાના  
નગરમાં આવ્યો. રાજુએ મોટો પ્રવેશ મહોત્સવ કર્યો ને  
ભાગ્યવાન રાજકુમારને રાજુએ ચુવરાજ પદ્ધતીથી વિભૂષિત  
કર્યો. એ વિશ્વવલ્લભ કુમાર પુણ્યમાં ભંડુરાં ઇલને લોગવતો  
પિતાની છાયામાં પોતાનો સમય મનિગ્રંભન કરવા લાગ્યો.

### મેલાપ

રજતમય વૈતાદ્ય પર્વતનિ પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણ વિધાછરોની એ અણિએ રહેલી છેએ અણિએમાં રાજધાની સહિત સાઠ અને પચ્ચાસ નગરો આવેલાં છે. ઉત્તર અણિની અંદર ગગનવદ્દલસ નામે મનોહર અને દ્વોની ભૂમિ સરખુ રમણીય નગર આવે હું છે. ત્યાંતા રાજ કનકેતુની કનકાવતિ અને રત્નાવતી નામે એ રાણીએ થડી કનકાવલી અને રત્નાવલી નામે અને પુત્રીએ યૌવન-વયમાં વિહાર કરી રહી હતી. સખીએ સાથે કીડા કરતી એ મનોહર ભાગાએની જ્યાતિ અને અણિએમાં પુણ્યમાં સુવાસની જેમ પ્રસરી ગઈ. રારણું જગતમાં રૂપનાં જાડ અદ્ભૂત હોય છે.

મિમિતિયાએ એ ભાગાએની ભાગ્યરેખા જોઈ કહેલું કે જે એક ભાગાનો પતિ થશે તે એક અણિનો અધિપતિ થશે, ને અને ભાગાએનો થનાર પતિ બને અણિનો અધિપતિ થશે.”

એ મનોહર લાવહૃયની પ્રતિમા સમી ભાગાએ માટે રાજએ સ્વયંવરની રૂચના કરી. સ્વયંવરમાં આવેલા અનેક વિધાધરોમાંથી એ બને ભાગાએ હરિવેગ કુમારને વરી તે મોદા મહોત્સવ પૂર્વક તેમનો વિવાહ ઉત્સવ ઉજવાયો. શિસુરના આગ્રહથી હરિવેગ થાડા દિવસ રોકાધને પછી તેમની રજ લઈ પોતાના નગર ક્ષિયાએની સાથે આવ્યો. પુત્રને કવચ ધારી, ભાગ્યશાળી ને રાજલોગાને ચોંઘ જાણી એના પિતા તારવેગ વૈરાગ્યને ધારણ કરતો મનમાં વિચાર કરવા લાગ્યો.

મતુષ્યપણામાં પણ વિધાધરની ઋડદ્વિ મોયા ભાગ્યે  
મલે છે તેમાંથી મારો પુત્ર તો ભાગ્યશાળી છે કે તે બન્ને  
શ્રેણીનો અધિપતિ થશે એ બન્ને ખાળાઓ અનેક વિધાધર  
નરેશાને ત્યાગ કરી મારા પુત્રને વરી એમાં એક પુણ્યજ  
પ્રધાન કારણ છે. અવાંતરના મોયા તપ સિવાય આવી  
સમૃદ્ધિ ન મળે. કેમકે જાનીનું વચન અન્યથા થશે નહિં.  
તો એના પૂર્વભવની વાત જાનીને પૂછું.”

રાજ તારવેગના મનમાં એ પ્રકારના નિયારો ઉદ્દલવ-  
તાજ કેવલી અગવાન શ્રીતેજ નગરીની બહાર નંદનવનમાં  
સમવસર્યા. એ વધામણુ સાંભળી રાજ પુત્રકલગ્રાહિક  
ઘરિવાર સાથે અગવાનને વાંદવાને આવ્યો. કેવલીને વાંદી  
તેમની ધર્મહેશતાં સાંભળી રાજએ હરિવેગને પૂર્વભવ  
પૂછ્યો.

કેવલી અગવાને શાંખરાજ અને કલાવતી રાણીથી  
શરૂ કરી પડોતર અને હરિવેગ સુધીના સર્વે ભવ તથા  
તેમની કરેલી ધર્મ કરણી કહી સાંભળાવી. એ ધર્મ કરણીથી  
પુણ્યાતુ બંધીપુણ્ય બંધાય છે તેનાં આ બન્નેનાં પ્રગટ ફળ  
છે. એ રીતે પુત્રના ચરિત્રથી વૈરાગ્ય પામેલા તારવેગ રાજએ  
પુત્રને રાન્ય અર્પણ કરી ચરિત્ર અંગીકાર કર્યું. હરિવેગ  
પણ ગુરુના સુખથી પડોતર કુમારની હકીકત જાણી લીધી.  
ધર્મરહિત પડોતર પોતા થકી ધર્મ-સમ્યક્તન પામશે એ  
બીના પણ કેવલી અગવાને કહી સાંભળાવી. કેવલી  
અગવાન વિહાર કરી ગયા. હરિવેગ પણ કેવલી અગવાનને  
નમી પોતાને સ્થાને ગયો.

પરાક્રમે કરીને અદ્વિતીય હરિવેગ નરપતિએ પોતાના  
અતુલ તેજ વડ કરીને વિધાધરની બન્ને શ્રેણીઓને તાણે  
કરી ચક્કબર્તી રાજ થયો.

એકદા પોતાના સ્નેહી પદ્મોતર કુમારને મહિયા માટે ગજ્જનપુર નગર તરફ જવા માટે હરિદેવ મંત્રીને રાજ્યની ચિંતા અળાવી માયા પેરવાણો માર્જર વિકુળી તેની સાથે સામાન્ય ઝપમાં ગજ્જનપુરના બજરમાં ઉપસ્થિત-પ્રગટ થયો.

રાજમાર્ગમાં ઉલા રહેલા એની આસપાસ અનેક વિશ્રેષ્ણ તેમજ અન્ય લેકોનું જુથ વીંટળાંધ ગણું પણ પેલા માર્જરની એક લાખ ટકા કિમત સંબળી બધા પાછા પડ્યા, અન્તે તે પુરુષ રાજસભામાં આવી પહોંચ્યો.

કુમાર પદ્મોતરના હૃદયમાં આ પુરુષને જોતાં સ્નેહના અંકૃતે પ્રગટ થયા, તેણે આ પુરુષનું સ્વાગત કરતાં સ્થૂલ કાલ માર્જરને જોઈ પૂછ્યું:

“હે સુંદર ! આ તમને કયાંથી મંદ્યો ?”

“મારી લક્ષ્મિથી પ્રસન્ન થયેલા દેવતાએ આ માર્જર-સ્તનની મને લેટ કરી છે એનામાં ઘણા ગુણો રહેલા છે. એક લાખ દીનાર આપે તેજ આને લઇ શકે છે.” પેલા પુરુષ-વિદ્યાધરે કહ્યું.

“એનામાં એવા કયા ગુણો છે તેનું વર્ણન કરો !” રાજના પૂછવાથી વિદ્યાધર યોદ્યો. “એકતો મહા પ્રામાણિક ધીજે ગુણ અન્ય માર્જરોથી આ અન્યે છે અને ત્રીજો ગુણ આ માર્જર જ્યાં રાત્રીએ નિવાસ કરે છે ત્યાંથી મૂષકો આર જોજન હૂર લાગી જાય છે. એ તો એના આદ્ય ગુણો છે. પણ અસ્યાંતરના ગુણોનો તો પાર નથી મહારાજ ! માટે વિદ્યાનો પાસે એની કિમત કરાવો. પછી હું મારે સ્થાનકે જાઉ.”

રાજએ આદ્યણોને યોદ્ધાવી એ માર્જર હવાલે કર્યો.

આદિષોએ માર્જરનો એક કર્ણ ખંડિત જોઈ વિધાધરને  
પૂછ્યું: “આનો એક કર્ણ કયાં ગયો ?”

“માર્જમાં આવતાં રાત્રી પડી જયાથી એક દેવ  
અંહિરમાં હું રાત્રી વાસો રહ્યો. નિશા સમયે અમે અન્ને  
નિદ્રાવશ થયા તે સમયે એક મૂખક બહારથી ધર્સી આવી  
આનો કર્ણ કરીને નારી ગયો-પલાયન કરી ગયો.

વિધાધરની વાત સાંભળી આદિષો હસીને બોલ્યા.  
“જરૂર ત્યારે તો અનો ત્રીજો ગુણ પણ એ સાથે પલાયન  
કરી ગયો.”

“અરે ! એવા એકાદ નણ્યા દોષથી રતનાં કીંમત  
કંઈ એછી થતી નથી. દેવતાઓમાં પણ એવું હેખાય છે.  
તો પછી માર્જરની તો વાતજ શી ?”

“દેવમાં તો દૂષપણ હોવાનો સંભવજ નથી. “વિગ્રો  
બોલ્યા.

“જો એમ છે તો હે આદિષો ! હું કહું તે સાંભળો.  
જે આદિષુ, ગાય, બાલક અને સ્ત્રીની નાખે છે તે  
કેવો ગણ્યા છે ?”

“તે મહાપાઠિ૧, ફૂર, ઘાતકી, એવું સુખપણ જોવા  
લાયક નથી એવા કહેવાય છે.” આદિષો બોલ્યા.

“જો એમ છે તો અમિત જ્યારે પ્રગટ થાય છે ત્યારે  
આળ, ગાય, આદિષ. કે સ્ત્રી કોઈને પણ દહન કર્યા વગર  
છાડતો નથી. એની અપદમાં આવેલ કોઈ સલામત નથી  
છતાં એને દેવ બુદ્ધિથી કેમ પૂણે છો ? તમે કહેશો કે તે  
તેત્રીસકેટિ દ્વોનું સુખ છે કેથી તેઓની રમ્ભિને માટે  
ધી, મધાહિ વડે કરીને એની પૂજા અમે કરીએ છીએ.  
છતાં એ અરાધર નથી. જો અમિત દ્વોનું સુખ છે તો  
. અનિષ્ટ એવાં મૃતક, કલેવરાહિ અસુવિને તે કેમ અહિષુ.

કરે છે. અસુચિનું લોજન કરનાર દેવતાનું પૂજન કરી તમે પવિત્ર શી રીતે થાએઓ છો ? આ વિરોધને તમે કેમ જાણતા નથી ?”

પાણીને પણ વિષણુની મૂર્તિદ્વય કહીને તેનાથી ગુદા, પાદાદિકનું પક્ષાલન કરો છો તે શું પ્રત્યક્ષ વિરોધ નથી ? તમે કહેશો કે જલ એ વિશ્વનું જીવન છે. વિશ્વનો ઉપકાર કરનારં છે તો જલ પણ દેવરૂપ છે. એમ માનશો તો કાર્ય કાર્યિત-કારણપણાએ કરીને કુંભકારને પણ દેવ માનવા પડશો. કારણ કે તે પણ લોકો ઉપર ઉપકાર કરનારા છે.

ગાય કે ઓકડાના મૂત્ર વગર આદણેાના સૂતકની શુદ્ધિ થતી નથી તેમજ જલ વગર દેહની શુદ્ધિ થતી નથી. તો પછી એ મૂત્ર અને જલ અન્નને તમારે દેવ માનવા પડશો. પણ અરી વાત તો એ છે કે જલ અને અશ્રિતું માનો કે ઉપકારપણું છે છતાં એમાં દેવની કદ્દિપના કરવી યુક્ત નથી.

મહાદેવે કામને બાળી નાખ્યો છે છતાં તે ગંગા અને ગૌરીમાં આસક્ત થયા છે એમ સાંભળવા છતાં તેમને નિર્દેષ માનો છો તો પછી મૂષ્પકના કરડવાથી અંડિતકર્ણી આ માર્જર દૂષિત કેવી રીતે હોંઘ શકે ?”

એ પુરુષની આ પ્રમાણેની શાસ્ત્રીય વાત સાંભળી બતા આદણેા નિરૂતર થઈ ગયા. સુરપતિ રાજ પણ આ પુરુષની વચનયુક્તિથી હંગ થઈ ગયો. અને આદણેાના મતમાં મંહ આહરવાળો થયો.

એ પુરુષની આવી વાણી સાંભળી પદ્મોત્તર કુમાર પણ વિચાર કરવા લાગ્યો. “શું આ માર્જરનો વેચનાર

છે કે ! આ કોઈ મહાન પુરુષ જણાય છે માટે એનેજ ધર્મતું સ્વરૂપ પૂરું. ” એમ વિચારી કુમાર બોલ્યો.

“ હે મિત્ર ! રાજહંસ જેમ પત્ર-વનમાં રમણ કરે છે તેમ તમારું મન કથા હેવ, ગુરુ અને ધર્મમાં રમે છે તે કહે. ”

કુમારના પ્રથમવાર્થી તે પુરુષ બોલ્યો. “ સર્વે દર્શનનાં શાસ્ત્રોને હું જાણું છું. કિંતુ એક જૈન દર્શન વગર બીજું કોઈ દર્શન વિવેકવાંત નથી કે જેને વિશે આહર થઈ શકે. બ્ધા દર્શનવાળા અહિંસા, સત્ય, અસ્ત્રેય અજ્ઞા અને સતોપથુકા પ્રતિ-વર્મને કહે છે પણ એ પ્રમાણે તેમનું વર્તન જોવામાં આવતું નથી. અન્ય દર્શનના દર્શનીયો કીટકાદિની લિંસા કરે છે. પચન, પાચનાદિક આરંભને પણ કરે છે. કેટલાક કંદ, મૂળ, ઇણના આહન કરતા તે દ્વારાધર્મતું વર્ણાન કરતા વનસ્પતિમાં જીવે છે તે જાણતા નથી. કેટલાક મૂળાંયો ધર્મને નામે યજામાં પશુઓને પણ હોયે છે. એવી રીતે દ્વારાધર્મતું વર્ણાન કરતાં છતાં પણ કેટલાક લિંસાને આચયે છે.

દાહું અને અહડના મિશ્ર અગ્ર વડે લોજન કરતા કેટલાક કલુષિત અન્નની માર્કે ધર્મ અધર્મતું મિશ્રણાકરી કલુષિત ધર્મતું સેવન કરે છે પણ નિર્દેખ ધર્મ તો જીનેકેર લગવાને કહેલો. તે જ છે તેને શુદ્ધધર્મ જાણ્યો. જ્યાં અહાર હોય રહ્યિત જીનેંદ્ર તે જ હેવ કહેવાય છે. પંચ મહા-પ્રતને ધારણ કરેનારે ગુરુ કહેવાય છે. અને ધર્મ પણ તે જ કહેવાય છે કે જે હુર્ગતિમાં પડતા પ્રાણીવર્ગતું રક્ષણ કરે છે.

૪

### શુરૂ સમાગમ

શુરૂ દેવ, ગુરુ અને ધર્મતું સ્વરૂપ જાણીને કુમારે  
ખુલ્લ પ્રસંગ થયો. કુમારને પ્રસંગ થયેલો જાણી હરિવેગ  
ઓદ્યો. “હે પદ્મોત્તર ! જૈનધર્મના અલાવથી વણા કાળ  
પર્યાત લોગવેલાં બૈવેયકનાં સુખને પણ શું તું જુદી ગયો ?  
એ મણિરતોથી નિર્મિત વિમાન, અહંકૃપણું, એકને  
આઠ પ્રતિમાથી ચુક્ત સિદ્ધાયતન એ ઘડું શું વિસરી  
ગયો ? હે મિત્ર ! ધર્મને સાંસલળવા છતાં તું આચેરતો  
કેમ નથી. ? ” હરિવેગની પરલખને સૂચન કરેનારી વાણી  
સાંસળી પદ્મોત્તર કુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું.

આશ્ર્યથી ભસ્તકને ધુષણાવતો પદ્મોત્તર ઓદ્યો. “વાણ !  
શું જ્ઞાનતું મહાત્મ્ય ? કેવો પરલખનો સ્નેહ ! પરોપકારમાં  
કેવી પ્રીતિ ! સુજ્ઞાવદીનો જીવ તું અત્યારે મહાન વિદ્યા-  
ધનોમાં અગ્રસર-ચક્રવર્તી થયો છે. તે મારા ઓધને માટે  
તું અહીં આવ્યો છે તો હવે માયાનો ત્યાગ કરી તાર મૂળ  
સ્વરૂપ પ્રગટ કર. ” કુમારના કથનથી હરિવેગ પાતાનું મૂળ  
સ્વરૂપ પ્રગટ કર્યું.

એ વિદ્યાધરનું મૂળ સ્વરૂપ જોઈ બધા સ્વરૂપથી  
આશ્ર્ય પામ્યા છતા એને જોઈ રહ્યા. કુમારે એને આલિં-  
ગન આપું પોતાના અર્ધાસને એસાઉદો હરિવેગ ઓદ્યો.  
“હે મિત્ર ! તને ભલવાને વણા સમયથી હું ઉત્સુક હતો.  
કેવલી લગવાન પાસેથી આપણા પૂર્વ લવની હકીકત  
જાણી ત્યારથી હું એવા વિદ્યાધરના મૈધ્યથીમાં સુખી હોવ્યા  
છતાં પણ કષણ વારે તને ભૂલ્યો નહિ. ને અવસર મેલદી  
આજે તને ભલવા આવી પહોંચ્યો છું. ”

હરિવેગનું વચન સાંભળી કુમાર બોલ્યો. “તમારા સરખા સજજન પુરુષોનું સૌજન્ય કહેવાને કોણ સમર્થ છે? પરંતુ મારે તો આજે સુવર્ણનો સૂર્ય ઉદ્ઘય પામ્યો. અત્યારનીજ વેલા સુઅકારક થઈ કે જે વેલાએ આપણો સમાગમ કરાયો.”

ધણા સ્નેહવાળા એ અન્નેને જાણી રાજ સુરપતિ વિચારમાં પડ્યો છતો બોલ્યો. “અરે! તમારે અન્નેને આવો સ્નેહ સંબંધ કયાંથી?”

એ પ્રક્રિયા જવાખમાં હરિવેગ પૂર્વના સમગ્ર લખ કહી સાંભળાવ્યા. કુમારે પણ એ વાતમાં અનુમતિ આપી. એ કથન સાંભળી આદ્ધણોથી સંયુક્ત રાજ પણ જૈનધર્મમાં પ્રીતિવાળો થયો. નગરમાં પણ ઉદ્ઘોષણા કરાવી કે “જૈન ધર્મ પૃથ્વી ઉપર જયવંત છે.”

એ દરમિયાન આમાનુથામ વિહાર કરતા કેવલી ભગવાન શ્રીગુણસાગર કેવલી એ નગરના ઉધાનમાં સમવસર્યા. તેમના આગમનથી હષ્ઠીત થયેલા નૃપાદિક સર્વે ગુરુને વાંદવાને આવ્યા. કેવલી ભગવાનને બધા નમસ્કાર કરી ધર્મ સાંભળવાને બેઠા. ભગવાને પણ પાપનો નાશ કરનારી દેશના આપી.

“જીતમ, જરા અને મૃત્યુ રૂપી કલ્લોલોથી લયંકર આ સંસાર સમુદ્રમાં આપહાર્ય ભગરોથી ચીડા પામી રહેલા તમારા સરખા પ્રાણીઓના રક્ષણ માટે સર્વજ્ઞ ભગવાને કહેલ ધર્મરૂપ નાવ-વહાણુજ સમર્થ છે. ચિંતામણિ, કામધેનું, કદ્યવૃક્ષ અને કામકુંલ હુંએ કરીને પ્રાત્મ થયેલી એ વસુએનું તમે યતનાથી રક્ષણ કરો છો. તો એ થકીપણ અધિક મૂલ્યવાન એવા ધર્મને વિષે ઉધમ કેમ કરતા નથી?

અરે ! કદમ્પવૃક્ષનું ઉન્મૂલન કરી રહુછિ (થાર)ને કોઈ વાવે ? ચિંતામણિને ઘઢલે કોઈ કંદરા-પત્થરાને અહૃણ કરે ? તેમજ અમૃતનો ત્યાગ કરી તેને ઘઢલે કોઈ વિષપાત કરે ? તેવીજ રીતે કોઈ હુર્મતિ પુરુષ જ અર્હત ધર્મનો ત્યાગ કરી મિથ્યાધર્મને અંગીકાર કરે.

ગુરુના ઉપદેશ વગર એવા શુદ્ધધર્મની પ્રાપ્તી થતી નથી. એ તત્ત્વત્રચીના ઉપદેશક ગુરુ મહારાજ જ હોય છે. જેમ જલ વગર કમલ હોતું નથી, સૂર્ય વગર દ્વિવસ શું હોએ શકે ? તેવી રીતે સ્વર્ગ અને મુજિને આપનારો ધર્મ ગુરુ વગર ન હોએ શકે, તો ગુરુના સમાગમે એ સંસાર સમુદ્ધથી પાર ઉતારનાર હુર્મલ જૈનધર્મ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી તેને આરાધવાનો હે ભવ્ય પ્રાણીઓ ! તમે પ્રયત્ન કરો !”

કેવળી લગવાનની દેશનાથી વૈરાગ્ય પ્રામેલા રાજ-એ પદ્મોત્તર કુમારને રાજ્યે સ્થાપન કરી લગવાન પાસે દીક્ષા અંગીકાર કરી, ને પદ્મોત્તર રાજાએ શાવકધર્મ અંગીકાર કરો.

વિદ્યાર્થ ચક્કવર્તી હરિવેગ રાજાએ પદ્મોત્તર રાજને વૈતાદ્ય પર્વત ઉપર પોતાના નગરમાં તેડી લાખી ઝુણ આગતા સ્વાગતા કરી. પૂર્વના અપૂર્વ પ્રેમથી વશ થયેલા હરિવેગની લક્ષ્ણિમાં તે શ્રી ન્યૂનતા હોય ?

“હે મિત્ર ! આ માર ઘણે શ્રેણિનું રાજ્ય અને પરંપરાથી આવેલી-પાપ થયેલી વિદ્યાઓને અહૃણ કરી મને કૃતાર્થ કર !”

હરિવેગની વાણી સાંભળી પદ્મોત્તર બોલ્યો “તારા ને મારામાં શું અંતર છે ? તારં રાજ્ય તે મારં છે ને મારં તે તારં છે. હુર્મલ એવો જૈનધર્મ આપીને તેં મને શું

નથી આપ્યું ? એનાવડે પ્રામ થતુ ખુદ મોક્ષનું સામ્રાજ્ય તો તે મને આપ્યું છે, કારણું ધર્મના ઉપદેશ કરનારા પુરુષો જગતમાં હુર્લબ હોય છે તો હે મિત્ર ! આપણે સાથે રહીને બ્રતે રાજ્યને ભોગવીયે, જ્યારે રાજ્ય ભારને સમર્થ પુત્ર થાય ત્યારે એને રાજ્યમાં સ્થાપન કરી આપણે સાથે જ દીક્ષાને આદરશું.”

પદ્મોત્તર રાજુનું વચન હસ્તિવેગે અંગીકાર કર્યું “હે મિત્ર ! ભારા મનમાં જે વાત હતી તેજ તમે કહી.” તે પછી બ્રતે મિત્રો સાથેજ રહીને રાજ્ય ભોગાને ભોગવવા લાગ્યા.

#### ૫

### ચારિત્ર અંહણ

હસ્તિવેગ એને પદ્મોત્તર રાજ બ્રતે સાથે રહીને ધર્મ કર્મ પણ પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. મહાવિદ્યાદિક ક્ષેત્રમાં જધને શુનેશ્વરોને વંદન કરી તેમનો ધર્મોપદેશ સાંસલતા હતા નાદિશ્વરકીપાદિના શાશ્વતા ચૈત્યોમાં તેઓ યાત્રા, પૂજાદિક બહુ ભક્તિથી કરવા લાગ્યા, જગતને આશ્ર્ય-કારી એવા બ્રતે રાજ્યાને ભોગવતા એને સુખમાં પોતાનો ડાલ નિર્ગમન કરતા તેઓ ચૈત્ય એને સાધુની પ્રત્યનીકિતાને નિવારતા મોદ્ય પ્રભાવક થયા. ને જૈનધર્મની અપૂર્વ સેવા બળવી ધર્મની પ્રભાવના કરી.

આવક ધર્મના ઉદ્ધાર માટે તેમણે પોતાની સમૃતિનો વ્યય કરી નાશ્યો. જગતસરમાં ગરીબ આવકની શાશ્વત કરતાં પણ જરૂર નહિ, પ્રજાને પણ કર વગરની કરી સુધી કરી. એ રામરાજ્યમાં લોકો મહા આનંદને પામ્યા. ચોરી, જારી વિજારીને। લય નાખું થધ ગયો, આલણો પણ જેન

ધર્મને વિષે આદેવાળા થયા, ધર્મતું આરાધન કરતા જન ધનાદ્યોને જોઈ અન્ય લોકો પણ તેમની અનુમોદના કરતા આસન્ન યોગ્યિતાભવાળા ને મત્સર રહિત તે અન્ને સરળ સ્વભાવી થયા.

અન્યદી રાજ્યભારને ધારણ કરવામાં સમર્થ તે અન્ને મિત્રો ગર્જનપુર નગરે આવ્યા, ત્યાં શ્રીમંત જૈનો જૈન પ્રાસાદને વિષે મહાપૂજાઓને રચાવતા, ગીત, ગાન, વાહિન અને નાટકાહિયડ મહાભક્તિથી મોદો મહોત્સવ કરતા હતા, એ ઉત્સવને જોઈ લોકો પણ પરમ આનંદને પામતા હતા.

આ અન્ને મિત્રો-રાજાએ પણ મોટી સમૃદ્ધિયડ જીનભવનમાં આવ્યા, લગ્નવાનની પૂજાને જોઈ પરમ સંતોષને ધારણ કરેનારા થયા થક લગ્નવાનની સહૃતિ કરવા લાગ્યા, સહૃતિ કરીને અન્ને રાજમિત્રો ચૈત્યથકી પોતાના સ્થાનકે ચાલ્યા ગયા.

માર્ગમાં હુણથી મહીન એવા કોઈ પુરુષને ખાંધીને ભારતા અને બિલત્સ શાખદ્વારી નવાજતા કેદલાક પુર ઘાને જોઈ રાજાએ હાકેટયા, “અરે મારો રાજ્યમાં આ શું અન્યાય ?” રાજાએ એ પુરુષને પોતાની પાસે યોલાવી મંગાઈયો.

રાજાની પાસે રહેલા એ પુરુષને જોઈ એને તાડના કરેનારા પુરુષો યોલ્યા, “હેવ ! નવકોડ દવ્યના, સ્વામી વર્ષણ શેઠનો આ પુત્ર આપણાજ નગરનો એ વ્યવહાર રીચો, પણ જુગારના વ્યસનમાં રક્ત થયેલા તેને તેના પિતાએ ઘણો સમજાઈયો, છતાં એ વ્યસનમાં આ કુલાંગાર વષું દવ્ય હારી જવાથી પિતાએ એને ઘર બ્યાદ કાઢી મુક્યો. તો પણ છતના વ્યસનથી આ વિરામ પામ્યો, નહિ.

હાથ અને પગને પણ છોડમાં મુક્કીને રમતો, ને હારી જતો ત્યારે કંઈ પણ આપતો નહિ એવી રીતે જુગા-રીજીથી પીડા પામતા ; આને સાતવાર એના પિતાએ દ્રવ્ય આપીને છોડવ્યો અનેક શપથ (સોગાન) પૂર્વક પણ એ દુતથી વિરામ પામ્યો નહિ, જે એ દુતમાં જીતી જતો તો કોઈની પાસે કંઈ પણ રહેવા હતો નહિ ને હારી જતાં તે નારી જતો હતો. હાલમાં એક લાખ દ્રવ્યનું પણ કરી રમતાં હારી જવાથી તે અમારા પંજામાંથી છદ્ધી ગયો. પણ એમે એને પકડીને અમારા લાખ દ્રવ્યની માંગણી કરીએ છીએ. છતાં તે આપતો નથી. માટે હે હે ! દુરા-ચારી એવા આપ છોડી દો.”

એ લોકાની વાણી સાંભળી રાજ વિચારમાં પડ્યો. “ અહો ! કર્મનો કેવો પરિણામ છે ? અજ્ઞાનની આવી ચૈષ્ટાને ધિક્કાર થાએ.” એમ વિચાર કરતો રાજ બોલ્યો. “ જે આ પુરુષ સાથે જુગાર રમશે તેને મહા ફંડ થશે.”

એક લાખ દિનાર પોતાનાં લંડારમાંથી માંગાવી પેલા પુરુષેને આપી તેમના પંજામાંથી મુક્ત કરી હરિવેગ સાથે રાજ રાજપ્રસાદ તરફ ચાલ્યા ગયા.

વૈરાગ્યવાન રાજ હરિવેગ વિદ્યાધરે દ્રને કહેવા લાભ્યા. “ સાધે ! આ જુગારી મૂર્ખ છે. જુગારના વ્યસનથી વારં-વાર પીડા પામ્યા છતાં તે જુગારને છોડતો નથી. એરે પણ એનો શું શોડ કરવો એના કરતાં આપણી સ્થિતિ કુદલી સારી છે તે ? સંસારની અસારતા જણવા છતાં પણ પ્રમાણના વશ થકી અશુચિથી ભરેલા એવા લોગોમાં આપણે પ્રીતિ કરીએ છીએ. દુતકારનું નિધ કર્મ કેમ જગત નિદે છે તેમ સંસારી પુરુષાનું વિષયસેવન પણ જ્ઞાની પુરુષોએ નિદ્દિંબ જ છે. જેમ મોયા કષ્ટથી ઉપાર્જન કરેલું

દિવ્ય જુગારી શીધતાથી જુગારમાં હારી જાય છે તેવી રીતે પૂર્વે ઉપાજ્ઞન કરેલું સુકૃત વિષયના સેવનથી પુરુષ હારી જતો નથી શું ? આ જુગારીને અનેક રીતે સમજાવવા છતાં તે જુગારને છોડતો નથી. તેમ આપણે પણ ચુડ મહારાજનો બહુ ઉપદેશ સાંભળવા છતાં પણ વિષયથી વિરામ પામતા નથી. આ જુગારીને આ લોકમાંજ અંધનાહિ કષ્ટ પ્રાપ્ત થાય છે તેવી રીતે આપણને નરકમાં વધણાંધનાહિ પ્રાપ્ત થશે. માટે હે વયસ્ય ! આ હુંઘુર્ણું સંસારમાં આત્માને ડુખાવવો આપણને ચુક્તા નથી.”

પદ્મોત્તરપની વિરક્ત વાણિ સાંભળી હરિવેગ બોલ્યો.  
“હે મિત્ર ! મારી ઈચ્છા-આવના પણ વણા કાલથી સંયમ અહણ કરવાની છે. પણ તમારો સ્નેહ મને પ્રતિઅંધ કરે છે.”

સંયમની ભાવનાવાળા તેઓ અન્તેએ પોત પોતાના પુત્રને રાજ્યપહે સ્થાપન કરી રેલાકરસૂરી ગુરુની પાસે દીક્ષા અહણ કરી, અનુકૂળે તેઓ બાર અંગને જાણુનારા થયા. તેમનું ચારિત્રે પાલન મોટા મહિંદ્રિયાને પણ અનુભરવા યોગ્ય થણું. એવી રીતે નિરતિયાર પણે ચારિત્ર પાલતા ને છુંદ, અહુમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ અને માસ-ક્ષમણુની તપસ્યા કરતા તેઓનાં શરીર તદ્દન કુશાંગ બની ગયાં.

અંત સમગ્રે તેમણે—એ અન્ને મહાબુનિયોએ સંલેખના કરી—અતિરાન કરી દીધું. પાપની આદોયના કરતાને શુદ્ધ ધ્યાનમાં પરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર રહેવા તેઓ મનુષ્યનું આથુ પૂર્ણ કરી મધ્યમ ગ્રૈવેયકે—પંચમ ગ્રૈવેયકને વિષે સત્તા-વીસ સાગરોપમના આયુષ્યવાળા મિત્રદેવ થયા—અહું શુદ્ધપણાને પ્રાપ્ત થાયા.

ગ્રૈવેયકના દેવતાએ પોતાનિ દિવ્ય લુભી છાડીને

અન્ય સ્થળે જવાના સ્વભાવવાળા હોતા નથી. પોતાના વિમાનમાં રહ્યા થકા જેના સકળ મનોરથા સિદ્ધ થાય છે. આ લોકમાં પણ બાર દેવલોકથી ઉપરના દેવતાઓનું આવાગમન હોતું નથી. તેમજ સ્વામી સેવક રહિત ત્યાં સુર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં સમાન ઝડદિં સિદ્ધ વાળા હોય છે ગમે તેવી દિવ્ય શક્તિએ છતાં તેમને શક્તિ ફોરવવાની-પ્રગટ કરવાની જરૂર પડતી નથી. શાસ્ત્રની વ્યાતમાં સંદેહ પડે છે તે વારે પોતાના વિમાનમાં રહ્યા રહ્યા કેવલી લગભાનને મનોરથાણા કારા પૂછીને સમાધાન કરી લે છે. દેવાંગનાઓનો સહનાસ ન હોવા છતાં તેમને અનંતગણું સુખ હોય છે. લગભગ એ હાથના શરીરવાળા તે દેવતાઓ પોતાના વિમાનમાં દિવ્ય સુખેને આગવતા જતા એવા કાળને પણ જાણતા નથી.

પદોત્તર રાજ અને હરિદેવ વિદ્યાધરેંદ્ર પોતાના અપૂર્વ ચારિત્રના પ્રભાવથી એવી અતુપમ સમુદ્ધિવાળા અહું ઈદ્ધના સામર્થ્યપણુંને પ્રાપ્ત થયા. એ દેવતાઓના અતુપમ સુખેનું વર્ણન આપણે મળુંદો શું કરી શકીયે? કેટલું કરી શકીયે? આપણે તો એટલું જ કહી શકીયે કે તેમને એક થીજથી અનંતગણું સુખ, સૌભાગ્ય અને સમુદ્ધિ હોય છે.

ખરિચઠેદ ૮ મે।  
ગિરિસુંદર અને રત્નસાર.

૧

રાજકુમાર ગિરિસુંદર

વર્ષમાન જિનો જીયાદુ વર્ષમાન ગુણાન્તિ:  
વર્જાતે સંપ્રતં યદ્ય, શાસ્ત્રતં પાપનાશનસૂ ॥૧॥

## પરિચ્છેદ ૮ મો

ગિરિસુંદર અને રત્નસાર.

૧

રાજકુમાર ગિરિસુંદર

વર્ધમાન જિનો જીયાદુ વર્ધમાન ગુણાન્વિતः ।

વર્તતે સાંપ્રતં યસ્ય, શાસનं પાપનાશનમ् ॥૧॥

ભાવાર્થ-તીવ્ર પાપને નાશ કરેનારું જેમનું શાસન કાલ જ્યવંત વર્તી રહ્યું છે, તેમજ વૃદ્ધિ પામતા ગુણોના સમુદ્ર એવા યરમ તીર્થપતિ વર્ધમાનસ્વામી જ્યવંત રહેણું.

પૃથ્વીને વિષે તિલક સમાન પુંદ્રપુર નગરનો અવિપત્તિ શ્રીભૂત નામે પરાકર્મી રાજ હતો. એ રાજને શાંખભૂત નામે નાનો ભાઈ ચુવરાજ હતો. તેમને સુલક્ષ્મણા અને લક્ષ્મણા નામે એ રાણીએ હતી. રામ અને લક્ષ્મણની માડુક રાજ્ય કરતા તેઓ સ્નેહથી સાથે રહેતા હતા. સુખમાં કેટલોક સમય વ્યતીત થયો. ત્યારે પદરાણી સુલક્ષ્મણાની કુક્ષીને વિષે પદ્મોત્તર રાજનો જીવ છૈવેયકથી ન્યવીને ઉત્પન્ન થયો. તે સમયે પદરાણી ઉન્તત એવા મેર ગિરિને જોઈ જાગ્રત થઈ.

રાજની આગળ સ્વમ્ભ નિવેદન કરતાં રાજયે કહ્યું. “મેરના જેવો ગંભીર અને સ્થિરતાવાળો તમારે પુત્ર થશો.” ગર્ભનું પાલન કરતાં રાણીને યથાસમયે પુત્રનો પ્રસવ થયો. રાજયે પુત્રનો જન્મોત્સવ કરીને સ્વમને અતું સારે તેનું નામ રાજખું ગિરિસુંદર.

રાજકુમાર યુવાનવયમાં આવ્યો તે દરમિયાન રાજના લધુભાતા શતાબ્દી યુવરાજની રાણી લક્ષ્મણાની કુક્ષિને વિષ હરિલેગનો જીવ સ્વર્ગથી અય્યી ઉત્પન્ન થયો તે સમયે સ્વમ્ભમાં રતનો દગ જોવાથી એ પુત્રતું નામ રાણ્યું રેનસાર.

ઘને રાજપુત્રો ભાણીગણી કલ્પામાં પાવરથા થઈ યૌવનવયમાં આવ્યા, એમનો પરલવનો સ્નેહ સંખ્યાંથી પણ અહીંયાં વૃદ્ધિ પામવા લાગ્યો. સાથે આતા, સાથે પીતાને સાથે કીડા કરતા તેમજ તેઓ શયન પણ સાથે કરતા. ક્ષણુમાત્ર પણ તેઓ એક બીજાનો વિદ્યોગ સહેત કરી શકતા નહિ. એ નાના બાળકોના અપૂર્વ સ્નેહ સંખ્યાંથી રાજ અને યુવરાજનો સ્નેહ પણ જાખવાણી પડી જતો હતો કારણું કે ભવાંતરના જે જે સંસ્કારોને પોપણ મળ્યું હોય તેને ભવિષ્યમાં સારી રીતે ફાલવાની-ભીલવાની તક મળે છે.

અન્યદી છીંઠીસ રાજકુળથી શોભતો રાજ સલા ભરી એડા હતો ત્યારે નગરદોકાએ આવી પોકાર દીધ્યા. “હે સ્વામી ! તમે જ્યવાંત છતે પણ અમને નગરમાં ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. કોઈક ચોાર હરરેાજ નગરમાંથી કન્યાએ અને દ્વયને ચોારી જાય છે. છતાં પકડાતો નથી પણ કન્યાએની કરુણ ચીસો જ માત્ર સંભળાય છે.”

નાગરિકોનો પોડાર સાંલળી રાજએ કોપથી જાન્યદ્યુ-આન થઈ કોટ્યાલને હુક્કેય્યા. “અરે પામર ! તું મારો ખગાર ખાદ મારી નગરીની આવી જ રક્ષા કરે છે ? રાત્રેને સમયે તું શું નિરાંતે ચારે છે કે જેથો ચોારે નિડરપણે નગરીને લુટે છો.”

“હેવ ! આ વાત સાંલળતાં મને પણ કાજ આપે

છ. રાત્રીએ સુલદો ખડે પગે નગરીની રક્ષા કરે છે. દૃવા-  
ભાગે પણ બરાબર ખંધ કરવામાં આવે છે. જરોક પોકર  
સાંભળતાં હું અને મારા સુલદો હોડહોડ કરીયે જીએ  
છતાં તે પકડાતો નથી-નજરે પણ પડતો નથી.” તત્ત્વ  
રક્ષકની વાણી સાંભળી રાજ વિચારમાં પડી ગયો.

રાજ અને રાજસભાની ભારે મુંજવણું જોઈ રાજ-  
કુમાર ગિરિસુંદર હાથ જોઈ રાજને કહેવા લાગ્યો. “હું !  
મને આજ્ઞા આપો તો સાત રાત્રી સુધીમાં એ દુરાચાર્યને  
ગમે ત્યાંથી પકડી આપની સામે હાજર કરીશ. “રાજકુમારની  
વિનંતિ સાંભળી રાજ બોલ્યો. “હું ! તારા જેવા  
ધારાદુર્ઘટી આ હરાણી પકડાય તહીં જે કાર્યમાં અમારો  
જેવા પ્રથળ પુરુષો પણ મુંજાધ ગયા છે. એવા હુંસાધ્ય  
િયમાં તને ચોજવો ચુક્તા નથી.”

“ છતાં પણ હે પિતાજ ! તમે મને આજ્ઞા કરો  
સિહેનોસુત બાળકપણામાં ગંભેરનો મહ ઉતારી નાખો છે  
એ શું આપ જાણતા નથી ? “રાજકુમારનો અતિ આગ્રહ  
છતાં રાજએ તેને રાજ આપી નહિ. તો પણ રાત્રીને સમુદ્રો  
અઝૂગને ધારણું કરી કુમાર ચોરની તપાસ માટે રાજમહેલા-  
માંથી નિકળી ગયો. ગુમ્પપણે તગરમાં અને નગર બહાર  
ચોરની જેમ તે ભામજા લાગ્યો.

નિર્ભયપણે ભમતો ગિરિસુંદર પર્વતની ગુકામાં, ખંડ-  
ચોમાં, જર્ણી દેવાલચોમાં તપાસ કરતો રહડતો હતો, ત્યારે  
પર્વતની અંદર અમિત પ્રજન્મલતે જોઈ રાજકુમાર પર્વતની  
મધ્યમાં ચાઢ્યો ગયો.

પર્વતની મધ્યમાં ડોઈક વિદ્યાબર અમિતંડમાં કાળજી  
અગટાણી ગુણાલની ગોળીએ હોમતો વિદ્યા જાણી રહ્યો  
હતો. તેની પાસે જઈને ‘સિદ્ધિરસ્તુ’ કુમાર બોલ્યો. જેણો

તેના પુષ્યથી આકષરિયેલો ક્ષેત્રપાલ વિદ્યાધરની આગળ પ્રગટ થઈ ને બોલ્યો, “હે વિદ્યાધર ! આ મહાપુરુષ ભાગ્યવાનનું આગમન ન થયું હોત તો તારી વિદ્યા સિદ્ધ ન થાત બદકે કંઈક તારું હું અનિષ્ટ કરત, પણ હવે તો આ પુષ્યવાનના પ્રભાવથી તને હું સિદ્ધ થાઉં શું. “યક્ષના વચનથી વિદ્યાધરે ખુશી થધને યક્ષની પૂજા કરી. “હું જ્યારે યાદ કરું ત્યારે તમારે હાજર થયું.” એમ કહીને યક્ષને રજ આપી, તે પછી વિદ્યાધર રાજકુમારને કહેવા લાગ્યો.

“હે મહા સત્ય ! તારો મારી ઉપર મહાન ઉપકાર થયો. તારા પ્રભાવથી મારું કાર્ય સિદ્ધ થયું. તો કહે ! તારું શું કાર્ય કરું ?” વિદ્યાધરની વાણી સાંભળી કુમાર બોલ્યો. “નગરની રક્ષા કરતાં પર્વતમાં અભિ સળગતો જાણી કૌતુકથી હું તો અહીં આવ્યો હતો છતાં એમાં પણ તમારી મંત્રસિદ્ધ થઈ તો સારું થયું એ તો !”

ઇચ્છાવગરનો કુમારને જાણી નવાધ પામતો વિદ્યાધર બોલ્યો. “એમ ના બોલ ! તું તો મારે ગુરુ રથાનકે છે. માટે કંઈક માગ ! જો કે ગુરુ આજ્ઞા ખંડન કરવી પાપ છે છતાં મારી પાસેથી રૂપ પરાવર્તની વિદ્યાને અહૃષુ કર. એમ કહીને પાઠસિદ્ધરૂપ પરાવર્તની વિદ્યા રાજકુમારને આપી.

એ સમયે “હા તાત ! હા તાત ! હે માતા ! મારું રક્ષણ કરો ! એવો કોઈક સ્થિતિ ઇદ્દનદ્વારનિ કુમારના કર્ણે અંશદાયો. શાશ્વતને અનુસારે કુમાર તે તરફ દોડ્યો ને તપાસ કરી છતાં કોઈપણ દેખાયું નહિ. “એ વાણી ગુઝાવાળા આ પર્વતમાં છુપાયેલા પાપી શરીરી રીતે જણાય ?” વિદ્યાર કરી કુમારે એક નિશ્ચય કર્યો.

૨

## ચોર નિથડ

પ્રાતઃકાળ થઈ ગયો હતો. સૂર્ય આકાશ મંડલમાં પોતાની સુસાફરી શરૂ કરી દીધી હતી, તે સમયે એક નવોદા મનમોહન સુંદરી નિહરપણે પર્વતની ગુફામાં પરિ-ભ્રમણ કરી રહી હતી. એક ગુફામાંથી બીજી ગુફામાં ભરતી એ રમણીએ વનકુંજની અંદર રહેલા દેવમંદિરમાંથી અયંકર વેશ ધારી કોઈ કાપાલિકને નિકાલે જોયો. ફરીથી આવતા એ અયંકર કાપાલિકને જોઇ વિચાર કરીને એ લલના પથ્થરની શિલા ઉપર વિશ્રામ લેવાને એઠી. જણે કાપાલિકના આગમનની અધર જ ન હોય એવી રીતે તે મહાદુઃખી અને ઉદ્ઘાસ વદનવાળી થઈ છતી રહેન કરવા લાગી.

મંદમંદ ડગલાં અરતો ને રહેન કરતી ચંદ્રવદનાને જોતો કાપાલિક એની પાસે આવ્યો. એ મનોહર આળાને જોઇ એના રૂપના જાહીથી સ્થંભિત થઈ ગયેલો. કાપાલિક આવ્યો. “હે સુંદરી ! હુષ વિધાતાએ તને દુઃખી કરીને શી મજા માણી હશે ! આ વનમાં હું એકદી કેમ છે ? શા માટે રહેન કરે છે ? કહેતારા સુખને માટે હું શું કરું ? ”

“યોગીંડ ! તમારી આગળ સત્ય વાત કહીશ. સુશર્મનગરના રાજનો કુમાર પિતાથી અપમાનિત ઘઢને પરદેશ ચાલ્યો, તેની પતની હું સર્વેની મના છતાં તેની સાથે ચાલી નિકળી, ગાઈ રાત્રોએ આ શીલા ઉપર અમે સુધ ગયાં તે સમયે મને નિદ્રિત જાણીને મારો ત્યાગ કરી તે જતો રહ્યો, જતાં જતાં મારો પતિ આ એની તલવાર પૂણ લૂલી ગયો. એ દુઃખથી હું રહેન કરું છું કે એકાડી

પરદેશમાં મારં હવે શું થશે.” એ રમણીની વાર્તા સાંભળી ચાંગી બોલ્યો.

“હે સુલોચને ! વરાક જેવો એ તને છેતરીને નાશી ગશો. તું તો શાણી અને સમજુ જણાય છે. માટે ઇદ્દન કર્મિણા નહિ તે મારી સાથે ચાલ.” સુંદરીએ કાપાલિકનું વચ્ચેન એંગીકાર કરવાથી કાપાલિક એ મનમોહનાને લઈ દેવકુલિકા તરફ પાછો વજ્યો. એ દેવમહિરમાં થને જણ આંદ્યા, મૂર્તિવિનાના શૂન્ય મંહિરમાં, પ્રવેશ કરી કાપાલિકે પાંદ પ્રલાર કર્યો ને એક ગુપ્ત દ્વાર ઉઘડી ગયું. દ્વારમાં એક ઇપસુંદરી નજરે પડી. કાપાલિકે પોતાની સાથે આવેલી રમણીને કહ્યું. ‘તું પણ આ સુંદરી સાથે દેવનું આરાધન કરો. હું પૂજનો સરસામન લઈને થાડી વારમાં આવી ખણંચીશ.’ એ નવીન સ્વીને ગુજરાતમાં પ્રવેશ કરાવી ગુજરાતનું દ્વાર બંધ કરી કાપાલિક ચાલ્યો ગયો. ગુજરાતમાં પૈલી સ્વીન્યા એ દૃષ્ટના જવાથી આનંદ પામી હૃદય બોલી વાત કરવા લાગી.

કાપાલિકના જવા પછી દ્વાર ઉઘાડનારી સ્વી બોલ્યો: “સખી તું આ રાક્ષસના પંજામાં શી રીતે આવી ?”

“મારી વાત રહેવા હે, પ્રથમ તું કહે કે સખી ! એં પુષ્પ કોણ છે ? અને તું અહીંયાં શી રીતે એના સંકંચનમાં આવી ?”

“હે સખી ! દંડ્યાલ નામે આ વિદ્યાવાળો મહાન ચોર હિવસે કાપાલિકના વેષે નગરમાં બધે લમે છે ને રાત્રીને સેભય આ નગરીના વનિકોનાં દ્રવ્ય અમે ઇપવાન કન્યાઓને લુંદી જાય છે. બધું દ્રવ્ય અને કન્યાઓ આ પાતાલ શૃંહમાં એ દુષ્ટ એકઢી કરેલી છે તારા સહિત એકસોઓઠ કન્યાઓ. એણે લેણી કરી છે એં નગરીના દૃથ્યર શોઠની

હું કન્યા છું. મહાઅલવાન રાજ અને યુવરાજની સુખમય જ્ઞાયામાંથી પણ આ હુષ અમને ઉપાડી લાવે છે. શું કરીયે દુનિયા બળવાનથી પણ બળવાન છે, ” એ ઓછીકન્યા સુલદાની વાત સાંભળી રમણી બોલી.

“ પણ સખી ! આ બધું પરાક્રમ એ કોની સહાયથી કરે છે ? શું કોઈ દૈવની સહાય છે કે કોઈ વિદ્યાના બળો નગરીને તે લુંટે છે ? ”

“ એમાંનું હું કાઈ જાણતી નથી પણ દરરોજ એ હુષ એક અદ્ગરલની પૂજા કરે છે. ” શેઠની કન્યાની વાત સાંભળી પેલી રમણી બોલી.

“ એ અદ્ગ મને બતાવ. ” તેણીએ કહ્યું.

પછી તો તે બાળા આ નવી રમણીને લઇ પાતાલ શૃહમાં અંદર ચાલી એ મણી માણેક અને સુવર્ણ તેમજ ધન જ્ઞાનથી પાતાળ શૃહ જોતાં તે બન્ને પેલા અદ્ગરલન પાસે આવી પહોંચ્યા. તે ચંદ્રહાસ અદ્ગને જોઈ પેલી નવીન સ્ત્રી ઝુશી થઈ તેને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી.

સ્તુતિ કરીને તેણીએ એ અદ્ગને ઉપાડી લીધું ને એ અદ્ગને સ્થાનકે પોતાનું અદ્ગ શુકી દધ ત્યાંથી પાછી ફરી. નવીન રમણીનું આ કૃત્ય જોઈ બધી કન્યાએ હાહાકાર ફર્યા લાગી. “ સુખી ! આ હુષને તારા કૃત્યની અખર પડતાં જ તને યમના મંહિરમાં રવાના કરશે. મારે અદ્ગને પાછું હતું તેમજ શુકી હે. નહીંતર તારી સાથે અમારી પણ ઠી વલે થશે. ”

એ કન્યાએનો કલકલાઈ સાંભળી આગંતુક રમણી-સુંદરી બોલી. “ સખીએ ! ગલસરશો નહિ. આ અદ્ગ સાથેનું મારું ડોતુક જરી જુએ. તો અરી. ધીરજ ધરે. ને

શું થાય છે તે જરી જોયા કરો. ” એ નવી રમણી ધીર-  
જથી બધી કન્યાઓને સમજાવતી હતી તે દરમિયાન યોગી  
આવી પહોંચ્યો. એ યુસ્ત ક્ષાર ઉઘડતાં તે અંદર દ્વારા  
થયો. ભયલીત થયેલી સર્વે કન્યાઓ આતુરતા પૂર્વક  
નવીન રમણીને જોવા લાગી. નવીન રમણીના હાથમાં  
પોતાનું દિવ્ય ખંગ જોઈ યોગી ચમક્યો. રક્ત નેત્રને ધારણ  
કરી કોષને વરસાવતો યોગી ખંગ અહેણ કરવાને એકદમ  
પેદી નવીન રમણી તરફ ધસ્યો.

પોતાની તરફ ધસી આવતા ચોરને નવી રમણીએ  
હોકેયો, “ ખારદાર ! ” શીધતાથી એનું ઇપ પરાવર્તન  
થઈ ગયું ને મૂળ સ્વરૂપે રાજકુમાર તરીકે ચંદ્રહાસ ખંગને  
ધારણ કરેલો પ્રગટ થયો. એ સ્વીમાંથી આ નવજવાન  
રાજકુમારને જોઈ યોગી ચાંક્યો. “ તું કોણ ? ”

“ તારો કાળ. ” ઐસો નવ જીવાન બોલ્યો. આ  
માયાવીને જોઈ બધી બાળાઓ પણ તાળું થઈ ગઈ.

પછી તો ચોર એને કુમારનું ભયંકર ચુદ્ધ થયું. એ  
ચુદ્ધમાં કુમારે ચોરને ચંદ્રહાસ ખંગના ધા વડે મારી  
તાણ્યો. કુમારના પરાક્રમથી અનિમેષ નથને જોતી કન્યાઓ  
વિસ્મય પામી. “ આ પરાક્રમી કોણ હશે ? ”

ચોરના ચુદ્ધમાંથી પરવારી રાજકુમાર બોલ્યો.  
“ બાળાઓ ! તમને તમારા સ્થળે પહોંચાડવા માટે કહો  
હું શું કરું ? ”

શ્રેષ્ઠીતનયા સુલદાએ રાજકુમારને એણાભી સર્વે  
કન્યાઓ આગળ તે વાત જાહેર કરી હીથી. ચોરના નાશથી  
સર્વે કન્યાઓ રાજ થઈ હતી. તેમાંથી પોતાની જ નગરીના  
રાજકુમારને પોતાની સહાયે આવેલા જણી અધિક ઝુશી  
થઈ હતી સર્વની સંમતિથી સુલદા બોલી.

“રાજકુમાર! અમારા સ્વજન વર્ગને મુખ બતાવવામાં અમને શરમ આવે છે માટે અમને બધાને આ નરકાગારમાંથી મુક્ત કરનાર તમારું જ અમને શરણ છે, અન્યથા અભિ, પણ અન્યવરને અમે વરશું નહિ.”

સર્વે કન્યાઓનો નિશ્ચય જાણી કુમાર વિચાર કરવા લાગ્યો. “દુષ્ટ વિધિને વિકાર થાયો. કે નેણે આ બાળાઓને વિદ્યનામાં નાખી. આ બધી અભિ શરણ થાય, એ પાપ હું શી રીતે લઘ શાડું? અદ્દે અત્યારે તો એમની ધૂઢુણ સર્કણ થાયો.”

એ સર્વે કન્યાઓ સાથે વિવાહ કાર્યથી પરવારી તેમની સાથે વિવિધ ડીડા કરતો કુમાર એક માસ પર્વત એ પાતાલ ગૃહમાં રહ્યો.

## ૩

## ભાઈની શોધમાં

લધુ બાંધવ રતનસારનો સ્નેહ યાહ આવવાથી એ અથીય પ્રિયાઓને પાતાલ ગૃહમાં રાખીને બહાર નિકાયો. ઇપ પરાવર્તન કરી ગિરિસુંદર નગરમાં આવ્યો. તો શોક વડે આકુળ વ્યાકુળ નગરીને જોવાથી કોઈને પૂછ્યું તો જવાબ મળ્યો કે “રાજકુમાર ગિરિસુંદર ચો઱નો નિશ્ચહ કરવા ગયા તે વાતને એક માસ થયો છતાં એમના કંધ સમાચાર નથી. જેથી તેમને શોધવાને તેમના લધુ બંધુ રતનસાર પણ ગયેલા હોવાથી નગરી સહિત બંધું રાજકુળ શોક સાગરમાં કુણી ગયું છે.”

એ વાત સાંલળી ગિરિસુંદર પણ બંધુ રતનસારને શોધવાને ચાલ્યો. અનેક ગામ, નગર, શહેર, પર્વત વગેરે સ્થાનકે ફર્યો, આખી પૂઢ્યી ઉલ્લંઘન કરી છતાં રતનસારના

સમાચાર ન મળવાથી દુઃખી થયેલો તે કોઈ નગરની સર્વીએ રહેલા દેવકુલમાં આવ્યો, અનેક મુસાફરો ત્યાં ઉત્તરેલા હોવાથી પોતે પણ રાત્રી ત્યાંજ પસાર કરવાનો નિશ્ચય કર્યો.

રાત્રીને સમયે બધા મુસાફરો એકથા થઈ સુઅહુઅની વાતો કરવા લાગ્યા, એ બધામાં એક મુસાફર બોલ્યો. “આરે ભાઈઓ ! હું એક મજેહની વાત કહું તે સાંભળો. અખલ્ખ અમુલ્ખયેલી એ વાત છે. પરદેશનાં અનેક કુતુહલ જોવાને હું ઘરેથી નિકળ્યો, વનચર જીવોથી અળલળી રહેલા કોઈ અરજુયમાં અનુકૂળ આવ્યો. ત્યારે ત્યાં મને એક સ્વરૂપવાન નરનો લેટો થયો એ રાજકુમારની સાથે મુસાફરી કરતાં અમે બજે મિત્રો બની ગયા, અમણ કરતા અમે એક શૂન્ય નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા અમે રાજમહેલમાં ગયા છતાં કોઈ પણ મતુષ્ય-પ્રાણી અમને ભદ્ધું નહિ.

નિશા સમય અમે રાજમહેલમાં જ પસાર કર્યો, ભર-નિશા જમે છતે હું તો નિદ્રાવશ થઈ ગયો. ને રાજકુમારે રત્નસાર જગતપણે માર્દ રક્ષણ કરવા લાગ્યો. ત્યારે મધ્ય-રાત્રીને સમયે એક વિકરાળસિંહ આવી પહોંચ્યો, તેણે રાજકુમાર પાસે મારી માગણી કરી. “હું સુંદર ! હું શુદ્ધાથી મહા પીડા પામું છું માટે તારી પાસે સુતેલા નરને મે આપી હું.”

રાજકુમારે તે માગણી સ્વીકારી નહિ. “આરે સિંહ ! મારે શરણે રહેલાને અપાય નહિ, પણ જો તું જુખ્યો. છોય તો મને ખાઈ જા” રાજકુમાર રત્નસારની વાણીથી વિસ્તય પામેલો સિંહ બોલ્યો.

“હું મહાસત્ત્વ ! ગમે તે હિસાએ પણ પોતાનું રક્ષણ.

ਕਰਿਵੁਂ ਅੰ ਨੀਤਿ ਛੇ ਮਾਟੇ ਤਾਵੰ ਰਕ਼ਖਣੁ ਕੱਦੀ ਆ ਨਰਨੇ ਮਨੇ  
ਆਪੀ ਹੋ॥” ਸਿਹਨੀ ਵਾਣੀ ਰਲਸਾਰੇ ਮਾਨਧ ਕੱਦੀ ਨਹਿ ਨੇ  
ਕਲੁਂ ਕੇ “ਤਾਰੀ ਕੁਥਾਨੀ ਕੇਵਨਾ ਤਾਰੇ ਹੂਰੈ ਕਰਵੀ ਛਾਥ ਤੋ  
ਮਾਰੇ। ਕੋਣੀਧਿਆ ਕੱਦੀਨੇ ਕਰ॥”

ਰਾਜਕੁਮਾਰਨਾ ਸਤਵਥੀ ਪ੍ਰਸਨਨ ਥਥੇਲੇ। ਸਿਹ ਬਾਲਧੇ।  
“ਛੇ ਪਰੈਪਕਾਰੀ! ਮਾਗ, ਕਾਈ ਮਾਰੀ ਪਾਸੇ ਵਰਹਾਨ ਮਾਗ॥”  
ਸਿਹਨੀ ਵਾਣੀਥੀ ਤਾਜੁਭ ਥਥੇਲੇ। ਰਲਸਾਰ ਬਾਲਧੇ। “ਕਿਛੋ  
ਤੋ ਘਰਾ ਲਲਾ ਤਮੇ ਕੋਣੁ ਛਾ॥”

“ਛੁ ਆ ਨਗਰਨੋ ਅਧਿਪਤਿ ਵੇਵ ਛੁ॥” ਸਿਹਨੀ ਵਾਣੀ  
ਸਾਂਕਣੀ ਕੁਮਾਰ ਰਲਸਾਰ ਬਾਲਧੇ। “ਤਮੇ ਅਧੀਕਥਰ ਛਤਾਂ  
ਆ ਨਗਰੀ ਜਨਸੂਨਧ ਕੇਮ ਛੇ, ਤੇਨੇ ਧਤਿਖਾਸ ਕਛੋ॥” ਕੁਮਾ-  
ਰਨੀ ਇਚਿਨੇ ਸਾਂਤੋ਷ਤੇ। ਸਿਹ ਪੋਤਾਨੁ ਸਵੜਪ ਪ੍ਰਗਟ  
ਕੱਦੀਨੇ ਬਾਲਧੇ।

“ਗਾਂਧਾਰਪੁਰ ਨਗਰਨਾ ਰਾਜ ਰਵਿਚਂਦ੍ਰਨੇ ਬੇ ਪੁਤ੍ਰੇ।  
ਛਤਾਂ ਰਤਿਚਂਦ ਅਨੇ ਕੀਰਿਚਂਦ, ਅਨਧਹਾ ਵੈਰਾਗਿਵਾਨ ਰਾਜ  
ਰਤਿਚਂਦਨੇ ਰਾਨਧਪਵੇ ਸਥਾਪਨ ਕੱਦੀਨੇ ਕੀਰਿਚਂਦਨੇ ਖੁਵਰਾਜ  
ਪੁਣ ਆਪੀ ਵਨਮਾਂ ਤਪੁ ਕਰਵਾਨੇ ਚਾਲਧੇ। ਗਧੇ। ਰਤਿਚਂਦ ਪੁਣ  
ਪੋਤਾਨਾ ਘੰਢੁ ਕੀਰਿਚਂਦਨੇ ਰਾਨਧਕਾਰੋਬਾਰ ਸਮਰ੍ਪਣੁ ਕੱਦੀ  
ਗੀਤ ਨੇ ਗਾਨਤਾਨਮਾਂ ਸਮਧ ਵਧਤੀਤ ਕਰਵਾ ਲਾਗਧੇ। ਰਾਨਧ  
ਕਾਲੀ ਕੀਰਿਚਂਦ ਸਾਮਾਂ ਮਾਂਨੀਐਨੇ ਵਸ਼ ਕੱਦੀ ਪੋਤੇ ਰਾਨਧਨੋ।  
ਮਾਲਿਕ ਥਥੇ। ਨੇ ਰਤਿਚਂਦਨੇ ਬਾਂਧੀ ਪੋਤਾਨੀ ਸਾਮੇ ਹਾਜਰ  
ਕਿਥੋ। ਮਾਰਾਓਨੇ ਬਾਲਾਵੀ ਤੇਨੇ। ਸ਼ਿਰਚਛੇਹ ਕਰਵਾਨੋ। ਹੁਕਮ ਕਿਥੋ॥

ਰਾਨਧਲੋਲੀ ਕੀਰਿਚਂਦਨੇ ਸਮਜਿਵਵਾਨੇ ਰਤਿਚਂਦੇ ਖੁਣ  
ਪ੍ਰਯਾਸ ਕਿਥੋ। ਬਾਂਧਵ! ਪਿਤਾਸਮਾਨ ਬੇ਷ ਘੰਢੁਨੇ ਮਾਰੀ  
ਆਪਣਾ ਨਿਰਮਣ ਕੁਣੀਮੇ ਕਲਾਂਕਿਤ ਨਾ ਕਰ। ਆ ਰਾਨਧ ਤਾਵੰਜ  
ਛੇ ਨੇ ਤੁੰਜ ਲੋਗਵ, ਮਨੇ ਝੁਕਾ ਕਰ, ਕੇ ਬੇਥੀ ਪਿਤਾਨਾ ਮਾਰੋ  
ਆਵੀ। ਤਪੋਵਨ ਜਧ ਤਪੁ ਕਰ।

રતિચંદ્રની વાત કુટબુદ્ધિ કીર્તિચંદ્રને ગળે ઉતરી નહિ, તેણે જ્યારે ભાતવધનો પોતાનો વિચાર પણ ઘઢદ્યો નહિ ત્યારે રતિચંદ્રે કહ્યું, કે “એ તારો એ વિચાર કાયમ જ હોય તો મારો ઝિધિરથી તારો હાથ રંગીશ નહિ. પણ મને કાણની ચિતા સણગાવી આપ. હું બળીને તારી છુંછા તુમ કરીશ.” રતિચંદ્રની એ વાત કીર્તિચંદ્રને ગળે ઉતરી ગઈ.

નગરની ખણાર ચિતા તૈથાર કરવામાં આવી. તેમાં રતિચંદ્રે પ્રવેશ કર્યો ને ચિતાને પ્રગાયાવી દીધી. રતિચંદ્ર આર્તધાને ભરણું પામી ભૂતરમણું નામે યક્ષ થયો. રાજ્ય અને લક્ષ્મીને માટે સગા બાંધવો પણ આધને હણી નાખે છે તો પછી થીજાની તો વાત જ શું?

એ ભૂતરમણું યક્ષ હું પોતે. વિલંગજાને જ્યારે મેં પૂર્વભવ જોયો ત્યારે કોથથી ધમધમતા મેં કુટબુદ્ધિ મંત્રી અને સામંતોને અહણું કરીને હૂર ફેંકી દીધા. રાજ કીર્તિચંદ્ર તો આ ઉપદ્રવ જાણીને પલાયન કરી ગયો. પ્રજા દ્વારા જોને જ્યાં ગમણું ત્યાં નાશી ગઈ, ત્યારથી જનશૂન્ય આ નગરમાં મેં તને જોયો. તને જોતાંજ કોથથી ધમધમતો હું તને મારવાને સિંહ અની આવેલો પણ તારો પુણ્યથી—સત્ત્વથી હું પ્રસન્ન થયો છું—શાંત થયો છું. માટે હે મહાસત્ત્વ ! મારી પાસે કંઈક વરદાન માગ.”

એ યક્ષની વાત સાંલળી કુમાર રતનસાર ઓદ્યો. “હું હેવ ! જો મારો પર આપ પ્રસન્ન થયા હો તો આ નગરને ફરી વસાવો કારણ કે રોષ પણ તેનોજ ઉત્તમ ગણ્યાય છે કે જે પાણીથી પ્રસન્ન થાય છે.”

“હું તારી વાણીથી આ નગરને તો વસાવી આપું, પણ તું આ નગરનો સ્વામી થાય ત્યારેજ તે અની શકે,

તેમજ ભાઈને શોધવાને તું નિકળ્યો છે તે તારો ભાઈ તને મહિનાને અંતે અહીજ મલશે. ભૂતરમણું યક્ષની વાણી કુમારે અંગીકાર કરી ને યક્ષ અદશ્ય થઈ ગયો. મારી પણ નિદાનો નાશ થવાથી હું જાગ્યો. ને મેં કહ્યું, “મિત્ર ! હું તમે સૂઈ જાઓ.”

રાજકુમાર પણ નિદાવશ થઈ ગયો. તે જ્યારે જાગ્યો ત્યારે પ્રાતઃકાળ થઈ ગયો હતો. સવિતાનારાયણે જગતને જગત કરી પોતપોતાના કર્તવ્યમાં જોડી દીઢું હતું, દેવની પ્રેરણાથી મંત્રીએ ને સામંતો વાહિનોના નાદ સાથે નગરમાં આવી પહોંચ્યા, પ્રજા પણ ચારેકારથી નગરમાં પાછી ફરવા લાગી. સર્વેએ રતનકુમારનો રાજ્યાલિષેક કર્યો. તેનું નામ રામયુ દેવપ્રસાદ.

દેવપ્રસાદને મંત્રી સામંતોએ પોતાની રૂપવતી અનેક કન્યાએ પરણાવી દીધી. એવો રાજ્યલોગ છતાં રાજને શાંતિ થતી નહિ. એકદા રાજએ મને કહ્યું “મિત્ર ! આ રાજ તું અહુણું કર. તેમને તારા સમાગમથી આ પ્રાપ્ત થયું છે.”

“હે સ્વામી એમ ના ખોલો. આપના ભાગ્યે જ આ રાજ્ય આપને મળ્યું છે વલી આપને ભાઈને મેલાપ પણ અહીં થવાનો છે એ વાત શું ભૂલી ગયા ? છતાં હું આપના ભાઈની શોધ માટે જઉં છું. મને એમનું નામ ઠામ વગરે કહો.” મારી વાણીથી શાંત થયેલા રાજ રતન-સારે (દેવપ્રસાદ) મને એમના ભાઈ અંધી સર્વે હકી-કત કહી સંભળાવી. તે પછી તરતજ હું રાજકુમાર ગિરિ-સુંદરની શોધ માટે ત્યાંથી નિકળી ગયો. તે આજે ફરતો ફરતો અહીં આવેલો હું તો હે મુસાફરો ! તમે અનેક દેશથી આવ્યા છો. તો મારા સ્વામીનો અંધું તમે કયાંય.

બોધો છે!” એમ કહી એ મુસાફરે પોતાની વાત પૂરી કરી.

અધાય મુસાફરે એ વાત સાંભળીને ઝુશી થયા પણ ગિરિસુંદરની લાળ-સમાચાર કોઈ આપી શક્યું નહિ, પણ સામાન્ય વેશમાં રહેલો ગિરિસુંદર બોલ્યો. “હું પથિક! તને ધન્ય છે. તારી મિત્રતાને ધન્ય છે કે જે મિત્રને માટે તું આપ્યો અધો કલેશ સહન કરે છે. તું મને એ હેવપ્રસાદ ભૂપતું દર્શન કરાવ, મારા સમાગમથી એ રોજ પોતાના બંધુના નિરહને ભૂતી જશે-સર્વે સાર્દે થશે.”

“જો એમ હોય તો ચાલો અટ,” તે બને મિત્રો અનેલા ત્યાંથી ગાંધારપુરના રસ્તે પડ્યા.

## ૪

### પરહેશમાં

ચંદ્રહાસ અહૃગાના પ્રભાવથી ગિરિસુંદર પેલા મુસાફર સાથે ગાંધારપુરમાં ઝુખ શીધતાથી આવી પહોંચ્યો. મિત્રો થયેલા તેઓ બને રાજસલામાં આવી પહોંચ્યા ત્યારે હેવપ્રસાદ પોતાના મિત્રની સાથે આવેલા આ પુરુષને બેદી ધણો ઝુશી થયો એના મિત્રે કહ્યું. “હું! આપના દર્શનની અભિલાષાવાળા આ પુરુષ વિદ્યાવાન અને ગુણવાન નર છે.”

હેવપ્રસાદ અન્નેનું સ્વાગત કર્યું. રાજાને સામાજિક વેશ ધારી ગિરિસુંદર ઉપર પરમ સ્નેહ થયો. ઇપ, પરાપ્રરીતન હોવાથી પોતાના સ્માર્ઘ તરીકે એ પુરુષને રાજા જાહી શક્યો નહિ. કેટલોક સમય જવા છતાં ગિરિસુંદર તું આવવાથી રાજ વિચાર કરવા લાગ્યો. “લાઇના નહીં આવવાથી હેવવાણી પણ બર્થ થઈ કે શું? અથવા તો

એ વિચાર વડે કરીને શું ? બંધુ વિચેગના હુંઅખી મુક્તા  
કરેનાર એક મૃત્યુ અયસ્કારી છે માટે અજિપ્રવેશ કરે”

એ પોતાનો અલિપ્રાય રાજાએ ગિરિસુંદર અને  
મિત્રને કહ્યો. એનો અલિપ્રાય જાળી ગિરિસુંદર બોલ્યો.  
“તમારે એમ કહેવું વ્યાજથી નથી. ઉજવણ એવા તમારા  
ગુણોએ કરીને વશ થયેલો હું તેને શું તમે હવે મારી  
નાખવા ભારો છો કે ? તમારા સ્નેહને વશો કરીને તો હું  
અહીંથાં રહેલો છું, માટે કર્ણને શૂલ સમાન એ વચ્ચન  
તમારે બોલવું યુક્ત નથી.”

“શું કરે ? મારો ઉપાય નથી, દેવતાએ કહેવા છતાં  
પણ મને ભાઇને મેળાય થયો નહિ. ને ભાઇ વગર હું  
લુભીશ નહિ માટે મને તમે આજ્ઞા આપો ને આ રૂક્ષ  
તમે સુખેથી ભોગવો.”

“દેવ વાક્ય કદમ્પિ મિથ્યા થતું નથી. માનોને કે હું  
જ તમારો ભાઇ છું. ભાઇને જોવા માટે આખી પુઢ્યીનું  
ઉદ્દલંઘન કરી તને જોઈ હું સંતોષ પાસું છું. તો અને  
જોઈ તું પણ સંતોષ પામ.”

એ પુરુષનાં વચ્ચન સાંલળી રતનસારે ચિંતાબું. “નહીં  
આ મારો જોઈ ભાતા ગિરિસુંદર જ છે. ઇપ્ર પરાવર્તન  
વિધાએ કરી એણે પોતાનું સ્વરૂપ અદ્વાતી નાંખું છે.  
અન્ય ઇપમાં હોવા છતાં મને એના ઉપર પુન્ય બુદ્ધિ રહે  
છે ને ગિરિસુંદર ક્રોચા સ્નેહથી હું એને જોઉં છું. કરણું  
કે કેવા પ્રકારના દેવતાઓની વાણી અન્યથા થતી નથી.”  
મનમાં ચિચાર કરી રતનસાર બોલ્યો. “એ કે તમારી  
વાણી સત્ય છે તમારો લરે મારો પક્ષપાત પણ ખુલ્ય છે  
જ્ઞાન તમારા સામાન્ય વેશથી મને નવાઈ લાગે છે કે  
નમા શું ? ”

રલસારની આતુરતાથી ગિરિસુંદરે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું પોતાના જેઠ ભાતા ગિરિસુંદરને જેઠ ખુબ ઝુશી થયેલો રલસાર વડીલ લાઇને સારી રીતે મહ્યો-લેટ્યો વડીલનો મેળાપ થવાથી રાજએ પોતાની ઝુશી પ્રગટ કરવાને વર્ધાપન મહોત્સવ કર્યો. ત્યાં સુખમાં કેદ્યોક સમય પસાર થયો.

દેવતાની અનુમતિથી પેલા મહસેન નામે ભિત્રને ગાંધારપુરનું રાજ્ય અર્પણ કરી સારી રીતે શિક્ષા આપીને સપ્તાંગ સેનાથી પરવરેલા અને લાઈ પોતાના વતન જવાને નીકળ્યા. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા, દેવતાઓ અને વિદ્યાવરો વરે આકાશમાં જોવાતા તેઓ કેદ્યોક પૃથ્વીનું ઉલ્લંઘન કરી પુંદ્રપુર નગરની સમીપે આવી પહોંચ્યા.

પોતાના અને પુત્રોનાં આવાગમન જાણી રાજ ઘણેઠ ઝુશી થયો અને તેમનો મોટા પ્રવેશ મહોત્સવ કર્યો. અને કુમારો પોતપોતાના માતપિતાને મહ્યા. ગિરિસુંદરે પણ પેલા પાતાલગૃહમાંથી પોતાની પત્નીઓને તેડાવી લીધી ઇદ્ધિસિદ્ધ જેની હતી તેને હવાલે કરી દીધી. રાજના પૂછવાથી ગિરિસુંદરે ચોરનો નિયંત્ર કર્યો ને રલસારનો મેળાપ થયો એ ખધી ય હકીકિત કહી સંભળાવી.

ગિરિસુંદરની વાત સાંભળી ચમત્કૃત થયેલો રાજ તેમના અદ્ભુત પુણ્યની પ્રશાંસા કરવા લાગ્યો. બાળક છતાં આવાં મહાભારત કાર્ય કરનારનો પૂર્વ લવ કેવોક હશે? તે જાણવાની રાજની લજાસા વૃદ્ધિ પામી.

રાજની આતુરતા જેઠ પુરોહિત બોલ્યો, “દેવ! કુસુમાકર નામના ઉધાનમાં શ્રી જ્યનંદન સૂરીથર પવાર્ય છે તે આપની અભિલાષા પૂર્ણ કરશો, પુરોહિતની વાણી

સાંલળી રાજ સકળ પરિવાર સાથે ગુરુને વાંદવાને આવ્યો. ગુરુને વાંદી યથારથાને ધર્મપદેશ અવણ કરવાને એઠો. ગુરુએ પણ રાજની આગળ ધર્મપદેશ શરૂ કર્યો.

“શુલ અને અશુલ કર્મથી પ્રાણીએ ઉચ્ચ અને નીચુણમાં જન્મ ધારણ કરે છે. હેવ ને નારકી, રાજ અને રંક, વિક્ષાન અને મૂર્ખ, સુખી અને હૃદ્દી, ઇપવાન અને કદ્વિપા, એ બધા શુલ અશુલ કર્મના લેદો સમજવા. હ્યાદિક વડે કરીને માણુસ પુણ્ય ઉપાર્જન કરે છે જેથી સ્વર્ગાદિક અદ્ભુત સુખને મેળવે છે તેમજ ચારિવધર્મનું આરાવન કરી સ્વર્ગ ઉપરાંત અપર્વાની લક્ષ્મી પણ શું તે નથી મેળવતો? માટે શુદ્ધ એવો જીનેથીર ભગવાને કહેલો. ધર્મ હે પ્રાણીએ! તમે આરાવ્યો.”

ગુરુનો ઉપદેશ સાંલળી રાજ શ્રીભલે ગિરિસુંદર અને રત્નસારનો પૂર્વ લવ પૂછ્યો. કેના ઉત્તરમાં ગુરુએ શાંખરાજ અને કલાવતીથી શરૂ કરીને સર્વે લવ ઇણી સાંલળાવ્યા. ઘૈયેયકનાં સુખ લોગવી તેઓ. અન્ને તારા કુણમાં ઉત્પન્ન થયા છે. એ બધા ચારિત્રિધી વૃક્ષનાં અનોન હુર ઇલ જાણ્યાં. મુક્તિને આપનારા એ ધર્મનાં રાજ્યાદિક પ્રાપ્તિદ્યપ ઇલ એ તો સામાન્ય ઇલ છે. અનાજને માટે એતી કરનારા ઐડતને રણજની સમાન છે. પણ આર્થિકની વાત તો એ છે કે એક મુનિને શુદ્ધ આહાર આપવાથી નામને ચારેને આ અદ્ભુત રાજ્ય પ્રાપ્ત થશું.”

ગુરુનાં વચન સાંલળી રાજ વિસ્મય પામતો એલો હે ભગવન! શી રીતે એ બધું થયું? આપ જરા સ્પષ્ટ-તાથી કહો.”

ગુરુએ શ્રીભલ રાજનો પૂર્વ લવ કહેવો શરૂ કર્યો. “અતિધીનપુર નગરાં સુમેધ નાણે કુણપુત્રને વિનિયુક્ત કરો

શાંખર નામે એ પુત્રો હતા, પોતાની દરિદ્રાવસ્થા હોવાથી અને પુત્રો ધન કમાવાને કંઈક લાતા સાથે કંચનપુર તરફ ગયા, કારણ કે કૃષ્ણાની વેહના જગે છતે વ્યાકરણ ભણવાથી કંઈ હૂર થતી નથી તેમજ જલની ઈચ્છાવાળાને કાવ્યરસથી પણ રૂપ્તી થતી નથી અને વેહના છંદના સ્તોત્રો વડે કંઈ કુળનો ઉદ્ઘાર થતો નથી, માટે જે ધન ઉપાર્જન ન કર્યું તો બધી ચ કિયાઓ નિષ્ઠળ જણવી.

અત્યદી માર્ગમાં લોજન સમયે એક કંદ્રાધની દુકાનથી મીઠાધ વગેરે લાવીને કોઈ વૃક્ષ નીચે લોજન કરવાને એઠા. ભાજ્યોગે માસોપવાસી કૃશ થયેલા મુનિ ધર્મલાલ કહેતા ત્યાં આવી ચડ્યા. એ મહામુનિને જોઈ લક્ષ્મિથી ભરપુર હૃદ્યવાલા તેઓએ એ નિર્દ્દીષ ભિષ્ણાનથી તેમને પ્રતિલાલિત કર્યા. મન, વચન અને કાયાના એકદમ શુદ્ધ અધ્યવસાયથી તેમણે લોગ્ય કર્મ ઉપાર્જન કર્યું.

તે સમયે યક્ષના મંહિરમાં આવેલી એ રાજ્યકન્યાઓ આ હાનને જોઈ તેમની અને હાનની ખુઅ પ્રશંસા કરવા લાગી. પ્રશંસા કરતી તે રાજકન્યાઓ પોતાના નગરમાં આવી ગઈ એવી રીતે એ ચારે જણે એક સરખુ પુષ્ય ઉપાર્જન કર્યું. તે પછી અને આતાઓ હાનની અતુમોદના કરતા કંચનપુરના ઉદ્ઘાનમાં આવ્યા ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રાબ લેવાને એઠા.

તે સમયે કંચનપુરના ચંદ્ર રાજનો પદહસ્તિ આલાન સ્થંભ ભાગીને નગરીમાં રંઝડ કરવા લાગ્યો જેથી લોકો હાહાકાર કરતા નાસ ભાગ કરવા લાગ્યા. અને બાંધવો આ ડાલાહલ સાંભળીને નગરમાં આવ્યા. પહુંચતીને કાઈ વશ કરી શક્યું નહિ, ને ગૃહ, હાથ, હુકાન વગેરે લુગતો મધ્ય વ્યોકમાં આવ્યો. રાજાએ દોઢેરો પીધ-

વ્યો “જે ખગવાન પુરુષ હાથીને વશ કરશે તેને રાજ મનગમતું ઇનામ આપશે.”

પણ એ ૬દેરો સાંભળવાની ડેઈને પડી નહોતી, સૌને પડી હતી પોતપોતાનો જીવ ખગવાની. આ કોલાહલ સાંભળી પેલા પરદેશી બન્ને ભાતાઓમાં વિનંદ્યે કમર કસી અને તૈયાર થધ પદ્ધતિ સામે આવ્યો. ગજવિધામાં કુશલ એ વિનંદ્યે ગજરાજને ખુખવાર કલેશ પમાડી-લમાડી વશ કર્યો. ન તેને આદાન સ્થંભે બાંધ્યો.

ગજરાજ વશ થવાથી લેકો આનંદ પામ્યા. રાજપુરદેશો વિનંદ્યને રાજ પાસે હાજર કર્યો. રાજએ પ્રસન્ન થઈ વરહાન આપ્યું, તેમની ધર્ઘાથી રાજએ બન્નેને રાજસેવામાં રાખી લીધા. તેમની ધર્ઘા કરતાં પણ અધિક ધન આપ્યું, ચિરકાલ ત્યાં સુખ લોગવીને સમાધિમરણ કરી ત્યાંથી દેવકુરમાં બન્ને નર તરીકે ઉત્પન્ન થયા. અનુમાદન કરનારી પેલી નૃપતુનીએ પણ સુખ લોગથી કાલ કરીને દેવકુર ક્ષેત્રમાં તે બન્ને નરની સ્ત્રીએ તરીકે ઉત્પન્ન થધ. દશ પ્રકારના કદ્યવૃક્ષથી જેમના મનોરથ પૂર્ણ થાય છે, અને જેએ અહંકિર્દ જેવા સુખી, સાંતોષી ને ગુણવાન છે. એવા તેએ ત્રણ પદ્યોપમ સુધી સુખ લોગવીને સૌધર્મ કદ્યમાં દેવ થયા. ત્યાંથી પુંદ્રનગરના મહાબલ રાજની વિલાસવતી પદ્મરાણી થકી તમે અને પેલી બન્ને નૃપતુનીએ તમારી સાથે સુખ લોગવતી દેવકુરમાંથી પહેલા દેવદેશે તમારી દેવીએ થધ. ત્યાંથી પહેલી પદ્મભંડ નગરના મહસેન રાજની પુત્રી સુલક્ષ્મણા નામે થધ. તે હે રાજન ! તમારી પત્ની થધ. બીજી વિજય નગરના પદ્મરથ રાજની પુત્રી લક્ષ્મણા નામે શુવરાજની પત્ની થઈ. એ બન્ને કન્યાએ તમને શી રીતે પાસ થઈ તે સાંભળો.

૫

### ગુરુ ઉપહેરા.

શ્રીભલ અને શતભલ જ્યારે નવીન યૌવનવયમાં આવ્યા ત્યારે એક દિવસે શ્રીગુરુ સિઙ્હપુત્રે વિદ્યા સાધન કરવા માટે શ્રીભલકુમારની સહાય માગી. શ્રીભલે તે વાત અંગીકાર કરવાથી તે બજે કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ શમશાન ભૂમિમાં ગયા, ત્યાં મંડળને આલેખી શ્રીગુરુ વિદ્યા સાધન લાગ્યો ને શ્રીભલ હાથમાં ખડુંને રમાડતો તેની રક્ષા કરવા લાગ્યો.

તે સમયે લયંકર સ્વરૂપને દારણ કરનારો એક પિશાચ પ્રગટ થયો તે મંત્ર સાધન કરતા શ્રીગુરુના કેશને ઐંગી તેને જંગલમાં દસડતો ચાલ્યો. શ્રીભલ કુમાર તેની પછ્વાડે ઢોડ્યો. પિશાચની પાછળ ઢોડતો શ્રીભલ મહાલયંકર વનમાં આવી પહોંચ્યો. પ્રાતઃકાળ થયો ત્યારે ન મળે પિશાચ કે ન મળે શ્રીગુરુ.

પણ એક સ્થીનો કદ્દણ રૂદ્ધન સ્વર સાંભળી કુમાર તેની સમીપી ગયો. ત્યારે વૃક્ષની શાખાએ ગળે ફાંસો ખાતી તે આળા બોલી. “હે વન દેવતાએ ! મારું વચ્ચન સાંભળો. મારા પિતાએ આપેલો એ શ્રીભલ કુમાર આ લવમાં તો મારો. પતિ ન થયો પણ લવાંતરમાં થણે.”

એ ગળે પાશ દઈને આત્મહત્યા કરતી બાળાનું શાણ્દો. શ્રીભલે સાંભળ્યા કે ત્યાં જઈ તરતજ પાશ છેદી નાખ્યો. આ લયંકર અરજ્યમાં પોતાને બચાવનાર અસુરૂપને બેઠ બાળા પોતાનાં અંગને વસ્તોથી આચળાહિત કરતી બોલી. “અરે ! સર્વને સાધારણ એવું મૃત્યુ પછું આરે તો દુર્લભ થયું.”

બાળાને આચ્યાસન આપતો કુમાર બોલ્યો. “બાળારું

એ કોણ છે ? અને શા માટે મૃત્યુનો ઉધમ કરતી હતી વે  
કહે. ”

એ પુરુષના શખ્ષાથી રાજ થતી થાળા બોલી. “ પદ્માંડ નગરના રાજ મહિસેનની હું રાજપુત્રી. મારું  
નામ સુલક્ષ્મણું. મારાપિતાએ મને મહાયલ નરેશના  
પુત્ર શ્રીયલને આપેલી હતી. એકદા સખીએ સાથે કીડા  
કરતાં કોઈ અધમ વિદ્યાધર મારું હરણું કરી ગયો તે આ  
જગતમાં મને મુક્તી અપરાજીતા નામની વિદ્યા સાધવાને  
ગયો છે. તે સમયનો લાલ લઘ એ દુષ્ટ મારા ઉપરથલા-  
તાર કરે તે કરતાં મારે મારા પ્રાણોને જ છોડવા એમાં ઐદં  
શું છે ? કુમાર !” થાળા સુલક્ષ્મણુએ પોતાની કથા હુંકા-  
ણમાં કહી સંભળવીને ઉપરથી પૂછ્યું. “ આપ શ્રીમાન  
કોણ છો ? આ લયંકર અરણ્યમાં આપ એકલા ક્યાંથી ? ”

સુલક્ષ્મણના પ્રશ્નના ઉત્તરમાં કુમારે પોતાની ઓળ-  
ખાણ આપી, જેથી થાળા પોતાના લાવી પતિને જાણી  
રાજ થઈ. એ સમય દરમિયાન વિદ્યા સિદ્ધ કરી શ્રીયુષે  
પણ નિમિતાજ્ઞાનથી જાણીને શ્રીયલની પાસે આવ્યો.  
શ્રીયુષને જોઈ શ્રીયલ અધિક પ્રસન્ન થઈ બોલ્યો. “ મિત્ર !  
પિશાચ ક્યાં ગયો ને તેના પંજમાંથી તું શી રીતે મુક્ત  
થયો. ? ”

“ મિત્ર ! એ બધી પિશાચની માયા હતી, મને કંધ  
પણ વિદ્ધ વગર વિદ્યા સિદ્ધ થઈ પણ તને ન જોવાથી હું  
હુંખી થઈને નિમિતથી તારો વ્યતિકર જાણી હું આવી  
પહેંચ્યો હું, નિમિતથી એ પણ મેં જાણ્યું કે તારા સત્ત્વથી  
પ્રસન્ન થયેલો એ પિશાચ તારી પ્રિયાનું રક્ષણું કરવા માટે  
તને અહીયાં ઐંચી લાવ્યો છે. તો હે મિત્ર ! ગાંધર્વ  
વિવાહથી અત્યારે જ તું આ થાળા સાથે લખ કર. અત્યા-

રતું મુહૂર્ત ઘણું જ સુંદર અને અભ્ય છે.”

મનને અનુકૂળ વાર્તા સાંલળી ખુશી થયેલા શ્રીખલે સુલક્ષ્મણા સાથે ગાંધર્વ વિવિથી લભ કરી હીધાં. પછી ત્રણે જણ વણ વિધાની સહાયથી ક્ષણ માત્રમાં પુંદ્રપુર નગરમાં આવી ગયાં. મહાબ્રત રાજાએ આ સધળી હકીકત મહેસેન રાજાને જણાવવાથી રાજાએ રાજ થતાં પોતાના મંત્રીઓએ મોકલી વિવાહ મહોત્સવ ઉજવ્યા ખુલ્લ પહે-રામણી આપી.

શ્રીખલના ગુમ થવાથી શતખલ બાધને શોધવા સૈન્ય સહિત ચાલ્યો. તે દેશના સીમાડ વનમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યો. તો શોકથી આકુળ વ્યાકુલ તાપસ અને તાપસીઓને જોઇ શતખલે પૂછ્યું. “આ બધું શું છે ? ”

શતખલકુમારને એક તાપસે કહ્યું. “ રાજકુમાર ! સાંલળો. વિલ્યપુર નગરના પદ્મરથ રાજાની લક્ષ્મણા નામની કન્યા મંત્રી આદિ પરિવાર સાથે શતખલકુમારને વરવા પુંદ્રપુર તરફ જતી હતી. ગઈ રાત્રીએ અમારા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. વાત એમ બની કે કિરાત દેશના અરિમથન રાજાનો કુંજર નામે કુમાર એને પરણુવાની છંઢા કરતો હતો. પણ તેની છંઢા સર્કલ ન થવાથી રાત્રીને સમયે આ આશ્રમમાં આવી કન્યાને હરી ચાલ્યો ગયો છે. જેથી અમે અધાં શોક કરીયે છીએ. કે શતખલમાં પ્રીતિ વાળી એ કન્યા નિશ્ચય વાટમાં જ મરી જશે.”

એ વાત સાંલળી શતખલ કોથથી ધમધમતો કુંજ-રના માર્ગ ઢાડ્યો. શીધ ગતિએ જતા એણે કુંજને પકડી પાડ્યો. તેની સાથે લયંકર સાંચામ કરી કુંજરને હરાવી લક્ષ્મણાને લઈ પાછા કર્યો. તે દરમિયાન શ્રીખુમ આકાશ

માર્ગ ત્યાં આવી શ્રીબત્તના સમાચાર જણાવી તેને ખુશી કર્યો. શ્રીગુરુની સહાયથી ક્ષણમાં તેઓ પુંદ્રપુર આવી પહોંચ્યા, ત્યાં લાધને મળી શતખલ ઘણો રાજ થયો. સારા ઝૂલૂતો તે પણ લક્ષમણાને મહોત્સવ પૂર્વક પરછ્યો. તે પછી અનુકૂમે તમે ખન્ને રાજ અને યુવરાજ થયા. તમે ચારેએ પૂર્વ લવે કરેલા સુપાત્રાનથી આ લવમાં તમને સુખ પ્રાપ્ત થયું. “એ રીતે સૂરીએ શ્રીબલ વગેરેનો પૂર્વ લવ કહી સંભળાવ્યો, પણ ઐલા વિદ્યાધરની હકીકત ન આવવાથી રાજએ પૂછ્યું. “અગવન! એ વિદ્યા સાધવા ગયેલા વિદ્યાધરનું શું થયું? ”

“વિદ્યા સાધતા એ વિદ્યાધરને ટેવીએ છળવાથી એતું મળજ ખસી ગયું. ગાંડાની માર્ક જ્યાં ત્યાં લટકતો તે અનુકૂમે કંપિલ્યપુર નગર આવ્યો. ત્યાં અહૃવીશ લખિય ચુક્ત એવા મહા સુનિ હરિષેણ ગુરુને જોઈ તેમના તપોભણથી ફેલીનો છળ દૂર થઈ ગયો. પછી તો પશ્ચાત્તાપ કરતા તે વિદ્યાધરે ગુરુ પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા અહણ કરી. અનુકૂમે કેવળજ્ઞાન પામી તે વિદ્યાધર સુનિ મોક્ષે ગયા. ”

ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીબલ રાજએ ગિરિસુંદરને રાજ્યગાહી સમર્પણ કરી. રતનસારને યૌવરાજ પદ આપી શતખલ આહિ અનેક રાજ પુરુષો. સાથે દીક્ષા અહણ કરી.

## ૬

### સંયમલક્ષ્મી

ન્યાયથી પ્રજાનું પાલન કરતા અન્ને બાંધવો (ગિરિસુંદર અને રતનસાર) પુણ્યનાં મધુરાં ફ્લાનો અનુભવ કરી રહ્યા હતા. એ રાજ્ય સુખમાં પાણીના પ્રવાહની માર્ક યુગના યુગ પસાર થઈ ગયા. રમણીય અને મનોહર યુવાની

પણ થાડીજ કાંઈ કોઈની કાયમ રકી રહે છે ? એ ખુબાની ગાંડ. મસ્તકના રથામ કેશ પણ થૈત વર્ષી ધારણ કરવાની હરીકાઈ કરી રહ્યા હતા. સુખ અને લોગો લોગવીનેથ થાકી ગયા હતા. એવા સુખમાં પણ એ ભાગ્યવાનને એક દિવસે વૈરાગ્ય આવ્યો.

પોતાપ તેજથી પૃથ્વી મંડળના શત્રુઓને જીતી લીધેલા હોવાથી આજે જગત ઉપર શાંતિનું મોઝું ફરી રહ્યું હતું. પૃથ્વી મંડળના રાજાએ શું કે સુલદો શું સર્વે રેંગ રાગમાં પડી ગયા હતા. લક્ષ્મીના સહ વ્યયથી અનેક દારિદ્ર ઇથી વૃક્ષને છેઢી દાનનું અનુપમ ઇથી લોગવી રહ્યા હતા. જીનેથરના પ્રાસાદો કરાની જિન પ્રતિ-આચ્છાની સ્થાપના કરી જૈન શાસનનો ઉદ્ઘોત કરી રહ્યા હતા. દેવ ગુરુ અને ધર્મની સેવા કરતા તે સાતેક્ષેત્રોમાં ધનનો વ્યય કરતા તેઓ અની શકે તે પ્રમાણે શ્રાવક ધર્મની આરાવના કરી રહ્યા હતા.

રાજ જિરિસુંહર એક દિવસે નિશાના ચતુર્થી પ્રહરે સ્વમેમાં પર્વતના શિખર ઉપર રહેલો. પોતાને જોયો, એ સ્વમે જોઈ જગત થયેલા રાજના વિચારે. કેવા નિર્ભળ અને પવિત્ર હતા. પરમેષ્ઠીમંત્રનું સમરણ કરતો રાજ પ્રાતઃકાલે જગત થઈ જીનમંદિરમાં ગયો. જીનેથરની સેવા પૂજા કરી નગરની બહાર ઉદ્ઘાનમાં એક આભ્રવૃક્ષની છાયાનો આશ્રય લઈ રહેલા ખુનિને જોઈ વાંદવા આવ્યો. ખુનિએ ધર્મને યોગ્ય જાણી તેને ધર્મપદેશ આપ્યો.

ખુનિના ઉપહેશથી વૈરાગ્યવંત થયેલા રાજ યુસે નમી દેર આવ્યા. દીક્ષાની ભાવનાવાળા રાજએ પોતાને અલિપ્રાય રત્નસારને કહી સંભળાવ્યો. રાજની દીક્ષાની ભાવના જાણી રત્નસારે કહ્યું: “હે અંધો ! મૂર્ખ પુરુષો

જ ગઈ વાતનો શોક કરે છે. આમણું સુખના લોલ્લી આપણને તુચ્છ સાંસારિક સુખોમાં રાચવું ચોગ્ય નથી. ગુરુનો ચોગ પ્રાપ્ત થતાં આ સંસાર કારાઅહેમાં પૂરાધ રહેલા આપણે દીક્ષા અહેણું કરી પૃથ્વી મંહલપર વિહુરશુઃ એ જ આમ અને નગરને ધન્ય કે જ્યાં આપણા ગુરુ જ્યનંહનસૂરીધરણ વિચરી રહ્યા છે.” ગુરરાજના આગમનની રાહ જોતા એ અને ખાંખવો કાલક્ષેપ કરી રહ્યા હતા, તે દરમિયાન ગુરુ મહારાજ ત્યાં આવી પહોંચ્યા, તેની વનપાલકે વધામણિ આપ્યો.

રાજ પોતાના ખાંખવાદિક પરિવાર સાથે ગુરુ જ્યનંહનસૂરીધરને વાંદવાને આવ્યો ને ગુરુને વાંહી ચોગ્ય આસને એસી ઉપદેશ સાંભળવા એઠો. ગુરુએ પણ રાજને ચોગ્ય જાણી ઉપદેશ આપ્યો.

“હે ભાવ્યો ! દુર્લભ મનુષ્યભય પામીને વિવેકી એવા લમારે ધર્મને વિષે યતન કરવો જોઇએ. કારણું પિતા, ભાતા, ભાઈ, સ્વી, પુત્ર, ભિન્ન અને સ્વામી, કરતાં પણ ધર્મ અધિક શ્રેષ્ઠ છે. આ જન્મમાં કે પર જન્મમાં પ્રાણીને ધર્મ જેવું હિતકારી કોણ છે ? દાંત વગર જેમ હાથી શોભા પામતો નથી, ચંદ્ર વગર નિશા શોભતી નથી, સુગંધ વગર પુષ્પ શોલે નહિ, જલ વગર સરોવર શોભતું નથી, લવણ વગર અન્ન સુદર લાગતું નથી, નિર્ગુણી પુત્ર તેમજ ચારિત્રણીન યતિ જેમ શોભતો નથી, તેમજ દૃવ વગરનું મંહિર જેમ શોભતું નથી, તેમ માનવી પણ ધર્મ વગર શોભતો નથી.

માટે હે રાજન ! ધંતુરાના કુલના જેવા અસાર સંસારમાં તારે પ્રીતિ કરવી નહિ. ઈંડિયાલની માર્કે આંખો મીંચાતાં આખરે કાંઈ નથી. કેમકે જન્મ છે તે

મૃત્યુને માટે છે, ચુવાની જરાવસ્થા માટે રહેલી છે, બોગો રોગોને કરનારા છે તો એવી તુંછ ને અદ્ય કાળ વાળી વસ્તુઓમાં કોઈ પ્રાણી રાચીમાચીને આસક્ત થાય નહિ.

ધર્મની ભાવના વાળા જીવો જ યત્નથી ધર્મકાર્યમાં જોડાઈ જીવનને સુધારી લે છે. ડાખા જનો તો બગડેલી ખાળુને પણ છેવડ જતાંય સુધારી લે છે. જેએ બોગમાં આસક્ત બનીને પાપકાર્ય આંખો મીંચી કર્યે જાય છે તે ધર્મ કરવા માટે કુરસફ પણ મેળવી શકતા નથી, તેમને આખરે તો ભવાંતરે કંલો પાકમાં પકાવું પડે છે. પરમાધારીઓની વેહના સહન કરવી પડે છે. મહા રૌરવ નરક હુંખના બોક્તા થવું પડે છે. માટે હે ભવ્ય ! તમે પ્રમાણે ત્યાગ કરી ધર્મને વિષે ઉધમ કરનારા થાએ !”

શ્રી જયનંદસૂરીથરનો ઉપદેશ સાંલળી દીક્ષા માટે આતુર થયેલો રાજ નગરમાં આવી રાજકુમારસુર-સુંદરને રાજ્યે સ્થાપન કરી દીક્ષા લેવાને તૈયાર થયો. રાજની સાથે રતનસાર ચુવરાજ પણ દીક્ષા લેવાને તૈયાર હોવાથી જીનેથરની પૂજા રચાવી મેદ્યા વર્ધાપન મહોત્સવ કર્યો. શુલ્ક મુહૂર્તે બન્નેએ દીક્ષા અહુણું કરી. અદ્ય હિવસમાં તેએ અગીયારે અંગના જ્ઞાતા થયા.

ઉત્કૃષ્ટ સંયમના રંગથી રંગાયેલા, ધ્યાન અને કિયામાં તત્પર લગભગ સમાન તીવ્ર તપસ્યા કરતા તેએ કૃશાંગ-વાળા થઇ ગયા. પૃથ્વી ઉપર વિહાર કરતા અને અનેક રાજાઓથી પૂજાતા એ એ મહા મુનિઓ અનુકૂમે અણસણને આરાધી શરીરને પણ વોસરાવી દીધું.

પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરતા તે બન્ને મહામુનિઓ કાલ કરીને નવમા છૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આચુવાળા અને એ હાથ શરીર પ્રમાણવાળા અહૃદંદ્ર.

દેવપણે ઉત્પન્ન થયા, ત્યાં દેવતાઓનાં ઉત્કૃષ્ટ સુખને લોગવતા ને પોતાના ભણિ રત્ન જહિત હિવ્ય વિમાનમાં સમયને વ્યતીત કરેતા, જતા એવા કાળને પૃષ્ઠ જાણતા નહિ, ધર્યા, વિષય કષાયથી રહિત તેમજ હિવ્ય લોગ સુખમાં પ્રીતિવાળા તેમના સુખની આપણે કદ્યપનાય શી કરીયે ?



પરિચ્છેદ દ મો  
કનકદ્વાજ અને જ્યસુંદર

૧

સત્તરમાં લવમાં

બંગાળ દેશમાં આવેલી તાદ્રલિભી નગરી પોતાની અનુપમ શોભાથી આજે અલકાપુરીને પણ જીતી ગઈ હતી. ત્યાં સુમંગલ નામે રાજ ધર્દના જેવો પરાહંમી હતો. ત્યાંની સ્ત્રીઓની સુંદરતાથી પરાલવ પામેલી અપસરાઓ લગ્નથી સ્વર્ગમાં ઝુપાધ ગઈ હતી. મનુષો ઇપવાન અને દેવતાની માડક કીડા કરતા સુખમાં સમય પસાર કરતા હતા. એવી મનોહર સ્વર્ગપુરી તાદ્રલિભી નગરીના રાજને શ્રીપ્રભા નામે પઢટેલી હતી. તેની કુક્ષીને વિશે ગિરિસુંદરનો જીવ ઉત્પન્ન થયો. તે સમયે સ્વર્ગમાં સિંહથી અંકિત અને કુસુમાદિકથી પૂજાએલી રતનમંહિત દંડવાળી આકાશમાં નૃત્ય કરતી ધ્વજને જોઇ. જાગ્રત થયેલી રાણી ખુશી થતી રાજ પાસે ગઈ. રાજ પાસેથી પુત્ર જન્મની વાત સાંભળી ગર્ભનું પોષણ કરવા લાગી. સારા દ્વાંહે રાણીને પુત્રપ્રસવ થયો તેનું નામ રાખ્યું કનકદ્વાજ.

રાજની બીજી રાણી સ્વર્યપ્રભાની કુદ્ધીએ રતનસારનો જીવ નવમા ઘૈંબેયકના સુખ લોગવીને ઉત્પન્ન થયો. તેનું નામ રાખ્યું જ્યસુંદર. પિતાએ ધનવ્યય કરી એમે પુત્રોનો જન્મ મહોત્સવ કર્યો.

અનુક્રમે વૃદ્ધિ પામતા અને ભણી ગણી કલા વિશાદ થયા. તે સાથે નવીન યૌવનદ્રધી વનમાં આવ્યા. ભવાંતરના સ્નેહથી આ સ્વરમાં પણ એમનો સ્નેહ અપૂર્વી

હતો. પાપથી રહિત, નિર્દોષ રમત ગમતમાં તે અન્ને પોતાનો સમય પસાર કરતા હતા. રાધાવેદ આદિ અનેક પ્રયોગ કરીને પોતાની કળાને સાર્થક કરી રહ્યા હતા. એવા નાતા છતાં સજજનોને પણ તેચો માન્ય હતા.

એક દિવસે નગરીની ઘણાર ઉચાનમાં ભિત્રાહિક પરિવાર સમક્ષ રાધાવેદનો પ્રયોગ કરતા હતા તે સમયે એ વિદ્યાધરો ત્યાં થઈને આકાશ માર્ગ કોઇ કાર્ય પસંગે જધ રહ્યા હતા તેમણે ભૂમિ તરફ દિશિ કરતાં આ અન્નેને રાધાવેદનો પ્રયોગ કરતા જોઇ પ્રસન્ન થઈને તેમની ઉપર મુષ્પવૃષ્ટિ કરીને આગળ ચાલ્યા ગયા. પુણ્ય વૃષ્ટિ જોઇ તેમનો પરિવાર રાજ થયો. “વાહ ! આ અન્નેની દેવતા-ઓએ પણ પૂજા કરી.”

એકદા રાજ સુમંગલ રાજસભા ભરીને ધોડા હતો. ત્યારે ઉત્તર દિશા તરફ મેટો કોલાહલ થતો. સાંભળાયો. એ જગતને ક્ષોલકારી ખળખળાઈ સાંભળી સભા સહિત રાજ વિસમય પાણ્યો. “ અરે મોટી સેનાવાળો કોઇ રાજ અહી આવ્યો કે શું ? ” રાજપુરુષો અને સુલદો પણ ક્ષોલ પામી ગયા. અનેક પ્રકારના વાહિનિના નાદ સાંભળી બધા આકાશ તરફ જોવા લાય્યા. ” અરે ! આતો બધું તોડાન આકાશમાં જણાય છે ને શું ? દેવતા અને દાનવોનું ચુણું શું ? ”

સુંદર સ્વરૂપવાળા એ વિદ્યાધરો અદી રાજ સભાની દિશિને આકર્ષિતા આકાશમાંથી રાજસભામાં ઉત્તર્યા. સિંહાસને બિરાજેલા સુમંગલ રાજને એ હાથ જોડી વિનંતિ કરવા લાય્યા. હે રાજન ! ઉત્તરદિશામાં અનેક આમ, નગર અને આરામ (અગ્નીચ્યા)થી શોલતા વૈતાદ્ય ઝર્ઝર્ઝર્ઝની અન્ને શ્રેણિનું પાલન કરતા સુરસેગ અને સુવેગો

નામે એ વિદ્યાધરેશરોને સો સો કન્યાએ છે. એ અને એચરેશરો એકદા રાધાવેદ કરતા તમારા પુત્રો ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને ચાહ્યા ગયા. ને પોતાની પર્ખદામાં તેમના પરાડમની સ્વરૂપની ખૂબ તારીઝ કરી તેમજ નિમિત્તિયાની વાણી સાંલળી એ કન્યાએ અને રાજકુમારો પર ગાઠ રાગ વાદી થઈ.

નિમિત્તિયા પાસે વિવાહ દિવસ જેવરાવી એ અને એચરેંડ્રો પોતાના કન્યાદિક મોયા પરિવાર તેમજ એક્સ્ટર્ન સાથે અત્યારે આપના તરફ આવે છે જેની વધામણ માટે અમને આપની પાસે મોકદ્યા છે. માટે આપ એમના સ્વાગતની તૈયારી કરો.”

વિદ્યાધરની વિનાંતિથી રાજએ ખુશી થઈને તૈયારી કરવા માડી. ભંત્રી, સામંતો ને મોયા મોયા રાજપુરેષા સહિત સર્વ સામની સાથે તેમની સામે રાજ સ્વાગત માટે નિમાયો. આજા નગરમાં એ વાત પ્રસરી જવાથી નગરીના લોકો પણ રાજ થઈને એ મહોત્સવમાં લાગ લેવાને તૈયાર થઈ ગયા. પલકવારમાં સારાય નગરને શાંખગારી શોભામાં દીક્રુંધુરી સમાન બનાવી દીઢું.

પોતપોતાની કન્યાએ સાથે આવેલા એચરેંડ્રોનું સારી હીતે રાજએ માન સન્માનથી આતિથ્ય કર્યું. તેમના ઉતારા માટે વ્યવસ્થા કરી, અનેક રાજપુરેષા, રાજસેવકો એ મહુમાનોની સરસરા કરવા લાગ્યા. એક બીજાની સુલાંકાતથી રાજ અને વિદ્યાધરેંડ્ર પરમસંતોષ પામ્યા, પછીતો વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી વિવાહની લારે તૈયારીએ થવા લાગી.

સારા ઝુદ્ધતે અને શુલ્ક દિવસે તે અને રાજકુમારોનાં વિદ્યાધર બાળાએ સાથે મોયા ધામદુમથી લગ્ય થઈ

ગયાં, સુરવેગ વિદ્યાધરેંદ્રે પોતાની સો કન્યાઓ કનકદંજા  
રાજકુમારને આપી ત્યારે સુવેગ વિદ્યાધરેંદ્રે પોતાની સો  
કન્યાઓ જયસુંદર કુમારને આપી, વિદ્યાધરેંદ્રો પોત-  
પોતાની કન્યાઓનો લશોત્સવ ઉજવીને પોતાના સ્થાનકે  
ચાલ્યા ગયા.

સુરકુમારની માર્ક એ કન્યાઓ સાથે કીડા કરતા  
અને રાજકુમારો રૂપવતી વિદ્યાધર ભાગાઓને આનંદ  
આપનારા થયા, સિવાય એમના રૂપ, ગુણ અને સૌભા-  
ગ્યથી આકર્ષણીયા અનેક રાજભાગાઓ હૂર દેશથી સ્વ-  
યંવરા આતીને તેમને પરણી, એ પ્રમાણે અને રાજકુમારોને  
પાંચસેં પાંચસેં કન્યાઓ થઈ, તેમજ ભરતાર્ધના રાજ-  
એઓ મોકલેલા હાથી, ઘાડા, રથ ઇંદ્રિ, સિદ્ધિવડે વૃદ્ધિ  
પ્રાભતા તેઓ અતુપમ લોગોને લોગવવા લાગ્યા.

## ૨

### સુમંગલ રાજાની દીક્ષા

પુત્રોના પ્રતાપથી અલયુદ્ધ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ  
પ્રાભતા રાજ સુમંગલ પુત્રના અદ્ભૂત ભાગ્યનાં વખાણ  
કરવા લાગ્યા, “અહો ! આશ્ર્ય છે કે મારા પુત્રોના પુણ્યો-  
દ્વાર જગતને હેરત પમાડે તેવો છે. જેમના પ્રલાવથી ભૂચર  
અને ઘેયરના નરપતિઓ નિરંતર એમની સેવા કરે છે.  
વગર આમંત્રણે મોદા મોદા નરપતિઓ અને વિદ્યાધર-  
પતિઓ પોતાની કન્યાઓ અને સમૃદ્ધિ આપી જાય છે  
તો મોદા પુણ્યોદ્વાર વગર એ ધર્મ શું બની શકે છે ?

તો મારે પણ હવે શું કરવા ચોણ્ય છે ? આ મોકું  
સાઓન્ય પુત્રોની તરફેણુમાં છાડી હવે મારી વધ્યને  
ચોણ્ય પરલોક સાધન માટે મારે આત્મહિત કરવું જોઇએ,  
ને ધર્મની સેવા વગર આત્મહિત થધ શકતું નથી. જે

શ્વિધતાથી આત્મહિત કરે એવા ધર્મનું મારે સેવન કરેલું ઓફે કારણુકે સારા ધર્મની સેવા કરનારા તો જગતમાં હુર્દાલ હોય છે.

ધર્મના મનોરથ કરતો રાજ સુમંગલ સારા ધર્મની ઐવના કરી રહ્યો હતો, મંત્રીને પૂછી પાખંડીએ પાસેથી ધર્મ સાંલળવાને તૈયાર થયો હતો તે દરમિયાન વનપાલકે રાજને વધામણું આવ્યો. “હેવ ! હેવરમણું ઉદ્ઘાનમાં મૂર્ત્તિ-માન ધર્મસમાન શ્રીસ્વયંપ્રલ નામે સૂરીથર પવાર્યા છે તેમને પ્રાતઃકાળે કેવલજ્ઞાન ઉત્તેજ થયું છે, જુએ ! આ વધા હેવતાએ તેમના વરણુંની સેવામાં લીન થઈ ગયા છે બધું આકાશમંડળ હુંદુંભિના નાહોવડે છયાએ ગયું છે. એવા જ્ઞાની ગુરુ-સૂરિને નમી એમનો ઉપદેશ આપને સાંલળવા યોગ્ય છે.”

વનપાલકની અમૃતથી પણ અધિક મીठી સમયને ઉચિત વાણી સાંલળી રાજ ખુલ્લ પ્રસ્તુત થયો, તેનાં દારિદ્ર હુર કરી મોદ્ય પરિવાર અને ચતુરંગી સેના સાથે સૂરી-શ્વરને વાંદવાને ચાલ્યો. ગુરુ પાસે આવી ગુરુને નમી જેમની સ્તુતિ કરી બજે હાથ જોડી ધર્મ સાંલળવાને બેઠો. બુરુંએ તેમને દેશના આવ્યો.

“હે લભ્યો ! અપાર અને મહા ભયંકર આ સંસાર-દ્વીપી કાંતારમાં સુક્ષ્મિની ઈચ્છા કરનારા પ્રાણીએને શુદ્ધ આર્ગ પ્રાપ્ત થયો ખુલ્લ હુર્દાલ છે. અનેક ઉન્માર્ગમાંથી કોઈક બુદ્ધિમાન શુદ્ધમાર્ગ શોધી કાઢે છે. કારણુકે અજ્ઞાનની લુચો બહુધા એ કુમાર્ગમાં મુંજાધને જાળમાં ઇસેલાની આફુક ગુંચવાઈ જાય છે છતાં શુદ્ધમાર્ગ પ્રાપ્ત કરી શકતા નથી, આ ભવદ્વીપી અરણ્યમાં શું નથી ? જ્યાં દેખદ્વીપી ચ્યાં અને રાગડીપી સિંહ, મોહદીપી રાક્ષસના પ્રેરલા આઈ

પણ પ્રાણીને પોતાના સકંજામાંથી છટકવા હેતા નથી.

એ અરણ્યમાં માનરિપી વિશાળ પર્વત પડેલો છે. ચારેકાર કોધિપી દાવાનળ સણગી રહ્યો છે. જ્યાં લોલારિપી કુવો પ્રાણીઓને પોતાના ઉદ્દરમાં સમાવી રહ્યો છે ત્યાં માયારિપી કુમાર્ગમાં લૂલેલા સુસાંકરને શુદ્ધમાર્ગ ક્યાંથી જડે?

એ અધ્યાય શરૂઆથી પ્રાણીઓ પરાલવ પામીને વિષયરિપી વૃક્ષનો આશ્રય લેવા જય છે. તો ત્યાં પણ વિષયની છાયાથી દ્યાયેલા તેઓ જડ જેવા ખની જય છે એવી દીતે અજ્ઞાનથી મોહયેલા ધધ તેઓ હુર્ગતિરિપી ભયંકર આડામાં પડે છે. પણ ભવકાંતારના પારને તેઓ પામી શકતા નથી.

માટે હે ભવ્યો ! કુમાર્ગનો ત્યાગ કરી શુદ્ધ માર્ગ ચાલો કે જેથી તમે પરમ નિર્વાણ નગરે પહોંચી જાઓ. હે રાજન ! સર્વ સાવધનો ત્યાગ કરેવો એ જ શુદ્ધ માર્ગ છે, તેમજ શરૂ અને ભિત્રમાં, સુવર્ણ અને કથીરમાં, રાજ અને રંકમાં કે સમાન-મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી, તેને જ લગવાને ધર્મ કર્યો છે એ જ મોક્ષનો સત્ય માર્ગ છે. માટે હે ભાગ્યવાન ! મોક્ષમાર્ગને આપનારા એવા શુદ્ધ ધર્મમાર્ગમાં તું પ્રવૃત્તિ કર. ”

શુરૂની વાણી સાંભળી બોધ પામેલો રાજ હાથ કોઈ ઘોલ્યો, “ભગવન ! રાગદ્વેષથી ભરેલા લૌકિક દ્વો જ્ઞિયાહિકથી પરાલવ પામેલા અમારા સરખા છે, તે પ્રાણી ઓને એકાંત હિત કરનારા થતા નથી તે આજેજ મેં જણ્ણું. આપનો યોગ પામી હું હુવે સંયમલક્ષ્મીને વરીશા.

રાજાએ નગરમાં આવી કનકદંડજને રાજ્યપદે સ્થાપન કરી જયસુંદર કુમારને યુવરાજની લક્ષ્મીથી અદંદૃત

કર્યો. નવા રાજએ દીક્ષા મહોત્સવ કર્યો અને રાજએ અનેક સામંત અમાત્યની સાથે ચારિત્ર અંગિકાર કર્યું.

નવા રાજ કનકદવજ અને યુવરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરતા તેમજ પિતાની દીક્ષાનું મનમાં સમરણ કરતા તેઓ રાજ્ય ભોગોમાં પણ આસક્તિ રહિત હતા, અનેક વિદ્યાધર અને કિશરની કન્યાઓની પ્રીતિવાળા, ભરતાધ્રના રાજએથી પૂજાતા, ગજ, અંધ્ય, રથ અને મણિ, માણેક તેમજ રત્નોની વિપુલ સમૃદ્ધિ હોવા છતાં ગર્વ રહિત અને ગુરુના સમાગમની ધર્ષણ કરતા તેઓને મોહિંદ્રી પિશાચ પોતાના પંજામાં સપડાવી શકતો નહિ.

સમ્યકૃતવગુણે કરીને શોભતા તેઓ જીનેશ્વરના ધર્મનું આરાધન કરતા હતા. જૈનધર્મની પ્રકાવના વધારતા તેમણે દ્વિંદ્ર યાત્રા શરૂ કરી. પૂર્વ પુરુષોએ અંધાવેલાં જીનમંહિરોને વંહના કરતા, જીર્ણમંહિરોનો પુનર્દ્વજાર કરવા લાગ્યા. જીનેશ્વરના ધર્મની હીલના કરતારાઓને શામ, દામ, દંડ અને લેદથી અટકાવ્યા, સાંધુ સાંધુ, શાવક અને શાવિકાનું સન્માન કરવા લાગ્યા. હાનવડે હીન, હુંઘી અને રંક જીનોનો ઉદ્ધાર કરવા લાગ્યા, કેટલાય નવીન જિનયૈત્યો અંધાવ્યાં.

રાજ કનકદવજ અનુકૂમે સાકેતપુર નગરે આવ્યા, ત્યાં નગરના ઉધાનમાં અરિહંત લગવાનનું વિશાળ અને મનોહર ચૈત્ય લેછ ખુશી થયેલા રાજએ લગવાનની પૂજા કરી સ્તુતિ કરી, જીનેશ્વરને પૂજ તેમના સ્તુતિ કરી રાજ ચૈત્યશૃષ્ટિ બહાર નીકળ્યો. તો એક મોદ્ય વૃક્ષની નીચે મુનિપરિથારે ચુક્ત સૂરીથરને લેછ હર્ષથી ગુરુને જ્રમ્યો, દ્વારીએ તેમને ધર્માપદેશ આપ્યો તે સમયે ત્યાંનો રાજ પણ પોતાના પરિવાર સાથે ગુરુની દેશના સાંભળના આવ્યો હતો.

૩

### સાકેતપુરમાં

“હે ભવ્યો ! મતુષ્યપણું, આર્થિક્ષેત્ર, ઉત્તમજ્ઞતિ, દીર્ઘ આયુષ્ય ને ધર્મસામગ્રી એ બધું પામીને સર્વશક્તિથી તમે ધર્મને વિષે ઉદ્યમ કરો કે જેથી એ બધી સામગ્રી વૃથા ન થાય, નવગ્રાંશવૃક્ષને પુણ્ય દુર્લભ હોય છે, સવાતિનાં જળ તેથીય દુર્લભ હોય છે, દેવર્દશન પણ દુર્લભ હોય છે, તેથીય મતુષ્ય જન્મ પણ પ્રાપ્ત થવો દુર્લભ છે. એવો દુર્લભ માનવલન મોટા પુણ્યથી તમે પ્રાપ્ત કરી પ્રમાણના વશમાં પડી ધર્મકર્મ ભૂલી હારી જશો નહિ, સાગ્રયોગે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રતનને કાગડાને ઉડાડવા ઇંકે તે કેવો કહેવાય !

માણસ પૂણ્યથી અનેક રતનો મેળવી શકે છે. વૈભવ, અયધ્યર્થ, ઠકુરાઈ ઋઙ્કરિ, સમૃદ્ધિ, સુખ, સાહેણી મેળવી શકે છે. છતાં ગયેલી મતુષ્યાયુની ક્ષણ કોઈ રતનો આપવા છતાં મેળવી શકતો નથી. તો એવું દુર્લભ મતુષ્યલવનું આયુ પ્રમાણના વશમાં પડી શા માટે હારી જનું ?

ધર્મના અર્થી મતુષ્યને તો ગુરુજનની પૂજા, દ્વારા, દીન, જય, તપ, તીર્થયાત્રા, શાસ્ત્રવણ અને પરોપકાર એ આડે કૃત્ય મતુષ્ય જન્મના ઇણ સમાન અહેનિશ કરવા યોગ્ય છે કારણું આ જગતમાં મોહબેલા માનવને બધી પણી શું થવાનું છે તેની કંઈ અધર પડતી નથી. ”

ધર્મ દેશના સમાપ્ત થતાં પુરષોત્તમ રાજના પુરોહિત કર્પિજલે ગુરુને પૂછ્યું. “હે સુરીન્દ્ર ! જીવનો સદ્ગ્લાલ હોય તો તમે કહો છો તે બધી વાત સત્ય કહેવાય. જતાં કે આવતાં જીવને કોઈએ બેયો છે કે તમે તેના સદ્ગ્લાલ માટે

આદલી બધી વ્યાખ્યા કરો છા ? વસ્તુતઃ તો કેદ્ધપણ રીતે જીવ હેખાતો નથી. શાખ શાખની માડક સંભળાતો નથી. રસ વડે કરીને પણ જણ્ણાતો નથી. એવી રીતે ડેઢ પણ પ્રમાણ વડે આત્માની સિદ્ધિ થતી નથી માટે વસ્તુતઃ તો જીવજ નથી. પાંચ ભૂતથી ઉત્પન્ન થયેલી શક્તિનેજ વિક્રાનો જીવ એવું ઉપનામ આપે છે. ગુહાદિક દ્રવ્યથી જેમ મહ શક્તિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે મનુષ્ય અને તિર્યાંચમાં જેને તમે જીવ કહો છો તે માત્ર પંચભૂતજું જ પરિણામ છે બીજું નહિ. ” એ પોતાને વિક્રાન મનાવતા કપિંજલે પોતાના જ્ઞાનનો ધરો ડાલવી દીધો.

નાસ્તિક આદ્ધણ કપિંજલની વાણી સાંભળી જ્ઞાની ગુરુ બોલ્યા. “ હે લદ ! છઘસ્થ જીવો અર્પી જીવને હેખી શક્તા નથી. છતાં જ્ઞાને કરી લવતું સ્વરૂપ સમજ શકાય છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, કાષમાં અમ્બિ, હેખાતી નથી છતાં જાણી શકાય છે તેમ શરીરમાં રહેલો આત્મા પણ જાણી શકાય છે, છતાં કેવલજ્ઞાનથી જ તે પ્રત્યક્ષ સિદ્ધ છે.

હે કપિંજલ ! તું જે પંચ ભૂતની વાત કરે છે તે અરાધર નથી. કેમકે એ પંચભૂતને તું સચેતન માને છે કે અચેતન ? જો સચેતન માનીશ તો સિદ્ધ, એકંદ્રિયાહિ બધા જીવ છે એ સિદ્ધ થયું. જો અચેતન માનીશ તો અચેતન એવા એ પંચભૂત સમુદ્દરયમાં પણ ચેતન શક્તિ શી રીતે પ્રગટ થશે ? જે વસ્તુ એકમાં નથી તે સમુદ્દરયમાં પણ રેતીના સમુહની માડક ન સંભળે. કારણકે રેતીના એક કુણુમાં જેમ તેલ નથી તેમ સમુદ્દરયમાં પણ નથી.”

ઇત્યાહિક અનેક યુક્તિઓ વડે સૂરીધરે કપિંજલને નિરૂપિત કરી દીધો. ત્યારે પોતાને કંઈપણ યુક્તિ ન આવડવાથી

કપિંજલ મૌન થઈ ગયો. છતાં જ્ઞાની એવા સૂરીશર મોહુ  
દ્વી મિથ્યાત્વાંધકારમાં ભૂલા પડેલા આ પામર જીવપર  
કરેણા લાવીને બોલ્યા. “હે કપિંજલ ! તારો આ કૃષોબ  
સ્વભાવજન્ય નથી, પરંતુ પોતાના પાપે કરીને જાત્યંધ  
થયેલા તારા મામા કેશવે તને દદ મિથ્યાત્વ તરફ બેચ્યો  
છે—મોહુથી તને અમિત કર્યો છે.”

કેશવની વાત સાંભળી અનેક વિચારવમળમાં પડેલો  
પુરુષોત્તમસાળ હાથ જોડી બોલ્યો. “લગવન ! એ કેશવે  
પરભવમાં શું પાપ કર્યું, કે જેથી તને આવું અંધત્વ  
પ્રાપ્ત થયું તે આપ કર્ણો.”

રાજના પૂછવાથી પર્ષાદાના બોધને માટે ગુરુએ કેશ-  
વતું ચરિત્ર કહેણું શરૂ કર્યું.

#### ૪

### મોહનના ભવમાં

વસંતપુર નગરમાં પૂર્વે વીરાંગદ નામે રાજ હતો.  
ગુણવાન અને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળો. છતાં એ  
રાજ મૃગયાનો બહુ શોભીન હતો. એક દિવસે અશ્વાઢ  
થઈ અદ્ય પરિવાર સાથે મૃગયા ખેલવાને નિકળ્યો. જાગ-  
લમાં ભૂમણુ કરતાં વનચર પશુએ તરફ પોતાના અથને  
દોડાવતો સેવકના કહેવાથી તે રાજ એક શુકરની પછવાડે  
દ્વારા અને શરસંધાન કર્યું:

બાળની પછવાડે રાજ પણ વેગથી ધસી આવ્યો.  
સજાએ શુકરને તો જોયો. નહિ પણ પોતાના બાળથી ચર-  
ણને વીંખાયેલા એવા ધ્યાનીભુનિને જોયા. ધ્યાનમાં ઉલેલા  
ભુનિને કલેશ પમાડવાથી રાજ પશ્ચાત્તાપ કરતો ભુનિના  
ચરણે નભ્યો. “લગવન ! મારો અપરાધ ક્ષમા કરો.

આપના જેવા નિરપરાધી મુનિને નાહક મેં પીડિત કર્યા,  
બારાતિબોર નરકમાં પણ મને સ્થાન નહી મળે, એ મહા  
પાપ મારાં હૂર કરો, હું તમારા શરણે આવ્યો છું.”

રાજ મુનિના ચરણમાં પડી ખુલ્લ પદ્માસ્તાપ કરવા  
લાગ્યો, મુનિએ પોતાનું ધ્યાન પૂર્ણ કરી રાજને ધીરજ  
આપતાં કહું. “રાજન! ભય રાખીશ નહિ, અપરાધીજનો  
ઉપર પણ મુનિએ કોપ કરતા નથી તો પછી તારા જેવા  
પદ્માસ્તાપ પરાયણ ઉપર તો કોષ શી રીતે કરી શકે? છતાં  
કંઈક હિતોપદેશ સાંલળ!

હુંનું પાન કરતારો માર્જર લાકીના ઘાને જોતો  
નથી તેવી રીતે પાપાસકત માનવી પણ નરકના ભયને  
મનમાં લાવતો નથી, તે દુર્લભ મતુષ્યપણ વ્યર્થ ધર્મકર્મ  
વગર ગુમાવે છે, દિવસે દિવસે આચુ ક્ષીણ થતું જાય છે  
ને મૃત્યુરૂપી રાક્ષસ પકડવાને ધર્સી રહ્યો છે તો જ્યાં સુધી  
એ રાક્ષસે પકડયો, નથી તેથલામાં મૃગયારૂપી પાપતો  
ત્યાગ કરી ધર્મને વિષે ઉધ્બ કર.

નરકાદિક આપવાતું મૂળ કારણ તેમજ સ્વર્ગ અને  
મુક્તિની લક્ષ્યમીને હૂર કરતાર, હુંખની પરપરાને આપ-  
નારી એ જીવહિંસાનો હે રાજન! તું ત્યાગ કર, વિષતું  
પાન કરી પોતાનું જ અનિષ્ટ કરી રહ્યો છે, જે મહા પાપ  
રૂપી વ્યાપારે કરી પોતાના કુદુંખો જનોનું પોપણ કરે છે,  
તે આ ભવમાં હુંખી હુંખી થવા છતાં તેણું કોઇ રક્ષણ  
કરી શકતું નથી, માટે હે રાજન! ધર્મ માર્ગમાં પ્રીતિ  
વાળો થા, કે જે ધર્મ શરીરનો નાશ થાય તોપણ પર-  
ભવમાં આત્માને સુખ આપનારો થાય છે.”

મુનિના ઉપહેશથી પ્રતિષેધ પામેલો રાજ વીરાંગન  
સમ્યકત્વ મૂળ ખારત્રતને યથાશક્તિ અહુણ કરી પોતાના

નગરમાં ગયો. તે દિવસથી પ્રતિ દિવસ ધર્મની આચરણા કરતો રાજ અનુકૂમે શુદ્ધ આવક થયો.

એ વસંતપુર નગરમાં જીવાળાદિક તત્ત્વનો જાણકાર જીનપ્રિય નામે આવક રહેતો હતો. કદાચણ રહિત અને માર્ગાનુસારી એવો તે આવક પ્રતિ દિવસ રાજયાસે આવી શાસ્ત્રની વાત સંલગ્નાવી રાજને ધર્મમાં સ્થિર કરતો હતો. રાજ પણ એ આવકનું બહુમાન કરતો હતો. એ આવકની ભણ્યથી સામાયિક, પૌષ્ટિ, જીનપૂજાદિક કાર્ય નિરંતર શુદ્ધપણે કરતો હતો. કારણકે સંસારમાં સાધર્મિકપણાની સગાઈ તે જ ખરી સગાઈ છે કે જે સગાઈ ભવાંતરમાં પણ આત્માને સુખ આપે છે.

તે નગરમાં સ્વજન પરિવારથી રહિત, નિર્ધન, મોહન નામે કોઈ વિષ રહેતો હતો. તે નાસ્તિક હોવા છતાં આજીવિકા આતર જૈન ધર્મને પાળતો, લોકોને જૈન ધર્મનો ઉપહેશ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એણે જીન પ્રિય સાથે કપટ મૈત્રી કરી. એકદા એની સાથે તે રાજની પાસે આવ્યો. રાજની આગળ જૈનધર્મની પ્રશંસાના મુખ્યોને વેરતો રાજના વિશ્વાસનું પાત્ર થયો. રાજએ તેને પોતાના મુખ્ય જીનમંહિરમાં પૂજારી તરીકે રાખ્યો. કે જેથી નગરના મહાજનોને પણ તે માનને ચોણ થયો.

સંસારપર વૈરાગ્યવાન રાજએ દીક્ષા ગ્રહણ કરવાનો નિશ્ચય કરી મોહનને કહ્યું. “હે ભદ્ર! ગુણવાન એવા કોઈક ધર્મચાર્યને તેડી લાવ કે જેમની પાસે હું પરલોકમાં હિતકારી એવા પ્રતને ગ્રહણ કરેં, તેમની સેવા કરી સંસાર સમૃદ્ધ તરી જાઉં.”

રાજની વાત અંગીકાર કરી મોહન ચાલ્યો ગયો. પણ તે મનમાં વિચાર કરવા લાગ્યો. “આ રાજ જો

દીક્ષા લેશે તો મારી આજીવિકા તુટી જશે નથો રાજ કોણું જણે પછી શું કરશે.” એમ વિચારતો કેદાક દિવસ પછી રાજની પાસે આત્મને કહેવા લાગ્યો. “હે ! મેં નગરમાં તેમજ બીજે સ્થળે ગુરુની બહુ શોખ કરી પણ એવા ગુણવાન અને જ્ઞાનીગુરુ મેં જોયા નહીં. કોઈ પરિયહુદારી તો કોઈ શિથિલાચારી તો કોઈ ક્ષાયના ભરેલા. કોઈ માયા કંપણ વૃત્તિથી બાધે આડંઘર વાળા જોયા પણ જેમના ચરણ દ્વારી યાનપાત્ર વડે સંસાર સમુદ્ર તરી શકાય એવા કોઈ મેં જોયા નહીં. માટે હાલમાં તો આપ પુરુષવાન એવા ગુહેવાસમાં રહેલા, જ્યાં દાન, શીલ, તપ અને ભાવથી ધર્મ સાધી શકાય છે. હું પણ દીક્ષાની ભાવના વાળો છું પણ તેવા ગુરુના અભાવે હુંએ હુંએ સંસાર નિષાવી રહ્યો છું.”

મોહનના શાખદ્વા સાંભળી રાજ વિચાર કરવા લાગ્યો. અહો ! આ પાપી પ્રતની ઉત્થાપના કરે છે. ધતિધર્મ તો મુક્તિની લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શીધુ ઉપાય છે માટે જુન પ્રિયને પૂછવા હે.” એમ વિચારી મોહનની પાસે જુનપ્રિયને બોલાવી મોહનની વાત અને પોતાનો અભિપ્રાય કહી સંભળાવ્યો. જુનપ્રિય મોહનને ઉદ્દેશી બોલ્યો. તું મોહન છે તે તારું નામ સત્ય છે, કે આ રાજને પણ તું મુંઝવી નાખે છે. પણ સાંભળ—સાંભસિક પુરુષોને બ્યપળ ચિત્ત પણ શું કરી શકે તેમ છે ? હુર્જય એવા ધંદિયાના વિકારો પણ તેને કંઈ કરી શકતા નથી. પ્રમાદનો ત્યાગ કરી સાવધાન પણે તેઓ પ્રત પાળે છે. સ્વાધ્યાય, ધ્યાન, તપમાં ઉધ્ભવાળા મુર્નિયોતું ચિત્ત કદાપિ બ્યલાયમાન થતું નથી. અટાર હળર શીલાંગ રથના ભારને વહેન કરેનારા મુનિ એ રથને કથારે પણ અર્વ માર્ગ છાડતા નથી. કર્મના દોષ થકી

કોઈનો રથ સખલિત થઈ જાય તેથી શું અન્ય જનોએ  
પ્રવૃત્તિ ન કરવી ? કોઈક પ્રમાદીનું વહાણ સમુદ્રમાં ભાગી  
ગયું જેથી શું ધીજાએ ધન કમાવા સમુદ્રની મુસાફરી  
ન કરવી ? જીવરના રોગવાળો કોઈક ધી આવાથી મરી  
ગયો જેથી ધીજા રોગ રહિત જતોએ પણ ધી ન ખાવું શું ?

તે કહ્યું કે સંસાર થડી તારનાર એવા કોઈ ગુરુ આજે  
હેખાતા નથી તે તારું પ્રગટ નિષ્ઠનવપણું અને ગુમે મિથ્યાત્વ  
જણાય છે સર્વસંગ રહિત, પંચ મહાત્રત પાળનાર, પંચ  
સમિતિ અને ત્રણ ગુમિથી શોભતા, જ્ઞાન, ધ્યાન અને  
તપમાં લીન ગુરુઓ આજે પણ જોવાય છે છતાં તારા જોવાને  
એવા ગુણવાન મુનિઓ હેખાતા નથી. કારણું એ અંધ  
માણસ નજર સમક્ષ રહેલા ઘયાદિક પદાર્થી પણ જોઈ શકતો  
નથી. અરે મૂર્ખ ! નિર્ભિંથ, સનાતક, પુલાક, બદુશ અને  
કુશીલ એ પાંચ પ્રકારના સાધુઓ તીર્થમાં હોય છે તે પણ  
શું તું જાણતો નથી ?

નિર્ભિંથ સનાતક અને પુલાક એ ત્રણ હાલ બુન્ધેદ છે  
પરંતુ બદુશ અને કુશીલ જ્યાંસુધી તીર્થ છે ત્યાંસુધી કાયમ  
રહેશે એ ભૂલીશ નહીં. માટે હે મોહન ! જો અનાંત લવ-  
ભ્રમણનો ડર હોય તો આ પાપનું તું પ્રાયશ્ચિત કર-તારા  
આત્માને નિર્મળ કર.”

શુનપ્રિયનો મોહનને એ પ્રમાણે ઉપદેશ છતાં મોહને  
પોતાનું પાપ આલોચણું નહિં. જેથી રાજાએ મોહનને રજા  
આપી પોતાની પાસેથી હૂર કર્યો.

૫

### ગુણુધર અને સુમિત્ર

મોહનને દૂર કર્યા પછી જીનપ્રિય રાજને કહેવા લાગ્યો। “હેવ ! આપને ધન્ય છે કે આપ નિર્ધિંદ્ય થવાને દૃષ્ટિ છો. સુખમાં આવા મનોરથો ઉત્તમ જીવાને જ થાય છે તો ગુરુનો જોગ પામી આપના મનોરથ સફળ થાય. હું પણ આપને સહાયકારી થઈશ. આપના પુણ્ય પ્રતાપે આપના નગરના ઉધાનમાં ગાઈ કાલે શ્રી જયકાંત મુનીથર પદ્ધાર્યા છે તેમની પાસે જઈને આપણે આપણું હિત સાધીયે.

જીનપ્રિયની વાણી સાંભળી પ્રસંગ થયેલો રાજ ઉધાનમાં આવી મુનિને નમ્યો ને તેમની ધર્મ દેશના સાંભળી. “હે અભ્યો ! આ દુઃખમય સંસારના દુઃખની શું વાત કરીયે ? પુરુષને જન્મતાં પ્રથમ તો ગર્ભવાસમાં દુઃખ સહેન કરવાં પડે છે. જન્મયા પછી બાલકપણુંનાં દુઃખ કર્યાં ઓળાં છે ? મલીનપણું ગંદાપણું, વિષાથી લેપાવું તેમજ મલીન શરીરવાળા સ્ત્રીના સ્તતનમાંથી સ્તતનપાતાન કરવું એ ઘણું જ્ઞાનીની નજરે ખુલ્ય વૈરાગ્યનું દારણું છે. તારણ્યમાં રોગ, શોક, સંતાપ ધન કમાવાતું, અને વિરહજન્ય દુઃખ વગેરે અનેક દુઃખો રહેલાં છે. અને વૃદ્ધાવસ્થા તો નરી દુઃખથી ભરેલીછે, તો હે મનુષ્યો ! મનુષ્ય ભવમાં પણ સ્વદ્ય જેચુલુંય સુખ નથી તો પછી નરક અને તિર્યંચ ભવની આપહા-ઓનું શું વર્ણન કરીયે ?

મનુષ્ય ભવમાં પણ રંક, ગરીબ અને નિર્ધિનને દ્વય કમાવાની ચિત્તા, ધનિકને ધનના રક્ષણુની ચિત્તા, વાંદા નરને જ્ઞાની અભિલાષા, ત્યારે પરણેલાને પુત્રની ચિત્તા. પુત્ર કે પુત્રી થાય તો પછી એને લગતી ચિત્તાનો કાંઈ પારે

આવે છે ? એક ચિત્તા હૂર થઈ કે બીજી ચિત્તા એનું સ્થાન  
લઈ લે છે માટે એ બધી ચિત્તાનો ત્યાગ કરી મુક્તિને માર્ગે  
જવાનો પ્રયત્ન કરો ”

યુરુની વાણી સાંભળી મુક્ત થવાની અભિલાષા  
વાળા રાજાએ નગરમાં આવી વીરસેન કુમારને રાજ્યપદે  
સ્થાપન કરી જનપ્રિય તેમજ મંત્રી, સામંત અને શ્રેષ્ઠિની  
સાથે યુરુ પાસે દીક્ષા અહેણ કરી. છુટુ, અફુમ આહિ તપસ્યા  
કરતો ને અગીયાર અંગનો જ્ઞાતા રાજ વીરાંગન મુનિ-  
વર્મને સારી રીતે પાલવા લાગ્યો.

સાધુધર્મની દ્વારિથ સમાચારીનું આરાવન કરતા ને  
મુનિગણુની વૈયાવચ્ચ કરતાં ખુખ પુણ્ય ઉપાર્જન કર્યું.  
પ્રાણાતે અનશનપૂર્વક કાળ કરી મહાશુક દેવલોકે ધંદ્રપદને  
પામ્યો. જનપ્રિય શાવક પણ એ ધંદ્રનો મહર્ષિક એવો  
સામાનિક દેવ થયો. એને મહાશુક દેવપણાનાં હિવ્ય મુખો  
ભાગવવા લાગ્યા.

પેલા ધિગ જાતિમોહન ત્યારથી સાધુ દ્રોહી થઈ સાધુ-  
ઓનાં છિદ્ર લેવા લાગ્યો. અભિનિવેશ મિથ્યાત્વવાળો  
તે પૌષ્ઠ્ર, પ્રતિકમણુના જહાને ઉપાશ્રયમાં જઈ સાધુ-  
ઓનાં જીણામાં જીણાં છિદ્રને મોઢં સ્વરૂપ આપી લોકની  
આગળ સાધુઓની નિદા કરતો પણ તેમના ગુણને અહેણ  
કરતો નહિ.

“ અરે બુઝો તો અરા આ સાધુ તો મુખ આડે  
મુહુપત્તિ રાખ્યા વગર ઘોલ ઘોલ કરે છે. આ સાધુ  
અહાર જાય છે ત્યારે હાથમાં દાંડા જ રાખતા નથી. અસુક  
સાધુ તો દ્વિષે પણ નિદા કરતા આળસુ બની ગયો છે.  
ને પેલા સાધુ તો વિકથા કરવામાંથી નવરા જ પડતા નથી.  
પર્વતીથિએ પણ ઉપવાસ ન કરવો એ શું સાધુધર્મ છે ?

અમુક સાધુ તો સૂત્ર પણ અરાખર વાંચતા નથી. કેરલાડ સ્વાધ્યાય વગર પાતાનો પ્રમાણમાંજ કાલ વ્યતીત કરે છે.” એ રીતે અનગાર સુનિયોના પ્રતિહિવસ અવર્ષિવાદ બોલતાં મુખ્ય શ્રાવકોનાં મન તેણે સાધુ ધર્મથી ભષ્ટ કરી હોથાં.

એ મોહન-સાધુ નિદક્ષ પ્રતિહિવસ સાધુ ધર્મની હીલના કરીને સમય નિર્ગમન કરતાં તેણે મહા પાપકર્મ ઉપાર્જન કર્યું. એ પાપના જોરે તેને આ ભવમાં મુખપાડનો રોગ થયો. એ રોગમાંજ મૃત્યુ પામીને વિદ્યાચળની તળેદીમાં હાથી થયો. લિલાઓએ હાથીને પકડી નગરીમાં વેચ્યો તેને વણીકોએ ખરીદ કર્યો. વણીકમહાજને રાજને અર્પણ કર્યો. આ શૂરવીર હાથી ચુદ્ધમાં ઉપયોગી થશે એમ જાણી રાજાએ એને વૃદ્ધિ પમાડયો. અવાંતરના સ્વભાવથી હાથીના ભવમાં પણ તે ધતિયોનો દ્રેષ્ટિ થયો.

એક હિવસે મનમાં સ્વાધ્યાય કરતા સાધુઓનો શાખા સાંસ્કારિક કોધથી ધમધમતો હાથી આલાન સ્તાંભ તોડી સાધુઓને હણવાને હોડયો પણ માર્ગમાં એક આધમાં પડ્યો. જેથી એનો ઢેઢ ભાગી ગયો. એના કુંભસ્થળમાંથી મોતી કાઢવા માટે રાજપુરુષોએ એનું ભસ્તક ઝાડી નામણું આર્તધ્યાને ત્યાંથી મરણ પામી રત્નપ્રલા નામે પહેલી નરકનો અતિથિ થયો. ત્યાં ખુખ્ય પાપનાં કળ લોગવી ર્યેન પક્ષી થયો. એ ભવમાં ખુખ્ય પાપ કર્મ કરી વાલુકાપ્રલા નામે ત્રીજી નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી નિકળીને સિંહ થયો. એ ભવમાં ખુખ્ય લુચહિસા કરી પંક્પ્રલા નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી નિકળી ધનપુર નગરમાં કામલી વણીકના ઘેર પુત્ર પણ ઉત્પત્ત થયો. તેનું નામ સુમિત્ર.

તે સમયે જીનગ્રિય સાતમા દેવલોકથી આચુક્ષયે તે જ

નગરના વિનયંધર એકીની ગુણવતી સ્ત્રીનો પુત્ર થયો તેનું નામ ગુણવર. ગુણવર પણ અનુકૂળ મનોહર એવા યૌવન વયમાં આવ્યો.

પૂર્વભવના અસ્યાસથી ગુણવરને સુભિત્ર સાથે મૈત્રી થઈ પણ સુભિત્ર ગુણવર સાથે કપદી સ્નેહ વારણ કરવા લાગ્યો. જે કે ગરીબ સુભિત્ર અને તવંગર ગુણવર વચેનો સ્નેહ અસામાન્ય હતો છતાં ગુણવર સુભિત્રને માનની નજરથી જોતો હતો. અન્યથા માતાપિતાના મૃત્યુ પછી દરદી સુભિત્ર હવે તદ્દન કંગાળ અની ગયો હતો. લોકોમાં પણ તે કંગાળપણાથી હંસીપાત્ર થયો.

લોકોમાં હંસીપાત્ર થયેલા સુભિત્રે વન કમાવા માટે પરદેશ જવાનો વિચાર કર્યો. તે માટે સુભિત્રે ગુણવરસાથે પરદેશ સંબંધી વાતચિત કરવા માંડી.

સુભિત્રની વાત સાંખળી એની ઉપર દ્વારા ચિત્તવતો ગુણવર પોતાની સહાયથી સુભિત્ર ધન પેદા કરે તેથી પોતે પણ એની સાથે પરદેશ જવાને તૈયાર થયો. સારા શુહૂતો ગુણવર કરીયાણ્ણાનાં ગાડાં ભરી સુભિત્રની સાથે દેશાવર નિકળ્યો. અનુકૂળ ડોધક અદ્વીમાં આવી સાર્થ ઉતારો કર્યો.

વનની શોભાને જોતા ગુણવર અને સુભિત્ર ફરતા ફરતા એક મોટા પીપળાના વૃક્ષ નીચે આવ્યા, ત્યાં નિરાંતે એસી ઘને જણા વાતો કરવા લાગ્યા. વનની શીતલ પવનની લહરીએથી ગુણવર ત્યાં જરૂરી આડે પડ્યે થયો. ને નિદ્રિત થઈ ગયો. ગુણવરને નિદ્રામાં જાણી સુભિત્રે પોતાનું કૌઠિલ્ય પ્રગાર કર્યું, ત્યાંથી એકહમ નાડો ને સાર્થમાં આવી “નાસો ! નાસો ! ગુણવરને લિલ્દો લઈ ગયા ને. બીજાઓ અહૃતી હુંટવા આવે છે.”

સુમિત્રની વાણી સાંભળી બધા નાસલાગમાં પણ્યા. સુમિત્ર પણ એ સાર્થને સંકેદી લઇને જરૂર ત્યાંથી નાશી ગયો, પછી તો એ કરીયાણુના શક્ત-ગાડાનો માલેક અની સુમિત્ર રાજુ થયો.

ભીજે હિવસ થયો તે હિવસના મધ્યાહ્ન સમયે સુમિત્રના પાપથી પ્રેરાયેલ દાવાનળ પ્રગટ થયો. દાવાનળથી લય પામેલો સાર્થ ખૂમો પાડતો નાશવા લાગ્યો, માલ ભરેલાં ગાડાં દાવાનળથી ફરજ થઈ ગયાં ને ચાકરો પણ નાશી ગયા. સુમિત્ર નરીઓને હાથ હેતો નાડો તે એક શુક્રમાં પેસી ગયો ત્યાં તેને લિલ્ડોએ પદ્ધતો પ્રણ હિવસ રાખીને એને છાડી શુક્રથી તે પોતાને વેર ગયો.

સાયંકણે મૃગયા રમવા નિકળેલો શેખરનામે પદ્ધતી-પતિ ત્યાં આવી ચક્કો. ગુણવરને પોતાના માણસોક્ષરા જગૃત કરી તેની હકીકત જાણી પોતાના સ્થાનકે તેણી લાવી આન, પાનથી તેની આગતા સ્વાગતા કરી.

પોતાના માણસો મોકદી શેખર પદ્ધતીપતિએ ગુણવરના સાર્થની તેમજ તેના મિત્ર સુમિત્રની તપાસ કરાવી પણ તેનો પત્તો લાગ્યો નહીં. ભીજે હિવસે પદ્ધતીપતિએ ગુણવરને સિદ્ધ રસતું તુંબડું આપીને રવાને કર્યો, પોતાના એ માણસો ગુણવરની સાથે તેને યોગ્ય સ્થાનકે પહોંચાવાને મોકદ્યા. ગુણવર પદ્ધતીપતિનો આભાર માનતો તેના સ્નેહ અને સૌજન્યનાં વખાણ કરતો અતુક્તે વીરપુર નગરમાં આવ્યો ત્યાં લુણ્ણ વણીકને વેર સુખપૂર્વક રહેવા લાગ્યો.

૬

## કેશવની કર્મકથા

લુંડે હવાલે લીખ માગી પેટ ભરતો સુભિત્ર રખડતો  
રખડતો એક દિવસે વીરપુર નગરમાં આવ્યો ત્યાં ગુણ-  
ધરનો તેને લેણો થતાં તેને ઓળખી ગયો. પછી તો કપ્ટ  
નાઢને ભજવતો ગુણધરનો છોડા પકડી સુભિત્ર ઝણ કરતો  
યોદ્યો. “હે ભિત્ર! સાર્થનો ડેલાહળ સાંભળી તને  
જગાડ્યા વગર હું સાર્થમાં આવ્યો તો આપણા માલને  
ચોરતા બિદ્ધ લોકોને જોઈ આપણા સુલટો સાથે હું તેમની  
બેઠે ચુદ્ધ કરવા લાગ્યો પણ મને તેઓએ પકડ્યો. આપણા  
માલ અધ્યો ચોરીને તેઓ જતા રહ્યા, ત્યાં પોતાની પદ્ધીમાં  
તેઓની ઉપર થીલ બિદ્ધ લોકો ચઢી આવ્યા. તેમની  
સાથે તેઓ લડ્યા એ સમયનો લાલ લઈ હું મારો લાખ  
અચાવી સુડીએ વાળી લાગ્યો. વનેવન તમને શોધવો  
અનુકૂળ અહીં આવ્યો. તો તમને જોઈ હું ખુશી થયો, હે  
અંધુ! પોતાને ઘેર સુધે રહેતા તમને મેં નાહક કલેશ  
પમાડ્યો.” સુભિત્રનાં વચન સાંભળી તેને ઓળખી ગુણ-  
ધર પોતાને મકાને તેડી લાગ્યો, ખાત, પાનથી તેને  
સંતોષ પમાડી પોતાની વાત પણ તેને કહી સાંભળાવી,  
પેદી સિદ્ધ રસની વાત પણ સરળ સ્વલાપવાળા  
ગુણધરે કહી હીંથી.

સુભિત્રની પ્રેરણાથી એ રસતુંથી વણીકને ત્યાં  
થાપણ સુધી અજે ભિત્ર સકેત કરી ખુખ ધન કમાવા પર-  
દેશ ચાલ્યા. તેઓ તાપ્રલિમ્બી નગરીએ આવ્યા, ત્યાં  
સસુદ્ર કિનારે કટ્ટાહદીપથી વહાણો આવેલાં હતાં, આ  
અજે ભિત્રો તે જોવાને કૌતુકથી ત્યાં આવ્યા. ગુણધરને

ઉત્તમ નર જાણી વહાણુના માલીકે બધો માલ ભતાવી તેની સાથે સોઢા કર્યો. પણ પોતાનો માલ થોડાક સમય સુધી ત્યાં વહાણુમાં રહેવા હેતુ વહાણુના માલેક સાથે શરત કરી, ગુણુધર નગરમાં જવાની તૈયારી કરવા લાગ્યો.

નગરમાં ખખર પૂર્તાં વ્યાપારીઓ સસુદ્ર કિનારે આવી પહોંચ્યા ને માલવાણીની તપાસ કરવા લાગ્યા ત્યારે વહાણુના માલીકે ગુણુધર તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું. “માલવાણી તો આ ગુણવાન-લાભવાન છે.”

વ્યાપારીઓ ગુણુધર સાથે સોઢા કરી માલ પોતા-પોતાને ઘેર લઈ ગયા, તેમને નાણાં પણ ગણી દીધાં. ગુણુધરે એ નાણાં વહાણુના માલેકને આપી દીધાં. એ કષ્ટ વિકષમાં ગુણુધરને કોઈ દિનારનો લાભ થયો.

“સસુદ્ર મારી ઉપર પ્રસન્ન થયો આજે” એમ પોલતા ગુણુધરે એ કોઈ દિનાર સુભિત્રને આપી દીધા, તોપણ લોલી સુભિત્રની છંણા તુસ થઈ નહિ, ન તેણે ચીનકીપ જવાનો વિચાર કર્યો. ગુણુધર પણ તેની સાથે કરીયાણાનાં વહાણ ભરી ચીનકીપ ચાલ્યો.

ગુણુધર ત્યાં પણ પુષ્કળ લાભ પ્રાપ્ત કરી સુભિત્રની સાથે પાછા કર્યો. માર્ગમાં દુષ્ટ સુભિત્રે રાત્રીને સમયે ગુણુધરને સસુદ્રમાં નાખી હેવાનો વિચાર કર્યો. ભધ્યરાત્રીને સમયે ગુપ્તુપ સુભિત્ર ગુણુધર પાસે જવા આવ્યો. પણ અંધારી રાત્રીએ દ્રિગ ભ્રમથી પોતે જ સસુદ્રમાં પડી ગયો.

પ્રાતઃકાળે સુભિત્રને ન જોવાથી ગુણુધર વિલાપ કરવા લાગ્યો. પણ સેવકોએ તેને સમજાવી શાંત કર્યો, અનુઠે તે તાઅલિક્ષી નગરીએ આવ્યો. થોડા દિવસ ત્યાં સુકામ કરી સુભિત્રની શોધ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો. નહિ, પોતાનાં કરીયાણાં વેચી સાર્થની સાથે ગુણુધર વીરપુરે

આવ્યો, ત્યાં જણે શૈઠને ખુખ વન આપી રાણ કર્યો, ત્યાંથી પોતાનું સિદ્ધરસનું તુંઘડં લઈ ધનપુર નગરમાં આવ્યો, માતપિતાના ચરણમાં નમી સ્વજન અને જ્ઞાતિજનને માનવા ચોભય થયો રાજાએ પણ તેનો સલકાર કર્યો.

સુભિત્રને યાદ કરતો ગુણુધર કાલાંતરે પણ સુભિત્રને ભૂલી શક્યો નહિ. ઉધાનમાં રહેલા જ્ઞાની ગુરુ સુધર્મ સુનિને એક હિવસે ગુણુધર વાંદવા ગયો તે સમયે ગુડુએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણી કહું, “હે સૌભ્ય ! મોહથી મૂઢ થયેલાની માર્ક ભિત્રને માટે તું શોક શું કરેવા કરે છે ? ભિત્ર અને શરૂનું સ્વરૂપ તું જાણતો નથી.” એમ કહી જિનપિય અને મોહનનો સંપૂર્ણ લવ તેને કહી સંભળાવ્યો. તે પછી ગુણુધર અને સુભિત્ર સુધીની સર્વ કર્મકથા કહી દીધી. પૂર્વલવના અસ્યાસથી આ લવમાં પણ તારી સાથે તે કષ્ટ મૈત્રીથી રહેતો હતો, તને જગલામાં સુતો મુકી નાશી ગયો ને તારા સાર્થનો માલીક થઈ એઠા તેમજ સમુદ્રમાં તને નાખી દેવા તૈયાર થયેલો તે પાતે જ સમુદ્રમાં પડી ગયો.

નામે સુભિત્ર છતાં કુભિત્ર એવો પાપ બુદ્ધિવાળો તે તને વારંવાર કષ્ટમાં નાખવાના પ્રયત્ન કરતો હતો. છતાં ધર્મના પ્રલાવથી તાર્દ અહિત તે કરી શકતો નહિ. કે ધર્મના પ્રલાવથી અનેક આરૂપો તરી પાર થયો છે તે ધર્મભિત્રને જ તું સાચો ભિત્ર જણું, એની સાથે ભિત્રાઈ કરી તું લવસાગર તરી જ. કે મૂઢ જીવો ગુરુ ઉપર દ્વેષ કરે છે તે જીવો રીખાઈ રીખાઈ અકાળમરણે મરી દુઃખી દુઃખી થિએ સંસારમાં રહવડે છે.

પોતાની આળવિકાના લયથી મોહને સાધુઓની નિંદા કરી અનેક પાપયુક્ત મહાગાદ મિથ્યાત્મ બાંધ્યું,

જેર્થી આ ભવારણ્યમાં તે ઘણો કાળ ભરમણો, હુંખ દારિદ્રય હોર્ઝાંય, રોગ, શોક અને સંતાપથી પરાલબ પામી અનેક હુંખો લોગવણો. જન્મ, જરા અને મરણના અનેક કલેશને સહન કરેશો, પણ તું તો ચારિત્ર અંગીકાર કરી છે ભાગ્યવાન ! ભવસાગર તરી જા.”

સુધર્મ ગુરુની વાણી સાંભળી ગુણુધર સંસારથી ભય પામતો યોદ્યો. “ છે લગવન ! સમુદ્રમાં પડેલા સુભિત્ર હાલ કયાં છે તે કહો.”

“ સમુદ્રના જલમાં તરફડતાં તેને મોદ્ય જલચર જીવોએ ઇડી આધો, ત્યાંથી મુત્ય પામી સાકેતપુર નગરના દરિદ્ર આદ્ધણુની દુર્ગતા નામે સ્ત્રીથી પુત્રપણે ઉત્પત્ત થયો. એક વર્ષ પછી મહાદુંખે એ આદ્ધણુચે પુત્રનો જન્મ આપ્યો. પૂર્વના પાપકર્મથી જન્મ થતાં તે અંધ થયો, તેના માતા પિતાએ કેશવ નામ રાજ્યું. થાસ, કાસ કંડ ચક્ષુ આહિ અનેક રોગથી યુક્ત કેશવ માતા પિતાને પણ ઉદ્દેગ કરનારો થયો. છતાં તે વૃદ્ધિ પામે છે.”

સુભિત્રની ભવ પરંપરાથી ઉદ્દેગ પામેલા ગુણુધરે માતાપિતાની રજા લઈ દીક્ષા અહુણુ કરી. સમગ્ર શાલેના અધિષ્ઠાતા થધને તે અનુકૂમે સૂર્ય પહેના ધારક થયા, એવા તે ગુણુધર મુની ઇડી રીતે ચારિત્રને પાલતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા, તે જ હું. વિહાર કરતો કરતો હાલ તમને પ્રતિષ્ઠાધવાને અહીંયાં આવેલો છું. વીરાંગાડ રાજ ચારિત્રને પ્રલાવે સાતમા સ્વર્ગ ગયેલા ત્યાંથી આવી આ સાકેતપુર નગરમાં તમે પુરુષોત્તમ રાજ થયા છો તો છે રાજન ! તમારે પણ હવે આરાધન કરવું તે જ યોધ્ય છે”



૭

### કનકદ્વારાળની દીક્ષા.

ગુણુધર મુનીએ કેશવની કર્મકથા કહી સંભળાવી, જેથી પુરુષોત્તમ રાજને જતિસ્મરણ જ્ઞાન થવાથી એણે પોતાનો પૂર્વ લખ જોયો. ગુરુના કહેવા પ્રમાણે પોતાનો ભવ જાણી ગુરુને નભી બોલ્યો. “હે લગવન! ભવાંતરની જેમ આ ભવમાં પણ અમને એથી કરવાને આપ પદ્ધાર્યાં એ અમારાં અહોભાગ્ય છે. સંસારથી વિરક્ત થયેલ હું હવે આપની પાસે દીક્ષા અહેણું કરીશા.”

રાજ પુરોહિત કપિંજલ પણ જતિ સ્મરણથી પોતાનો ભવ જાણી ગુરુને નભી બોલ્યો. “લગવન! મેં પણ હનીં-તિનું ઇલ જોયું છે. તો સંસારથી ભય પામેલા મને દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો.”

કપિંજલની વાણિ સાંભળી રાજએ ગુરુને પૂછ્યું, “લગવન! કપિંજલે હુન્યાંથું ઇલ શી રીતે ભોગવ્યું તે કહો.”

“રાજન! કપિંજલનો પૂર્વભવ સાંભળ. વસાંત-પુર નગરમાં તું જ્યારે રાજ હતો ત્યારે શિવદેવ નામે આ શ્રાવક હતો, તે અણુવ્રતને ધારણ કરતારો ને સામાયિક-પૌષ્યમાં પ્રીતિવાળો, અદ્ભુતારી હતો સાધુઓની વૈયાવર્ય કરતારો હોવા છતાં મોહને એની ભતિ કેરવી નાંખી જેથી સમકિતને વમી તે પણ સાધુઓની નિંદા કરવા લાગ્યો. ગુરુને વંદન કરવાનું તેમજ તેમને આહારપાણી આપવાનુંય છોડી દીંદું. વૈયાવર્ય કરવા અથવા દર્શાન કરવા પણ તે ગુરુ પાસે જતો નહિ. બદ્ધે મોહનની જેમ સાધુઓની નિંદા કરતો ને તેમની આજાની વિરાધના

કરતો ભિથ્યાત્મી એવો તે પોતાને શુદ્ધ શ્રાવક માનતો અનુકૂળે કાળકરી કિલિબિંબિક થયો.

હૌરાણ્ય નામ કર્મના ઉદ્દ્યથી ત્યાં પણ સમુદ્ધ દેવતા-ઓએ એને પંક્તિ બહાર કર્યો. તેથી તેણે સમશાનાદિકમાં રહીને પોતાના કાલ નિર્ગમન કર્યો. ત્યાંથી ચંડાલના કુળમાં અવતર્યો. અનેક પાપકર્મ કરી ત્યાંથી ધૂમપ્રભામાં નારકી થયો. એ નારકીની મહાબ્યથા અનુભવી તારે પૂરૈછિત કપિંજલ થયો. ભવાંતરના સંખ્યાથી આજે પણ કપિંજલને કેશવ સાથે પ્રીતિ થઈ. એ કેશવની સંગતથી કુલને ઉચિત કિયાના પણ ત્યાગ કરી કપિંજલ નાસ્તિક થયો. છતાં પણ હજુ ઇજુ પરિણામી હોવાથી શિવદેવના ભવમાં તીવ્ર ભિથ્યાત્મ ન બાંધવાથી અત્યારે એને જતિ-કુમરણ જ્ઞાન થયું છે. એ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવ જાહીને પ્રતિષ્ઠાધ પામ્યો. છે પણ કેશવ તો ગુરુદોહ કરવાથી તીવ્ર અભિનિવેશને ધારણ કરતો વણેં કાળ ભવારણ્યમાં ભાડકશે.

જ્ઞાન, ધ્યાન, તથી અને ઉપધાતની વિવિધી શાસનની ઉન્નતિ કરનારા શુદ્ધ સંખ્યમ ધારી ગુણીજન એવા સાધુઓની કે અદ્ય બુદ્ધિવાળા પુરુષો હીલના કરે છે તે આત્માને વારંવાર નરકાગારમાં પાડે છે. અન્નાચર્યને ધરનારા શુદ્ધ મુનિવરોના અવર્ણવાહને બોલે છે તે ભવાંતરમાં કાણા, અંધા, અહેરા, હુંડા, મુંગા, હુર્લાગી દરિદી અને દુઃખી થયા છતાં સંસારમાં વણેં કાલ ભમે છે. જીને શરના ધર્મને પામીને પણ તે ભવાર્ણવમાં ડણી જય છે. માટે વિવેકી જનોએ તોસાધુ-મુનિરાજની અવશ્ય આરાધના કરવી. કારણ કે આ દુષ્મ કાલમાં તરવાને માટે ગુરુ એ એકજ સાધન વિઘમાન છે. ભગવાનની વાણીને

જણાવનારા પણ એ જ્ઞાની ગુરુન્નો પોતે જ છે. તેમની વિરાધના લેશ પણ ન થઈ શકે.” ગુણધર મુનિન્નો એ પ્રમાણે કહી પોતાની દેશના સમાંત કરી.

તે પછી પુરુષોત્તમ રાજાને પોતાના પુત્ર પુરુષચંદ્ર કુમારને રાજ્યપદે સ્થાપન કરી કપિંજલ વગેરેની સાથે મહામહોત્સવ પૂર્વીક દીક્ષા અહેણું કરી.

હિન્દુયાના કરવા નિકળેલા કનકદંડજ નરપતિ પોતાના બંધુ જ્યસુંદર વગેરે પરિવાર સાથે ગુણધર સુરીથરની દેશના સાંલળી વૈરાગ્ય પામ્યા ને જ્યસુંદરને રાજ્યપદે સ્થાપન કરી દીક્ષા લેવાનો તેમનો મનોરથ થયો, જેથી તેમણે ગુરુને વિનંતિ કરી. “ભગવન्! હું પણ મારા લધુ બાંધવ જ્યસુંદરને રાજ્ય આપી આપની પાસે દીક્ષા અહેણું કરીશા.”

“આપણે રચેલા ધુલીઅહેને થાડીવાર રમીને પછી તે તેનો ત્યાગ કરી હે છે તેમ તમારા ક્રેવા ઉત્તમ નરને મુક્તિની વરમાળ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. માટે તમારે હું ક્ષણુભર પણ પતિષ્ઠંધ ન કરવો. ગુરુનું વચન સાંલળી રાજાને પોતાના લધુ બાંધવ જ્યસુંદરને રાજ્ય અહેણું કરવા કહ્યું “હું વત્તસ! તું રાજ્ય અહેણું કર, જેથી હું સંયમને આદરૂં.”

રાજાની વાણી સાંલળી ગદ્યગદિત સ્વરે જ્યસુંદર એદ્યો. “હે નરેથર! પોતાના પ્રિય જનને કેદખાનામાં જીકી પલાયન કરી જવું એ ઉત્તમ નરની રીતિ ન કહેવાય. ગુરુની વાણીથી વૈરાગ્યવંત હું પણ આપની સાથે દીક્ષા અહેણું કરીશા.” જ્યસુંદરનો દીક્ષાનો નિશ્ચય જાણી કનકદંડજ રાજાને પોતાની છાવણીમાં સામંત, મંત્રી, સેનાપતિ આહિ સર્વાની સમક્ષા કુમાર કનકકેતુનો રાજ્યાલિષેક કરી દીધો.

મંત્રી, સામંત, સેનાપતિ, મંદ્લેશાહિ સાથે કનકદવજ રાજ અને જયસુંદર યુવરાજે ગુણુધર ગુરુની પાસે મહો-ત્સવપૂર્વક દીક્ષા અહુણ કરી. નવોરાજ કનકકેઠ પણ પૂજય એવા પોતાના વડીલોને વાંદી શોકઅસ્ત થયો છતાં પોતાના પરિવાર સાથે પોતાને નગરે ગયો. કનકદવજ અને જય-સુંદર નિર્મળ ચારિત્રને પાળતા, સમિતિ અને શુભ્રિને ધારણ કરતા ઝડી રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના કરેવા લાગ્યા.

દીર્ઘકાલપર્યંત ચારિત્રને પાળી પ્રાણુંતે અણુશણુ-પૂર્વક સમાધિમરણવડે વિજય નામના અનુત્તર વિમાનમાં બને બાંધવો બત્તીશ સાગરોપમના આણુવાળા ઉત્તમ હેવ થયા. એક હાથના શરીરવાળા તે ઉત્પાદ શય્યામાં સુતાં સુતાં પોતાનો સર્વ સમય સુખમાં નિર્ગમન કરે છે. ને ચંદ્રવાના મોતીના ઊમખામાં થતા નાયારંગને જોતા જતા કાલને પણ જણતા નથી.

પરિચ્છેદ ૧૦ મો

કુસુમાચુદ્ધ અને કુસુમકેતુ

૧

અંગાધિપતિ શ્રીજયરાજ

જીયાતું સંખેશ્વરઃ પાર્શ્વ-નાથો વિશ્વોપકારકઃ ।

ભૂત-ભાવી-મવદ્ભાવ-વિભાસનૈકભાસ્વરઃ ॥૧॥

ભાવાર્થ—અધ્યા જગત ઉપર ઉપકાર કરનારા, તેમજ ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભાવને જણાવવામાં અદ્વિતીય સૂર્ય સમાન શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ જગતમાં જયવંતા વર્તો, જય પાંચો.

આ ભરતાર્થમાં અંગદેશની રાજ્યવાની ચંપાનગરી સ્વર્ગપુરી સમાન રમણીય અને મનોહર હતી, નગરીના રાજ શ્રીજયે શત્રુઓના સમુહને જીતી પોતાનું શ્રીજય નામ સાર્થક કર્યું હતું. એના અંતઃપુરની અનેક રાણી-ઘોટામાં પ્રિયમતીનામે પદ્મરાણી હતી. અંગદેશની લક્ષ્મી રેમા અને રામાને પ્રાત કરી નરપતિ શ્રીજય સર્વ રીતે સુખી હતો.

કનકદવજ રાજનો જીવ વિજય વિભાનમાંથી પોતાનું આચુ પૂર્ણ કરી પ્રિયમતીના ઉદ્દેશમાં ઉમ્મેજ થયો. તે સમયે પદ્મરાણીએ મનોહર સ્વમ જોયું. જાણે કે “સિંહાસન પર એઠેલી પદ્મહેવીના ભસ્તક ઉપર રાજએ પોતાનો મુશુટ આરોપણ કર્યો.”

સ્વમાવસ્થામાંથી જગૃત થયેદી રાણીએ રાજ આગળ પ્રાતઃકાળે સ્વમ નિવેદન કર્યું, તે સાંભળી રાજએ કહ્યું.

“તમારે મનોહર અને રાજ્યભારે ઉપાડવાને સમર્થ  
પુત્ર થશે.”

રાજના શાખા સાંભળી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું  
સારી રીતે પોષણ કરવા લાગી. પણેવીને જે જે હોહં  
થયા તે રાજએ પૂર્ણ કર્યા.

અન્યથા શ્રીષ્મ ઋતુના કલેશકારી દિવસો આવી  
પહેંચ્યા. એ શ્રીષ્મ રતુના એક દિવસે આત્માને શાંતિ  
આપવા રાજ પણરાણી સાથે સર્વ ઇંદ્રિયી ઉધાનમાં  
ગયો. કર્પૂર અગર, કસુરી મિશ્રિત શીતલ વાવનાજળમાં  
કીડા કરી દ્રાક્ષના મંડવામાં પરિશ્રમ ઉતારતો એડો. તે  
પછી હૃથમાં વીણાને વગાડતો કિન્ફરોના મનને મોહ પમાડ  
તેવાં એક પછી એક મનોહર ગીત શરૂ કર્યાં. પણેવીના  
આનંદને માટે રાજ શું શું કરતો નહિ?

સ્વરૂપવાન, ગુણવાન અને શુરવીર રાજ શ્રીજ્યના  
ગુણોથી પ્રસન્ન થયેલી વનહેવી એની સાથે રમવા મનો-  
હર રમણીનું સ્વરૂપ કરી રાજ આગળ પ્રગટ થઈ. હાલ,  
ભાવ અને ચાડ વચનવડે રાજની પ્રાર્થના કરી. પરસ્કીના  
નિયમવાળા રાજએ એનો તિરસ્કાર કરી એની નિર્ભ-  
ત્સના કરી. રાજને સમજાવતાં તે સ્ત્રી બોલી. “હે સ્વા-  
મિન! હું પરસ્કી નહિ પણ તમારા ગુણોથી અતુરકા થયેલી  
વનહેવી છું, તો મારી ઉપર પ્રસન્ન થઈ મને અંગીકાર  
કરો. પણરાણી પ્રિયમતીને સમજાવી મેં નગરમાં મોકલી  
દીધી છે. રાજન! કેવી રૂપાળી એકાંત શાંતિ છે?”

હે દુષ્ટ! નિર્ભન્જે! પાપિનિ! હું સુરજાતિને પણ  
લજજવનારી છે. ધિગું છે તારી જતને! દૂર થાય છે કે નહિ  
મારી નજર આગળથી? રાજનો રોષ જણી હેવી અત્યારે  
તો અદરય થઈ ગઈ.

કોપાયમાન થયેલી હેવી ખળવાન અને પુણ્યવાન રાજનું બીજુ તે શું અપ્રિય કરી શકે? પણ વનહેવીએ મધ્યરાત્રિને સમયે પદ્ધતેવીનું નિદ્રાવસ્થામાં હરણ કરી તેને ઘાર અરજ્યમાં છાડી દીધી.

પ્રાતઃકાળે રાજ નગરમાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરી રાજ પદ્ધતેવીના વાસભુવનમાં આવ્યો. તો પદ્ધતેવી હાવ સાવ કરતી રાજની પાસે આવી કામ વિકારમય ચેષ્ટા કરવા લાગી. એની આ ચેષ્ટા જોઈ રાજ તાજુખ થઈ ગયો. “આ પદ્ધતેવી ન હોય, નક્કી પેલી વ્યતારીની આ માયા છે હજુ પણ તે મારો પીછા છાડતી નથી.”

કોધાયમાન રાજએ સુષ્ઠિનો પ્રહાર કરી તેના કેશ એંચીને વાસભુવનમાંથી બહાર એંચી કાઢી, ક્રાળથી ભષ્ટ થયેલી મૃગદીની માઝે હેવી-પદ્ધતેવી થયેલી તેણી અદરય થઈ ગઈ.

રાજએ પદ્ધતેવીની શોખાશોખ કરી પણ ક્યાંય પતો લાગ્યો નહીં, જગલમાં, વનમાં, ઉપવનમાં બોડેશ્વરો તીરની માર્કન વધુટચા. ચારેકોર શોખખોળ થઈ પણ ક્યાંય પદ્ધતેવીનો પતો લાગ્યો નહીં. નિરાશ થયેલો રાજ હેવીનું એ કૃત્ય જાણી ધીરજ વારણ કરી રહ્યો.

સંસારનું સ્વરૂપ ચિંતવતો રાજ સાવધાનપણે અદ્યાય્યને પાળતો મનમાં વિચાર કરવા લાગ્યો. “અરે, પુત્ર સહિત કુશળક્ષેત્રે હું હેવીને જોઈશ કે તુરતજ હું તે પછી આ અસાર સંસારનો ત્યાગ કરી સંયમ આદરીશ. એ હૃદ્દા વનહેવીએ હરણ કરી મારી પ્રિયાને એણે ગમે ત્યાં મુકી હોય ત્યાં એ ધર્મપ્રસાદે ગર્ભસહિત કુશલ રહો.”

શોકથી આકુળ વ્યાકુળ રાજ બોજનનો પણ ત્યાગ કરીને રાજકાર્યથી પરાજમુખ થઈ ગયો. ત્યારે મંત્રીઓએ

રાજાને ખુખ સમજાવ્યો. મંત્રીએઓએ નિમિત જાણનારેને રાજ સમક્ષ હાજર કરી પછેવેનો વૃત્તાંત પૂછ્યો. પ્રશ્ન લગ્ન અને નિમિત જોઈ નિમિતજ્ઞ પણ બોલ્યો. “હેલ ! આપનાં પછેવી પુત્ર સહિત આપને કાલાંતરે મલશે. મારે આપ ચિંતા કર્યોના નહિ.”

નિમિતકના વચનથી શાંત થયેલો રાજ ભોજન કરી હેજેને ટકાવતો સમય નિર્ગમન કરવા લાગ્યો.

## ૨

## કુસુમાયુધ

ભયંકર અઠવીમાં સાવધ થયેલી પછેવી પ્રિયમતી-એ શું જોયુ ? ચારેકાર ઘોર જંગલ જોઈ એના હૈયામાં બ્રાસ્કો પડ્યો. “અરે ! આ શું ! આ તે ઈંડનળ છે કે અમણું ! મારું વાસલુંવન કયાં ને આ ઘોર જંગલ કયાં !” રાણી વિલાપ કરવા લાગી. “અરે ! શું વિના અપરાધે રાજએ મારો ત્યાગ કર્યો ! આ ઘોર જંગલમાં મારું શું થશો ! નક્કી પરલવનાં મારાં પાપ ઉદ્ય આવ્યાં, કે આ દાર્ઢણ દુઃખ મને પ્રાપ્ત થયું.”

પછેવી વિલાપ કરતી ને શાપદાદિથી ભય પામેલી મનમાં ‘નમો અરિહંતાણ’ નો જપ જપતી મહાકષે ઉલ્લિ થઈ ચારે તરફ અરણ્યની ભયંકરતા જોતી “હું કયાં જઉ !” વિચાર કરતી પછેવી દક્ષિણ દિશામાં ચાલી, સિંહ, બ્યાત્ર અને શિયાળવાના શબ્દથી ભયલીત થયેલી રાણીના ચરણ ઉન્માર્ગ ગમન કરવાથી કંદા કંદા વગેરેથી વીધાવા લાગ્યા. કષ્ટના આવેશથી મૂર્ચિંચિત થધ જતી પછેવી વનના શીતલ વાયુથી સાવધ થઈ, વળી દુઃખેદુઃખે માર્ગ કાપતી આગળ ચાલી.

ભૂખ અને તૃપ્તાની વેહનાથી એ કારમો દિવસ પસાર થયો, એ પછેદેવીના કષ્ટથી દુઃખિત સૂર્ય પણ અસ્ત થવાની તૈયારી કરતો હતો તે સમયે તેણુંને ભાગ્યયોગે ડોધક તાપસીના લેટો થયો, ભયંકર અરણ્યમાં મનોહર અંગવાળી ખીને જોઈ તાપસી તેણુંને આધ્યાત્માસન આપી પોતાના આશ્રમમાં લઈ ગઈ, આશ્રમની વૃદ્ધ ગુરુણીએ રાણુંને આધ્યાત્માસન આપી એના દુઃખનું કારણું પૂછ્યું, પછ્ચરાણીએ પોતાની સર્વ કથા કહી સંભળાવી.

વૃદ્ધ તાપસીએ આધ્યાત્માસન આપેદી પછેદેવી ભગવાનનું સમરણ કરતી ત્યાં આશ્રમમાં પોતાનો સમય વ્યતિત કરવા લાગી. એ વૃદ્ધ તાપસીએ આશ્રમના કુળઘરુંને વાત કરી પ્રિયમતીને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવા જણાવ્યું.

કુલપતિએ ડેલાક વૃદ્ધ તાપસોની સાથે એક દિવસે પ્રિયમતીને રવાને કરી, ગર્ભના ભારથી ધીરે ધીરે ચાલતી પ્રિયમતી શ્રીપુર નગરમાં આવી, નગરના ઉદ્યાનમાં આરામ લેવા તે સહકારના વૃક્ષ નીચે બેઠી, સમીયે રહેલા જુનમાંહિરમાં પૂજા સ્તવના જાણી રાણી જુન જુવનમાં આવી જુનેથરને નમી, ભગવાનની સ્તવના કરવા લાગી.

તે સમયે જુનસુંદરી નામે શાવિકા આ વિદેશી સાધર્મિકાને જાણી જુનપ્રાસાદથી ઘણાર નિકળ્યા પછી પૂછ્યું, “હે બહેન ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ?”

પ્રિયમતી એને જોઈ રૂફન કરવા લાગી “બહેન ! મારા દુઃખની શી વાત કરું ?” ડસકાં ભરતી ગણગદિત પદ્દેવી કંઠ દંધવાથી કંઠ બોલી શકી નહિ, તેણુંને ધીરજ આપતાં જુનસુંદરી બોલી. “હે ભાગ્યવતી ! આ સંસારનું સ્વરૂપ જ એવું છે જગતમાં નિરંતર કોણ સુખી છે ?

હે સુભુ ! રડીશ નહિ. આ હુંખ પૂર્ણ સંસારમાં ડગલે ને પગલે મતુજ્યને હુંખ જ પ્રાપ્ત થાય છે. માટે એમાંથી કુટવા તું એક ધર્મનું જ આરાધન કર. ધર્મ કરવાથી હુંખમાં પણ પ્રાણીને શાંતિ વળે છ-હુંખનેા નાશ થાય છે. રોગીને ઔષધની માડક હુંખીને ધર્મ એ પરમ ઔષધિપ છે”.

અનસુંદરી આચ્યાસન આપી રાણીને પોતાને ઘેર તેડી લાવી. તેના માતાપિતાને આ હુંખી સ્થીએ બધી વાત કહી સંભળાવવાથી અનસુંદરીના માતા પિતાએ તેણીને પોતાની પુત્રીની માડક રાખી.

અતુક્કે શુભ હિને રાણીને પુત્રનો પ્રસવ થયો. એ રાજ્યપુત્રને નિરખી પ્રસન્ન થયેલા ધનંજ્ય શ્રેષ્ઠીએ રાજને પ્રસન્ન કરી કેદીએને છોડાવ્યા તેમજ મોટો જન્મમહોન્સ કર્યો. પુત્રનું નામ કુસુમાયુધ રાખ્યું. બાદકુસુમાયુધ એ ધનંજ્ય શ્રેષ્ઠીના ઘેર વૃક્ષ પામતો અતુક્કે એ વર્ષનો થયો.

તે સમયે એ શ્રીપુરનગરનો વાસવહ્તા નામે સાર્થવાહુ ચંપાનગરી તરફ જવાને તૈયાર થયો. એ વાત જાણીને ધનંજ્ય શ્રેષ્ઠીએ સાર્થવાહુને પોતાની પાસે બોલાવી સર્વે હકીકિત સમજાવી, પ્રિયમતીને પુત્ર સહિત વસ્ત્રાભરણથી સત્કાર કરી વાહુન તથા માણુસનો બંદોઅસ્ત કરી તેના સાથે ચંપા તરફ રવાને કરી.

વાસવહ્તા સાર્થવાહુ શ્રીપુરથી પ્રયાણ કરતો અતુક્કે શિવવર્ધનપુર નગરમાં આવ્યો અને નગરના ઉધાનમાં પડાવ નાખ્યો, સાર્થવાહુની સાથે આવેદી પ્રિયમતીએ પણ ત્યાં જ આગ્ર વૃક્ષની નીચે મુકામ કર્યો.

એ સમયે શિવવર્ધનનગરનો શ્રી સુંદર રાજ ગુડુ

પાસે ધર્મ સાંસણી દીક્ષા લેવાને તૈયારી કરી રહ્યો હતો. રાજનો લધુ બાંધવ ચુવરાજ પુરંદર પણ રાજ્યને નહિ ધર્છતો વડીલખંધુ સાથે દીક્ષા લેવા તૈયાર થયો હોવાથી રાજ્ય કોને અર્પણ કરવું તે માટે બધા રાજપુરુષો વિચારમાં પડી ગયા હતા.

રાજએ કંઈક નિશ્ચય કરી પંચહિવ્ય કર્યાં. મંત્રી આહિ પરિવાર સહિત રાજ પંચહિવ્યની પાછળ ચાલ્યા. એ પંચહિવ્ય નગરીમાં લમીને ઉધાનમાં જ્યાં સાર્થવાહનો પડાવ હતો ત્યાં આવ્યાં, બાળક કુસુમાચુંઘ જ્યાં રમત કરી રહ્યો હતો ત્યાં આવી સ્થિર થછ ગયાં, ગજરાજે કલશનું જળ એ બાળકુમાર ઉપર નામી કુમારને પોતાની સૂંધ વડે ઉચ્ચકી સ્કંધ ઉપર સુકી દીધ્યો. પછીતો રાજ અને ચુવરાજ એની માતા સહિત બાળકુમારને મહોત્સવપૂર્વક નગરમાં લાવ્યા.

રાજમંહિરમાં કુમારને ઉચ્ચ પડે સ્થાપન કરી એ અને બાંધવો પ્રિયમતીને કહેવા લાગ્યા. “હે માતા ! તમે આ રાજ્યને અહણ કરો. કે તમારી સહાયથી અમે દીક્ષા અહણ કરીએ”.

એ અવસરે સાર્થવાહે આવી રાજને અરજ કરો “હે મહારાજ ! અંગદેશના અધિપતિ શ્રી જ્ય રાજનાં આ પદ્ધતી, મારે ચંપામાં જધને મહારાજને સોંપવાં એવી મને લલામણ છે તો આપ એમને સુક્ત કરો. હે રાજન ! કલિંગાધિપતિની રાજકુમારી પ્રિયપતીને પણ શું આપ જાણતા નથી ?”

સાર્થવાહની વાણી સાંસણી અને રાજપુરુષો-બાંધવો પ્રિયમતીના ચરણમાં પડી ઓલ્યા. “ત્યારે તમે તો અમારાં મારી થાએઓ”.

રાજએ સાર્થવાહને સર્વે હકીકત સમજાતી શ્રી જય-  
રાજને જણાવવાનું કહુને માન સન્માન સહિત ચંપાનગરી  
તરફ રવાને કર્યો.

મંત્રી, સામંત, સેનાપતિ આહિ રાજપુરષો અને  
પ્રજા સમક્ષ કુસુમાયુધનો રાજ્યાલિષેક કરી અન્તે આંધ્રવોએ  
દીક્ષા અહેણું કરી.

## ૩

### શિવવર્ધનપુરમાં

રાજ કુસુમાયુધ પૂર્વભવના પુષ્યોદયથી મંત્રી, સામંત  
અને સેનાપતિના પ્રતાપે અખંડિત શાસનવાળો થયો.  
એકદા બાળરાજ કુસુમાયુધ રાજસભામાં ઘેઠલો હતો,  
મંત્રીએ આહિ રાજપુરષો રાજસભામાં ઘેઠાયેઠા જુદ્ધ  
પ્રતાપથી રાજ્યશાસન સ્થિર કરી રહ્યા હતા, તે સમયે  
અવતિ દેશના રાજ રાજશોભરનો હૃત રાજસભામાં હાજર  
થઈ કુસુમાયુધને કહેવા લાગ્યો.

“હું રાજન ! મારા સ્વામી અવંતીરાજ રાજશોભર  
તેમણે મને શ્રીમુખે તમને કહાયું છે કે હાથી, ઘાડા રથા-  
દિક સમુદ્ધિ મને સમર્પણ કરી તમે મારી તરફ અક્ષિ-  
લાવ બતાવો, કારણ કે મારો આશ્રય કરવાથી અન્ય કોઈ  
રાજએ તમને હેરાન કરેશો નહિ ને સુઝેથી તમે રાજ્ય  
કરશો.”

હૃતનાં વચન સાંભળી મુખ્ય મહોમંત્રી શાલ બોલ્યો  
“અરે વાચાળ ! તું જેમ તેમ શું બકી રહ્યો છે ? પણ  
બાલ સ્વભાવી કુસુમાયુધ સેવા કરવાનું જ જાણતો નથી.  
હુય, ગજ, રથાદિક સાથે કીડા કરવાની ઈચ્છાવાળો આ  
રાજ તને ગજાદિક શી રીતે મોકલી શકે ? છતાં તમારે

હૃયાહિકની જરૂર હોય તો તમારો ધનલંડાર મોકલો એથે ખરીદ કરી મોકલીયે.”

શાલમંત્રીની વાણી સાંલળી જણે આ રાજ્ય સત્ત્વ વગરનું હોય તેમ સામાન્ય મનુષ્યના જેમ કોપને ધારણું કરી હૃત બોલ્યો. “આવા મંત્રીએથી જ કુસુમાયુધ ચિર-કાલ પર્યાત રાજ્ય કરશે શું? દીર્ઘદશી મંત્રીએથી રાજ પોતાનું સાઓન્ય ચલાવે છે, તમારા જેવાથી નહિ.

હે મંત્રી! પોતાનાથી બલવાનને કંઈક ઉપહાર આપી અથવા તો નમસ્કાર કરી પ્રસંગ કરવો, પણ અભિ-માની વચ્ચેનો બોલ્યા કોથાયમાન કરવાથી શું ક્ષાયહો? જે પ્રણામથી વશ થાય તેને કોપાવવામાં ખરાણી જ થાય, કારણુંકે નખછિદ કાર્યને પરશુર્થી છેદવાનો આરંસ ન કરવો, આ રાજ્યશેખર રાજ નમસ્કાર કરનારને કદ્યપ્રવૃક્ષ સમાન છે. ત્યારે અભિમાનીએને તો થમના જેવો લય-કર છે માટે એની સેવાનો સ્વીકાર કરી તમે વૃદ્ધિ પાડો.”

“એહુ ટોઠ ડાઢો છે કંઈક, નક્કયાધની તે કંઈ હુક છે જેવો એનો સ્વામી તેવો સેવક, જણેકે એ રાજની મહેર-ભાનીથી જ કુસુમાયુધ રાજ્ય કરતો હોય ને શું પણ રે ઝૂઠ! બાળ એવા આ કુસુમાયુધને વશ કરવા જતાં તારો સ્વામી ક્યાંય એનું રાજ્ય ના ગુમાવે. કારણુંકે બાલક એવો પણ સિંહનો શિશુ કંઈ મેંદાંના ટોળાથી પરાલવ પામતો નથી.” શાલ મંત્રીએ કોથથી ધુંવાણુંવા થધ હૃતને રાજસલામાંથી કાઢી મુકાવ્યો.

અપભાનની આગથી જલતા હૃતે અવંતીમાં આવી પોતાના સ્વામીની આગળ સર્વ હકીકત વિસ્તારથી કહી સંભળાવી બળતામાં ધી હોમણું. રાજ્યશેખર રાજના શાંત ઝૂફ્યને ખુખ તોળી-વલોાવી નામણું.

“આહ ! એક નાના બાળકનો આ ભિજજ ! નક્કી થા મરવાની થાય ત્યારેજ વાઘરીવાડે જાય છે. વિનાશકાળ આસે આવે છે ત્યારેજ ખુદ્ધિમાં વિકાર-કારફેર થાય છે. રાજ તો નવો ને બાલક છે પણ એના મંત્રીઓ પણ શું કુપરના બ્લથી અજ્ઞાત છે કે ઉદ્ધતાઈ કરી રહ્યા છે-નાહું પોતાનો ક્ષય કરાવી રહ્યા છે.” એમ બોલતો રાજ રાજ-શૈખર ચતુરંગી સેનાથી પરવરેલો, કોથથી અધરને ઉસેટો, અહીમંડલને મુજલવાટો કુસુમાખું ઉપર ચડી આવ્યો.

શિવવર્ધનપુરમાંથી નિકળેલો સાર્થવાહ વાસવહાસ શીક્ષણતિયે ચંપામાં આવી ચંપાપતિને નમ્યો. “દેવ ! દેવી, રાજકુમાર અને નવીન રાજ્યના આવાગમનવડે આપ વૃદ્ધિ પામો !” ચંપાનરેશ આગળ લેટ ખરી સાર્થ-વાહ બોલ્યો.

સાર્થવાહના વચનથી વિસ્મય પામેલો રાજ બોલ્યો. “શ્રી ! જરા સ્પષ્ટતાથી કહો. તમારા કથનનો લાવાર્થ શું છે ?” સાર્થવાહે દેવીની પુત્રની અને રાજ્ય પ્રાપ્તિની વાત નરપતિને કહી સંલગ્નાવી.

પોતાના ઝડંખની કુશળતાની વધામણિથી પ્રસન્ન થયેલા રાજએ સાર્થવાહને ખુણ ધન આપી રાજ કર્યો અને સાર્થવાહનો કર માર્દ કર્યો.

સાર્થવાહને રાજ કરી ચંપાપતિ તરતજ મંત્રી સામંત સેનાપતિ આદિ પરિવાર સાથે શિવવર્ધનપુરમાં આવી પ્રિયા અને પુત્રને મળ્યો. પ્રિયમતીએ પોતાના પિતાને પણ સમાચાર મેડલવાથી માનતુંગ રાજ પણ પોતાના પરિવાર સાથે પુત્રને મળવા આવી પહોંચ્યો.

ચરમારક્ષતે અવંતીપતિને માર્ગમાં આ સમાચાર મળતાં એના હૈયામાં મૌણા ધ્રાસકો પણો. “અરરર ! આ

શું થઈ ગયું ! શ્રીજયરાજ તો મારે મિત્ર ! એના જ ભાગ પુત્ર સામે લડાઈ ! અંગ અને કલિગના એ ખેત્રે રાજી ઓને હવે હું શું સુખ બતાવું ?” પોતાના અવિચારી કાર્યથી અવંતીપતિને બહુ પદ્ધતાપ થયો, “અરે ! મારે શી ન્યુનતા હતી ! અવંતીદેશનું વિશાળ સાઓન્ય છતાં મેં લોલથી થીજાનું રાજ્ય પડાવી લેવાની છંણ કરી. મારી એ લોલ વૃત્તિને વિકાર હો ! પૂર્વના પુષ્યથી રાજ્ય પ્રાપ્ત કરેનારને ગમે તેવો કોઢી ને બ્યાળવાન પણ શું કરી શકે ? દેવ તુષ્ટમાન થાય તોય નિભાગીને તે શું આપી શકે તેમ છે ! મારે હવે તો એ ખેત્રે રાજીઓને અમારું, કારણું ખાળ બગડી ગઈ હોય તો પણ અધ્યન્યથી પણ ડાઢા માણસો સુધારી લે છે.” વિચાર કરી અવંતીરાજ પોતાના સુંદર નામે મંત્રીને સમજાવી એ રાજીઓની પાસે મોકદ્યો.

સુંદરમંત્રી શિવવર્ધનપુરમાં આવી શ્રીજય અને આનતુંગ નરપતિને નમ્યો અને પોતાના સ્વામી વત્તી ઘોલ્યો. “મહારાજ ! અમારા સ્વામીએ આપના પુત્ર ઉપર જે કટક આરંભ્યું છે તે અપરાધને આપ અમો !

જયભૂપતિએ સુંદર મંત્રીનું સ્વાગત કરી વસ્ત્રાલંકારથી એનું સન્માન વધાર્યે, “તમારા સરખા સજજનને તે ચોણ્ય છે કારણું સજજન પુરુષો અવિચારી કાંઈપણ કરતા નથી. લુલેચુકે જે કદાચ અફુત્ય થઈ જાય તો સત્ય સ્થિતિ સમજતાં તરતજ અફુત્ય થઈ જાય તે ને તેમને કરેલા અકાર્યનો પરસ્તાવો થાય છે. અમને એ રાજ સાથે મહ્યાને શરૂએ સમય થયો છે તો અવંતીપતિ ભલેને અહીં આવે ને અમારા મહેમાન થઈ જાય.” એમ કહી જયભૂપતિએ પોતાના મંત્રી આપદિ પરિવારને સુંદર મંત્રી સાથે મોકદી

રાજશોભર રાજને પણ તેડાવ્યા. રાજને ખુલ માન આપ્યું. ત્રણે રાજઘોના મેલાપથી એ નગરનું નામ ત્યારથી રાજ-પુર-રાજનગર થયું.

રાજ રાજશોભરે કુસુમાયુધને જોઈ પ્રસંગ થઈ તેના મુષ્યથી આકર્ષણીય રૂપવાન એવી પોતાની બતીશ કન્યાએ પરણાવી.

યાર પછીના એક દિવસે શિવવર્ધનપુરના ઉધાનમાં શ્રીગુણુસાગર કેવલી ભગવાન સમવસર્યા. વનપાલકે નગરમાં આવી જ્યલ્લુપતિને વધામણિ આપી. “હે નરરાજ ! સહસ્રાં વનને વિષે સુરાસુર અને મતુષ્યાથી પૂજાતા શ્રીકેવલી ભગવાન પવાર્યા છે—સમવસર્યા છે.”

વનપાલકની વધામણિથી રાજને તુષ્ટમાન થઈ વનપાલકને ખુલ દાન આપી રાણ કર્યો, પ્રલુ ઉપર અક્રિયાના ત્રણે નરપતિએ પોતપોતાના પરિવાર સાથે ગુરુને વાંદવા ઉધાનમાં આવ્યા. ભગવાનને નમી વાંદી દેશના સાંભળના હાથ જોઈ તેમની સન્મુખ એઠા, કારણું ઉપદેશ આપનારા ગુરુ પણ જ્ઞાની હતા, જ્ઞાનથી આ ત્રણે નરપતિએને ધર્મને ચોગ્ય જાણી ગુરુમહારાજે પણ દેશના શરૂ કરી.

## ૪

## માહરાજનું સાગ્રાજય.

હે ભાવ્યો ! આ મતુષ્ય ભવના જલના પરપોદાની માફક ચ્યપળ લુચિતદ્યમાં આત્મહિત કરી લેણું એજ સાર છે. કામહેવની પીડાથી સુક્ત રહી કોધાદિકનો ત્યાગ કરવો અને ધર્મને વિષે પ્રાતિ કરેવી.”

“ભગવાનની વાણી ગંલીર હોવાથી મૂઢ એવા

અમે એના પરમાર્થને સમજુ શકતા નથી.” માનતુંગ  
નરપતિએ વચ્ચમાં કહ્યું.

“મોહરાજએ આજ્ઞાનર્પી મહિરાપાત તમને કરાવેલું  
હોવાથી શાસ્ત્ર વચ્ચનો પરમાર્થ તમારાથી સમજાતો  
નથી.” કેવળી ભગવાનનાં વચ્ચ સાંભળી કંઈક હસીને  
રાજશોભર રાજ ઓદ્યો.

“ભગવન! આપે મોહરાજ કહ્યો તો હવે આપ  
સ્પષ્ટતાથી કહો કે એ મોહરાજ કોણ છે? એનો રાજ્યાદિક  
પરિવાર પણ અમને સમજવો.”

અવંતીરાજનાં વચ્ચ સાંભળી મોહનપત્ની બ્યાળ્યા  
કરતા કેવળી ભગવાન ઓદ્યો. “પરમાર્થિત ધર્મર્પી  
નરપતિનો સુષ્પોધ નામે હૃત સુદર્શન નામે ચુણું તમને  
આપશે ત્યારે શાસ્ત્રની વાતનો સત્ય પરમાર્થ તમારાથી  
સમજશે. એ સુષ્પોધ નામે હૃત હવે શીધતાથી તમારી  
પાસે આવશે. પણ તે પહેલાં પ્રથમ તમે મોહરાજનું  
સ્વરૂપ જરા સાંભળો.

“અનેક પ્રકારના આશ્ર્યથી ભરેલા આ સંસાર  
ઝ્ય નગરમાં સુર, અસુર અને નરનાથ પર અખાહિત  
આજા પ્રવર્તાવનાર કર્મપરિણામ નામે રાજ મોદા વિસ્તા-  
રવાળા રાજ્યનો : માલિક હતો, તેને કાલપરિણુતિ નામે  
રાણી સ્વામીના સિદ્ધાંતને અનુસરનારી હતી. અનાદિ  
કાળથી સુખ લોગવતાં તેમને મોહ નામે કુમાર થયો.  
ત્રણ જગતપર મોદો પ્રભાવ પાડનારો તે સારી આલમ  
પર થાતાના પરાકમથી રાજ્ય કરતો હતો. રાગદ્વેપાદિક  
તેના સુસટો હતા.

મોહ સિવાય ભીજાપણું સાત બ્યસન ઝ્ય સાત કુમાર  
હતા. પિતા ઉપર ભક્તિવાળા એ પુત્રો નિરંતર ભવ્ય

પ્રાણીઓને પોતપોતાના પંજામાં જકડીને સંસારમાં સ્થિર કરતા હતા. પુત્રોના પરાક્રમથી પ્રસન્ન થયેલો રાજ કર્મ પરિણામ એક દિવસે પોતાની પ્રિયા કાલપરિણિતિને કહેવા લાગ્યો.

“મોહદુમારને રાજ્ય પર સ્થાપન કરી આપણે હવે સુખે સુખે કાળ નિર્ગમન કરીયે.” કાલપરિણિતિએ પણ તે વાત અંગીકાર કરવાથી મોહદુમારને રાજ્યપર સ્થાપન કરી બાકીના કુમારોને તેમની શક્તિ ચોગ્ય અવિકારપદે સ્થાપન કરી કર્મપરિણામ રાજ રાજ્ય ભારથી નિવૃત્ત થઈ નવારાજ મોહદુપને શિખામણ આપવા લાગ્યો “હું વત્તસ ! પહેલાં યુવરાજપણામાં પણ તું જગતપર સર્વ સત્તાવિકારી હતો. ને હવે તો રાજતેજથી વધારે પ્રતાપવાળો થઈ સાંઘ્રાન્યનું રક્ષણ કર કે જેથી કોધપણ પ્રાણી આપણા સાંઘ્રાન્યમાંથી છટકી શકે નહિએ.”

જગત ઉપર મોહરાજનું સાંઘ્રાન્ય એ રીતે સારી રીતે જામે છે. એક દિવસે સંસાર નગરમાં યૂમાખૂમ મચી રહી. મોટો કોલાહલ થયો. “હે સુલદો ! હોડા ! હોડા ! આ ચારિત્રરાજનું-કર્મરાજનું સૈન્ય ધસી આવયું છે તે પ્રજાના લોકોને-આપણી પ્રજાને હરી શિવનગરીમાં-પોતાની નગરીમાં લઈ જાય છે.”

મોહરાજની સભામાં આ પોકાર પડવાથી કોખથી ધમધમતો મોહરાજ ધર્મરાજની સામે ચુક્ક કરવાને તૈયાર થયો. “રે મંત્રી ! આ શું જુલામ ! એવો કોણ એ ભાથાનો છે કે મારી છાયામાંથી મારી પ્રજાને હરી જાય છે ? હે રાગદેષ સુઅટો ! અદ્વિતીય પરાક્રમવાળા તમે તમારી સેના સાથે તૈયાર થાએઓ ! હે મિથ્યાત્મ મંત્રી ! રાજનો

કારોબાર તું કૈવો ચલાવે છે? તું મંત્રી છતાં આ ચારિત્ર મારી પ્રજાને હરી જાય છે તે જોતો-જાણતો નથી શું?

મોહરાજનો ડલડલાઈ સાંલળી અવિવેક રૂપી મંત્રી બોલ્યો “હે દેવ! આપ પ્રસન્ન થાઓ, ઐહને દૂર કરી મારી વાત સાંભળો. પૂર્વે તમારા પિતાએ ચિર સ્થિતિ નામની તમારી માસીના વિવાહ સમયે જગતપુરમાંથી કન્યાદાનમાં એકસો સીતેર નગર લેટ આપેલાં હતાં, એ અધાર્યાં તમારી માસીએ ધર્મરાજના આશ્રય-આવિપત્ય નીચે સુદ્ધાં, ત્યાંના જે જે પ્રજાજનો ધર્મરાજનો આશ્રય લીધો તેમને ધર્મરાજ સુધ્ય સમૃદ્ધ આપવા લાગ્યા. જે લોકો અવિકાચિક ધર્મરાજની સેવા કરવા લાગ્યા તેમને ગુણ આપવા માંડ્યું. ધર્મરાજએ અર્જુત ચહી, અળદેવ, વાસુદેવ વગેરેની સમૃદ્ધિ પણ આપવાથી લોકો ધર્મમાં ઉજમાળ થવા લાગ્યા. સુધ્યની ધર્યાએ પણ લોકો ધર્મની સેવા કરવા લાગ્યા.

હે નરપતિ! મિથ્યાત્વ દર્શનાદિક તમારા મંત્રીઓએ દુર્ગતિમાં ફેંકેલા તમારા પ્રજાજનો પણ ત્યાંથી કાળ-સ્થિતિ પૂરી કરી નિકળેલા તે પણ દુઃખથી ઐહ પામેલા છતાં ધર્મરાજની સેવા કરવા લાગ્યા. ધર્મરાજનું રાજ્ય અનુકૂમે અ રીતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યું.

ચિરકાળ પર્યત રાજ્ય ભોગવી ધર્મરાજએ પોતાના જયેષ્ઠ પુત્ર ચુવરાજ ચારિત્રને રાજ્યપદે સ્થાપન કર્યો. પરો-પકાર રસિક ચારિત્ર નૃપને દીનજનો વિનંતિ કરવા લાગ્યા. “હે સ્વામીન! મોહરાજના જૂત્યોથી પીડા પામેલા અમને તમારા શરણમાં લ્યો. અમને નિર્બય સ્થાનક અતાવો કે જ્યાં મોહરાજના સુભરો અમને પીડિ નહિ.” એમની દીનવાળી સાંલળી ચારિત્ર ભૂપ બોલ્યા. “હે

વિવેકી જનો ! મારો આત્મય કરી મુક્તિ નગરીમાં જાઓ,  
ત્યાં તમને કોઈ હેરાન કરી શકશે નહિ. એ મુક્તિનગરી  
(નિર્બધ નગરી)માં જવા માટે તમારે નિઃસરણીની  
ખાસ જરૂર છે પણ આજે નિઃસરણી (ક્ષપકશેણિ)નો વિરહ  
હોવાથી તમે વિવેકદ્વપ્ત પર્વત ઉપર ચઢી જાઓ. કે  
ત્યાં તમને મોહના સુભટો હેરાન કરશે નહિ” એ પ્રમાણે  
કહી ચારિત્ર ભૂપતિએ સહાગમની સાથે વિવેકપર્વત  
ઉપર ચઢાવ્યા. પણી તો વિવેકદ્વદ્ધ થયેલા એ પ્રજાજનને  
બોધ આપણા સુભટો પાછા પડવા લાગ્યા. વિવેકદ્વદ્ધ થયેલા  
તે પુરુષો કેવલજ્ઞાનથી મુક્તિનો માર્ગ બોધ ત્યાં ચાલવા  
લાગ્યા. તે વારે નામ, ગોત્રાદિક ચારે તમારા ઘાંખેઓ  
એમને પડાવા ધર્મયા પણ તેથી નિરાશ થઈને પાછા ઝરી  
ગયા. છે તેમનો આ બધો પોકાર છે, તો છે હેવ ! અત્યારે  
વ્યર્થ પ્રયાસ કરવાથી શું ? અવિવેકની વાણી સાંભળી  
મોહરાજ ઊંખવાઈ ગયો.

અરે ! અરે ! આચલી બધી વાત આગળ બધી  
ગાઈ છે ? તો પણ તું હવે બધા પ્રાણીઓને અજ્ઞાન રૂપી  
મહિરાનું પાન કરાવ, કે જેથી તેઓ અધર્મમાં પણ પ્રીતિ-  
વાળા થને ” મોહનૃપની વાણી અંગીકાર કરી અવિવેક  
તુરત જ એ વાતનો અમલ કરી રાજને સમાચાર આપ્યા.

છતાંય મોહરાજ અવિવેકને સાથે લઈ નગરેનગરે  
ભામવા લાગ્યો. તો લોકોને અજ્ઞાનરૂપી મહિરાથી નષ્ટ ચેતના  
વાળા થઈને યોગ્ય શું કે અયોગ્ય શું ? આવા યોગ્ય શું  
કે અભક્ષ્ય શું ? ધર્મ શું કે અધર્મ શું ? એવા કાર્ય-  
કાર્યથી રહિત જોયા, પણ પોતાની માસીના નગરમાં  
લોકોને ધર્મ ધર્મ કરતા બોધ મુખ મયકોડતો મોહનૃપ  
યોદ્યો. “ અરે ! શું આ લોકોને તેં મહિરાપાન કરાવ્યું

નથી કે, ધર્મ ધર્મ કરતા આ બધા શું બધી રહ્યા છે ?”

મોહની જાણી સાંસળી અવિવેક હાથ જોડી બોલ્યો.  
 “હે ! આ બધા પણ અજ્ઞાન મહિરાના પાનથી ભાન ભૂલે-  
 લા જ છે. જો કે આ બધા ધર્મની વાતો તો કરી રહ્યા  
 છે-લોકોને ધર્મને નામે રમાડી રહ્યા છે. એ ખુને તેઓ  
 પોતપોતાના વાડા જનાવી રહ્યા છે ઇક્તા જનરંજન માટે-  
 જ આ બધું થઈ રહ્યું છે બાકી તેમનાં હૈયાં તો ધર્મના  
 પરમાર્થથી ઉલટી દિશામાં જ ફૂલી રહ્યા છે. સત્ય સ્વરૂપથી  
 તો તે બિચારાએ. ઠગાયેલા છે. હે હે ! આપ જરા  
 સુધ્રમતાથી આ ધર્મને પોકારનારાએ તરફ જોશો તો તેઓ  
 વિવેકપર્વત ઉપર હજુ ચઢેલા નથી શમાદિક મિત્રોની  
 એળાખ વગરના વાત વાતમાં લડી જવડા કરેનારા ધર્યા-  
 દિક હોષ્યવાળા છે. શુદ્ધ ચારિત્રની સેવાથી રહિત તેમજ  
 સમિતિ અને ગુમિ વગરના આપને જણાશે.” અવિવેક  
 આ લોકોની વસ્તુ સ્થિતિ સમજવવા છતાં મોહ નરપતિ  
 બોલ્યો.

“અરે ! આ બધું તું શી રીતે જાણી શક્યો?” મોહ  
 રાજના એ પ્રક્રનો જવાબ આપતો અવિવેક બોલ્યો.  
 “રાજન ! મિથ્યાહર્ષન મંત્રીની આજ્ઞાથી જીવાને હરવા  
 હું એક દિવસે વિવેક પર્વત તરફ ચાલ્યો. જો કે વિવેક-  
 પર્વત ઉપર ચઢવાને હું સમર્થ તો થયો. નહિ. પણ વ્યુહ  
 અહ, કદાઅહાદિક સુલાયોને મોકદી શુદ્ધાગમની વિધિને  
 બોલતાં કેટલીક વાતો મેં સાંસળી છે તેમના અંતરની  
 પરીક્ષા પણ કરી છે. જેથી હું કંઈક જાણું છું હેવ !”

“એ તો બધું ઠીક છે પણ મારી મારીના નગરો-  
 માંય મારા ભક્તો છે કે નહિ !” મોહરાજાએ અવિવેકને  
 પૂછ્યું.

“ વિવેકપર્વતની નીચે રહેલા બધાય ત્યાં તમારી જ આજા માને છે રાજુન ! પર્વત પર રહેલાઓમાં પણ ઘણા જનો તમારી આજાનો ત્યાગ કરી શકતા નથી.” અવિવેકની એ વાત સાંભળી પ્રસન્ન થયેલો મોહ જગત પુરમાં રમવાને ચાલ્યો-રમવા લાગ્યો.

અનેક ચિત્રવિચિત્ર વેશ કરતો તે ગાયન ગાવા લાગ્યો, નૃત્ય કરવા લાગ્યો પોતાની સાથે લોકોને પણ રમાડવા લાગ્યો-નચાવવા લાગ્યો કલેશ કરાવવા લાગ્યો કથારેક વાદિન વગાડતો સ્ત્ર્યં હુસતો અન્ય જનોને હુસાનવા લાગ્યો, જગતપુરમાં એ રીતે અનેક પ્રકારના લોકો પાસે ઐદ કરાવતો પુત્રોને પિતા કહેવા લાગ્યો, માતાને સ્ત્રીની જેમ આદિંગન કરવા લાગ્યો, સુતાને માતા કહેવા લાગ્યો, પિતાને શત્રુ કહેવા લાગ્યો માતાને વૈરિષ્ણી સમજવા લાગ્યો, સ્ત્રીને મા કહેતો તેના પાછે પડ્યો, ક્ષણમાં લાજ વગરનો થઈ વસ્ત્રને દૂર ફેંકી નૃત્ય કરતો, પાપી લોકોની-જથરા લોકોની ખુશામત કરતો વળી દેવ, ગુરુની નિંદા કરતો, એવી અનેક ચેષ્ટાઓ કરતો મોહનુપ પોતાના પરિવાર સાથે નવ નવા રસવાળાં નારક કરતો પોતાના પિતાને ખુશી કરવા લાગ્યો ને માતાને સંતોષ આપવા લાગ્યો. હે ભવ્યો ! એવી રીતે પોતાના શૌર્યથી પ્રમાણની સહાયથી જુતેલા સર્વ લોકોને મોહરાજાએ હણી નાખ્યા છે તેમજ મોહના કુલમાં ઉત્પજ થયેલા ઈદ્રિયોના વિષય વિકારોએ જગતને પરાવિન-પોતાને આવિન બનાવ્યું છે. માટે એ વિષય વિકારોને જીતીને હે ભવ્યો ! તમે અક્ષય એવા મોક્ષના સુખને મેળવો, રાગાદિ રિપુઓને જિતનારા સંયમને તમે આદરો, ભાગ્યથી રસાસ્વાહરહિત છતાં તત્વથી સુખ આપનારા ચારિત્રમાં જ તમે પ્રીતિવાળા

થાઓ.” ગુરુ મહારાજે મોહરાજનું તેમજ તેમના હુદાંખનું હુંકમાં વર્ણિન કહી સંભળાવ્યું.

રાજશેખર રાજયો માનતું ગ રાજાની સંમતિથી ગુરુ મહારાજને દીક્ષા આપવાની પ્રાર્થના કરી. જેથી કેવલી ભગવાને કહ્યું. “તમને એ ચોઅં છે માટે વિદાંખ કરશો નહિં.”

બને રાજયોએ જ્યલ્લૂપતિને પોતાપોતાના રાજ્ય સંભળવા વિનંતિ કરી તારે જ્યલ્લૂપાણે કહ્યું. “મારો અભિગ્રહ પૂર્ણ થવાથી હું પણ દીક્ષા લઈશ.” ત્રણે રાજયોએ દીક્ષાનો નિશ્ચય કરી પુણ્યવાત કુસુમાચુધને ત્રણે મહારાજ્યો અર્પણ કરી કેવલી ભગવાન પાસે દીક્ષા અહેણું કરી.

દીક્ષા માટે તૈયાર થયેલી પ્રિયમતીને પિતા અને પતિએ સમજાવી દીક્ષા લેતાં અચ્છાવી ભાગરાજને પાલન પોષણ કરવાની લલામણ કરી. જેથી તેણીએ દાક્ષાનો વિચાર થાડો સમય સુલતવી રાખ્યો.

## ૫

### કુસુમકૈતુ

કુસુમાચુધ રાજ ચોઅં ઉંમરનો થતાં પિતાના રાજ્યમાં આવ્યો, ત્યાં રહીને સર્વ રાજ્ય સમૃદ્ધિને લોગવવા લાગ્યો. સામંત આહિ પરિવાર વડે વૃદ્ધ પામતો પુણ્યના ઝણઝપ સુખને લોગવવા લાગ્યો, ચાર ચાર રાજ્યનો ધણી તેમજ સંસારના દિવ્ય સુખોને લોગવનારો છતાં એ લોગોમાં એનું મન દીન થતું નહિં કે જેવું મન પિતાએ આચરેલા માર્ગમાં દીન થતું હતું; જેથી તે આવકનો

ધર્મ આચરતાં અહોત લગવાનની પૂજા, યાત્રા, સ્તાવ્રા-  
દિક મહોત્સવો કરવા લાગ્યો.

સંસારના સોગો, ગીત, ગાન, તૃત્યાદિમાં એટલી  
ખદી પ્રીતિ તેને થતી નહિ. જેવી પ્રીતિ જીનેશ્વરના ધર્મ  
ઉપર રાજને હતી, એના રાજ્યમાં સર્વે આખાલગોપાલ  
જીનેશ્વરના ધર્મને યથાશક્તિએ આચરનારા હતા એમની  
જીહવા જીનેશ્વરના ગુણોની સ્તુતિ કરવામાં જ સાચધાન  
થતી પણ બીજી મલીન વાસનામાં પ્રીતિ ધરતી નહિ.

નિષ્કલંડ એવા આ નરપતિ ઇપ અપૂર્વચંદ્ર ઉદ્દ્ય  
પામે છતે જગત ભરમાંથી મિથ્યાત્પરી અંધકાર નાશ  
પામી ગયો હતો. એવા આ કુસુમાયુધ નરેશ્વરને રાજ-  
શૈખર રાજની સુલક્ષણની સુર્પા પુત્રી કુસુમાવલી  
નામે પદ્ધરાણી હતી. રાજવૈભવ સાથે રમણીનાં સુખ ભો-  
ગવતા આ નરરાજને ઘણો સમય ચાલ્યો ગયા છતાં  
જતા એવા સમયની તેમને અખર પડી નઈ.

વિજય વિમાનનાં સુખને લોગવતો જ્યસુંદરનો ઇવ  
આચુ પૂર્ણ થયે ત્યાંથી ચ્યવી કુસુમાવલીના ઉદ્રમાં  
ઉત્પન્ન થયો તે સમયે નિશાના સાગ્રાન્યમાં પદ્ધદેવીએ  
સ્વભાવમાં ધુમાડા વગરનો અભિ જોગ્યો. જગત થયા પછી  
એ સ્વભન રાજને જણ્ણાવતાં રાજાએ કહ્યું “તમારે મનો-  
હર પુત્ર થશો.” રાજનાં વચ્ચે સાંલળી રાણી ગર્ભતું  
પાલન કરવા લાગી.

યથા સમયે પદ્ધદેવીએ મનોહર અગોપાંગવાલા પુત્રનો  
જન્મ આપ્યો રાજએ પુત્રનો જન્મોત્સવ કરી મોદ્ય  
આંખર પૂર્વક પુત્રનું નામ રાખ્યું કુસુમકેતુ.

કુસુમકેતુ વૃદ્ધ પામતો કલામાં પાવરધો થધ અનુક્રમે  
નવીન રમણીય યૌવનમાં આવ્યો. યૌવન વચ્ચેમાં આવતા

એ કુમારની કીર્તિગાથાએ જગતના ખુણે ખુણે ઝરી વળી, પુણ્યની સુવાસની માર્ક એની યશ ઇપી સુવાસ દુનિયાપર ચારેકાર પ્રસરી રહી.

અન્યથા રાજસલામાં બીરાબેલા કુસુમાયુધ નરેપ તિની આગળ મથુરા નગરીમાં રાજ મહાકીર્તિનો મંત્રી વિનાંતિ કરવા લાગ્યો.

“હું નરેશ્વર ! અમારા સ્વામીને મનોરમાદિક આડ કન્યાએ છે તે પોતાના ઇપ, બુણ અને કળાથી ઉદ્ઘત થયેલી કોઈપણ કુમારને ઈચ્છતી નથી. એકદા રાજની આગળ તમારા કુમારની પ્રશંસા થતી તેમણે સાંભળી.

એ વર્ષાન સાંભળી પ્રસત્ર થયેલો રાજ મહાકીર્તિ એ કવિને કહેવા લાગ્યો “અહો તમે જેની આઠલી બધી પ્રશંસા કરી તે કોણ છે ?”

રાજના પ્રશ્ના જવાબમાં કવિ બોલ્યો “પ્રભો ! મહારાજ કુસુમાયુધ નરેશ્વરના કુળદ્વી આકાશમંહલમાં ચંદ્રમા સરખા સકલકલાના પારગામી કુસુમકેતુ નામે રાજ-કુમાર જેનાં વર્ષાન અનેક કિન્નર કિન્નરીએ સ્વસુષે ગાયા કરે છે” એ કવિની વાણી સાંભળી એ આડે રાજકુમારીએ કુમાર કુસુમકેતુ ઉપર રાગવાળી થધ.

રાજએ પુત્રીઓનો અભિપ્રાય જાહું પોતાનો મહામંત્રી મહાયુદ્ધિનામા, તેને બધી બાબત સમજાવી આપની પાસે મોકલ્યો છે, જે હું આપને અરજ કરું છું કે રાજ-કુમાર કુસુમકેતુને આપ મારી સાથે મોકલો.”

મહાયુદ્ધ મંત્રીની વાત સાંભળી રાજ કુસુમાયુધ બોલ્યો. “હે મંત્રીશ ! તમારા રાજએ કહું તે બધું બરાબર છે પણ આ રાજકુમાર યૌવનવયમાં આવેલો છતાં વિકારરહિત છે. હાસ્યથી વચન બોલવામાં પણ આગમું

છે. અગોપાંગમાં ચુવાનીના હાવલાવ પણ જણાતા નથી. સ્વીએ તરફ નજર સરખીય કરતો નથી વિષયો તરફ વૈરાગ્યવૃત્તિવાળો આ કુમાર કેવળ ચોગીની માડક શાસ્ત્રના વાંચનમાં જ પ્રીતિવાળો છે જેથી તેની ચિત્તની વૃત્તિએ કેવી છે તે તો અમેય જાણતા નથી છતાં વડીલની આજાનું પાલન કરનાર હોવાથી કહાચ અમારી આજાથી કુમાર તમારા નગર તરફ આવશે અરો.”

કુસુમાયુધ મંત્રીને સમજાવતો હતો તે દરમિયાન પ્રતિ-હારીથી આજા કરાયેલો સાકેતપુર નગરના રાજનો સુગુમ્ન નામે હૃત રાજસભામાં પ્રવેશ કરીને બોલ્યો. “હૃવ ! અમારા રાજ રવિસેન નરપતિને આઈ સુંદર કન્યાએ છે. નરવૈરિણી એવી તે કન્યાએ અનેક રાજકુમારોનાં ચિત્ર-પટ જોયા છતાં તે રંઝુત થઈ નહિ પણ રાજકુમાર કુસુમ-કેતુનું ચિત્રપટ જોતાં બધીય રાગપીડિત થઈ આકુળ વ્યાકુળ થઈ ગયું. જેથી રવિસેન રાજએ મને આપની પાસે મોકલ્યો છે કે હે સ્વામી ! કૃપા કરી રાજકુમારને અમારા નગર તરફ મોકલો.” સુગુમ્નામા મંત્રીને રાજ કુસુમાયુધ કંઈ પણ જવાબ આપે તે દરમિયાન વત્તસ દેશના અધિપતિએ મોકલેલો સુલાણિત નામે હૃત રાજને નમી હાથ જોડી બોલ્યો.

હૃવ ! જયતુંગ રાજએ આપને વિનંતિપૂર્વક કહેવ-ાયું છે કે પોતાને ઇપવાન અને ગુણવાન સોણ કન્યાએ છે તેમના પતિ માટે એક દિવસે નિમિત્તકને પૂછતાં કહેલું કે ‘આ કન્યાએનો પતિ કુસુમકેતુ થશે.’ જેથી રાજએ કહું છે કે કૃપા કરી કુસુમકેતુ રાજકુમારને આ તરફ મોકલો !’

ત્રણે હૃતોની વાણી સાંભળી રાજ કુસુમાયુધ વિચા-રમાં પડી ગયો. કુમારને હવે કયાં મોકલવો. કારણકે એકને

રાજ કરી યેનાં અપમાન કરવાં ચોણ્ય નથી. એના કરતાં તો વણેને ના પાડવી એજ ઠીક છે.

વિચારવાન રાજએ પોતાના મહાયુદ્ધ મંત્રી સામે જોયું. મંત્રીએ મહારાજની ચિંતા જાણી તરતજ હાથ જોડી અરજ કરી. “હૃવ ! બાર દિવસ પછી લગ્ન શુદ્ધિનો એક દિવસ આવે છે જેવો દિવસ બાર વર્ષે પણ આવનાર નથી. તો વણે નરપતિએ પોતપોતાની કન્યાએને અહીંયાં મોકલે કે જે દિવસે અધી કન્યાએ સાથે એકી વખતે લગ્ન થઈ જાય, માટે કન્યાએને અહીં મોકલવા દરેક રાજએને જણાવો મંત્રીની વાણી સાંભળી રાજ પ્રસન્ન થયો. “વાહ મંત્રી ! વાહ ! જેવું મહાયુદ્ધ તારું નામ છે તેવુંજ તારું કામ.”

મંત્રીની વાત સાંભળી બધા મંત્રીએ “સાધુ ! સાધુ ! કહી તેની પ્રશંસા કરવા લાગ્યા રાજ કુસુમાયુધે પણ એ વણે દૂતોને એ વાત કહી સંભળાવી.

રાજની વાત અંગીકાર કરી એ વણે દૂતોએ પોતપોતાના નગરમાં આવી પોતપોતાના સ્વામીને તે વાત કહી સંભળાવી. પ્રસન્ન થયેલા તે રાજએએ અનેક હાથી, ઘાડા, રથ, સુલટો, દાસ, દાસીએ મણિ, રત્નો, સુવર્ણા-હિક સમુદ્ધિપૂર્વક પોતપોતાની કન્યાએ મોકલી દીધી.

પેલા શુલ્ષ દિવસે પિતાની આજા અંગીકાર કરી કુસુમકેતુ તે બન્તિસે કન્યાએ સાથે માટી ધામધુમપૂર્વક પરણી ગયો ને દોષુન્દુકહેવની માર્ક સુખસાગરમાં કીલા કરતાં જતા એવા કાળને પણ જાણુંતો નહિ, સુખમાં વણે કાળ ચાલ્યો ગયો.

૬

### ઉપકારી ગુરુ

શિવવર્ધનપુર નગરના રાજ શ્રીસુંદરે કુસુમાયુવને રાજ્યપહે સ્થાપન કરી પોતાના બંધુ પુરંદર તથા મંત્રી સામંત સાથે દીક્ષા ઘરુણ કરેલી તે ભણી ગણી આચાર્યપહે સ્થાપન થયા. પુરંદરાદિક પાંચસો મુનિઓની સાથે વિહાર કરનારા સુંદરાચાર્ય પૃથ્વીમંહલને પાવન કરતા અવ્યજનોને પોધ કરવા લાગ્યા. અનુકરે સુંદરાચાર્ય અવધિજ્ઞાની થયા. જ્ઞાનથી કુસુમાયુવનો પ્રતોહય જણી વિહાર કરતા ચંપાનગરીના ઉધાનમાં આવ્યા. વનપાલકના મુખ્યી વધામણિ સાંભળી રાજએ દાન આપી તેને રાજ કર્યો.

રાજ મોટી ઝડ્ધિસમૃદ્ધિપૂર્વક અંતઃપુરાદિક પરિવાર સાથે ગુરેને વાંદવાને આવ્યો. શાંત રસના સાગર સમાન સૂરિને જેધ અક્ષિપૂર્વક નમી ગુરુની આગળ રાજ બેડા. આચાર્ય પણ રાજને ઉદ્દેશી ધર્મ દેશના દેવા લાગ્યા. “હુ રાજન! જગતના સંયોગ છે તે વિચોગના કરનારા છે. માતા, પિતા, પુત્ર, કલનના સંખ્યાદ્યો સ્વમ સરખા જણી લેવા. તો આ અસાર સંસારમાં ધર્મનું સેવન કરવું એજ શ્રેયસ્કારી છે.

હંતશુંદ વગર જેમ ગજરાજ શાલા પામતો નથી, વેગ વગરનો અથી જેમ કિમત વગરનો છે, ચંદ વિનાની રજની શાલા પામતી નથી, સુગંધ વગરનું પુણ જેમ નકાસું છે, જળ વગરનું સરોવર જેમ શાલતું નથી, છાયા વગરનું વૃક્ષ શાલા કિનાનું છે, ચારિત્ર વગરનો સાંધુ, અને પ્રતિમા વગરનું ભવન જેમ નકાસું છે, તેમ ધર્મ વિનાનો માનવી જગતમાં નકામો છે.

હે રાજન ! ચિરકાલ પર્યંત તેં ભોગોને લોગવ્યા જગત પર અંધ્યાર્થ લોગવ્યું તો હવે એ રાજ્ય અને ભોગોનો ત્યાગ કરી તારે પ્રતને વિષે યત્ન કરવો જોઈએ. સુંહરાચાર્યનો ઉપદેશ સાંભળી કુસુમાખુદરાજ મનમાં વિચાર કરવા લાગ્યો.

“અહો ! આ પૂજ્ય મને એકાંતે હિત કરનારો છે. અથવા તો પરોપકાર પ્રતવાળા સજજન પુરુષો જગતમાં આવાજ હોય છે. વરસાદ પરોપકાર માટે વરસે છે. સૂર્ય પરોપકાર માટે અંધકારને હરે છે. ચંદ્રમા પરોપકાર માટે અમૃતને જરે છે.

માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ભિત્ર, સ્વામી, બૃત્યો, હાથી, ઘોડા, રથ જરજરેરોતાદિ ભવસાગરમાં ડાબતા લુધને રક્ષણ કરવા માટે કોઈ સમર્થ નથી, ઇક્તા એક ગુરુજ ધર્મ પમાડવાતે કરીને આત્માને દુર્ગતિ ગમન કરતાં અદ્યકાવે છે. તેમાંથી આ ગુરુનો મારે વિશેષ ઉપકારી થથા છે બાલપણામાં જેમણે પોતાનું મોઢ રાજ્ય મને આપી દીધું અત્યારે મુક્તિના રાન્યને અપાવવા તૈયાર થથા છે. આવા ઉપકારીનો મેલાપ છતાં મને વિક્ષાર છે કે આ વિષયોમાં આસક્ત થધુ પિતાએ આચરેલા માગની હું અંગીકાર કરતો નથી. પ્રિયાના મોહાંધંબન અને રાજ્ય અંધનથી અંધાયેલા મારા સરખા મોહાંધ પુરુષોને મૃગલાની માઝેક પાશમાં અંધાવાતી હવે શી વાર છે ? હજુ પણ જો જાગૃત નહી થાઉં તો આ ભવસાગરમાં મનુષ્ય-જન્મ પામ્યા છતાં નક્કી હું હારી જઈશે.

વિચાર કરી રાજ ગુરુને હાથ જોડી યોદ્યો. “આ અસાર સાંસારમાં ભાગ્યયોગે મળેલો આપનો ઉપદેશ સાંભળી મને મનુષ્ય ભવની કિંમત સમજાઈ ગઇ છે.

અકારણ બંધુ એવા આપનો આદેશ હું અવશ્ય અંગીકાર કરીશા.”

શુદ્ધનું વચન અંગીકાર કરી રાજ નગરમાં આવ્યો. રાજએ મંત્રીઓની સમક્ષ કુસુમકેતુ કુમારને આસન ઉપર ઘેસાડી પૂછ્યું: “હે કુમાર! જગતમાં એવી નીતિ છે કે પુત્ર કવચધારી થાય તારે રાજએ રાજ્યભાર સમર્પણ કરી શુક્ત થયું. રાજ્યભાર ઉપાખનને સમર્થ તારા જેવો પુત્ર મને રાજ્ય ચિંતાથી શુક્ત કરે તો હું પાછલી અવસ્થામાં શુદ્ધનો જોગ પામી આત્મહિત કર. કારણ કે તે જ ખરા પુત્રો છે કે જેમની સહાયથી પિતા ધર્મ સાધન કરી શકે.

“હે પિતા! જ્ઞાત તત્ત્વવાળા આપ જેવાને એ વાત શુક્ત છે, હું એ ધર્મકાર્યમાં આપને અંતરાય કરતો નથી કિંતુ પ્રાણતકણે શથાનો ત્યાગ કરતાં પ્રથમ જે હું તમારાં મુખ દર્શન કરું તો જ રાજ્ય, વૈભવ, સુખ બધુંય સર્જણ થાય. જે તમારાં દર્શન ન થાય તો આ રાજ્ય, વૈભવ ઐશ્વર્યનું પણ મારે શું કામ છે? બાપુ! જે રાજ્યમાં રહેવા છતાં ચંદ્રમા સમાન સૌભય આપતું મુખ વારંવાર જેવામાં ન આવે એવા રાજ્યનું પણ શું?

પ્રજ્ઞયલતા મકાનમાં પ્રિય એવા પુત્રનો ત્યાગ કરી પલાયન કરી જવું તે હે તાત! તમને શું યોગ્ય છે? લયંકર અરણ્યમાં મુખ્ય એવા મૃગધાલ સમાન મારો ત્યાગ કરી જતા રહેવું તમને શોભતું નથી.” સંયમની અભિલાષાવાળા પુત્રને જાણી રાજ ઘોલ્યો.

“હે વત્સ! તું હજુ આશા ભરેલો નવદુલાન સંયમને શ્રી રીતે આચરીશ? ઈદિયોનું દમન, કષાયોનું વશપણ અને વિષયોને યૌવનવયમાં સ્વાધિન કરવા તે કંઈ સરળ-

મુગમ નથી. ચપળચિતવાળી ચુવતીનો વિશ્વાસ શો? અદે ઉઠીને વિચારો કરી જાય, માટે અત્યારે તો રાજ્યનું પાલન કરી વિલાસ કર, સમય આવે ત્યારે તું પણ મારી કેમ દીક્ષા અહણું કરશો.” રાજ્યે રાજકુમારને સમજની વાત માંઝો.

પિતાનાં વચન સાંભળના છતાં પણ દીક્ષા લેવાની દદ ભાવનાવાળો કુસુમકેતુ બોલ્યો. “પિતાજ! મંદ મંદ ગતિએ ગમન કરનારો તારાઓ પણ મોદા તારાઓનો આશ્રય પામી આકાશ પાર કરે છે. શૂરવીરની નિશાએ રહેલા કાતરપુરુષો પણ શું ચુક્ક કરતા નથી? સાર્થવાહના સાથમાં રહેલા નિઃસત્ય પુરુષો પણ મહા અરણ્યનો પાર પામી જાય છે. તેવી રીતે હે તાત! આપનો આશ્રય લઈને દુર્ગમ એવા શીલદર્શી શૈલ ઉપર હું ચઢી જઈશ. પૃથ્વી ઇપી ઉધાનમાં ભર્મી રહેલા મનદર્શી વાંદરાને યોગીએ જ્ઞાનદર્શી શું અલાથી બાંધી શું સ્થિર નથી કરતા?”

કુસુમકેતુની સંયમની ભાવના જાણી કુસુમાયુદ્ધ રાજ્યે દેવસેનકુમારનો રાજ્યાભિષેક કર્યો. અહૃતી ઉત્સવ તેમજ માટીમાટી જનપૂજાએ રચાવી, દીન, અનાથ અને રંકજનોને પુષ્કળ દાન આપી તેમનાં હારિદ્ય હૂર કર્યો. શાસનની પ્રભાવના કરી. એ વૈરાઘ્યરંગવાળા રાજ્યે કુસુમકેતુ તેમજ પાંચસો પુરુષાની સાથે, અત્રીસ રાણીએ તેમજ પુત્રીએની સાથે, દેવસેન રાજ્યે મહોત્સવ કરેલો છે એવા તેની સાથે મહા આડઅરપૂર્વક ખરીદ્યર પાસે દીક્ષા અહણું કરી.

કુસુમાયુદ્ધ અને કુસુમકેતુ વૈરાઘ્યરંગથી રંગાયેલા તો હતા જ ભવોભવના ચારિત્ર પાલનાના અદ્યાસંહી હોવાથી આ લઘમાં પણ એમનો અફ્યાસ વૃદ્ધિ પામવા લાગ્યો.

જ્ઞાનનો અભ્યાસ કરતા ને તપને આચરતા તેઓ સંયમ ઇથી વૃક્ષને ખુલ્લ વૃક્ષ પમાડવા લાગ્યા. ઝાલીકુલીને એ સંયમઇથી વૃક્ષને તેમણે એવું તો વૃક્ષ પમાડણું કે જેનાં ઇલ હું અધ્ય સમયમાં જ મેલવવાને તે લાગ્યશાળી થશે.

ધૂખંડના વિજયથી તેમજ અલિમાનથી ઉદ્ઘત થયેલા રાજાઓને લુતી પૃથ્વીમંડલમાં જેમનો યશ વિસ્તાર પામ્યો છે એવા યક્વતીને ધૂખંડની સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેમજ ચોસઠહણર અંતે ઉરીના વિલાસોમાં જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ અન્ધિક આત્મસુખનાં તે અધિકારી થયા.

## ૭

## સ્નેહ અંધન.

ચારિત્રની આરાધના કરતા એ ધ્યને મુનિઓ સંયમ તેજવડે શોભતા, જે તપ પિતા કરતા હતા તે જ તપ પુત્ર કરતો હતો. ધ્યને મુનિઓ સાથે વિહાર કરતા હતા, તેમજ સાથે રહેતા હતા. સાધુપણાની ઉત્કૃષ્ટ કિયા કરવા છતાં એકથીજનો વિચોગ તેઓ સહન કરી શકતા નહિએ, દેહની છાયાની માઝુર પિતા અને પુત્રનો એક સાથે નિવાસ એ સ્નેહઅંધન સાધુપણામાં અભ્યुક્ત ગણ્યાતું હતું. તેમના આવા સંબંધથી એક હિવસે ગુરુએ તેમને શિખામણ આપી.

“હુ મુનિઓ ! સંસારઇથી કેદ્ભાનામાંથી નિકળેલા તમારે સ્નેહ અંધનથી અંધાધને મુક્તિમાર્ગમાં અગાલા ઉલ્લિ કરવી તે યોગ્ય નથી. કારણ કે સ્નેહ એ તો લુધને સંસારમાં ખાંધી રાખવા માટે સાંકળ સમાન છે. પ્રાણી-ઓને સ્નેહ જેવું પીડાકારી આ જગતમાં ધીજુ કોણ છે? સ્નેહપણાથી જ દહીને મંથાવું પડે છે. સ્નેહ થકી તદ્દ

અને સરસવને ઘાણીમાં પીલાનું પડે છે. રાગના વશે મળું ને કેટલી પીડા લોગવવી પડે છે ? માટે હે સાધુ ! ભારે કર્મી એવા ધર્મરહિત જીવોના સ્નેહની વાત તો દૂર રહ્યો પણ આસજ્ઞસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કૈવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્વી અને મુત્રાદિક જે ભિત્રગણ તેમજ જે શત્રુસભુદાય એ એકચેકની સાથે અનંતીવાર શત્રુમિત્રના સંખંધે લેગા થયા. લુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું અક્ષણ થયું. કેટલાકને રોપથી મારી નાખ્યા. સ્નેહથી કેટલાકનું પાલન કર્યું, માટે સંસારનું સ્વરૂપ જાણનાર જીવોએ રાગ અને રોપ કરવો યુક્ત નથી.” ગુરુની શિખામણ સાંભળીને તે અન્ને મુનિઓ ઘોલ્યા.

“હે ભગવન ! સંસારના સર્વે સંખંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાવના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસનો સ્નેહ જતો નથી એનું કારણ શું ? તે આપ કહો.”

અજે મુનિઓની વાણી સાંભળી ગુરુએ તેમનો પરિલખનો સંખંધ મૂળથી અત્યાર સુધીનો કહી સાંભળાવી કર્યું. “તમે જન્મોજન્મ સ્નેહને ઝુંઘ પોંચોલો છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુસ્ત્યાંય છે છતાં તમારા જેવાએ એ બંધન તો તોડવાં જ જોઈએ. મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ સ્નેહખંધન તમારી ભવપરંપરા વધારશે. માટે તમારે એનો ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ.”

ગુરુના મુખથી પોતાના પૂર્વલબ્દો જાણી અન્ને મુનિના આને જતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરુના ફિદ્યા પ્રમાણે પોતાના પૂર્વલબ્દ જેવા, જેથી મનમાં અધિક

વિરક્ત થયેલા અને સંસારભાવથો ઉદ્ઘાસ વૃત્તિવાળા તે અન્ને મહાભુનિએ ત્યારથી સ્નેહખંધન તોડવા પૃથ્વી પૃથ્વી વિહાર કરવા લાગ્યા, ને સ્નેહ ખંધનને તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

મહાસત્વ કુસુમાયુદ્ધ ભુનિરાજ પણ ગુરુની વાણી સાંભળી એકાકી વિહાર કરવા લાગ્યા, તેએ પ્રતિમા ધારણ કરી પોતાનો સંયમ નિર્વાહ કરવા લાગ્યા. લીધણુ શમશાનમાં કે શૂન્ય ખાંડેરમાં, પર્વત ઉપર કે વૃક્ષની નીચે સિંહ અને વ્યા�ના લયથી રહિત થઈ પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં રહેવા લાગ્યા. જે જગ્યાએ સૂર્ય અસ્ત થતો તે જગ્યાએ જ કાયાને વોસિરાવી કાઉસગ ધ્યાને રહેતા નાના કે મોટા ડોઈ પણ લયની તે પરવાહ કરતા નહિ. તપને ધારણ ગમે તેવો નિરસ આહાર મલતો તો પણ તેએ રાગદ્રોષ ધારણ ન કરતાં સમલાવે આહાર કરતા.

શામ, સંવેગ અને નિર્બદ્ધ વડે કથાયોનો નાશ કરતા એ મહાભુનિ ધ્યાનદ્વીપી અભિવડે કુમેને નિરંતર બાળવા લાગ્યા. મેઝની ભાડેક ધ્યાનમાં સ્થિર રહેલા તે નાના મોટા ડોઈપણ ઉપદ્રવાથી પણ ચલાયમાન થતા નહિ.

એકાકીપણે ગુરુચાજાએ વિહાર કરતા એ મહાભુનિ કુસુમાયુદ્ધ એક દ્વિવસે સુલોમ નામના ગામે વ્યાવ્યા, તે ગામના એક શૂન્ય ગૃહમાં રાત્રીને સમયે પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં સ્થિર રહ્યા.

મધ્યરાત્રીને સમયે ડોઈક પ્રમાદીએ એ ગામમાં ડોઈના મફાનમાં અભિ મુક્યો. તે અભિન ગામને બાળતો અનુ-ક્રમે ધર્મધ્યાનમાં સ્થિર રહેલા ભુનિવાળા ગૃહને પણ બાળવા લાગ્યો. એ અભિના ઉપસર્ગ માંય ભુનિ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તો પછી ધ્યાન છોડી પલાયન થઈ

જવાની તો વાત જ શી ? જેએ ભયંકર ઉપસર્ગથી પણ  
ચલાયમાન થતા નથી તેવા મહાસુનિને ધન્ય છે,

શૂન્ય શુહુનો જોગ લેતો અજિન સુનિને પણ ખાળવા  
લાગ્યો, ધર્મધ્યાનમાંથી એ મહાસુનિ શુક્લ ધ્યાનમાં  
આવ્યા, શુક્લ ધ્યાનને ધ્યાતા એ સુનિએ અધ્રિનો ઉપ-  
સર્ગ સહન કર્યો પણ ધ્યાન કે ચિત્તાની સ્થિરતાનો ત્યાગ  
કર્યો નહિ.

શુલ ભાવનામાં આસક્ત એ સુનિ અજિનો ઉપ-  
સર્ગ સહન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અતુતર  
વિમાનમાં ઉત્તમ એવા દેવ થયા.

પ્રાતઃકાલે એ મહાસુનિને અજિનથી ફંધ થયેલા જોઈ  
ગામ લોડો હાહાકાર કરવા લાગ્યા. પોતાના ફંખને ભૂલી  
જઈ શોાક કરવા લાગ્યા, “અરે ! આ મહાસુનિને કોઈએ  
બરમાંથી કાઢ્યા નહિ. આ ઘેર સુનિહૃત્યાના પાપથી  
આપણે બધા કલાંકિત થયા.” એ પ્રમાણે શોાક કરતા  
તેમણે સુનિની ઉચિત કિયા કરી, તે પછી ધીરે ધીરે  
શોકને ભૂલી જતા પોતપોતાના કાર્યમાં તેએ પ્રવર્ત્ય,  
કુરણું કે ગમે તેવો શોાક પણ કાલે કરીને ભૂલી જવાય છે.

એ સમયે શ્રી સુંદરાચાર્યને કેવલજ્ઞાન ઉપજ થવાથી  
આસન રહેલા દેવતાએ તેમની પૂજા કરવા લાગ્યા, ને  
ભાવસ્તી નગરીના ઉધાનમાં દેવતાએ રહેલા સુવર્ણકમલ  
ઉપર બેસી દેશના દેવા લાગ્યા. દેશના સમાસ થયે સમય  
મેલવી કુસુમકેતુસુનિ ઉત્સુકતાથી બોલ્યા. “હે ભગવન !  
અત્યારે કુસુમાયુધસુનિ કયાં વિચરતા હો ?”

કેવલી ભગવાને કુસુમાયુધ સુનિનો વૃત્તાંત જ્ઞાનથી  
જાણું તેમની પ્રશાંસા કરતાં કહ્યું. “તે કુસુમાયુધ સુનિના  
જીવિતને ધન્ય છે કે જે મહાર્ષિએ અધ્રિનો ઉપસર્ગ સહન

કરી આત્મહિત સાધી લીધું. હે મુને ! સંયમ લેવું એ તો સહેલું-સુગમ છે પણ તેની આરાધના કર્વી-નિર્વાહ કરવા એ હુલ્લબ છે. ” પછી ડેવલી લગવાને કુસુમાં શુદ્ધ મહામુનિનો વૃત્તાંત કહી સંભળાવી કુસુમકેતુ મુનિને કહું. “ હે લાગ્યવાન ! એમણે પોતાનું સ્વહિત સાધી લીધું છે એવા એ મહામુનિનો શોક તું કરીશ નહિ. તું પણ એમને અદ્ય સમયમાં જ મલીશ. એટલું જ નહિ પણ તમે અન્તે હવે થોડાજ કાળમાં ભાવસાગર તરી પાર થશો. ”

ડેવલી લગવાનનાં વચન સંભળી કુસુમકેતુ મુનિ અધિક ઉદ્ઘાસવૃત્તિથી સંસાર ઉપર અધિક વૈરાગ્યવાળા થયા છતાં ગુરુ આજા પ્રાપ્ત કરી સંલેખના કરી.

દ્રવ્ય અને ભાવશાલ્ય હૂરે કરી તે મહામુનિએ પાદ-પોપગમન અનશન અંગીકાર કર્યું. સિદ્ધોના ધ્યાનમાં તત્પર એવા એ મુનિ પર્યાશ દિવસને અંતે કાલકરીને સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં હેવ થયા.

## ૬

### સર્વાર્થસિદ્ધ મહાવિમાન

સર્વાર્થસિદ્ધ મહા વિમાન અહિથી લગભગ સાત રાજ ઉંચે અને સિદ્ધ શિલાથી બાર જોજન નીચે અનુત્તર વિમાનોનો એક પ્રતર આવેલો છે. ત્યાં ચારે દિશાએ ચાર શીંગોડાના આકારનાં વિજયાદિક વિમાન રહેલાં છે. ત્યારે મધ્યમાં જોળ અને લક્ષ્યોજનના પ્રમાણવાળું સર્વાર્થ-સિદ્ધ મહાવિમાન આવેલું છે. એ વિમાનોનું પૃથ્વીદ્દાન એક વીસસો જોજનતુ શાસ્ત્રમાં કહેલું છે ત્યારે વિમાનોની ઉંચાઈ અગીયારસો જોજનની છે.

એ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં પૂરા એક હાથ પ્રમાણ શરીરવાળા હેવો ઉત્પાદ શર્યામાં અંતઃમુદ્રાર્થ માત્રમાં ઉત્પત્ત થાય છે ત્યાંના દેવતાઓનું આયુષ્ય સંપૂર્ણ તેત્રીસ સાગરોપમ હોવાથી તેત્રીસ હજાર વર્ષે આહારની ધર્શાવાળા ને તેત્રીસ પખવાડીએ થાસોથાસ લેનારા એક અવતારી હોય છે સંખ્યાત વર્ષના આયુવાળા સંયમા મનુષ્ય જ ત્યાં જર્ઝ શકે છે.

ઉત્પાદશર્યામાં ઉત્પત્ત થતા એ હેવોને પોતાના અથાગ અનંત સુખમાંથી પરવારી શર્યા પરથી નીચે ઉત્તરવાનીય કુરેસહ નથી-જરૂર પડતી નથી. શર્યામાં પોઢેલા થકા તેમનો તેત્રીસ સાગરોપમનોય કાલ સમાપ્ત થઈ જાય છે. અદ્યત ઘણે કાલે જરૂર જણાય તો તેઓ એક પડખેથી ભીજે પડખે થઈ શકે છે એવા એ સુખી હેવો મંદુક્યાય વાળા, સમકિતવંત અને એકજ અવતારી હોવાથી ત્યાંથી મનુષ્ય અધમાં આવી સીધા મોક્ષ ચાલ્યા જાય છે.

અહુમિંદ જેવા એ દેવતાઓ અવવિજાને કરી કંઈક ન્યૂન ચૌદ રાજલોક સુધી જોઈ શકે છે એટલે ઉપર વિમાનની ધ્વજ સુધીને નીચે લોકનાલિકાસુધી તેઓ જોઈ શકે છે-જણી શકે છે. નીચેના દેવતાઓથી અનંત સુખ સાથીથીવાળા એ દેવતાઓના સુખ સૌભાગ્યની તે વાત જ શી કરવી !

મણીરલોથી વિલૂષિત એ વિમાનમાં ઉત્પાદ શર્યા ઉપર વિશાળ ચંદ્રવો હોય છે એ ચંદ્રનાની મધ્યમાં એક ચોસડમણુના પ્રમાણનું મોઢં મોતી હોય છે તેની ચારે આજુએ બત્રીસ બત્રીસ મણુનાં અગઝગતાં ચાર મોતી હોય છે તેની પછી સોળમણુનું એક એવાં આડ મોતી અગઝગ છે, તેની પાખતીએ આડ મણુનાં સોળ મોતી

જળડી રહ્યાં છે તે પણી ચાર ચાર મણુનાં ખત્રીસ મોતી વિમાનની શોલામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પણી એ એ મણુનાં ચોસઠ મોતી આવેલાં છે. એ મોતીના કુમણ્ણ પછવાટે એક એક મણુનાં એકસો અફાલીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદ્રવામાં બસોને ત્રેપન મોતીને કુમણ્ણ રહેલો છે.

એ મોતીમાં વિવિધ પ્રકારના નાયારંગ સ્વાલાવિક જ થયા કરે છે. દરેક મોતીમાં જુદી જુદી જતના થતા શાયિતા એ નાયારંગને જેતાં ઉત્પાદ શાયામાં રહેલા દેવને શાયાથી નીચે ઉત્તરવાની પણ જરૂર પડતી નથી-કુરસ્થદ નથી.

પવનની મંહમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફ્ઝાય છે એક થીજના સંવર્ષથી અનેક રાગ રાગણુના ઉત્પન્ન થાય છે મનોહર દેવતાઈ વાહિન કરતાં પણ અનંત ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મોતીની અંદર થતા નાયારંગને જેતાં જેતાં તેમને બધો કાળ ચાદરો જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ધૂંઢ્છા થાય છે ત્યારે પણ ધૂંઢ્છા થતાંની સાથે જ તે તુલા થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કરવાનીય જરૂર પડતી નથી.

સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પોતાના એ હિંય સુખમાં એવા તો લયદીન છે કે એટલું બધું દીર્ઘ આખું પણ પસાર થઈ જાય છે તેમની તેમને અખરે પડતી નથી.

કૃતા છંકુના નપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મતુષો એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તો મોક્ષે જ પહેંચી જાય એવા એ લયસમ્પ્રેમ દેવતાએ કહેવાય છે. અગીયારમા ગુણસ્થાનકે જે કાળ કરે તો પણ અનુતર વિમાનમાં

જ ઉત્પન્ન થાય છે, એવા અથાગ સુખના ધર્ષી એ દેવ-  
તાઓ સુક્રિયાની કક્ષા બાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી  
સુક્રિયામાં જધ શક્તા નથી.

ચંદ્રવામાં વલયાકારે રહેલા એ મોતીના કુમખાના  
સુખનો આસ્પદ તો મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઈ  
શકે, એમને કેવુંક સુખ હશે એની કદ્દપના પણ આપણે  
તો શી કરી શકીયે !



પરિચ્છેદ ૧૧ મો  
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર.



૧

**એકવીશમા ભવમાં**

**વર્ધમાનજિનો જીયાદુ, વર્ધમાનગુણાન્વિતઃ ।**

**વર્તતે સાંપ્રતં યસ્ય, શાસનं પાપનાશનમ् ॥૧॥**

ભાવાર્થ-અનેક ગુણાવડે વૃદ્ધિ પામેલા-ભરેલા તેમજ પાપને નાશ કરનારું જેમનું શાસન વર્ધમાન કાલમાં જયવંતુ વર્તે છે એવા શ્રી વર્ધમાન સ્વામી જયવંતા વર્તો, જય પામો !

આ જાંબુદ્ધીપના દ્વિક્ષિપ્તાર્થ ભરતના મધ્ય ખંડમાં રમણીય કોશલ નામે દેશ આવેલો છે. લક્ષ્મીને કીડા કરવાનું સ્થાન એવા એ મનોહર દેશમાં સ્વર્ગપુરીની શોભાનો પણ તિરસ્કાર કરે એવી શરૂઆથી અણુત અચોધ્યાનગરી આવેદી છે જેની રૂચના પ્રથમ જીનેથરના રાજ્યકાળે હરિના વચનથી દેવતાએએ કરેલી છે. એવી અણુત અચોધ્યા નગરીમાં સિંહસમાન પરાક્રમી હરિસિંહ નામે રાજ હતો. પ્રજાનું પિતાસમાન પાલનકરનારો, અર્થાં જનોને ખુબ હાનથી સંતોષ આપનારો આશ્રિતોને કદ્ય કુમ સરખો ને શરૂઆતનું નિકંદન કરનારો એ રાજ રાજ કરતે છતે પ્રજા સુખી અને સમૃદ્ધિવાન હતી.

આ રાજને પદ્મ સમાન લોચનવાળી, ઇપવાન અને ગુણવાન પજાવતી નામે પદ્મરાણી હતી. રાજ દ્વિષ્ટ

ભોગોની જેમ હેવતાની માર્ક સુખને ભોગવતો પોતાનો કાળ સુખમાં નિર્ગમન કરતો હતો.

અન્યથા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી કુસુમાયુધ રાજનો જીવ ચ્યવી પદ્માવતીના ઉદ્રમાં ઉત્પત્ત થયો. તે સમયે રાત્રીના પાછળાના પ્રહરે હેવીએ સુર અને હેવીથી ભરેલું મહાવિમાન સ્વપ્નમાં જેણું.

સ્વપ્ન જોઈ જાણુત થયેલી રાણીએ રાજ આગળ સ્વપ્નની વાત નિવેદન કરતાં રાજએ કહ્યું. “તમારે મનોહર પુત્ર થશો.”

રાજના વચનથી પ્રસત્ત થયેલી રાણી ગર્ભતું સારી રીતે પોપણ કરતી સમય નિર્ગમન કરતી હતી. નવમાસ વ્યતીત થયા ત્યારે પદ્મરાણીએ મનોહર કાંતિને ધારણ કરનારો પુત્રનો જન્મ આપ્યો.

રાજએ પુત્ર જન્મનો મોદો વર્ધાપન મહોત્સવ કર્યો. સગાંડું દુખાહિકની સંમતિથી કુમારનું નામ રાજણું પૃથ્વીચંદ્ર.

પંચ ધાત્રીએથી લાલન પાલન કરતો પૃથ્વીચંદ્ર કલાગ્નોના પારંગામી થિએ અનુકૂમે યૌવનવયમાં આવ્યો, નવીન યૌવનના ભાગ્યોદયવાળો હોવા છતાં કુમાર વયને ઉચ્ચિત કીડા કરતો નહિ. હાસ્ય કે વિલાસ પણ કરતો નહિ. વીતરાગની માર્ક પ્રશાંત મનવાળો તે આચુધ રમવાનો પણ અલ્યાસ કરતો નહિ કે ગજ અથવા અંધે પર સ્વારી પણ કીડાની આતર કરતો નહિ. કેવળ વ્યવહારની આતર સ્નાન, અલંકાર કે ભાલાને ધારણ કરતો હતો તેમજ અર્હન, ચૈત્ય, સાધુ, સાર્વભિક ને ભાતાપિતામાં તે અક્ષિવાળો હતો.

રાજકુમાર પૃથ્વીચંદ્રની વિરક્તાવસ્થા જોઈ રાજ વિચારમાં પણો “આ વૈરાણી રાજકુમારને લોગાસકત

શી રીતે કરવો ? એને પરણાવ્યો હોય તો સ્વીમ્યાના મોહમાં  
ખેંચાતાં સ્વયમેવ એ કદાચ ભોગાસક્તા થાય ખરો. કારણ  
કે જગતમાં પુરુષ ત્યાં લગીજ ધર્મી રહ્યી રહે છે કે જ્યાં  
લગી મનોહર એવી રમણીએ એને છુદ્યો નથી.

ખળવાનને પણ પુરુષો ખુદ્દિથી વશ કરતા નથી શું ?  
મહોન્મત ગજરાજ પણ અંકુશથી વશ થઈ જાય છે.  
તોડાની અથ લગામથી કર્દો સિદ્ધોહાર થઈ જાય છે.  
તેમજ માતેલા ખળહ પણ નાથ નાખ્યા પછી ડાહા થઈ  
જાય છે તેવીજ રીતે આ વૈરાગી પુત્ર પણ પરણાવ્યા પછી  
જરૂર ભોગામાં પ્રીતિવાળો થઈ વૈરાઘ્યમાં ઢીકો થઈ જશે.

મનમાં કંધક નિશ્ચય કરી હરિસિંહ રાજએ કુમારના  
મામા વિજયહેવ પાસે પોતાના અતુર મંત્રીને જ્યાપુર  
નગરે મોકદ્યો જેણે પોતાની લલિતસુંદરી નામે કન્યા  
પૂર્વે પૃથ્વીચંદ્રને આપેલી હતી.

રાજમંત્રીએ વિજયહેવ પાસે આવી કન્યાની પ્રાર્થના  
કરવાથી વિજયહેવ રાજએ પોતાની બીજ સાત કન્યાઓ  
સાથે લલિતસુંદરીને સર્વ સામગ્રી સાથે અયોધ્યા તરફ  
મોકદી.

રાજમંત્રી કન્યાદિક પરિવાર સાથે એ કન્યાઓના  
મામાની રાજધાની રાજ્યપુર નગરે આવ્યો. રાજ્યપુર પતિ  
એ પણ પોતાની કનકવતી આહિ આઠ કન્યાઓ સર્વ  
સામગ્રી સાથે પૃથ્વીચંદ્ર કુમાર માટે મોકદી. સોળ કન્યાઓ,  
હાથી, બોડા, રથ, ઝર, અવેરાત, સુલદો, દાસદાસી આહિ  
પરિવાર સાથે રાજ મંત્રી અતુક્રમે અયોધ્યા આવી પહોં  
ચ્યો. રાજએ મંત્રીનું સન્માન કરી કન્યાઓના ઉતારની  
વ્યવસ્થા કરી.

તે પછી રાજએ કુમારને પોતાની પાસે યોલાવી

કહ્યું. “કુમાર ! બજે મહારાજાએ તરફથી તારે માટે આવેલી આ સોળ કન્યાએ સાથે તું વિવાહ કરી એમની સાથે તારી ખુવાની સર્કલ કર. એમને પણ આ મોટી ચિંતા-માંથી તું મુક્ત કર.” લગ્ન કરવાની ખાસ ઈચ્છા ન છતાં પિતાનું વચ્ચે કુમારે માન્ય કર્યું જેથી રાજએ સારું ખુહ્રત્ત બોઈ એ સોળે કન્યાએ કુમાર સાથે પરણાવી.

મોટા મહોત્સવ પૂર્વક વિવાહ થતો જોઈ પૃથ્વીચંદ્ર મનમાં વિચાર કરવા લાગ્યો. ‘‘અરે ! જગતના મોહેલાદા માનવીની પ્રવૃત્તિ તો જુઓ ! મોહેલાએ કેટલી બધી કદર્થના પામે છે. છતાં પણ એ કદર્થનાનું તેમને જરાય લાન થતું નથી. આ હાડ માંસ એને ઇવિર લરેલા શરીરને ખહારથી કેવું મનોહર બનાવે છે, શાણગારે છે, છતાં પણ સ્વભાવથી અસુંદર એવો આ હેઠ કાંધ સુંદર થતો નથી. જે માલા, વસ્ત્રાલંકારાદિક સુંદર પહાર્થી હેખાય છે તે પણ મલમૂત્રથી લરેલા આ હેણતા સંસર્ગથી ઉલય મળીન એને અશુય્યિમય થઈ જાય છે.

આ અસાર સંસારમાં કોણ કોનો પુત્ર છે ? કોઈ કોધનો બંધુ નથી. સ્વામી શું કે સેવક શું ? એ બધા ક્ષણીક ભાવો છે. જેને માટે લોકો આનંદિત થયા છતા રમે છે, એવો માતાપિતાનો સ્નેહ પણ ક્ષણીક છે. સ્નેહથી મુંઝાયેલાં મારાં માતા પિતા અત્યારે મારે માટે કેટલું બંધું કરી રહ્યા છે ? અરે આ ક્ષીણો પણ મૂર્ખ છે કે પોતાના માતાપિતાનો ત્યાગ કરી મારે માટે અહીંયાં આવી, તો જ્ઞાનીજનોએ તો આવા મોહમાં રમવું ચોગ્ય નથી. છતાં પણ જો હું આ ખાલાએની સાથે વિવાહ કરવાની ના પાડ તો મારાં માતાપિતા કેટલાં બધાં હુંઓ થાય, હુરથી આવેલી આ આગાએા પણ મારા વિયોગ હુંઓઓ થઈ જાય.

દીક્ષા લેવાની ભાવનાવાળા મને તાતે આ મહા સંકટમાં નાખી દીવો તો મારે હવે શું કરવું ? જો માતા પિતા અને આ પ્રિયાઓને બોધ કરી દીક્ષા અહેણ કરવું તો તો બધાં સારાં વાનાં થાય. એ બધા ઉપર મહાન ઉપકાર થાય. એ પ્રમાણે વિચાર કરતો પૃથ્વીચંદ કુમાર માતાપિતાની આજ્ઞાથી લગ્નકાર્ય પરિપૂર્ણ કરી પોતાના વાસલુચનમાં આવ્યો.

હિવસના કાર્યથી પરવારી રાત્રીની શરૂઆત થયે છતે ભદ્રાસન ઉપર કુમાર ઘેડો. એની આસપાસ રતનપઢક ઉપર સોણે સુંદરીએ કુરી વળી. રાજકુમારને રીજિવવાનો પ્રયત્ન કરવા લાગી. તારાઓની મધ્યમાં કૌમુદીપતિ ઊળકી રહે તેમ રાજકુમાર શોભાને પામતો વિરક્તતાને જ અનુભવવા લાગ્યો. એ લલિત લલનાઓમાંની એક પણ એ વૈરાગીને પોતાના નેત્રકટ્યાક્ષથી વીંધી શકી નહિ. શમરપી બાખ્તરને ધારણ કરનારો કુમાર પોતાની મધ્યમાં હોવા છતાં તેમને એક વૈરાગી સાંધુ જેવો જણાયો.

ઇપગવિતા લલિતસુંદરી પણ પતિની આ બેદ્ધાથી જરા લજિજત થધ ગઈ “અરે ! શું પોતાનો હાવભાવ કે કટાક્ષ પણ સ્વામીને કંઈ અસર કરી શકતો નથી એનું કારણ શું ? એમના જેવાના ચિત્તને સ્પર્શ કરવા માટે શું હું અચોગ્ય છું ? ત્યારે ? “એ બધી ભાળાઓએ મુખહાવભાવ કરવા માંડ્યા, છતાં ક્ષાર ઉપર લીંપણુંની જેમ તે તદ્દન બ્યર્થ ગયા. કુમારે તો સ્નેહભરી દશ્ચિથી તેમને જોઈ નહિ. ત્યારે વિષણુનામે બદુક બોલ્યો “અરે ! આ ભાળાઓ બધીય બ્યર્થ કર્દર્થના લોગવી રહી છે તો હે સ્વામી ! આ બધાનાં મન શાંત થાય તેમ કરો.” બદુકની વાણી સાંસળણી કુમાર બોલ્યો.

“હે બદુક ! સંસારમાં તો જ્ઞાનીને ઉગલે ને પગલે વૈરાગ્ય જણ્ણાય છે. પણ કેશવ બદુકની માઝે કદર્થના અમવા છતાંય આમને વૈરાગ્ય ન આવે તો પછી દોષ કોનો ?”  
“એ કેશવ કોણ ?” બદુના પૂછવાથી કુમારે કેશવનું વૃત્તાંત કહેનું શરૂ કર્યું.

૨

### કેશવ બદુક

પૂર્વે ભયુરાનગરોમાં હરિદ્રી એવો કેશવનામનો બદુક (વિભ) રહેતો હતો, તેને કપઠી, કુરીલા, કુર્યા અને કલાહ કરનારી કપિલા નામે પ્રિયા હતી. કુનારીનાં લક્ષ્ણને ધારણ કરનારી એ કપિલાનારી શાસ્ત્રમાં કહેલા કુલક્ષણાથી ભરેલી હતી, પિગલ નેત્રોવાળી, કર્ણશ શાખદવાળી, ઉંડા કપેલવાળી, સ્થૂલ જંધાવાળી, ઉંદ્રકેશવાળી, લાંખા ઓષ્ઠવાળી, લાંખા મુખવાળી, દીર્ઘનાસિકાવાળી તેમજ જેનાં તાલુ, જુહ્યા અને હોઠ (એષ) શ્યામ છે એવી દુર્ઘટા અંગવાળી ને વિષમ કુચુગલવાળી નારી પતિ અને પુત્રથી રહિત હોય છે એવી બ્રાહ્મ શીલવાળી નારીનો પુરુષોએ ત્યાગ કરવો.

ત્યાગ કરવા યોગ્ય નારી કપિલા સાથે પાતુ પાડી કેશવ બદુક હુંએ હુંએ દ્વિવસો પસાર કરતો હતો. અન્યદ્વા કપિલા ગર્ભવંતી થધ ત્યારે કેશવને કહેવા લાગી. “ધી, ગોળાદિક પહાર્થ મારે માટે ખરીદ કરવાને તમે દ્રવ્ય લધુ આવો.” કપિલાનો ધડકો સાંલળી કેશવનું હૈથું ધડક્યું.

“કપિલાનાં વચ્ચેન સાંલળી કેશવ બોલ્યો.” દ્રવ્ય ઉપાર્જન કરવાનું તો હું કંઈ પણ જણુતો નથી. તું કંઈ જાણતી હો તો ઉપાય બતાવ,”

“સુવર્ણ ભૂમિમાં જઈ મહેનત કરી સુવર્ણ કમાઈ લાવો. જાયો કમાઈ અટ વહેલા આવો.” કપિલાયે કહ્યું.  
કપિલાનાં વચ્ચન સાંભળી કેશવ સુવર્ણભૂમિ તરફે  
આવ્યો. ત્યાં બન ઉપાર્જન કરી પોતાના વતન તરફ પાછો.  
કર્યો ત્યારે કેશવને માર્ગમાં એક ધંડજાળીયો મદ્દયો, એ  
પ્રયંગીના સરદાર ધંડજાળીકે પૂછવાથી કેશવે મૂર્ખતાથી  
પોતાની બધી વાત કહી હીધી. પોતે સુવર્ણ કમાવી લાવેલો  
તે પણ જણાવી હેવાથી ધંડજાલિકે કેશવને ઠળી સુવર્ણ  
પડાવી લેવાનો વિચાર કર્યો.

ધંડજાલિકે પોતાની ધંડજાળવિદ્યા દેલાવી કેશવ  
અને ધંડજાલિક સાથે સુસાફરી કરતાં નગરની સમીપે  
એક વૃક્ષ નીચે વિસામે લેવાને બેઠા. તે સમયે એક સોળ  
વરસની માયાવી વિપ્ર કન્યા સાથે તેનાં માતાપિતા પણ  
એજ વૃક્ષ નીચે આવી એક બાળુએ વિસામે લેતાં બેઠાં.  
એ સોળ વર્ષની વિપ્રકન્યાની મનોહરતા જોઈ કેશવ  
દોલાઈ જતો વારંવાર એના સામે જોવા લાગ્યો.

નિર્દ્દર્શ થઈ કેશવે એ કન્યાની એના માતાપિતા  
પાસે માગણી કરી. જવાબમાં એના પિતાએ સહસ્ર  
હિનારની માંગણી કરી. પછી કેશવ હુલર હીનાર આપી  
એ કન્યા સાથે પરણી ગયો. લખને ચોણ્ય ખાન પાનની  
સામગ્રી પણ પેલાની માયાથી ત્યાં આવી હાજર થઈ, એ  
નવીન કન્યાને પરણી બઢક ઝુશી થયો.

ધંડજાલિક એની પાસેથી સઘળું સુવર્ણ એ રીતે  
તરફાવી પલાયન કરી ગયો. તે સાથે પોતાની ધંડજાળ  
માયા પણ સંહરી લીધી. પછી તો ન મળે નારી કે ન  
મળે કંઈ સામગ્રી. આ બધી લીલા જોઈ બઢક આલો  
ઘની ગયો “અરે! આ શું! સુવર્ણ પણ ગયું ને નવોદાં”

કારી પણ !” હું પણ ખોલ્યો ખોલ્યો તે નવી ફળીને શાખાને ઘર્યું ભૂમિ દરી વાયો. પણ કચાંથી જડે ! અસ્તકાજ અસ્તાજ એક કરવા પ્રયત્ન કર્યો, પણ એ તે કોઈ નાખી અન્યું છે કે તે બનાવી શકે.

જંગલમાં તાપ, ભૂખ, તરસ સહન કરી થાક્યો ત્યારે પાછી પેદી કપિલા સાંલળવાથી મુનઃ વતન તરફ કર્યો. “અરે ! સૂઠ ભૂદ્ધિવાળા મેં બધું સુવર્ણ લ્યથું ચુમાવી દીધું. કેમકે કણું છે કે જરડ મુર્ખો ખુખ કલેશ કરી પેઢા કરે છે ત્યારે બાધ્યસાધી જ એવાં કલ તે બોગવે છે. હાંત બિચાર દળી દળીને આડી જાય છે તેને જાણવા એક લીલા મારમાં ગણા નીચે ઉત્તરી નાખે છે. મેં પણ ખુખ કષ્ટ વેઠી સુવર્ણ પેઢા કર્યું તેને ચુમાવી દેતાં કર્દ્ધવાર લાગી ? બન વગર કપિલને હું સુખ પણ શું બતાવું.

“સુવર્ણ માટે ત્યારે દરી હું શું સુવર્ણ ભૂમિ તરફ જાઉં કે વિરાધાતુર પ્રિયા પાસે ?” એ પ્રમાણે વિચાર કરતો હે અતુક્ષે કોઈ ગામે આવ્યો ત્યાં તેને કોઈઓ ઇલિથી મિશ્રિત ભાતનું ભોજન કરાવ્યું.

તે રાત્રીને સમયે ત્યાં વડના વૃક્ષ નીચે જીવેલા તેણે સ્વમ્પમાં જોયું કે “પ્રાતાના થરમાં જોહ કામ કરત્યાં રહ્યોથી ભરેલું આખું ભૂમિયુહ બેધ ખૂશી થતા તેણે ગામમાં વર્ધાધન મહોત્સવ કર્યો. સ્વજનેને ભોજન કરાવી અધ્યાય નગરનો ભાનિતો થયો. રાજ્યએ પણ એનું અનુમાન વાધ્યાં એક નવી કન્યા સાથે લગ્યી સુણી થયો. કપિલા પણ રાજુ ક્ષણ તેની સેવા કરવા લાગી.”

એ મહુરા સ્વમની મીડી લહેચેમાં વિદ્ધાર કરતો કેશવ બદ્ધક રાજુલના જુંકવાથી એકાએક જગત થયેટ જગત થયેલો. કેશવ વિચાર કરવા લાગ્યો. “અરે ! નાસ

પોતાના ભક્તાનમાં આખું લૂભિગણ રતોથી ભરેલું છતાં હું પરદેશમાં નાહક કલેશ લોગવું છું માટે હવે તો ધેર જમ એ રતોને ઘણાર કાઢી હું હવે સુખી થાડું.” એ પ્રમાણે વિચાર કરતો ને મનમાં મોયામોયા હવાઈ મહેલ બાંધતો ધેર આવ્યો.

કેશવનું હસમુખ વદન જોઇ કપિલાએ વિચાર કર્યો, “નક્કી આ ધણું સ્વર્ણ લાધ આવ્યો છે.” કપિલાએ પણ સ્વાન વિલેપનથી એનો સારી રીતે સતકાર કર્યો, જ્યારે એની પાસે કાંઈ જોવામાં આવું નહિ ત્યારે આકોશ કરતી આલણી બોલી, “અરે ! ક્યારેનાય આવ્યા છો તે શું લાભ્યા છો મને ઘતાવો તો ખરા ?”

કપિલાનાં વચન સાંભળી શાંતિથી કેશવ બોલ્યો, “ધીરીથા ! ધીરીથા ! તારં સુખ હું ઉજવલ કરીશ, સ્વજન, કુદુંઘમાં તને શિરોમણિ અનાવીશ ! પહેલાં વણી-કની દુકાનથી ઉધારે ગોળ ધી વગરે લાવી સારી રસવતી કરી આવતી કાલે આપણા સ્વજનોને જમાડી તેમની સમજ કંઈક ચમત્કાર પૂર્વક હું મારી સમૃદ્ધિ પ્રગટ કરીશ.”

કેશવની વાણીથી ચમકેલી કપિલા બોલી, “પણ એ ઇવ્ય કચાં છે ? પ્રથમ મને એ દવ્ય ઘતાવો ? એ વન જોઇ શાંતિથી હું બધું તમારા કહેવા પ્રમાણે કરં !” પોતાની સીન નિશ્ચાસ પમાડતો કેશવ ઇરીથી બોલ્યો.

“અત્યારે એ દવ્ય વ્યવસ્થિત પડેલું છે સ્વજનોની સાક્ષીઓ હું તેને પ્રગટ કરીશ, તો હે પ્રિયે ! જો તને લદ્ભીનો ધંઢા હોય તો મારા વચન ઉપર નિશ્ચાસ રાખ.”

કેશવના વચનમાં વિશ્વાસ ધારણ કરતી કપિલાએ સ્વજનોને આમંત્રણ આપી ભોજન માટે નોતર્યા, ઉધાર માલ લાવી સર્વને કોજન કરાવું, લોકોમાં જ્યાતિ પ્રચ-

લિત થિત કે “‘દેશાંતરથી ધન કમાવી લાવેલો કેશવ મોદો વર્ધાપન મહોત્સવ કરે છે.’’ લોકો પણ કૌતુક જોવા એના ધર આગળ એકત્ર થયા. સ્વજનો લોજન કાર્યથી નિર્ધિત થયા કે તેમની સમક્ષ કોઈઓ લધ કેશવે સ્વમની જેયેલી ભૂમિ પ્રમાણે પોતાનું ધર ખોલવા માંડ્યું.

“‘અરે ! ચા તું શું કરે છે ?’’ સ્વજનોના પૂછવાથી કેશવ પોછ્યો.

માર્દ સારભૂત દ્રવ્ય આ ડેકાણે ગુમ પડેલું છે તેને તમારી સાક્ષીએ હું પ્રગટ કરું છું.” કેશવની વાણીથી ચમત્કૃત થયેલા સ્વજનો પોછ્યા. “તારું દ્રવ્ય અહીયાં કોણે સ્થાપન કરેલું છે ? ક્યારે સ્થાપેલું છે ?”

તે તો હું જાણુતો નથી. પણ અમુક ગામે મને સ્વમ્ભા આવેલું તેમાં મેં જોયું કે અહીયાં ધન છે તે ઉપરથી હું અહીયાં ખોલ્યામ કરી રહ્યો છું.” કેશવની વાણી સાંલળી સ્વજનોએ જાહેરું કે આ મહાભૂદ શિરોમણિ છે. એમ વિચારતા તેની ચેષ્ટા જોવા લાગ્યા. ધર આગળ એકઠા થયેલા લોકોએ તેની આ વાત જાણી ત્યારે માંહોમાંહે હાથ તાદી દેતા એની મશકરી કરવા લાગ્યા.

કેશવે પોતાના મડાનમાં ચારેકોર જોઈ નાખ્યું પણ કાંઈ નિકાયું નહિ. બધુંય મડાન જોકીને આક્યો તોય કાંઈ ન નિકળવાથી કપિલાએ પણ મારીની ખુફી ભરી એના માથા ઉપર નાખી ધિક્કારી કાઢ્યો. સ્વજન આગળ પણ લજનતુર થયેલો તે ખુખ હાંસીને પાત્ર થયો.

કપિલાએ આ ભૂર્ભ શિરોમણિ કેશવની મુર્ખતાથી કેશવને ગાળો કઈ ધર બહાર કાઢી ખુફ્યો. સ્વજનોએ હસેલો, તેમજ લોકોનું ખુખ વગોવાતો મરકરી કરતો એ કેશવ બદુક લારે હર્દશાને પ્રાપ્ત થયો. એ પ્રમાણે

કુમારે કેશવનું વૃત્તાંત કહ્યું તે સાંલળી સર્વે સીએઓ એની મૂર્ખતા પર ખડખડ હસી પડી.

પૃથ્વીચંદ્ર કુમાર એલયો, હે બરો! આ કેશવનું થરિન હાસ્યાસ્પદ છે કે નહિં; તે કહે. “બઢુક એલયો.” આ વૃત્તાંત જરૂર હાસ્ય કરનારું છે સ્વામિન! પણ એના જેવા શું બધા હશે કે?

## ૩

## પ્રિયાએને પ્રતિષેષધ

“હે બઢુક! તું કહે છે કે બધા જીયો શું આવાજ હોય છે તો સાંલળ.” બઢુક વિષણુના પ્રક્રિયા જવાબમાં પૃથ્વીચંદ્રકુમાર એલયો.

“આ સાંખારી જીવ કેશવ બઢુના જીવો છે. મોહનાં મુંઝાધ ગબેલો હોવાથી જ્ઞાનીની નજરમાં જડ, તેમજ કાર્યકાર્ય હિતાહિતના લાન વગરનો હોવાથી ચોરાસ્તી લાય જીવયોનિમાં લભી રહ્યો છે.

કેશવ જેમ કથિતાના આદેશથી સ્વર્ણભૂમિમાં થાં કુભાવા ગયો તેમ જીવ કર્મભરિણતિના વસા પડેલો તેના આદેશથી સ્વર્ણભૂમિ ઇથે મનુષ્યલવમાં આવ્યો. કેશવ જેમ સ્વર્ણભૂમિમાંથી મહેનત કરી સ્વર્ણ પેહા કર્યું તેન જીવે પણ અકાશ નિર્જરન વડે કરી કંઈક સુકૃત ઇથે કંચન ઉપાર્જન કર્યું. કેશવનું ધન ઈંદ્રજાલિકે ભાસા વડે કુન્યાની સાલથી બતાવી હયી લીધું તેમ જીવે મનુષ્ય જગતમાં ઉપાર્જન કરેલું સુકૃત ભાસામાં મોહિત શરીર વિષયમાં કુષ્ય બની અદારે પાખસ્થાનક આચરીને હારી હીધું. કેશવ જેમ ઇરીને સ્વર્ણ મેલવના દેશોહેશ કરવા જાગ્યો,

દેમ છુંબ પણ વિષયવિલાસમાં બધુ હાની નારક, તિર્યેશ  
આદિ યોનિઃપ અનેક દેશમાં જામણ કરવા લાગ્યો.

જામણ કરતાં કેશવ દેમ કોઈ ગામમાં ફલી સહિત  
ભાત આવા લાગ્યો દેમ છુંબને કોઈક ભવદ્દેપ ચામુનાં  
કર્મચાર્યનો મેલાપ થયો તેમણે તપુર્ણી ફલી સહિત  
આદનનું દાન કરાવવાથી-આપવાથી કાઈક સ્વર્ણથ થયો.

કેશવ દેમ મોદા વડલાના વૃક્ષ નીચે નિદા લેતાં  
સ્વમામાં રહોનો સભૂહ જેણો તેમ છુંબ પણ એ તપના  
પ્રભાવથી કોઈ મોદા કુળમાં-વનાદ્યના કુળમાં જન્મ  
ધ્યારણ કરે શક્તિનો દુઃખચોગ કરતો મોહર્ણી મદિરામાં  
મર્સ્ત અનેકો મેહનિદ્રામાં પ્રાણી જ્યો-ક્ષણ કર વિલા-  
સોમાં રાચી ગયો. આત્માનું લાન ભૂલી ગયો.

કેશવ દેમ કપિલનું સ્મરણ કરતો પોતાને ઘર ગયો  
દેમ છુંબ કર્મપરિણુતિને સંસારનો પ્રાણી મનુષ્ય-  
જીવમાં આવ્યો. કેશવ દેમ નાલ્હી હોવા છતાં પોતાના  
બરમાં લક્ષ્મીના અસ્તિત્વને માનતો ઘર આવી ઉંઘાર  
માલ લાવી આવામાં તેમજ સ્વજનોને જમાડવામાં આતંક  
આનવા લાગ્યો તેમ છુંબ હાથી, ઘોડા, રથ, સેવક,  
દાસ, દાસી, લંડાર, લૂમિના પાલનથી અભિત થયો  
હોવા છતાં પોતાને અનન્ય સુખી માને છે તેમજ હાડ,  
માંસ, રધિર અને મલમૂકની કયારી જેવી છતાં વહારથી  
મંતોહર એવી યુચ્યતીના સંગમાં જ્ઞાસક્ત થઈ રહે છે.

કામીજનની નર્કટાધનો તે કેશવની માદ્ક કાંદ પાર  
છે? હાડ, માંસ, રધિર અને સ્નાયુથી એંધારેલ સહા  
અસાર એવા કામીજનીના વડનોને કામીજનો શરેહ રહુના  
ચંદ્રમાની ઉપમા આપે છે.

**લાળ પહતા અને હર્ષિંદ્ર ચુક્ર તેમજ મલિનહંતવાણી**

કામિનીના અધરોધને કામીજનો અમૃત સમાન ગણે છે. તેમજ વિષયના લાલચુજનો કામિનીના હાડકાના હાંતને હાડમની કળી સમાન કદમ્બે છે. માંસના લોચા સમાન સ્ત્રીના સ્તનને લધુ એવા સુવર્ણકલશની ઉપમા આપે છે. હાડ, ચરણી અને માંસ ખુલ્લ ભૂજાઓને કમલહંડની ઉપમા આપે છે. હાડ, માંસખુલ્લ સથુલ જંધાને વિષયના લાલચુંચેા કેળના સ્થંભ સમાન ગણે છે. અદાંકારથી વિભૂષિત એવા કામિનીના ઘેણે કામુકજનો સુરસુંદરી-હૃવીની ઉપમાથી નવાજે છે. જ્ઞાનીને મન જે નારી નરા વૈરાગ્યના કારણભૂત છે, તે નારીને કામીજન જુદી જુદી દશ્ઠિથી નિહાળે છે.” પૃથ્વીચંડકુમારે કેશવ ઘડકનો ઉપનય લુચ સાથે સરખાવી બતાવ્યો.

કુમારનો ઉપહેશ સાંભળી એ રૂપવતીએના રૂપમદનો નીશો એસરી ગયો. વૈરાગ્યના રંગને ધારણ કરેનારી એ રમણીએ. વિચારવા લાગી. “અહો ! કુમારની વાણી સત્ય છે. અમારા સરખી સ્ત્રીએના અંગની શું લાલિત્ય છે ? જેવું અમારું અંગ હાડ માંસ અને દૃધિરથી વ્યાપે છે તેવું પુરુષનું પણ ! છતાંય આર્યાપુત્ર સ્ત્રીએના જ અંગની નિહા કેમ કરે છે ?”

પોતાની સ્ત્રીએને ગહેન વિચારમાં પડેલી જાણી કુમાર બોલ્યો. “પુરુષો જેમ સ્ત્રીએના અંગોપાંગને જોઈ મોહ્ન પામી જય છે તેવી રીતે સ્ત્રીએ પણ પુરુષોના મનો-હર અવયવો જોઈ આસક્ત થાય છે. છતાં એમાંય ઇતુધર્મ, દુઃખે કરી ગર્ભધારણ, દુઃખે કરી પ્રસૂતિ, અને કામની અતિ આસક્તિથી સ્ત્રીએ અધિક નિહાને પાત્ર છે. મોહ્ન-બ્લો લુચ શરીરઝી ધરમાં અસહ એવા વિષયસુખને જોઈ રાચે છે. કે કેશવ જેમ પોતાના ધરમાં અસહ એવા

રતો જોઈ રાખ્યો હતો, બાંધવોએ સમજાવવા છતાં કેશવ સમજયો નહિ તેમ બાંધવ સમાન સાંચર્જિકની શિખામણું છતાં જીવ સમજતો નથી. કેશવે બધું ઘર ઓદ્ડી નાખ્યું તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદારૂપી મકાન ઓદ્ડી નાખે તે કેશવની માફક બેચાબૃંધ થંડ લોકો વડે નિઃધાર્ય છે. ને કપિલાની માફક કર્મપરિણિતિથી જીવની કંધ ઓછી હીલના થતી નથી.

વિષયના પાપથી જીવ અનેક હુંખોને લોક્તા થાય છે, એવાં નિર્વિવેકી જનોનાં ચારિત્ર જોઈ કોણા ચિત્તને વૈરાગ્ય થતો નથી ? ” પૃથ્વીચંકુમારની વાણી સાંલળી સંસારની અસારતા ચિત્તવતી સંવેગના રંગે રંગાયેલી એ લાલનાએ ઓદ્ડી. “ હે સ્વામી ! તમે કહ્યું તે બધું સત્ય છે, સંસાર બધો એવોજ છે, સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચું જીવ પોતાને ભૂલી ગયો છે પણ હું એતો ત્યાગ શી રીતે કરવો ? ”

તમે સહયુક્તને આરાધી ધર્મસેવન કરો. ગુરુ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાણી હોય, મોક્ષના ઉધ્ભૂતી હોય.” કુમારે કહ્યું.

“હે પ્રભો ! અમને સહયોગ આપી વૈરાગ્ય પમાડનારા તમેજ અમારા ગુરુ છો અમે તમારી શુહિણી શાખદથી કૃતાર્થ થંડ હું એ અમારી લોગ તરફણા આપના ઉપરેશથી નાશ પામી છે. તો અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરો. હે આર્યપુત્ર ! તમારે પણ અનિથી પ્રદીપ એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તો તમને અમે વિશેષ શું કહુંયે ? તમે તો તત્ત્વના જાણુકાર છો.” સ્થીએનાં એ પ્રમાણેનાં વચ્ચે સાંલળી હર્ષિત થયેલો કુમાર ઓદ્ડો.

“તમે અત્યારે વિશેક્ષણ ધ૰્યત ઉપર આરું થયેલી હોવાથી હવે તમારે ધર્મ પ્રાપ્તિ હુલ્લાસ નથી. કે આસ્તિક - સમજિતિબંનું છે તેનું મનુષ્યપણું, સાર કુણી, ડંડાંથ પરિવાર, સમૃદ્ધિ આદિ સામચી સક્રય થાય છે. અર્થાત તે એ બધી સામચીનો સહઉપયોગ કરે છે અને મુક્તિ પણ તેને હુલ્લાસ નથી. હાલમાં તો ત્યાં સુધી તમે સાંતોષને ખરણું કરી નમસ્કારમંત્રનું સમરણ કરતી, જીવદ્યા પ્રાણવામાં પ્રાતિવાસી તેમજ સત્ત્વાલ્લી ઉચ્ચયરવા પૂર્વક ધર્મ આરાધન કરતાં છતાં વરમાં રહેણે કે જ્યાં લગી જુડુમહારાજનો બોળ પદમી ચોઅ ધર્મ આરાધવાનો અવસર પ્રાપ્ત ન થાય.”

પૃથ્વીચંદ્ર કુમારની વાખી એ બધી સ્ત્રીઓએ અંગી કાર કરી. યથારાક્ષિ ધર્મનું આરાધન કરતી સમય નિર્ગમન કરવા લાગી.

## ૪

## પૃથ્વીચંદ્ર રાજ.

વિષણુભદુક થકી સર્વે વૃત્તાંત જાણી રાજ પ્રેતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “અરે ! મેંતો કાર્યું હતું કે કુમારને ફરણુષવાથી સ્ત્રીઓના મોહમાં લખાઈ થાલાએ કશે પણ સ્ત્રીઓ તો આને કંઈ પણ વરા કરી સકી નહિ પરનું કુમારે સ્ત્રીઓને પ્રતિષ્ઠેાધી વૈરાગી ઘનાવી દીધી. હવે શું કરશું ?

“હાં ! એક ઉપાય છે રાજ્ય ઉપર સ્થાપન કરે, એ રાજ્યાર્થીમાં બ્યાં થવાથી ધર્મનો ત્યાગ કરશે.” રાજે એ પ્રમાણે વિચાર કરી પ્રેતાનો એ વિચાર પદ્દેવી - કુમારની માતાને કહી સંભળાવ્યો.

રાજાની વાત સાંલળી પદ્દેવી બોલી. “સ્વામી !

મને પણ અધ રાત્રીએ સ્વમ્ભ આબદુ કે આપે રાજભુટીથી કુમારને મોદા મહોત્સવ પૂર્વક રાજ્યગાઢી ઉપર સ્થાપન કર્યા. ત્યારે તે દેવતાની માડુક ત્યાંથી ડિ પ્રાસાદના આગ લાગ ઉપર ઘેડો ત્યારે આપે પોતાના હાથે તેને ત્યાંથી પાછા સિંહાસન પર ઘેસાડ્યો. ને હું જગત થઈ.”

પદ્ધરાઝીનાં વચન સાંભળી રાજ વિચારમાં પડ્યો. “મોદા ઉદ્યને સુચનાડાં આ સ્વમ છે તો હું વે આરો વિચાર અમલમાં મુકવા હે.” એટલામાં પ્રાતઃકાલ યવાથી પિતાના વરણમાં નમવાને કુમાર પૃથ્વીનિંદ આવ્યો. પિતાએ આસન આગ્ની તે ઉપર ઘેસાડ્યો. આસ્તેથી સામાન્ય કુમારને સાખળાવવા માંડયો.

“રાજકુમાર ! જેને ધેર તપાં જેવો ગુણવંત કુમાર છે એવા અમને ધન્ય છે. ઉદુભ્રરના પુષ્પની માડુક દુર્લભ એવા તને અમે મોદા પુષ્પથી-ગ્રેમથી બોધએ છીએ. હું પુત્ર ! તને જોઈને અમે રાજને રોજ મુખ ભુટી બધાએ છીએ કે જેવી રીતે શરીરને જોઈ સાગર હરખાય છે.

હું નંદન ! તું અમારી એક અભિલાષા પૂર્ણ કરે કે જેથી અમારા આનંદનો પાર ન રહે. તે જે અભિલાષા પૂર્ણ થવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. સાજની વાણી સાંભળી રાજકુમાર પિતાના વહન તરફ બોતો મનમાં વિચાર કરી રહ્યો હતો. “પિતાની શ્રી અભિલાષા હશે, શું રાજમુખની ?”

કુમારને વિચારવંત બાળી રાજએ આગળ ચલાયું. “કુમાર ! જે શ્વેત છત્ર, ચામર આદિ સમૃદ્ધિથી વિભૂ-વિત ગજરાજ ઉપર આડદ થચો છતો. સકુલ સેનાથી પ્રસ્વરેલો, તર્ફણીવર્યની સાથે રાજમાર્ગ વિહાર કરતો જ્યારે હું તને બોધશ ત્યારે મારા આત્માને હું ધન્ય

માનીશ-મારું જીવન સહી થયું માનીશ, તો આ રાજ્યનો સ્વીકાર કરી અમને સુખી કર." રાજની સ્નેહયુક્ત વાણી સાંલળી કુમાર વિચારમાં પડ્યો. "આ તો દીક્ષામાં મોટી ઝાંસ ઉલ્લિ થધ."

"અરે! વિષય વિકાર રહિત એવા વૈરાગ્યવંતને રાજ્યમાટ્ઠ એ અસંભવિત-વિરુદ્ધ વાત છે. કેમકે દક્ષિણ હિસા તરફ ગમન કરનાર શું હિમવંતગિરિ પહોંચી શકે છે? તો આવા વિષમ સંઘોરામાં મારે શું કરવું?"

ધણા સ્નેહયુક્તા માતાપિતાનો એ અનુગ્રહ છે અને એ અનુગ્રહનો ઉપાય પણ ખુખું હુર્લાલ-હુંએ કરી કરી શકાય છે, છતાં વિચક્ષણ જનોએ માતાપિતાની આજ્ઞા ઉદ્ઘાંધન કરવી જોઈએ નહિ.

લેકે હું પણ માત્ર શુરૂના આવાગમનની માર્ગપ્રતીક્ષા કરી રહ્યો છું તો તે સમય હરમિયાન પિતાનું વચ્ચન લખે પ્રમાણ થાઓ, શુરૂના આગમન પછી મને જેમ યોગ્ય લાગશે તેમ કરીશ."

ખુખું ડાહુપણનો વિચાર કરી કુમારે કહ્યું. "પિતાજ! આપની આજ્ઞાનો હું સ્વીકાર કરું છું. પણ મારા જેવા કાયર પુરુષો રાજ્યભાર ઉપાડવા સમર્થ થતા નથી. છતાં આપનો આહેશ મારે પ્રમાણ છે."

કુમારની વાણી સાંલળી. "શું વિનયવાન છે. તારા જેવા પુત્રોથી રાજન્યાના યશ ઉજવલ છે." એમ યોલતા રાજને કુમારના ભસ્તક ઉપર પોતાનો હાથ સુકી સહાર કરી તેની પ્રશ્નાંસા કરી.

તે પછી સારા મુહૂર્તે રાજને પૃથ્વીચંદ્ર કુમારનો રાજ્યાલિષેક કર્યો. તે નિમિત્તે રાજને મોટા મહોત્સવ આરંભ્યો. આખાય નગરમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો.

સિંહાસનાઝદ નવા રાજને મંત્રી, સામંત આદિ મોટા મોટા રાજપુરુષો લેટણું વરી નમ્યા, નવા રાજ પૃથ્વીચંદ્રને જોઈ એમના ભાતા પિતા પણ અતિ હુદ્દ-વંત થયા.

પિતાની આજાથી કુચિષ્ઠા નહિ છતાં રાજયાઝદ થયેલા રાજ પૃથ્વીચંદ્ર રાજ્યલક્ષ્મીમાં અનાસક્ત પણે રાજ્યનું પાલન કરવા લાગ્યા. નવા રાજએ પોતાના રાજ્યમાં હિંસાનાં સાધન બંધ કરાવી અમારી પ્રવત્તાવી, ખોટા કર માડે કર્યા. કેહીએને કારાવાસમાંથી સુક્ત કરી સર્વત્ર રાજ્યમાં શાંતિ પ્રસરાવી. રાજની મારુક રાજ્યની પ્રજા પણ વિકથા-કુથદી છાડી નીરંતર ધર્મકથા કરવા લાગી. જૈનશાસનની શોભા વૃદ્ધિ પામે તેવાં અનેક કાર્યો થયાં. પ્રજાએ પણ રાજના માર્ગને અતુસરી ‘યથા રાજ તથા પ્રજા’એ જગતની કહેવત સાચી પાડી. એવી રીતે ધર્મભ્ય રાજ્યને કરનારા પૃથ્વીચંદ્ર નરપતિ એકદા રાજ્યસિંહાસન ઉપર ઘેઠા હતા, તારે દ્વારપાલે આવી નમસ્કાર પૂર્વક વિનંતિ કરી. “હેવ ! આપના દર્શનનો અભિલાષી સુધનનામે બ્રેધી-સાર્થવાહ હાથમાં ઉપહાર લઈ દ્વાર આગળ ઉલો ઉલો સલામાં પ્રવેશ કરવાની રજ માગે છે.”

પ્રતિહારીની વાણી સાંભળી રાજએ તેને પ્રવેશ કરવા માટે આજા ફરમાવી. રાજની આજા પામી દ્વારપાણ ચાહ્યો ગયો.

પ્રકુદ્ધિત વહનવાળો સુધન બ્રેધી હાથમાં લેટણું સાથે રાજસભામાં પ્રવેશકરી, રાજ આગળ લેટણું મૂકી, પ્રણામ કરી એ હાથ જોઈ આગળ ઉલો રહ્યો.

રાજએ એનું સન્માન કરી પૂછ્યું. “કુચાંથી આવો છો ? રાજસભામાં કેમ આવ્યા છો ? શું કંધ નવીન સમાચાર લાવ્યા છો ?”

રાજનાં વચન સાંભળી ક્રેષ્ટી ઓલદ્યો, “હેઠ ! ભારત  
નગરમાં આક્ષર્યને કરતાડં એક ઉતામ ચારિત્ર બેધ વિરભા  
યથી માડં હૃદય ફાટી જતું હેઠ તેવી દીતે હું તેને કહેવા  
પણ સમર્થ નથી, તો પણ આપના દર્શાનનો અલિલાપી ને  
એ ઉતામ ચારિત્રનો વિચાર કરતો હું અહીંયાં આવ્યો છું  
મહારાજ ! જો કે એ સર્વેને કહેવા તો અસમર્થ છું છતા  
હું એમાંથી સારભૂત કંઈક તત્ત્વને કહીશા.”

સુધન સાર્થવાહની વાણી સાંભળી રાજ સહિત ખાંડી  
સલાને કંઈક નવાઈ લાગી. ‘અરે ! કેવું હશે એનું એ  
ઉતામ ચારિત્ર ?’

રાજએ પ્રિયથી કહું. “તમે જે ચારિત્ર જેવું તે  
અહીંયાં આ સજસલા આગળ કહો.”

“એ ચારિત્ર અવશ્ય આપની આગળ કહીશા, હેઠ !  
જેવું એ અદ્ભુત અમારા નાગરમાં ઘન્યું છે, તેવુંજ ફીજું  
અદ્ભુત આક્ષર્ય અહીંયાં ઘનવાસું છે સ્વામી !”

સુધનની વાત સાંભળી અવા નવાઈ પામ્બા, ને  
રાજએ પૂછ્યું “હે ક્રેષ્ટી ! એ કેવુંક અદ્ભુત છે તે કહો !”

રાજની આજ્ઞાથી સુધન ક્રેષ્ટીએ તે અદ્ભુત ચારિત્ર  
શરૂ કર્યું.

## ૫

### ગુણુગ્રામ

“આ લરતાર્ધમાં કુદ્રદેશને વિષે ધનવાન્યથી લર-  
પુર, સુખી અને સમૃદ્ધ એવું હસ્તિનાપુર-ગજપુર નામે  
નગર આવેલું છે. એ નગરનો હું સહેવાસી હોવાથી અમારા  
નગરમાં ઘનેલું એ કૌતુક હવે સાંભળો, કારણ કે જે કૌતુક  
સાંભળવાથી અવ્યાળવોને યોધ થાય ને વૈરાગ્ય પામે એ.  
કૌતુક પણ મહાન અને ઉદ્ધાર સમજવું.

એ જગતુરમાં અનેક રલોનો સંચય કરેનરસે નામ અમાણે ગુણુદ્ધાળો રલસંચય નાથે ક્રેષ્ટી રહેતો હતો તેને સતીઓમાં શિરોમણિ અને સારા લક્ષણ વડે ઝુલ્લ સુખ-ગલા નામે પલ્લી હતી. અને એક બીજાને ચેરાય હોવાથી સુખી, સંતોષી હવાં, ભાઘની અનુરૂપતાથી આ યુગદે પ્રેતનો કેદ્દોક કાળ સુખમાં પસાર કર્યો. ત્યારે તેમને ત્ત્વાં લક્ષ્મીને ચેરાય એવા એક લાઘ્યવંત પુત્રનો જન્મ થયે. એ નરીબ્રચણ સભ્રદ્વયાન પુત્રના અદ્ભુત ભાગને જોઈ પ્રેસન્ન થયેલા ક્રેષ્ટીએ નગરમાં આશ્રમ્યકારી જન્મ મહેતસવ ડર્યો. ગર્ભ ધારણ સમગે માતાએ સ્વભાવમાં શ્રેષ્ઠ એવા સાગરનું પાન કરેલું હોવાથી એ સ્વભાવી સૂચિત માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું ચુલ્લસાગર.

પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરતો ગુણુસાગર બૃદ્ધ પામવા લાગ્યો. માતાપિતાને પોતાની કાદી લાપામાં આનંદ પમારતો તેમજ નગરની નારીઓથી રમાડાતો. ગુણુસાગર કલા અસ્યાસને કરતો સ્ત્રીજનને પ્રિય એવા યૌવનમાં આવ્યો. સભ્રદ્વૈ સુંદર ગુણુસાગર નવીન યૌવન વયમાં તે અધિક સ્વદ્વયાન-તેજસ્વી થયો. નગરની ધાળા શું કે તરણી શું. ફરેક યુવતીએ ગુણુસાગરને સ્નેહની નજરે જોવા લાગી. તો મણ કાળથી કમલ જેમ અલિમ્બ કરે તેમ ગુણુસાગર ક્રેતીની દૃષ્ટિભી બાણથી તુવાનીમાં અણ જીવાયો નહિ.

એક દિવસે એ ગુણુસાગરને તે નમરના રહેવાસી એક અધીનોની ગુણુસુંદરીએની આહિ આપઠ કન્યાઓમે બાર્ધિકાં જરાં જોગ્યો, પોતાના મિત્રની સાથે જરા ગુણુસાગરને એપ તેમની ભનેહદર શારીરકાંતિકા મોહ પામેલી એ આહે કન્યાઓની દાઢિ ત્યાંજ ગુણુસાગરમાં સ્થાંલી જાડ. “જા-

તમાં સ્થોભાને જો આવો પતિ ન મલે તો એમનો અવતાર એળો ગયો સમજવો આપણે પણ પરણશું તો આ નવજવાનને, નહીં તો અન્નિ શરણ, પણ અન્ય વરને વરણું નહિએ.”

એ આડે કન્યાના માતા પિતાએ કન્યાનો નિશ્ચય જાણો પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓનો નિશ્ચય રતનસંચય શ્રેષ્ઠીને જણાવ્યો, એ શ્રેષ્ઠીઓની વિનંતી રતનસંચય શેડે સ્વીકારી લીધી ને આડે કન્યાએ સાથે વિવાહ નક્કી થયા.

પોતાના વિશાળ અને રમણીય મહાલયની અચારીયે ઉલ્લો ઉલ્લો ગુણુસાગર કુમાર ત્યાર પણીના એક હિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે તપથી કૃશાયેલા એક મુનિને ગોચરી અર્થે નગરમાં ભ્રમણું કરતા જોઈ ગુણુસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાંજ સ્થળભી ગઢ. “આ મુનિનો વેપ કેવો આનંદકારી છે, ભૂમિ તરફ દાખિને સ્થાપન કરતા તેઓ ઈદિયાને ગોપની મંદ ગતિએ કેવા ગમન કરી રહ્યા છે? આવું મુનિપણ મેં પણ કયાંક અનુભવેલું છે.” મુનિને જોઈ વિચાર કરતો ગુણુસાગર ત્યાંજ એકદમ મૂર્ચિત થધ ગયો.

માતાપિતાહિક પરિવાર જટ હોડી આવી મૂર્છા વાળાના અનેક પ્રયત્ન કરવા લાગ્યો, કોઈ શિતલ જલથી સિંચન કરવા લાગ્યા, કોઈ વીજણા વડે પવન નાખવા લાગ્યા, એવી રીતે અનેક ઉપયાર વડે જ્યારે ગુણુસાગર સ્વસ્થ થયો ત્યારે હુંભી થયેલા તેના પિતાએ પૂછ્યું. “હું પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું? નગરમાં વિહાર કરતી કોઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને મૂર્છાં આવી કે શું? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને

જોઈ તારી આ હાલત થઈ? તારા હૃદયમાં જે થણું હોય તે  
કહે તો અદ્ય સમયમાં જ તે તને મેળવી આપું.”

પિતાની વાણી સાંલળી કુમાર-ગુણસાગર ઓદ્યો.  
“પિતાજ! એવી મોહની રમતમાં ભને કંઈ મજાહ નથી  
આવતી. સ્થીયાદિકના વિષયલોગને તો હું રોગોની માર્ક  
જાણું છું. જેથી માર્ઝ મન તેમાં રમતું નથી કારણ કે ભવાં-  
તરમાં દેવગતિમાં મેં દેવલોકનાં સુખ સારી પેડે લોગવ્યાં  
છતાં લુધને તૃપ્તિ થઈ નહ્યો. તો મતુષ્યના આ તુચ્છ લોગોથી  
લુધને તૃપ્તિ શી રીતે થશે?

અત્યારે તો માર્ઝ મન દેવના લોગોમાં પણ પ્રીતિ  
ધારણ કરતું નથી તો બીલત્સ એવા મતુષ્યોના લોગોની  
તે વાત શી? જેને અમૃતનાં પાન કરવાની પણ હંચા  
થતી નથી તે શું વિષ પાન કરે કે? છતાં પણ હે પિતાજ!  
તમે જો મારા મનોરથ પૂર્ણ કરવાને પ્રસન્ન થયા હો તો  
ભને અમણપણું અંગીકાર કરવાની રજા આપો. કારણ કે  
અર્ઝામાં-ગોખમાં ઉલેલા ભને મુનિર્દર્શનથી પૂર્વભાવમાં  
ચારિત્ર પાળેલું યાદ આવ્યું.” સાવધ થયેલા ગુણસાગરે  
અતિસમરણ જ્ઞાનની પોતાનો પૂર્વભાવ જાણી પિતાની પાસે  
કીક્ષા લેવાની રજા માગી.

પુત્રની વાત સાંલળી કંઈક જ્ઞાનિ પામીને શ્રેષ્ઠી  
ઓદ્યો. “પુત્ર! આ નવીન તાર્થયમાં અત્યારે તારે દીક્ષાનો  
સમય નથી. કારણ કે પહીલોએ અનુકૂળે કરી વણે વર્ગ  
સાધવાની આજા ફરમાવેલી છે તે પ્રમાણે પહેલી અવ-  
સ્થામાં વિદ્યાલ્યાસ કરવો ને બીજી વર્ષમાં વન ઉપાર્જન  
કરી ગૃહસ્થધર્મનું આરાધન કરવું અને ધર્મ તો ત્રીજી  
અવસ્થામાં સેવવો કર્યો છે.

હે પુત્ર! તારે પણ બુક્તી લોગી થઈ ત્રીજી અવ-

સેથામાં ધર્મ સાધન કરવું શેષ છે, માટે અત્યારે તારે ધર્મસાધનનો વિચાર કરવો નહિ.

પિતાનાં ચચન સાંસારી પુત્ર બોલ્યો, “પિતાજ ! ધર્મશક્તિ જ સુખ થાય છે. બણાકુલ રૂપીંત લોગવેલા અર્થી આતે કામથી તો કુલ ભાગ જ પેઢા થાય છે.

હુ પિતાજ ! અત્યારે આજયેંત પડુ સમાદિક ને લોળન કર્યાં તે કો એકવ કરી લગ્યો કરવામાં આવે તો પ્રદીપ પણ અધિક થઈ જાય, આજ સુધીઓં ને જળનું પાન કરેલું તે એકદું કરતાં સાગરના મારાર છાંકાઈ જાય, કે ઝોણોનો આહાર કરેલો છે તે અથાં કો એકવ કરીયે તો સમય વૃક્ષ ઉપર પણ જમાઈ શકે નહિ, આ સંસારમાં એવા કોઈ લોગો નથી કે કે લોગે આ જીવ અનંતીવાર ન લોગવ્યા હોય, તો પણ એવા લોગેથી રંકને સ્વમાભાં મળેલા રાન્યની જેમ જીવને રૂપી થઈ નહિ. ભૂતકાળમાં એ અંતાં લોગવેલાં સુણ્યો આ ભવમાં જીવને પ્રાયઃ સ્વમાની માર્ક થઈ જાય છે. જેથી જીવની જીવસા રૂપી પામતી નથી. માટે એવા ભોગોભાં ન લાગાતાં હુ પિતા ! એવિ ખર્મા, મોહમાં સુંઘાંસો નહિ. એ ભોગને લોગવવા છતાં સર્તોષ થતો નથી. સુદ્ધિઓં રક્ત વિદેશીજનો બોઝને માટે ફંડી ધર્મ કરતા નથી. અને એ સુદ્ધિની વરમાળ પણ સ્તરપરો બન વિના પ્રાપ્ત અતી નથી. તો આપ સમજુ અને વિદેશી થઈ મને એમાં વિજી કરુશો નહિ. આ સવસાયરાંને જામણ કરવાથી શરીર શેષોનો હુ હુવે જરૂર દીક્ષા લઈશ.

પુત્રનો દીક્ષાનો નિશ્ચય જાણી પિતા સેનસેન્ય ઝોડ મૌન થઈ ગયો. જ્યારે તેનો ઝંડું પણ ઉપાય રદ્દો નહિ ત્યારે એની માતા ઝણ કરતી પુત્રની ખાસે આવી કહેવા

લાગી. “હે વત્સ ! તારા એવા વિનયવાન પુત્ર માટે અમારા કંઈ કંઈ મનોરથો હતા જે આજે પ્રતિકૂળ વાયુ વડે તું નિષ્કળ કરીશ નહિં, તારા વગર પાકેલા ક્લની માઝું મારં હૃદય રાણી જશે. તો હે કુમાર ! જરાવડે જર્જરીલૂત થયેલા એવા અમારં તું પાલન કર, ને અમારા મૃત્યુ પછી તું તારી ઈચ્છા પૂર્ણ કરજો.”

માતાનાં વચન સાંલળી શુષ્પસાગર બોલ્યો, “મોહને આવિન થયેલા તમે જે વાત કરી તે હીક છે છતાં મૃત્યુનો કંઈ કમ નથી, કચારેક એ બાળકને હુણી ને વૃજુનું રક્ષણું કરે છે. મૃત્યુ તે કોધનું ભિત્ર થયું છે વાર ! જે એમ જાણે કે મૃત્યુ એનું ભિત્ર છે અથવા પૈતે પૈતાને અમર માનતો હોય તે જ સંયમને વિષે પ્રમાદ કરે છે, હું એવો ન હોવાથી માતા ! હું તો અવરય સંયમને આદરીશ, આ અસાર સંસારમાં લ્યો અનંતીવાર પુત્રપણાને પામે છે, અનંતીવાર માતાપણાને કે પિતાપણે ઉમજ થાય છે, કર્મને આવિન સ્થિતિવાળા લ્યો સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભિત્ર, ભગિની આધ, શત્રુ, કે સ્નેહીપણે ઉમજ થાય છે એવા સંસાર સ્વરૂપનો વિચાર કરનારી હે માતા ! તું મારે માટે ઐહ શું કરવા કરે છે ? જે હું જ તને છણ છું તો મરણથી લય પામેલા મને દીક્ષા લેતાં તારે અટકાવવો નહિં. અંધ કુવામાંથી કે અભિમાંથી, સસુદમાંથી કે રોગ, શોક અથવા દારિદ્રથી બહાર નિકળતા અને મુક્તિની રાન્યલક્ષમીને ઉમજ કરતા પુત્રને કચી માતા અટકાવી શકે ? માટે હે માતા ! લવસાગરમાંથી બહાર નિકળતા એવા મને તું રણ આપ. સંસારે તરવા માટે તું મને સહીય કરનારી થા, માતા !”

૬

### શુભલગ્ન સાવધાન

ગુણસાગરનું વચન સાંલળી પુત્રને સમજાવતી માતા બોલી, “હે વત્સ ! જરી તારી પોતાની તરફ તો જો ! કોમળ અંગવાળો અને નવીન તારણ્યના ઉદ્ઘયવાળો તું દીક્ષા અહેણ કરી પ્રતોનાં કષ્ટ શી રીતે સહન કરીશ ? પુત્ર ! ચારિન તો હાલ્યાલુ-દુખુર છે ત્યારે તું અસમર્થ આળક સુકુમાર છે માટે ગુહસ્થ વર્મ સુએ આરાધન કરો, તને વિશેષ શું સમજાવું ?”

માતાનાં કોમળ અને લીલા વચન સાંલળી જતિ-સ્મરણ જ્ઞાનથી પોતાના લવોની પરંપરા જાણુનાર ગુણસાગર મુખ મરકાવતો ઓદ્ધો. “માતા ! આ લુંબે દુનિયામાં અનંતીવાર મહાન કષ્ટ સહન કર્યાં છે. પૂર્વે મેં નરકને વિષે વૈતરણીનાં દુઃખ લોગવ્યાં છે. શાદમલી વૃક્ષનાં કરેવત સમાન પત્રથી વીંધાઈ રહ્યો હતો, તપેલી વાલુકા-ઝીતીમાં મને પરમાધારીઓએ ચલાવ્યો હતો. કુંલી-પાકમાં અમિની ભડીની ક્રેમ વારંવાર પકાયો છું. વારંવાર નરકમાં શુલિકા પર ચઢ્યો છું. કરેવતથી પરમાધારી વડે વારંવાર છેદન લેદન કરાયો છું, ત્યાં ભાલા અને તલવારવડે છેદાઈ રહ્યો હતો, મુદ્ઘરના મારથી ત્રાયિત્રાય પોકારી રહ્યો હતો, અસિવનમાં અભણ કરતાં થાન આહિકનો શિકાર-ખોરાક થર્થ રહ્યો હતો. એવાં અસંખ્ય દુઃખો નરકમાં લોગવી રહ્યો હતો. અને તેય કેદોં બધો. કાળ ? સાગરોપમનાં સાગરોપમ સુધી એ બધાં દુઃખો મેં વારંવાર લોગવ્યાં, માતા !

તિર્યંચ લવમાં અગ્રહનો અવતાર ધારણ કરી અતિ-

ભાર ભરેલા ગાડામાં જોડાયો, એતીને માટે હળ લઈ ગળ ઉપરાંત વૈતર કર્યું. ને ઉપરથી ચાખુક, પરોણાના માર સહન કર્યા. ભૂખ, તરસ, તાપ, દાઢ આહિ મેં સહન કર્યા. હાથી, ચાડા, ગાય, લેંસાહિક ફરેક ભવમાં એવાં અનંતીવાર હુંઘો સહન કર્યા, માતા ! પરાધિનપણે હુંઘો સહન કર્યાનો કંધ પાર નથી. એવાં તે કેલાં હુંઘો વર્ષાવું, માતા !”

મનુષ્ય ભવનાય હુંઘો કંધ ઓછાં છે ? માતા ! પ્રથમ તો ગર્ભાવસ્થાનાં હુંઘ કંધ જેવાં તેવાં નથી. તે પણ જન્મ, જરા, શોક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અનિષ્ટનો સંયોગ અને ધંધનો વિયોગ તેમજ શરીર સંખ્યા અને મન સંખ્યા હુંઘો અનેકવાર લેણાવ્યાં એ બધાં હુંઘાને સંભારતો સુખને માટે સાહુપણું અંગીકાર કર્યું. તો એમાં ઘોડું શું માતા ! એ બધાંથી સંસાર જન્ય હુંઘો આગળ સુનિપણાનાં સ્વાધિનતાપૂર્વક લેણવાતા કષ એ તે કંઈ હુંઘ કહેવાય માતા !” ગુણસાગરે લખાયું વર્ષાન કરી પોતાની ભક્તમતા જહેર કરી.

પુત્રનો નિશ્ચય જાણી એની માતા આશીયાળી થઈ ગઈ, ગદગદ કંઠવાળી થઈ પુત્રના વરણ પકડી પોલી. “દિકરા ! તારો નિશ્ચય અપૂર્વ છે, મારી આટાએલી કાકલુદી છતાં તારા નિશ્ચયમાં ફેરક પડતો નથી તો જેવી હૈવની મરણ ! મારા જેવી સત્ત્વ વગરની તારી માતાને તું કંઈક અવલંબન તો આપ, મારી એક વાત તું માન્ય કર, તારા વિવાહને માટે કે કન્યાએ આવેલી છે તેમની સ્થાય વિવાહ કાર્ય કરી મને વહુએનાં ભૂખ ઘતાવ. તને પરણુંલો જેઠ કૃતાર્થ થયેલી હું તને અનુમતિ આપીશા.” માતાની એ જોહ ઘેલણા જાણી પુત્ર પોલ્યો. “પરણુંને હું તરતજ દીક્ષા અંગીકાર કરનાર હોવાથી

એવાં લમ્બથી લાલ શું? છતાં પણ હે માતા! તું મારે માન્ય છો જેથી તારં એ વચ્ચેન હું અંગીકાર કરું છું; કન્યાએ સાથે લમ કરી તારી છંછા પૂર્ણ થયા ખાડ તારે મને ભીજુ કોઈ કારણ બતાવી અદ્વાવવો નહિ. કારણુંકે પ્રતાઙ્ગણ કરેવાના નિશ્ચયવાળો હું પ્રતને તો જરૂર અહુણ કરીશ અને તેથી જ કન્યાના માતાપિતાને પણ મારી દીક્ષાની વાત જણાવવી. જેથો તેમને ઠગાવાપણું રહે નહિ,” પુત્રે માતાની વિનાંતિ માન્ય કરી.

રતસંચય શેડ કન્યાના પિતાએને પોતાના મકને તેડાવી તેમને સૃપણ વાત જણાવી દીધી, “શેડ! આપણે પ્રથમ વિવાહ સંખ્યાંધી વાતચિત થતાં જે સાડુ મેં કણુલ કર્યું છે તે વાત જો કે સત્ય છે તથાપિ એક વાત તમે સાંભળો, લમ થયા પણ તરતજ મારો પુત્ર દીક્ષા અહુણ કરશો માટે જો તમારી છંછા હોય તો લમ કરો યા તો વિવાહ તોડી નાઓ.”

શેડની આ વાત સાંભળી બધા વિચારમાં પરી ગયા, જો કોઈ પોતપોતાને બેર આવી પોતપોતાની કન્યાને પૂછવા લાગ્યા. તે સમયે કન્યાએ પોતાનો નિશ્ચય કહી સંભળાવ્યો. કન્યા એકજવાર અપાય છે, એ વાર નહિ. માટે તાકાઈ વિવાહ કરી નાઓ. અમે પણ એની ગૃહિણી-સ્ત્રી શખ્દથી સર્કળતા માની એની સાથે સંયમ આપરશું. જો તમે કદાઅહ રાખી લમ નહિ કરશો. તો પરણ્યા વગર પણ અમે તેની પાછળ દીક્ષા અહુણ કરશું. એ અમારો નિશ્ચય છે” કન્યાએ પણ પોતાનો નિશ્ચય સંભળાવી માતાપિતાને ચેતવી દીધા.

માતાપિતાએ રાણ થઈ રતસંચય શ્રેણીને એ સમાચાર જણાવ્યા ને વિવાહની તૈયારી થઈ ગઈ, કુલાચારે

પ્રમાણે ગુણસાગર કુમાર મોટા આડંખરપૂર્વક પરણવાને આવ્યો જ્યારે કુમાર તોરણે આવી ઉલેલા રહ્યો ત્યારે મંગલ-મય વાહિન વાગવા લાગ્યા, સૌભાગ્યવંતીએ મંગળ ગીતગાવા લાગી. ભાઈચારણે બિઝદાવલી ઘોલવા લાગ્યા. હાન, માનવડે લોકોનો સતકાર કરાતો હતો, કન્યા અને વરપક્ષના કુદુંભીજનો જ્યારે ભાલ્ય વિવાહકાર્યના આનંદમાં મશગુલ હતા, અન્ય લોકો પણ વરઘોડાના આનંદની મોજ મેળવી રહ્યા હતા ત્યારે તોરણે પોંખવાને ઉલેલો વરરાજ ગુણસાગર જુદાજ વિચારોમાં મશગુલ હતો વિવાહની સામચીને લોકો જ્યારે ભાલ્ય દર્શિથી જોતા હતા ત્યારે ગુણસાગર અંતર્દિષ્ટી તેની તુલના કરવા લાગ્યો.

“એરે આ અને ભાજુના વૈવાહિક પુરુષોના નામ સાર્થક છે. વૈકહેતાં નિશ્ચય અને વાહિકા: વાહનાતુ સંસાર સાગરે પાતનાતુ વાહિકા: એ રીતે વૈવાહિકા શાળદ થયો. સોપારીના આરોપણ વડે તેઓ પુણ્યને વિષે પાપનું આરોપણ કરે છે. શરાવ સંયુક્તના ભાગવા વડે હવે તારોથી ધર્મ સાધી શકાશે નહિ એ ધર્મને તું અત્યારથી જ હવે ભાગી નાખે છે, એ સૂચવે છે. શોરીથી પોંખવા વડે હવે તારે શૃહસ્થધર્મ ચલાવવા માટે જીવહિસા કરવી પડશે. સુશલથી પોંખવા વડે તારે હવે આ સુશલની માર્ક સંસારમાં જીવાને આંડવા પડશે. ધોંસદ-યુગ વડે કરીને આજથી આ નારીઓએ જેતરું તારે ગળે વળે છે તે તારે સહન કરવું પડશે અને તકલીથી સૂચવે છે કે તારે હવે કર્મદીપી સૂત્રને કાંતી એકડાં કરવા પડશે.-પાપના ભારથી ભારે થવું પડશે.

માયરામાં પ્રવેશ કરતાં એમ સૂચવે છે કે આજથી

તું હવે માયારૂપી વૃહમાં એડા છે. સ્વી એ માયાનું માદિર છે. ચોરીમાં બેસી જે વેહિકા પછવારે ચારવાર કેરા કરવા પડે છે તે કહે કે સ્વીરૂપી માયાવૃહમાં પ્રવેશ કરવાથી તારે ચારે ગતિમાં ભ્રમણ કરવું પડશે. રાત્રીને વિષે સર્વ સમક્ષ એક બીજા કંસાર ખવડાવે છે તે શું સુચયે છે. નારીના સમાગમમાં આવી હે જીવ ! તું આજથી લાજ અને કુલાચાર બધું ગુમાવી એડા.

આનણ કહે છે કે પુણ્યાહં, પુણ્યાહં, સાવધાન, સાવધાન, એ શું કહે છે ? એ કહે છે કે આજ સુધી તારો પુણ્યનો દ્વિસ હતો. હુદેથી તારે પાપહિન આવવાનો છે માટે સાવધાન-હળ પણ સમય છે માટે ભાગીજા, નાશી-શુદ્ધ. આ બધું સમજવવા છતાં મૂર્ખ જીવ સમજતો નથી ત્યારે વરમાળા વરના ગળામાં નાખી તેને સંસારને વિષે પાડવામાં આવે છે. એવી એ વિવાહ વિધિ સાક્ષાત् વિડાનારૂપ હોવા છતાં ભારે કર્મલિખ તેનો કાંઈ પણ પરમાર્થ સમજી શકતો નથી. પણ રાજુ થાય છે. કર્મથી લેપાય છે.

અંતર્દિષ્ટથી વિચાર કરતા ગુણુસાગરને વિવાહ વિધિ એ રીતે સમાસ થઇ ગયો. વિવાહ કાર્ય મૂર્ખ થયા બાદ હજાર પુરુષો વહેન કરે તેવી શિથિકામાં આડ કન્યાએ સાથે આરૂપ થયો. સ્વજન પરિવારની સાથે મંગળમય વાહિનોથી સત્કાર કરાતો તેમજ સૌલાંઘ્યવંતી સત્ત્રીઓથી સ્તુતિ કરાતો ગુણુસાગર પોતાના ભડકાન તરફ ચાદ્યો. પુત્રના લમ્બથી માતા પિતાના હર્ષનોતે કાંઈ પાર નહોતો.

૭

ગુણુસાગરને કૈવલ્યજ્ઞાન થાય છે.

આડ કન્યાથી શોભતા વરરાજના લાભની પ્રશાંસા

કરતા કેટલાક ગુણસાગરને વખાણતા હતા. કેટલાક કહેવા લાગ્યા કે રતિના ઇપને જીતનારી આડે કન્યાઓનો ત્વાગ કરી ગુણસાગર દીક્ષા અહણું કરશે. એવા એના વ્યાતમાને ધન્ય છે. ત્યારે કેટલાક કહેતા કે દીક્ષા લેવાને ઉત્સુક થચેલા ગુણસાગરને માતા પિતાએ કન્યારૂપી બેડીઓ પહેરાવી દીધી કે જેથી પ્રત લેવા તે હવે તૈયાર થશે જ નહિ. કેટલાક કહેવા લાગ્યા કે આ મૂઠ સત્ત્રીઓ-કન્યાઓ શું જાણુંને આ વૈરાગ્યવાન સાથે પરણું હશે. સુવર્ણની છુરી શું કંઈ ઐએ ઉપર ભરાય છે ? એવી રીતે લિન્નલિન્ન નારી-ઓનાં વચનને સાંભળતો ગુણસાગર પ્રિયાઓ સાથે પોતાના મકાને વ્યાઘ્યો.

પોતાના વિશાળ મકાનમાં ભદ્રાસન ઉપર ગુણસાગરને બેસાડી આજુ બાજુ તેની માતા તથા પિતાદિક પરિવાર બેઠો. કુમારની પાસે એની સત્ત્રીઓ-નવીન પત્નીઓ બેઠી. તે પછી એ વરરાજ આગળ વીણાના તાર સાથે પોતાના કંઠને મેળવતી તેમજ ચરણના ઠપકા પડે મનને રંજન કરતી પણ્યાંગનાઓ અદ્ભૂત નૃત્ય કરવા લાગી.

અધો પરિવાર જ્યારે એ અદ્ભૂત નાટક જોવામાં સાવન્નાન હતો ત્યારે તરતનો પરણેલો ગુણસાગર શું વિચાર કરતો હતો ? બાહ્યથી સંસારના બંધનમાં બંધાયેલો ગુણસાગર તો સમતારસમાં લીન થયો છતો સંસારની અસારતા ચિંતવતો હતો. “અરે ! ભવરૂપી વૃક્ષનું મૂળ આ સ્ત્રીઓ જ છે, એનો સમાગમ કરવાથી પુત્રાદિક સંતતિ ઉત્પન્ન થાય છે. એ કુદુંખના પરિવાર માટે જીવને પાપ રૂપી આજુવિકા કરવી પડે છે. એવી સ્વાર્થ પુરતો જ સ્નેહ દર્શાવનારી વિરક્ત સ્ત્રીઓની કોણું ડાઢો માણસ ધર્ઘા કરે ? રાગી ઉપર પણ વૈરાગી થતાં આ સ્ત્રીઓને

વાર લાગતી નથી તો હું તો વૈરાગી ઉપર નિરંતર રાગ-વાદી એવી મુક્તિ ઇથી કન્યાની જ હવે પ્રાર્થના કરીશ.

“માતાની અભિલાષા પૂર્ણ થવાથી હવે પ્રાતઃકાલે હું ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરીશ. ગુરુનો વિનય-વૈયાવર્ય કરીશ. જ્ઞાન, ધ્યાનમાં સાવધાન રહી ભવસાગર તરી પાર ઉત્તરીશ.” એ પ્રમાણે આત્મચિતવન કરતો ગુણુસાગર જાતિસ્મરણજ્ઞાન વડે પૂર્વના ભવોને સંભારતો ને ચારિત્રની આરાધનાનું સમરણ કરતો ધર્મધ્યાનમાંથી શુક્લ ધ્યાને બડયો. એ શુક્લધ્યાન આર્દ્ધ થયેલા ગુણુસાગર ક્ષાપકશ્રેણિએ ચઢી અનુકૂમે ત્યાંજ કેવલજ્ઞાન પામ્યા. મોહના મંહિરમાંજ તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું.

દાંત અને શાંતરસમાં નિમગ્ન ગુણુસાગરને-પોતાના સ્વામીને નિશ્ચલ-સ્થિર દાખિલાળા જોઈ લજણથી અવનત મસ્તકવાળી એ સર્વે નવોદા વિચારમાં પડી. “ગુહસ્થ અને મોહના મંહિરમાં રહેવા છતાં આ અમારા સ્વામીને ધન્ય છે કે જેએસા શાંતરસમાંજ માત્ર લીન છે, પાપકર્મના નિધાન સમાન અમારે વિષે એમને જરા પણ રાગ નથી. આવા મુક્તિવધુની વરમાલ અહેણ કરનારા અમારા સ્વામીને ધન્ય છે ને આવા સ્વામીની વધુ કહેવડાવવા માટે અમનેય ધન્ય છે કે જેથી એમે પણ તેમની પાસે દીક્ષા અહેણ કરી પરમપદને પામશું.

ધર્મધ્યાનમાં શુલ ભાવનાર્દ્ધ થયેદી આડે કન્યાએ પણ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાને આર્દ્ધ થાડુ ક્ષાપકશ્રેણિએ ચઢી ચાર ઘનવાતી કર્મનો નાશ કરી કેવલજ્ઞાનને પામી. કારણ કે સાચી સ્ત્રીએ તો એજ કે જે પતિના માર્ગને અનુસરે.

તે સમયે આકાશમંડળમાં નૃત્ય કરતા હેવતાએ હેવ-

હુંહલિ વગાડવા લાગ્યા, સુગંધિત જલની એના મર્કાન  
આગળ વૃષ્ટિ કરવા લાગ્યા, પંચવર્ષી યુક્ત પુણ્યના હંગ  
આંગણામાં પડવા લાગ્યા, હેઠી ઘ્યમાન હુંહલોવાળા હેવોથી  
ગુણસાગરનું ભવન આચ્છાહિત જોઈ નગરીના લોકો  
આશ્ર્ય પામતા હતા બોલવા લાગ્યા, “અહો ! અહો !  
ગુણસાગરના વિવાહમાં તો એના પુણ્યથી આકર્ષણીલા  
હેવતાએ પણ વર્ધાપન મહોત્સવમાં ભાગ લેવા આવ્યા  
ને શું ?

જ્યારે હેવતાએ એના ભવન ઉપર આકાશમંડળમાં  
રહીને નૃત્ય કરતા ને હેવહુંહલિ વગાડતા શું ચિંતવતા  
હતા ? બોલતા હતા કે “અહો ! આશ્ર્ય ! આશ્ર્ય !  
મોહના રાજ્યમાં રહેલા આ આત્માએ મોહેરી મહો-  
મહુનો નાશ કરી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ કરી.” તે  
પછી હેવતાએ તેમની સમક્ષ પ્રગટ થઈ-હાજર થઈ  
સાંધુનો વેપ આપ્યો, સાંધુ વેપધારી તેમને નમસ્કાર કરી  
હેવતાએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો.

આ વૃત્તાંત જોઈ-જાણો ગુણસાગરનાં માતાપિતાને  
પણ ધર્મધ્યાનની ભાવના આવતાં ધર્મધ્યાનથી વધતાં  
વધતાં શુક્લધ્યાન પ્રગટ થયું ને કર્મનો નાશ થતાં તેમને  
પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.

આ બધા વૃત્તાંતની રાજને ખખર પડતાં શ્રીશેખર  
રાજ આશ્ર્ય પામતો ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક  
કેવલજ્ઞાનીને નમસ્કાર કરી તેમની આગળ હાથ જોડી એડો.

તે સમયે હે હેવ ! હે પુણ્યીચંદ્ર નરેશ ! હું તમારા  
નગર તરફ આવવાની તૈયારી કરી રહેલો વાહન, નૃત્ય  
વગેરે રવાને કરી નિકળવાની તૈયારીમાં હતો તે દરમિયાન  
આ વૃત્તાંત જાણવાથી આશ્ર્ય પામેલો હું ત્યાં ગયો.

તેમને વાંદીને તર્ક વિતર્ક કરતો હું તેમની આગળ એડો. “શું આમને કેવલજ્ઞાન થયું હશે? જ્ઞાની જાણે, સત્ય શું હશે?”

મારા મનના વિતર્કનો જવાબ આપતા હોય તેમ તુરતજ ગુણુસાગર કેવલી એલ્યા. “હે સૌભ્ય! હે સુધન! તું સ્વયં અયોધ્યા તરફ જવાની તૈયારીમાં હતો પણ. કૌતુક જોવા માટે અહીં આવ્યો છે. સાર્થ હૂર જવાથી હવે તું અહીં આવ્યા પણી એસવા કે જવાને શક્તિવાન નથી. પણ હે સુધન! આમાં શું આશ્ર્ય છે! આ થડી વધારે આશ્ર્ય તો તું અયોધ્યામાં-રાજસભામાં જોઈશ.”

કેવલજ્ઞાનીનાં એ વચ્ચે શ્વરૂપ કરી હું પામેલો હું. તાંથી શીધગતિએ અહીંયાં આવી હે હેવ! આપની સમક્ષ હાજર થયો છું. “સુધનશ્રેષ્ઠિએ એ રીતે પોતાની આશ્ર્ય વાર્તા-ગુણુસાગરની કથા પૂર્ણ કરી.

## ૮

## પૃથ્વીચંદ્ર રાજને કેવલજ્ઞાન થાય છે

એકવીશ ભવના સાથી ગુણુસાગરનું વૃત્તાંત સાંભળી રાજસભામાં સિંહાસનારૂપ રાજ પૃથ્વીચંદ્ર અજખ વિચારમાં પડી ગયા. એમની વિચાર એણિ પલયાધ ગાઠ. નિસ્તખ્ય થધ શુલ ભાવનારૂપ થધ ગયા, એજ ઘરા મહા મુનિ એજ સત્ય મહાત્મા ગુણુસાગર છે કે જેમણે મોહને લૃતી પોતાનું કાર્ય સાધી લીધું છે. નિરીહ એવા મહાત્મા પુરુષોને ગમે તેવી મહાન ભોગ સામગ્રી પણ ધર્મમાં અંતરાય કરી શકતી નથી. જેથી તેએ ભવસાગર પાર તરી ગયા અને હું?

હું તો ભાણુતાં છતાં પણ માતા પિતાની દાક્ષિણ્ય-

તાથી વિકટ એવા રાજ્યરૂપ થત્તના ચક્રમાં પડી ગયો.  
હા ! તે હિંસ કયારે આવશે. કે ગુણોએ ગરિષ્ઠ એવા  
સુનિજ્જનોનાં દર્શન કરી તેમના ચરણે નમીશ, ગુરુની  
લક્ષ્ણ કરતાં રત્નત્રથીને ધારણ કરનારો હું કયારે થઈશ ?  
મારા શરીરરદ્ધી મકાનમાં ક્ષમારૂપ લક્ષ્ણી કયારે કીડા  
કરશે ? શૂન્ય ગુહમાં કે ખાડેમાં, સમશાનમાં કે પર્વતના  
અથ લાગ ઉપર, વનમાં કે સરિતાના તથ ઉપર સમતા  
રસને જીલતો ને ધ્યાનમાં એકાશ એવા કાઉસગા ધ્યાને  
સ્થિર ઉલ્લો હોઉ એવો હિંસ મારો કયારે આવશે ?”

શુલ ભાવના ભાવતા પૃથ્વીચંદ્ર રાજ સંવેગના  
રંગથી શોભતા અપૂર્વ કરણુથી ક્ષપક અણિએ આર્દ્ધ  
થયા. શિવ મંહિરમાં પહોંચવા માટે ત્યાંથી અતુક્રમે પગ-  
થીયાં ચઢવા લાગ્યા. અનક્રમે તે ક્ષીણ મોહનામા બારમા  
ગુણુસ્થાનકે પહોંચી ગયા. ત્યાં અંત સમયે શુકલધ્યાન-  
રદ્ધી અભિવડે ઘનથાતિ કર્મનો નાશ કરી નાખ્યો.

જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણ ચતુર્ક, અંતરાય  
પાંચ એરૂપ ચૌહ પ્રકૃતિ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી  
તેરમે ગુણ સ્થાનકે આવ્યા. રાજપૃથ્વીચંદ્ર કેવળજ્ઞાની  
પૃથ્વીચંદ્ર થયા.

તે સમયે સૌધર્મ ધંડે હૃવતાએ સાથે ત્યાં આવી  
સુનિવેપ અર્પણ કરી કેવળજ્ઞાનનો મેટો મહોત્સવ કર્યો.

સુવર્ણ કુમલ ઉપર બીરાજમાન પૃથ્વીચંદ્ર કેવળ  
જ્ઞાનીને ભસ્તક નમાવી નમસ્કારે કરતા ધંડ તેમના ચર-  
ણને સ્પર્શ કરતા લક્ષ્ણ વડે તેમની સુત્તિ કરવા લાગ્યા.  
“હે નિર્દોષી ! હે મોહને જીતનારા ! તમે જ્ય પામો !  
હે રાજ્ય રદ્ધિમાં નિસ્પૃહ વૃત્તિનાળા ! હે રોષનો ત્યાગ  
કરતારા ! હે દ્વાષ રહિત એવા તમે જ્યવંતા રહો ! સંસાર

સાગરમાં રહ્યા છતાં પાપડ્યી ધંકથી અલિમ એવા આપ  
જયવંતા વત્તો કે જેમનું ચારિત્ર લુચનને વિષે આશ્ર્ય  
કરેનારે છે.”

ધંદ એ પ્રમાણે સ્તુતિ કરી એ હાથ વડે કરસંપુટ  
કરી ભગવાન આગળ બેઠા તે સમયે હરિસિંહ રાજપણ  
પદ્માવતી દેવી સાથે ત્યાં આવ્યો તારે સુનિના વેષમાં,  
તેમજ કેવલજ્ઞાની એવા વિશ્વને આતંદ્કારી પોતાના  
નંદનને જોઈ ખુલ હર્ષથી નમસ્કાર કરી સ્તુતિ કરવા  
લાગ્યા. “કુલક્રમે કરી તમને રાજ્ય સ્થાપન કરી ધર્મને  
ચોઅય એવા અમો દીક્ષા લેવાને ચોઅય હતા. તે દીક્ષા તમે  
શી રીતે પામી ગયા ? અરે ! સંસારમાંથી નિકળવાને  
આતુર થયેલા તમને મોહથી મૂઢ થયેલા અમે જર્જરી  
ભૂત થયેલા રાજ્યપિંજરમાં નાખ્યા એ ભિથ્યા દુઃકૃત  
હો. ” રાજ કેવલીની સ્તુતિ કરતા ને પોતાની નિંદા  
કરતા હતા. તે દરમિયાન સ્વામીનું અદ્ભૂત ચરિત્ર જાણી  
પેલી સોણે નવોઠાએ ત્યાં આવી પહોંચી. પતિના ચસ્તિ-  
ગ્રથી વિસ્મય પામેલી તે કેવલીને નમસ્કાર કરી પદ્માવતી  
દેવીની પાછળ બેઠી. કેવલી ભગવાનની પ્રશાંત ઝુદાને  
વિલોક્તી એ સ્ત્રીઓની વિચાર એણિ ભાવીને ચોગે પલ-  
દાઇ ગાડ. ભવ ઉપર ઉદાસ થઇ ગયેલી તે ખાળાએ  
સંસારની અનિત્યતાનું સમરણ કરતી શુભ લાવનામાં આરૂ  
થઇને તરસજ કેવલજ્ઞાન પામી.

ધંદે તેમને સાંદ્રીનો વેષ આપી નમસ્કાર કર્યો.  
તેમની સ્તુતિ કરી. ધંદની પાછલ સકળ પરિવારે પણ  
નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી.

આ અધું જોઈ સુધન એણી વિચાર કરવા લાગ્યો.  
“આ આશ્ર્ય પણ કાંઈ જેવું તેનું નથી, ગુણસાગર

કેવલીએ કહું હતું તેમજ થાય છે. આહા ! કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જનારા ભવ્ય આત્માનો પરિવાર પણ કેવો હોય છે. પતિની પણવાડે પણનીએ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી એમના માગને અનુસરનારી હોય છે.” સુધન સાર્થવાહ પોતે મનમાંજ કેવલીની સ્તુતિ કરવા લાગ્યો. પોતાના નગર કરતાં પણ અધિક આશ્વર્ય જોઈ તાળુણ્ણ થઈ ગયો.

એકવીસ લવના સંબંધવાળા પૂર્ખીચંદ્ર રાજ અને ચુણસાગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ ગયા. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્મા તેજ લવમાં શેષ આશુષ્ણ કરી શિવમંહિરમાં ચાલ્યો જાય છે.

## ૬

### પૂર્ખીચંદ્ર કેવલીની હેશના

રાજ હરિસિંહના કથન બાદ પર્દાની આગળ પૂર્ખીચંદ્ર કેવલી ધર્મોપદેશ આપવા લાગ્યા. “હે ભવ્ય જનો ! સંસારની મોહમાયામાં સુંઝાઈ તમે પ્રમાદી થાઓ. નહિ. જે તમારે ભવસાગર તરી પાર થવું હોય તો સંયમદૂર્ઘી રથમાં આરદ્ધ થઈ જાઓ. કારણુકે જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોકાહિ નીર જેમાં અળલણી રહ્યાં છે, કષાયરૂપી તુચ્છ મત્સ્યો જ્યાં કુદાંકુદા કરી રહ્યા છે. રાગ અને દ્રેષ રૂપી ઉદ્રેગો જેમાં ઉભાળા મારી રહ્યા છે, એવા સંસારદૂરી સસુદ્ધમાંથી તરી પાર જવું હોય તો સંપૂર્ણ જ્ઞાનરૂપી નાવિકની સહાયથી ચારિત્રરૂપી વહાણુમાં આરદ્ધ થાઓ. તો તમે પાર પામશો. અન્યથા એ સસુદ્ધનો પાર પામી શકાશો નહિ.

એ ચારિત્ર મનુષ્યભવ સિવાય પ્રાપ્ત થઈ શકતુ-

નથી. ચોરાસી લાખ જવાયાનિમાં ચારિત્રને અતુકૂળ સામયી ભાવ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. માટે ધર્મને ચેચ્ય સામયી મનુષ્ય ભવમાં પ્રાપ્ત થવા છતાં કો પ્રમાણી અનીને હારી જશો. ધર્મ કરવાની ઉપેક્ષા કરશો-તે બનદના પુત્રોની માઝેક એવી તક તમને ફરી ભલાવી દુર્લભ થઈ પડશે.

તામ્રલિપ્તિ નામે નગરીમાં પ્રજા વત્સલ્લ ન્યાય નીતિનો જણું શ્રીકૃત્તિનામે રાજ હતો. તે પોતાની નગરીમાં અનેક ધનાધ્યોને જોઈ પ્રસન્ન થતો હતો. પ્રજા પણ આવા અમીમય દાખિલાળા રાજને જોઈ રાજ થતી હતી. નગરીના ધનાધ્ય જનો જેની પાસે કોઈ દવ્ય હોય તે પોતાના મકાન ઉપર ધ્વજ ચડાવે એવી રાજ આજા હોવાથી નગરમાં અનેકના મકાનો ઉપર ધ્વજાચો ફરકતી હતી તેમજ કોઈ કોઈના મકાનો ઉપર એક કરતાં પણ અધિક ધ્વજાચો જોવાતી હતી. એ ધ્વજાચો ઉપરથી એના દવ્યની સંખ્યા પણ મપાતી હતી. એવું એ શહેર સુખી અને આખાદીવાળું હતું.

એ નગરમાં ધનદ નામે મોટો શાહુકાર રહેતો હતો. ધનદ ધનવડે કુષેર લંડારી સમાન હોવા છતાં પોતાના મકાન પર ધ્વજ ધરકાવતો નહિ. જેની કીંમત થઈ શકે નહિ એવાં અનેક રતો એના લંડારમાં પડેલાં હતાં. તોપણ પોતાના મકાન પર ધ્વજ ફરકતી કરવાનું તેને મન થતું નહિ.

ત્યારે ધનદના પુત્રોના વિચારો જુદા હતા. પોતાના મકાન ઉપર ધ્વજ ફરકતી જોવાને તે ખુલ્લ આહુર હતા. પણ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન તેમનાથી ન થતું હોવાથી પોતાની દૃઢા તેઓ પાર પાડી શકતા નહિ.

ભીજ કેટી ધ્વજેની ઝેરકતી ધ્વજામોથી રાજ તેમનું ભાન સંભાન સારી રીતે કરતો હતો. ભાઈ-ચારણો એમનીઃ પિંડાવતી બોલી લોકમાં તેમનો ઉજાવત યક્ષ ઝેલાવતા હતા. નગરીના લોકો પણ એમનું બહુમાન સાચવતા હતા. કેટિ ધ્વજેનો એ પ્રમાણે સત્કાર થતો જોઈ માન બૂધ્યા ધનદના પુત્રોના મનમાં કંઈ કંઈ વિચારો થઈ આવતા હતા. પોતાના પિતાની મૂર્ખ્યતા ઉપર તેઓ ખૂબ ઉંચા નીચા થતા હતા. પણ પિતા આગળ કંઈ ચાલતું ન હોવાથી એક હિવસે તેમણે પૂછ્યું: “પિતાજ ! આપણી પાસે વિપુલ ધન સામગ્રી હોવા છતાં શા માટે ધ્વજ ઝેરકાવવા હેતા નથી ? ”

પુત્રોની વાણી સાંલળી પિતા બોલ્યો “હે પુત્રો ! આપણા ધનની સંખ્યા થઈ શકે તેમ નથી, કે એ કરો-તાની સંખ્યામાં છે કે અખજેની !

ને ગણુતરી કર્યા વગર ભૂષા બોલવું એ સજજન, પુરષેને યોગ્ય નથી. વળી ધર્મકાર્ય વગર બાબુ આડાં-ઘર કરવો એય સારું નથી લોકમાં કહેવત છે કે પોતાનો ગોળ પાતેજ કુલદીમાં ચોરી ભાવો.

એ પ્રમાણે પુત્રોને સમજાવવા છતાં પણ તેઓ કશ-અહથી વિરમ્યા નહિ. ને અવસરની રાહ જોતા તેઓ કાલક્ષેપ કરવા લાગ્યા. એ પછી કેટલોક સમય ચાલ્યો ગયો.

એક હિવસે વિવાહ કાર્યમાં સ્વજનોના આગ્રહથી ધનદ પુત્રોને સમજાવી બહાર ગામ ગયો. તારે પુત્રોએ અવસર પ્રાપ્ત થવાથી પિતાનાં જાંચય કરેલાં રહ્યો અંડારાં-માંથી કાઢી બજારમાં વેચી નાખ્યા. બહારગામના વ્યા-પારીઓ ખરીદી લઈ દ્વય આપી ચાલ્યા ગયા.

એ બહું દ્વય કેટિ સંખ્યામાં થવાથી પુત્રોએ સુવન-

ઝુંના દંડથી સુશોભિત ધવળ પોતાના મકાન ઉપર ઉલ્લી કરી. તે વારે બાંધીજનો એમની બિરહાવલી બોલવા લાગ્યા. ને લોકાવડે સતકાર કરતાં તે પુત્રો પરસ્પર કહેવા લાગ્યા. “આ ! આપણા પિતાની બુદ્ધિ વૃદ્ધાવસ્થામાં બહેર મારી ગઈ છે. આથલા સમય સુધી તેણે નાહક આપણું હશ્યા છે.”

ધનદ પણ પોતાનું કામ આદોપી પોતાના નગરમાં આવી પહોંચ્યો. પોતાને ઘેર આવ્યો ત્યારે પોતાના મકાન પર ધવળ જોઈ એ સંખાંધી વૃત્તાંત પુત્રોને પૂછવાથી પુત્રોએ સમસ્ત વાત કહી સંભળાવી.

પુત્રોની વાત સંભળી કોષથી ધમધમતો ધનદ પુત્રોને આફોશતો બોલ્યો. અરે કુલાંગારો ! કુપુત્રો ! કુદુદ્ધિ-વાળાઓ ! કુલક્ષણુવેતાઓ ! કુનક્ષત્રમાં જન્મેલાઓ ! તમે આ શું કર્યું ? બધાં રતનો વેચી તમે માત્ર આઠલુંજ દ્રવ્ય મેળવ્યું ? પણ આ કેટિ દ્રવ્ય કરતાં મારા એક રતનની ફિભત પણ વધારે હતી. મારાં બધાં રતનો તમે પાણીના ભૂલ્યે વેચી દીધાં. જાઓ, નિકળો મારા મકાનમાંથી, એ બધાં રતનો લધ આવો ન મળો તો મને તમારે સુખ પતાવશો નહિ. પછી તો પિતાએ તિરસ્કાર કરી પુત્રોને ધર-માંથી કાઢી સુક્યા.

પિતાનો તિરસ્કાર પામી ધરે બહાર નિકળેલા એ પુત્રો રતનાના બ્રહ્મણ કરનારા વ્યાપારીઓને શોધવા લાગ્યા પણ તેઓ પોતપોતાના નગરે ગયેલા હોયાથી તેમનો પતો મલ્યો. નહિ ને પૃથ્વી ઉપર બ્રહ્મણ કરી મહાદુઃખ પામ્યા. તો હે લધ્યો ! ધર્મને આરાધવાને મનુષ્ય લવમાં બધી સામની પ્રાપ્ત થવા છતાં ગુરુનો જોગ પામી જો સંયમની આરાધના કરશો નહિ તો પાપકર્મથી લેપાયેલા તમે એ ગુમાવેલી તક વારંવાર પ્રાપ્ત કરી શકશો નહિ.

એ પ્રમાણે કેવલજ્ઞાની જગતન પૃથ્વીયંડ રાજર્ષિની દેશના સાંલળી પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈએ સાંકુધર્મ તો કોઈએ આવકુધર્મ અંગીકાર કર્યો, તે વારે કેવલી જગતાનની માતા પદ્માવતી દેવી બોલ્યાં. “હે જગતન! અહોદ્વર્મના જાણકાર એવા અમારો તમારે વિષે આદ્યો અધ્યો સ્નેહ કેમ છે?

તેમના પ્રક્રિયાં જીવાયમાં કેવલી જગતાન બોલ્યા. પૂર્વ જવને વિષે આ મારા પિતા જીય નામે રાજ હતો, તમે પ્રિયમતી નામે માતા ને હું કુસુમાખુધ નામે તમારો પુત્ર હતો. ત્યાં સારી રીતે સંયમની આરાધના કરવાથી તમે વિજયનામે અનુત્તર વિમાનમાં હેવપણે ઉપ્ત્ર થયાં ને હું સંયમની આરાધના કરી સર્વાર્થસિક્ષ નામે મહા વિમાનમાં હેવ થયો.

એ વિજય વિમાનમાંથી ચ્યાવી તમે એજે અહૃત્યાં પણ પૂર્વના કેમ પ્રમાણે મારાં માતા પિતા થયાં. જેથી જીવાંતરનો તમારો સ્નેહ આ જવમાં પણ વૃદ્ધિ પામતો રહ્યો છે. કેવલીનાં વચનથી એમને જાતિસમરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે પોતાના પાછલા જવો જોયા ને વૈરાઘ્યની તીવ્ર જાવના જગત થઈ.

શુલ જાવના જગત થતાં એ રાજરાણીને પછી તો ત્યાંજ કેવલજ્ઞાન પ્રગટ થયું. જાક્ષિમાન એવા સુધર્મેદે એ કેવલજ્ઞાન નિર્મિતે મહોત્સવ કર્યો, ને પોતાની જાક્ષિ જતાવી. આ સમયે અયોધ્યા નગરીમાં મહા આનંદ આનંદ પ્રસરી રહ્યો એટલુંજ નહિ પણ અધા વિશ્વમાં આનંદ પ્રસરી રહ્યો, ડારણકે અધા વિશ્વને આશ્ર્વયમાં જરકાવ કરે તેવો એ પ્રસંગ હતો.

સુધન સાર્થકાણ કેવલી જગતાનને નભી બોલ્યો,

“હે ભગવન ! તમારામાં તેમજ ગુણુસાગર કેવલીમાં આઠલી બધી સરખાઈ કેમ જણાય છે ?”

એ સુધુનના પ્રતીક્રિયાએ પર્યાયાની આગળ શાંખરાજ અને કલાવતી રાણીના લવથી શરૂ કરી બતેને આ લવમાં કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યાં લગીનો તમામ વૃત્તાંત કહી સંભળાયેલો. એ એક-વીશે લવનો બતેનો સંબંધ સાંભળી પર્યાય તાજુથ થઈ ગઈ.

છેવટે ઉપસંહાર કરતાં કેવલી બોલ્યા. “હે સુધુન ! અમે બતે દરેક લવમાં લગલગ પુણ્યાનુભૂતીપુણ્ય સરખું જ મેળવતા હતા. જેથી અમે સરખી સુખ સંપત્તિ લોગવતા હતા. હે ઓછિન ! આસન સિંહ થનારા તત્ત્વ-વેદી જીવોનાં ભનવિષની મારુક વિષયોમાં રમતા નથી.

પૂર્વલવની આ મારી સ્ત્રીએ પણ સંયમની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉમ્મન થઈ ત્યાંથી આ લવમાં પણ મારી સ્ત્રીએ થમ. મારી પછવાડે તે પણ કેવલજ્ઞાનને પામી. જગતમાં પ્રાયઃ કરી સરખા ગુણવાળા પ્રાણીએમાં જ પ્રેમ ઉત્પત્ત થાય છે. રાજહંસની સ્ત્રી મરાલી કાગની સાથે કંઈ રમતી નથી.” એ પ્રમાણે કેવલજ્ઞાનીની વાણી સાંભળી સુવન પણ પ્રતિબોધ પામ્યો છતો ધર્મ પામ્યો. બીજા પણ અનેક લબ્ધ્યજનો ધર્મને પ્રાપ્ત કરી યથાશક્તિ ધર્મનું આરાધન કરવા લાગ્યા. એવી રીતે લબ્ધ્યજનોને ધર્મ પમાડી પૃથ્વીચંદ્ર કેવલી પરિવાર સાથે અચોધ્યાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.

અચોધ્યાની ખાલી પડેલી રાજ્યગાહી ઉપર સૌધ-મેંદ્રે હરિસિંહરાજના દ્વિતીય પુત્ર હરિષેણુનો રાજ્યાલિષેક કર્યો. તે પછી તે પોતાના સ્થાનકે ગયા.

૧૦

### માલગમન અને છેવટ.

તેરમા ગુણુસ્થાનકે રહેલ પૃથ્વીચંદ્ર રાજખિં અને ગુણુસાગર કેવલી પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્યજ્ઞનોને પ્રતિષ્ઠાધ કરતા ભવ્યજ્ઞનો પર ઉપકાર કરવા લાગ્યા. કેવલજ્ઞાન અને કેવલજર્ણનિથી લોકાલોકના સ્વરૂપને જણનારા એ ઘને મહાભુનિ હવે કૃતકૃત્ય થયા હતા. ને પૃથ્વીમંડળ ઉપર વિહાર કરી ભવ્યજ્ઞનો પર ખુખું ઉપકાર કરતા અનેક લ્યોને ભવસાગરથી દુખતા બચાવવામાં સહાયકારી થતા હતા.

ભવ્ય જ્ઞનો ઉપર ઉપકાર કરતા તેમનો નિર્વાણ સમય હવે નાલુક આવ્યો. જાણી મન, વચન અને કાયાના યોગોને રોધતા તેરમા ગુણુસ્થાનકને અંતે નામકર્મની ઓગણુનીસ ને વેહનીયની એક એમ ત્રીસ પ્રકૃતિનો. ઉદ્યમાંથી ક્ષય કરતા ને શુક્લધ્યાનના ત્રીજા પાદનું ધ્યાન કરતા એ ચૌદમે ગુણુસ્થાનકે આવ્યા. ચૌદમા ગુણુસ્થાનકનો કાલ પાંચ હસ્ત સ્વરત્નું ઉચ્ચારણ કરતા જેટલો કાલ જથ્ય તેટલો છે.

તેરમા ગુણુસ્થાનકે મન વચન ને કાયાના યોગોનો રોધ કરી શૈલેશીકરણ—ચૌદમા ગુણુસ્થાનકમાં પ્રવિષ્ટ થયા. એ ગુણુસ્થાનકના ઉપાંત્ય સમયે સત્તામાં રહેલી બહેલોતેર પ્રકૃતિનો ક્ષય કરી અંત સમયે શેષ રહેલી તેર પ્રકૃતિનો ક્ષય કરી નાખી તેમજ ઉદ્યમાં રહેલી પ્રકૃતિઓનો પણ ક્ષય થઇ જતાં એ મહાભુનિઓ શિવવદ્ધુના ભરથાર થયા. પોતપોતાનું આચુ પૂર્ણ કરી મુક્તિ પુરી ચાલ્યા ગયા.

અંતસમયે પોતાના આત્મપ્રદેશ વડે જેટલા આકાશ પ્રદેશ અવગાહા હોય તેટલા આકાશપ્રદેશની સમગ્રેણીઓ

અવગાહન કરતા માત્ર એકજ સમયમાં લોકાંત પર્યેત  
ચાલ્યા ગયા.

ધર્માસ્તિકાય આદિની સહાયતાથી આત્માની ગમ-  
નાગમનાદિ હિયા થઈ શકે છે. ને લોકાંત પર્યેત ધર્માસ્તિ-  
કાયાદિ હોવાથી ત્યાં જઈ અટકી જાય છે ખરન્તુ આગળ  
ધર્માસ્તિકાયાદિકનો અસાવ હોવાથી ત્યાંથી આત્મા આગળ  
જઈ શકતો નથી. કેમકે ચૌદ રાજલોક ધર્માસ્તિકાયાદિ  
ષડ દવ્યથી લરેલો છે, તે સિવાય અલોકમાં તો આકાશ  
સિવાય બીજુ કોઈ દવ્ય નથી. ચૌદ રાજલોકની આઙ્ગુ-  
ખાળુ અલોક અનંતો છે. એ અલોકનો પાર પામવાનેતો  
કોઈ સમર્થ નથી. જ્ઞાની પણ જ્ઞાનથી અલોકનો અંત  
હેઠી રાકતા નથી.

સંસારમાં જન્મ ભરણ કરતા આત્માને એક ગતિ-  
માંથી બીજી ગતિમાં જતાં અનેક સમય લાગે છે ત્યારે  
ઝુક્લિ જનારો આત્મા અનંત શક્તિનો ધર્થી હોવાથી એક  
સમયમાં જ લોકાંત પહોંચી જાય છે.

અનંતસુખનો ધર્થી-લોકાંત હોવાથી સર્વથા કર્મ  
રહિત થતાં જીવ સ્વાભાવિકરીતે જ ઉદ્વર્ગમન કરી  
લોકાંતે જઈ અટકી જાય છે. કુંભારના ચાકની માર્ક કે  
હિંડાલાની માર્ક અથવા તો ધનુધ્યથી છુટેલા આણની  
માર્ક પૂર્વ પ્રયોગ વડે જેમ તેમની ગતિકિયા થાય છે  
તેમજ કર્મથી મુક્ત થયેલા જીવની પણ એ સિદ્ધગતિમાં  
ગમનરૂપ હિયા થાય છે. જળમાં માટીના લારથી દ્વારેછું  
તુંખડ જેમ માટીથી મુક્ત થતાં નીચેથી ઉપર આવે છે  
તેમ કર્મરૂપ લેપથી રહિત થતાં જીવ પણ ઉદ્વર્ગતિ કરે  
છે કારણ કે જીવની સ્વાભાવિક ગતિ જ ઉદ્વર્દ્ધ રહેલી છે  
તેથી તેની ઉદ્વર્ગતિ થાય છે, અને લોકાંત જઈ અટકી  
જાય છે.

સામાન્ય રીતે જીવનું ઉત્પત્તિસ્થાન નિર્ગોદ છે. નિર્ગોદમાંથી નિકળેલો જીવ સંસારમાં ચારે ગતિઝપ લવસાગરમાં-ચૌરાસી લાખ જીવયોનિમાં લમ્બા કરે છે. મુક્તિમાં જતો નથો ત્યાંસુધી આ સંસારમાં એને સુખ-હુંઘનો અનુભવ કરતાં લમવાનું જ રહે છે. જ્યારે એ મુક્તિમાં જાય છે ત્યારથી એના ભ્રમણુનો અંત આવી જાય છે, એને સાહિ અનંત લાંગે મુક્તિમાં એની સ્થિતિ કાયમી થઈ જાય છે.

દેહથી રહિત હોવાથી આત્માને ત્યાં કર્મજન્ય સુખ હુંઘનો અનુભવ નથી. કે શરીરમાંથી નિકળી તે મુક્તિમાં ગયેલો હોય છે, તે શરીરના ત્રીજા લાગ જેટલી અવગાહના પ્રમાણ લોકાંતના આકાશપ્રહેણોને અવગાહનીને રહે છે. રોગ, શોક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ અથડાં કર્મજન્ય હોવાથી ત્યાં અશરીરી આત્માને એમાંનું કંધ પણ નથી. લુખ તેમજ રૂપા તેમને ધાર્યા કરતી નથી. શીત કે ગરમી તેમને પીડી શકતી નથી. વેહનીયકર્મનો ક્ષય થવાથી શરીરજન્ય શાતા અશાતા. મુક્તિમાં નથી કિંતુ આત્મિક સુખનો પાતે ભોક્તા હોય છે. કેવળજ્ઞાન એને કેવળજર્શનથી લોકાલોકના ત્રણે કાલના સ્વરૂપને ભાષુનારોને જોનારો આત્મા જ્ઞાનસુખ એને દર્શનના સુખોને અનુભવી રહ્યો છે. સુખ એ આત્માનો સહજ ગુણ હોવાથી જગતમાં અનુભવાતું ગમે તેનું સ્વરૂપ પણ સુક્ત આત્માને તો સુખરૂપે જ પરિષ્કારે છે એવા અવ્યાખાં એને અનંત-સુખનો ભોગી છે.

ચૌહ રાજલોક રૂપી પુરુષના લલાટસ્થાને સિદ્ધશિક્ષા છે. એ સિદ્ધક્ષેત્ર અઢીક્રીપના પ્રમાણ સરખું પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે. એટલે અઢીક્રીપના ગમે તે-

સ્થાનકથી આત્મા સમશ્રેષ્ટીએ સિદ્ધિગતિમાં જઈ શકે છે. ત્યાં ગયા પછી આ લોકમાં તેને પાણુ ક્રેવાપણું રહેતું નથી જેથી ત્યાં ગયા પછી ડાળના કાળ વહી જય તો પણ ત્યાં પોતાના અનંત સુખમાં રહે છે.

ભીસ્તાલીશ લાખ જોજનની સિદ્ધિગતિને ધ્યતપ્રાગું-ભારા પણ કહે છે. અર્જુન જાતિના સુવર્ણભાઈ ઉજાવળ વર્ણવાળી મધ્યમાં આડ જોજન જાડી અને તે પછી પાતળી થતી છેવટે માખીના પાંખ સમાન છેએ છે. એવી એ સ્વચ્છ, નિર્મળ, સુગંધમય, શાંખ જેવી સહેદ, ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધિગતિ ક્યા જ્ઞાનીના આકર્ષણે માટે થતી નથી?

જ્યાં ઉત્કૃષ્ટથી પાંખસેં ધનુષ્ય પ્રમાણુ શરીરવાળા તેમજ જઘન્યથી એ હાથ પ્રમાણવાળા જઈ શકે છે. ને પોતપોતાની અવગાહના ત્રીજા ભાગે ન્યૂન આકાશક્ષેત્રને અવગાહી લોકાંતે રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા છે છતાં એક બીજાને ત્યાં બ્યાક્ષેપ-અડિયણ થતી નથી, ને સુખઝૈપે રહે છે.

સર્વર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજથી આર જોજન હૂરે રહેલી સિદ્ધિગતિ-એ સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્માના સુખનો તે કંધ પાર !

લોકના અંતે રહેલા એ અનંત શક્તિસંપત્ત સિદ્ધ ભગવાન ત્યાં રહ્યા છતા કેવલજ્ઞાન અને કેવલર્દ્ધનથી ચૌહ રાજલોકનું નાથક જુએ છે ભુવનપતિ, વ્યન્તરે, જ્યોતિષીનાં પાર વિનાનાં સુષો, બારે દેવલોકના દેવતાઓનાં સુષો-નાથકો, નવ ગ્રૈવેયક અને અતુતર વિમાનમાં એ દ્વિષ્ય નાથારંગ તેમજ અનેક રાગરાગિણીપૂર્વક થતા મધુરા આલારોનાં સુષો લોકાંતે રહેલા તે જ્યો જાળી:

રહેલા છે. મતુષ્યદોડાનાં સુખો ચક્કનરી વાસુદેવાહિના નાટારંગ વગેરેનાં સુખો પણ સાત રાજ હૂર રહેલા સિદ્ધ ભગવાન જાહી રહ્યા છે, ભૂત, સવિષ્ય અને વર્તમાન પ્રણે કાળનાં સુખો કેવલજ્ઞાનથી જાહી રહ્યા છે કેવલ-દર્શનથી દેખી રહ્યા છે પરંતુ તેઓને તો વેહનીયકર્મનો ક્ષય થયેલો હોવાથી આત્મિક અનંત સુખનો અનંતકાળ પર્યંત અનુભવ હોય છે.

અનંતો કાળ જય તો પણ ત્યાંથી પાછુ સંસારમાં આવાગમન નહિ હોવાથી એમના એ સુખોનો કયારે પણ અંત આવતો નથી. જેથી સાહિ અનંત ભાગે તેમનું સુખ શાસ્ત્રમાં કહેલું છે. કર્મના ક્ષય થડી ઉત્પન્ન થયેલો ક્ષાયિકભાવ તેમજ પારિણામિકભાવ એ એ ભાવ સિદ્ધ-ભગવાનમાં રહેલા છે.

સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધને ઓળામાંઓછી એક હાથને આઠ વાંગળ જગ્યા જોઈએ છે અર્થાત મૈટલી જગ્યામાં તે સમાઇ શકે છે જ્યારે વધારેમાં વધારે ૩૩ ધતુષ્ય ૧ હાથ ને ૮ અંગુલ જેટલી જગ્યામાં પણ સિદ્ધનો જીવ સમાઇ શકે છે તે પાંચસે ધતુષ્યની અવગાહનાવાળા શરીરને આશીરીને સમજલું. એવી રીતે પીસ્તાલીસ લાખ જોજન લાંબી પહોળી સિદ્ધગતિમાં લોકાંતના છેલ્લા જોજનને અંતે ઉપર કહ્યા મુજબ અવગાહનાએ સિદ્ધ જીવો રહે છે એ સિદ્ધગતિમાં સિદ્ધના જીવો ખીચોખીચ-પણે ભરેલા છે ત્યાં એવો ખાદી આકાશ પ્રદેશ નથી કે જે ઠેકાણે સિદ્ધના જીવો ન હોય. એક ધીજામાં સંક્રમીને રહેવા છતાં તેમને જરાય ખાદી થતી નથી.

સંસારમાંથી જીવો કાયમ એ સિદ્ધગતિમાં ગમન કરી રહ્યા છે એમાં જે ઉત્કૃષ્ટ અંતર પડે તો છ માસનું.

એ અનંત સુખસાહિથી ભરેલા સિદ્ધક્ષેત્રનું વર્ણન  
પંડિતમાં પંડિત પણ કેટલું કરી શકે ! એનું વર્ણન એના  
સુખની વાનગી તો સર્વજ્ઞ જ્ઞાની જ બતાવી શકે. એવા  
અનત સુખ સાહિથીના પૃથ્વીચંદ્ર અને ગુણસાગર લોક્તા  
થયા. આત્માનું જે કાયમી સ્થાન તેના અધિક્ષાતા થયા.  
અનંત કાળચક વહી જય તો પણ એ સુખ એમનું સંપૂર્ણ  
થવાનું નથી ને ત્યાંથી પાછા ફરવાપણું પણ નથી.

યુગના યુગ જવા છતાં આજે પણ સુક્રિતમાં રહ્યા  
છતા એ જગતની લીલા જોઈ રહ્યા છે આપણે જ્યારે  
એમનું ચારિત્ર અવષ્ટુ કરી આપણા આત્માને નિર્મણ  
બનાવી એમના પગલે ચાલવાનો વિચાર કરી રહ્યા છીએ  
ત્યારે ત્યાં રહેલા એ આપણા મનોગત ભાવને જાણતા ને  
ચૌદ રાજલોકનું નાટક જોતા છતાં આત્મસુખમાં રમણુ  
કરી રહ્યા છે એવા તે અવસાગર પાર તરી ગયા છે. કૃત-  
કૃત્ય થયા છે. ત્યારે આ લાવસાગરમાં જન્મ મરણ કરેતા  
ને સંસારના આકર્ષણોમાં લોલાઈ રહેલા એવા આપણું  
શું ? એમની માર્ક આપણે પણ આ જન્મમરણનો અંત  
લાવવો કે નહિ ?

શંખરાજ અને કલાવતીના લઘમાં એ બજે  
આત્માએ આપણા સરખા આત્મા હોવા છતાં એમનામાંન  
ધર્મ ભાવના જમત થઈ. ગુરુના સમાગમે સમકિતિતવની  
પ્રાપ્તિ થતાં સત્યહેઠ, ગુરુ અને ધર્મની ઓળખ થતાં  
તેઓની દિશા કરી ગઈ, ને સુક્રિની ભાવના જમત થઈ.

પછી તો સંસારની ઇચ્છિ સિદ્ધિ કે રમણીએના  
લોગોમાં ન લોલાતાં એક સુક્રિની જ તમજા તેમનામાંન  
જમત હોવાથી અવસર પ્રાપ્ત થતાં રૂષની માર્ક લોગોને  
પણ તળ દ્વારા થારિતની આરાધના કરવા લાગ્યા. એ

રીતે ભયોભન સંયમનું આરાધન કરતાં એમનું ધર્મવૃક્ષ  
ખુબ ઝાલીકુલી વૃક્ષને પામણું. જેનાં ઇલ એકવીશમા  
લવમાં એમને પ્રગટ રીતે પ્રાપ્ત થયાં તે આપણે સારી  
ઘેડ જાણી ગયા.

એવી રીતે ધર્મવૃક્ષનું શરણ અંગીકાર કરવાથી એ  
તો તરી પાર થયા, પણ એમનું ચરિત્ર વાંચી આપણે  
એમને માર્ગ જવા તૈયારી કરીય તો હીક.

શુદ્ધ લવતુ ? ? ?



સ'પૂર્ણ'

## પૃથ્વીચંદ્ર અને ગુણુસાગરનું ત્રિદાલિયું

દાઢા

શાસન નાયક સુખ કરું, વંદી વીર ઉણાંદ,  
પૃથ્વીચંદ્ર મુનિ ગાધશું, ગુણુસાગર સુખકંદ; ૧  
ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ,  
વાત ઘણી વૈરાગ્યની, સાંભળજે મનરંગ; ૨  
શાખ કલાવતી લબથકી, લબ એકવીસ સંખાંખ,  
ઉત્તરોત્તર સુખ લોગવી, એકવીશમે ભવે સિદ્ધ; ૩  
પુણ એકવીશમા લબતણો, અદ્વય કહુ અધિકાર,  
સાંભળજે સન્સુખ થઈ, આતમને હિતકાર; ૪

દાઢા ૧ લી

(કંત તમાડુ પરિહરો—એ દેશા)

નથરી અધોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ ॥ મેરે  
લાલ ॥ પ્રિયા પદ્માવતી તેહને, સુખ વિલસે ગુણદ્રાષ્ટ  
॥ મેરેલાલ, ચતુર સ્નેહી સાંભળો ॥૨॥ એ આંકણી ॥  
સર્વારથથી સુર ચવી, તસ કુઝે અવતાર ॥ મેરે લાલ ॥  
૩૫ કળાગુણ આગળો, પૃથ્વીચંદ્ર કુમાર ॥૪૦ ચતુર૦ ॥૨॥  
સમ પરિણામી મુનિ સમો, નિરાગી નિરથાર ॥૪૦  
પિતા પરણાવે આગહે, કન્યા આઠે ઉદાર ॥૪૦ ચતુર૦ ॥૩॥  
ગીત વિલાપની સમગ્રણો, નાયક, કાય કલેશ ॥૪૦  
આભૂષણ તતુ લાર છે, લોગને રોગ ગણેશ ॥૪૦ ચતુર૦॥૪॥  
હું નિજ તાતને આગહે, સંકટ પરીચા જેમ ॥૪૦  
પુણ પ્રતિષ્ઠોધુ એ પ્રિયા, માતપિતા પણ એમ ॥૪૦ ચ૦ ૫  
જો સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર ॥૪૦  
એમ શુલ ધ્યાને ગુણનિલો, પહોંચો ભવન મોઝાર ॥૪૦ચ૦૬

નારી આઠને ઈમિ કહે, સાંભળો ગુણની ખાણ ॥૮૦  
 લોગવતાં સુખ લોગ છે, વિપાક કડવા જાણ ॥૮૦ ચ૦ ૭  
 કિપાક ઇલ અતિ મહુર છે, ખાયે છુંડે પ્રાણ ॥૮૦  
 તેમ વિષય સુખ જાણજો, એહુવી જુનતી વાણ મે૦ ચ૦ ૮  
 અમિ જે તૃપ્તિ દુધણે, નહીંએ જલધિ પૂરાય ॥૮૦  
 તો વિષય સુખ લોગથી, જીવ એ તૃપ્તો થાય મે૦ ચ૦ ૯  
 અવોભવ જમતાં જીવને, જેહ આરોગ્યાં ધાન ॥૮૦  
 તે સવિ એકઠાં જે કરે, તો સવિ ગિરિવર માન મે૦ ચ૦ ૧૦  
 વિષય સુખ પરલોકમ જગતીયાં ધ્રણલ્લવ મે૦  
 તોપણ તૃપ્તેજ નહિ થચો, કાળ અસંખ્ય અતીવ મે૦ ચ૦ ૧૧  
 ચતુરા સમજો સુંદરી, સુઓભત વિષયને કાજ ॥૮૦  
 સંસાર અદ્યી ઉતરી, લહીયે શિવપુર રાજ ॥૮૦ ચ૦ ૧૨  
 કુંવરની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ ॥૮૦  
 લધુકમી કહે સાહેખા, ઉપાય કહે ગુણખાણ ॥૮૦ ચ૦ ૧૩  
 કુમર કહે સંયમ અહેા, અદ્ભૂત એહ ઉપાય ॥૮૦  
 નારી કહે એમ વિસરજો, સંયમે વારે ન થાય મે૦ ચ૦ ૧૪  
 કુમર કહે પડખો તુમે, હમણાં નહી ગુર જોગ ॥૮૦  
 સદગુર જોગ સાધશું, સંયમ છાંડી લોગ ॥૮૦ ચ૦ ૧૫  
 માત પિતા મન ચિત્તવે, નારીને વશ નવિ થાય ॥૮૦  
 ઉલટી નારી વશ કરી, કુમરતું ગાયું જાય ॥૮૦ ચ૦ ૧૬  
 જે હું રાજ કીજુયે, તો ભળશો રાજ્યને કાજ ॥૮૦  
 નરપતિ ઈમિ મન ચિત્તવી, થાપે કુમારને રાજ ॥૮૦ ચ૦ ૧૭  
 પિતા ઉપરોધે આદરે, ચિત્તે મોહના ધાર ॥૮૦  
 પાળે રાજ્ય કૈરાગીયા, જેતો ગુરુની વાટ ॥ મે૦ ચ૦ ૧૮  
 રાજ્ય સલાયે અન્યદા, પૃથ્વીચંદ સોહંત ॥ મે૦  
 ધ્રણ અવસર વ્યવહારિયા, સુધન નામે આવંત ॥૮૦ ચ૦ ૧૯

રાજ પૂછે તેહને, કોણકોણ જોયા દેશ ॥ મે૦  
 આશ્વર્ય દીકુ જે તમે, ભાખો તેહ વિશેષ ॥ મે૦ ચ૦ ૨૦  
 શેઠ કહે સુષુ સાહિયા, એક વિનોદની વાત ॥ મે૦  
 સાંભળતાં સુખ ઉપજે, ભાજુ' તે અવદાત મે૦ ચ૦ ૨૧

( હાહરા )

કૌતુક બેતાં ખાદુ ગયો કાળ અનાહિ અનંત  
 પણ તે કૌતુક જગ વડ, સુષુતાં આતમ શાંત ॥ ૧ ॥  
 કૌતુક સુષુતાં જે હુવે, આતમનો ઉપકાર,  
 વક્તા શ્રોતા મન ગણખણે, કૌતુક તેહ ઉદાર ॥ ૨ ॥

॥ ટાળ ૨ ઙ ॥

( ગિરિ વૈતાદ્યની ઉપરે-સે દેશી. )

આવ્યા ગજપુર નથરથી, તિહાં વસે વ્યવહારીરે લો ॥  
 અહો તિહાં વસે વ્યવહારી રે લો ॥  
 રતનસંચય તસ નામ છે, સુમંગલા તસ નારિરે લો ॥  
 અહો સુમંગલાં ॥ ૧ ॥  
 ગુણુસાગર તસ નંદનો વિધા ગુણનો દરિયા રે લો ॥  
 અહો વિધાં ॥

ગાખે બેઠા અન્યદા, જુએ તે સુખ ભરિયારે લો ॥  
 અરે જુએ તે સુખં ॥ ૨ ॥  
 રાજપંથ સુનિ મલપતો, દીક્ષા સમ ભરિયારે લો ॥  
 અહો દીક્ષા સમં ॥

તે દેખી શુભ ચિંતવે, પુરવ ચરણ સાંભરિયારે લો ॥  
 અહો પૂરવં ॥ ૩ ॥

માત પિતાને એમ કહે, સુખીયા મુજ કીજેરેલો ॥ અ૦સું  
 સંયમ લેશું હું સહી, આજા મુજ દીજે રે લો ॥  
 અહો આજા ં ॥ ૪ ॥

માતપિતા કહે નાના, સંયમ ઉમાદ્વારે લો ॥ અ૦ ॥ સવા  
 તોપણુ પરણુ, પદમણી, અમ મન હરખાવોરે લો ॥  
 અહો ॥ અમ૦ ॥ ૫ ॥  
 સંયમ લેજો તે પછી, અંતરાય ન કરશુ રે લો ॥  
 અહો અંત૦ ॥  
 વિનયી વાત અંગીકરી, પછે સંયમ વરશુ રેલો ॥  
 અહો પછ૦ ॥ ૬ ॥  
 આડ કન્યાના તાતને, ધમ ભાએ વ્યવહારીરેલો ॥  
 અહો અમ૦ ॥  
 અમસુત પરણુવા માત્રથી, થારો સંયમ ખારીરેલો ॥  
 અહો થારો ॥ ૭ ॥  
 ધમ સુષ્ણીમન ચમકિયા, વર ભીજે કરશુ રે લો ॥ અહો વર૦ ॥  
 કન્યા કહે નિજ તાતને આ ભવ અવર ન વરશુ રે લો ॥  
 અહો આભ૦ ॥૮॥  
 જે કરશે એ શુષ્ણનિધિ, અમો તેહ આદરશુ રે લો ॥  
 અહો અમોં ॥  
 રાગ વૈરાગી દ્વારામે તસ આણા શિરે ધરશુ રે લો ॥  
 અહો તસ ॥૯॥  
 કન્યા આડના વચનથી, હરખ્યા તે વ્યવહારીરે લો ॥  
 અહો હરખ૦ ॥  
 વિવાહ મહોત્સવ માંડીયા, ધ્વલ ગાવે નારીરે લો ॥  
 અહો ધ્વલ૦ ॥ ૧૦ ॥  
 ગુણસાગર ગિરાયો હવે, વરથોડે વર સોહેરે લો ॥  
 અહો વર૦ ॥  
 ચારીમાંહે આવીયા, કન્યાનાં મન મોહેરે લો ॥  
 અહો કન્યા૦ ॥ ૧૧ ॥  
 હાથ મેદાવે હરખશુ, સાજન જન સહૃ મલીયારે લો ॥  
 અહો સાજન૦ ॥  
 હવે કુમર શુલ ચિંતમે, ધર્મધ્યાન સાંભરિયારે લો ॥  
 અહો ધર્મ૦ ॥ ૧૨ ॥

સંયમ લેઈ સુગુરુ કને, શુત ભાણશું સુખકારીરે લો ॥  
અહો શુત૦ ॥

સમતા રસમાં જીલશું, કામ કષાયને વારીરે લો ॥  
અહો કામ૦ ॥ ૧૩ ॥

દ્વાષ એતાદીશ ધાળશું, માયા લોલ નિવારીરે લો ॥  
અહો માયા૦ ॥

જીવિતમરણે સમપણું, સમ તુણુમણિગણશું રે લો ॥  
અહો સમ૦ ॥ ૧૪ ॥

સંજમ જોગ થિર થધ, મોહ રિપુને હણશું રે લો ॥  
અહો મોહ૦ ॥

ગુણુસાગર ગુણુશ્રેણીયે, થયા કેવલનાણીરે લો ॥  
અહો થયા૦ ॥ ૧૫ ॥

નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણીરેલો ॥  
અહી વરીય૦ ॥

અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથેરે લો ॥  
અહી નાથ૦ ॥ ૧૬ ॥

એમ આડે થધ કેવલી, કર પિયુલ હાથેરે લો ॥ અહો કરે૦  
અંધર ગાળે દુંદુલિ, જ્ય જ્ય રવ કરતારે લો ॥  
અહો જ્ય૦ ॥ ૧૭ ॥

સાધુ વેશ તે સુરવરા, સેવાને અનુસરતારે લો ॥  
અહો સેવા૦ ॥

ગુણુસાગર મુનિરાજના, માત પિતા તે હેખીને રે લો ॥  
અહો માત૦ ॥ ૧૮ ॥

શુલ સંવેગે કેવલી, ધાતી ચાર ઉવેખીરે લો ॥ અહોધાતી૦  
નરપતિ આવે વાંદવા, મન આશ્ર્ય આણી રે લો ॥  
અહો મન૦ ॥ ૧૯ ॥

શાંખ કલાવતી ભવ થકી, નિજ ચારિત્ર વખાણીરેલો ॥  
અહો નિજ૦ ॥

લવ એકવીશ સાંભળી, બુજીયા કોઈ પ્રાણીરેલો ॥  
અહો બુજીયાં ॥૨૦॥

મુધન કહે સુણો સાથથા, અવ આવ્યો ઉમાહીરેલો ॥  
અહો અત્રં ॥

પણ તે કૌતુક દેખવા, મનડા મુજ હરખાચોરે લો ॥  
અહો મનડાં ॥૨૧॥

કેવલજ્ઞાની સુજ કહે, શુ' કૌતુક ઉલ્લાસરે લો ॥  
અહો શુ' કૌતુક૦ ॥

એહથી અધીકૃ દેખશો, અચોધ્યા નામા આમેરે લો ॥  
અહો અચોધ્યાં ॥૨૨॥

તે સુણુ સુનિવયનથી, આવ્યો ધ્રુ ડામેરેલો ॥  
અહો આવ્યોં ॥૨૩॥

કૌતુક તુમ પ્રસાદથી, જોશુ' સુજશ કામીરે લો ॥અહો જોશુ॥

એમ કહી મુધન તિહાં, ઉલો શિરનામીરે લો ॥  
અહો ઉલોં ॥૨૪॥

( દાહરા )

પૃથ્વીચંદ તે સાંભળી વાધ્યો મન વૈરાગ,  
ધન ધન તે ગુણસાગર, પામ્યો લવ જળ તાગ ॥૧॥

હુ' નિજ તાતને દાક્ષિણ્ય, પડીયો રાજ મોઝાર  
પણ હું નિસરશુ' કહા, થાશુ કણ અણુગાર; ॥૨॥

॥૩॥

( પૂજય પથારો હો નગરી અમતણી-એ દેશી. )

ધન ધન જે સુનિવર ધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ સું  
રાજ ચિંતે સદગુર સેવના, કરશુ નિર્મણ બુદ્ધ ॥

ધન ધન જે સુનિવર ધ્યાને રમે ॥૩॥ એ આંકણી ॥

કણહુ સમ દમ સુભતિ સેવશું, ધરશું આતમ ધ્યાનસું  
ધમ ચિત્તવતા અપૂરવ ગુણ ચઢે, શ્રેષ્ઠિયે શુક્લધ્યાન સું  
ધ્યાન અણે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન

હર્ષ ક્રી સોહમપતિ આવીયા, વેશ વંદે બહુ ભાન મું  
સાંલળી માતપિતા મન સંભમે, આવ્યા પુત્રની પાસ મું  
એ શું એ શું એખીશરે બ્યાલતા, હરિસિંહ હર્ષ ઉલ્લઙ્ગસ  
દ્વિતા આડ સુષું મન હર્ષથી, ઉલટ અંગ ન માય મું  
સવેગ રંગ તરંગમેં જીતતી, આડ કેવલી થાય મું  
સારથ સુધન પણ મન ચિંતવે, કૈતુક અદલુત હીઠ મું  
નરપતિ પૂછે સુનિ ચરણે નમી, સ્નેહનું કારણજિંહ મું  
કેવલી કહે પૂરવસ્થ સાંલળો, નયરી ચંપા જ્યરાય મું  
સુંહરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સુત થાય મું  
સંયતિ સંયમ પાણી શુલમના, વિજય વિમાન તે જાય મું  
અનુત્તર સુખ વિલસી સુરતે ચચ્ચાં, થયાં તુમે રાણીને રાય  
કુસુમાયુધ પણ, સંયમ સુર ચર્વી, ચ્યો તુમ સુત તણે નેહ મું  
માતપિતા પર્ણ પૃથ્વીચંદ્રના, સુષું થયાં કેવલી તેહ મું  
સારથ પૂછે પૃથ્વીચંદ્રને, ગુણસાગર તુમે કેમ ॥ મુનિસરે  
સુનિ કહે પૂરવ ભવ અમ નંહનો, કુસુમકેતુ તસનામ મું  
એહી જ દીયિતા દોયને તે ભવે, સંયમ પાણી તે સાર મું  
મચદમે સવિ અનુત્તર ઉપન્યાસ, આ ભવ પણ થધ નાર મું  
સાંલળી સુધન આવકન્તત લીધે, બીજા પણ બહુ પ્રોધ મું  
પૃથ્વી વગેરે પૃથ્વીચંદ્રાલ, સાહિ અનંત થયા સિદ્ધ મું  
નિતનિત ઉઠી હું તસ વંહન કર, કેણે જગ જીચો રે મોહ  
ચડતે રંગે હો સમસુખ સાગર, કરતો શ્રેણી આરોહ મું  
નેગ ઉપકારી હો જગ હેતુ વન્ધલુ, હીઠ પરમ કલ્યાણ મું  
વિરહ મ પડશો હો એહવા મુનિતણે, ભવ લહુ નિર્વાણ મું  
મુનિવર ધ્યાને હો જન ઉતામ પદ વરે, ઇમ કણ ગુણગાન મું  
કીર્તિ કમળા હો વિમળા વિસ્તારે, જીવવિજય પરે ધ્યાન મું  
મુનિસર ધન ધન જે મુનિવર ધ્યાને રેંગ ॥ ૧૫ ॥ ધતિ.

॥ સુંપૂર્ણ ॥